

માધ્યમિક અભ્યાસક્રમ

૨૧૫ – ધંધાનો અભ્યાસ

ભાષાંતર સહયોજક
ડૉ. રાજેશ કુમાર

અભ્યાસક્રમ સહયોજક
ડૉ. પિયુષ પ્રસાદ



નેશનલ ઈન્સિટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ
(MHRD), ભારત સરકાર ડસ્ક (સ્વાયત્ત) સંસ્થા
અ – ૨૪ – ૨૫, ઈન્સિટિટ્યુશનલ વિસ્તાર, સેક્ટર – ૬૨, નોઈડા–૨૦૧૩૦૮ (યુ.પી.)
વેબ સાઇટ: www.nios.ac.in, ટોલ ફોન નં. ૧૮૦૦૧૦૮૮૮

© રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન

ઓગસ્ટ, ૨૦૧૨ (૧૮,૦૦૦ નકલો)

સેક્ટરી, રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન, એ-૨૪-૨૫, સંસ્થાનીય વિસ્તાર, અનંદેચ-૨૪, સેક.૬૨, નોઈડા-૨૦૧૩૦૬,
દારા પ્રકાશિત

સલાહકાર સમિતિ

ડૉ. એસ. એસ. જેના	ડૉ. કુલથીપ અગવાલ	શ્રીમતી ગોપા બિશ્વાસ	ડૉ. સોનિયા બેહલ
અધ્યક્ષ	નિયામક (શૈક્ષણિક)	સંયુક્ત નિયામક (શૈક્ષણિક)	મદદનીશ નિયામક (શૈક્ષણિક)
એન.આઈ.ઓ.એસ. નોઈડા	એન.આઈ.ઓ.એસ. નોઈડા	એન.આઈ.ઓ.એસ. નોઈડા	એન.આઈ.ઓ.એસ. નોઈડા

અભ્યાસક મ સમિતિ

પ્રો. પી. એલ. ચતુર્વેદી	શ્રી સી. કે. મિશ્રા	કુમારી મીના ગોઈલ	
અધ્યક્ષ	વાણિજ્ય રીડર (નિવૃત્ત)	ઉપ આચાર્ય	
ફોર્મર વાઈસ ચાન્સલર	સી. કે. ઉત્ત/જ. નીલંકંઠ	નવ હિન્દ સીની. માધ્ય. ગલ્સ સ્કૂલ	
૩/૩૦, જવાહર નગર,	વારણસી - ૨૨૧૦૦૧	ન્યૂ રોહિતક રોડ,	
જયપુર, રાજ્યસ્થાન - ૩૦૨૦૦૪		દિલ્હી - ૧૧૦૦૦૪	
પ્રો. પ્રમોદ કુમાર સાહુ	ડૉ. શીપ્રા વૈદ્ય	ડૉ. પી. એન. પાંડે	
પ્રોફેસર (નિવૃત્ત)	વાણિજ્યમાં લેક્ચરર	આચાર્ય (નિવૃત્ત)	
કો-ઓપરેટી કોલોની, ૧લી લાઈન	એન.સી.ઈ.આર.ટી, ન્યૂ દિલ્હી - ૧૧૦૦૧૬	૨૩/૪૭/૭૫ - સી. ક્રિડવાઈ નગર	
બહેરામપુર, ઓરિસ્સા - ૭૬૦૦૦૪		અલહાબાદ, ઉત્તર પ્રદેશ	
ડૉ. બી. એલ. શર્મા	શ્રી અદિતી રંજન રાઉટ	ડૉ. પિયુષ પ્રસાદ	
ચંદ્ર સંદન, સુદ્ધામાપુરી	નાય બ નિયામક ક્ષેત્રિય કેન્દ્ર	શૈક્ષણિક અધિકારી	
લેસ બહેરા,	કલકત્તા	એન.આઈ.ઓ.એસ. નોઈડા	
મથુરા, ઉત્તર પ્રદેશ - ૨૮૧૦૦૧			

વિષય દળ

પ્રો. પી. એલ. ચતુર્વેદી	ડૉ. આર્લિં ખાન	ડૉ. એ. કે. કાલા	પ્રો. પ્રમોદ કુમાર સાહુ
ફોર્મર વાઈસ ચાન્સલર	લેક્ચરર વાણિજ્ય	લેક્ચરર વાણિજ્ય	પ્રોફેસર (નિવૃત્ત)
૩/૩૦, જવાહર નગર,	શરીફ મેદોરીયલ સીની. માધ્ય. સ્કૂલ	એચ.એલ.જે. સીની. માધ્ય. સ્કૂલ	કો-ઓપરેટી કોલોની, ૧લી લાઈન
જયપુર, રાજ્યસ્થાન - ૩૦૨૦૦૪	બારા છિન્હ રાઉ, દિલ્હી	સદર બજાર, દિલ્હી	બહેરામપુર, ઓરિસ્સા - ૭૬૦૦૦૪
ડૉ. બી. પી. સરશ્વત	પ્રો. ઉદ્ય જૈન	શ્રી અદિતી રંજન રાઉટ	શ્રી સંજીવ કુમાર
વાણિજ્ય શાખાના પ્રમુખ	આચાર્ય (ઓફિસીએટીઝ)	નાય બ નિયામક ક્ષેત્રિય કેન્દ્ર	પી.જી.રી., રાજકીય, પ્રતિભા વિકાસ
એમ.ડી.એસ. યુનિવર્સિટી	શ્રી. વેણુ વાણિજ્ય કોલેજ	કલકત્તા	વિઘાલય, ગાંધીનગર,
અજમેર, રાજ્યસ્થાન	ઈન્ડોર, મધ્ય પ્રદેશ		દિલ્હી
ડૉ. સુનીલ ગુપ્તા	ડૉ. બી. પી. સાહુ	ડૉ. એ. કે. સિંહ	ડૉ. અજ્ય ગર્ગ
સહાયક પ્રોફેસર	મદદનીશ પ્રોફેસર	સહાયક પ્રોફેસર	પી.જી.ડી.એ.વી. ઈવનીગ કોલેજ
સોમસ, ઈંગ્નુ	ખાલસા કોલેજ, ડી.યુ.	શ્રી ભગત સિંહ કોલેજ, ડી.યુ.	દિલ્હી

સંપાદક

પ્રો. પી. કે. ઘોષ	ડૉ. તન્મય પાંડા	કુમારી શીવાંગી નાગરથ	શ્રી અદિતી રંજન રાઉટ
ફોર્મર વાઈસ ચાન્સલર	વાણિજ્ય રીડર	લેક્ચરર વાણિજ્ય	નાય બ નિયામક ક્ષેત્રિય કેન્દ્ર
૩૫, વેણુલી, પીતમપુરુ	ડૉ. બી.આર. આંબેડકર કોલેજ	સમર કિલ્ડ સ્કૂલ	કલકત્તા
દિલ્હી	દિલ્હી યુનિવર્સિટી દિલ્હી	કેલાસ કોલોની, ન્યૂ દિલ્હી	
ડૉ. આર. કે. ગુપ્તા	ડૉ. બી. પી. સાહુ	ડૉ. સુનીલ ગુપ્તા	શ્રી સંજીવ કુમાર
મદદનીશ પ્રોફેસર	મદદનીશ પ્રોફેસર	સહાયક પ્રોફેસર	પી.જી.રી., રાજકીય, પ્રતિભા વિકાસ
પી.જી.ડી.એ.વી. ઈવનીગ કોલેજ, ડી.યુ.	ખાલસા કોલેજ, ડી.યુ.	સોમસ, ઈંગ્નુ	વિઘાલય, ગાંધીનગર,
દિલ્હી		દિલ્હી	દિલ્હી
શ્રી સી. એસ. સવિતા	ડૉ. કી. કે. પાંડે	ડૉ. અજ્ય ગર્ગ	ડૉ. આનંદ શર્મા
સહાયક પ્રોફેસર (નિવૃત્ત)	સહાયક પ્રોફેસર	પી.જી.ડી.એ.વી. ઈવનીગ કોલેજ	સહાયક પ્રોફેસર
શ્યામલાલ કોલેજ, ડી.યુ.	ડૉ. બી.આર. આંબેડકર કોલેજ, ડી.યુ.	દિલ્હી	મધ્ય હરિયાણા યુનિવર્સિટી
દિલ્હી	દિલ્હી		હરિયાણા

ગ્રાફિક્સ, કવર ડિઝાઇન અને રીટીપી

શ્રી મહેશ શર્મા	એમ. કે. કોમ્પ્યુટર્સ		
ગ્રાફિક્સ આર્ટિસ્ટ	દુકાન નં. ૧૮, રીટીપી માર્કેટ,		
એન.આઈ.ઓ.એસ., ન્યૂ દિલ્હી	બેરા ઈન્ક્વિલ, પાંચમ વિલાર,		
	ન્યૂ દિલ્હી - ૧૧૦૦૮૦		

અધ્યક્ષાશ્રીનો સંદેશ

પ્રિય વિદ્યાર્થી,

સમાજની સામાન્ય જરૂરિયાત અને કેટલાક સમૂહોની ખાસ જરૂરિયાત, બદલાતા જતા સમય સાથે તાવીમ આપવાની પદ્ધતિ અને ટેકનિકની અપેક્ષાઓ પૂરી કરવા માટે તે મુજબના ફેરફાર લાવવા જરૂરી છે. શિક્ષણએ પરિવર્તનનું માધ્યમ છે. યોગ્ય પ્રકારનું શિક્ષણ યોગ્ય સમયે મળે તો, સમાજમાં સકારાત્મકતા, વર્તનમાં પરિવર્તન, નવા પડકારોનો સમનો કરવાની ક્ષમતા અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની હિસ્સત વિદ્યાર્થીઓમાં કેળવાય છે. અભ્યાસક્રમોમાં સમયાંતરે નિયમિત રીતે સુધારા કરવાથી આ હેતુ અસરકારક રીતે પ્રાપ્ત કરી શકાય છે. એક જેવા સ્થિર અભ્યાસક્રમથી કોઈ હેતુ સરતો નથી, કારણ કે તે વ્યક્તિની તેમજ સમાજની આવશ્યકતાઓ અને અપેક્ષાઓને સંતોષી શકૃતું નથી.

ફક્ત આ હેતુથી શિક્ષણશાસ્ત્રીઓ યોગ્ય સમયાંતરે સમગ્ર દેશમાંથી એકત્ર થઈ, અભ્યાસક્રમમાં ફેરફારની જરૂરિયાત માટે ચર્ચા કરે છે. આવી ચર્ચાઓના પરિણામરૂપે, વી નેશનલ કરિક્યુલમ ફેમવર્ક (ઓનસીએફ ૨૦૦૫) તૈયાર થયેલ છે. જેમાં ઈચ્છનીય/આવશ્યક શિક્ષણનો પ્રકાર જે પ્રાથમિક, પ્રાર્થમિક, માધ્યમિક અથવા ઉચ્ચ માધ્યમિક કક્ષાનો હોઈ શકે છે.

આ માળખાને ધ્યાનમાં રાખીને તેમજ રાષ્ટ્રીય તેમજ સામાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અને હાલમાં બધા વિષયના, માધ્યમિક સરના અભ્યાસક્રમોમાં સુધારા કર્યા છે, જેથી તે વર્તમાન સમયને અનુરૂપ અને જરૂરિયાત આધારિત બને. શૈક્ષણિક પુસ્તકો તૈયાર કરવાની કામગીરી NIOS કાર્યક્રમો જે મુક્ત અને ડિસ્ટન્ટ શિક્ષણ પદ્ધતિ દ્વારા પાઠ્યપુસ્તકો પુરા પાડે છે તે તેનું જરૂરી અને આંતરિક કાર્ય છે. આથી અમે અભ્યાસ સામગ્રીને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રસપ્રદ અને આકર્ષક બનાવીએ છીએ.

હું આ અભ્યાસ સામગ્રીને સરપ્રદ અને તમારી આવશ્યકતાને અનુરૂપ બનાવવામાં આ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓઓ આપેલ યોગદાન બદલ તેમનો આભાર માનું છું. મને આશા છે કે આ અભ્યાસક્રમ તમારા મનને આત્મસાત્ત્વ કરનાર અને આકર્ષક લાગશે.

NIOS વતીથી હું તમારા જળહળતા અને સફળ ભવિષ્યની કામના કરું છે.

સહી/—

ડૉ. એસ. એસ. જેના

અધ્યક્ષ

નિયામક શ્રીનો સંદેશ

પ્રિય વિદ્યાર્થી,

NIOSનો શૈક્ષણિક વિભાગ અવારનવાર નવા અને તમારી જરૂરિયાત/આવશ્યકતાને અનુરૂપ અભ્યાસક્રમ આપવાનો પ્રયત્ન કરે છે. માધ્યમિક સતરે અમે બધાં જ અભ્યાસક્રમોમાં સુધારો કરી રહ્યા છીએ. આ અભ્યાસક્રમો એવી રીતે તૈયાર કરવામાં આવે છે, જે દેશના અન્ય બોર્ડની સમકક્ષ હોય. અમે સીબીસી અને કેટલાક રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ વિષયોના અભ્યાસક્રમોનો અભ્યાસ કર્યો છે. નેશનલ કરિક્યુલમ ફેમવર્ક (અનસીઅફ) જે નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, તેને સંદર્ભ તરીકે રાખવામાં આવેલ છે. ઘનિષ્ઠ તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જે વહેવારું, જીવનની પરિસ્થિતિને સંબંધિત, સાહું અને સરળ છે. દેશના આગળ પડતા શિક્ષણ નિષ્ણાંતોના માર્ગદર્શનથી અમે આ અભ્યાસક્રમને સુધારીને અધતન બનાવી શક્યા છીએ.

એજ રીતે અને અભ્યાસની સામગ્રી માટે પણ વિચાર્યુ છે. અમે જૂની કાઢી નાંખવા જેવી માહિતી દૂર કરી છે અને નવી ઉમેરી છે, જે આધુનિક સમય સાથે અનુરૂપ હોય અને તેને તમારા માટે આકર્ષક અને રસપ્રદ બની શકે.

મને આશા છે કે તમને આ નવી સામગ્રી રસપ્રદ અને ઉત્સાહજનક લાગશે. ભવિષ્યમાં તેમાં સુધાર કરવા માટેના આપના સ્વીકાર્ય છે.

હું આપ સહૃદાના સફળ અને આંનદમય ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.

સહી/—

ડૉ. કુલદીપ અગ્રવાલ

નિયામક (શૈક્ષણિક)

આપની સાથે કેટલીક વાતો

પ્રિય વિદ્યાર્થી,

અમને એ જાણીને ખુબ આનંદ થાય છે કે માધ્યમિક અભ્યાસમના સ્તરે તમે વાતિજ્ય વ્યવસ્થાને એક વિષય તરીકે પસંદ કર્યો છે. આ પાઠ્યપુસ્તક દ્વારા આપનું સ્વાગત કરવામાં આવે છે.

તમે જાણો છો કે આધ્યક વ્યવહારો તમારા રોજ બરોજના જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને સ્પર્શો છે. આપણી ચારે બાજુ ચાલતી વાણિજ્ય પ્રવૃત્તિઓ આપણા જીવનમાં ખુબ પ્રભાવીત કરે છે. આ બાબતમાં અમારો પ્રયત્ન વિદ્યાર્થીઓને વાણિજ્યનો અધ્યયન, વાણિજ્યનું સ્વરૂપ અને તેના બદલાતા જતા નવા સ્વરૂપની જાણકારી વિકસાવવી છે. આ પાઠ્યપુસ્તકમાં વાણિજ્યની પ્રવૃત્તિના પ્રકાર, તેની ભૂમિકા, જુદા જુદા પ્રકારની વાણિજ્ય સેવાઓ, ઉત્પાદિત વસ્તુઓનું વિતરણ (વેચાણ) તથા ગ્રાહક જાગૃતતાની જાણકારી આપવામાં આવી છે. આનાથી આપણને એ પણ જ્ઞાનનો અનુભવ થશે કે વાણિજ્યનો અભ્યાસ તમારી કારકીર્દી બનાવવામાં કંઈ રીતે મદદરૂપ થઈ શકે છે.

આ અભ્યાસક્રમમાં (પાઠ્યપુસ્તકમાં) સાત મુખ્ય બિન્દુ છે. વાણિજ્યનો પરિચય, વાણિજ્ય વ્યવસ્થાના પ્રકાર, વાણિજ્યક સેવાઓ, વેચાણ-વિતરણ, ગ્રાહક સુરક્ષા-જાગૃતતા, જીવનમાં વાણિજ્યની ઉપયોગિતા અને પ્રોજેક્ટ રિપોર્ટ-કાર્ય. આ વિષયના દરેક પાઠ તૈયાર કરવાના સમયે સ્વ-અધ્યયન કરતા વિદ્યાર્થીઓનું સ્તર અને આવશ્યકતા ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જેમ કે મુક્ત તથા સ્કૂલથી દુર તમે માત્ર પાઠ્યપુસ્તકને આધારે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. વિષય વસ્તુ સરળ ભાષામાં લખવામાં આવ્યા છે. તેમજ યોગ્ય ચિત્ર – આકૃતિ કે આંકડાકિય માહિતી થી ઘેયપૂર્ણ કરેલ છે. જે માત્ર એક નજરથી સમજી શકાય છે. આ પાઠ્યપુસ્તકના પ્રકરણને અંતે પાઠગત પ્રશ્નો આપેલા છે. જેમાં સામાન્યતા: ટુંકા પ્રશ્નો, સાચા-ખોટા વિષયનો, જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, બહુવિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો વગેરે સંદર્ભક પ્રશ્નો છે. આનાથી આપને એ જાણવાની મદદ મળશે કે આપ દરેક વિભાગનો અભ્યાસ કર્યા બાદ તમે કેટલું સમજી શક્યા છો. આ પ્રશ્નોના ઉત્તરો પાઠના અંતે આપવામાં આવેલા છે. જો તમે આ પ્રશ્નોના ઉત્તરો જવાબ આપવામાં યોગ્ય થઈ ગયા હોય તો જ આગળના પાઠનો અભ્યાસ શરૂ કરો. નહીં તો આ જ પાઠનું પુનરાવર્તન આગળ ચાલુ રાખો.

મને આશા છે કે આ અભ્યાસક્રમ તમને ખુબ પસંદ અને રસપ્રદ રહેશે. તમારા જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં પણ ઉપયોગી બની શકશે. ટુંકમાં બધા જ પાઠીનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો અનેપરીક્ષા માટે તૈયારી કરો.

આખરે તો તમને રોજગારી મેળવવી કે સ્વરોજગારી સ્થાપવી જ પડશે. તમારી સફળતા એ બાબત પર નિર્ણયાત્મક બને છે કે તમે કેટલી ગંભીરતાથી આ વિષયમાં નિપૂણતા મેળવો છો. છેલ્લા પ્રકરણોમાં એ વિષય પર ભાર મુક્તવામાં આવ્યો છે કે તમને સૌખ્યવામાં આવેલું કાર્ય તમે કેટલી નિષાળ્યક કરો છો અને તમારો વિકાસ થઈ શકે એ અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રોજેક્ટ રિપોર્ટનું કાર્ય તમારામાં રહેલી કાર્ય કુશળતાનો વિકાસ થાય, વાણિજ્ય અધ્યયનના વિવિધ પાસાઓ ખુબ સારી રીતે સમજી શકો અને સાથે સાથે તમારા જીવનમાં પણ તે અર્થપૂર્ણ બને તેવો અનુભવ થાય.

તમારી પરીક્ષામાં વાણિજ્ય વિષયનું પ્રશ્નપત્ર ૧૦૦ ગુણનું હશે. તમારા અભ્યાસ માટે આ પુસ્તકની છેલ્લા ભાગમાં નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વિસ્તારથી ગુણોનું (માકર્સ)નું વિભાજન સમજાવવામાં આવ્યું છે. જેનાથી તમને એ જાણવાની મદદ મળશે કે તમારા પ્રશ્નના ઉત્તરથી તમને કેટલા ગુણ મળી શકશે. દરેક પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરો અને ગુણભાર યોજના સાથે મળેલા ગુણની તુલના કરો.

જો તમારા અભ્યાસક્રમ દરમિયાન તમને કોઈ પણ મુશ્કેલી પડે તો સંકોચ વીના મને અવશ્ય લખો.

અભ્યાસ માટે શુભ કામનોઓ!

હું તમારી સફળતા માટે શુભેચ્છા પાઠનું છું.

ડૉ. પિયુષ પ્રસાદ
શૈક્ષણિક અધિકારી

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થા

અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરશો?

અભિનંદન તમે સ્વ વાંચન કરવાની તર્ક સ્વીકારી. એન.ઓ.આઈ.એસ. પ્રત્યેક કદમે તમારી સાથે છે, અને તમને ધ્યાનમાં રાખીને મળોવિજાનની સામગ્રી નિષ્ણાત જૂથની મદદ લઈ તૈયાર કરવામાં આવી છે. સ્વવાંચનના માળખાને સ્વતંત્ર વાંચન સાથે અનુસરવામાં આવ્યું છે. તમે સુચનાઓનો અમલ કરીને આપેલ વાંચન સમગ્રીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. વાંચન સમગ્રીમાં આપેલ સંબંધિત ચિત્રો તમને માર્ગદર્શન આપશે.

સમાવિષ્ટ:—કુલ સમાવેશને વિભાગો અને પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે.



નોંધ:— દરેક પાનાની હાંસિયા (Margin) ની બાજુઓ ખાલી જગ્યા આપેલી છે. જેનો ઉપયોગ તમે અગત્યના મુદ્દા અથવા અગત્યની નોંધ લખવા માટે કરી શકશો.



ધ્યેય:— (હેતુ) આ પ્રકરણનો અભ્યાસ કર્યા પછી તમારી પાસેથી બહાર લાવવાના (out comes) અપેક્ષિત વિધાનોનો હેતુ છે. તમારી પાસેથી અપેક્ષા છે. તમે શોધી શકશો, તેમને વાંચો અને તમે મેળવ્યા હોય (શોધ્યા હોય) તો તપાસ કરો.



પુસ્તકના પ્રશ્નો:— દરેક વિભાગને અંતે સ્વતપાસના ટૂંકા જવાબવાળા પ્રશ્નો આપવામાં આવ્યા છે. પ્રકરણના અંતે જવાબો આપવામાં આવ્યા છે. આ તમારા વિકાસની તપાસમાં મદદ કરશે. તેમનો ઉકેલ (જવાબ) મેળવશે સફળતા પૂર્વકની પૂર્ણતા. તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે આગળ વધું અથવા ફરીથી વાંચન કરવું અને પાછા જવું.



તમે શું શીખ્યા? :— પ્રકરણના મુખ્ય મુદ્દાઓનો સારાંશ અહીં આપેલ છે તે તમને સાર જાણવામાં (ઉપસંહાર) અને પુનરાવર્તન કરવામાં મદદરૂપ થશે. તમે તમારા પોતાના નવા મુદ્દા ઉમેરો તે આવકાર્ય છે.



સત્રાંત પ્રશ્નો:— લાંબા અને ટૂંકા પ્રશ્નો છે કે જે તમને સમગ્ર ચર્ચાની (topic) સ્પષ્ટ સમજૂતીની તર્ક આપશે.



સ્વાધ્યાય આધારિત પ્રશ્નોના જવાબ :— તમે સ્વાધ્યાય આધારિત પ્રશ્નોના જવાબ તમે કેટલા સાચા આપ્યા છે. તે જાણવા માટે તમને આ મદદ કરશે.

અનુકૂળમણિકા

(પાઠ) પ્રકરણ નં.	શીર્ષક	પાના નં.
૧	ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર.....	૦૩
૨	ઉદ્યોગ અને વાણિજ્ય.....	૩૩
૩	એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને હિંદુ અવિભક્ત કુટુંબ.....	૪૬
૪	સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની.....	૫૨
૫	વાહન વ્યવહારની સેવાઓ.....	૮૦
૬	વખાર.....	૮૬
૭	માહિતી સંચારની સેવાઓ.....	૧૦૮
૮	ટપાલ અને ખેપિયાની (કુરિયર) સેવા.....	૧૨૨
૯	બેન્કની સેવાઓ.....	૧૪૮
૧૦	વીમાની સેવાઓ.....	૧૭૬
૧૧	(આઉટ સોર્સિં)	૧૯૦
૧૨	ખરીદી અને વેચાણ.....	૨૦૨
૧૩	વિતરણનો માર્ગ (channel).....	૨૧૬
૧૪	છૂટક વેપાર.....	૨૨૮
૧૫	જાહેરાત (વિશાપન).....	૨૬૦
૧૬	વેચાણ વૃધ્ઘ અને અંગત વેચાણ.....	૨૭૪
૧૭	ગ્રાહકોના હક્કો અને જવાબદારીઓ.....	૨૮૨
૧૮	ગ્રાહકનું રક્ષણ.....	૩૦૨
૧૯	કારકિર્દીની પસંદગી.....	૩૨૨
૨૦	સાહસિકતા.....	૩૩૨
૨૧	યોજનાનું કામ.....	૩૪૩
	અભ્યાસક્રમ.....	૧ – ૭
	નમૂનાનું પ્રશ્નપત્ર.....	૮ – ૧૨
	ગુજરાતી યોજના.....	૧૩ – ૧૮

મોડયુલ - ૧

મહત્વમાં

૧૨

અભ્યાસના કલાક

૨૫

વાણિજ્ય પ્રવૃત્તિની પૂર્વભૂમિકા

આપણે આર્થિક પર્યાવરણમાં જીવંત છીએ. આર્થિક પર્યાવરણ એ સમાજનું અવિભાજ્ય અંગ છે. બૃહદ્દ આર્થિક પ્રવૃત્તિના માળખાને કારણે આપણે આપણી વિવિધ જરૂરિયાતો જેવી કે વૈવિધ્ય સલભર ચીજ વસ્તુઓ અને સેવાઓ સંતોષી શકીએ છીએ. આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ કે કે જેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિશ્વના વાણિજ્યથી સજાગ બને, તેનું મહત્વ સમજી શકે, હેતુઓ જાણી શકે, વાણિજ્ય પ્રવૃત્તિના જુદા જુદા પ્રકારની સમજ મેળવી શકે અને આ ઉપરાંત નવ વિકસિત વિભાવતા જેવી કે ઈ-કોમર્સ અને ધંધાની સાથે જોડાયેલા વિવિધ સામાજિક પક્ષકારો પ્રત્યેની જવાબદારીઓ જાણી શકે.

પાઠ - ૧ : ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

પાઠ - ૨ : ઉદ્યોગ અને વાણિજ્ય

ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

જ્યારે આપણે આજુબાજુ નજર કરીએ છીએ ત્યારે મોટા ભાગના લોકો વિવિધ પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે. શિક્ષકો શાળામાં શીખવે છે, ખેડૂતો ખેતરમાં કામ કરે છે, કારીગરો કારખાનામાં કામ કરે છે. વાહનચાલક (ડ્રાઇવર) વાહન ચલાવે છે. દુકાનદાર વસ્તુ વેચે છે, ડોક્ટર દર્દીને તપાસે છે વગેરે. આ રીતે સમગ્ર વર્ષ દરમ્યાન લોકો દિવસ દરમ્યાન અને ક્યારેક રાત્રે વ્યવસ્થા હોય છે. હવે પ્રશ્ન આ છે કે, શા માટે આપણે આપણી જાતને વ્યસ્ત (પ્રવૃત્તિમય) રાખીએ છીએ? જવાબ છે, આપણી જરૂરિયાતોને સંતોષવા માટે. આમ કરીને કયાં તો આપણે અમૃત ઉપકારોમાંથી મુક્ત થઈએ છીએ. અથવા આપણે ઐસા કમાઈએ છીએ જેનાથી આપણે વસ્તુઓ ખરીદી શકીએ છીએ અને સેવા પ્રાપ્ત કરી શકીએ છીએ.

આથી, આપણે આ પાઠમાં વિવિધ પ્રવૃત્તિઓ કે જે આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણાને વ્યસ્ત રાખે છે તેના વિષે વધુ શીખીએ (પ્રવૃત્તિઓ). આપણે ધંધો એ માનવીય પ્રવૃત્તિ વિષે શીખીશું.



ધોય (હેતુ) (લક્ષ્યાંક)

આ પાઠનો અભ્યાસ કર્યા પછી તમે કરી શકશો.

- માનવીની પ્રવૃત્તિની વ્યાખ્યા
- આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત
- 'ધંધો' શબ્દની વ્યાખ્યા
- ધંધાની વિવિધ ખાસિયતો (લક્ષ્યાંક) ઓળખો
- ધંધાની સામાજિક જવાબદારી સમજાવો
- પ્રદૂષણના પ્રકાર, કારણો અને અસરો સમજાવો અને વાતાવરણનું પ્રદૂષણ ઘટાડવા માટે ધંધાની ભૂમિકા વિષે સમજાવો.

૧.૧ માનવીય પ્રવૃત્તિઓ

જે પ્રવૃત્તિઓ માનવી કરે છે તેને માનવીય પ્રવૃત્તિઓ કહે છે. આ પ્રવૃત્તિને આપણે બે જૂથમાં વહેચીશું.

૧. આર્થિક પ્રવૃત્તિઓ, ૨. બિન આર્થિક પ્રવૃત્તિઓ



માનવીના કાર્યો

૧. આર્થિક પ્રવૃત્તિઓ:-

જે પ્રવૃત્તિઓ નાણાં કમાવાના ઉદ્દેશથી કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. દાટ. ખેડૂત પાક વેચવા માટે ઉગાડે છે, કારખાનામાં અથવા ઓફિસમાં (કાર્યાલયમાં) નોકરિયાતો કામ કરે છે અને મજૂરી અથવા પગાર મેળવે છે. વેપારી (ધર્માકીય માનવી) વસ્તુના ખરીદ વેચાણ દ્વારા અથવા સેવાના વિતરણ દ્વારા નફો કમાય છે. આ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવર્તતિઓ કહે છે.

૨. બિન આર્થિક પ્રવૃત્તિઓ :

જે પ્રવૃત્તિઓ નફો કમાવવા માટે નહિ પરંતુ સંતોષ મેળવવા માટે કરાય છે તેને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. આ પ્રવૃત્તિઓ સામાજીક ઉપકાર દુર કરવા અથવા શારિરીક તંદુરસ્તી માટે અથવા આનંદ વગેરે માટે કરવામાં આવે છે. લોકો ભક્તિના સ્થળની મુલાકાત લે છે, પૂર અથવા ધરતીકુંપના અસરગ્રસ્તોને મદદ પૂરી પાડવી, રમતની પ્રવૃત્તિઓમાં, બાગકામમાં, રેડીઓ સાંભળવામાં અથવા ટી.વી. જોવામાં વ્યસ્ત રહેવું એ બિન આર્થિક પ્રવૃત્તિઓના દાખલા (ઉદાહરણ) છે.

આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત

આધાર	આર્થિક પ્રવૃત્તિ	બિન આર્થિક પ્રવૃત્તિ
૧. હેતુ	કમાણીનો ઉદ્દેશ	સામાજીક અને માનાસિક હેતુ
૨. પ્રાપ્તિ (લાભ)	સંપત્તિ અને મિલકતની વૃદ્ધિમાં અગ્રોસર	સંતોષ અને સુખ માટે અગ્રોસર
૩. અપેક્ષા	લોકો નફો અથવા નાણાની આવકની અપેક્ષા રાખે છે.	લોકો નફો અથવા નાણાની આવકની અપેક્ષા રાખતા નથી.
૪. કાળજીપૂર્વક વિચાર કરવો	તે વિવેકી કાળજીપુર્વક વિચાર કરવા પ્રેરાય છે કારણ કે તે આર્થિક અધિતવાળા સાધનોનો ઉપયોગ કરવામાં જોડાયા છે. જેવા કે જમીન, શ્રમ મૂડી વગેરે	આ લાગણીપ્રદ અને અતિ લાગણીવશ કારણથી અભિપ્રેરિત છે. કોઈ આર્થિક કારણ સંકળાયેલ નથી.



૧.૧ પુસ્તક આધારિત પ્રશ્નો

- અ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે સાચા વિધાનની સામે T અને ખોટા વિધાનની સામે F કરી જણાવો.
૧. ડોક્ટર દર્દી તરફ ધ્યાન આપવા માટે તેના / તેણીના દવાખાનામાં (રોકાયેલી) વ્યસ્ત રહે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
૨. માતા તેના બાળકોના કપડા સીવવામાં રોકાયેલી રહે તો તેની આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
૩. દરજી તેના ગ્રાહકોના કપડા સીવવામાં રોકાયેલો રહે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
૪. મંદિરની બહારના ભિક્ષુકોને ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવું તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
૫. સચિન તેનું લકર દેશ માટે છિક્કેટ રમે તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય.

- બ. નીચે જણાવેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ અને કઈ પ્રવૃત્તિ બિન આર્થિક છે તે જણાવો.
- અ. મિત્રો સાથે ફુટબોલ રમવો.
- બ. શાળામાં શીખવવું (ભણાવવું).
- ક. કોઈ સંબંધી માંદો હોય તો મળવા જવું.
- ઢ. રેઝિયો સાંભળવો.
- ફ. સ્થાનિક બજારમાં ફળ અને શાકભાજી વેચવા.
- ફ. કુટુંબના સભ્યો માટે ખોરાક તૈયાર કરવો.
- જ. કાર્યાલયમાં કામ કરવું.

૧.૨ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર

આપણે જાણીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિઓ ઐસા કમાવવા માટે કરાય છે. સામાન્યતઃ લોકો તેમની જાતને કાયમી ધોરણે આવી પ્રવૃત્તિમાં રોકાયેલા રાખે છે. અને તે વ્યવસાયમાં રોકાયેલા છે તેવું કહેવાય છે. વ્યવસાયને ત્રણ વિશાળ વિભાગમાં વર્ગીકૃત કરાય છે.

અ. ધંધો (Business):-

ધંધો એ એવો વ્યવસાય છે જેમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીને નાંસાની ચૂકવણી સામે વેચવામાં આવે છે. તે નિયમિત ધોરણે નકો કરવાના મુખ્ય ધ્યેય સાથે કરવામાં આવે છે.



ધંધો

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

મોડ્યુલ - ૧

વાણિજ્ય પ્રકૃતિની પૂર્વભૂમિકા



નોંધ

ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

(ચલાવવામાં આવે છે.) ખાણા, ઉત્પાદન, વ્યાપાર, હેરફર, સંગ્રહ કરવો, બેન્કીંગ અને વીમો તે ધંધાની પ્રવ તિઓના દાખલા છે.



વ્યવસાય

બ. વ્યવસાય (Profession):-

માનવી દરેક ક્ષેત્રમાં નિષ્ઠાત નથી હોતો તેથી આપણે જે જે એક યા બીજા ક્ષેત્રમાં નિષ્ઠાંત (તજ્જશ) હોય તેની સેવા લેવાની જરૂર પડે છે. દાખલા તરીકે આપણી સારવાર માટે આપણને ડોક્ટરની જરૂર પડે છે. કાયદાના ટેકા માટે વકીલની જરૂર પડે છે વગરે.

આ બધા વ્યવસાયમાં રોકાયેલા છે. આમ, વ્યવસાય એવા રોજગારને સાંકળે છે, કે જેને વિશિષ્ટ શાન અને તેને સમજવા માટે તાલીમની જરૂર પડે છે અને દરેક વ્યવસાયનો પ્રાથમિક હેતુ સેવા પૂરી પાડવાનો છે. વ્યવસાયી સંસ્થા દરેક વ્યવસાયનું નિયંત્રણ કરે છે. આ વ્યવસાયીઓને આચાર સંહિતા હોય છે કે જે સંબંધિત વ્યવસાયી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે.

ક. કામ (રોજગાર):-

કામ એ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેમાં વ્યક્તિ નિયમિત ધોરણે અન્ય માટે કામ કરે છે અને બદલામાં (વેતન) મજૂરી / પગાર મેળવે છે. સરકારી નોકરો, કંપનીના અમલદારો, બેંકના ઓફિસરનો (પદાધિકારી) કારખાનાના કામદારોને કામમાં છે તેમ કહેવાય. કામમાં કેટલાક નિયમો અને શરતો કામ કરવામાં, કામના કલાકોમાં (વેતન) મજૂરી / પગારની રકમમાં અને અન્ય સગવડોમાં હોય છે. સામાન્ય રીતે માલિક કે જે કામ (નોકરી) આપે છે તે આ શરતો નક્કી કરે છે. વ્યક્તિ કે જે નોકરી મેળવવા માંગે છે તે બધા નિયમો અને શરતોનું પાલન કરે પણી જ તે નોકરીમાં જોડાઈ શકે છે. નોકરિયાતને ચૂકવવામાં આવતુ મહેનતાણું નિચ ચત અને તે મજૂરી કે પગારના સ્વરૂપમાં ચૂકવાય છે.



રોજગાર

ધંધો, વ્યવસાય અને નોકરી વચ્ચે તફાવત :-

તફાવતનો આધાર	ધંધો	વ્યવસાય	નોકરી
૧. કામનું સ્વરૂપ	ગ્રાહકોને વસ્તુ કે સેવાનું વિતરણ નાણાં માટે	વિશિષ્ટ વ્યક્તિની એક ફી સાથેની સેવા મુનસ્ઝી વાળા કામ માટે	માલિકના હુકમ પ્રમાણે કોઈ મુનસ્ઝી વગર કામ કરવાનું

ધૂમાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

૨. લાયકાત	કોઈ લઘુતમ લાયકાતની જરૂર નથી.	ચોક્કસ ક્ષેત્રનું શાન અને તાલીમ જરૂરી	બધા સંજોગોમાં વિશિષ્ટ શાનની જરૂર નહિ.
૩. મૂડી	ધૂમાના સ્વરૂપ, કદ અને માપ પ્રમાણે મૂડી રોકાણ જરૂરી	સ્થાપના માટે મયા દિન મૂડીની જરૂર	મૂડીની જરૂર નથી.
૪. અભિપ્રેરણ (અમુક ઉદ્દેશથી કામ કરવા પ્રેરવું)	ગ્રાહકોને વસ્તુના વેચાણ અને સેવા પૂરી પાડીને નફો કમાવવો.	સેવાના વિતરણ સામે નિયત વ્યવસાયી ઝી.	નિશ્ચિત મજૂરી અથવા પગાર
૫. જોખમ	નુકસાનનું જોખમ છે. નફો અનિશ્ચિત છે.	નિશ્ચિત આવક, ફરજમાં બેદરકારી બદલ જવાબદાર	નિયમિત મજૂરી અથવા પગારમાં કોઈ જોખમ નહિ.
૬. આચાર સંહિતા	કોઈ ચોક્કસ આચારસંહિતા નથી.	વ્યવસાયના ઉચ્ચ ધોરણો જાળવવા જરૂર આચારસંહિતા વ્યવસાયમાં હોય છે.	કરારની શરતો અને નોકરીની શરતો હોય છે.

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની પૂર્વભૂમિકા



નોંધ



૧.૨ પુસ્તક આધારિત પ્રશ્નો

- અ. યોગ્ય શબ્દો મુકી ખાલી જગ્યા પુરો
૧. આર્થિક પ્રવૃત્તિ કે જેમાં કોઈ નિયમિત ધોરણો રોકાયેલો હોય તો તેને / તેણીને
.....
૨. વ્યવસાયીને જરૂર છે અને ચોક્કસ ક્ષેત્રમાં તાલીમ.
૩. રોજગાર કે જેમાં માણસ બીજાને માટે કામ કરે અને ચોક્કસ આવક કમાય તેને કહેવાય.
૪. વ્યવસાયી સંસ્થા દરેક વ્યવસાય માટે ચોક્કસ મૂડીને નિયંત્રીત કરે છે.
૫. નોકરીની શરતો દ્વારા નક્કી થાય છે.

- બ. 'અ' વિભાગના જોડકાને 'બ' વિભાગના જોડકા સાથે યોગ્ય રીતે જોડો



વિભાગ—અ

૧. ધંધાનો પ્રાથમિક હેતુ
૨. વ્યવસાયનો પ્રાથમિક ઉદ્દેશ
૩. વ્યવસાય માટેની મૂળભૂત આવશ્યકતા
૪. ચાર્ટડ એકાઉન્ટનનો રોજગાર

વિભાગ—બ

- (અ) વિશિષ્ટ કણા
- (બ) નક્ષાનો ઉદભવ કરવો
- (ક) વ્યવસાય
- (દ) સેવા પૂરી પાડવી

૧.૩ ધંધાનો અર્થ

બજારમાં તમે વિવિધ વસ્તુઓ જોશો. તમને જ્યારે તે વસ્તુની જરૂરિયાત જણાશો ત્યારે તમે ખરીદશો. તમે જાણો છો આ વસ્તુઓ બજારમાં કઈ રીતે આવે છે? કોણ આ વસ્તુઓ બનાવે છે? અને કોણ તેમને બજારમાં લાવે છે? ખરેખર આ વસ્તુઓનું કોઈ ચોક્કસ જગ્યાએ ઉત્પાદન થાય છે. પછી કોઈ વસ્તુને વસ્તુના ઉત્પાદન સ્થળેથી વિતરણ સ્થળે લાવે છે. પછી જ આપણે આ વસ્તુઓને ખરીદી શકીએ છીએ અને તમનો આપણી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ.



ધંધો

ફરીથી, તમે એવા લોકો જોયા હશે કે જે માલ અને મુસાફરોની હેરફર, બેન્કિંગ, વીમો, જાહેરાત, વીજળી પૂરી પાડવી, ટેલીફોન વગેરેમાં રોકાયેલા હશે. આ બધી સેવાની પ્રવૃત્તિઓ છે. કે જે લોકો દ્વારા તેમની આજીવિકા (ગુજરાન) માટે (પુરી પાડવામાં) કરવામાં આવે છે.

ઉપરની બધી પ્રવૃત્તિઓમાં પછી તે ઉત્પાદન, વિતરણ, માલની ખરીદી કે વેચાણ કે સેવા, પ્રત્યેક સંજોગોમાં (બાબતમાં) નાણાંકીય લાભ અપેક્ષિત છે, અને તે સતત ધોરણે (કાયમી ધોરણો) કરાય છે, આમ ધંધો એ કોઈ પણ નિયમિત ધોરણો થતી (કરાવતી) માનવીય પ્રવૃત્તિ છે. જેનો હેતુ ઉત્પાદન, વિતરણ, માલની ખરીદી કે વેચાણ અને સેવા દ્વારા નક્ષે કરવાવાનો છે.

ધંધાની વ્યાખ્યા:-

"નક્ષાના હેતુથી નિયમિત ઉત્પાદન અથવા માલની ખરીદી અને વેચાણ માટે સેવાની થતી ફેરબદ્ધલી અને વિનિમય."

૧.૪ ધંધાના લક્ષણો (વિશિષ્ટતા)

ધંધાના જરૂરી લક્ષણો નીચે મુજબ છે:



નોંધ

અ. વસ્તુ અને સેવાનો વેપાર:-

ધૂમાનું રોકાયેલા લોકો વસ્તુનું ઉત્પાદન અને વિતરણ તેમજ સેવાનું પણ વિતરણ કરે છે. વસ્તુઓ વપરાશી વસ્તુઓ જેવી કે બ્રેડ, માખણા, દૂધ, ચા વગેરે અથવા મૂડી વસ્તુઓ જેવી કે પ્લાન્ટ, યંત્રો, સાધનો વગેરે સેવાઓની હેરફેર (ટ્રાન્સપોર્ટ શન) બેંક, વીમો, વખાર, જાહેરાત વગેરે સ્વરૂપમાં હોય છે.

બ. વસ્તુ અને સેવાનું વેચાણ અથવા વિનિમય:-

જો માલસ પોતાના વપરાશ માટે અથવા કોઈને બેટ આપવા માટે વસ્તુનું ઉત્પાદન કરે અથવા ખરીદવાના કાર્યમાં રોકાયેલો હોય તો તે ધૂમાનું રોકાયેલો નથી. પણ જો તે વસ્તુનું ઉત્પાદન અથવા ખરીદી કોઈને વેચાણ કરવા માટે કરે તો તે ધૂમાનું રોકાયેલો છે તેમ કહેવાય. આમ, જો ધૂમાનું વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન અથવા ખરીદી માત્ર પૈસાના વિનિમય સામે અથવા ખરીદી નાણાની લેવડાઉડ સામે (વિનિમય) અથવા વસ્તુઓની સાટા પદ્ધતિ ખરીદનાર અને વેચનાર વચ્ચે થાય. વસ્તુના વેચાણ સિવાયની પ્રવૃત્તિને ધંધો ગણાવી શકાય નહિ.

ક. વસ્તુ અને સેવાનો નિયમિત વિનિમય:-

ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિ. નિયમિત ધોરણે ચાલતી હોવી જોઈએ. સામાન્ય રીતે અલગ કરેલ વ્યવહારને ધંધો ગણી શકાય નહિ. દાખલા તરીકે જો રાજુ તેની જુની કાર હરિને વેચે તો તેને ધંધો કહેવાય નહિ. સિવાય કે તે કારની ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ નિયમિત ધોરણે કરતો હોય.

ડ. રોકાણ જરૂરી:-

દરેક ધૂમાકીય પ્રવૃત્તિમાં કેટલીક મૂડીનું રોકાણ જમીન, શ્રમ અથવા મૂડીના સ્વરૂપમાં જરૂરી હોય છે. આ સાધનોનો (સ્ત્રોતનો) ઉપયોગ વિવિધ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવા માટે અને સેવાઓનું વિતરણ અને ઉપયોગ માટે કરાય છે.

૩. નફાની કમાણીનો ધ્યેય:-

આવક નફાના સ્વરૂપમાં કમાવાના પ્રથમિક હેતુથી ધૂમાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નફા વગર લાંબા સમય સુધી ટકી રહેવું શક્ય નથી. નફાની કમાણી, વૃદ્ધિ અને ધૂમાના વિકાસ માટે જરૂરી છે.

૪. જોખમ અને આવકની અનિચ્છાનો સમાવેશ:-

આપણે જાણીએ છીએ કે દરેક ધૂમાનો હેતુ નફો કમાવાનો છે. ધૂમાદારી કે જે વિવિધ સાધનોમાં રોકાણ કરે છે તે સારી રકમના વળતરની અપેક્ષા રાખે છે. પરંતુ તેના / તેણીના શ્રેષ્ઠ પ્રયત્નો હોવા છતાં તેને / તેણીને મળેલ બદલો કાયમ અનિશ્ચિત હોય છે. કયારે તે / તેણી નફો પ્રાપ્ત કરે છે. અને કયારેક એવો સમય આવે છે કે જ્યારે તે મોટુ (ભારે) નુકસાન



ભોગવે છે. આવું થાય છે કારણ કે ભવિષ્યની ધારણા કરી શકતી નથી. અને ધંધાદારી વ્યવહારું રીતે તેની કમાણીને જે પરિબળો અસર કરે છે તેના પર અંકુશ ધરાવતો નથી.

૧.૫ ધંધાની ઉત્કાંતિ

આપણો જાણીએ છીએ કે ભારત પાસે અતિ શ્રીમંત સંસ્કૃતિનો વારસો છે. જો કે ધારણા બધા જાણતા નથી કે ભારત એ અર્થતંત્ર અને ધંધામાં ખૂબ વિકસીત દેશ હતો. ખોદકામ, લેખિત દસ્તાવેજોલ સાહિત્ય અને બધાથી ભારતની પ્રચંડ સમૃદ્ધિએ ધારણા પરદેશીઓને ભારત પર હુમલો કરવા આકાર્યા. ભારત આ બાબતનો સાક્ષી છે. ભારતની સંસ્કૃતિ માત્ર ખેતી આધારિત ન હતી. પરંતુ વિકસીત ધંધો અને વ્યપાર ભારતમાં અને ભારત બહાર (દેશ બહાર) હતો. તેણે વિશ્વના ધંધાના દરેક ક્ષેત્રમાં પ્રચંડ ફાળો આપ્યો છે. ભારતીય ધંધો અજોડ, નવીન, ગતિશીલ અને તે સમયના અન્ય દેશો કરતાં ગુણવત્તાસભર હતો.

શરૂઆતના સમયમાં, ભારતીય અર્થતંત્ર સમગ્રપણે ખેતી આધારિત હતું. લોકો તેમના સ્વ-વપરાશ માટે ઉત્પાદન કરતા હતા. ત્યારે વસ્તુના ઉત્પાદનની કે વિનિમયની કોઈ જરૂરિયાત ન હતી. ત્યારપછી લોકોની જરૂરિયાતો વધી અને તેમણે ઉત્પાદન શરૂ કર્યું. લોકો રોજિંદા વપરાશ અને સુખસગવડની વસ્તુઓ બનાવવામાં વિશેષતા મેળવવા લાગ્યા અને તેમની પાસે તેમની વધારાની જરૂરિયાતવાળી વસ્તુઓ બનાવવાનો સમય ન હતો. જો કે તેમની કાર્યક્ષમતાના વધારાની સાથે તેઓ વધારાની વસ્તુનું ઉત્પાદન કરતા હતા. તેથી વધારાની વસ્તુનો વિનિમય જરૂરિયાત પ્રમાણે વિકસીત થયો. આ વ્યપારની શરૂઆત હતી.

એવું સામાન્ય રીતે સમજવામાં આવે છે કે ભારતે ધારી બધી વસ્તુઓમાં ખાસ કરીને સ્વતંત્રતા પછી ધંધા અને વ્યપારના ક્ષેત્રમાં આધુનિક સમયમાં વિકાસ કર્યો છે. જેથી આપણે આપણા ઉપયોગની બધી વસ્તુઓનું ઉત્પાદન કરી શકીએ છીએ. આનો અર્થ એ નથી કે ભૂતકાળમાં ભારતે આ ક્ષેત્રમાં વિકાસ કર્યો નથી. હકીકતમાં ભારત પાસે ધંધો અને વ્યપાર ક્ષેત્રે ખૂબ જ શ્રીમંત વારસો છે કે જે દરેક ભારતીયને ગૌરવ અપાવે છે. લોકોને જાણીને નવાઈ થશે કે ભારતે વ્યપાર અને વાણિજ્ય ક્ષેત્રની સક્રિ ૫૦૦૦ વર્ષ પૂર્વ કરી હતી. ઐતિહાસિક પુરાવાથી સાબિત થાય છે કે તે વખતે ભારતમાં સુઆયોજીત શહેરો હતાં અને વિશ્વમાં ભારતીય ટેક્સટાઇલ, ઘરેણાં અને અતાર વપરાતા. તે સમગ્ર વિશ્વમાં પ્રશંસા પામતા, ધારણા લાંબા સમયથી ભારતીય વેપારીઓ ધંધાનો ચલાણ તરીકે ઉપયોગ કરતા. વ્યાપારીઓ, કલાકારો અને ઉત્પાદકોના હિત સાચવવા માટે એકબીજાના સહકારથી એક સમાન ઉદ્દેશી કામ કરનાર મંડળી હતી. આ ભારતના વ્યપાર અને ઉદ્યોગના વિકાસની જટિલ નિશાની (સૂચક) છે. આંતરિક વ્યપાર માર્ગોને સિવાય ભારતે આરબ અને સેન્ટ્રલ અને સાઉથ ઈસ્ટ અશીયાના ભારતની ક્ષિતીજો સ્થાપી છે. ભારતના ઉત્પાદનમાં મહેલની વસ્તુઓ જેવી કે બારી અને પિતણની મૂર્તિઓ, વાસણો, ઘરેણા અને સુશોભનના ટુકડાનું ઉત્પાદનમાં પણ છે. ભારત વિશ્વના જુદા જુદા ભાગોમાંથી અસંખ્ય વસ્તુઓની આયાત-નિકાસ કરે છે. તે પણ અતિ જાણીનું છે કે બ્રિટીશરો સૌથી

વંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

પહેલાં ભારતમાં વ્યાપારી તરીકે આવ્યા હતા કે જેણે તેમને સત્તા સ્થાપવામાં માર્ગદર્શન (મદદ) આપ્યું.

ભારતે સમગ્ર વિશ્વને ધંધા અને વ્યાપારના ક્ષેત્રે પણ ફાળો આપ્યો છે. આધુનિક સમયમાં વપરાતી સાંખ્યિક પદ્ધતિનો (numerics) વિકાસ પણ ભારતમાં થયો હતો. સંયુક્ત કુટુંબ પ્રથા અને ધંધામાં શ્રમવિભાજનનો ઉદ્ભબ અહીં થયેલ કે જે આજે પણ અમલમાં છે. ગ્રાહકોની આધુનિક કળા કે જે ધંધામાં પ્રકાશિત છે તે છેલ્લા કેટલાક વખતથી ભારતીય ધંધાનો એક પૂર્ણ બાગ બની ગયો છે.

આમ આપણે કહી શકીએ કે ભારત પાસે વ્યાપાર અને વાણિજ્યમાં શ્રીમંત વારસો છે કે જેણે તેના વિકાસમા ફાળો આપ્યો છે.



૧.૩ પાઠ આવારિત પ્રશ્ન

- (૧) રાહુલ એક દુકાનદાર છે કે જે ઘણી બધી વસ્તુઓમાં રોકાયેલો છે કે જેને તે ધંધો કહે છે. તેમાંના દરેકને વપારો અને જણાવો કે તમે તેની સાથે સહમત છો કે નહિ? દરેક વિધાનની સામે 'સહમત' અથવા 'અસહમત' એવું લખો.
૧. રાહુલ તેની દુકાનમાં ગ્રાહકોને ભોડ વેચે છે.
 ૨. તે તેની નાણી બેનને ભેટ આપવા પેન ખરીદે છે.
 ૩. તે તેના પડોશીને તેનો જૂનો ટેલીવિઝન રૂ.૩,૦૦૦માં વેચે છે.
 ૪. રાહુલ પોલ્ટ્રી ફાર્મમાંથી ઈડા ખરીદીને તેના ગ્રાહકોને વેચે છે.
 ૫. રાહુલ દુધનું એક પેકેટ રૂ.૧૦ માં ખરીદીને તેના ગ્રાહકોને રૂ.૧૨માં વેચે છે.
 ૬. રાહુલ તેના કુટુંબ માટે રૂ.૩૦ ની કિમતના શાકભાજી ખરીદે છે.
 ૭. તે તેની દુકાનમાંથી વિના મૂલ્યે ગરીબ બાળકોને બિસ્કિટ વહેચે છે.
- (૨) નીચે ધંધા વિષે કેટલાક વિધાનો આપ્યા છે કેટલાક સાચા છે અને કેટલાક ખોટા છે. સાચા વિધાનની સામે 'R' લખો અને ખોટા વિધાનની સામે 'W' લખો.
૧. ધંધાએ ભારતના એકીકરણમાં કોઈ ભૂમિકા ભજવવાની નથી તેથી તે માત્ર વસ્તુઓ અને સેવામાં વ્યાપાર કહે છે. (વ્યવહાર)
 ૨. ધંધો લોકોનું જીવનધોરણ સુધારવામાં કોઈ ફાળો આપતો નથી.
 ૩. ઔદ્યોગિક શોધે નવી અને નવીનતમ વસ્તુનો વિકાસ કર્યો છે.
 ૪. ધંધો પરદેશથી વસ્તુ આયત કરવાની મંજૂરી આપતો નથી.
 ૫. ધંધો રોજગારીમાં વધારો કરીને ગરીબાઈમાં ઘટાડો કરે છે.
 ૬. આંતરરાષ્ટ્રીય મેળા અને પ્રદર્શન અને વેચાણ દ્વારા ધંધો દેશની હકારાત્મક છાપનું સર્જન કરે છે.

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ




૧.૬ ધંધાના હેતુ (વિકાસ) નું વર્ગીકરણ

બધા ધંધાની પ્રવ તિઓ કોઈક હેતુથી કરવામાં આવતી હોય છે. ધંધાના હેતુઓનું નીચે મુજબ વર્ગી કરણ કરી શકાય.

ધંધાના હેતુઓ

ધંધાના ઉદ્દેશ્ય



૧.૬.૧ આર્થિક હેતુઓ

ધૂમાના આર્થિક હેતુઓ નફાની કમાણીના હેતુને સાંકળે છે અને અન્ય હેતુઓ જેવા કે નફાના હેતુ માટે સતત પાછળ પડવું કે જેમાં ગ્રાહકોનું સર્જન નિયમિત નવીનતા અને ઉપલબ્ધ સ્ત્રોતનો શ્રેષ્ઠ ઉપયોગનો સમાવેશ થાય છે.

નફાની કમાણી:-

નફો એ ધૂમાની પ્રાણદાયી વસ્તુ છે. જેના સિવાય કોઈપણ ધૂમો હરિફાઈ યુક્ત બજારમાં ટકી શકે નહિએ. આમ, નફો મેળવવો અને ધૂમાનો પ્રાથમિક હેતુ છે. જેના માટે ધૂમાના અસ્તિત્વનું સર્જન કરાય છે. નફો વેપારીને જીવવા માટે માત્ર મદદ નથી કરતો પણ નફાના અમૃક ભાગને ધૂમાનમાં પુનઃ રોકી ધૂમાના વિકાસમાં પણ મદદ કરે છે.

પ્રાથમિક હેતુ સિદ્ધ કરવા માટે અન્ય હેતુઓ પણ ધૂમાને સમજવા જોઈએ. (પાછળ પડવું જોઈએ.)

અ. ગ્રાહકોનું સર્જન:-

ધૂમાકીય એકમ કયારેય બચી ન શકે સિવાય ગ્રાહકો વસ્તુઓ અને સેવાઓ ખરીદી. ફરીથી ધૂમો ત્યારે જ નફો કરી શકે કે જ્યારે તે / તેણી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ વ્યાજળી ભાવે પૂરી પાડે. આ માટે એ જરૂરી છે કે તે ચાલુ તેમજ નવી વસ્તુઓ માટે વધુ ને વધુ ગ્રાહકોને આકર્ષે. આ વિવિધ બજાર વૃધ્ઘની પ્રવૃત્તિની મદદથી થઈ શકે.

બ. સતત નવીનતા:-

ધૂમો ખુબ જ ગતિશીલ છે અને સાહસ સતત સફળ રહેવા માટે તેના વાતાવરણમાં બદલાવ સ્વીકારવો પડે. નવીનતાનો અર્થ બદલાવ કે જે ઉત્પાદનમાં ઉત્પાદન પ્રક્રિયા અને વસ્તુના વિતરણમાં સુધારો લાવે. પડતરમાં ઘટાડો અને વેચાણવૃધ્ઘ ધૂમાદારીને વધુ નફો આપે છે. હેન્ડલુમની જગ્યાએ પાવરલુમસનો ઉપયોગ, ખેતીમાં હાથેથી ખેડાણ કરવાને બદલે ટ્રૂક્ટરનો ઉપયોગ વગેરે નવીનતાના પરિણામો છે.

ક. સાધનો (સ્ત્રોત)નો શ્રેષ્ઠ ઉપયોગ:-

તમે જાણો છો કે ધૂમાને ચલાવવા માટે તમારી પાસે પૂરતી મૂડી અથવા ભંડોળ હોવું જોઈએ. મૂડીની રકમનો ઉપયોગ યંત્રો અને કાચો માલ ખરીદવા માણસોને કામે રાખવા અને રોજ બરોજના ખર્ચ માટે કરી શકાય. આમ ધૂમાને વિવિધ સાધનો જેવા કે માનવી, માલસામાન, નાણાં અને યંત્રોની જરૂર પડે છે. આ ઉદેશ (પાર પાડવા) કુશળ માણસોને રોજગારી આપી, યંત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને કાચા માલ સામાનનો લઘુત્તમ બગાડ રીતે નાના થઈ શકે છે.



૧.૪ પાઠ આધ્યારિત પ્રશ્નો

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



નીચે કેટલાક વિધાનો ધંધાના આર્થિક હેતુ સંબંધિત છે. કેટલાક વિધાનો સાચા છે અને કેટલાક ખોટા છે. સાચા વિધાનો ઓળખી બતાવો.

૧. ધંધાનો પ્રાથમિક ઉદ્દેશ વસ્તુ માટેની માંગ ઉભી કરવી તે છે.
૨. ધંધામાં રોકાયેલી મૂડીના પ્રમાણમાં ધંધાદારી નફાની કમાણીની અપેક્ષા રાખે છે.
૩. ધંધાદારી માટે દરેક વખતે (હંમેશા) માલસામાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જરૂરી નથી.
૪. ધંધાદારીએ ધંધા દ્વારા કમાયેલ નફાનો ઉપયોગ માત્ર તેમના જીવવા માટે કરવો જોઈએ.
૫. ધંધાનો પ્રથમિક આર્થિક હેતુ રોજગારીનું સર્જન કરવાનો છે.

૧.૬.૨ સામાજીક હેતુ (ધ્યેય):-

સામાજીક હેતુ એ ધંધાના એવા હેતુ છે કે જે સમાજના લાભ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. ધંધાની કોઈપણ પ્રવૃત્તિનો હેતુ સમાજને કોઈપણ પ્રકારની અગવડ આપવાનો હોઈ શકે નહિએ. ધંધાના સામાજિક હેતુમાં ગુણવત્તાસભર વસ્તુ અને સેવાનું ઉત્પાદન અને વિતરણ, વ્યાજબી ધંધાકીય પ્રવૃત્તિનો સ્વીકાર અને સમાજના જાહેર કલ્યાણ માટે ફાળો અને સમાજની શૌભા માટે સેવા પૂરી પાડવાનો સમાવેશ થાય.

અ. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન અને વિતરણ:-

જ્યારથી ધંધો સમાજના વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે. ત્યારથી સમાજ ધંધા પાસેથી ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાની અપેક્ષા રાખે છે. ધંધાનો ઉદ્દેશ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવવી અને તેને યોગ્ય સમયે અને યોગ્ય કિંમતે પૂરી પાડવાનો હોવો જોઈએ. તેમણે વસ્તુની ગુણવત્તા પ્રમાણે અને પૂરી પાડેલ સેવા પ્રમાણે કિંમત વસુલ કરવી જોઈએ.

બ. વ્યાજબી ધંધાના કાયો નો સ્વીકાર:-

દરેક સમાજમાં સંગ્રહ, કાળા બજાર અને વધુ ભાવ લેવા તેને અનિયાનીય પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ઉપરાંત ગેરમાર્ગ દોરતી જાહેરખબર ક્યારેક વસ્તુની ગુણવત્તા અંગે ખોટી છાપ ઉભી કરે છે. ધંધાકીય એકમે આવશ્યક ચીજવસ્તુની કૃત્રિમ અછિત ઉભી ન કરવી જોઈએ અથવા માત્ર નફો કમાવાના હેતુથી કિંમતમાં વધારો ન કરવો જોઈએ. આ બધી પ્રવૃત્તિઓ ખોટું નામ ઉભું કરે છે અને ક્યારેક ધંધાદારી દંડને પાત્ર બને છે. અને ક્યારેક કાયદા હેઠળ કેદ પણ થાય છે. તેથી જ ધંધાએ વ્યાજબી ધંધાના કાર્યોનો સ્વીકાર ગ્રહકોના તેમજ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ.

ક. સમાજના સામાન્ય કલ્યાણ માટે ફાળો:-

ધંધાકીય એકમે સામાન્ય કલ્યાણ માટે અને સમાજના ઉત્કર્ષ માટે કામ કરવું જોઈએ. આ સારા શિક્ષણ માટે શાખા અને કોલેજો ચલાવીને વ્યવસાયીક તાલીમ કેન્દ્રો ખોલીને લોકોને રોજગારી માટે તાલીમ અપાય, તથીબી સગવડ માટે હોસ્પિટલની સ્થાપના કરીને,

ધ્યાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

સામાન્ય લોકોને બગીચા અને રમતગમતના કેન્દ્રો ખોલીને આનંદ પ્રમોદની સગવડ આપીને શક્ય બનાવી શકાય.



૧.૫ પાઠ આધારિત પ્રશ્નો

- નીચેના સામાજીક હેતુ સંબંધી વિધાનોમાંથી ક્યા વિધાનો સાચા છે અને ક્યા વિધાનો ખોટા છે તે જણાવો.
- ધ્યાના સામાજીક હેતુ એ ધારણા પર છે કે જે ધ્યાન માટે સાચું છે તે સમાજ માટે પણ સારું છે.
- ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન અને તે ગ્રાહકોને પૂરી પાડવી તે ધ્યાનનો સામાજીક હેતુ છે.
- વસ્તુની માંગનું સર્જન કરવું તે ધ્યાનનો સામાજીક ઉદ્દેશ છે.
- રમતના ભાગવાળા મકાનની (અંગ) જનતા માટે સ્થાપના એ ધ્યાનનો આર્થિક હેતુ છે.
- સંગ્રહખોરી અને કાળા બજારને ધ્યાનનો ઈચ્છિત ભાગ ગણવામાં આવે છે.

૧.૬.૩ માનવ હેતુઓ

માનવ હેતુઓ નોકરિયાતો પરતે સારુ વર્તન તેમની અપેક્ષાઓને સંતોષવી અને જે લોકો અશક્ત, અપંગ અને સારા શિક્ષણ અને તાલીમથી વંચિત છે, તેનો સમાવેશ કરે છે. આમ ધ્યાના માનવ હેતુઓ નોકરિયાતો સાથે આર્થિક રીતે સારુ વર્તન, તેમને સામાજીક અને મનોવૈજ્ઞાનિક સંતોષ અને માનવ સાધનોમાં વિકાસનો સમાવેશ કરે છે.

અ. નોકરિયાતો સાથે આર્થિક રીતે સારું વર્તન:-

ધ્યાનમાં માલિકે વ્યાજબી વેતન અને પ્રયત્નોને ઉત્તેજન, પ્રોવિડન્ડફંડના લાભ અને અન્ય સવલતો જેવી કે તબીબી સહાય, ઘરની સગવડ, વગેરે પૂરી પાડવી જોઈએ. આનાથી તેઓ વધુ સંતુષ્ટ થશે અને ધ્યાનમાં વધુ કામ કરશે.

બ. કર્મચારીઓને સામાજીક અને મનોવૈજ્ઞાનિક સંતોષ:-

ધ્યાનીય એકમની ફરજ છે કે તેણે કર્મચારીઓને સામાજીક અને મનોવૈજ્ઞાનિક સંતોષ પુરો પાડવો જોઈએ. આ શક્ય બનાવવા કામ વધુ રસપ્રદ અને પડકાર આપનારું, યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ મુકીને અને કામનું પુનરાવર્તન ઘટાડીને કરી શકાય. વળી કર્મચારીના દ્વિતીય પરતે પુરતું ધ્યાન આપીને અને તેમના સૂચનો ગંભીરપણે સ્વીકારીને નિર્ણય લેતાં અમલ કરવો જોઈએ. જો કર્મચારીઓ સુખી અને સંતોષી હશે તો તે સારામાં સારું કામ આપી શકશે.

ક. માનવ સાધનોનો વિકાસ:-

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



કર્મચારીઓનો માનવી તરીકે, કાયમ વ્યવસાયી તરીકે વિકાસ થવો જોઈએ તેમના વિકાસનો આધાર યોગ્ય તાલીમ તેમજ વિકાસ છે. ધંધાનો વિકાસ થઈ શકે જો કર્મચારીનોની આવડતમાં સુધારો થાય. આમ ધંધા માટે એ અગત્યનું છે કે ધંધાએ કર્મચારીઓ માટે તાલીમ અને વિકાસના કાર્યક્રમો ગોઠવવા જોઈએ.

૩. સામાજીક અને આર્થિક રીતે પછાત સાથે સાચું વર્તનઃ—

ધંધાકીય એકમો એ સમાજનું અવિભાજન અંગ છે. પછાત વર્ગને અને જે શારિરીક અને માનસિક રીતે અસરગ્રસ્ત છે તેમને મદદ કરવી જોઈએ. આ ઘણી રીતે શક્ય છે. જેમ કે વ્યવસાયીક તાલીમના કાર્યક્રમો સમાજના પછાત વર્ગના લોકોની કમાણીની ક્ષમતા સુધારવા યોજવામાં આવે છે. ધંધાકીય એકમો ઉચ્ચી ગુણવત્તાવાળા ગુણ ધરાવનારને ઉચ્ચશિક્ષણ માટે શિષ્યવૃત્તિની સહાય કરીને મદદ કરી શકે.



૧.૬ પાઠ આધારિત પ્રશ્નો

નીચે જણાવેલ વિધાનો માનવીય હેતુ સંબંધિત છે. તમે જણાવો કે તેમાના કયા વિધાનો 'સાચા' છે અને કયા વિધાનો ખોટા છે.

૧. ધંધાદારીએ કામદારોને યોગ્ય વેતન આપવું જોઈએ જે કામદારોને કાર્ય કરવા પ્રોત્સાહન આપશે.
૨. ધંધાકીય એકમે સામાજીક અને મનોવૈજ્ઞાનિક સંતોષ કામદારોને પૂરો પાડવો જોઈએ.
૩. ધંધાદારીએ અપંગ વ્યક્તિને મદદ કરવી ન જોઈએ સિવાય તેમને ધંધામાં કામે રાખવામાં આવે.
૪. ધંધાકીય એકમે જ્યારે અગત્યના નિર્ણય લેવાતા હોય ત્યારે તેમના કર્મચારીઓએ આપેલ સુચનોની અવગાણના કરવી જોઈએ.
૫. સમાજમાં શારિરીક રીતે અપંગ એવી વ્યક્તિને મદદ કરવી તે ધંધાનો આર્થિક હેતુ છે.

૧.૬.૪ રાષ્ટ્રીય હેતુઃ—

ધંધો એ રાષ્ટ્રીય અર્થતંત્રનો એક અગત્યનો ભાગ હોવાને કારણે દરેક ધંધાનો રાષ્ટ્રના ધ્યેય અને મહત્વકંશા પૂરી પાડવાનો હેતુ હોવો જોઈએ. નીચે જણાવેલ ધંધાના રાષ્ટ્રીય હેતુઓ છે.

અ. રોજગારી ઉભી કરવી:—

ધંધાનો મહત્વનો રાષ્ટ્રીય હેતુ એ છે કે લોકો માટે લાભકારક રોજગારીનું સર્જન કરવું નવા ધંધાકીય એકમો સ્થાપીને બજારનો વિસ્તાર વધારીને વિતરણની ચેનલોમાં વધારીને આ હેતુ પાર પાડી શકાય.

વંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

બ. સામાજીક ન્યાયને વૃદ્ધિઃ—

એક જવાબદાર નાગરિક તરીકે વંધાદારી પાસે એ અપેક્ષા હોય છે કે તે જેમની સાથે (તે / તેણી) વ્યવહાર કરતા હોય તેમને સમાન તક પૂરી પાડે. તે / તેણી પાસે એ પણ અપેક્ષા છે કે તેમને ત્યાં કામ કરતા કર્મચારીને પણ કામ કરવામાં અને વિકાસમાં સરળી તક પૂરી પાડવી જોઈએ.

ક. રાષ્ટ્રીય અગ્રતા પ્રમાણે ઉત્પાદનઃ—

સરકારે આયોજન અને નિતીમાં જે પ્રમાણે અગ્રતાક્રમ મુક્યા હોય તે પ્રમાણે વંધાકીય એકમોએ વસ્તુનું ઉત્પાદન અને પુરવઠો પૂરાં પાડવા જોઈએ. આપણા દેશમાં કોઈ પણ વંધાનો રાષ્ટ્રીય હેતુ એ છે કે ઉત્પાદન વધારવું જોઈએ અને જરૂરી ચીજ વસ્તુનો પુરવઠો વ્યાજબી ભાવે પૂરો પાડવો જોઈએ.

ડ. દેશની આવકમાં ફાળો આપવો:-

વંધાના માલિકોએ તેમના કર અને દેવા પ્રમાણિકતાથી અને નિયમિતપણે ભરવા જોઈએ આથી સરકારની આવકમાં વધારો થશે કે જેનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરી શકશે.

ઈ. સ્વ-નિર્ભરતા અને નિકાસવૃદ્ધિઃ—

દેશને મદદ કરવા સ્વ-નિર્ભર બનવું જોઈએ. વંધાકીય એકમોએ વસ્તુની આયાત પર નિયંત્રણ મૂળીને જવાબદારીમાં વધારારો કર્યો છે. વધારામાં પ્રત્યેક વંધાકીય એકમનો હેતુ નિકાસ વધારવાનો હને દેશ માટે વિદેશી હૂંડિયામણની અનામત વધારવાનો છે.



૧.૭ પાઠ આધારિત પ્રશ્નો

કોણ્સમાં આપેલ શબ્દોથી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ કે શબ્દો મૂકો.

૧. જરૂરી વસ્તુનું ઉત્પાદન કરવું અને વ્યાજબી ભાવે વિતરણ કરવું તે વંધાનો હેતુ છે. (સામાજીક, રાષ્ટ્રીય, માનવીય)
૨. દેશને મદદ કરવા માટે વંધાનો સ્વનિર્ભરતાનો હેતુ વધારવાનો છે. (નિકાસ, આયાત, કિંમત)
૩. વંધાકીય એકમે કરવેરા પ્રમાણિકતાથી અને ભરવા જોઈએ. (ક્યારેક, વારંવાર, નિયમિત)
૪. વંધા એ સમાન તકો ને પૂરી પાડવી જોઈએ. (માલિક, કર્મચારી, માલ પૂરો પાડનાર)

૧.૮.૫ વૈશ્વિકવ્યાપક હેતુઃ:

(ભૂતકાળમાં) પહેલાં ભારતને અન્ય દેશો સાથે સિમીત વંધાકીય સંબંધો હતા. વસ્તુ અને સેવાની આયાત અને નિકાસ માટે ખૂબ જરૂર નિરી હતી. પરંતુ હાલ છૂટ છાટવાળી આર્થિક અને આયાત-નિકાસની નિતીને કારણે વિદેશી રોકાણ પરના મોટા ભાગના નિયંત્રણો ઉદાવી

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



લીધા છે. અને આયાતી વસ્તુ પરની ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બદલાવનેકારણે બજારમાં હરિફાઈમાં વધારો થયો છે. આજે વૈશ્વીકરણને લીધે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. એક દેશમાં ઉત્પન્ન થયેલ માલ બીજા દેશમાં તરત તૈયાર માલ તરીકે મળી શકે છે. આમ વિશ્વના બજારની હરિફાઈને સામનો કરવા દરેક ધંધાએ મગજમાં હેતુ રાખવા પડશે જેને વિશ્વવ્યાપક હેતુ કહેવાય. ચાલો તેના વિષે શીખીએ.

અ. સામાન્ય જીવનધોરણમાં વધારો:-

રાષ્ટ્રીય સરહદમાં થયેલ ધંધાની પ્રવૃત્તિના વિકાસને કારણે ગુણવત્તા વાળી વસ્તુ વ્યાજબી ભાવે સમગ્ર વિશ્વમાં મળી શકે છે. એક દેશના લોકો એ જ પ્રકારની વસ્તુઓ મેળવી શકે છે જે બીજા દેશના લોકો વાપરે છે. આ કારણે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે.

બ. રાષ્ટ્રો વર્ચ્યેની અસમાનતામાં ઘટાડો:-

ધંધાએ શ્રીમંત અને ગરીબ દેશ વર્ચ્યેની અસમાનતા ઘટાડવા તેણે તેની પ્રવૃત્તિ (કાય્યો) વધારવી જોઈએ. વિકસીત અને અવિકસીત દેશોનાં મૂડીરોકાણ કરીને આ થઈ શકે. તે ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું પોષણ કરે છે.

ક. વૈશ્વીક હરિફ દ્વારા વસ્તુઓ અને સેવાની પ્રાપ્તિ:

ધંધાએ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડશે. જે વસ્તુ અને સેવાની વિદેશના બજારમાં માંગ હોય તેવી નિકાસ કરનાર દેશની છાપ સુધારશે અને દેશ માટે વધુ ઝૂંડિયામણ કમાવી આપશે.

૧.૭ ધંધાની સામાજીક જવાબદારી

આપણે જાણીએ છીએ કે લોકો નકો કમાવવા માટે ધંધો કરે છે. જો કે નકો કરવો એ ધંધાનું (એક) મુખ્ય કાર્ય નથી. તે ઘણા સામાજીક કાર્ય કરે છે. કારણ કે તે સમાજનો એક ભાગ છે. તે જે સલામતી અસ્તિત્વ માટે સાધન બનેલા છે તેમની કાળજી લે છે, જેમ કે માલિકો / રોકાણકારો કમ ચારીઓ, ગ્રાહકો અને સરકાર અને સમાજ અને સામાન્ય શરીત. આથી દરેક ધંધાએ ફણો આપવો અથવા બીજાના ફણ્યદા માટે દાખલા તરીકે દરેક ધંધાએ રોકાણકારને સંતોષકારક રોકાણ પર વળતર દરની ખાત્રી આપવી જોઈએ, સારું વેતન આપવું જોઈએ અને તેના કર્મચારીને સલામતી અને કામગીરીની સારી પરિસ્થિતિ પૂરી પાડવી જોઈએ, ગ્રાહકોને વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી વસ્તુ આપવી જોઈએ. યોગ્ય વાતાવરણ જાળવવું જોઈએ વગેરે.

જો કે, ધંધાની સામાજીક જવાબદારી તરીકે કામ કરતાં બે બાબતોની નોંધ લેવી જોઈએ. પ્રથમ આવી કોઈ પ્રવૃત્તિ દાન નથી તેનો અર્થ એ થાય કે જો કોઈ પણ ધંધો અમુક રકમ દાન તરીકે કોઈ પણ હોસ્પિટલ અથવા મંદિર અથવા શાળા કે કોલેજને આપે વગેરે. તેને સામાજીક જવાબદારીમાંથી મુક્તિ તરીકે સમજવું ન જોઈએ(ગણવું ન જોઈએ) દાનનો

ધેંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

અર્થ જવાબદારી પૂરી કરવો થતો નથી. બીજું કોઈપણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ કે જે એક માટે સારી અને બીજા માટે ખરાબ હોય ધારો કે ધેંધાદારી દાખાચોરી દ્વારા અથવા ગ્રાહકોને છેતરીને પુષ્ટ પૈસા કમાય છે અને પછી તે ગરીબ દઢી ઓ માટે હોસ્પિટલ ચલાવે છે. આ પ્રવૃત્તિને સામાજીક ન્યાયી ન ઠેરવી શકાય. સામાજીક જવાબદારીનો અર્થ એ થાય છે કે ધેંધાદારીએ તેના ધેંધાની પ્રવૃત્તિ દ્વારા સમાજને નુકસાન થાય તેવું કંઈ પણ કરવું જોઈએ નહિ.

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

આમ, સામાજીક જવાબદારીનો ઘ્યાલ ધેંધાદારીને નફો કમાવવા માટે અયોગ્ય કાર્યનો સ્વીકાર કરવા માટે ઉત્તેજન આપતું નથી જેમકે કાળાબજાર, સંગ્રહખોરી, ભેણસેળ, કરચોરી અને ગ્રાહકોને છેતરવા વગેરે. આના બદલે તે તેમને ધેંધાના ન્યાયી સંચાલન દ્વારા નફો કમાવા ઉત્તેજન આપે છે. જેમ કે તેના કર્મચારીને રહેવાની અને કામ કરવાની સારી સગવડ આપીને, સારી વસ્તુ પૂરી પાડીને, વેચાણ પછીની સેવા તેના ગ્રાહકોને આપીને અને સાથોસાથ પ્રદૂષણ નિયંત્રણ અને કુદરતી સંપત્તિની સાચવણી.



૧.૮ પાઠ આધારિત પ્રશ્નો

ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકો :

૧. દરેક ધેંધો મા ચલાવાય છે.
૨. ધેંધાની સામાજીક જવાબદારી બધી ફરજો ધ્યાનમાં લે છે અને ધેંધાનો કે જે સમાજના કલ્યાણ સાથે દોરાયેલી છે.
૩. રોકાણકારોને સારુ વળતર આપવા વાળી વસ્તુ ઉચ્ચી કિંમતે પૂરી પાડવી. તે સામાજીક જવાબદારી પૂરી કરતું નથી.
૪. સરકારી નિયંત્રણની અવગણના કરવા ધેંધાદારી ગૃહોએ તેમની ફરજમાંથી મુક્ત થવું જોઈએ.
૫. ધેંધાની કમાણીનો આધાર લોકોની પ્રવૃત્તિ પર છે.
૬. આજે ને કારણે સમગ્ર વિશ્વ એક મોટું બજાર બન્યું છે.
૭. લાગં પડે છે કે ધેંધાદારીએ તેની ધેંધાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજને નુકસાન થાય તેવું કંઈ પણ કરવું જોઈએ નહિ.
૮. સામાજીક જવાબદારીનો ઘ્યાલ ધેંધાદારીને અયોગ્ય સાધનોનો સ્વીકારમાંથી કરે છે. જેવા કે નફો કરવા માટે કાળા બજાર કરવા, સંગ્રહખોરી, ભેણસેળ, કરચોરી અને ગ્રાહકોને છેતરવા.

૧.૮ રસ ધરાવતા વિવિધ જીથો પ્રત્યે જવાબદારી (ધેંધાની જવાબદારી)

ધેંધાની સામાજીક જવાબદારીનો ઘ્યાલ અને અગત્યતા સમજ્યા પછી ચાલો આપણો ધેંધાની વિવિધ જવાબદારીઓ વિષે જોઈએ. સામાન્ય રીતે ધેંધો માલિકો, રોકાણકારો, કર્મચારીઓ,



ગ્રાહકો, હરીફો, સરકાર અને સમાજ સાથે આંતર વ્યવહાર કરે છે. તેમને રસ ધરાવતા જૂથ કહે છે. કારણ કે ધંધાની પ્રત્યેક પ્રવૃત્તિને કારણો આ જૂથ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસરકરતા છે.

૧. માલિક અને રોકાણકારો પરત્વે જવાબદારી:-

ધંધાની માલિક પ્રત્યે પ્રાથમિક જવાબદારીઓ નીચે પ્રમાણે છે.

- અ. ધંધો કાય ક્ષમતાથી ચલાવવો
- બ. મૂડી અને અન્ય સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો
- ક. મૂડીનો વિકાસ અને મૂલ્યાંકન કરવું
- ડ. રોકાયેલી મૂડીનું નિયમિત અને વ્યાજબી વળતર આપવું.
- ્યાજની નિયમિત ચુકવણી કરવી.
- ્યાજની નિયમિત ચુકવણી કરવી.
- ગ. મૂળ મૂડીની સમયસર પુનઃ ચુકવણી કરવી.

૨. લેણદારો પરત્વે જવાબદારી:-

- અ. ચુકવણી સમયસર કરવી.
- બ. તેમના દ્વારા મળેલ જમા (શાખ)ની સલામતીની ખાત્રી આપવી.
- ક. બીજા દ્વારા જે માપદંડ અમલમાં હોય તેને અમલમાં મૂકવા.

૩. કર્મચારીઓપ્રત્યે જવાબદારી:-

ધંધાની તેના કર્મચારીઓ પ્રત્યેની જવાબદારીમાં સમાવેશ થાય છે.

- અ. સમયસર નિયમિત મજૂરી અને પગારની ચુકવણી
- બ. કામની યોગ્ય પરિસ્થિતિ અને કલ્યાણની સુખસગવડ
- ક. કારકિર્દીના વધુ વિકાસ માટેની ઉજ્જીવતકો
- ડ. નોકરીની સલામતી તેમજ સામાજીક સલામતી જેવી કે પ્રોવિંડ ફંડની સવલત, જૂથ વીમો, નિવૃત્તિ વેતન, નિવૃત્તિ લાભ વગેરે
- ્યાજની સારી વ્યવસ્થા જેમ કે ઘર, વાહન વ્યવહાર, કેન્દ્રીન વગેરે
- સમયસર તાલીમ અને વિકાસ

૪. પૂરો પાડનાર પરત્વે જવાબદારી (Supplier):-

પૂરા પાડનાર પરત્વે ધંધાની જવાબદારીમાં સમાવેશ થાય છે.

- ૧. નિયમિત રીતે માલની ખરીદીનો ઓર્ડર આપવો.
- ૨. વ્યાજબી નિયમો અને શરતો પ્રમાણે વ્યવહાર કરવો.
- ૩. વ્યાજબી શાખ આપવી.
- ૪. લેણાની સમયસર ચુકવણી કરવી

૫. ગ્રાહકો પરત્વે જવાબદારી:-

ધેંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

ધેંધાની ગ્રાહકો પરત્વેની જવાબદારીમાં સમાવેશ થાય છે.

- વસ્તુઓ અને સેવાઓ ગ્રાહકની જરૂરિયાતોની કાળજી લઈ શકે તેવી હોવી જોઈએ.
- વસ્તુઓ અને સેવાઓ ગુણવત્તાસાભર હોવી જોઈએ.
- વસ્તુઓ અને સેવાનું વિતરણ નિયમિત રીતે થવું જોઈએ.
- વસ્તુઓ અને સેવાની કિમત વ્યાજથી અને પોથાય તેવી હોવી જોઈએ.
- વસ્તુના ફાયદા અને ગેરફાયદા તેમજ વસ્તુ વાપરવાની રીત અંગેની જાણ ગ્રાહકોને કરવી જ જોઈએ.
- વેચાણ પછીની યોગ્ય સેવા હોવી જોઈએ.
- ગ્રાહકોની કોઈ પણ ફરિયાદ / વાંધાની (કોઈ પણ હોય તો) પતાવટ તરત થવી જોઈએ.
- અયોગ્ય સાધનો જેવા કે વસ્તુનું ઓછું વજન, ભેણસેળ વગેરેને દુર રાખવા (સ્વીકારવા નહિએ.)

૬. હરિફો પ્રત્યેની જવાબદારી:-

હરિફો પ્રત્યેની ધેંધાની જવાબદારીમાં સમાવેશ ન કરવો.

- વિતરક કે એજન્ટને અપવાદરૂપ સંજોગમાં વેચાણ પર વધુ કમિશનનો પ્રસ્તાવ
- ગ્રાહકને ભારે વળતર અને / અથવા પ્રત્યેક વેચાણ પર વિનામૂલ્યે વસ્તુ
- હરિફની જુઠી અથવા દ્વિઅથી જાહેરાત દ્વારા બદનામી કરવી.

૭. સરકાર પ્રત્યેની જવાબદારી:-

ધેંધાની સરકાર પ્રત્યે વિવિધ જવાબદારીઓ છે :

- એકમની સ્થાપના સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કરવી.
- કી, ડયુટી અને કરવેરાની ચુક્કવણી નિયમિત તેમજ પ્રમાણિકપણે કરવી.
- ઇજારાશાહી અને નિયંત્રીત વ્યાપાર કાર્ય દ્વારા પોતાની જાતને સંતૃપ્ત કરવી.
- સરકારે નિર્ધારિત કરેલ પ્રદૂષણ નિયંત્રણ સરકારી ધોરણોને અનુસરવું.
- લાંચ દ્વારા રુશવત અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા પોતાની જાતને સંતુષ્ટ કરવી.

૮. સમાજ પરત્વે જવાબદારી (શાંતિ):-

સમાન વ્યક્તિઓ, જુથ, વ્યવસ્થાતંત્ર કુટુંબ વગેરેનો બનેલો છે. તથા બધા સમાજના સભ્યો છે. તે એકબીજા પર અસર કરે છે અને તે બધા મોટે ભાગે બધી પ્રવૃત્તિઓ માટે એક બીજા પર નિર્ભર છે. તે બધાની વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ રાખે છે. ધેંધો સમાજના એક ભાગ તરીકે સમાજના બધા સભ્યો સાથે સંબંધો જાળવે છે. આમ તેને સમાજ પરત્વે જવાબદારી છે જે નીચે મુજબ છે.

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



- અ. સમાજના નબળા અને પદ્ધત વર્ગના લોકોને મદદ કરવી.
- બ. સામાજીક અને સાંસ્કૃતિક મૂલ્યની સાચવણી અને વૃધ્ઘિ
- ક. રોજગારી ઉભી કરવી.
- ડ. વાતાવરણનું રક્ષણ
- ૩. કુદરતી સંપત્તિ અને વન્ય જીવની સાચવણી
- ૫. રમત અને સાંસ્કૃતિક વૃધ્ઘિ
- ૬. શિક્ષણ, મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીના કેતે મદદ પૂરી પાડવી.



૧.૬ પાઠ આધારિત પ્રશ્નો

નીચે ધંધાની વિવિધ જવાબદારી વિવિધ રસ ધરાવતા જૂથ પરત્વે છે જેની ઉપર ચર્ચા કરેલ છે. કઈ જવાબદારી કયા જૂથ સાથે સંબંધિત છે તે જણાવો.

૧. વાતાવરણનું રક્ષણ
૨. સારી રહેવાની પરિસ્થિતિ જેમ કે ઘર, વાહનવ્યવહાર, કેન્ટી, ડેચીસ વગેરે
૩. રમત અને સાંસ્કૃતિકને ઉત્સેજન
૪. ઉજળી કારકિર્દીની તક
૫. વસ્તુ અને સેવાનો નિયમિત પૂરવઠો
૬. યોગ્ય કામગીરીની પરિસ્થિતિ અને કલ્યાણની સગવડો
૭. વસ્તુઓ અને સેવાનો નિયમિત પૂરવઠો
૮. વેચાણ પદ્ધીની નિયમિત સેવા
૯. કુદરતી સંપત્તિ અને વન્ય જીવનની જાળવણી.

૧.૬ વાતાવરણનું પ્રદૂષણ અને ધંધાની ભૂમિકા

સમાજને જાળવવા વાતાવરણને જાળવવું અગત્યનું છે અને તેથી દરેક ધંધાએ વાતાવરણને નુકસાન કરવા કરતાં જાળવવાના પગલાં ચોક્કસ લેવા જોઈએ. ચાલો, આ પ્રકરણમાં આપણે વિવિધ પ્રકારના વાતાવરણના પ્રદૂષણ અને ધંધાની ભૂમિકા વિશે શિખિએ. વાતાવરણનું પ્રદૂષણ, વાતાવરણના લાંછન (ચેપ) સંબંધિત છે. કે જેની રહેઠાણ અને બિન રહેઠાણ બાબત પર પ્રતિકુળ અસર પડે છે.

વાતાવરણના પ્રદૂષણના ત્રણ પ્રકાર છે.

૧. હવાનું પ્રદૂષણ
૨. પાણીથી પ્રદૂષણ
૩. જમીનનું પ્રદૂષણ

૧. હવાનું પ્રદૂષણ:-

આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં ઘણા ગેસનો સમાવેશ થાય છે, કચરાના કષ્ણોનો પણ સમાવેશ થાય છે. આપણા શરીરની યાંત્રિક રચના જેની જરૂર નથી અને જેની આપણા બચવા માટે જરૂર છે તેનું શુદ્ધિકરણ કરે છે. આ અન્ય કુદરતી વસ્તુઓ જેવી

વંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

કે જુંગલો, નદી વગેરે માટે સત્ય છે. આમ હવાનું પ્રદૂષણ ગમે તે બિનજરૂરી ગેસ, કચરના કણો વગેરે સાથે સંબંધ ધરાવે છે. કે જે લોકોને તેમજ કુદરતને નુકસાન પહોંચાડે છે.

હવાના પ્રદૂષણના કારણો:-

ચાલો જાણીએ કે હવા પ્રદૂષિત કેવી રીતે થાય છે. કેટલાક હવાના પ્રદૂષણના સામાન્ય કારણો છે.



હવાનું પ્રદૂષણ

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

૧. નાકમાં બળો તેવો વાહનમાંથી બહાર કાઢેલ ધૂમાડો.
૨. ઉત્પાદનના પ્લાન્ટમાંથી ધૂમાડો, કચરો અને કેમીકલ જે બહાર કાઢેલ છે.
૩. એટોમીક પ્લાન્ટમાંથી ઉદ્ભવેલ ગેસ અને કચરો.
૪. ઓઈલ રિફાઇનરી, વૃક્ષોને અને પ્લાન્ટને જુંગલમાં આગ લાગવાથી, કોલસા બાળવાથી કાઢેલ ધૂમાડો.

હવાના પ્રદૂષણની અસર:-

આપણી ચારુબાજુ હવાના પ્રદૂષણની ખૂબ જ અસર થાય છે જેમાંની કેટલીક છે.

- હવામાં ગેસની હાજરી કે જેની માનવીને જરૂર નથી. પ્રાણી અને પક્ષીને ગંભીર તબીયતના પ્રશ્નો ઉભા થાય છે. તે અસ્થમા, કદ્દ અને શરદી (હંડી), આંધળાપણું, શ્રવણશક્તિ ગુમાવવી, ચામડીના રોગો વગેરેનો ઉદ્ભવ કરે છે. તે મુણસંબંધિ ફેરફારનું કારણ બને છે. લાંબા સમયે ગંભીર બનાવમાં તે જીવલોણ પણ થઈ શકે છે.
- હવાનું પ્રદૂષણ શિયાળામાં ધૂમમસનું પણ સર્જન કરે છે. ધૂમાડો અને કચરો ધૂમર સાથે મળો છે તેકારણ છે. તે કુદરતી જોવાની શક્તિ ઘટાડે છે અને આંખમાં ખંજવાળ આવે છે અને વાચ્છો વાસને લગતી તકલીફ ઉદ્ભવે છે.
- ઓગ્રોન આવરણ આપણી પૃથ્વીને ગેસના આવરણથી બચાવે છે. જે આપણને સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણથી રક્ષણ આપે છે. તે હવાના પ્રદૂષણથી ખાલી થાય છે અને તે જીન બદલે છે. જેથી જીનેટીક ખામી અને કેન્સર થાય છે.
- હવાના પ્રદૂષણને કારણે પૃથ્વીનું તાપમાન વધે છે. આનું કારણ એ છે કે આપણી પૃથ્વી સૂર્ય પાસેથી જે કંઈ સ્વીકારે છે તે વાતાવરણમાં ગરમીના કિરણો બહાર ફેકાતા નથી તેનું કારણ એ છે કે વધુ પડતા ગેસની હાજરી જેવી કે કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રોઈડ ઓક્સાઈડ વગેરે.
- હવાનું પ્રદૂષણ ઓસીડના વરસાદનું કારણ છે જેનો અર્થ એ છે કે વરસાદના પાણીમાં વિવિધ ઝેરી ગેસની હાજરી. જેવી કે સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ વગેરે આ વેજીટેશન, વૃક્ષ અને દરિયાઈ જીવન મકાનો અને સ્મારકના નુકસાનનું કારણ બને છે.



➤ વાતાવરણ વધુ પડતા અવાજથી પણ પ્રદૂષિત થાય છે જે અવાજ પ્રદૂષણ તરીકે ઓળખાય છે. અવાજનો સરળ અથ એ છે કે વણ જોઈતો અવાજ જે શુસ્સો (કંટાળો) ઉભો કરે છે. તે આધુનિક યંત્રના બટન દ્વારા કારણભૂત બને છે. જેમ કે રેલ એન્જીન, લાઉડસ્પીકર, જનરેટર્સ, એરોલેન, વાહન, યંત્રો, ટેલીફોન, ટેલીવિઝન વગેરે તે શરૂઆતમાં માહિતી સંચારની પ્રક્રિયાની આક તિ બગાડે છે. પણ સમય જતાં અવાજનું પ્રદૂષણ શ્રવણશક્તિ ગુમાવવી, માથાનો દુખાવો, બંજવાળ, હાઈ બ્લડ પ્રેશર, ન્યુરોલોજીકલ કે માનસિક અસમતુલા વગેરે.

૨. પાણીનું પ્રદૂષણ:-

તમે દિલ્હીની યમુના નદી જોઈ છે? તમે ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટથી જાણકાર છો? આ બે પ્રશ્નો આપણને વારંવાર યાદ કરાવે છે કે કઈ નદીનું ક્યાં સુધી પાણી પ્રદૂષિત છે? પાણીનું પ્રદૂષણ તેની હાજરીથી પાણીનું લાંઘણ (અધ) ઉદભવે છે. આમ, વણજોઈતા અને નુકસાનકારક દ્રવ્યોથી આપણ ઉદ્યોગ માટે પાણી અયોગ્ય બને છે.



પાણીના પ્રદૂષણના કારણો:-

પાણી પ્રદૂષણના વિવિધ કારણો છે જેમકે,

૧. માનવ મુત્રનો નદી, કેનાલ વગેરેમાં નિકાલ કરવો.
૨. અયોગ્ય આરોગ્ય વ્યવસ્થા અને શહેર કે ઘરનો કચરો.
૩. કચરો નાંખવો અને ઔદ્યોગિક એકમનું નદીમાં અને કેનાલમાં બહાર વહેતું પાણી.
૪. ટોક્ષિક ભાગનો નિકાલ જેવા કે ખેતીમાં વપરાતા કેમીકલ અને ખાતર નદીમાં અને પાઈપમાં ઠલવાય.
૫. કચરો, મૃત શરીર અને ધર્મિક વિધીમાં વપરાતી વસ્તુ ઘર ઘરાવતા લોકો નજીકના પાણીના પુરવઠામાં નાખે છે.

પાણી પ્રદૂષણની અસરો:-

પાણી પ્રદૂષણની અસરો છે.

૧. તંદુરસ્તી સાથે માણસો, પ્રાણી અને પકી સાથે સંદૂ જેવું જોખમ છે. કારણ કે તેનાથી ટાઈફોઇન્ડ, કમળો, કોલેરા અને ગેસની તકલીફ વગેરે થાય છે.
૨. તે ઘણી બધી જીદગીને પાણીના પ્રદૂષણને લીધે જોખમમાં નાખે છે.
૩. નદીનું પાણી, કેનાલ અને ભુગર્ભનું પાણી પ્રદૂષિત થવાને કારણે પીવાના પાણીની તંગી ઉભી થાય છે.



૧.૧૦ પાઠ આધારિત પ્રશ્નો

- (૧) પાઠ્યપુસ્તકના યોગ્ય શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો.
૧. આપણી વર્તણુક બીજા માટેમાટે ન હોવી જોઈએ.
 ૨. લોકોના ઈચ્છિતા કાર્ય અને વર્તણુક સમાજમાં તરીકે ઓળખાય છે.
 ૩. ધૂંધાના આચાર ધૂંધાને વસ્તુ વેચવા માટે મંજુરી આપતા નથી.
 ૪. સામાજિક મુલ્યો, સામાજીક જવાબદારી માટે નક્કી કરે છે.
 ૫. પ્રામાણિકતાથી અને નિયમિત સરકારને કર ચુકવવો તેનું માર્ગદર્શન મળે છે.

(૨) નીચેના જોડકા જોડો

વિભાગ – અ

૧. વાતાવરણનું પ્રદૂષણ

૨. હવાનું પ્રદૂષણ

૩. પાણીનું પ્રદૂષણ

૪. ધૂમાડો

૫. એરોપ્લેન

વિભાગ – બ

૧. ધૂમાડાનું, કચરાનું અને ધૂમસનું મિશ્રણ

૨. અવાજના પ્રદૂષણ માટે જવાબદાર

૩. બિન જરૂરી ભાગ વાતાવરણમાં હોવાને કારણે તકલીફ ઉભી થાય છે.

૪. ગેસના પ્રમાણની અસમતુલ્ય અને હવામાં કચરાના ભાગ

૫. પાણીનું લાંઘન, વધુ પડતા નુકસાન ભાગને કારણે

૩. જમીન પ્રદૂષણ:-

જમીન પ્રદૂષણ બિન ઉપયોગી, બિનજરૂરી કચરો કાઢી નાંખવો તેમજ જમીનને અવરોધરૂપ તેમજ આપણે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ તેની ગુણવત્તા ઘટાડે. તેમને દુર કરવા સાથે સંબંધિત છે. આપણી જમીન માનવીની જમીન પ્રત્યેની બેદરકારીને કારણે પ્રદૂષિત થાય છે.



જમીન પ્રદૂષણ

જમીન પ્રદૂષણના મુખ્ય કારણો છે.

૧. ખાતર, કેમીકલ અને જંતુનાશક દવાનો ખેતી પર વધુ પડતો ઉપયોગ
૨. ઉદ્યોગો, ખાણ અને કવોરીના ધન કચરાનો (Solid waste) નિકાલ
૩. રસ્તો અને મકાન બાંધકામના ધન કચરાનો નિકાલ

મોડયુલ – ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



૪. જમીન દ્વારા નહી શોખાતું કેટલાક પ્લાન્ટનું બહાર વહેતું પાણી.
૫. ધોરણ વગરની વધુ પડતો પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ.
૬. ઘર, હોટલ, હોસ્પિટલ તેમજ ઉદ્યોગોનો ભેગો નહી કરેલ કચરો. આમા પ્લાસ્ટિક, કપડા, લાકડાનો સણગી ઉઠે તેવો કચરો અને ન સણગે તેવો કચરો જેવો કે ઘાતુ, કાય, સિરામીક સિમેન્ટ વગેરે

જમીન પ્રદુષણ ની અસરો:-

જમીન પ્રદુષણની નીચે મુજબ નુકસાનકારક અસરો છે :

૧. ખેતી લાયક જમીનનો વિસ્તાર ઘટાડે.
૨. આરોગ્ય માટે મુશ્કેલીરૂપ કારણ કે તે ખોરાકના સ્ત્રોતને ગંઢો કરે છે.
૩. જમીનના આકારને નુકસાનકારક.
૪. હવા અને પાણીના પ્રદુષણ તરફ દોરી જાય.

૧.૧૦ વાતાવરણ પ્રદુષણમાં ધેંધાનો ફાળો

વાતાવરણ પ્રદુષણની ઉપરોક્ત ચર્ચા પરથી એક વસ્તુ સ્પષ્ટ જણાય છે કે ધેંધો એ એક જ છે કે જે હવા, અવાજ, પાણી અને જમીનનું પ્રદુષણમાં મુખ્ય ફાળો આપે છે. ધેંધો પ્રદુષણ નીચે જણાવેલ રીતે ફેલાવે છે.

૧. યંત્રોના પ્લાન્ટમાંથી ગેસ અને ધૂમાડો કાઢે.
૨. યંત્રો અને વાહનોના ઉપયોગને કારણે અવાજનું પ્રદુષણ થાય.
૩. પ્લાન્ટ સ્થાપવા માટે જંગલની જમીન મેળવવામાં આવે જેથી બિન જંગલની જમીન થાય.
૪. ઔદ્યોગિકરણ અને શહેરીકરણનો વિકાસ.
૫. નહી અને કેનાલમાં કચરો અને વહે તે.
૬. ઘન કચરાનો ખુલ્લી જગ્યામાં નિકાલ.
૭. ખાણ અને કવોરીની પ્રવૃત્તિ.
૮. વાહન વ્યવહારનો વધુ ઉપયોગ.

ધેંધો વાતાવરણ પ્રદુષણને ત્રણ રીતે અંકુશમાં રાખી શકે. અટકાવીને, મટાડીને અને સાવચેતી રાખીને.

૧. અટકાવવાની ભૂમિકા:-

તેનો અર્થ એ કે વાતાવરણને વધુ નુકસાન ભવિષ્યમાં ન થાય તે માટેના બધા પગલાં લેવા. ધેંધાને લેવા જોઈએ. આ માટે સરકારે પ્રદુષણ માટે મુશ્કેલ અંકુશના બધા નિયમોનું ધેંધાએ પાલન કરવું જોઈએ. ધેંધાએ માનવી દ્વારા વાતાવરણને ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે આગળ આવવું જોઈએ.

વંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

૨. મટાડવાની ભૂમિકા:-

તનો અર્થ એ કે વાતાવરણને નુકસાન થયું છે તેને સુધારવામાં આવે. વધારામાં જો પ્રદૂષણ અટકાવવું શક્ય ન હોય તો સાથોસાથ મટાડવાના પગલા લેવા જોઈએ. દાખલા તરીકે વૃક્ષ વાવવા. જે ઔદ્યોગિક વિસ્તારમાં મોટે ભાગે ખાસું પ્રદૂષણ ઘટાડશે.

૩. જાગૃતતાની ભૂમિકા:-

(સાવચેતી) તનો અર્થ એ છે કે કર્મચારીનો અને સામાન્ય લોકોને પ્રદૂષણના કારણો અને સંજોગોથી માહિતગાર કરવા જીથી મરજીયાતપણે (ર્યેચિષ્ટકરીતે) તે લોકો વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે. હવે, આપણને જણાય છે કે કેટલાક વંધાકીય ગૃહોએ શહેરો અને ગ્રામદાંમાં પાર્ક અને ગાર્ડન વિકસાવવાની અને જાળવવાની જવાબદારી લીધી છે. જે બતાવે છે કે વાતાવરણની કાળજી લે છે.



૧.૧૧ પાઠ આધારિત પ્રશ્નો

૧. નીચેનામાંથી ક્યા વિધાનો સાચા છે અને ક્યા ખોટા છે ?
- અ. વધુ પડતો ખાતર, કેમીકલ્સ અને જંતુનાશક દવાનો ઉપયોગ હવાના પ્રદૂષણનું કારણ છે.
- બ. વધુ પડતા પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ જમીન પ્રદૂષણનું કારણ છે.
- ક. ઔદ્યોગિક વિસ્તારની નજીક વૃક્ષારોપણ પાણીનું પ્રદૂષણ ઘટાડે છે.
- ડ. જમીન પ્રદૂષણ દેશમાં ખેતીલાયક જમીનનો જથ્થો વધારે છે.
૩. વંધાકીય ગૃહોએ લોકોને વાતાવરણ પ્રદૂષણના કારણો અંકે સંજોગોથી જાગૃત કરવા જોઈએ.

૨. વિવિધ વિકલ્પવાળા પ્રશ્નો

- ૧) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિન આર્થિક છે.

(અ) ગ્રાહકને બ્રેડ વેચવી	(બ) પડોશીને જુનો ટેલીવીઝન વેચવો
(ક) મિત્રને ભેટ આપવી	(ઢ) પુનઃ વેચાણ માટે પુસ્તકો ખરીદવા
- ૨) નીચેનામાંથી શું વ્યવસાય નથી ?

(અ) ધંધો	(બ) વ્યવસાય
(ક) નોકરી	(ઢ) સવારે ચાલવા જવું.
- ૩) નીચેનામાંથી ક્યા વંધાના લક્ષણો નથી ?

(અ) વસ્તુનો વ્યાપાર કરવો	(બ) પિતા પુત્રને શીખવે
(ક) જોખમનો સમાવેશ અને આવકની અનિશ્ચિતતા	(ઢ) નંસો કમાવવાનો ઉદેશ
- ૪) વંધાના આર્થિક ઉદેશ સમાવેશ નથી કરતા

(અ) ગ્રાહકોનું સર્જન	(ક) રોજગારીનું સર્જન
(બ) સતત નવીની કરણ	(ઢ) સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ



- ૫) ધંધાના સામાજીક ઉદ્દેશો સમાવેશ કરે છે.
- (અ) સમાજના સામાન્ય કલ્યાણ માટે ફાળો
 - (બ) આર્થિક સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ
 - (ક) ગ્રાહકોનું સર્જન
 - (દ) નફાનું સર્જન



તમે શું શીખ્યા ?

પ્રવૃત્તિઓ કે જે માનવી દ્વારા થાય છે તેને માનવીય પ્રવૃત્તિ કહે છે. તેના બે પ્રકાર છે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ નાણા કમાવાના ઉદ્દેશથી કરાય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિ સામાજીક અને મનોવૈજ્ઞાનિક હેતુથી કરાય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય.

- આર્થિક પ્રવૃત્તિ એ કોઈ એક વ્યક્તિની રોજગારી માટે કરાય તેને રોજગાર કહેવાય. રોજગાર ત્રણ પ્રકારના છે. ૧. વ્યવસાય, ૨. નોકરી, ૩. ધંધો.
- વ્યવસાય એ એવી રોજગારી છે કે જેમાં વિશિષ્ટ જ્ઞાન અને તાલીમની જરૂર પડે છે. વ્યવસાયી સંસ્થાઓ દ્વારા જે કુંઈ આચાર સંહિતા નક્કી કરવામાં આવી હોય તેનું દરેક વ્યવસાયે પાલન કરવું પડે છે. દરેક વ્યવસાયનો પ્રાથમિક હેતુ સેવા પુરી પાડવાનો છે.
- નોકરી એ એવી રોજગારી છે જેમાં માણસ નિશ્ચિત આવકની સામે નિયમિત કામ કરે છે. તેણે માલિક દ્વારા નક્કી કરેલ નિતી નિયમોનું પાલન કરવું પડે છે.
- ધંધો એ નંખે કમાવાના ઉદ્દેશથી થતી ઉત્પાદન અથવા વેચાણ માટે માલની ખરીદી અને સેવાનું વેચાણ, નફાના હેતુથી થતી હેરફર અને વિનિમય.
- ધંધાના લક્ષણમાં નિયમિત ધોરણે વસ્તુ અને સેવાના વેચાણનો સમાવેશ થાય છે. તે નફાના આશયથી નાણાના રોકાણનો સમાવેશ કરે છે. પણ તેમાં જોખમ અને વળતરની અનિશ્ચિતતા છે.
- ધંધાનું વ્યવસ્થાતંત્ર કુંઈ પણ નિયત સમયમાં સિદ્ધ કરવા માંગે તેને ધંધાના હેતુ (લક્ષ્યાંક, ધ્યેય) કહે છે.
- ધંધાના હેતુના પ્રકાર
 - સામાજીક હેતુ
 - આર્થિક હેતુ
 - માનવીય હેતુ
 - રાષ્ટ્રીય હેતુ
 - વૈશ્વીક હેતુ
- ધંધાની સામાજીક જવાબદારી સમાજના કલ્યાણ પરત્વેની તમામ ફરજો અને કામની સાથે સંબંધિત છે.

ધૂમાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

- ધૂમાદારી માટે યોગ્ય રીતે સામાજીક જવાબદારી વિષે સમજવું યોગ્ય છે. કારણો
 - તે લોકોમાં ધૂમાની પ્રતિષ્ઠા ઉભી (Goodwill) કરે છે.
 - તે લાંબા સમય સુધી ધૂમાને પોખે છે. અને વિકાસ કરે છે.
 - તે કર્મચારીઓને સંતોષ પૂરો પાડે છે. જે સીધી રીતે ઉત્પાદકતા સાથે સંબંધિત છે.
 - ગ્રાહકો તેમના હક્કો માટે વધુ સમાન બન્યા છે.
- દરેક ધૂમો એ સમાજનો મિત્ર છે. અને ધૂમો સમાજનો દરેક ભાગ છે, જેને રસ ધરાવતા વિવિધ જીથ કહે છે. આ રસ ધરાવતા જીથ, માલિક, રોકાણકારો, કર્મચારીઓ, પૂરો પાડનાર, ગ્રાહક, હરિઝો, સરકાર અને સમાજનું બનેલું છે.
- સામાજીક મુલ્યો દર્શાવે છે કે સારું અને અપેક્ષિત, ધૂમાનો વ્યવહાર એ સમાજના શ્રેષ્ઠ હિતમાં છે.
- ધૂમાની નિતી દર્શાવે છે કે ધૂમાના કાર્યો નૈતિક ન્યાયી સિદ્ધાંતોને આધારે થવા જોઈએ.
- વાતાવરણનું પ્રદૃષ્ટણ એ વાતાવરણનું લાંછન છે કે જેના દ્વારા રહેઠાણ અને બિન રહેઠાણને પ્રતિકુળ અસર પડે છે.
- વાતાવરણ પ્રદૃષ્ટણના ત્રણ પ્રકાર છે.
 1. હવા પ્રદૃષ્ટણ
 2. પાણી પ્રદૃષ્ટણ
 3. જમીન પ્રદૃષ્ટણ
- દરેક ધૂમાએ વાતાવરણના પ્રદૃષ્ટણને અંકુશમાં રાખવા ત્રણ પ્રકારની ભૂમિકા ભજવવી પડે છે. અટકાવવાની, મટાડવાની અને જાગૃતતાની ભૂમિકા



સત્તાંત સ્વાધ્યાય

1. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિના બે ઉદાહરણ (દરેકના) આપો.
2. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત
 1. હેતુના આધારે
 2. ઉપાજ નને આધારે આપો
3. રોજગારી એટલે શું ?
4. નોકરીના બે લક્ષણો આપો.
5. વ્યવસાયના બે લક્ષણો સમજાવો.
6. 'ધૂમા'ના પદની વ્યાખ્યા આપો.
7. સુધારી કામમાં રોકાયેલ માણસને શા માટે આપણે રોજગારમાં રોકાયો છે તેમ કહીએ છીએ ?
8. મોચી પોતાને માટે જોડા બનાવતો હોય તો તેથી ધૂમામાં રોકાયેલો છે તેમ ન કહેવાય શા માટે?

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

૮. ધંધાના મુખ્ય લક્ષણોની ચર્ચા કરો.
૧૦. ધંધાનો અર્થ શું થાય? ધંધાના બે લક્ષણોનું વર્ણન કરો.
૧૧. ધંધો વ્યવસાયથી કેવી રીતે જુદો પડે છે ? ૫૦ શબ્દોમાં તેનું વર્ણન કરો.
૧૨. ધંધાની પ્રવૃત્તિની બે વિશાળ જાતનો દાખલો આપી સમજાવો.
૧૩. સામાન્ય રીતે લોકો જે વ્યવસાયમાં રોકાયેલા હોય તેવા વ્યવસાયના ત્રણ ઉદાહરણો આપી સમજાવો.
૧૪. જે પ્રવૃત્તિ વ્યવહારમાં નિયમિત થતી ન હોય તે ધંધો ન કહેવાય. તમે આ વિધાન સાથે સહમત છો : તમારા જવાબના સમર્થનમાં કારણો આપો.
૧૫. વળતરની અનિષ્ટિતતા હોવા છતાં શા માટે ધંધાદારી ધંધામાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે?
૧૬. નઝો કમાવો એ ધંધાનો મુખ્ય હેતુ છે.
૧૭. ધંધાના આર્થિક ઉદ્દેશો સમજાવો.
૧૮. ધંધાના સામાજિક ઉદ્દેશોની ગણત્રી કરો.
૧૯. ધંધાના રાષ્ટ્રીય ઉદ્દેશોનું મહત્વ સમજાવો.
૨૦. ધંધાના માનવીય ઉદ્દેશો સમજાવો અને ગણત્રી.
૨૧. ધંધાના વૈશ્વીક ઉદ્દેશો સમજાવો.
૨૨. ધંધાની સામાજિક જવાબદારીનો શું અર્થ થાય?
૨૩. જેમની સાથે રોજ બરોજની પ્રવૃત્તિ થઈ શકે તેવા રસ ધરાવતા જુથની યાદી તૈયાર કરો.
૨૪. શા માટે ધંધો સમાજને જવાબદાર છે ? ત્રણ કારણો આપો.
૨૫. ધંધાની ગ્રાહક પ્રત્યેની જવાબદારી જણાવો.
૨૬. ધંધો સરકારને કઈ રીતે જવાબદાર છે ?
૨૭. વાતાવરણ પ્રદુષણની વ્યાખ્યા આપો અને વાતાવરણ પ્રદુષણના પ્રકાર જણાવો.
૨૮. હવાના પ્રદુષણના વિવિધ કારણો સમજાવો.
૨૯. હવાના પ્રદુષણની ત્રણ અગત્યની અસરો જણાવો.
૩૦. પાણીના પ્રદુષણની શું અસરો છે ?
૩૧. ધંધો વાતાવરણને કઈ રીતે પ્રદુષિત કરે છે ? પાંચ મુદ્દા જણાવો.
૩૨. વાતાવરણ પ્રદુષણને રોકવા માટે ધંધાની ભૂમિકા જણાવો.
૩૩. બિટીશ કાળમાં ભારતીય ધંધાને આકર્ષ્યા હોય તેવા બનાવની ગણત્રી કરો.
૩૪. ભારતે વિશ્વના ધંધામાં ફણો આપ્યો છે. આના સમર્થનમાં ચાર ફણાની આધારિત બાબતો જણાવો.



પાઠ્ય આધારિત પ્રશ્નોના જવાબ

૧ . ૧
(અ)

વંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

૧. સાચું	૨. ખોટું	૩. સાચું	૪. સાચું	૫. ખોટું
(બ)				
૧. બિનઆર્થિક	૨. આર્થિક	૩. બિનઆર્થિક	૪. બિનઆર્થિક	૭. આર્થિક

૧.૨				
(અ)				
૧. રોજગાર	૨. વિશિષ્ટ જ્ઞાન	૩. નોકરી		
૪. આચાર સંહિતા	૫. માલિક			

૧.૩				
(૧)				
૧. સંમત	૨. અસંમત	૩. અસંમત	૪. સંમત	
૫. સંમત	૬. અસંમત	૭. અસંમત		
(૨)				
૧. ખોટું	૨. ખોટું	૩. સાચું	૪. ખોટું	૫. સાચું
૬. સાચું				

૧.૪				
૧. ખોટું	૨. સાચું	૩. ખોટું	૪. ખોટું	૫. ખોટું

૧.૫				
૧. ખોટું	૨. સાચું	૩. ખોટું	૪. ખોટું	૫. ખોટું

૧.૬				
૧. સાચું	૨. સાચું	૩. ખોટું	૪. ખોટું	૫. ખોટું

૧.૭				
૧. સામાજીક	૨. નિકાસ	૩. નિયમિતપણે		

૧.૮				
૧. સમાજ	૨. ઉપકાર	૩. ઉત્તરં	૪	.
મરજીયાતપણે				
૫. કલ્પના	૬. વૈ વીકરણ	૭. સામાજીક જવાબદારી	૮	.
નિરૂત્સાહી				

મોડ્યુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

ધંધાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

૧.૬	સમાજ :	૧	૩	૮
	કર્મચારીઓ :	૨	૪	૬
	ગ્રાહકો :	૫	૭	૮

૧.૧૦

(૧)

૧. નુકસાનકારક ૨. પ્રશંસનીય ૩. ભેણસેળ્યુક્ત ૪. આધાર
પ. ધંધાના નિયમો

(૨)

૧ – ૩, ૨ – ૪, ૩ – ૫, ૪ – ૧, ૫ – ૨

૧.૧૧

૧.

અ. ખોટું બ. સાચું ક. ખોટું દ. ખોટું ઈ. સાચું

૨.

(૧) ક (૨) ડ (૩) બ (૪) ક (૫) અ



તમારા માટે પ્રવૃત્તિઓ

- તમારી આજુબાજુમાંથી કામ કરતા ૧૦ માણસ વિષે શોધી બતાવે કે તે જીવવા માટે શું કરે છે? ધંધો, વ્યવસાય અને નોકરીમાં વર્ગીકૃત કરો.
- દુકાનદારને વાત કરો અથવા બીજા ધંધાદારીને વાત કરી શોધી બતાવો.
- વસ્તુ કે સેવાનો પ્રકાર કે જેમાં તે વ્યવહાર કરે છે.
➢ તે રોકાણ કરતા હોય તેવા સાધનો જેવા કે જમીન, શ્રમ, મૂડી વગેરે.
➢ નઝો કમાવવા માટે તે સામનો કરતા હોય તેવા જોખમો અને અનિશ્ચિતતા.
- પુસ્તકો, મેગેઝીન અને વર્તમાનપત્રમાંથી, વર્તમાનમાં જે અગત્યની વસ્તુની આયાત-નિકાસ થતી હોય તે એકત્રિત કરો આપણા દેશમાં વિદેશ વ્યાપાર માટે વપરાતા ઓછામાં ઓવા પાંચ બંદરોના નામ આપો.
- તમારા વિસ્તારના દુકાનદાર કે અન્ય ધંધાથી પાસેથી શોધી બતાવો કે તેમનો ધંધો ચલાવવાના તેમના ઉદ્દેશો શું છે? તમે આ પાઠમાં જે હેતુઓ વિષે શીખ્યા તે મુજબ વિવિધ પ્રકારના હેતુઓમાં વર્ગીકરણ કરો.
- તમારા વિસ્તારના દુકાનદાર દ્વારા સમાજના કલ્યાણ માટે અદા કરવામાં આવતી બે જવાબદારીઓ ઓળખી બતાવો.
- તમારું વાતાવરણ પ્રદૂષિત છે? જો હા હોય તો આ પ્રદૂષણના કારણોની યાદી બનાવો. તમે આવાતાવારણ પ્રદૂષણને અટકાવવા માટે કયા પગલાં લેવાનું સુચયવશો?

ઉદ્યોગ અને વાણિજ્ય

મોડયુલ – ૧
વાણિજ્ય પ્રકૃતિની
પૂર્વભૂમિકા



નોંધ

ધંધો એ વ્યક્તિત અથવા વ્યક્તિતના જૂથ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થિત પ્રયત્નોનું પ્રતિનિધિત્વ કરે છે. 'ધંધો' શબ્દનો જુદા જુદા લેખકો દ્વારા તેમની રીતે અર્થ કરવામાં આવ્યો છે. ઉર્વિક અને હન્ટના મત મુજબ 'ધંધો' એવું સાહસ છે કે જે કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન વિતરણ કરે છે અથવા સેવા પૂરી પાડે છે કે જેની સમાજના લોકોને જરૂર છે અને તેના નાણાં ચૂકવવા તૈયાર છે. આથી તે બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે કે જેમાં વસ્તુનું ઉત્પાદન અથવા ખરીદીનો સમાવેશ થાય છે અથવા વેચાણ દ્વારા નકો કરવાના આશયથી કેટલીક સેવાઓ લેવામાં આવે છે. ધંધો નકો કરતી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે (નો બનેલો છે) અને સાહસ આર્થિક પદ્ધતિને જરૂરી છે. તેવી વસ્તુ અને સેવા પૂરી પાડે છે.



હેતુઓ:-

આ એકમનો અભયાસ કર્યા પછી તમે કરી શકશો

- ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ
- ઉદ્યોગો અને તેના પ્રકાર
- વાણિજ્ય-વ્યપાર અને તેની સહાયકારી
- ઈ-કોમસ શબ્દની વ્યાખ્યા
- ઈ-કોમસ ના પ્રકારનું વર્ગીકરણ
- ઈ-કોમસ ના ફાયદાની ચર્ચા

૨.૧ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ

બધી ઉત્પાદકીય પ્રવૃત્તિનું મુખ્ય કારણ એ છે કે માનવીની માંગ અમર્યાદિત છે અને તેમને સંતોષવી જરૂરી છે. માનવીની માંગ ઘણી છે અને સ્વરૂપમાં ગુંચવાડા ભરી છે. જો કે માનવીની મૂળભૂત જરૂરિયાતો ત્રણ છે. દા.ત. ખોરાક, કપડાં અને રહેઠાણ. આપણો બીજી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેના સામાન્ય રીતે ઐસા ચુકવીએ છીએ. દા.ત. ટુથપેસ્ટ અને સાબુનો ઉપયોગ, બ્રેડ ખાઈએ છીએ, ફર્નિચરનો ઉપયોગ, જે કપડા પહેરીએ છીએ, ટી.વી. જોઈએ છીએ. તેવા કેટલાક ઉદાહરણો છે. તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આ બધી વસ્તુઓ તમારા સુવી કેવી રીતે આવી છે? દરેકની પાછળ લાંબી પ્રક્રિયા

મોડયુલ - ૧ વાણિજ્ય પ્રવૃત્તિની પૂર્વભૂમિકા



નોંધ

ઉદ્યોગ અને વાણિજ્ય

છે. ઉત્પાદક વપરાશકારો માટે વસ્તુ બનાવે છે. સામાન્ય રીતે ઉત્પાદક મધ્યસ્થીની મદદ લે છે. જેમ કે જથ્થાબંધ વેપારી અને છુટક વેપારી ગ્રાહક સુધી વસ્તુનું વિતરણ કરે છે.

ધંધાકીય પ્રવૃત્તિઓ વિશાળ રીતે બે વિભાગમાં વહેચી શકાય. ૧. ઉદ્યોગ અને ૨. વાણિજ્ય. ઉદ્યોગ વસ્તુ અને માલસામાનના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જ્યારે વાણિજ્ય તેના વિતરણ સાથે સંકળાયેલ છે.

૨.૨ ઉદ્યોગ

ધંધાકીય પ્રવૃત્તિની ઉત્પાદન બાજુને ઉદ્યોગ કહે છે. તે ધંધાકીય પ્રવૃત્તિ છે કે જે વૃદ્ધિ, ઉત્પાદન, પ્રક્રિયા અથવા વસ્તુના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. ઉત્પાદિત વસ્તુઓ ગ્રાહકોની (વપરાશી) વસ્તુ તેમજ ઉત્પાદકની વસ્તુ છે. વપરાશી વસ્તુ એ વસ્તુ છે કે જેનો ગ્રાહક દ્વારા છેવટે વપરાશ થાય છે. દા.ત. ખાદ્યપદાર્થ, ટેક્ષાઈલ્સ, કોસ્મેટિક્સ વગેરે ઉત્પાદકની વસ્તુ એવસ્તુ છે કે જે ઉત્પાદક દ્વારા બીજી વસ્તુના ઉત્પાદન માટે વપરાય છે. દા.ત. યંત્રો, ટુલ્સ, સાધનો વગેરે. વ્યપાર અને વાણિજ્યનો વિકાસ ઔદ્યોગિક વિકાસ પર આધાર રાખે છે. તે બજારની પુરવઠા બાજુનું પ્રતિનિધિત્વ કરે છે.



ઉદ્યોગ

'ઉદ્યોગ' શાઢ ધંધાની પ્રવૃત્તિના એ ભાગની સાથે સંબંધિત છે કે જે સંકળાયેલી છે.

- અ. બહારનો માલસામાન, જેમ કે કોલસો, કાચુ લોખંડ, પેટ્રોલીયમ (બહારનો ઉદ્યોગ કહેવાય)
- બ. કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરની પ્રક્રિયા જેમ કે સાબુ, બ્રેડ, પંખા, યંત્રો, સિમેન્ટ (ઉત્પાદન ઉદ્યોગ કહેવાય) અને
- ક. બાંધકામ પ્રવૃત્તિ જેમકે મકાનો, ડેમ, પુલ, રસ્તા વગેરે (બાંધકામ ઉદ્યોગ કહેવાય)

આમ, માનવીય પ્રવૃત્તિઓ બહાર કાઢવામાં, ઉત્પાદોમાં, પ્રક્રિયામાં, બાંધકામમાં અને વસ્તુ બનાવવામાં રોકાયેલી છે. જેનો સમાવેશ ઉદ્યોગમાં થાય. બીજી રીતે ઉદ્યોગ એટલે કારખાનું જુથ કે જે સામાન્ય રીતે વિશિષ્ટ વસ્તુના ઉત્પાદનમાં છે. દા.ત. બધા કારખાના કે જે કોટન ટેક્ષાઈલ બનાવે છે તેને સમૂહમાં કોટન ટેક્ષાઈલ ઉદ્યોગ (ઈન્ડસ્ટ્રી) કહેવાય. બધી સિમેન્ટના કારખાના સાથે સિમેન્ટ ઉદ્યોગ કહેવાય.

૨.૩ વર્ગીકરણ / ઉદ્યોગના પ્રકાર

ઉદ્યોગ અને વાણિજ્ય

ઉદ્યોગના વિવિધ પ્રકાર છે જે નીચે મુજબ છે.

૧. પ્રાથમિક ઉદ્યોગો:-

પ્રાથમિક ઉદ્યોગો કુદરતની મદદથી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તે કુદરત-આધારિત ઉદ્યોગ છે. જેમાં માનવ પ્રયાસો બહુ ઓછા છે. દા.ત. ખેતી, વાવણી, જરૂરી, મત્સ્યઉદ્યોગ, બાગકામ વગેરે.



ખેતર

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રક્રિયા
પૂર્વભૂમિકા



નોંધ

૨. ઉત્પત્તિના ઉદ્યોગો:-

ઉત્પત્તિના ઉદ્યોગો પુનઃઉત્પાદન અને કેટલાક છોડ અને પ્રાણીઓને વેચવાના હેતુથી મસાલેદાર બનાવવાના બહુવિધ ઉદ્યોગમાં રોકાયેલા છે. આ પ્રકારના વેચાણ દ્વારા નફો કમાવાનો ઉદેશ છે. દા.ત. છોડ બાગકામ, ચોપગા પ્રાણી ઉછેરવા, બતકા ઉછેર અને પ્રાણીનો ખોરાક વગેરે.



ઉત્પત્તિના ઉદ્યોગ

૩. બહાર કાઢવાના ઉદ્યોગ:-

બહાર કાઢવાના ઉદ્યોગો મારી, હવા અને પાણીમાંથી વસ્તુઓ બહાર કાઢવા સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે બહાર કાઢવાના ઉદ્યોગમાં કાચા સ્વરૂપમાં હોય છે અને તે ઉત્પાદન અને બાંધકામ ઉદ્યોગમાં તૈયાર વસ્તુના ઉત્પાદનમાં વપરાય છે. દા.ત. ખાણ ઉદ્યોગ, કોલસાની ખાણ, તેલ ઉદ્યોગ, કાચુ લોન્ડ, ટીમ્બર બહાર કાઢવું અને જરૂરી રજૂબાની રજૂબા મેળવવું વગેરે.



ખરીજ કાઢવાના ઉદ્યોગ

૪. ઉત્પાદન ઉદ્યોગ:-

ઉત્પાદન ઉદ્યોગો યંત્ર અને માનવીની મદદ દ્વારા કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવાના કાર્યમાં રોકાયેલા છે. તૈયાર માલ એ વપરાશી માલ અથવા ઉત્પાદક માલ હોય છે. દા.ત. ટેક્સટાઇલ્સ, કેમીકલ્સ (રસાયણ), ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ.



ઉત્પાદન ઉદ્યોગ

૫. બાંધકામ ઉદ્યોગ:-

બાંધકામ ઉદ્યોગ મકાનો, પુલ, રસ્તા ડેમ, કેનાલ વગેરે બાંધવાના કાર્ય હાથ પર લે છે. આ ઉદ્યોગ બીજા ઉદ્યોગ કરતા અલગ છે. કારણ કે બીજા



બાંધકામ ઉદ્યોગ

મોડયુલ - ૧ વાણિજ્ય પ્રકૃતિની પૂર્વભૂમિકા



નોંધ

ઉદ્યોગ અને વાણિજ્ય

ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન એક જગ્યાએ થાય છે અને વેચાણ બીજી જગ્યાએ (સ્થળે) થાય છે. પણ બાંધકામ ઉદ્યોગમાં એક જ જગ્યાએ ઉભી કરેલ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ એક જ જગ્યાએ થાય છે.

૫. સેવા ઉદ્યોગ:-

આધુનિક સમયમાં સેવા વિભાગ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને તેથી તે (સર્વિસ) સેવા ઉદ્યોગ તરીકે ઓળખાય છે. આ વર્ગમાં આવતા મહત્વના ઉદ્યોગોમાં હોટલ ઉદ્યોગ, પ્રવાસ ઉદ્યોગ, આનંદ પ્રમોટ ઉદ્યોગ વગરે.




સેવા ઉદ્યોગ

ઉદ્યોગ વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલો છે. જગ્યારે વાણિજ્ય જે લોકોને તે વસ્તુની જરૂર છે તેમને તે વસ્તુ પૂરી પાડવા સાથે સંકળાયેલો છે. મુખ્યત્વે વાણિજ્ય વસ્તુના વિતરણ સાથે સંકળાયેલ છે. તે એવા કાર્યનો સમાવેશ કરે છે કે જે વસ્તુના મુક્ત અને અવરોધ વગરના પ્રવાહ માટે જરૂરી હોય. આથી 'વાણિજ્ય' શબ્દમાં 'વ્યપાર' અને 'વ્યપારને મદદરૂપ' નો સમાવેશ થાય છે.

૨.૪ વાણિજ્ય

'વ્યપાર' પદ ખરીદી અને વેચાણ જણાવવા માટે વપરાય છે. આથી જે વસ્તુ ખરીદે છે અને વેચે છે તે વ્યપારી છે. વ્યપારી, ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થ છે. વ્યપાર એ જણ્ણાબંધ અથવા છૂટક હોઈ શકે. જણ્ણાબંધ વેપારી મોટા જણ્ણામાં ઉત્પાદક પાસેથી ખરીદે છે. અને નાના જણ્ણામાં છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારી કે જે જણ્ણાબંધ વ્યપારી પાસેથી ખરીદે છે અથવા કેટલીક વાર ઉત્પાદક પાસે સીધેસીધી ખરીદ કરે છે અને છેવટના ગ્રાહકને નાના જણ્ણામાં વેચાણ કરે છે.

૨.૫ વ્યપારને સહાય (વ્યપાલની સહાયકારી સેવાઓ)



આ બધી પ્રવૃત્તિઓ વસ્તુઓના પ્રવાહને ઉત્પાદન કેન્દ્રથી વપરાશી કેન્દ્ર સાથે સરળ રાખે છે. તેને સહાય અથવા વ્યપારને સહાય કહેવામાં આવે છે. વ્યપારને સહાયને પાંચ

ઉદ્યોગ અને વાણિજ્ય

વર્ગમાં વહેંચી શક્યાય ૧. વાહનવ્યવહાર, ૨. વખાર, ૩. વીમો, ૪. જાહેરાત, ૫. બેન્કિંગ (શરાફીસેવા) આને વિગતે નીચે સમજાવવામાં આવ્યા છે.

વાહનવ્યવહાર:-

ઉત્પન્ન કરેલ બધો માલ ઉત્પાદિત જગ્યાએ અથવા તે ઉત્પાદન કેન્દ્રની નજીક વેચવો સરળ નથી. આથી વસ્તુની જ્યાં માંગ હોય ત્યાં મોકલવામાં આવે છે. માનવી અને માલને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે (લઈ જવા માટે) જે માધ્યમનો ઉપયોગ થાય છે તેને હેરફેર અથવા પરિવહન કહે છે. પરિવહન ત્રણ પ્રકારના છે.

૧. જમીન પરિવહન – રસ્તા, રેલવે
૨. હવાઈ પરિવહન – વિમાન
૩. જળ પરિવહન – જહાજ, વહાણ

વખાર:-

મોટા પાયા પરના ઉત્પાદનના સમયમાં સંગ્રહ એ અનિવાર્ય બની ગયો છે. વસ્તુનું ઉત્પાદન થાય ત્યારથી વસ્તુ વેચાય નહિ તે સમય દરમ્યાન તેનો કાળજીપુર્વક સંગ્રહ થવો જોઈએ. તેથી તેને વખારની જરૂર છે. વખારને ગોડાઉન (કોઠાર) પણ કહે છે.

વીમો:-

વસ્તુઓને ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન અથવા હેરફેર દરમ્યાન અક્સમાતને કારણે અથવા આગ કે ચોરીને કારણે નુકસાન થાય છે. વ્યપારીને આ જોખમ સામે રક્ષણ મેળવવું પસંદ છે. વીમા કંપનીઓ આ બાબતમાં બચાવ કરવા આવે છે. તે આવા જોખમથી થતા નુકસાન સામે વળતરની બંદેઘરી આપે છે. આ હેતુ માટે ધેરાએ 'વીમા પોલિસી' લેવી પડે છે અને ચોક્કસ રકમ નિયમિત રીતે ચૂકવવી પડે છે. જેને 'પ્રિમિયમ' કહે છે.

જાહેરાત:-

જાહેરખબર વસ્તુના વેચાણ માટે અસરકારક સાધન છે. ઉત્પાદક જાહેરાત દ્વારા તેની વસ્તુની બધી માહિતી અપોક્ષિત ગ્રાહકો સુધી પહોંચાડે છે. અને તેમનામાં વસ્તુ ખરીદવા માટેની તીવ્ય ઈચ્છા ઉભી કરે છે. જાહેરાત જુદી જુદી રીતે કરાય છે. તે આંતરિક (બારણાની અંદર) અથવા બાહ્ય (બારણા બહાર) થઈ શકે. જાહેરાત દ્વારા લોકો સાથે જ્યારે તે તેમના ધેર હોય ત્યારે માહિતી અપાય તેને (ઇનડોર) આંતરિક જાહેરાત કહેવાય. આ પ્રકારના ઉદાહરણોમાં વર્તમાનપત્ર, રેડિયો, ટેલીવિઝન વગેરે દ્વારા જાહેરાત લોકો જ્યારે તેમના ઘરની બહાર હોય ત્યારે માહિતી અપાય તેને (આઉટડોર) બાહ્ય જાહેરાત કહેવાય. આ પ્રકારના ઉદાહરણોમાં સિનેમા થિયેટર, ભીત પત્રો અને મુખ્ય જગ્યાએ ઉચા પાટીયાની દિવાલ પર જાહેરાત કરાય.

બેન્કિંગ (શરાફીસેવા):-

મોડયુલ – ૧
વાણિજ્ય પ્રક્રિયા
પૂર્વભૂમિકા



નોંધ



હાલના દિવસોમાં આપણે ધેંધાની સાથે બેક જોડાયેલ ન હોય તેવો વિચાર કરી ન શકીએ. ધેંધો શરૂ કરવા માટે અથવા ધેંધો સરળતાથી ચલાવવા માટે આપણને નાણાની જરૂર રહે છે. બેક નાણાં પૂરા પાડે છે. બેક એ એવું વ્યવસ્થાતંત્ર છે જે લોકોમાંથી (જનતા પાસેથી) થાપણો સ્વીકારે છે, જરૂરિયાત સમયે નાણા ઉપાડી શકાય છે નહિ તો અને જેને જરૂર છે તેમને નાણા ધીરે છે. બેક ધેંધાની પ્રવૃત્તિને જરૂર હોય તેવી સેવાઓ પૂરી પાડે છે. અહીં, અને ધેંધાની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે.



2.૧ પાઠ આધારિત પ્રશ્નો

૧. સાચા વિકલ્પ સામે ✓ કરો.
 ૧. ઉદ્યોગ, ઉત્પાદન / વિતરણ સાથે સંકળાયેલ છે.
 ૨. વાણિજ્ય મુખ્યત્વે ઉત્પાદન / વિતરણ સાથે સંબંધ ધરાવે છે.
 ૩. જે મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે અને વેચે તે જથ્થાબંધ વેપારી / છુટક વેપારી છે.
 ૪. માનવી અને માલસામાનના જે માધ્યમ એક સ્થળોથી બીજે સ્થળે હેરફર કરે તેને વીમો / પરિવહન કહે છે.
૨. દાલમિયા ઓઈલ શુદ્ધ કરેલ તેલ બનાવે છે. સમગ્ર ઉત્પાદન રૂચિ ઓઈલ ડીપો દ્વારા હાથ ધરાય છે. કે જે છુટક વેપારીને વેચે છે. શ્રીમતી પ્રિતી, બાલાજી ગ્રોસરીમાંથી ૨ કિલો તેલ ખરીદે છે.
- નીચે જણાવેલના નામ આપો:
- | | |
|--------------------|-------|
| ૧. ઉત્પાદક | |
| ૨. જથ્થાબંધ વેપારી | |
| ૩. છુટક વેપારી | |
| ૪. ગ્રાહક | |

2.૭ ઈ-કોમર્સ (વાણિજ્ય)નો અર્થ અને વ્યાખ્યા

ઇન્ટરનેટથી ઉદ્યોગો સમૃદ્ધ થયા છે. જે ઝડપી ગતિઓ પ્રગતિ થઈ છે. તેમ તેમ વધુને વધુ લોકો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ખોલતાં થયાં છે. (વાપરતા થયા છે.) તેઓ તેમની રોજ બરોજની જરૂરિયાત માટે ઇન્ટરનેટનો ઉપયોગ વધારતા થયા છે. અહીં ઈ-કોમર્સ વેબસાઈટે લાખો લોકોને તેમની વસ્તુ અને સેવા શોધવા માટે ઓનલાઈન તરફ વળ્યા છે. આને સરળ ભાષામાં મુકીએ તો ઈ-કોમર્સ અથવા ઈલેક્ટ્રોનિક કોમર્સ એટલે ઇન્ટરનેટ દ્વારા વસ્તુ અને સેવાની ખરીદી અને વેચાણ. ધેંધામાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઈ-કોમર્સની નવી પદ્ધતિ દ્વારા કંપનીને કેટલો લાભ થશે તેનો વિચાર કરવો વ્યાજબી છે. તેથી તમારે સૌ પ્રથમ એ જાણવાની જરૂર છે કે તમારા ધેંધાના પ્રકાર પ્રમાણે વેબસાઈટ સાથેના ઈ-કોમર્સના લક્ષણો છે.

ઉદ્યોગ અને વાણિજ્ય

પ્રશ્નાનુંનાં હંધોકાને ઈ-હંધા પ્રક્રિયાની વિવરાઓ	ઈ-હંધો
૧. રચના	અધરી
૨. શારિરિક હાજરી	જરૂરી
૩. સ્થાપના ખર્ચ	વધુ
૪. ચલાવવાનો ખર્ચ	પ્રાપ્તિ, માર્કેટીંગ અને વિતરણમાં વધુ રોકાણ તેથી ખર્ચ વધુ
૫. વ્યવહારનો સમય	વધુ
૬. આંતરિક અંગત સંપર્કની તક	વધુ
૭. હંધાકીય ચકની લંબાઈ	લાંબી કારણ કે વિવિધ હંધાકીય પ્રક્રિયા સાથે ઘરેણાં જેવા સંબંધો રહે છે.
૮. સરકારી મદદ	ઓછી
૯. વૈશીક સંશોધન	ઓછું

મોડયુલ – ૧
વાણિજ્ય પ્રક્રિયા
પૂર્વભૂમિકા



નોંધ

(ઈ-કોમર્સ અથવા ઈલેક્ટ્રોનિક કોમર્સ) વિજાળુને લગતું વાણિજ્ય ઈ-હંધાનો પેટા વિભાગ છે. જેમાં ખરીદી વેચાણ અને માલ અને સેવાની હેરફર કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા (જેમ કે ઈન્ટરનેટ) કે જેમાં વેચાણના વ્યવહારો અથવા શરતો ઈલેક્ટ્રોનિકલી થાય છે. વ્યવહારમાં આ પર્યાય નવો પર્યાય ઈ-હંધો વારંવાર પરસ્પર વપરાય છે.

ઈલેક્ટ્રોનિક કોમર્સ એ ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા થતો નાણાકીય વ્યવહાર છે. હંધાની ઈન્ટરનેટ દ્વારા જબરજસ્ત સફળતાને કારણે ઈ-કોમર્સ સામાન્ય રીતે વિશ્વવ્યાપી વેબ દ્વારા ઓનલાઈન ખરીદી માટે વપરાય છે. જે ઈ-કોમર્સ (વેબસાઈટ) તરીકે ઓળખાય છે. ઈ-કોમર્સને મુખ્યત્વે ચાર વર્ગમાં વહેંચવામાં આવે છે. બી2બી, બી2સી, સી2બી અને સી2સી

૨.૮ ઈ-કોમર્સના પ્રકાર

ઈ-કોમર્સનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે.

બી2બી (હંધાથી હંધો):-

કંપની એક બીજા સાથે હંધો કરે છે જેમકે ઉત્પાદક વિતરકને વેચાણ કરે અને જથ્થાબંધ વેપારી, છુટક વેપારીને વેચાણ કરે કિંમત જથ્થાના ઓર્ડર આધ્યારિત હોય છે અને વારંવાર વાટઘાટ દ્વારા ફેરફાર થઈ શકે છે.



બી2સી (ધંધાથી ગ્રાહક):-

ધંધાઓ સામાન્ય રીતે સામાન્ય જનતાને શોપીંગ કાર્ટ સોફ્ટવેર ટ્રાન્સકનો ઉપયોગ કરી કેટલોગ દ્વારા (ભાવપત્રક) વેચાણ કરે છે. બી2બી. ડોલરના જથ્થા દ્વારા કિંમત લે છે અને ગ્રાહકો વ્યવહાર કરે છે.

ધંધા	ધંધા	ગ્રાહકો
	બી2બી	સી2બી
ગ્રાહકો	બી2સી	સી2સી

ઈ-કોમર્સના પ્રકાર

ગ્રાહક ઓનલાઈન પર નક્કી કરેલ અંદાજપત્ર સાથે તેનો પ્રોજેક્ટ મુકે છે. અને કલાકોના કંપની ગ્રાહકની જરૂરિયાત પ્રોજેક્ટના બીડ પર ફેર તપાસણી કરે છે. ગ્રાહક બીડની ફેર તપાસણી કરે છે. અને જે કંપની પ્રોજેક્ટ પૂરો કરી શકે તેને પસંદ કરે છે. સી2બી ગ્રાહકોને સમગ્ર વિશ્વમાં મુલાકાત માટેનું સ્થળ અને આવા વ્યવહાર માટેની જગ્યા આપી સક્ષમ બનાવે છે.

સી2સી (ગ્રાહકથી ગ્રાહક):-

અહીં ઘણી બધી સાઈટ્સ (જગ્યા) છે કે જે વિનામૂલ્યે વર્ગીકૃત હરાજી અને ફોરમની પ્રસ્તાવ મુકે છે. જેના વ્યક્તિગત ઓન લાઈન પેમેન્ટ દ્વારા વસ્તુની ખરીદી અને વેચાણ કરે છે. જેમ કે બીલની ચૂકવણી જગ્યાં લોકો નાણાની લેવડટેવડ ઓનલાઈન પર સરળતાથી કરી શકે છે. ઈ-બોઝ હરાજીની સેવા શ્રોષ ઉદાહરણ છે. જેમાં ૧૮૫૫થી વ્યક્તિત્વી વ્યક્તિ દરરોજ વ્યવહારો થાય છે. કંપની તેમના કર્મચારીઓના ઉત્પાદન અને સેવાને મૂકવા માટે આંતરિક નેટવર્કનો ઉપયોગ કરે છે. એવું જરૂરી નથી કે ઓનલાઈન પરની વેબ બી2ઈ સાથે (ધંધાથી નોકર) સાથે ઈ-કોમર્સમાં સંકળાયેલ હોય.

સરકાર સાથે ઈ-વાણિજ્યના અન્ય સ્વરૂપો સંકળાયેલ છે. જે ધંધાના રીટાર્ન મેળવવાથી ફાઈલ કરવા અને ધંધાની નોંધણીના લાયસન્સ રીન્યુ કરાવવા ઈ-કોમર્સના બીજા વર્ગ પણ છે. પણ તે અતિશયોક્કિન ભરેલા છે. તેમના કેટલાક છે. જી2જી (સરકારથી સરકાર) જી2ઈ (સરકારથી કર્મચારી) જી2બી (સરકારથી ધંધો) બી2જી (ધંધાથી સરકાર) જી2સી (સરકારથી નાગરિક) સી2જી (નાગરિકથી સરકાર)

૨.૯ ઈ-કોમર્સના ફાયદા

હવે તમને લાગ્યું હશે કે ધંધાના વ્યવહારો ઈલેક્ટ્રોનિકલી (વિજાણુ) દ્વારા થાય તો તેનું વિશ્વાણ કાય ક્ષેત્ર છે. ઈ-કોમર્સ નો અમલ જથ્થાબંધ તેમજ છુટક વેપારમાં થાય છે. ઈન્ટરનેટ દ્વારા ખરીદ-વેચાણ ઘડિયાળના કાંટે વિ વના જુદા જુદા ભાગોમાં થાય છે. ચાલો, ઈ-કોમર્સ ના ફાયદાની ચચા કરીએ.

૧. વિશ્વાણ પસંદગી:-

ઉદ્યોગ અને વાણિજ્ય

સુવિકસીત કોમ્પ્યુટર નેટવર્કિંગ પદ્ધતિની મદદથી ધંધાકીય એકમો દેશ તેમજ વૈશ્વીક સરે ક્રમ કરી શકે છે. આમ ગ્રાહકને વસ્તુ અને સેવાની વિશ્લેષણ શ્રેણીની પસંદગી છે. ધંધાદારી પણ તેમની વસ્તુઓ અને સેવા માટે વધુ વિશ્લેષણ બજાર મેળવે છે.

૨. ગ્રાહકની સેવામાં સુધારો:-

વસ્તુ અને સેવાના વિતરકો વસ્તુના વેચાણ સમયે અને વસ્તુના વેચાણ પછી વિવિધ શ્રેણીમાં સેવાઓ આપી શકે છે. જેમ કે વસ્તુ વિષે માહિતી ઉપયોગ માટે માર્ગદર્શન અને વસ્તુની ગુણવત્તા અને ઉપયોગ માટે ગ્રાહક પુછપરછ.

૩. ગ્રાહકની જરૂરિયાતનો તરકાળ જવાબ:-

સામાન્ય પ્રક્રિયાવાળી ખરીદી અને વેચાણ કરતા ઈ-કોમર્સના ધંધાકીય વ્યવહારો ધણો ઓછો સમય લે છે. કારણ કે ઉત્પાદકો વિતરણનો માંગ ટુંકાવી દે છે. અને વસ્તુ અને સેવા ગ્રાહકને સીધી પૂરી પાડે છે.

૪. ખર્ચમાં બચત અને કિંમતમાં ઘટાડો:-

ઈ-કોમર્સ દ્વારા થતા વ્યવહારમાં નોંધપાત્ર રીતે ખર્ચમાં ઘટાડો થાય છે. અહીં શોરૂમમાં વસ્તુઓ દર્શાવવાની કે વખારમાં મોટા પાયે માલનો સ્ટોક રાખવાની જરૂર નથી. ધંધો ચલાવવા માટે બહુ ઓછા કર્મચારીઓની જરૂર પડે છે. આમ સ્વભાવિક રીતે ધંધો ચલાવવાનો ખર્ચ ઘટી જાય છે. આથી ગ્રાહકોને નીચા ભાવે વસ્તુ મળી શકે છે.

૫. બજાર માહિતી:-

ઈન્ટરનેટના પ્રવેશથી બજારની માહિતી ધંધાને મળે છે. જેનાથી એકમ ગ્રાહકની વિવિધ જરૂરિયાતોને જાણી શકે છે અને નવી વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. અને વધુ સારી સેવા આપી શકે છે.



૨.૨ પાઠ આધારિત પ્રશ્નો

બહુવિધ વિકલ્પવાળા પ્રશ્નો

૧. જે ઉદ્યોગો પ્લાનનો ઉછીર કરવામાં રોકાયેલા છે તે ઓળખાય છે.
અ. બાંધકામ ઉદ્યોગ ક. બધાર કાઢવાનો ઉદ્યોગ
બ. ઉત્પાદન ઉદ્યોગ ડ. જનનશાસ્ત્રનો ઉદ્યોગ (મૂળસંબંધી)
૨. જે ઉદ્યોગો મકાન, રસ્તા અને પુલના બાંધકામમાં રોકાયેલા છે તે ઓળખાય છે.
અ. બાંધકામ ઉદ્યોગ ક. બધાર કાઢવાનો ઉદ્યોગ
બ. ઉત્પાદન ઉદ્યોગ ડ. જનનશાસ્ત્રનો (મૂળસંબંધી) ઉદ્યોગ

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રક્રિયા
પૂર્વભૂમિકા



નોંધ



૩. ઈ—કોમર્સનો અર્થ છે. વસ્તુઓ અને સેવાની ખરીદી
 અ. ઈલેક્ટ્રોનિકલી ક. ટપાલ ઓફિસ દ્વારા
 બ. વ્યક્તિગત દ. ટી. વી. દ્વારા

૪. વ્યપારને સહાયમાં સમાવેશ થાય છે.
 અ. બેન્કિંગ (શરાકી ધંધો) ક. ખરીદી
 બ. ઉત્પાદન દ. વેચાણ

૫. ઈ—કોમર્સ સમાવેશ નથી કરતું.
 અ. બીજી અ. બ. બીજી ક. બીજી દ. જીદ્દી



તમે શું શીખ્યા ?

નફો કમાવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરાય તેને ધંધો કહેવાય. વ્યક્તિ કે જે ધંધામાં રોકાયેલો છે તેને ધંધાદાર કહેવાય ધંધાની પ્રવૃત્તિને વિશાળ રીતે બે વર્ગમાં વહેચાય છે. – ઉદ્યોગ અને વાણિજ્ય ઉદ્યોગ એ માલની પ્રક્રિયા અને વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. વાણિજ્ય તે માલ અને વસ્તુના વિતરણ સાથે સંકળાયેલ છે.

વाणिज्य विशाळ અર्थમાં વ્યપાર અને વ્યપારને સહાય બનેનો સમાવેશ કરે છે. વ્યપાર એ ખરીદી અને વેચાણની પ્રક્રિયા છે. વ્યપારને મદદરૂપ થવાના હેતુથી પ્રવૃત્તિઓ જેવી કે પરિવહન, વખાર, વીમાં, આહેરાત, બેન્કિંગ વગેરે જરૂરી છે. આને સહાય અથવા વંધાને સહાય કરે છે.



સત્રાંત પ્રશ્નો

1. ધૂંઘાનો તમે શું અર્થ કરો છો ? ધૂંઘાની વિવિધ પ્રવૃત્તિના પ્રકાર સમજાવો.
 2. 'ઈ-કોમર્સ' ની વ્યાખ્યા આપો તેના ફાયદા ચર્ચો.
 3. ઉદ્યોગનો શું અર્થ થાય? વિવિધ પ્રકારના ઉદ્યોગની ચર્ચા કરો.
 4. 'ઈ-કોમર્સ' ના શું પ્રકાર છે ?
 5. વેપારને સહાયનો શું અર્થ થાય? સમજાવો.
 6. ધૂંઘાદારી તરીકે તમે ધૂંઘાના રોજીદા વ્યવહારમાં તમે કઈ વિવિધ સહાયનો ઉપયોગ કરો છો. ચર્ચા કરો.

ઉદ્યોગ અને વાણિજ્ય



પાઠ્ય આધારિત પ્રશ્નોના જવાબ

૨.૧

(૧)

૧. ઉત્પાદન ૨. વિતરણ
૩. જથ્થાબંધ વેચનાર ૪. પરિવહન

(૨)

૧. દાલમિયા ઓર્ડલમીલ
૩. બાલાજી ગ્રોસરી (કરિયાણ)
૨. રૂચિ ઓર્ડલ ડીપો
૪. શ્રીમતી પ્રિતી

૨.૨

૧. ઢી ૨. અ ૩. અ ૪. અ ૫. અ



તમારા માટે પ્રવૃત્તિઓ

તમારા વિસ્તારમાં ચલાવાતી પાંચ ધંધકીય પ્રવૃત્તિઓ ઓળખી બતાવો. તેમને 'ઉદ્યોગ' અને 'વાણિજ્ય' માં વર્ગીકૃત કરો. વળી, ઉદ્યોગમાં તમે કહી શકશો કે તે પ્રાથમિક, માધ્યમિક અથવા ત્રીજો ઉદ્યોગ છે.

મોડયુલ - ૧
વાણિજ્ય પ્રવૃત્તિની
પૂર્વભૂમિકા



નોંધ

મોડયુલ - ૨

મહત્તમ માર્ક

૧૫

અભ્યાસના કલાક

૩૫

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો

ધંધાના કદ, માલિકી હક્ક અને સંચાલક્ય જરૂરિયાતોને આધીન ધંધાકીય માળખાના પ્રકાર છે. આ મોડયુલના અભ્યાસ બાદ વિદ્યાર્થી ધંધાકીય સાહસનો અર્થ, પ્રકાર અને વિવિધ સ્વરૂપો જેવાકે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની (સંયુક્ત હિસ્સાવાળી કંપની) વગરેનું શાન મેળવી શકશે.

- પાઠ - ૩ : એકાકી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કુટુંબ
- પાઠ - ૪ : સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની



વૈયક્તિક માલિકી (એક જ માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

આપણે આપણી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા બજારમાં જઈએ છીએ. આપણે બજારમાં વિવિધ પ્રકારની દુકાનો જોઈએ છીએ, તેમાંની કેટલીક નાની અને કેટલીક મોટી હોય છે. આપણે કેટલીક વ્યક્તિત્વોને શાકભાજી, ચોખા, કઠોળ, સીગ, છાપા વેચતા રસ્તાબાજુ જોઈએ છીએ. આપણને જુતા રીપેર કરતા મોચી ફુટપાથ પર મળે છે. દરરોજ તમે તમારા વિસ્તારમાં આવી દુકાનો જોતા હશો. પણ તમે કદી એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ ધંધા કેવી રીતે ચાલે છે? આવા ધંધાઓના કોણ માલિકો છે? ધંધાના માલિક કોઈપણ ધંધા માટે ચોકકસ પણે શું કરે છે? તમે એમ કહેશો કે માલિક ધંધો શરૂ કરવા મૂડીનું રોકાણ કરે છે, ધંધાને લગતા બધા નિર્ણયો લે છે. ધંધાના રોજ બરોજના કાર્યો પર દેખરેખ રાખે છે અને છેવટે નફો કે નુકસાન માટે જવાબદાર છે. હા, તમે સાચા છો. માલિક ચોકકસપણે આ બધી વસ્તુઓ કરે છે. તમે થોડાક આગળ જશો (ઉડા જશો) તમને જણાશો કે કેટલાક ધંધાઓમાં એક જ વ્યક્તિ આ બધા જ કાર્યો કરે છે. આને વૈયક્તિક માલિકી અથવા એકાકી વેપાર કરે છે. કેટલાક ધંધાઓમાં વ્યક્તિત્વત જુથ સાથે મળીને ધંધાના માલિક બને છે અને નફો કે નુકસાન વહેંચે છે. આ બાજુ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેને ભાગીદારી કહે છે. અન્ય બીજુ ધંધાનું સ્વરૂપ છે કે જેમાં સંયુક્ત હિંદુ કુટુંબના સત્યો માલિકી ધરાવે છે કે જેમાં કુટુંબ વારસાગત મિલકત ધરાવે છે. આ 'હિંદુ અવિભક્ત કુટુંબના ધંધા' તરીકે જાણીતું છે.

આ પાઠમાં ચાલો, ધંધાકીય વ્યવસ્થાના આ સ્વરૂપો વિષે વધુ વિગતો મેળવીએ.



કેતુઓ:-

આ પાઠનો અભ્યાસ કર્યા પછી તેમે કહી શકશો.

- ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ વૈયક્તિક માલિકીનો અર્થ સમજાવો.
- વૈયક્તિક માલિકીના લક્ષણોની યાદી આપો.
- એકાકી વેપારના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો.
- ભાગીદારી પેઢીનો અર્થ સમજો.
- ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગીદારી પેઢીના લક્ષણો (ખાસિયતો) ઓળખી બતાવો.

એકાકી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કટુંબ

- ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગીદારી પેઢીના ફાયદા અને ગેરફાયદા જણાવો.
- મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીનો ખ્યાલ સમજાવો.
- સંયુક્ત હિન્દુ કુટુંબનો ધંધો તેના લક્ષણો, ફાયદા અને ગેરફાયદા સાથે સમજાવો.

૩.૧ વૈયક્તિક માલિકીનો અર્થ

વૈયક્તિક (sole)નો અર્થ વ્યક્તિગત અને 'માલિકીપણા' (Proprietorship) નો અર્થ 'ધંધીપણું'. આપો અર્થ એ થાય કે એક વ્યક્તિ અથવા 'વ્યક્તિગત' ધંધાના માલિક હોય, સંચાલન કરે અને ધંધાની બધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખે તેને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 'વૈયક્તિક માલિકી' (એકાકી વેપાર) તરીકે જાણવામાં આવે છે. વ્યક્તિગત કે જે ધંધાનો માલિક છે અને પોતાની માલિકીનો ધંધો ચલાવે છે. તેને 'એક જ માલિકી' અથવા 'એક જ વેપારી' કહે છે. વૈયક્તિક માલિકી સાધનો (સ્ત્રોત) ખેચી લાવે છે અને વ્યક્તિગત રીતે તેની વ્યવસ્થા કરે છે અને નફો ક્રમાવાના આશય સાથે તેની પર અંકુશ રાખે છે.



વૈયક્તિક માલિકી

મોડયુલ - ૨ વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

૩.૨ વૈયક્તિક માલિકીના લક્ષણો (એકાકી વેપાર)

વૈયક્તિક માલિકીના નીચે મુજબ લક્ષણો છે.

૧. સ્થાપનાની (રચનાની) સરળતા:-

માલિકના સ્વરૂપની આદર્શ બાબત એ છે કે તેની સ્થાપના સરળ હોવી જોઈએ.
સરળ રચના સૂચિવે છે કે ન્યૂનતમ કાયદાની અને અન્ય કાર્યવાહી છે. વૈયક્તિક માલિકીની રચના ખૂબ સરળ છે.

૨. એક જ માલિકીપણું:-

એક જ વ્યક્તિ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 'વૈયક્તિક માલિકી' ની માલિકી ધરાવે છે. તે એક જ વ્યક્તિ ધંધાની બધી મિલતો અને સંપત્તિ ધરાવે છે. તેથી તે ધંધાના બધા જોખમો ધરાવે છે. આમ એકાકી વેપારીની ઈચ્છા મુજબ અથવા તેનું મૃત્યુ થાય તો તેનો અંત આવે છે.

૩. નફો અને નુકસાનની કોઈ વહેંચણી નહિએ:-

વૈયક્તિક માલિકીવાળા ધંધાનો જે કંણ નફો થાય છે તે ધંધાના એક જ માલિકને જાય છે. જો ધંધામાં નુકસાન જાય તો પણ તે વૈયક્તિક માલિકે જ ભોગવવાનું

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાકી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્હુ અવિભક્ત કટુંબ

૩. ધંધાના વ્યક્તિગત માલિક સાથે કોઈપણ બીજી વ્યક્તિ નફો કે નુકસાન વહેચાતી નથી.
૪. એક જ વ્યક્તિની મૂડીઃ—
ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ એવા 'વૈયક્તિક માલિકી' માં જરૂરી મૂડીની વ્યવસ્થા એક જ માલિક દ્વારા થાય છે. તે ક્યાં તો પોતાના અંગત સાધનોમાંથી અથવા મિત્રો સગાબાલા, બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થાઓમાંથી ઉધીના મેળવે છે.
૫. એક વ્યક્તિનો અંકુશઃ—
વૈયક્તિક માલિકીવાળા ધંધામાં અંકુશની સત્તા પણ માલિક પાસે જ રહે છે. ધંધાનો માલિક અથવા પ્રોપરાયટર ધંધો ચલાવવા અંગેના સઘણા નિર્ણયો લે છે.
૬. અમર્યાદિત જવાબદારીઃ—
એકાકી વેપારીની જવાબદારી અમર્યાદિત છે. આનો એ અર્થ થાય કે જો નુકસાન થાય તો ધંધાની મિલકતો સાથે માલિકની અંગત મિલકતોનો ઉપયોગ પણ ધંધાની જવાબદારી માટે વપરાય છે.

૩.૩ વૈયક્તિક માલિકી (એક જ માલિકી)ના ફાયદા

આપણા દેશમાં ધંધાનું વૈયક્તિક માલિકીનું સ્વરૂપ ખૂબ જ સરળ અને સામાન્ય છે.

૧. રચના અને વિસર્જન સરળઃ—
ધંધાકીય વ્યવસ્થાનું વૈયક્તિક માલિકીની રચના કરવી ખૂબ જ સરળ છે. ખૂબ ઓછી મૂડીથી એક જ જ્ઞાન ધંધો શરૂ કરી શકે છે. કાયદાની પ્રક્રિયા લઘુત્તમ છે. રચનાની (સ્થાપના) માફક ધંધો બંધ કરવાનું (વિસર્જન) પણ સરળ છે. માલિકની મરજી પર આધારિત છે કે ધંધો કયારે શરૂ કરવો અને કયારે બંધ કરવો.
૨. પ્રત્યક્ષ અભિપ્રેરણ (પ્રોત્સાહન)ઃ—
ધંધા દ્વારા કમાયેલ નફાનો માલિક 'વૈયક્તિક માલિક' (એક જ માલિક) છે તે જ રીતે ધંધાના નુકસાનનું જોખમ પણ તે ધરાવે છે. આમ પ્રયત્ન અને બદલા વચ્ચેનું જોડાણ પ્રત્યક્ષ છે. જો તે સખત કામ કરે તો નફો મળવાની શક્યતા વધુ હોય છે. અને તેનાથી વિપરિત આ વૈયક્તિક માલિકને સખત કામ કરવાની પ્રેરણા આપે છે.
૩. તત્કાલ નિર્ણય અને ઝડપી પગલાઃ—
વૈયક્તિક માલિકી વાળા ધંધામાં બધા જ નિર્ણય માટે એક જ માલિક જવાબદાર હોય છે. તેથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈનો પણ સમાવેશ થતો નથી. તેથી તત્કાળ અને ઝડપી પગલા લીધેલા નિર્ણયના સંદર્ભમાં લઈ શકાય છે.
૪. વધુ સારો અંકુશઃ—
એક માલિકીવાળા ધંધામાં, ધંધાની દરેકે દરેક પ્રવૃત્તિઓ પર માલિકનો અંકુશ હોય છે. તે પોતે જ આયોજક તેમજ વ્યવસ્થાપક છે કે જે દરેક પ્રવૃત્તિનું કુશળતાપૂર્વક

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કટુંબ

સંચાલન કરે છે. આમ માલિક પાસે ધંધા પર વધુ સારો અંકુશ રાખવા બધી જ સત્તા છે.

૫. ધંધાના રહસ્યોની જાળવણી:-

એક જ માલિકીવાળા ધંધામાં માલિકનું સ્થાન એવું છે કે જેમાં તે આયોજન પોતે કરે છે અને સંચાલન તેમજ અંકુશ પણ તેના હાથમાં છે. આથી ધંધાનું રહસ્યોની જાણ બીજાને કરવાની જરૂર રહેતી નથી.

૬. અંગત વ્યક્તિગત સંબંધ:-

વૈયક્તિક માલિક, ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સારો સંબંધ રાખવાની સ્થિતિમાં છે. એકાડી વેપારી પ્રત્યક્ષ સંપર્કને કારણે ગ્રાહકોના ગમા અણગમા અને રૂચિ (taste) જાણી શકે છે. આ કર્મચારીઓ સાથે સઘન અને મિત્રાચારીના સંબંધ જાળવવામાં મદદ કરે છે. અને આમ ધંધો સરળતાથી ચાલે છે.

૭. સ્વરોજગારી પૂરી પાડે છે:-

ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ વૈયક્તિક માલિકી લોકોને સ્વરોજગારીની તક પૂરી પાડે છે. માત્ર માલિક જ સ્વ-રોજગારીમાં નથી. કેટલીક વાર તે બીજા માટે પણ કાર્યની તક પૂરી પાડે છે. તમે વિવિધ દૂકાનોમાં જોયું હશે કે ઘણા બધા કર્મચારીઓ માલિકને ગ્રાહક સુધી વસ્તુઓ વેચવામાં મદદ કરે છે. આમ તે ગરીબી ઘટાડવામાં અને દેશમાં બેરોજગારી ઓછી કરવામાં મદદ કરે છે.

૩.૪ એક જ માલિકીના ગેરફાયદા (મર્યાદાઓ)

એક જ માણસનો ધંધો ધંધાકીય વ્યવસ્થાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. તેમ ઉપર ચર્ચેલ ફાયદાથી કહી શકાય જો કે બધા પ્રકારની માલિકીને કેટલીક મર્યાદાઓ હોય છે અને વૈયક્તિક માલિકી તેમાં અપવાદ નથી. ચાલો, તે મર્યાદાઓ શીખીએ.

૧. મર્યાદિત મૂડીઃ-

એકાડી વેપારમાં માલિક પોતે જ ધંધામાં જરૂરી મૂડીની વ્યવસ્થા કરે છે. ઘણી વાર એક જ વ્યક્તિ દ્વારા ધંધાને જરૂરી એવી વિશાળ મૂડી ઉભી કરવાનું મુશ્કેલ બને છે. કેટલીકવાર માલિકનું પોતાનું ભંડોળ તેમજ ઉછીનું લાવેલ ભંડોળ પણ ધંધાની જરૂરિયાતને, ધંધાના વિકાસને અને ધંધાના વિસ્તારને સંતોષવા માટે ઓછું પડે છે.

૨. સતત અછત (Lack of continuity):-

વૈયક્તિક માલિકીના અસ્તિત્વનો આધાર ધંધાના માલિક પર છે. જ્યારે ધંધાનો માલિક નક્કી કરે ત્યારે અથવા તો તેનું મૃત્યું થાય તો ધંધાનો અંત આવે છે.

૩. સિમીત કદઃ-

ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં વૈયક્તિક માલિકીની મર્યાદા હોય છે જેની બહાર તેની પ્રવૃત્તિનો વિકાસ કરવો મુશ્કેલ હોય છે. જો ધંધો ચોકક્કસ મર્યાદા કરતા વધુ વિકાસ થાય તો એક જ વ્યક્તિ દ્વારા ધંધાનું નિરીક્ષણ કરવું અને તેની પ્રવૃત્તિની વ્યવસ્થા કરવી શક્ય નથી હોતું.

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્હુ અવિભક્ત કટુંબ

૪. સંચાલકીય કુશળતાની અછત:-

એકાડી વેપારી સંચાલનના દરેક પાસામાં નિષ્ણાંત નથી હોતા. તે / તેણી વહીવટમાં અને આયોજનમાં હોશિયાર (નિષ્ણાંત) હોય પણ માર્કેટીંગમાં નબળા હોય.



૩.૧ પાઠ આધારિત પ્રશ્ન

નીચેના વિધાનો વૈયક્તિક માલિકીના છે તેમાં યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂરો

૧. વૈયક્તિક માલિક તેના ધંધાના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં નો વધારો કરી શકતો નથી.
૨. ધંધાના આયુષ્યનો આધારની જીદગી પર રહેલો છે.
૩. નાણાંકીય સાધનો અને માલિકના સિમીત નિષ્ણાંતપણાને લીધે ધંધાને વ્યવસાયી જ્ઞાનની અછત હોવાથી તે નથી.
૪. ધંધો, સરળ ધંધા માટે અનુકૂળ છે જગ્યાં કણાની જરૂર હોય.
૫. એકાડી વેપાર ગ્રાહકોની જરૂરિયાત શ્રેષ્ઠ રીતે પૂરી પાડી શકે કે જગ્યાં વસ્તુનું બજાર અને હોય.

૩.૫ ભાગીદારીનો અર્થ

ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં એકાડી વેપારની કેટલીક મર્યાદાઓ વિષે તમે શીખ્યા. તેના નાણાંકીય અને સંચાલકીય સાધનો મર્યાદિતછે. ધંધાનો અમુક હદથી વધુ વિકાસ કરવો શક્ય નથી. આ બધી મર્યાદાઓ પાર કરવા ધંધાકીય વ્યવસ્થાનું અન્ય સ્વરૂપ ભાગીદારી અસ્તિત્વમાં આવ્યું. ચાલો પહેલાં ભાગીદારી શું છે તે જાણીએ.



ભાગીદારી

ધારો કે તમારે તમારા વિસ્તારમાં ભોજનગૃહ

ખોલવું છે. તમારે ધણી બધી વસ્તુઓ ભેગી કરવાની જરૂર પડશે. તમને એમ લાગશે કે ધંધો શરૂ કરવા અને ચલાવવા માટે જરૂરી નાણાની વ્યવસ્થા એક વ્યક્તિથી શક્ય નહિ બને તમે તમારા મિત્રોને વાત કરશો અને તમે બધા નાણાની અમુક રકમનો ફણો આપીને અને અન્ય જરૂરી વસ્તુઓ ભોજનગૃહ ચાલુ કરવા લાવશો આમ તમે બધા માલિક બનવા અને નફો કે નુકસાન વહેંચવા એકબીજા સાથે હાથ મિલાવશો. આ ધંધાકીય વ્યવસ્થાનું અન્ય સ્વરૂપ છે જે 'ભાગીદારી' તરીકે જાણીતું છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કટુંબ

નફો કરવાના હેતુથી ધંધાકીય સ્વરૂપ રચવાના આશયથી એક બીજા સાથે હાથ મિલાવે છે. (સંબંધની રચના) જે વ્યક્તિ હાથ મિલાવે છે. તે વ્યક્તિગત રીતે ભાગીદાર અને સંયુક્ત રીતે 'પેઢી' તરીકે ઓળખાય છે. જે નામથી ધંધો ચલાવાય છે તેને પેઢીનું નામ તરીકે ઓળખવામાં આવે છે. સુલતાનચંદ એન્ડ કંપની, રામલાલ એન્ડ કંપની, ગુપ્તા એન્ડ કંપની, કેટલાક ભાગીદારી પેઢીના નામ છે.

ભાગીદારી પેઢીનું સંચાલન ૧૯૮૮ના ભારતીય ભાગીદારી કાયદા અન્વયે થાય છે. ભારતીય ભાગીદારી કાયદો ૧૯૮૮ વિભાગ-૪ ભાગીદારીની વ્યાખ્યા મુજબ, "ભાગીદાર એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય અને ધંધો બધા દ્વારા કે બધા વતી તેમનામાંથી કોઈપણ એક દ્વારા ચલાવાતો હોય."

૩.૬ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગીદારીના લક્ષણો

ભાગીદારી વિષેનો સંક્ષિપ્ત ખ્યાલ મેળવ્યા પછી ચાલો આ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપના લક્ષણોને ઓળખીએ.

૧. બે અથવા વધુ સમ્ભ્યો:-

ભાગીદારીનો ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિની જરૂરિયાત રહે છે. પણ બેંકીંગનો ધંધો શરૂ કરવા વધુમાં વધુ ૧૦ અને અન્ય ધંધામાં ૨૦ થી વધુ સંખ્યા ન થવી જોઈએ.

૨. કરાર:-

જ્યારે તમે ભાગીદારીનો ધંધો શરૂ કરવા માટે એકબીજા સાથે હાથ મિલાવવાનો વિચાર કરો છે ત્યારે, સૌ પ્રથમ તમારા બધા વચ્ચે કરાર થવો જરૂરી છે. આ કરારમાં સમાવેશ થાય છે:

- દરેક ભાગીદાર દ્વારા મૂડીમાં અપાતો ફાળો
- નફો અથવા નુકસાનની વહેંચણીનું પ્રમાણ
- જો કોઈ ભાગીદારને પગાર અથવા કમિશન ચૂકવવાનું હોય તો તે ધંધાનો સમય ગાળો જો હોય તો
- ભાગીદારોના અને પેઢીના નામ અને સરનામા
- દરેક ભાગીદારની સત્તા અને જવાબદારી
- ધંધાનું સ્વરૂપ અને સ્થળ અને
- ધંધો ચલાવવા માટે જો કંઈ શરતો અને નિયમો હોય તો

૩. કાયદેસરનો ધંધો:-

ભાગીદારે એક બીજા સાથે કોઈ પણ પ્રકારનો કાયદેસરનો ધંધો ચલાવવા હાથ

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્હુ અવિભક્ત કટુંબ

મેળવે છે. સણાખોરી, કાળાખજાર વગેરેને સંતોષવા ભાગીદારી કાયદાની દ્રષ્ટિઓ શરૂ ન થઈ શકે.

૪. નફાની વહેંચણી:-

દરેક ભાગીદારી પેઢીનો મખ્ય હેતુ ધંધાનો થયેલ નફો બધા ભાગીદારો વચ્ચે નક્કી કરેલ પ્રમાણમાં વહેંચવાનો છે. કોઈપણ કરારની ગેરહાજરીમાં બધા ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી સરખા હિસ્સે કરવામાં આવે છે.

૫. અમર્યાદિત જવાબદારી:-

વૈયક્તિક માલિકીની માફક દરેક ભાગીદારીની જવાબદારી અમર્યાદિત હોય છે. તેનો અર્થ એ થાય કે ધંધાની જવાબદારી અદા કરવા માટે જો ધંધાની મિલકતો અપૂરતી હોય તો ભાગીદારની અંગત મિલકતનો ઉપયોગ જવાબદારી ચૂકવવા માટે કરવામાં આવે છે.

૬. મરજીયાત નોંધણી:-

તમારી ભાગીદારી પેઢીની નોંધણી ફરજીયાત નથી. જો કે તમે નોંધણી ન કરાવો તો તમે અમુક ફયદા વિના રહેશો. તેથી તે ઈચ્છનીય છે. નોંધણી ન કરાવવાની નીચેની અસરો છે.

- તમારી પેઢી કોર્ટ દ્વારા કાયદેસરના પગલાં કોઈ પણ પક્ષકારના દાવાની પતાવટ માટે લઈ શકશે નહિ.
- જો ભાગીદારો વચ્ચે કોઈ ઝગડો થાય તો તેનું નિરાકરણ કોર્ટના કાયદા દ્વારા લાવી શકાશે નહિ.
- તમારી પેઢી કોઈને પણ થતી ચૂકવવાની રકમના દાવાની પતાવટ અથવા કોઈની પણ પાસેથી લેવાવાની થતી રકમની પતાવટ કોર્ટના કાયદા દ્વારા કરી શકાશે નહિ.

૭. માલિક પ્રતિનિધિ સંબંધ:-

પેઢીના બધા ભાગીદારો ધંધાના સંયુક્ત માલિકો છે. તે બધાને દરેકને ધંધાના સંચાલનમાં ભાગ લેવાનો સમાન હક્ક છે. દરેક ભાગીદારને પેઢીવતી કાર્ય કરવાનો અધિકાર છે. જ્યારે ભાગીદાર બીજા પક્ષકાર સાથે ધંધાના વ્યવહાર કરે છે. તે / તેણી બીજાના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. અને એ જ સમયે બીજા માલિક બને (મુખ્ય વક્તિ) છે. તેથી ભાગીદારી પેઢીમાં માલિક અને પ્રતિનિધિ વચ્ચેનો સંબંધ સ્થપાય છે.

૮. ધંધાનું સાતત્ય:-

ભાગીદારી પેઢીનો અંત મૃત્યુના પ્રસંગે ભાગીદાર ગાંડો અથવા નાદાર થાય ત્યારે આવે છે. તદઉપરાંત બધા ભાગીદારોની ઈચ્છા હોય તો અંત આવે છે. તે ગમે ત્યારે તેમના સંબંધનો અંત લાવવાનો નિર્ણય લઈ શકે છે.

૩.૭ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગીદારીના ફાયદા

ભાગીદારી પેઢી સ્વરૂપના કેટલાક ફાયદા છે જે નીચે મુજબ છે.

૧. સરળ રચના:-

વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારી પેઢીની રચના કોઈપણ કાયદાની પ્રક્રિયા વગર કરી શકાય છે. પેઢીની નોંધણી કરાવવી જરૂરી નથી. ભાગીદારી પેઢીની રચના કરવા કયાં તો મૌનિક અથવા લેખિત કરાર પૂરતો છે.

૨. મોટા પ્રમાણમાં સાધનોની પ્રાપ્યતા:-

જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભાગીદાર તરીકે હાથ મિલાવે છે ત્યારે વૈયક્તિક માલિકીની સરખામણીએ એકાડી વેપાર કરતા વધુ સાધનોનો ફણો આપી શકે છે. ભાગીદારો વધુ મૂડી, વધુ પ્રયત્નો અને વધુ સમય ધંધા માટે આપી શકે છે.

૩. સમતુલિત નિર્ષ્ણય:-

ભાગીદારો જ ધંધાના માલિકો છે. તેમાના દરેકને ધંધાના સંચાલનમાં ભાગ લેવાનો સમાન અધિકાર છે. જ્યારે કોઈપણ સમસ્યા ઉભી થાય ત્યારે તેઓ સાથે બેસીને સમસ્યાનું નિરાકરણ લાવે છે. જ્યારે બધા ભાગીદારો નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે અવિચારી અને ઉત્તાવળીયા નિર્ણય લેવાની શક્યતા ખુબ ઓછી છે.

૪. નુકસાનની વહેંચણી (નુકસાનમાં ભાગ):-

ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો નુકસાનમાં ભાગ લે છે. દાખલા તરીકે જો પેઢીમાં ત્રણ ભાગીદારો હોય અને પેઢીને ચોકકસ સમયમાં રૂ. ૧૨,૦૦૦/- નું નુકસાન થાય તો બધા ભાગીદારો તે વ્યક્તિગત રીતે માત્ર રૂ. ૪,૦૦૦/-ના નુકસાનનો ભાર વહેંચે છે.

૩.૮ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ, ભાગીદારીની મર્યાદા

ઉપરોક્ત બધા ફાયદાની ચર્ચા છતાંય ભાગીદારી પેઢીની કેટલીક મર્યાદાઓ છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે.

૧. અમર્યાદિત જવાબદારી:-

બધા ભાગીદારો સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે પેઢીના દેવા પરતે અમર્યાદિત સ્તરે જવાબદાર છે. આમ તેઓ તેમની વચ્ચે જવાબદારી વહેંચી શકે અથવા તેમનામાંથી ગમે તે એક ને તેમની અંગત મિલકતમાંથી દેવાની પતાવટ કરવાનું કહી શકે.



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

ઓકાડી વેપારી (વેયકિતક માલિકી), ભાગીદારી અને હિંન્હ અવિભક્ત કટુંબ

૨. અનિશ્ચિત જીવન:-
ભાગીદારી પેઢીને તેમના ભાગીદારોથી કોઈ કાયદેસરનું અલગ વ્યક્તિત્વ નથી. તેનો અંત મૃત્યુ, નાદારી ભાગીદારની નિવૃત્તિ અથવા અશક્તિ આવે ત્યારે આવે છે. વળી જુદ્ધો મત (વિચાર) ધરાવનાર કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીના વિસર્જન માટેની નોટિસ આપી શકે છે.
૩. મર્યાદિત મૂડી:-
જ્યારે ભાગીદારોની સંખ્યા ૨૦ થી વધારી શકાય નહિ ત્યારે મૂડીમાં વધારો હંમેશા મર્યાદિત હોય છે. ભાગીદારી પેઢીના સ્વરૂપમાં મોટો ધૂંધો શરૂ કરવો શક્ય નથી.
૪. ભાગની હેરફેર થઈ શકતી નથી:-
જો તમે પેઢીમાં ભાગીદાર છો. તો તમે બીજા ભાગીદારોની સંમતિ વિના તમારા નજીનો ડિસ્ટ્રિબ્યુટરની વ્યક્તિને આપી શકતા નથી. જે ભાગીદાર પેઢી છોડવા માંગે છે. અથવા તો બીજાને તેનો ભાગ વેચવા માગે છે તેને માટે અગવડ (મુશ્કેલી) ઉલ્લી કરે છે.

૩.૬ ભાગીદારીની મર્યાદિત જવાબદારી

કોર્પોરેટ ધંધાકીય વાહન વ્યવસાયીને નિષ્ઠાંત બનાવે છે અને સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આમ આ બંને પરિવર્તનક્ષમ નવીનતા અને કાર્યક્ષમ સંચાલક, મર્યાદિત જવાબદારીના લાભ પૂરા પાડે છે. જ્યારે તેના સત્યોને આંતરિક માળખાના વ્યવસ્થાતંત્ર માટે પરિવર્તનક્ષમતાને મંજૂર કરે છે. (પ્રવેશ આપે છે.) ત્યારે તેને ભાગીદારીની મર્યાદિત જવાબદારી કહે છે.

૧. ભારતીય અર્થતંત્રના વિકાસની સાથે સાહસિકો દ્વારા ભજવાયેલ ભૂમિકા તેમજ તેના ટેકનીકલ અને વ્યાવસાયિક માનવ શક્તિને કારણે તે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય રખાયું છે. તે સમયોચિત લાગે છે કે સાહસિકતા, જ્ઞાન અને મૂડીનું જોખમ ભારતીય વિકાસને ઉતાવળીયો વિકાસ પુરો પાડે છે. આ પૂર્વભૂમિકામાં નવા અનેક ઘટકોના સ્વરૂપમાં પ્રણાલિકાગત ભાગીદારીને વિકલ્પ પુરો પાડે છે જે એક બાજુ અમર્યાદિત જવાબદારી અને કાયદા આધારિત મર્યાદિત જવાબદારીના માળખાવળી કંપની અને બીજી બાજુ વ્યવસાયી તજશીતા અને સાહસિકતાની પ્રાથમિકતા સંયુક્ત રીતે વ્યવસ્થા કરી પરિવર્તનક્ષમતા પૂરી પાડે છે.
૨. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી એ કોર્પોરેટ ધંધાકીય વાહનના વિકલ્પ તરીકે જોવાય છે. કે જે મર્યાદિત જવાબદારીના ફાયદા પૂરા પાડે છે. પરંતુ તેના સત્યોને વ્યવસ્થાતંત્રના આંતરિક માળખામાં વ્યવસ્થાતંત્રની પરિવર્તનક્ષમતા પૂરી પાડે

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કટુંબ

છે કે જે ભાગીદારોના પરસ્પર કરાર પર આધ્યારિત છે. મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારીનું સ્વરૂપ સાહસિકોને, વ્યવસાયીઓને અને એકમોને કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિક અને ટેકનીકલ સ્વરૂપવાળી સેવા પૂરી પાડે છે. જેથી વાહનો તેમની જરૂરિયાત માટે સક્ષમ બને. તેના માળખામાં પરિવર્તનક્ષમતા અને કાર્યની પરિવર્તનક્ષમતા હજુ બાકી છે. ત્યારે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી નાના એકમો માટે અનુકૂળ વાહન (સાધન) છે. અને જોખમી મૂડીનું રોકાણ માટે પણ અનુકૂળ સાધન છે.

૩. આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદે ૨૦૦૮માં મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી કાયદા અનુકૂળ વાહન (સાધન) છે. અને જોખમી મૂડીનું રોકાણ માટે અનુકૂળ સાધન છે.

મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી કાયદા ૨૦૦૮ના બહાર આવેલા લક્ષ્ણો નીચે મુજબ છે.

૧. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી અનેક ઘટકોનું બનેલું માળખું અને તેના ભાગીદારોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે. બે અથવા વધુ વ્યક્તિત્વો નફો કરવાના હેતુથી કાયદેસરનો ધંધો કરવા ભેગા થાય તો તેમના નામ દસ્તાવેજના રજીસ્ટ્રાર (નોંધણી અધિકારી) સમક્ષ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીમાં દાખલ કરાવે. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી સતત એક પછી એક ક્રમમાં આવે છે.
૨. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીના પરસ્પર હક્કો અને જવાબદારી અને મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારોનું મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી કાયદા—૨૦૦૮ મુજબ સંચાલન થશે. કાયદો દસ્તાવેજમાં તેમની પસંદગી મુજબ પરિવર્તન કરવાની છુટ આપે છે. આવા કોઈ કરારની ગેરહાજરીમાં મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી કાયદા અન્વયે પરસ્પર હક્કો અને જવાબદારીઓ અમલમાં આવે છે.
૩. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી કાયદેસરનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. તો તેની મિલકત સુધી સંપુર્ણ જવાબદાર છે, ભાગીદારોની મર્યાદિત જવાબદારી તેમની મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીના કરારમાં નિયત કર્યા મુજબ છે જે દ્રશ્ય અથવા અદ્રશ્ય સ્વરૂપમાં હોય અથવા બંને દ્રશ્ય અને અદ્રશ્ય સ્વરૂપમાં હોય. કોઈ પણ ભાગીદાર સ્વતંત્ર રીતે જવાબદાર નથી અથવા બીજા ભાગીદારના બિન અધિકૃત કાર્યની તેમની ગેરવર્તણુક માટે જવાબદાર નથી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીની જવાબદારી જો ભાગીદારોને છેતરવાના હેતુથી દુષ્કૃત્ય કરેલ હોય અથવા કોઈ દગ્ગાખોરીના હેતુથી કાર્ય કરેલ હોય તો તેની

મોડયુલ – ૨ વાંશિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાડેમી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિન્દુ અવિભક્ત કુટુંબ

અમર્યાદિત જવાબદારી બધાની અથવા કોઈના દેવડ અથવા મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારીની અન્ય જવાબદારી રહે છે.

- દરેક મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીમાં બે ભાગીદારો હોવા જ જોઈએ અને બે વ્યક્તિગત નીમાયેલા હોવા જોઈએ, જેમાંના એક ભારતીય રહીશ હોવા જોઈએ. કાયદા મુજબ નીમાયેલ ભાગીદારની ફરજો અને કાર્યો નક્કી કરવામાં આવેલ છે.



ઓ.૨ પાઠ આધારિત પ્રશ્નો

- કોંસમાં આપેલ શબ્દોથી યોગ્ય શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો.
- ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી છે.
(બિનજરૂરી, જરૂરી)
 - ભાગીદારી પેઢીએ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે.
(પરિવર્તનશીલ, જડ)
 - ભાગીદારીમાં ધંધાકીય જોખમ બધા ભાગીદારો વચ્ચે છે.
(વહેચાય, વહેચાતું નથી)
 - ભાગીદારી એ પ્રયત્નો છે.
(જૂથ, વ્યક્તિગત)
 - મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીનો કાયદો વર્ષમાં ઘડાયો.
(૨૦૦૮, ૨૦૧૦)

૩.૧૦ સંયુક્ત હિન્દુ કુટુંબના ધંધાનો અર્થ

સંયુક્ત હિન્દુ કુટુંબના ધંધાનો અર્થ એ છે કે સંયુક્ત હિન્દુ કુટુંબના સભ્યોની માલિકીવાળો ધંધો તે હિન્દુ અવિભક્ત કુટુંબના ધંધા તરીકે પણ ઓળખાય છે. વ્યવસ્થાનું આ સ્વરૂપ હિન્દુ કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવે છે અને પરંપરાના કાયદા મુજબ તે ચલાવાય છે. સંયુક્ત કુટુંબ એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં કુટુંબ એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં કુટુંબ કેટલીક વારસાગત મિલકતો પૂરુષ સભ્યોની હોય છે. પૂર્વજો પાસેથી વારસામાં મળેલો મિલકતનો હિસ્સો એ તેના પિતા, દાદા અને વડદાદાનો હોય છે. આમ ત્રણ એક પણી એક કમમાં આવતી પેઢી



સંયુક્ત હિન્દુ કુટુંબનું ચિત્ર

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

વારસામાં મળેલ મિલકત ધરાવે છે. સંયુક્ત હિંદુ કુટુંબના ધંધાનો હેતુ માત્ર પુરુષ સભ્ય બની શકે કે જે સહકર્તા તરીકે ઓળખાય અને જુનામાં જુનો સભ્ય કર્તા તરીકે ઓળખાય.

૩.૧૧ સંયુક્ત હિંદુ કુટુંબના ધંધાના લક્ષણો (વિશિષ્ટતા)

૧. જન્મથી સભ્યપદ:-

પુરુષ બાળકના જન્મ સાથે આપોઆપ તે સંયુક્ત કુટુંબના ધંધાનું સભ્યપદ મેળવે છે. તે કુટુંબ વચ્ચેના કરાર દ્વારા અસ્તિત્વમાં આવતું નથી.

૨. સંચાલન:-

સંચાલન કુટુંબના જુનામાં જુના સભ્ય કર્તા પાસે હોય છે. જો કે કર્તા અન્ય સભ્યોને હિંદુ અવિભક્ત કુટુંબમાં તેને મદદ કરવા માટે સામેલ કરે છે.

૩. જવાબદારી:-

કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે ધંધાના દેવાની ચુકવણી કરવા તેની અંગત મિલકતનો ઉપયોગ પણ થઈ શકે છે. જ્યારે બીજા સહકર્તાની જવાબદારી તેમના હિંદુ અવિભક્ત કુટુંબના ભાગ જેટલી જ હોય છે.

૪. કોઈ મહત્તમ મર્યાદા નહિઃ-

હિંદુ અવિભક્ત કુટુંબના ધંધામાં સહકર્તાની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. આમ સભ્ય ત્રણ ક્રમમાં આવતી પેઢી સુધી મર્યાદિત છે.

૫. સગીર સભ્યઃ-

પુરુષ સગીર બાળક જન્મતાની સાથે જ સહકર્તા 'બની શકે છે. આમ હિંદુ અવિભક્ત કુટુંબમાં સગીર સભ્ય થવા માંગે તો કોઈ મર્યાદા નથી.

૬. મૃત્યુની કોઈ અસર નથી:-

હિંદુ અવિભક્ત કુટુંબનો ધંધો સહકર્તાના મૃત્યુ કે પછી કર્તાનું મૃત્યુ થાય તો પણ ચાલુ રહે છે. હિંદુ અવિભક્ત કુટુંબનો પછી ક્રમમાં આવતો જુનો સભ્ય કર્તા બની શકે છે. જો કે તેનો અંત ત્યારે આવે કે જ્યારે બધા સભ્યો જણાવે કે તેઓ સંયુક્ત કુટુંબના સભ્ય રહેતા નથી.

૩.૧૨ સંયુક્ત હિંદુ કુટુંબના ધંધાના લાભ

૧. આર્થિક સલામતી અને સભ્યોને માનભર્યો હોદો (માનભર્યું સ્થાન):-

સંયુક્ત હિંદુ કુટુંબનો ધંધો તેના સભ્યોને સલામતી પૂરી પાડે છે. કારણ કે તે નાણાંકીય જોખમ ધરાવે છે. જ્યારે તેઓ બીજા સાથે વ્યવહાર કરે છે ત્યારે તેમને સમાજમાં માનભર્યો હોદો પૂરો પાડે છે.

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

૨. ધંધાનું સાતત્ય:-

ધંધાને સાતત્ય (કાયમીપણું) છે. સભ્યના મૃત્યુ કે નાદારીની તેને કોઈ અસર થતી નથી. જ્યાં સુધી સલ્ય સભ્યપદ બંધ કરાવવાનું નક્કી ન કરે ત્યાં સુધી તેનું સભ્યપદ ચાલુ રહે છે.

૩. કુટુંબનું સ્વાભિમાન :

સભ્યો બલિદાનપૂર્વક, નિષ્ઠા અને કાળજીથી કામ કરે છે. કારણ કે તે કુટુંબના નામ સાથે સંકળાયેલા છે. ધંધો એ માત્ર આર્થિક એકમ નથી, પરંતુ કુટુંબની પ્રતિષ્ઠા પણ છે.

૩.૧ સંયુક્ત હિંદુ કુટુંબના ધંધાની મર્યાદાઓ

૧. અમર્યાદિત જવાબદારી:-

કર્તા ધંધાના બધા જ કાર્યો માટે જવાબદાર છે. જો ધંધાના દેવા ચુકવવા ધંધા પાસે પૂરતી મિલકતો ન હોય તો તેની અંગત મિલકત પણ વેચી શકાય છે.

૨. મૂડીનો વધારો મર્યાદિત:-

કર્તા પાસે મૂડીના વધારાની તકો મર્યાદિત છે. તેમનું / તેણીનું પોતાનું ભંડોળ વિકાસ માટે અપૂરતું છે. આ ધંધાના વિકાસની તકો ઘટાડે છે.

૩. કર્તા ખૂબ જ સક્ષમ:-

જો બિનકાર્યક્ષમ કર્તા દ્વારા ધંધાના બધા જ નિર્ણયો લેવાય તો ધંધો નાશ પામે છે.

૪. કદાચ ધંધાકીય વ્યવસ્થાનું આ સ્વરૂપ સંયુક્ત હિંદુ કુટુંબનો કુદરતી આર્થિક વધારો છે. તે આર્થિક સલામતી પૂરી પાડે છે. અને સલ્યોને મોભા ભર્યું સ્થાન આપે છે. તે ભારતીય ધંધામાં અગત્યનું સ્થાન ધરાવે છે.



૩.૩ પાઠ આધારિત પ્રશ્નો

૧. યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો

૧. એચ્યુ.ઓફ. (હિંદુ અવિભક્ત કુટુંબ) માટે છે.

૨. ક્રમે આવતી પેઢી વારસામાં મળેલી મિલકતોના વારસદાર બને છે.

૩. સંયુક્ત હિંદુ અવિભક્ત કુટુંબનો જુનામાં જુનો સભ્ય તરીકે ઓળખાય છે.

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

૪. સંયુક્ત હિંદુ અવિભક્ત કુટુંબના સહ્યો તરીકે ઓળખાય છે.
૫. અમર્યાદિત જવાબદારી છે.
૨. વિવિધ વિકલ્પવાળા પ્રશ્નો
૧. હિમાંશી વૈયક્તિક માલિકીનો વેપાર ચલાવે છે. ધંધામાં નુકસાન જવાને કારણે તેણે ધંધો બંધ કરવાનું નક્કી કર્યું. ધંધો બંધ કર્યો તે દિવસે મિલકો રૂ.૫ લાખની અને દેવા (બધા લોણદારો) રૂ.૧૦ લાખના હતા. હિમાંશુ પાસે તેની અંગત મિલકો રૂ. ૬ લાખની હતી ધંધો બંધ કરવાના સમયે લોણદારોને કેટલીક રકમ મળશે? તમે શું વિચારો છો?

અ. રૂ. ૫ લાખ	બ. રૂ. ૧૦ લાખ
ક. રૂ. ૭ લાખ	ડ. રૂ. ૧૧ લાખ
 ૨. વૈયક્તિક માલિકીના ધંધાની મર્યાદાઓમાં નીચેનાનો સમાવેશ થતો નથી

અ. મર્યાદિત મૂડી	બ. સાતત્યની અધિત
ક. અમર્યાદિત કદ	ડ. વહીવટી કુશળતાની અધિત
 ૩. ભારતીય ભાગીદારી પેઢીનું સંચાલન ભારતીય ભાગીદારી કાયદા દ્વારા થાય છે.

અ. ૧૮૮૨	બ. ૧૮૫૮
ક. ૨૦૦૮	ડ. ૧૮૧૨
 ૪. સંયુક્ત હિંદુ કુટુંબના લક્ષણોમાં સમાવેશ થતો નથી.

અ. જન્મથી જ સભ્યપદ	બ. કર્તાની અમર્યાદિત જવાબદારી
ક. મૃત્યુની કોઈ અસર નહિએ.	ડ. કુટુંબનો સૌથી જુવાન સહ્ય કર્તા
 ૫. સંયુક્ત હિંદુ કુટુંબના સહ્યો ઓળખાય છે.

અ. ભાગીદાર	બ. સહ્યો
ક. સહકર્તા	ડ. માલિકો



તમે શું શીખ્યા?

- વૈયક્તિક માલિકી એ ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં ઓક જ વ્યક્તિ માલિક, સંચાલક અને ધંધાકીય એકમને બધી સત્તા જવાબદારી અને જોખમથી (અંકુશ કરતો) કાબુમાં રાખતો હોય છે.

મોડયુલ - ૨ વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૨

વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો



નોંધ

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

- વૈયક્તિક માલિકીના ધંધામાં એક જ વક્તિની માલિકી હોય છે. એક જ માલિક ધંધા પર અંકુશ રાખે છે અને તેની જવાબદારી અમયાદિત હોય છે. માલિક નફો અથવા નુકસાન ધરાવે છે અને તેના પોતાના સાધનોમાંથી મૂરીનું રોકાણ કરે છે. તે / તેણી તેના ભિત્રો અને સગાખાલા પાસેથી ઉછીના લાવે છે. અથવા બેંક અને અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન મેળવે છે. આમ ધંધો શરૂ કરવામાં અને ચલાવવામાં કોઈ કાયદાકીય વિવીની જરૂર પડતી નથી.
- વૈયક્તિક માલિકીનો ધંધો એ ધંધો શરૂ કરવામાં અને બંધ કરવા માટે સરળ સ્વરૂપ છે. આ ધંધાઓમાં નિર્ણયો તરિત લઈ શકાય છે, વધુ સારો અંકુશ રાખી શકાય છે, અને ગુપ્તતા જાળવી શકાય છે.
- ભાગીદારી એવી વ્યક્તિઓ વર્યેનો સંબંધ છે કે જેઓ ધંધાનો નફો વહેચી લેવા સંમત થયા હોય અને ધંધો બધા દ્વારા કે બધા વતી તેમનામાંથી કોઈ પણ એક દ્વારા ચલાવાતો હોય.
- મયાદિત જવાબદારીવાળી ભાગીદારી મયાદિત જવાબદારીનો લાભ પૂરો પાડે છે પણ તેના સભ્યોને આંતરિક માળખાની વ્યવસ્થામાં પરિવર્તનક્ષમતા માટે પરવાનગી આપે છે. કારણ કે ભાગીદારી પરસ્પર સહમતી (સમજૂતી)ને આધારે હોય છે.
- વ્યક્તિઓ કે જે હાથ મિલાવે છે તે વ્યક્તિગત રીતે 'ભાગીદાર' અને સંયુક્ત રીતે 'પેઢી' કહેવાય છે. જે નામથી ધંધો ચલાવાય છે તેને 'પેઢીનું નામ' કહે છે.
- સંયુક્ત હિંદુ કુટુંબનો ધંધો એ એવો ધંધો છે કે જે સંયુક્ત હિંદુ કુટુંબના સભ્યો તેની માલિકી ધરાવે છે.
- સંયુક્ત હિંદુ કુટુંબનો ધંધો ચલાવવાના હેતુ માટે માત્ર પુરુષ સભ્યો જ અધિકારી છે જે સહકર્તા તરીકે ઓળખાય છે.
- કુટુંબનો સૌથી વૃદ્ધ સભ્ય 'કર્તા' તરીકે ઓળખાય છે.



સત્રાંત પ્રશ્નો

1. વૈયક્તિક માલિકની વ્યાખ્યા આપો.
2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ વૈયક્તિક માલિકીનો શું અર્થ થાય ?
3. વૈયક્તિક માલિકીનું અસ્તિત્વ કાયમી હોઈ શકે? તમારા જવાબની યથાર્થતા તપાસો.
4. વૈયક્તિક માલિકીના ધંધાની સગવડ રોજગારીનું સર્જન કેવી રીતે કરી શકે? વર્ણન કરો.
5. બેન્કિંગ અને અન્ય ધંધામાં કેટલા વધુમાં વધુ સભ્યો ભાગીદાર તરીકે જોડાઈ શકે?
6. ભાગીદારીની વ્યાખ્યા આપો.
7. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગીદારીના અન્ય કોઈ ચાર લક્ષણો જણાવો.
8. સંયુક્ત હિંદુ કુટુંબની વ્યાખ્યા આપો.

એકાડી વેપારી (વૈયક્તિક માલિકી), ભાગીદારી અને હિંદુ અવિભક્ત કુટુંબ

૬. સંયુક્ત હિંદુ કુટુંબના લક્ષણો જણાવો.
 ૧૦. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીના સુખુપ્ત લક્ષણો જણાવો



પાઠ્ય આધારિત પ્રશ્નોના જવાબ

૩.૧

- | | | |
|-----------|-------------------|-----------|
| ૧. મૂરી | ૨. માલિક | ૩. સંચાલન |
| ૪. માનવીય | ૫. નાનુ / સ્થાનિક | |

૩.૨

- | | | |
|--------------|-----------------|--------------|
| ૧. જરૂરી નથી | ૨. પરિવર્તનક્ષમ | ૩. વહેંચાયેલ |
| ૪. જૂથ | ૫. ૨૦૦૮ | |

૩.૩

(૧)

- | | | |
|-------------------------|------------|------------|
| ૧. હિંદુ અવિભક્ત કુટુંબ | ૨. ત્રણ | ૩. સહકર્તા |
| ૪. કર્ત્તા | ૫. કર્ત્તી | |

(૨)

- | | | | | |
|-------|-------|-------|------|------|
| ૧. બ, | ૨. ક, | ૩. અ, | ૪. ઝ | ૫. ક |
|-------|-------|-------|------|------|



તમારા માટે પ્રવૃત્તિઓ

તમારી આજુ બાજુના ધૂંધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરો, અને શોધો કે તે વૈયક્તિક માલિકી, ભાગીદારી અથવા સંયુક્ત હિંદુ કુટુંબના ધૂંધાઓ છે. તે દરેકના લક્ષણો એકબીજાથી જુદા કેવી રીતે પડે છે. તેની પણ નોંધ કરો.

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

આપણે છેલ્લા પ્રકરણમાં વેચકિતક માલિકી, ભાગીદારી, ધંધાકીય વ્યવસ્થાના અલગ સ્વરૂપ તરીકે શીખ્યા. પરંતુ બીજા એવા વ્યવસ્થાતંત્રો છે કે જેનો મુખ્ય હેતુ નશો કમાવવાનો નહિ પરંતુ સેવા કરવાનો છે જો કે બજારમાં ટકી રહેવા માટે અમુક નશો જરૂરી છે. પણ તેમનો મુખ્ય ઈરાદો નશો કમાવીને વૃદ્ધિ કરવાનો નથી. આપણે ટાટા સ્ટીલ, રિલાયન્સ ઈન્ડ.લી., કોલ ઈન્ડીયા, રિલાયન્સ પાવર, ડી.એલ.એફ રેન બક્ષી વગેરે વિષે સાંભળ્યું છે. આપણા મગજમાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે કે તેના માલિકો કોણ છે? તેઓ શું કરે છે? કંપનીનું કદ શું છે? આવી કંપનીઓના નાણાંકીય કદ શું છે? ચાલો, તેમના વિષે વધુ જાણીએ.



હેતુઓ:-

આ પાઠનો અભ્યાસ કર્યા પછી તમે કહી શકશો.

- સહકારી મંડળીનો અર્થ જણાવો
- સહકારી મંડળીના લક્ષણો જણાવો
- સહકારી મંડળીના વિવિધ પ્રકારો ઓળખી બતાવો
- સહકારી મંડળીના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો
- સંયુક્ત હિસ્સાવાળી કંપનીની વાખ્યા આપો
- સંયુક્ત હિસ્સાવાળી કંપનીના મુખ્ય લક્ષણો જણાવો.
- સંયુક્ત હિસ્સાવાળી વિવિધ કંપનીના પ્રકાર ઓળખી બતાવો
- સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદા—ગેરફાયદાની ચર્ચા કરો
- ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ એવા સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અનુકૂળતા અંગે સૂચન કરો.
- બહુવિધ કંપનીનો અર્થ જણાવો.

૪.૧ સહકારી મંડળીનો અર્થ

સહકારી ચળવળ એ ઔદ્યોગિક કાંતિને કારણે ઉદભવેલ આર્થિક અને સામાજિક અસમાનતા છે. સહકારી મંડળીઓ બંને મૂડીવાદી દેશો, યુ.એસ., જાપાન તેમજ સમાજવાદી દેશોમાં મહત્વ પ્રાપ્ત કર્યું છે.

સહકારી મંડળીઓ અને સંયુકત હિસ્સાવાળી કંપની

'સહકાર' શબ્દ લેટિન ભાષાના 'કો—ઓપરારી' (Co-operari) પરથી ઉત્તરી આવ્યો છે. 'કો' એટલે સાથે અને 'ઓપરારી' એટલે 'કામ કરવું' અર્થ થાય છે. સહકાર એટલે સાથે કામ કરવું. તેનો અર્થ એ થાય કે જે લોકો સમાન આર્થિક હેતુઓ માટે કામ કરવા માંગ્યો છે તે મંડળીની રચના કરી શકે છે, જેને 'સહકારી મંડળી' કહે છે.



સહકારી મંડળીનું ચિત્ર

તે મરજીયાત પણો સલ્યોનું મંડળ છે

કે જેમાં આર્થિક હિતની વૃધ્ઘિ માટે સાથે મળીને કામ કરે છે. તે 'સ્વમદદ' તેમજ 'પરસ્પર મદદ' ના સિદ્ધાંત પર કામ કરે છે. કોઈ પણ નકો કમાવવા માટે સહકારી મંડળીમાં જોડાતો નથી. લોકો જૂથમાં આગળ આવે છે. તેમના અંગત સાધનો (સ્ત્રોત) ખેંચી લાવે છે. તેનો શ્રેષ્ઠ મહત્તમ ઉપયોગ કરે છે અને તેમાંથી સર્વસામાન્ય લાભ મેળવે છે.

"સહકાર એ વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ મરજીયાતપણો વ્યક્તિ તરીકે (માનવી) સમાનતા અને તેમના આર્થિક હિતોના સંવર્ધન માટે જોડાય છે."

દા.ત. ચોક્કસ વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ ધોરણોના પુસ્તકો પૂરા પાડવાના હેતુથી હાથ મિલાવે અને સહકારી મંડળીની રચના કરો. હવે તે બારોબાર પ્રકાશક પાસેથી પુસ્તકો ખરીદે અને વિદ્યાર્થીઓને સત્તી કિંમતે વેચો. કારણ, તેઓ પ્રકાશક પાસેથી સીધેસીધા પુસ્તકો ખરીદે છે અને તેથી મધ્યસ્થીનો નકો રહેતો નથી. તમને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિગત ગ્રાહક પ્રકાશક પાસેથી પુસ્તકો ખરીદે તે શક્ય છે? અલખાતા આ માત્ર પરસ્પર સહકારથી જ શક્ય બની શકે.

૪.૨ સહકારી મંડળીના લક્ષણો

સહકારી મંડળી એ, તમે અગાઉ જે છેલ્લા પાઠમાં શીખ્યા તેના કરતાં જુદા પ્રકારનું વંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. ચાલો તેના લક્ષણો વિષે ચર્ચા કરીએ.

૧. સૈચિદ્ધક મંડળી:- સહકારી મંડળી એ વ્યક્તિઓની સૈચિદ્ધક મંડળી છે. જ્યારે સભ્યને ઈચ્છા થાય ત્યારે તે જોડાઈ શકે છે, જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી સભ્ય તરીકે ચાલુ રહી શકે છે અને જ્યારે તેની ઈચ્છા થાય ત્યારે મંડળી છોડી શકે છે.
૨. ખુલ્લુ સભ્યપદ:- જે સમાન હિત ધરાવે છે તેવી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું છે. સભ્યપદ જાતિ, જાતિ, રંગ અથવા ધર્મને આધારે નિયંત્રિત નથી. પરંતુ તે ચોક્કસ વ્યવસ્થાતંત્રના કર્મચારી પૂરતું મર્યાદિત છે.
૩. અલગ કાયદેસરનું વ્યક્તિત્વ:- સહકારી મંડળીએ સહકારી મંડળીના ૧૯૧૨ના કાયદા અન્વયે નોંધણી કરાવવી પડે છે. અથવા રાજ્ય સરકારના

મોડ્યુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

- સંબંધિત સહકારી મંડળીના કાયદા હેઠળ નોંધણી કરાવવી પડે છે. સહકારી મંડળીને તેના સભ્યો કરતાં અલગ કાયદે સરનું વ્યક્તિત્વ છે.
૪. નાણાકીય સાધનો:- સહકારી મંડળી શેર મૂડીના સ્વરૂપમાં તેના સભ્યોમાંથી મૂડી ઉભી કરે છે. જો કે તે નોંધણી પછી સરળતાથી સરકારમાંથી લોન મેળવે છે અને સરકારમાંથી સહાય મેળવે છે.
 ૫. સેવાનો હેતુ:- સહકારી મંડળીનો પ્રાથમિક હેતુ તેના સભ્યોની સેવા કરવાનો છે. જો કે પ્રક્રિયામાં એવું બને છે કે તેમને તેમના માટે વ્યાજબી નફો મેળવવો પડે.
 ૬. મતદાન અધિકાર:- દરેક સભ્યને માત્ર એક મતનો અધિકાર છે. પછી ભલે તે / તેણી ગમે તેટલા શેર ધરાવતા હોય.

૪.૩ સહકારી મંડળીના પ્રકારો

સહકારી મંડળી તેના સેવાના સ્વરૂપને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. સહકારી મંડળીના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે.

૧. ગ્રાહકોની સહકારી મંડળી:- સહકારી મંડળીઓ સામાન્ય ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા વપરાશી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવા માટે રચવામાં આવે છે. તેઓ ઉત્પાદક પાસેથી સીધેસીધી વસ્તુઓ ખરીદે છે, આ વિતરણની પ્રક્રિયામાંથી મધ્યસ્થી (વયેટીયા)ને દૂર કરે છે. કેન્દ્રીય ભંડાર, અપના બજાર અને સુપર બજાર ગ્રાહક સહકારી મંડળીના ઉદાહરણ છે.
૨. ઉત્પાદકોની સહકારી મંડળી:- આ મંડળીઓ મૂળભૂત રીતે જે ઉત્પાદકો નાના છે તેમના હિતનું રક્ષણ કરવા અને તેમને ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓ જેવી કે કાચો માલ, ટુલ્સ (ઓજાર) સાધનો, યંત્ર વગેરે મળી રહે તે માટે રચવામાં આવે છે. હેન્ડલૂમ મંડળીઓ જેમ કે, એપ્કો બ્યાનિકા, હરિયાણા હેન્ડલૂમ વગેરે ઉત્પાદકોની સહકારી મંડળીના ઉદાહરણ છે.
૩. બજાર માટે સહકારી મંડળી (માર્કેટીંગ):- આ મંડળી નાના ઉત્પાદકો અને ઉત્પાદકો જેમને વ્યક્તિત્વ રીતે તેમની બનાવેલ વસ્તુ વેચવામાં મુશ્કેલી પડે છે તેમને માટે રચવામાં આવે છે. આ મંડળી વ્યક્તિત્વ સભ્યો પાસેથી વસ્તુ એકઢી કરે છે અને બજારમાં તે વસ્તુઓ વેચવાની જવાબદારી સ્વીકારે છે. ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અમૂલ્યની દૂધની બનાવટોનું વેચાણ કરે છે. તે બજાર માટે સહકારી મંડળી (માર્કેટીંગ)નો દાખલો છે.
૪. કરકસર અને શાખ (વિરાસ્ત) સહકારી મંડળી:- આ મંડળીઓ સભ્યોને નાણાકીય ટેકો પૂરો પાડવાના હેતુથી રચવામાં આવે છે. તેઓ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે. અને સભ્યોને તેમની જરૂરિયાત સમયે વ્યાજના વ્યાજબી દરે લોન આપે છે. ગ્રામ્ય સેવા સહકારી મંડળી અને શહેરી સહકારી મંડળી સહકારી શાખ (વિરાસ્ત) મંડળીના ઉદાહરણ છે.
૫. સમૂહ ગૃહ સહકારી મંડળી:- આ રહેઠાણ મંડળીઓ છે જે તેના સભ્યોને રહેઠાણ માટેના મકાનો પૂરા પાડવા માટે રચવામાં આવે છે. તેઓ જમીન ખરીદે છે, મકાન અથવા ફ્લેટ બાંધે છે અને તે જ સભ્યોને ફણવે છે.



૪.૧ પા� આધારિત પ્રશ્નો

- નીચેના વિધાનોમાં ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ / શબ્દો મૂકો.
૧. સહકારી મંડળીએ વ્યક્તિઓની મંડળી છે કે જે સમાન હિત મેળવવા (પ્રાપ્ત કરવા) માટે ઓકઠા થાય છે.
 ૨. સહકારી મંડળીનો ધ્યેય સભ્યોને પૂરી પાડવાનો છે.
 ૩. સહકારી મંડળી તેના સભ્યોથી સ્વતંત્ર છે.
 ૪. સહકારી મંડળી સ્વમદદ તેમજ ના સિદ્ધાંત પર કામ કરે છે.
 ૫. ગ્રાહકોની સહકારી મંડળી વસ્તુની વિતરણ પ્રક્રિયામાંથી દૂર કરીને મદદ કરે છે.
 ૬. અપના બજાર અને કેન્દ્રીય બજાર સહકારી મંડળીના દાખલા છે.

૪.૨ સહકારી મંડળીના લાભ

ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ સહકારી મંડળીના લાભ નીચે મુજબ છે.

૧. સૈચિચ્છિક સંગઠન (મરજીયાત):— તે સૈચિચ્છિક સંગઠન છે કે જે મૂડીવાટી અને સમાજવાદી બંને પદ્ધતિમાં વિકસી શકે છે.
૨. લોકશાહી અંકુશ:— સહકારી મંડળી પર અંકુશ લોકશાહી ફબે રાખવામાં આવે છે. સંચાલન લોકશાહી છે તે 'એક વ્યક્તિ, એક મત' ના ખ્યાલ પર આધારિત છે.
૩. ખુલ્લુ સભ્યપદ:— જે વ્યક્તિઓ સમાન હિત ધરાવે છે. તેઓ સહકારી મંડળીની રચના કરી શકે છે. સક્ષમ વ્યક્તિ ગમે ત્યારે સભ્ય થઈ શકે છે અને તે / તેણી ઈચ્છા મુજબ સભ્યપદ છોડી શકે છે.
૪. મધ્યસ્થીનો નફો ઘટાડાય છે:— સામાન્ય રીતે મધ્યસ્થીનો નફો ઘટાડવામાં આવે છે. કારણ કે સહકારી મંડળી તેના સભ્યો દ્વારા તેમના પુરવણાની વસ્તુઓનો અંકુશ રાખે છે કે જે તેમના દ્વારા વિવિધ ઉત્પાદકો પાસેથી સીધેસીધો ખરીદવામાં આવેલ હોય છે.
૫. મર્યાદિત જવાબદારી:— સહકારી મંડળીની બાબતમાં તેના સભ્યોની જવાબદારી તેમને આપેલ મૂડી સુધી મર્યાદિત હોય છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીના જેવું અહીં નથી, અહીં સહકારી મંડળીના સભ્યો ધંધાની જવાબદારીના કોઈપણ પ્રકારના જોખમથી મુકૃત છે.
૬. સ્થિર જીવન:— સહકારી મંડળીને સુગમ પડે તેવી સ્થિર જીદગી છે અને તે લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહે છે. તેના અસ્તિત્વને મૃત્યુ, નાદારી, ગાંડપણ કે કોઈ સભ્યના રાજીનામાની કોઈ અસર થતી નથી.

૪.૩ સહકારી મંડળીની મર્યાદાઓ

ઉપરોક્ત ફાયદા ઉપરાંત ધંધારીય વ્યવસ્થાના સ્વરૂપ સહકારી મંડળીને કેટલીક મર્યાદાઓ છે. ચાલો મર્યાદાઓ જાણીએ.



નોંધ



સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

1. ઉતોજનનો (પ્રેરણ) અભાવ:- સભ્યો પૂરા ઉત્સાહથી અને બલિદાનથી કામ કરતા નથી કારણ કે અહીં નફાનું ઉતોજન નથી.
2. મર્યાદિત મૂડી:- સહકારી મંડળીના સભ્યો દ્વારા તેની મૂડીમાં મર્યાદિત વધારો થાય છે કારણ કે સભ્યપદ સમાજના અમુક વર્ગ પુરતું જ મર્યાદિત હોય છે.
3. સંચાલનમાં સમસ્યાઓ:- સહકારી મંડળીનું સંચાલન આવશ્યક લાયકાતવાળું નથી. કારણ કે સહકારી મંડળી તેના કર્મચારીઓને મહેનતાણા નીચા ધોરણે ચૂકવે છે.
4. માથે લીધેલ જવાબદારીની ઉષ્ણપ:- સહકારી મંડળીની સફળતાનો આધાર તેના સભ્યોની નિષ્ઠા પર આધ્યારિત છે. તે ખાત્રીપુર્વક કે દબાણથી થઈ શકે નહિ.
5. સહકારનો અભાવ:- સહકારી મંડળી પરસ્પર સહકારના આશયથી સ્થપાય છે. પરંતુ એવું લાગે છે કે સભ્યો વચ્ચે ખુબ ઘર્ષણ હોય છે. પછી તે અંગત મતભેદ, અહેંકાર, ઘર્ષણ વગેરેને કારણે ઉદભવે છે. ઘણીવાર સભ્યોની સ્વાર્થી વર્તણૂંકને કારણે સહકારી મંડળીનો અંત આવે છે.



૪.૨ પાઠ આધારિત પ્રશ્નો

નીચેના વિધાનો સહકારી મંડળીને લગતા છે તેમાંથી કયા વિધાનો સાચા છે અને કયા વિધાનો ખોટા છે.

1. કોઈ પણ સક્ષમ સભ્યગમે ત્યારે સહકારી મંડળીનો સભ્ય થઈ શકે છે.
2. સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે.
3. તેનું સભ્યો કરતાં કાયદેસરનું અલગ વ્યક્તિત્વ હોવાને કારણે લાંબા સમય સુધી અસ્તિત્વ છે.
4. મંડળીનું સંચાલન માત્ર ઓક જ સભ્ય દ્વારા થાય છે.
5. સહકારી મંડળી મહત્તમ નકો કમાવવા કરતાં સભ્યોને સેવા પૂરી પાડવા રચવામાં આવે છે.
6. વ્યવસાયી સંચાલકો સહકારી મંડળીમાં કામ કરવાનું પસંદ કરતા નથી કારણ કે તેમને પુરતું મહેનતાણાં મળતું નથી.
7. સહકારી મંડળીની સફળતાનો આધાર સભ્યોની નિષ્ઠા પર છે. જેની નથી ખાત્રી મેળવી શકતી કે નથી દબાણ થઈ શકતું.

૪.૬ સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ

કંપનીઓનું સંચાલન ૧૯૫૬ના ભારતીય કંપનીધારા અન્વયે થાય છે. કાયદા પ્રમાણે કંપની એટલે જેને કાયદા મુજબ રચવામાં આવે છે અને નોંધણી કરવામાં આવે છે.



સંયુક્ત હિસ્સાવાળી કંપની

સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

તે કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ છે અને તે સતત વારસો અને સામાન્ય મહોર ધરાવે છે.

કંપનીની મૂડી સરખી કિમતના શેરની સંખ્યામાં વહેચાયેલી છે. સભ્યો કંપનીના એક કરતાં વધુ શેર ધરાવે છે. અને તે કંપનીના શેર હોલ્ડર તરીકે ઓળખાય છે.

૪.૭ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના લક્ષણ

- કાયદેસરની કૃત્રિમ વ્યક્તિત્વ:- કંપની કાયદાથી અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને તે માત્ર કાયદાના વિચાર પ્રમાણે અસ્તિત્વ ધરાવે છે. જેમ માનવી જન્મે છે, વિકાસ પામે છે, સંબંધોમાં દાખલ થાય છે અને મૃત્યુ પામે છે. આ જ રીતે સંયુક્ત હિસ્સાવાળી કંપની પણ જન્મે છે, વિકાસ પામે છે, સંબંધોમાં દાખલ થાય છે અને મૃત્યુ પામે છે. છતાંય તેની પાસે કૃત્રિમ વ્યક્તિત્વ છે. કારણકે તેનો જન્મ, અસ્તિત્વ અને મૃત્યુ કાયદા દ્વારા અંકુશિત છે.
- કાયદેસરનું અલગ વ્યક્તિત્વ:- કંપની તેના સહ્યો કરતાં અલગ કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે. તે પોતે મિલ્કત ધરાવી શકે છે અને તેના નામથી કરાર કરી શકે છે. તે તેના નામથી દાવો દાખલ કરી શકે છે.
- સતત વારસાનો હક્ક:- કંપની સતત વારસો ભોગવે છે. અને તેની જીદગીને સહ્યોના મૃત્યુ, નાદારી, ગાંડપણની અસર થતી નથી.
- મર્યાદિત જવાબદારી:- મર્યાદિત કંપનીના સહ્યોની જવાબદારી તેમને ખરીદેલ શેરની કિમત પૂરતી મર્યાદિત હોય છે અથવા તેમણે જેટલી રકમની ખાત્રી આપેલ હોય તેટલી જવાબદારી હોય છે.
- સામાન્ય મહોર:- કંપની કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે તેથી તે જાતે સહી કરી શકતી નથી. તેની કંપની પાસે તેની સામાન્ય મહોર (Common seal) હોય છે.
- શેરની ફેરબદલી:- જાહેર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી કરી શકાય છે. તે શેરબજાર દ્વારા ખરીદી અને વેચી શકાય છે.
- માલિકી અને સંચાલન અલગ:- જાહેર કંપનીની સહ્ય સંખ્યા વિશાળ હોય છે. તેથી તેમાંના બધા અથવા મોટા ભાગના સહ્યો કંપનીના રોજબરોજના સંચાલનમાં ભાગ લેતા નથી. કંપનીનું સંચાલન સહ્યો દ્વારા ચૂંટાયેલ (બોર્ડ ઓફ ડિરેક્ટર્સ) સંચાલન મંડળ દ્વારા થાય છે. આમ કંપનીની માલિકી તેના સંચાલનથી અલગ છે.



૪.૮ પાઠ આધારિત પ્રશ્નો

નીચેનામાંથી કયા વિધાન સાચા છે અને કયા વિધાન ખોટા છે.

- કંપનીની રચના કરવા માટે કાયદેસરની પ્રક્રિયા જરૂરી છે.
- જાહેર કંપનીના શેરની મુક્તપણે ફેરબદલી થઈ શકે છે.

મોડ્યુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



૩. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોય છે.
૪. સંયુક્ત હિસ્સાવાળી કંપની પોતાને નામે મિલકત ધરાવી શકે નહિએ.

૪.૮ કંપનીના પ્રકાર

માલિકીને આધારે કંપનીના ચાર પ્રકાર છે.

ખાનગી કંપની	સરકારી કંપની
જાહેર કંપની	બહુરાષ્ટ્રીય કંપની

ખાનગી કંપની:-

૧૯૫૮ના ભારતીય કંપનીધારા મુજબ જે કંપની એટલે એવી કંપની કે જેમાં એક લાખ રૂપિયાની ભરપાઈ થયેલ મૂડી હોય અથવા જણાવ્યા મુજબ તેનાથી વધુ મૂડી હોય અને તેના આર્ટીકલ્સ દ્વારા નીચે જણાવેલ લક્ષણો હોય.

૧. તેના સભ્યોના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય.
૨. સભ્યસંખ્યા માત્ર ૫૦ થી વધુ ન હોય.
૩. જાહેર જનતાને કંપનીના શેર અથવા ડિઝેન્ચરમાં નાણાં રોકવાનું આમંત્રણ આપી શકે નહિએ.
૪. વ્યક્તિઓ પાસેથી, તેના સભ્યો સિવાય, સંચાલકો અથવા તેમના સંબંધીઓને આમંત્રણ આપીને તેમની પાસેથી થાપણો સ્વીકારી શકે નહિએ.

જાહેર કંપની:-

૧૯૫૮ના ભારતીય કંપનીધારા મુજબ જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. તેના લક્ષણો નીચે મુજબ છે.

૧. તેના શેરની મુકૃતપણે ફેરબદલી થઈ શકે છે.
૨. તેની લઘુતમ શેરમૂડી રૂપિયા પાંચ લાખની હોય છે. અથવા સૂચાવ્યા મુજબ વધુ મૂડી હોય છે.
૩. જેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે.
૪. શેર હોલ્ડરની સંખ્યા જેટલા શેર બહાર પાડ્યા હોય અને ભરપાઈ થયેલા હોય તેટલી અથવા તો તેથી વધુ પણ ઓછામાં ઓછી સભ્ય સંખ્યા સાતથી ઓછી ન હોવી જોઈએ.

૪.૯ ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત

૧. ખાનગી કંપનીના સંજોગોમાં કંપની રચવા માટે ઓછામાં ઓછા બે સભ્યોની જરૂર પડે છે. જ્યારે જાહેર કંપનીની બાબતમાં સભ્યસંખ્યા સાતની હોવી જોઈએ.
૨. ખાનગી કંપનીની લઘુતમ ભરપાઈ થયેલી મૂડી રૂ. ૧ લાખ છે. જ્યારે જાહેર કંપનીની ઓછામાં ઓછી ભરપાઈ થયેલ મૂડી રૂ. ૫ લાખ છે.

સહકારી મંડળીઓ અને સંયુકત હિસ્સાવાળી કંપની

૩. ખાનગી કંપનીની બાબતમાં સભ્ય સંખ્યા ૫૦ થી વધુ ન હોવી જોઈએ. જ્યારે જાહેર કંપનીની બાબતમાં સભ્ય સંખ્યા પર આવા કોઈ નિયંત્રણ નથી.
૪. ખાનગી કંપનીમાં શેર ફેરબદ્ધલી પર નિયંત્રણ છે. જ્યારે જાહેર કંપનીની બાબતમાં શેરની ફેરબદ્ધોલી મુક્તપણે કરી શકાય છે.
૫. ખાનગી કંપની વિજ્ઞાપનપત્ર બાહાર પાડી શકતી નથી જ્યારે જાહેર કંપની સામાન્ય લોકોને શેર અથવા ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે આમંત્રણ આપી શકે છે.
૬. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે ડિરેક્ટર (સંચાલક) હોવા જોઈએ. જ્યારે જાહેર કંપનીની બાબતમાં ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર હોવા જોઈએ.
૭. ખાનગી કંપની સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા પછી ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીને રજીસ્ટ્રાર (નોંધણી અધિકારી) પાસેથી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યા પછી ધંધો શરૂ કરી શકે છે.
૮. ખાનગી કંપનીને કાયદેસરની સભા બોલાવવી જરૂરી નથી જ્યારે જાહેર કંપનીએ કાયદેસરની સભા ફરજીયાતપણે બોલાવવી પડે છે.
૯. ખાનગી કંપનીમાં બે સભ્ય જાતે હાજર રહીને 'કોરમ' રચે છે. જ્યારે જાહેર કંપનીમાં આ સંખ્યા પાંચ સભ્યોની છે.

મોડ્યુલ – ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



૪.૪ પાઠ આધારિત પ્રશ્નો

નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દો / શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો.

૧. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી હોવી જોઈએ.
૨. એક સભ્ય પાસેથી બીજા સભ્યમાં મુક્તપણે શેરની હેરફર લિ કંપનીમાં શક્ય નથી.
૩. હિન્દુસ્તાન મશીન ટુલ્સ કંપની છે.
૪. ખાનગી કંપની શરૂ કરવા માટે ઓછામાં ઓછી મૂડી રૂપિયા છે.

૪.૧૦ સંયુકત હિસ્સાવાળી કંપનીના ફાયદા

ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કંપનીની રચના કરવાથી ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપ કરતાં ઘણા ફાયદા છે જેનો લાભ કંપની મેળવે છે.

૧. મર્યાદિત જવાબદારી:- કંપનીના સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની દાર્શનિક કિમત જેટલી મર્યાદિત હોય છે.
૨. વિશાળ નાણાકીય સાધનો:- કંપની માલિકીની રચના દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય સાધનો એકત્રિત થઈ શકે છે. કંપનીની શેરમૂડી નાના એકમના શેરમાં વહેંચાયેલ હોય છે. જેથી ઓછા નાણા ઘરાવતા લોકો પણ કંપનીના શેર ખરીદી શકે છે.

મોડયુલ – ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

૩. સાતત્યઃ— કંપની વિક્ષેપ વગરની જીદગી જીવે છે. કોર્પોરેટ માળખા તરીકે તે મૃત્યુ પામે અથવા ત્યાગ કરે તો પણ તે ચાલુ રહે છે.
૪. શેરની ફેરબદ્દલીઃ— બીજા સભ્યોની સંમતિ વગર જાહેર કંપનીના સભ્યો શેરની ફેરબદ્દલી મુક્તપણે કરી શકે છે.
૫. ચોમેર ફેલાયેલ જોખમઃ— કંપનીના જોખમનું નુકસાન મોટી સંખ્યામાં રહેલા કંપનીના સભ્યોમાં ફેલાયેલ છે.
૬. સામાજીક લાભઃ— કંપનીનું વ્યવસ્થાતંત્ર સમાજની બચતની હેરફેર કરવામાં મદદ કરે છે અને ઉદ્યોગમાં તેનું રોકાણ કરે છે.

૪.૧૧ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓ

૧. રચના કરવામાં મુશ્કેલીઃ— કંપનીની રચના કરવી ખુબ મુશ્કેલ અને ખર્ચાળ છે. કંપનીના રજીસ્ટ્રાર (નોંધણી અધિકારી) પાસે અસંખ્ય દસ્તાવેજો તૈયાર કરીને નોંધાવવા પડે છે.
૨. વધુ પડતો સરકારી અંકુશઃ— કંપની તેના રોજબરોજના કાર્યોમાં જીણવટ ભરી રીતે કાયદાકીય નિયમોનું પાલન કરવાની શરતે બંધાયેલી છે. સામયિક માહિતી ઓડિટ અને હિસાબો પ્રકાશિત કરવાનું ફરજીયાત છે.
૩. કેટલાક માણસો દ્વારા સંચાલનઃ— કંપની દ્વારા સંચાલન લોકશાહી ઠબે દેખાય છે પણ વાસ્તવમાં તેનું સંચાલન કેટલાક (થોડા) માણસો દ્વારા થાય છે.
૪. નિર્ણયમાં વિલંબઃ— સંચાલનમાં ઘણી બધી સપાટીઓ નિર્ણય લેવામાં વિલંબ કરે છે. ઘણો બધો સમય સભા બોલાવવામાં, સભા કરવામાં અને ઠરાવ પસાર કરવામાં જાય છે.
૫. ગુપ્તતાનો અભાવ (અધિત):— ૧૮૮૮ના કંપની ઘારા મુજબ કંપનીએ તેના કાર્યવાહીનો વિવિધ ભાગ જાહેર જનતા સમક્ષ રજૂ કરવા પડે છે. આના પરિણામે રહેસ્યો ખાનગી રાખી શકતા નથી.

૪.૧૨ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અનુકૂળતા

કંપનીના સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર વિશાળ એકમો માટે અનુકૂળ છે. મોટા પાયા પરના કાર્યો માટે જરૂરી વિશાળ મૂડી ભેગી કરવાનું શક્ય બનાવ્યું છે. યંત્રો બનાવવા, માહિતી ટેકનોલોજી, લોંગડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ, ખાતર અને ફાર્માસ્યુટીકલ (દવા બનાવવા સંબંધી વગેરે) વગેરે સામાન્ય રીતે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના સ્વરૂપમાં સંગઠિત હોય છે. (ગોઠવાયેલા હોય છે.)

૪.૧૩ સરકારી કંપની

ભારતીય કંપનીઘારા ૧૮૮૮ મુજબ સરકારી કંપનીની વ્યાખ્યા આપવામાં આવી છે તે મુજબ એવી કંપની કે જેની ભરપાઈ થયેલી મૂડી ૫૧ ટકા સરકાર ધરાવતી હોય (સરકાર અને રાજ્ય) અને આવી કંપનીની ગૌણ કંપનીનો સમાવેશ કરતી હોય. સરકારી કંપનીનું

સરકારી મંડળીઓ અને સંયુકત હિસ્સાવાળી કંપની

ઓર્ડિટ કોમ્પોટ્રોલર અને ઓર્ડિટર જનરલ ઓર્ડર ઈન્ડિયા (GAGI) દ્વારા થાય છે અને તેના રિપોર્ટ સંસદ સમક્ષ મૂકવામાં આવે છે.

ભારતની મુખ્ય સરકારી કંપનીઓમાં હિન્દુસ્તાન મશીન ટુલ્સ, કોલ ઈન્ડિયા, સેઈલ, એન્ટીપીસી, એમટીએનએલ, ઓએનજીસી વગેરેનો સમાવેશ કરી શકાય.

ઓએનજીસી વગેરેનો સમાવેશ કરી શકાય.

સરકારી કંપનીના અન્ય ખાસ લક્ષણોની યાદી

નીચે મુજબ રજૂ કરી શકાય.



સરકારી કંપની

1. તે સ્વતંત્ર કાયદેસરનું અલગ અસ્તિત્વ ધરાવે છે.
2. કયાં તો સંપુર્ણ અથવા ભરપાઈ થયેલી શેર મૂડીના ૫૧ ટકા સરકાર ધરાવે છે.
3. બધા જ સંચાલકો અથવા મોટા ભાગના સરકાર દ્વારા નીમાય છે.
4. તેના કર્મચારીઓ શહેરી કર્મચારી નથી.



૪.૫ પાઠ આધારિત પ્રશ્નો

નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દો દ્વારા ખાલી જગ્યા પુરો.

1. સંયુકત હિસ્સાવાળી કંપનીના સભ્યોની જવાબદારી સુધી મર્યાદિત હોય છે.
2. સંયુકત હિસ્સાવાળી કંપનીના ધંધાનું વ્યવસ્થાતંત્રનું દ્વારા સંચાલન થાય છે.
3. કંપનીની રચનાનો ખર્ચ ખુબ જ હોય છે.
4. ઈન્ડિયન ઓર્ડિલ કોર્પોરેશન અને ઓએનજીસી ના દાખલા છે.
5. કંપનીના જોખમનું નુકસાન મોટા ભાગના વચ્ચે વહેચાયેલ છે.

૪.૧૪ બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીનો અર્થ

આ એવી કંપની છે કે જે પોતાનો ધંધો તેના દેશમાં તેની રચના માટે નહિ પરંતુ એક થી વધુ દેશમાં ચલાવે છે. આવી કંપનીઓ વસ્તુઓ બનાવે છે. અથવા એક કે વધુ દેશમાં સેવા પૂરી પાડે છે. તમે બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિષે સાંભળ્યું હશે જે ભારતમાં ધંધો ચલાવે છે. જેમ કે ફિલીપ્સ, એલજી, હુન્ડાઈ, જનરલ મોટસ ,



બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપની

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

કોકા કોલા, નેર્સે, સોની (Sony) મેક ડોનાલ્ડસ, સીટીબેન્ક, પેસ્ચી ફુડ્સ, કેડબરી વગેરે. બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપની પુષ્ટ કમાણીના લાભ મોટા પાયા પર ઉત્પાદન અને વિતરણની પ્રવ તી દેશની સરહદ બધાર થતી હોવાને કારણે મેળવે છે.

૪.૧૫ બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીના લાભ

- વિદેશી મૂડીનું રોકાણઃ— બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા મૂડીનું સીધુ રોકાણ થાય છે. જે અખ્ય વિકાસીત દેશોને તેમનો આર્થિક વિકાસ જરૂરી બનાવવામાં મદદ કરે છે.
- રોજગારીનું સર્જનઃ— બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીની ઔદ્ઘોગિક અને વ્યપારી પ્રવૃત્તિઓ રોજગારીની તકોનું સર્જન કરે છે. અને યજમાન દેશનું જીવનધોરણ ઉચ્ચ લાવે છે.
- અધતન ટેકનોલોજીનો ઉપયોગઃ— મોટા પાયા પરના સાધનોને કારણે બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપની સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરે છે કે જે ઉત્પાદનની પદ્ધતિ અને પ્રક્રિયામાં સુધારાનો ફાળો આપે છે. આમ વસ્તુની ગુણવત્તામાં વધારો કરે છે. કમશા: બીજા દેશો પણ આ ટેકનોલોજી અપનાવે છે.
- સહાયકારી એકમોની વૃદ્ધિઃ— બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીના કાર્યોને પરિણામે માલસામાન અને સેવા પૂરી પાડનારાઓની સંખ્યા યજમાન દેશમાં વધતી જાય છે.
- નિકાસમાં વૃદ્ધિ અને વિદેશી હૂંડીયામણશમાં આવકઃ— યજમાન દેશોનાં બનાવતી વસ્તુ કેટલીકવાર બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા નિકસ થતી હોય છે. આમ વિદેશી હૂંડિયામણ યજમાન દેશના રિઝર્વ હૂંડિયામણને વધારે છે.
- તંદુરસ્ત હરિફાઈઃ— બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા ગુણવત્તાસભર વસ્તુના કાર્યક્ષમ ઉત્પાદનો રાષ્ટ્રીય (સ્થાનિક) ઉત્પાદકોને બજારમાં ટકી રહેવા માટે તેમના પ્રયત્નો પ્રેરવા જણાવે છે.

૪.૧૬ બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીની મર્યાદાઓ

ઉપર ચર્ચા કરેલ ફાયદાઓ અલબત્ત યજમાન દેશ માટે લાભદાયી છે. પરંતુ બહુવિધ આંતરરાષ્ટ્રીય કંપનીની કેટલીક મર્યાદાઓ છે જેની આપણે નોંધ લેવી જોઈએ.

- યજમાન દેશની અગ્રતાને બહુસંબંધ નહિઃ— બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓ મોટે ભાગે મૂડીનું રોકાણ નફો કરતા ઉદ્ઘોગોમાં કરે છે. તે વિકસતા દેશોના ઉદ્ઘોગોના અગ્રતાક્રમ વિષે અને પછાત પ્રદેશમાં સેવા આપવાનું ધ્યાનમાં લેતા નથી.
- સ્થાનિક એકમો પર પ્રતિકુળ અસરઃ— મોટા પાયા પરના કાર્યો અને ટેકનોલોજીકલ આવડતને કારણે બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓ વારંવાર યજમાન દેશના બજાર પર વર્ચસ્વ જમાવે છે અને ઈજારાશાહી મેળવવાનો ઈરાદો ધરાવે છે. આમ ઘણાં સ્થાનિક એકમો બંધ કરવાની ફરજ પડે છે.

સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

૩. પદ્ધતિમાં (પ્રણાલિકા) ફેરફાર:- બહુવિધ રાષ્ટ્રીય કંપની દ્વારા લવાતી વપરાતી વસ્તુઓ, યજમાન દેશના ધોરણો પ્રમાણે હોતી નથી. આમ, લોકોની વપરાશની ટેવો ખાસ કરીને ખોરાક અને કપડામાં તેમના સાંસ્કૃતિક વારસા કરતાં ઘણી બદલાઈ જાય છે.



૪.૬ પાઠ આધારિત પ્રશ્નો

- અ. નીચે બહુવિધ રાષ્ટ્રીય કંપની અંગેના વિધાનો આપ્યા છે. તમે જણાવો કે તેમાંના કયા વિધાન સાચા છે અને કયા વિધાન ખોટા છે.
૧. બહુવિધ રાષ્ટ્રીય કંપની અથ્વ વિકસીત દેશોનો આર્થિક વિકાસ ધીમો પાડે છે.
 ૨. બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોને વિદેશી હૂંડિયામણ કર્માવવામાં મદદ કરે છે.
 ૩. બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓને કારણે સ્થાનિક ઉત્પાદકો તેમના કાર્યોમાં સુધારા કરે છે.
 ૪. સામાન્ય રીતે બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓ નફકારક ઉધોગોમાં રોકાણ કરે છે.
 ૫. બહુવિધ રાષ્ટ્રીય કંપની કદ્દી યજમાન દેશ પર ઈજારો સ્થાપતી નથી.
- બ. વિવિધ વિકલ્પવાળા પ્રશ્નો
૧. સહકારી મંડળીઓમાં નીચે જણાવેલ લક્ષણો હોતા નથી.

અ. ખુલ્લુ સભ્યપદ	બ. અલગ કાયદેસરનું વ્યક્તિત્વ
ક. નફાનો હેતુ	ડ. મતદાનની સત્તા
 ૨. નીચેનામાંથી કયા દાખલા ગ્રાહક સહકારી મંડળીના નથી.

અ. અપના બજાર	ક. સુપર બજાર
બ. કેન્દ્રીય ભંડાર	ડ. નારાયણ ગૃહ હાઉસીંગ સોસાયટી
 ૩. સહકારી મંડળીના સહ્યોની જવાબદારી છે.

અ. મર્યાદિત	બ. અમર્યાદિત
ક. સંયુક્ત	ડ. સંયુક્ત અને અલગ
 ૪. સહકારી મંડળીની સફળતાનો આધાર

અ. તેના સહ્યોની વજાદારી પર	બ. કેન્દ્ર સરકાર પર
ક. રાજ્ય સરકાર પર	ડ. સ્થાનિક સ્વ સરકાર પર છે.
 ૫. ખાનગી મર્યાદિત કંપનીમાં મૂરીની વહેચણી કરાય છે.

અ. કેન્દ્ર સરકાર	બ. માત્ર જનતા અને સરકાર
ક. માત્ર તેના સહ્યો	ડ. માત્ર જનતામાં શેર બહાર પાડીને

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ



તમે શું શીખ્યા?

- સહકારી મંડળી એ સ્વતંત્ર વ્યક્તિત્વોની સ્વૈચ્છક મંડળી છે કે જે સામાન્ય આર્થિક હિતોની પ્રાપ્તિ માટે પરસ્પર સહકાર (મદદ) દ્વારા કામ કરે છે.
- સહકારી મંડળીના લક્ષણો:-
 1. સ્વૈચ્છક સંગઠન
 2. ખુલ્લુ સમ્ભયપદ
 3. કાયદેસરનું અલગ વ્યક્તિત્વ
 4. નાણાંના સાધનો
 5. સેવાનો આશાય
 6. મતદાન અધિકાર
- સહકારી મંડળી, સહકારી મંડળી ધારા ૧૯૧૨ અન્વયે ઓછામાં ઓછા દસ સભ્યોથી રચી શકાય છે. સહકારી મંડળીની નોંધણી માટે અરજી સાથે મંડળીના પેટા કાયદા સહકારી મંડળીના નોંધણી અધિકારી સમક્ષ રજૂ કરવા પડે છે.
- સહકારી મંડળીના પ્રકારો:-
 1. ગ્રાહકોની સહકારી મંડળી
 2. ઉત્પાદકોની સહકારી મંડળી
 3. વેચાણ માટેની સહકારી મંડળી
 4. કરકસર અને વિરણ મંડળી
 5. સહકારી જૂથ ગ્રાહક મંડળી
- સહકારી મંડળીઓના ફાયદા:-
 1. મરજીયાત સંગઠન (સ્વૈચ્છક સંગઠન)
 2. લોકશાહી અંકુશ
 3. ખુલ્લુ સમ્ભયપદ
 4. મધ્યરસ્થીનો નફામાં ઘટાડો
 5. મર્યાદિત જવાબદારી
 6. સ્થિર જીવન
- સહકારી મંડળીની મયા દાઓ:-
 1. ઉતેજનનો અભાવ
 2. મર્યાદિત મૂડી
 3. સંચાલનમાં પ્રશ્નો

સહકારી મંડળીઓ અને સંયુકત હિસ્સાવાળી કંપની

- ४. માથે લીધેલ જવાબદારીનો અભાવ
- ५. સહકારનો અભાવ
- સંયુકત હિસ્સાવાળી કંપની એ કાયદાથી અસ્તિત્વમાં આવેલ કૃતિમ વ્યક્તિત્વ છે. તેને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ છે તે કમશા: વારસદાર અને સામાન્ય મહોર ધરાવે છે. કંપનીનું સંચાલન ૧૯૫૬ના કંપનીધારા અન્વયે થાય છે.
- સંયુકત હિસ્સાવાળી કંપનીના લક્ષણો:-
 ૧. કૃતિમ કાયદેસરની વ્યક્તિત્વ
 ૨. સ્વતંત્ર (અલગ) કાયદેસરનું વ્યક્તિત્વ
 ૩. સતત વરસાગત
 ૪. સભ્યોની મર્યાદિત જવાબદારી
 ૫. સામાન્ય મહોર
 ૬. શેરની ફેરબદલી
 ૭. માલિકી અને સંચાલન અલગ
- કંપનીના પ્રકારો:-
 ૧. ખાનગી મર્યાદિત કંપની
 ૨. જાહેર મર્યાદિત કંપની
 ૩. સહકારી કંપની
 ૪. બહુવિધ રાષ્ટ્રીય કંપની
- સંયુકત હિસ્સાવાળી કંપનીના ફાયદા:-
 ૧. મર્યાદિત જવાબદારી
 ૨. વિશાળ નાણાકીય સાધનો
 ૩. સાતત્ય
 ૪. શેરની ફેરબદલી
 ૫. ચોમેર ફેલાયેલ જોખમ
 ૬. સામાજીક લાભ
- સંયુકત હિસ્સાવાળી કંપનીના ગેરફાયદા:-
 ૧. રચનાની મુશ્કેલી
 ૨. સરકારનો વધુ પડતો અંકુશ
 ૩. જૂથ સંચાલન
 ૪. નિર્ણયમાં વિલંબ
 ૫. રહસ્યનો અભાવ

મોડયુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

મોડયુલ – ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

સહકારી મંડળીઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની

- સરકારી કંપની:—કંપની કે જેમાં ૫૧ ટકા શેર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર ધરાવતી હોય.
- બહુવિધ રાષ્ટ્રીય કંપની:— તે એવી કંપની છે કે જે તેની સ્થાપના દ્વારા તેના દેશમાં નહિ પણ એક કરતાં વધુ અન્ય દેશમાં ધંધો કરે છે.



સત્રાંત સ્વાધ્યાય

૧. સહકારી મંડળીનો અર્થ શું છે ?
૨. ગ્રાહક સહકારી મંડળી દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ ચલાવાય છે ?
૩. ગ્રાહક સહકારી મંડળી અને ઉત્પાદક સહકારી મંડળીના દરેકના બે બે દાખલા આપો.
૪. કરકસર અને વિરાષ મંડળીનો અર્થ શું થાય ?
૫. સહકારી મંડળીના સત્યો વચ્ચે ઘર્ષણ અને ઉતેજનના અભાવના કયા કારણો છે ?
૬. ઉત્પાદક સહકારી મંડળી અને માર્કેટીંગ (વેચાણ) સહકારી મંડળી વચ્ચેનો તફાવત આપો.
૭. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો શું અર્થ થાય ?
૮. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદા જણાવો.
૯. બહુવિધ રાષ્ટ્રીય કંપનીનો અર્થ જણાવો.
૧૦. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ગમે તે ચાર લક્ષણોનું વર્ણન કરો.
૧૧. ખાનગી મર્યાદિત કંપનીના શું લક્ષણો છે ? તે જાહેર મયા દિત કંપનીથી કઈ રીતે અલગ પડે છે?
૧૨. ખાનગી મર્યાદિત કંપની અને જાહેર મર્યાદિત કંપની વચ્ચેનો તફાવત જણાવો.
૧૩. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના લાભની યાદી આપો.
૧૪. સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓ જણાવો.
૧૫. બહુવિધ રાષ્ટ્રીય કંપનીના પાંચ ઉદાહરણો (દાખલા) આપો.



પાઠ્ય આધારિત પ્રશ્નોના જવાબ

૪.૧

- | | | |
|----------------------|--------------|--------------------------|
| ૧. સૈચિંદ્રિક, આથી ક | ૨. સેવાઓ | ૩. કાયદેસરનું વ્યક્તિત્વ |
| ૪. પરસ્પર મદદ | ૫. મધ્યરસ્થી | ૬. ગ્રાહક |

૪.૨

- | | | | |
|---------|---------|---------|----------|
| ૧. સાચુ | ૨. સાચુ | ૩. સાચુ | ૪. ખોટું |
| ૫. સાચુ | ૬. સાચુ | ૭. સાચુ | ૮. સાચુ |

સહકારી મંડળીઓ અને સંયુકત હિસ્સાવાળી કંપની

૪.૩

૧. સાચુ ૨. સાચુ ૩. ખોટુ ૪. ખોટુ

૪.૪

૧. બે ૨. ખાનગી ૩. સરકાર ૪. ૧ લાખ

૪.૫

૧. શેરની દાશ નિક કિંમત તે ધરાવે છે.
૨. સંચાલક મંડળ (બોર્ડ ઓફ ડિરેક્ટર્સ)
૩. ઉચ્ચં
૪. ભારતીય બહુવિધ રાષ્ટ્રીય કંપનીઓ
૫. સલ્બ્યો

૪.૬

અ.

૧. ખોટું ૨. સાચુ ૩. સાચુ ૪. સાચુ ૫. ખોટુ

બ.

૧. ક ૨. ઢ ૩. અ ૪. અ ૫. ક



તમારા માટે પ્રવૃત્તિઓ

૧. તમારા વિસ્તારમાં સહકારી મંડળીની શોધ કરો. મેળવવા પ્રયત્ન કરો.
 - અ. મંડળીની પ્રવૃત્તિઓ
 - બ. મંડળીની સલ્બ્ય સંખ્યા
 - ક. મંડળીનો પ્રશ્ન
૨. કોઈપણ એક કંપની, કયાં તો ખાનગી કે જાહેર કે સરકારી કે બહુવિધ રાષ્ટ્રીય કંપની શોધો. અને તેની સ્થાપના અંગે તેમજ તેના ધંઘાના કાયો અંગે માહિતી એકનિત કરવાનો પ્રયત્ન કરો.

મોડ્યુલ - ૨
વાણિજ્ય વ્યવસ્થાના
સ્વરૂપો



નોંધ

મોડયુલ - ૩

મહત્વમાં માર્ક

૨૫

અભ્યાસના કલાક

૪૫

સેવાના ક્ષેત્ર

આજનું વાણિજ્ય જગ્ઠિલ અને સેન્સીટીવ બની ગયું છે. વાણિજ્યની સફળતાનો આધાર જુદા જુદા પ્રકારની આનુષ્ઠાનિક સેવાઓ જેવી કે વાહન વ્યવહાર, વખાર, માહિતી સંચાર, ટપાલ વ્યવહાર, બેન્કિંગ, વીમો અને આઉટ સોર્સિંગ (BPO) વગેરે પર નિર્ભર છે. વાણિજ્યની આ સેવાઓ વિશ્વાળ પાયા પર પથરાયેલ હોય સમગ્ર વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓને ગતિશીલ શાખી વિકાસની નવી ટિશાઓ સર્જી શકે છે. આ મોડયુલ આનુષ્ઠાનિક સેવાઓનો અલ્યોક્સિક વિકાસ સમજાવી શકે છે.

પાઠ - ૫	:	વાહન વ્યવહારની સેવા
પાઠ - ૬	:	વખારની સેવા
પાઠ - ૭	:	માહિતી સંચારની સેવા
પાઠ - ૮	:	ટપાલ વ્યવસ્થા અને કુરિયરની સેવા
પાઠ - ૯	:	બેન્કની સેવા
પાઠ - ૧૦	:	વીમોની સેવા
પાઠ - ૧૧	:	આઉટ સોર્સિંગ



વાહન વ્યવહારની સેવા

આપણો દૈનિક જીવનમાં અનેક ઉત્પાદિત વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ. તેમાંની ઘણી ઉત્પાદિત વસ્તુઓ આપણા રહેઠાણની દૂરના સ્થળે ઉત્પાદિત થતી હોય છે. તેમ છતાં આપણો કેવી રીતે ચીજવસ્તુઓ આપણા સ્થળે મેળવી શકીએ છીએ? ઉત્પાદિત તમામ ચીજ વસ્તુઓ વિવિધ સ્થળેથી રેલ્વે માર્ગો, રસ્તા માર્ગો, જળ કે હવાઈ માર્ગો આપણા વિસ્તારમાં પૂરવઠો સતત ઉપલબ્ધ રાખે છે. વિદ્યાર્થી મિત્રો તમે ટ્રક, ટેમ્પો, બણદ ગાડીમાં કાચો માલ કે ઉત્પાદિત તૈયાર માલ એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન થતા જોયા હશે. એ જ રીતે તમોએ મુશાફરોને પણ એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન થતા જોયા હશે. જેઓ વિમાન, ટ્રેઇન, બસ કે કારમાં મુસાફરી કરતા હોય છે.

વસ્તુઓ અને વ્યક્તિઓની આ હેર-ફેર આર્થિક પ્રવૃત્તિઓ અત્યંત ઉપયોગી છે. વાહન વ્યવહારને કારણે જ કાચો માલ ઔદ્યોગિક કેન્દ્રમાં પહોંચે છે અને તૈયાર વસ્તુઓ-માલ વિવિધ બજારોમાં કે પ્રત્યક્ષ વપરાશકારો પાસે પહોંચે છે. માનવશ્રમ પણ વાહન વ્યવહારની સેવાથી જ એક સ્થળેથી બીજા સ્થળે ઉપયોગમાં લઈ શકાય છે.

આ પ્રકરણમાં આપણો માલ સામાન અને શ્રમ પુરવઠો એક સ્થળેથી બીજે સ્થળે કેવી રીતે સ્થળાંતર કરે છે તેનો અભ્યાસ કરીશું.



હેતુઓ:-

આ પ્રકરણના અભ્યાસ અંતે તમે આટલું જાણશો.

- વાહન વ્યવહારનો અર્થ જણાવી શકશો.
- વાહન વ્યવહારની અગત્યતા
- વાહન વ્યવહારના વિવિધ માધ્યમો – પ્રકારો
- વાહન વ્યવહારના વિવિધ પ્રકારોનો તુલાનાત્મક અભ્યાસ

૫.૧ વાહન વ્યવહારનો અર્થ

"વાહન વ્યવહારની સેવા એવી પ્રક્રિયા છે કે જેમાં વિવિધ પ્રકારનો માલ સામાન અને વ્યક્તિઓનો એક સ્થળેથી બીજા સ્થળે ભૌતિક સ્થળાંતર કરવામાં આવે છે.

વाहन व्यवहारनी सेवा

વाहन व्यवहार एवं व्यापारनी आनुषंगिक – सહायक सेवा છે. એટલે કે તે કાચા માલને ઉત્પાદનના સ્થળે લઈ જવાના અને તૈયાર માલને અંતિમ વપરાશના બજારના સ્થળ સુધી વિતરણ કરવા માટે વેપાર અને ઉદ્ઘોગને આધાર આપે છે.

આમ વાહનવ्यવહારના વ્યવસાયમાં જે વ્યકિતઓ અને પેઢીઓ રોકાયેલી છે તેમને ટ્રાન્સપોર્ટર કહે છે. તેમનું મુખ્ય કાર્ય કાચો માલ, અધ્ય તૈયાર માલ, તૈયાર માલ અને માનવ મહેરામણ એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવાનું છે.

૫.૨ વાહન વ्यવહારનું મહત્વ

વાહન વ्यવહારનો અર્થ જોતાં વસ્તુના અંતર અંગેના અવરોધો દૂર કરે છે. હવે એક સ્થળને ઉત્પન્ન થયેલ ચીજ વસ્તુઓ બીજે દૂરને સ્થળે સહેલાઈથી ઉપલબ્ધ બને છે. લોકો વિશ્વભરમાં વાહનવ्यવહારને કારણે મુક્ત મને સહેલગાહ કરી શકે છે. વાહન વ्यવહારની સેવા વિના ધંધાકિય એકમો એક ડગલું પણ ચાલી શકે નહિ. વાહન વ्यવહારનું મહત્વ નીચેના મુદ્દા દ્વારા સમજી શકાય છે:

૧. ઉત્પાદકો કે નિર્માતાઓને કાચા માલનો પુરવઠો પૂરો પાડે છે:-

વાહન વ्यવહારની સેવા જે સ્થળેથી કાચો માલ ઉપલબ્ધ હોય ત્યાંથી એવા સ્થળે વહન કરે છે કે જ્યાં ઉત્પાદન પ્રક્રિયા દ્વારા તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવતો હોય.

૨. ગ્રાહકોને ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બનાવે છે:-

વાહન વ्यવહાર દ્વારા વસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી અને ઝડપથી મોકલી શકાય છે. આમ દેશના જુદા જુદા ભાગમાં ફેલાયેલા ગ્રાહકો દૂરના સ્થળોએ ઉત્પાદિત થયેલ ચીજોનાં વપરાશનો લાભ મેળવે છે.

૩. જીવનધોરણ ઉચ્ચ લાવે છે:-

વાહન વ्यવહારના સરળ સાધનો ઉત્પાદન પડતર નીચી લાવી વિશાળ પાયા પર ઉત્પાદન ઝડપી બનાવે છે. તે ઉપભોક્તાઓને જુદી જુદી કિમતે જુદા જુદા જથ્થાની વસ્તુઓનો ઉપયોગ કરવાની પસંદગી આપે છે. તેથી તે લોકોનું જીવનધોરણ ઉચ્ચ લાવે છે.

૪. નીચી પડતરે મોટા પાયા પર ઉત્પાદનના લાભ શક્ય બનાવે છે:-

આપણે જાણીએ છીએ કે મોટા પાયા પર ઔદ્ઘોગિક ઉત્પાદન હંમેશા શક્ય હોતું નથી. કારણકે અંતરમાળખાકિય સુવિધાના અભાવે. પરંતુ વાહનવ्यવહારની સેવાને કારણે મોટા પાયા પર કાચા માલ અને તૈયાર માલ અને શ્રમના પુરવઠાની સ્થાનાંતર કરી નીચી પડતરે મોટા પાયા પર ઉત્પાદન શક્ય બનાવે છે.

૫. કટોકટી અને કુદરતી આઇટ દરમિયાન મદદ કરે છે:-

યુધ્ય, અંતરિક અશાંતિ કે તોકાનોને લીધે રાષ્ટ્રીય કટોકટીના સમયે વાહનવ्यવહાર ઝડપથી વસ્તુઓ અને માનવોની હેરફેર કરી શાંતિ અને સલામતિ સ્થાપે છે.

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



૬. રોજગારી ઉત્પન્ન કરવામાં સહાય કરે છે:-

વાહન વ્યવહારની સેવા વ્યક્તિઓને ડ્રાઇવર, કંડકટર, પાઈલોટ, કેબીન–કુ, જહાજના કેપ્ટન વગેરે કે જેઓ વાહન વ્યવહારની સેવા સાથે સીધી રીતે સંખાયેલા હોય છે. તેમને માટે રોજગારીની તકો પૂરી પાડે છે. વળી તે એવા લોકો કે જેઓ આડકતરી રીતે વાહનો ઉત્પન્ન કરતા વિવિધ ઉદ્ઘોગોમાં નિર્માણ કાર્ય માં રોકાયેલા હોય છે. તેમને પણ રોજગારી પૂરી પાડે છે. આ ઉપરાંત પરોક્ષ રીતે વાહન વ્યવહારના ગેરેજ કે સર્વિસ સ્ટેશનો ખોલીને પણ રોજગારી મેળવતા હોય છે.

૭. શ્રમની ગતિશીલતામાં મદદરૂપ:-

વાહન વ્યવહારની સેવા માનવશ્રમને ગતિશીલતા બદ્ધવામાં પૂર્ખી મદદરૂપ બને છે. આપણા દેશના નાગરિકો વિદેશના ઉદ્ઘોગોમાં કામ કરવા વિદેશ જાય છે. અને વિદેશના નાગરિકો કામ મેળવવા ભારતમાં આવે છે. આપણા દેશના શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે શ્રમનો પુરવઠો પૂરો પાડવા સતત વાહન વ્યવહારની સેવા લેતા હોય છે. એવું હંમેશા ન બને કે કારખાનાની નજીક જ હંમેશા કામદાર રહેતા હોય તેવા સમયે કારખાનાના માલિક દ્વારા જ કામદારોને લાવવા લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા સ્ટાફ બસ સુવિધા આપતા હોય છે.

૮. રાષ્ટ્રોને એક સાથે રાખવામાં મદદરૂપ થાય છે:-

વાહનવ્યવહારની સેવા દ્વારા નાગરિકો અને વસ્તુઓની હેરફર એક દેશમાંથી બીજા દેશમાં ખુલ્લ સરળ રીતે થઈ શકે છે. સાંસ્કૃતિક અને રીત રિવાજોના આદાન–પ્રદાન માટે વાહનવ્યવહાર મદદરૂપ છે. આ આદાન–પ્રદાનથી રાષ્ટ્રો–રાષ્ટ્રો વચ્ચે ભાઈચારાની લાગણી પ્રવર્તે છે.



૫.૧ પાઠ્યગત પ્રશ્નો

નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે અને કયા ખોટા છે તે જણાવો.

૧. ધંધામાં વાહન વ્યવહારની સેવા આનુષ્ઠાનિક ગણાય છે.
૨. વાહન વ્યવહારની સેવા લોકોનું જીવનધોરણ ઉચ્ચ લાવવામાં મદદરૂપ નથી.
૩. રાષ્ટ્રો વચ્ચે સંસ્કૃતિના આદાન–પ્રદાન વાહન વ્યવહારને આભારી નથી.
૪. વાહન વ્યવહારની સેવાથી કોઈ પણ પ્રકારની રોજગારી ઉભી થતી નથી.
૫. શ્રમની ગતિશીલતા વાહન વ્યવહારની સેવાથી વધે છે.

૫.૨ વાહન વ્યવહારના પ્રકારો અને સાધનો

આપણે જોઈ શકીએ છીએ મૂળભૂત રીતે સમગ્ર વાહન વ્યવહાર જમીન માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ થાય છે. આ જ વાહન વ્યવહારના પ્રકાર છે. જમીન પર આપણે ચીજ

વाहन व्यवहारनी सेवा

वस्तुओं लઈ જવा ટ્રક, ટ्रैक्टर વગेરे ઉપयोगમां લઈએ છીએ. હવाई માર્ગ માટે આપણે વિમાન ડેલિકોપ્ટર ઉપયોગમાં લઈએ છીએ. જે ચીજવસ્તુઓ સાથે મુસાફરોન પણ વહન કરે છે. તેવી જ રીતે જળમાર્ગ જહાજ, સ્ટીમર વગેરે ચીજવસ્તુઓ સાથે મુસાફરોન પણ વહન કરે છે. આ બધા વાહનો વાહન વ्यવહારના સાધન તરીકે ઓળખાય છે.

વાહન વ्यવહારના પ્રકાર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. ભૂમિ (જમીન) માર્ગ, જળમાર્ગ વાહન વ्यવહાર અને હવાઈ માર્ગ વાહન વ्यવહાર.

ચાલો આપણે વાહન વ्यવહારની વિવિધ રીતો વિશે ચર્ચા કરીએ.

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૫.૪ ભૂમિ (જમીન) વાહન વ्यવહાર

ભૂમિ વાહન વ्यવહાર ચીજ વસ્તુઓ અને મુસાફરોની જમીન પરનાં ભૌતિક સ્થળાંતર – વહનની પ્રવૃત્તિઓ સૂચયે છે. આ પરિવહન રસ્તા (રોડ), રેલ, દોરડા કે પાઈપ દ્વારા થતી હોય છે. ભૂમિ (જમીન) માર્ગના પેટા વિભાગોમાં રોડ ટ્રાન્સપોર્ટ, રેલ ટ્રાન્સપોર્ટ, રોપ – વે અને પાઈપ લાઇનનો સમાવેશ થાય છે. ચાલો આપણે તે દરેક વિશે વિસ્તારથી સમજીએ.

૫.૫ રોડ (રસ્તા) ટ્રાન્સપોર્ટ

રોડ એ જમીનની સપાટી પર એક સ્થળને બીજા સ્થળ સાથે જોડનાર માધ્યમ છે. તમે તમારા ગામમાં, નગરોમાં અને શહેરોમાં રસ્તા જોયા હશે. તે બધા રસ્તા સરખા લાગતા નથી. તેમાંના કેટલાક રેતીના, તો કેટલાક ચિપ અને સિમેન્ટ અથવા કોલટાર (ડામર)નાં બનેલા હોય છે. તમે રોડ પર દોડતાં જુદા – જુદા વાહનો જેવાં કે બળદગાડાં, સાઈકલ, બાઈક, કાર, ટ્રક, બસ, રીક્ષા વગેરે જુઓ છો. આ તમામ રોડ ટ્રાન્સપોર્ટના વિવિધ સાધનો કહેવાય. રોડ ટ્રાન્સપોર્ટનાં સાધનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય.

૧. મનુષ્ય દ્વારા ચલાવતા,
૨. પ્રાણીઓ દ્વારા હંકારાતા,
૩. મોટર દ્વારા હંકારાતા.



રોડ ટ્રાન્સપોર્ટ નું ચિત્ર

તમે કેટલીક એવી વ્યક્તિઓ જોઈ હશે, જે પોતાના માથા પર કે પીઠ પર, સાઈકલ કે ઠેલા પર સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. લોકો ટૂંકા અંતર માટે સાઈકલ



કે રીક્ષા સવારીનો ઉપયોગ કરે છે. વળી આપણે પ્રાણીઓ દ્વારા ચલાવતાં વાહનો (બણદ, ઉટ, ઘોડા, ગઢેડાં) વગેરે ગ્રામ્ય વિસ્તારમાં પાક, ઘાસ–ચારો, લાકડા વગેરે લાવવા લઈ જતા જોઈએ છીએ. કેટલીક વાર પ્રાણીઓ જ વસ્તુ કે માનવોની હેરફેર કરે છે. એવા વિસ્તારો કે જે સામાન્ય રીતે વર્ષભર બરફથી છવાયેલા રહે છે, ત્યાં આપણે કૂતરાઓથી ખોચાતી સ્લેજ (બરફ પર ચલાવતી ગાડી) જોઈએ છેએ, જે ઉતારુંઓ અને સામાન બંન્નેને લઈ જવા વપરાય છે. મનુષ્ય દ્વારા કે પ્રાણીઓ દ્વારા હંકારાતા રોડ ટ્રાન્સપોર્ટનાં સાધનોની સરખામણીમાં મોટર દ્વારા હંકારાતા વાહન વ્યવહારનાં સાધન વર્તમાન સમયમાં બૃહદ ઉપયોગી બન્યા છે. તેઓની ઝડપ અને વહન ક્ષમતાને કારણે વધુ ઉપયોગી બન્યા છે. દેશના દરેક ખૂણે રોડના વિસ્તારથી મોટર વડે ચાલતા વાહન વ્યવહારનો ઉપયોગ વધ્યો છે. સામાન અને ઉતારુંઓને લઈ જવા વપરાતાં મોટર–વાહનોના પ્રકારોમાં ઓટો–રિક્ષા, સ્કૂટર, વાન, બસ ટેમ્પો અને ટ્રક વગેરેનો સમાવેશ થાય છે. કલકતામાં ટ્રામ–વે પણ ઉતારુંઓને લઈ જવા માટે રોડ ટ્રાન્સપોર્ટનો એક ભાગ બને છે.

૫.૬ રોડ ટ્રાન્સપોર્ટના લાભ

રોડ ટ્રાન્સપોર્ટના લાભ નીચે મુજબ છે.

૧. વાહન વ્યવહારના તમામ માર્ગોની સરખામણીમાં સૌથી સસ્તો માર્ગ છે.
૨. ઝડપી નાશવંત વસ્તુઓ રોડના માધ્યમ દ્વારા ટૂંકા માર્ગ ઝડપથી વહન કરી ઉપયોગી બનાવી શકાય.
૩. વાહન વ્યવહારની તે એક લવચીક – સૌથી સરળ ઉપલબ્ધ રીત છે. જે કોઈ પણ સ્થળે વસ્તુનું કે માનવાનું વહન શક્ય બનાવે છે.
૪. તેના દ્વારા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે અને માલ સામાન લઈ જાય છે અને તે એવા સ્થળોએ પણ વાહન વ્યવહાર શક્ય બનાવેછે કે જ્યાં અન્ય માર્ગો ન હોય જેમ કે પવ તો કે દુર્ગમ જંગલો કે રણ વિસ્તારો.

૫.૭ રોડ (રસ્તા) માર્ગની મર્યાદાઓ

તેની મર્યાદાઓ નીચે મુજબ છે.

૧. મર્યાદિત માલ–વહન ક્ષમતાને લીધે રોડ ટ્રાન્સપોર્ટ માલના લાંબા અંતરના વહન માટે કરક્સરવાળો નથી.
૨. ભારે માલ કે જથ્થાબંધ માલના રોડ દ્વારા વાહન વ્યવહાર ખૂબ ખર્ચાળ છે.
૩. પ્રતીકૂળ હવામાન પરિસ્થિતિઓની તેના પર અસર થાય છે. પૂર, વરસાદ, ભૂસ્ખલન (પર્વતની ભેડ તૂટી પડવી) વગેરે કેટલીક વાર રોડ ટ્રાન્સપોર્ટમાં અવરોધ ઉત્પન્ન કરે છે.

૫.૮ રેલ્વે માર્ગ – રેલ્વે ટ્રાન્સપોર્ટ



નોંધ

રેલ્વે લાઈન પર ટ્રેન દ્વારા માલ અને મુસાફરોનો વાહન વ્યવહાર રેલ્વે ટ્રાન્સપોર્ટ કહેવાય છે. તે આપણા દેશના વાહન વ્યવહાર તંત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને લાંબા અંતર પર માલ અને મુસાફરોને લઈ જવા માટે વાહન વ્યવહારની સૌથી ભરોસો રાખી શકાય તેવી રીત છે. લાંબા અંતર ઉપરાંત મુસાફરોનો સ્થાનિક વાહન વ્યવહાર પણ લોકલ ટ્રેન કે મેટ્રો રેલ દ્વારા કેટલાક મેટ્રોપોલિટન શહેરોમાં પૂરો



રેલ્વે ટ્રાન્સપોર્ટ

પાડવામાં આવે છે. રેલ્વે સેવા કેટલાક કુંગરાળ કે પર્વતીય પ્રદેશો સિવાય દેશભરમાં ઉપલબ્ધ છે. ભારતમાં બે પ્રકારની ટ્રેન જોવા મળે છે. એક મુસાફરો (પેસેન્જર) માટેની ટ્રેન અને બીજી છે તે ભારવહન (ગુડ્જ ટ્રેન). પેસેન્જર ટ્રેન મુસાફરો તેમજ માલનો મર્યાદિત જથ્થો બન્ને વહન કરી જાય છે. ત્યારે ગુડ્જ ટ્રેન માત્ર ગુડ્જ (માલ) એક સ્થળોથી બીજે સ્થળે લઈ જવા વપરાય છે. આ ટ્રેન રેલ્વે એન્જિન દ્વારા ચલાવાય છે અને તેમાં વરાળ, ડિઝલ કે વિદ્યુત પાવર વપરાય છે. ચાલો, હે આપણે રેલ્વે વ્યવહારના લાભ અને ગેરલાભ ચર્ચા કરીએ.

૫.૯ રેલ્વે માર્ગના લાભ

- લાંબા અંતરની મુસાફરી માટે તે એક અનુકૂળ વાહન વ્યવહારની રીતે છે.
- તે રોડ ટ્રાન્સપોર્ટ કરતાં વધુ જરૂરી છે.
- તે લાંબા અંતરે વિશાળ જથ્થામાં ભારે માલ વહન માટે ઉપયોગી છે.
- તેની કામગીરી ઉપર પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ જેવી કે વરસાદ, પૂર, ધૂમમસ વેરેની અસર ઓછી પડે છે.

૫.૧૦ રેલ્વે માર્ગના ગેરલાભ

- ટૂંકા અંતરે માલસામાન તેમજ ઉતારુઓને લાવવા – લઈ જવા સાપેક્ષે ખર્ચાની પડે છે.
- દેશના અંતરિયાળ પ્રદેશોમાં આ સેવા ઉપલબ્ધ નથી.
- તે નિયત સમયપત્રક મુજબ જ સેવા આપી શકે અને કોઈ પણ સ્થળોથી માલ ભરવા કે ખાલી કરવામાં લવચીકતા (સરળતા) હોતી નથી.
- તેમાં અકસ્માતના કિસ્સામાં માનવજીવન તેમજ માલ સામાની ભારે ખુલારી થાય છે.



૪.૧૧ પાઈપ લાઇન ટ્રાન્સપોર્ટ

વર્તમાન સમયમાં પાઈપ લાઇન વિવિધ હેતુઓ માટે વપરાય છે. રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં પાઈપ લાઇનની મદદ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. વળી પેટ્રોલિયમ પેદશો જેવી કે ગેસ વગેરે પણ સલામત રીતે વહન કરી શકાય છે. પેટ્રોલિયમ તેમજ નેચરલ ગેસનું વહન પૂરવડો વિશાળ અને સતત હોય તો, રોડ અને રેલવે વાહન વ્યવહારની સરખામણીમાં સૌથી અનુકૂળ તેમજ કરકસરભરી રીત છે. પરંતુ પાઈપ લાઇન નાખવામાં અને તેની જાળવણી કરવા માટે વિશાળ મૂડી રોકાણ જરૂરી હોય છે.



પાઈપ લાઇન ટ્રાન્સપોર્ટ

૪.૧૨ રોપ–વે ટ્રાન્સપોર્ટ

રોપ–વે વાહન વ્યવહારની એવી રીત છે જે પર્વત પર કે ખીંચ કે નદી પરનાં બે સ્થળોને જોડે છે. પર્વતીય પ્રદેશોમાં લોખંડના દોરડા (રોપ વે) સાથે ટ્રોલી પૈડા સાથે જોડાયેલી હોય છે. અને તેમાં ઉતારું ઓ કે ખાદ્ય સામગ્રી – વપરાશી વસ્તુઓનું વહન થાય છે. ગુજરાતમાં પ્રસિદ્ધ ઊડન ખટોલા જગદંબા એ રોપ–વે વાહન વ્યવહારનું ઉદાહરણ છે. જે યાત્રાળુઓને પર્વત પર આવેલ મંદિરે લઈ જાય છે. એકી વખતે ૫૦ થી વધારે યાત્રાળું યાત્રા કરે છે.



રોપ – વે ટ્રાન્સપોર્ટ



૪.૨ પાઠગત પ્રશ્નો

૧. નીચેના કયા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
 ૧. વાહન વ્યવહાર એટલે માત્ર માલ મોકલવો, વ્યક્તિગ્રામો નહિ.
 ૨. વાહન વ્યવહાર અંતરનો અંતરાય દૂર કરે છે.
 ૩. પાઈપ લાઇન વાહન વ્યવહાર એ જમીન – ભૂમિ વાહન વ્યવહારનો પ્રકાર નથી.
 ૪. રોડ ટ્રાન્સપોર્ટ પર પ્રતિકૂળ હવામાનની અસર થતી નથી.
 ૫. રેલવે માર્ગ એ ભારે અને જથ્થાબંધ માલ સામાન લઈ જવા માટે અનુકૂળ માર્ગ છે.

વाहन व्यवहारनी सेवा

૨. કોલમ A ને કોલમ B ના સાચા જવાબ સાથે જોડો.

કોલમ A	કોલમ B
૧. હાથલારી (ટેલા)	અ. ખીણમાં પરિવહન સરળ બનાવે છે.
૨. રોપ—વે	બ. ભારે અને જથ્થાબંધ માલ સામાન લઈ જવાની રીત
૩. સ્લેજ	ક. ગેસ પરિવહન માટે ટ્રોન્સપોર્ટની રીત
૪. રેલ્વે	ડ. માનવ દ્વારા ચલાવાતા વાહન વ्यવહારનું માધ્યમ
૫. પાઈપ લાઇન	ઇ. જેચવા માટે ફૂતરા વપરાય છે.

૫.૧૩ જળ વાહન વ्यવહાર

જળ વાહન વ्यવહાર એટલે વિવિધ સાધનો જેવાં કે બોર, સ્ટીમર લોંચ, હોળી કે જહાજ દ્વારા જળમાર્ગ માલ સામાન અને ઉત્તારુઓનો પરિવહન. આ સાધનો દ્વારા માલ સામાન અને મુસાફરો દેશની અંદર અને બહાર ફરી શકે છે. દેશમાં નદીઓ અને નહેર દ્વારા હોળી કે બોર લોંચ દ્વારા અવર જવર સરળ બને છે. માલ સામાન અને મુસાફરો દેશની અંદર જ અવર જવર કરતા હોઈ વાહન વ्यવહારના આ પ્રકારને આંતરિક જળમાર્ગ કહે છે. જ્યારે જળમાર્ગના જુદા જુદા સાધનોનો ઉપયોગ માલ સામાન અને ઉત્તારુઓને દરિયાઈ માર્ગ લઈ જવય ત્યારે તેને બાહા જળમાર્ગ કે મહાસાગરીય જળમાર્ગ કહે છે. ચાલો, હવે આપણે જળ વાહન વ्यવહારના આ બે પ્રકારોનો વધુ અભ્યાસ કરીએ.

૫.૧૪ આંતરિક જળમાર્ગ

આંતરિક કે અંત દેશીય જળમાર્ગમાં માલ સામાન અને મુસાફરોને નદી અને નહેર માર્ગ લાવવા—લઈ જવા હોડી (બોર) લોંચ, બાજ — ફેરી, આગબોર — સ્ટીમર વગેરેનો ઉપયોગ થાય છે. આ માર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. આ માર્ગ જથ્થાબંધ માલ સામાનનું વહન કરવા કે આંતરિક વેપારને ઉપયોગી થવા મદદરૂપ બને છે. આંતરિક જળ માર્ગ ઉત્તારુઓ માટે આપણા દેશમાં એટલો પ્રચલિત નથી. આંતરિક જળમાર્ગ માત્ર કેટલાક રાજ્યોમાં ચાલે છે, જેવા કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આસામ, તામિલનાડુ વગેરે.

૫.૧૫ દરિયાઈ માર્ગ (બાહા જળમાર્ગ)

બાહા જળમાર્ગ એટલે દરિયા કે મહાસાગર દ્વારા જહાજની મદદથી માલ સામાન અને મુસાફરોની અવર જવર. આ માર્ગ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ અગત્યનો છે. વળી તે તટીય (કિનારાના) વિસ્તારોમાં માલ અને મુસાફરોના વહન માટે પણ વપરાય છે. મહાસાગરીય વાહન વ्यવહારને તેનો નિયત માર્ગ હોય છે. જે વિશ્વના લગભગ તમામ દેશોને સાંકળે છે. દરિયાઈ માર્ગના બે પ્રકારો છે.

વાણીજ્ય વ્યવસ્થા

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



દરિયાઈ માર્ગ



૧. તરીય જહાજી માર્ગ:- આ વાહન વ્યવહારમાં જહાજો દેશના મુખ્ય બંદરો વચ્ચે દોડે છે. આનાથી દેશી વેપારને તેમજ દેશમાં ઉતારું ઓને લઈ જવામાં પણ મદદ કરે છે.

૨. દરિયાપાર જહાજી:- આ વાહન વ્યવહારમાં જહાજો દરિયા કે મહાસાગરથી અલગ પડેલ જુદા જુદા દેશો વચ્ચે પરિવહન કરે છે. તે મુખ્યત્વે ઔંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી બને છે. તે ભારે યંત્રો અને જથ્થાબંધ માલ લઈ જવા કરકસરપૂર્વક વાહન વ્યવહારનું માદ્યમ છે.



દરિયાપાર જહાજી

દરિયાપાર વાહન વ્યવહાર નિયત માર્ગોએ ચાલે છે. જે લગતના તમામ દેશોને સાંકળે છે. દરિયાઈ વાહન વ્યવહારમાં જુદા જુદા પ્રકારનાં જહાજો મુસાફરો અને માલ સામાન લાવવા – લઈ જવા વપરાય છે. અ. વ હ । શ (લાઈનર) – વહાણ (લાઈનર) એ ઉતારું કે માલ વાહક વહાણ (કાગો વેસલ્સ) છે. જે ચોક્કસ કંપનીના માલિકીના હોય છે. આ લાઈનર – જહાજ નિયત સમય પત્રક પ્રમાણે પરિવહન કરે છે. બ. માલ વાહક વહાણ (ટ્રેમ્પ – Tramp) – ટ્રેમ્પ એ માલ વાહક (કાગો) જહાજ છે. જે નિયમિત મુસાફરી કરતું નથી. પરંતુ માલના વહનની જરૂરિયાત મુજબ કાય રત થાય છે. તે કોઈ નિયત માગ કે નિયત સમય પત્રકને લાઈનરની માફક અનુસરતું નથી.

૫.૧૬ જળમાર્ગ વાહન વ્યવહારના લાભ

જળમાર્ગના લાભ નીચે પ્રમાણે છે.

- તે જથ્થાબંધ અને ભારે માલ માટે કરકસરપૂર્વક વાહન વ્યવહાર કરે છે.
- તે સલામત ભરેલો, અક્સમાત ઓછા થવાની શક્યતાવાળો માર્ગ છે.
- માર્ગો બાંધવાના કે જાળવવાનાં ખર્ચ ખૂબ ઓછા હોય છે. કારણ કે આ માર્ગ કુદરતી માર્ગ છે.

૫.૧૭ જળમાર્ગ વાહન વ્યવહારના ગેરલાભ

- નદીઓ અને નહેર ઉડાઈ અને જહાજ ચલાવવાની અનુરૂપતા અલગ અલગ હોય છે. અને આમ જુદાં જુદાં વાહન વ્યવહાર વહાણોની કામગીરીને અસર કરે છે.
- સૌથી દીમો માર્ગ છે જેથી જડપથી નાશ પામતા માલનું વહન કરવું મુશ્કેલ છે.
- હવામાનની આ માર્ગ પર ભારે અસર થાય છે.

વाहन व्यवहारनी सेवा

૪. દરियાઈ વાહન વ्यવહારને જહાજ અને તેમની જાળવણી માટે મોટું રોકાણ અનિવાર્ય છે.



પ.૩ પાઠગત પ્રશ્નો

૧. નીચેના પૈકી કયા વિધાનો સાચા કે ખોટા છે તે જણાવો.

૧. આંતરિક જળમાર્ગ દરિયા અને મહાસાગરથી જોડાયેલ છે.

૨. જળમાર્ગ એ ઘણો ઝડપી વાહન વ्यવહાર માર્ગ છે.

૩. જળમાર્ગ આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવે છે.

૪. દરિયા પાર જહાજો પડોશી દેશોમાં જાય છે.

૫. જળમાર્ગને વાતાવરણની કોઈ વિપરીત અસર થતી નથી.

૨. નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરી પૂર્ણ કરો.

૧. જહાજ એ કાગ્યો જહાજ છે. જેનો ચોક્કસ સમય અને માર્ગ નિશ્ચિત હોતો નથી.

૨. આંતરિક જળમાર્ગ સામાન્ય રીતે વેપાર માટે વપરાય છે.

૩. નિયત માર્ગ નિયમિત દોડતા જહાજો કહેવાય છે.

૪. મહાસાગરીય માર્ગ મુખ્યત્વે વેપારને સરળ બનાવે છે.

૫. જળમાર્ગમાં જહાજો વસાવવા રોકાણની જરૂરિયાત હોય છે.

પ.૧૮ હવાઈ માર્ગ

હવાઈ માર્ગ એ વાહન વ्यવહારનો સૌથી ઝડપી માર્ગ છે. તે હવાઈ માર્ગ જુદા જુદા હવાઈ જહાજો જેવા કે એર કાફટ, કાગો એરકાફટ, વિમાન, ડેલિકોપ્ટર વગેરેનો ઉપયોગ કરીને માલ સામાન અને ઉતારુઓને લઈ જાય છે. ઉતારુઓ ઉપરાંત સામાન્ય રીતે તે એવો માલ સામાન લઈ જાય કે જેનું વજન ઓછું હોય. પરંતુ કિંમત હોય. દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં જગ્યાં અન્ય વાહન વ्यવહાર



હવાઈ માર્ગ

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



ન હોય ત્યાં હવાઈ વાહન વ્યવહાર અગત્યનો અને અનુકૂળ રહે છે. કુદરતી આપત્તિઓ જેવી કે ધરતીકંપ અને પૂર વગેરે સમયે માલ અને લોકોને બચાવવા ખૂબ ઉપયોગી બને છે. યુદ્ધ દરમિયાન હવાઈ માર્ગ સૌનિકોને તેમજ જરૂરી પૂરવઠાને પહોંચાડવા અગત્યની ભૂમિકા બજાવે છે.

હવાઈ માર્ગને આંતરિક હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ એમ વર્ગીકૃત કરી શકાય છે. આંતરીક હવાઈ માર્ગ મુખ્યત્વે દેશની અંદર અવર જવરને સરળ બનાવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે માલ સામાન અને મુસાફરોનું વહન કરવા ઉપયોગી છે. હવાઈ માર્ગ ચોક્કસ માર્ગ પર ચાલે છે, જે લગભગ તમામ દેશોને સંકળે છે.

૫.૧૯ હવાઈ માર્ગના લાભ

હવાઈ માર્ગના લાભો નીચે મુજબ છે.

૧. હવાઈ માર્ગ સૌથી ઝડપી માર્ગ છે.
૨. દુર્ગમ વિસ્તારોમાં માલ સામાન અને મુસાફરોને લાવવા લઈ જવા અત્યંત ઉપયોગી છે કે જ્યાં કોઈ માર્ગ દ્વારા પહોંચી ન શકાય.
૩. કુદરતી આપત્તિઓ દરમિયાન તે સૌથી વધુ ઉપયોગી માધ્યમ છે.
૪. તે રાષ્ટ્રીય સલામતી અને સંરક્ષણ માટે અત્યંત મહત્વનું પીઠબળ છે.

૫.૨૦ હવાઈ માર્ગની મર્યાદાઓ

હવાઈ માર્ગની મર્યાદાઓ નીચે મુજબ છે.

૧. બધા માર્ગો કરતા તે વધુ ખર્ચણ માર્ગ છે.
૨. વજનમાં ભારે અને મોટા કદના માલ સામાન વહન કરવા અનુકૂળ નથી.
૩. પ્રતિકૂળ હવામાનની તેની પર ભારે અસર પડે છે.
૪. ટૂંકા અંતરની મુસાફરી માટે યોગ્ય નથી.
૫. અક્સમાતના કિસ્સાઓમાં માલ – મિલકત અને જીદગીને ભારે નુકશાન થાય છે.



૫.૪ પાઠગત પ્રશ્નો

૧. નીચેના પૈકી કયા વિધાનો સાચા કે ખોટા છે તે જણાવો.
૨. હવાઈ માર્ગ એ સૌથી ઝડપી માર્ગ છે.

વાહન વ્યવહારની સેવા

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૨. હવાઈ માર્ગ પર પ્રતિકૂળ હવામાન સ્થિતિની કોઈ અસર થતી નથી.
 ૩. હવાઈ માર્ગ ટૂંકા અંતર માટે યોગ્ય નથી.
 ૪. હેલિકોપ્ટર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ઉડાણ માટે વપરાય છે.
 ૫. હવાઈ માર્ગ રાષ્ટ્રીય સાલમતી માટે મદદરૂપ નથી.
૨. બહુવિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
૧. પર્વતીય અને ઊંચા સ્થળોએ આ માર્ગ સૌથી વધુ ઉપયોગી છે.


અ. રેલ્વે માર્ગ	બ. રસ્તા માર્ગ
ક. હવાઈ માર્ગ	ડ. જળ માર્ગ
 ૨. વાહન વ્યવહારની સેવા પૂરી પાડતી કંપનીને

અ. ઉદ્યોગ	બ. વેપાર
ક. અનુષ્ઠાનિક સેવા	ડ. આમાંથી એક પણ નથી.
 ૩. દેશમાં જ ભારે વજનવાળી અને મોટા જથ્થામાં દૂરના સ્થળોથી વસ્તુની હેરફર કરવા ઉપયોગી છે.

અ. રેલ્વે માર્ગ	બ. રસ્તા માર્ગ
ક. હવાઈ માર્ગ	ડ. જળ માર્ગ
 ૪. જે જહાજ ચોક્કસ સમયે અને ચોક્કસ માર્ગ પરિવહન કરે છે તેને

અ. કાર્ગો જહાજ	બ. ચાર્ટડ પાર્ટી જહાજ
ક. લાઈનસ	ડ. ગૃહવપરાશી જહાજ
 ૫. નીચેનામાંથી ક્યો લાભ જળ માર્ગને મળતો નથી.

અ. કરકસરયુક્ત મોટા જથ્થામાં અને ભારે માલ વહન કરવાનો.
બ. પ્રતિકૂળ હવામાનની અસર થતી નથી.
ક. આંતરરાષ્ટ્રીય વેપારની વૃद્ધિ કરે છે.
ડ. અક્સમાત સમયે સલામતી માર્ગ ગણાય છે.



તમે શું શીખ્યા?

- વાહન વ્યવહાર એટલે એવી પ્રકૃતિ જે માલ સામાન તેમજ વ્યક્તિઓને એક સ્થળોથી બીજે સ્થળે વિવિધ સાધનો દ્વારા ભૌતિક અવર-જવર (સ્થળાંતર)ને શક્ય બનાવે છે.
- વાહન વ્યવહારનું મહત્વ નીચે પ્રમાણે છે.
 1. કાચા માલને નિર્માતા કે ઉત્પાદકોને પૂરો પાડે છે.
 2. ગ્રાહકોને તૈયાર માલ પૂરો પાડે છે.
 3. જીવન ધોરણ ઉન્ત બનાવે છે.
 4. નીચી પડતરે મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે.
 5. કુદરતી આપત્તિ અને કટોકટી સમયે બચાવ કામગીરીમાં મદદ કરે છે.
 6. રોજગારી સર્જન કરે છે.
 7. શ્રમની ગતિશીલતામાં વધારો કરે છે.
 8. રાષ્ટ્રોને જોડવાનો પ્રયત્ન કરે છે.
- વાહન વ્યવહારના પ્રકારો નીચે મુજબ છે.

પદ્ધતિઓ	જમીન માર્ગ	જળ માર્ગ	હવાઈ માર્ગ
પ્રકાર	રોડ વાહન વ્યવહાર રેલ્વે વાહન વ્યવહાર પાઈપ લાઈન વાહન વ્યવહાર રોપ – વે માર્ગ	આંતરિક જળ માર્ગ દરિયાઈ માર્ગ	ડોમેસ્ટિક હવાઈ માર્ગ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ

- માલ અને મુસાફરોને લાવવા – લઈ જવા જળમાગ ના વિવિધ સાધનો આ પ્રમાણે છે.

માદ્યમ	આંતરિક જળમાર્ગ	દરિયાઈ જળ માર્ગ
પ્રકાર	બોટસ, સ્ટીમર્સ, બાર્ગિસ, લોંચીસ	જહાજ, ટેન્કસ, સબમરીન

વाहन व्यवहारनी सेवा

➤ માલ અને મુસાફરોને લાવવા – લઈ જવા જમી માગ ના વિવિધ સાધનો અને માધ્યમો આ પ્રમાણે છે.

રસ્તા (રોડ) માર્ગ			રેલ્વે માર્ગ	પાઈપ લાઈન	રોપ – વે
મનુષ્ય દ્વારા ચાલતા	પ્રાણીઓ દ્વારા ચાલતા	મોટર દ્વારા ચાલતા			
મનુષ્યનું માથું કે પીઠ	પ્રાણીઓ દ્વારા ખેંચાતા ગાડાં	સ્કૂટર અને મોટર સાયકલ	ઉત્તાર ટ્રેન	પાઈપ	દોરડા
મનુષ્ય દ્વારા ખેંચાતી હાથલારી	સ્લેજ (બરફ ચાલતી ગાડી)	ઓટો રિક્ષા	ગુડજ ટ્રેન (માલ ગાડી)		ટ્રોલી
કેલાણ ગાડી	પ્રાણી	કાર			
સાઇકલ		વાન			
રિક્ષા		બસ			

➤ માલ અને મુસાફરોને લાવવા – લઈ જવા હવાઈ માર્ગના વિવિધ માધ્યમો આ પ્રમાણે છે.

માધ્યમ	ડોમેસ્ટિક હવાઈ માર્ગ	આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ
પ્રકાર	એરોપ્લેન, હેલિકોપ્ટર	એરોપ્લેન

મોડ્યુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



સત્રાંત સ્વાધ્યાય

1. વાહન વ्यવહાર એટલે શું? વંધામાં વાહન વ्यવહારનું મહત્વ વર્ણવો.
2. વાહન વ्यવહારના પ્રકારો એટલે શું? વાહન વ्यવહારનાં પ્રકારો વર્ણનો.
3. જમીન માર્ગની વિવિધ રીતોનું વર્ણન કરો.
4. રેલ્વે માર્ગના લાભ–લાભ જણાવો.
5. રોડ માર્ગના વિવિધ પ્રકાર જણાવો.
6. રોડ માર્ગના લાભ–લાભ જણાવો.
7. જળ માર્ગના વિવિધ પ્રકારોનું વર્ગીકરણ કરો.
8. જળ માર્ગના ફાયદા અને ગોરક્ષાયદા જણાવો.

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

વાહન વ્યવહારની સેવા

૬. આંતરિક જળમાર્ગ અને બાહ્ય – દરિયાઈ જળમાર્ગનો તફાવત સ્પષ્ટ કરો.
૧૦. લાઈનર્સ એન્ટ ટ્રેમ્સનો તફાવત જણાવો.
૧૧. હવાઈ માર્ગના ફાયદા અને ગેરફાયદા વર્ણવો.
૧૨. યોગ્ય વાહન વ્યવહારનો માર્ગ પસંદ કરવા તમે ક્યા ક્યા પરિબળો ધ્યાનમાં લેશો? તે જણાવો.
૧૩. પાઈપ લાઈન દ્વારા ક્યા પ્રકારની પેદાશોનું વહન કરવું સરળ છે? અને શા માટે?



પા�્યત સ્વાધ્યાયની ચાવી

૫.૧

૧. સાચું,
૨. ખોટું,
૩. સાચું,
૪. ખોટું,
૫. સાચું

૫.૨

૧.

૧. ખોટું,
૨. સાચું,
૩. ખોટું,
૪. ખોટું,
૫. સાચું

૨.

- ૧ – ઈ,
- ૨ – એ,
- ૩ – કુ,
- ૪ – બુ,
- ૫ – ક

૫.૩

૧.

૧. ખોટું,
૨. સાચું,
૩. ખોટું,
૪. ખોટું,
૫. સાચું

૨.

- | | | | |
|------------|--------------------|----------|-----------|
| ૧. ટ્રેમ્પ | ૨. હોમ – ડોમેસ્ટિક | ૩. લાઈનસ | ૪. વિદેશી |
| ૫. ભારે | | | |

૫.૪

૧.

૧. સાચું,
૨. ખોટું,
૩. સાચું,
૪. ખોટું,
૫. ખોટું

વાહન વ્યવહારની સેવા


૨.

૧ – બ, ૨ – ક, ૩ – અ, ૪ – ક, ૫ – બ

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



તમારા માટે પ્રવૃત્તિઓ

- તમારા રહેઠાણ નજીક વાહન વ્યવહારની વિવિધ રીતોનું વર્ણન કરો અને તેમના લાભ અને ગેરલાભ લખો.
- તમારા નજીકના વિસ્તારના બજારની મુલાકાત લો અને વેપારીને પૂછો કે તેઓ ક્યા પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે અને શા માટે?
- તમારા કુટુંબમાં વિવિધ પ્રસંગોએ વાહન વ્યવહારની કઈ કઈ રીતોનો ઉપયોગ થાય છે? તેની યાદી બનાવો.



વખારની સેવા

આપણો આપણા રોજબરોજના જીવનમાં વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આપણામાંના કેટલાંક ચોખા લે, જ્યારે અન્ય ચપાટી કે રોટી મુખ્ય ખોરાક તરીકે લે, પરંતુ તમે કદ્દી વિચાર્યુ છે કે અનાજ કે ઘઉ જેમાંથી આ ખોરાકની વાનગીઓ તૈયાર થાય છે તે ક્યાંથી આવે છે. આપણો જાણીએ છીએ કે આ અનાજ બારેમાસ ઉત્પન્ન થતું નથી. પરંતુ આપણો તો તે દરરોજ ખાવા જોઈએ. તેથી ખેડુતો એ અનાજ આપણાને સતત કરી રીતે પૂરું પાડે છે? તમે વિચારતાં હથો કે તેઓ યોગ્ય સ્થળો અનાજનો સંગ્રહ કરી સતત પૂરવઠો પૂરો પાડતા હશે. હા, બરાબર (તમે સાચા છો) ઉત્પાદન અમુક જીતું દરમિયાન અને વિશિષ્ટ વિસ્તારોમાં થતું હોઈ, આ અનાજ પદ્ધતિસર સંગ્રહ કરવાની આવશ્યકતા રહે છે. આપણા ઘરમાં પણ વપરાશ માટે મયા દિન જથ્થો રાખીએ છીએ. પરંતુ એવાં અમુક સ્થળો કે સ્ટોર છે. જ્યાં આ વસ્તુઓનો વિશાળ જથ્થામાં યોગ્ય અને પદ્ધતિસર રીતે સંગ્રહ કરવામાં આવે છે. આ પાઠમાં આપણો આ ભંડારો / વખારો વિશે વિસ્તારથી શીખીએ.



હેતુઓ:-

આ પાઠ શીખ્યા પછી તમે જાણી શકશો.

- 'વખાર' નો અર્થ સમજાવી શકશો.
- વખારની (માલ ભરવાની) આવશ્યકતા જાણી શકશો.
- જુદા જુદા પ્રકારના ભંડારો ઓળખી શકશો.
- આદર્શ (ભંડારો) વખારનાં લક્ષણો સમજાવી શકશો.
- વખારનાં કાર્યો અને
- વખારોના લાભની યાદી કરી શકશો.

૫.૧ 'વખાર'નો અર્થ

આપણાને આપણા રોજબરોજના જીવનમાં વિવિધ પ્રકારની વસ્તુઓની જરૂર પડે છે. આપણો તેમાંની કેટલીક વસ્તુઓ મોટા જથ્થામાં ખરીદી આપણા ઘરમાં સંગ્રહ કરીએ છીએ. તે જ રીતે વ્યવસાયી વ્યક્તિઓને પણ વિવિધ વસ્તુઓ ઉપયોગ માટે જરૂર પડે છે. તેમાંથી કેટલીક દરેક વખતે ઉપલબ્ધ ન પણ બને, પરંતુ તેઓને વર્ષ દરમિયાન કોઈ જાતની અધ્યત વગર તે વસ્તુઓની જરૂર હોય છે. શેરડીના કારખાનાનું ઉદાહરણ લઈએ તે

વખારની સેવા

માટે ખાંડના ઉત્પાદન માટે શેરડીનો કાચો માલ જોઈએ. તમે જાણો છો શેરડી વર્ષના અમુક સમયગાળામાં પાકે છે. ખાંડનું ઉત્પાદન વર્ષભર થતું હોય છે. તેથી શેરડી સતત રીતે પૂરી પાડવાની જરૂરત હોય છે. પરંતુ તે કઈ રીતે શક્ય બને? અહીં પૂરતા જથ્થામાં શેરડીનો સંગ્રહ જરૂરી બની રહે છે. વળી ખાંડના ઉત્પાદન પછી પણ તેના વેચાણ કે



વખારની અંદર સામાન

વહેંચણી માટે કેટલોક સમય લાગે. આમ કાચા માલ તેમજ તેથાર માલ માટે સંગ્રહની જરૂરિયાત ઉલ્લી રહે છે. “સંગ્રહ એટલે ચીજવસ્તુઓને સાચવવા માટે યોગ્ય વ્યવસ્થા.” તેમના ઉત્પાદન કે ખરીદી સમયથી તે ખરેખર ઉપયોગ સુધી જ્યારે આ સંગ્રહ મોટા પાયા પર કરવામાં આવે અને તે પણ વિશિષ્ટ રીતે, ત્યારે તેને ‘વખાર’ કહે છે. “જે સ્થળે માલ રખાય તેને વખાર કહે છે.” વખારના કાર્યભાર સંભાળતા વ્યક્તિને સ્ટોર ક્રીપર કહે છે.

વખારની સેવા એટલે એવી પ્રવૃત્તિઓ, કે જેમાં મોટા પાયા પર પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે માલસામાનનો સંગ્રહ અને તેમને અનુકૂળ રીતે જરૂર પડયે ઉપલબ્ધ બનાવવાનો સમાવેશ થતો હોય.

બીજા શબ્દોમાં કહીએ તો, વખાર અને તે પણ માલની ખરીદી કે ઉત્પાદનથી તેના ખરેખર ઉપયોગ કે વેચાણ સુધી.

વખાર એ વેપારને એક મુખ્ય સહાયક છે. તેનાં સમય ઉપયોગિતા ઉલ્લી થાય છે. કારણ કે ઉત્પાદન અને વસ્તુઓના વપરાશ વચ્ચેના સમય માટે તે એક સેતુનું કાર્ય કરે છે.

૬.૨ વખારની જરૂરિયાતો

‘વખાર’ એ નીચેના કારણોને લીધે જરૂરી હોય છે.

૧. મોસમી ઉત્પાદન:- તમે જાણો છો કે કૃષિ વિષયક ઉત્પાદન નો પાક અમુક અતું દરમિયાન લેવામાં આવે છે. પરંતુ તેમનો વપરાશ અને ઉપયોગ આખા વર્ષ દરમિયાન થતો હોય છે. તેથી આ ઉત્પાદન માટે યોગ્ય સંગ્રહ કે ભંડારની જરૂર હોય છે. જેથી તે જ્યારે આવશ્યક હોય ત્યારે પૂરાં પાડી શકાય.
૨. મોસમી માંગ:- કેટલીક ચીજો એવી હોય છે, જેની માંગ મોસમ પ્રમાણે હોય છે. જેમ કે શિયાળામાં ગરમ કપડાં કે ચોમાસામાં છિન્નીઓ. આ વસ્તુઓનું ઉત્પાદન મોસમી માંગને પહોંચી વળવા માટે વર્ષ દરમિયાન થતું રહે છે. તેથી આ ચીજોને વખારમાં સંગ્રહ કરવાનું જરૂરી હોય છે. જેથી જરૂર વખતે તે ઉપલબ્ધ બની રહે.
૩. મોટા પાયા પર ઉત્પાદન:- નિર્ભિત વસ્તુઓના કિસ્સામાં આજકાલ ઉત્પાદિત માલની પ્રવર્તમાન માગ તેમજ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રે



નોંધ

મોડયુલ – ૩

સેવાના શૈક્ષણિક પત્ર



નોંધ

વખારની સેવા

- ઉત્પાદન થાય છે. નિર્માતાઓ પણ ચીજવસ્તુઓ વિશ્વાળ જથ્થામાં ઉત્પાદિત કરે છે. જેથી મોટા પાયા પર ઉત્પાદનના લાભ લઈ શકાય, જે વધુ કરકુસરયુક્ત હોય છે. તેથી તૈયાર માલ જે મોટા પાયા પર ઉત્પાદિત થાય છે તે જ્યાં સુધી વેચાઈ ન જાય ત્યાં સુધી યોગ્ય રીતે સંગ્રહ જરૂરી હોય છે.
૪. ઝડપી પૂરવઠો:- ઔદ્યોગિક તેમજ કુષિ ચીજવસ્તુઓ કોઈ વિશિષ્ટ સ્થળોએ ઉત્પાદિત થાય છે. પરંતુ દેશભરમાં તે વપરાય છે. તેથી વપરાશ ને સ્થળે આ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. જેથી વિલંબ વગર આ ચીજવસ્તુઓ ઉપલબોક્તાઓને તેમની જરૂર હોય ત્યારે ઉપલબ્ધ હોય છે.
 ૫. સતત ઉત્પાદન:- કારખાનાંઓમાં ચીજવસ્તુઓના સતત ઉત્પાદન માટે કાચા માલનો પૂરતો પૂરવઠો આવશ્યક હોય છે. તેથી ભંડારમાં કાચા માલનો પૂરવઠાનો પૂરતો જથ્થો જાળવવો જરૂરી હોય છે, જેથી સતત ઉત્પાદનની ખાતરી મળે.
 ૬. કિંમતની સ્થિરતા:- બજારમાં ચીજવસ્તુઓની કિંમતની વાજબી કષ્ટા જાળવી રાખવા માટે ભંડારમાં પૂરતો જથ્થો (સ્ટોક) રાખવો જરૂરી હોય છે. ચીજવસ્તુઓના પૂરવઠાની અધ્યત દ્વારા બજારમાં તેમની કિંમત વધે પણ ખરી. કિંમતમાં ઘટાડો પણ થાય. ચીજવસ્તુઓના પૂરવઠાની સમતુલા જાળવવાથી ભંડાર દ્વારા કિંમતની સ્થિરતા જાળવી શકાય છે.



૬.૧ પાઠગત પ્રશ્નો

નીચેનામાંથી ક્યા વિધાનો સાચા અને ક્યાં ખોટા છે તે જણાવો

૧. વખારની પ્રવૃત્તિ દ્વારા સમયનો અવરોધ દુર થાય છે.
૨. 'વખાર' એ વેપાર ને અગત્યનો સહાયક નથી.
૩. વખારનો હેતુ એ છે કે અધ્યતના સમયે ભવિષ્યના વપરાશ માટે વધારાની ચીજવસ્તુઓની આપૃત્તિ કરવી.
૪. મોસમી પ્રકારની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા ભંડાર પ્રવૃત્તિનો ઉપયોગ થતો નથી.
૫. મોટા પાયા પર વેપાર માટે ભંડાર પ્રવૃત્તિ ઉપયોગી નથી.
૬. 'વખાર' તે કારખાનાઓમાં ચીજવસ્તુઓના સતત ઉત્પાદનમાં સહાય કરે છે.

૬.૩ વખારના પ્રકાર

ભંડારની આવશ્યકતા વિશેતો ખ્યાલ મેળવ્યા પછી ચાલો આપણે વિવિધ પ્રકારના ભંડારો ઓળખીએ.

તમે શીખી ગયા કે વખાર પ્રવૃત્તિ વિવિધ પ્રકારના ચીજવસ્તુઓના સંગ્રહની આવશ્યકતા પૂરી પાડે છે. આવશ્યકતાઓને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના વખારો અસ્તિત્વમાં આવ્યા, જે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય.

૧. ખાનગી (ભંડારો) વખાર

વખારની સેવા

૨. જાહેર સાર્વજનિક (ભંડારો) વખાર
૩. સરકારી (ભંડાર) વખાર
૪. બોન્ડેડ ગોદામ
૫. સહકારી વખાર (ભંડાર)

હવે આપણે આ દરેકની ચર્ચા કરીશું

૧. ખાનગી વખારો:- ભંડારો કે જે નિર્માતાઓ કે વેપારીઓ દ્વારા માલિકી ધરાવતા હોય અને વહીવટ થતો હોય અને તે પણ તેમના પોતાના ચીજવસ્તુઓના સ્ટોક માટે તો તેમને ખાનગી ભંડારો કહે છે. સામાન્ય રીતે આ વખારો બેડુતો તેમના ખેતર પાસે બનાવે છે. જથ્થાબંધ વેપારીઓ તેમજ છૂટક વેપારીઓ તેમના વ્યવસાય કેન્દ્રો પાસે અને નિર્માતાઓ તેમનાં કારખાનાં પાસે તૈયાર કરે છે. તેમની ડિગ્રીન તેમજ સુવિધાઓ સંગ્રહ કરવાની ચીજવસ્તુઓના સ્વરૂપ / પ્રકાર પર રહે છે.
૨. જાહેર સાર્વજનિક વખારો:- વખારો કે જે આમ જનતાનો માલસામાનનો સંગ્રહ કરવા ચાલે છે, તે સાર્વજનિક વખાર તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો માલસામાન ભાડું ચુકવીને આ વખારોમાં સંઘરી શકે. કોઈ વ્યક્તિ, ભાગીદારી ફર્મ કે કોઈ કંપની આ વખારોની માલિકી ધરાવી શકે. આવી વખાર શરૂ કરવા સરકારની પરવાનગી લાયસન્સ જરૂરી હોય છે. સરકાર પણ આ વખારોનાં કાર્યક્ષેત્ર અને કામગીરીને નિયમન કરી શકે. મોટે ભાગે આ વખારોનો ઉપયોગ ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, નિકાસકારો, આયાતકારો, સરકારી એજન્સી વગેરે દ્વારા થતો હોય છે.
૩. સરકારી વખારો:- આ વખારોની માલિકી, વહીવટ અને નિયંત્રણ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કે પબ્લિક કોર્પોરેશન કે સ્થાનિક ઓથોરિટી ધરાવે છે. સરકારી તેમજ ખાનગી સાહસો બન્ને આ વખારોને ચીજવસ્તુના સંગ્રહ માટે ઉપયોગ કરી શકે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન અને કૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી વખારોની જાળવણી કરતી એજન્સીઓના ઉદાહરણો છે.
૪. બોન્ડેડ વખારો:- આ વખારોની માલિકી, વહીવટ અને નિયંત્રણ સરકાર તેમજ ખાનગી એજન્સીઓ ધરાવે છે. ખાનગી બોન્ડેડ વખારો એ સરકારમાંથી લાયન્સ મેળવવું પડે છે. બંધક વખારો આયાત કરેલ માલના કિસ્સામાં આયાત કર્તાઓને ડયુટી ન ભરે ત્યાં સુધી માલ લઈ જવાની છૂટ આપતી નથી. આ વખારો સામાન્ય રીતે ડોક ઓથોરિટીના માલિકીપણ હેઠળ હોય છે. અને તે બંદરોની નજીક જોવા મળે છે.
૫. સહકારી વખારો:- સહકારી મંડળીઓ આ વખારોની માલિકી, વહીવટ અને નિયંત્રણ ધરાવે છે. તે તેમની મંડળીના સભ્યોને વખાર સુવિધા અત્યંત કરકસરભર્યા દરે પૂરી પાડવામાં આવે છે.

મોડયુલ - ૩
સેવાના કોન્ટ્રે



નોંધ



૬.૪ આદર્શ વખારનાં લક્ષણો

ઉપરના વિભાગમાં તમે વખારોના જુદા જુદા પ્રકારો વિશે શીખી ગયા. દરેક વખારમાં માલ સામાન એ યોગ્ય સ્થિતિમાં રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે. પરંતુ એક આદર્શ વખારમાં નીચે પ્રમાણેના લક્ષણો હોય છે.

૧. વખાર અનુકૂળ સ્થળે હોવી જોઈએ. જેમ કે હાઈવે, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને દરિયાઈ બંદરોની પાસે જ્યાં માલ સહેલાઈથી ભરી શકાય અને ખાલી પણ કરી શકાય.
૨. માલસામાન ભરવા અને ખાલી કરવા યાંત્રિક ઉપકરણો હોવા જોઈએ. આનાથી કારભાર કરવામાં વ્યય ઓછો થાય અને તે અંગેનું ખચ ઓછું થાય.
૩. વખારમાં માલ યોગ્ય રીતે રાખવામાં પૂરતી જગ્ગા હોવી જોઈએ.
૪. બગડી જાય તેવી ખાદ્ય ચીજો જેમ કે ફળ, શાકભાજી, ઈડા અને માખણ વગેરેની જાળવણી માટેના વખારોમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવી જોઈએ.



વખાર

૫. સૂર્ય પ્રકાશ, વરસાદ, પવન, ધૂળ, ભેજ અને ઉપદવીઓથી રક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
૬. વખારની અંદર પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવી જોઈએ. જેથી સામાન ભરવા અને ખાલી કરવાની કામગીરી સરળ અને જરૂરી બને.
૭. ચોરી ન થાય તે માટે રાત દિવસ સુરક્ષા કર્મચારી પોતાની ફરજ બજાવે.
૮. આગથી નુકશાન ન થાય તે માટે આધુનિક અભિનશામક વ્યવસ્થા હોવી જોઈએ.



૬.૨ પાઠગત પ્રશ્નો

વખારની સેવા

કોંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો

- કૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વખારોની જાળવણી કરે છે.
(સરકારી, ખાનગી, બોન્ડેડ)
- વેપારીઓ વડે પોતાનો માલ સંગ્રહવા વપરાતા વખારો વખારો તરીકે ઓળખાય છે.
(બોન્ડેડ, સાર્વજનિક, ખાનગી)
- વખાર શરૂ કરવા માટે સરકારમાંથી લાયસન્સ જરૂરી નથી.
(બોન્ડેડ, ખાનગી, સાર્વજનિક)
- બોન્ડેડ વખારો સમમાન્ય રીતે નજીક જોવા મળે છે.
(ઔદ્યોગિક વિસ્તાર, બંદરો, વાણિજ્ય કેન્દ્રો)
- માલ કે જેને માટે આયાત ડયુટી ચૂકવવામાં આવી ન હોય તેને વખારમાં રાખવામાં આવે છે.
(ખાનગી, બોન્ડેડ, સાર્વજનિક)

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રો



નોંધ

૬.૫ વખારનાં કાર્યક્રોનો

તમે શીખી ગયા કે (ભંડારો) વખારો માલસામાન મોટા પાયા પર પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે જાળવે છે. તે માલને ગરમી, પવન, તોફાન-વાવાઝોડું, ભેજ વગેરે સામે રક્ષણ પૂરું પાડે છે અને બગાડ, અપવ્યય વગેરેને લીધે ખર્ચ પણ ઘટાડે છે. દરેક વખારનું આ પાયાનું કાર્ય છે. વધારામાં વખારો આજકાલ અન્ય વિવિધ કાર્યો પણ કરે છે. આ વિભાગમાં ચાલો, આપણે વખારોનાં વિવિધ કાર્યો વિશે શીખીએ.

વખારો નીચેના કાર્યો કરે છે.

- માલસામાનનો સંગ્રહ
- માલનું રક્ષણ
- જોખમ ઉઠાવવું
- નાણાકીય સુવિધાઓ
- પ્રક્રિયાકરણ
- ગ્રેડિંગ તથા બ્રાંડિંગ
- વાહનવ્યવહાર વ્યવસ્થ

હવે આપણે દરેક કાર્યની ચર્ચા કરીશું

- માલસામાનનો સંગ્રહ:- વખારનું મૂળભૂત કાર્ય ચીજવસ્તુઓનો મોટા જથ્થાનો સંગ્રહ કરવો તે છે. આ વસ્તુઓ તેમના ઉત્પાદન કે ખરીદીથી માંડીને તેમના ઉપભોગ (વપરાશ) કે ઉપયોગ થાય ત્યાં સુધી સંઘરવામાં આવે છે.
- માલનું સંરક્ષણ:- વખાર ચીજવસ્તુઓની ગરમી, ધૂળ, પવન અને ભેજ વગેરેથી થતા નુકસાન કે હાનિથી બચાવે છે. તે વિવિધ ઉત્પાદનના સ્વરૂપ પ્રમાણે વિશિષ્ટ વ્યવસ્થા કરે છે. તેનાથી માલના સંગ્રહ દરમિયાન થતા બગાડ અને અપવ્યયને લીધું થતું નુકસાન ઘટે છે.

મોડયુલ - ૩

સેવાના કોન્ટ્ર



નોંધ

વખારની સેવા

૩. જોખમ ઉઠાવવું:- વખારો વસ્તુઓના સંગ્રહને આનુષ્ઠાંગિક જોખમ ઉઠાવે છે. એક વાર ચીજવસ્તુઓ વખારના માલિકના હસ્તક સંગ્રહ માટે મુકાય એટલે આ ચીજવસ્તુઓની જવાબદારી વખાર સાચવનારની બને છે. આમ, સંગ્રહ દરમિયાન ચીજવસ્તુઓને થતા નુકસાન કે હાનિનું જોખમ વખાર સાચવનાર ભોગવે છે. ચીજવસ્તુઓ સારી સ્થિતિમાં પરત કરવાનું બંધન હોઈ વખાર કોઈ નુકસાન ચોરી કે હાનિ વગેરે માટે જવાબદાર ગણાય છે. આમ વખાર (વેર-હાઉસ) કોઈપણ દુર્ઘટનાને રોકવા તમામ સાવચેતીઓ બે છે.



વેર હાઉસ માં સામાન

૪. નાણાકીય સુવિધા:- જ્યારે ચીજવસ્તુઓ વખારમાં સંગ્રહ તરીકે મૂકવામાં આવે છે ત્યારે જમા કરનારે એક પહોંચ આપવામાં આવે છે. જે ચીજ વસ્તુઓ જમા કરાવવા માટેનો પુરાવો બની રહે છે. વળી, વખારો માલસામાનના માલિકની તરફેથામાં એક દસ્તાવેજ આપે છે, જેને વખાર ક્રીપર વોરંટ કહે છે. આ વોરંટ એ અધિકારપત્ર હોય છે. અને તે દસ્તાવેજોની પાછળ હસ્તાક્ષર કરી હસ્તાંતરિત કરી શકાય છે. તેથી વસ્તુઓ જ્યારે (ભંડાર) વખાર સાચવનારના કબજામાં હોય, ત્યારે વ્યવસાયી વ્યક્તિઓ તેના પર બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી તે વોરંટને ગીરવે મુક્કીને લોન મેળવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ભંડારો ડિપોલિટરને ટૂંકા સમયગાળા માટે ચીજવસ્તુઓને જામીનગીરી ગણીને નાશાં એડવાન્સ પણ આપી શકે.
૫. પ્રક્રિયાકરણ:- કેટલીક વસ્તુઓ જે સ્વરૂપમાં ઉત્પાદિત થાય તે જ સ્વરૂપમાં વપરાતી નથી. તેમને વપરાશ યોગ્ય બનાવવા માટે તેના પર પ્રક્રિયા જરૂરી છે. ઉદાહરણાર્થ અનાજને પોલિશ કરવામાં આવે છે. (ઈમારતી) લાકડાને પાકું કરવામાં આવે છે અને ફળોને પકવવામાં આવે છે. વગેરે કેટલીક વાર વખારો માલિકો વતી આ પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે.
૬. ગ્રેડિંગ અને બ્લાડિંગ:- વખારો વિનંતીથી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ કે આયાત કરનારાઓ વતી થી ચીજવસ્તુઓને ગ્રેડિંગ અને બ્લાડિંગના કાર્યો પણ હાથ ધરે છે. વળી તે ચીજવસ્તુઓ સાથે કામ પાડવાની અને વેચાણની અનુકૂળતા માટે મિશ્રણ, બ્લેડિંગ અને પેકેજિંગની સુવિધાઓ પણ પૂરી પાડે છે.
૭. વાહનવ્યવહાર વ્યવસ્થા:- કેટલાક કિસ્સાઓમાં વખારો જથ્થાબંધ વેપારીઓ માટે વાહનવ્યવહારની વ્યવસ્થાની જોગવાઈ કરે છે તે ઉત્પાદનના સ્થળેથી

વખારની સેવા

વસ્તુઓ એકત્ર કરે છે. વેપારીને વિનંતીથી તે તબદીલ (રવાના) કરવાના સ્થળે મોકલે પણ છે.

૬.૬ વખારના લાભ

વખાર વ્યવસાય સમાજને ઘણા લાભ આપે છે. પછી તે ઉધોગ હોય કે વેપાર. તે અનેક લાભ પૂરા પાડે છે, જેની યાદી નીચે મુજબ છે.

1. ચીજવસ્તુઓનું રક્ષણ અને જાળવણીઃ— વખાર વ્યવસાયી વ્યક્તિઓની તેમની વસ્તુઓના સંગ્રહ માટે જરૂરી સુવિધાઓ પુરી પાડે છે. એવે વખતે જ્યારે તે વેચાણ માટે જરૂરી ન હોય તે સ્ટોકને રક્ષણ પૂરું પાડે છે. તેમની સલામતીની ખાતરી આપે છે અને બગાડ અટકાવે છે. તે તૂટવા, ફૂટવાથી, ગુણવત્તામાં ઘટાડાથી બગાડ થવાથી વગેરેથી થતી હાનિ ઘટાડે છે. વખારો સામાન્ય રીતે અધતન ટેકનોલોજી અપનાવે છે, જેથી શક્ય હોય ત્યાં સુધી હાનિ રોકી શકાય.
2. વસ્તુઓનો નિયમિત પ્રવાહઃ— ઘણી ચીજો જેમ કે ચોખા, ઘઉ વગેરે અમુક ઝૂલુમાં ઉત્પાદિત થાય છે. પરંતુ તેમનો વપરાશ વર્ષભર થતો હોય છે. વખાર દ્વારા આવી મોસમી ચીજોનો વર્ષ દરમ્યાન નિયમિત પુરવઠો મળતો રહે છે.
3. ઉત્પાદનમાં સાતન્યઃ— વખાર નિર્માતાઓને ઉત્પાદન ચાલુ રાખવા માટે ને તે પણ કાચા માલનાં સંગ્રહ વિશે હેરાન (ચિંતિત) થયા વગર શક્ય બનાવે છે. તે મોસમી કાચો માલ કોઈ તૂટ વગર સતત પૂરો પાડવામાં સહાય કરે છે, જેથી તૈયાર ચીજો ઉત્પાદિત કરી શકાય.
4. અનુકૂળ સ્થાનઃ— વખારો સામાન્ય રીતે અનુકૂળ સ્થળોએ રોડ, રેલ કે જળમાર્ગ નજીક ચીજવસ્તુઓના હેરફરની સુવિધા માટે સ્થાપિત હોય છે. અનુકૂળ સ્થાન વાહનવહારોનો ખર્ચ ઘટાડે છે.
5. સરળતાથી કામ પાડવું:— આધુનિક વખારો સામાન્ય રીતે યાંત્રિક ઉપકરણો સાથે જોડાયેલ છે, જેથી ચીજોની સાથે કામ સરળતાથી પાડી શકાય. ભારે અને વિપુલ જથ્થામાં ચીજો આધુનિક યંત્રોનો ઉપયોગ કરી ભરી શકાય કે ખાલી કરી શકાય. જે આવી અને ચીજો સાથેના વ્યવહારમાં થતો ખર્ચ ઘટાડે છે. આવા યંત્રો માલ ભરવામાં અને ખાલી કરવામાં બગાડ ન્યુનતામ કરે છે.
6. નાના વ્યવસાયીઓ માટે ઉપયોગીઃ— પોતાના વખારની રચના કરવા માટે ભારે મૂડી રોકાણ જરૂરી હોય છે, જે નાના ધંધાથી ઓને પરવરી શકે નહિ. આ પરિસ્થિતિમાં ભાડા તરીકે નામની રકમ ચૂકવીને તેઓ તેમનો કાચો માલ તેમજ તૈયાર ઉત્પાદનો સાર્વજનિક વખારોમાં જાળવી શકે છે.
7. રોજગારી ઉલ્લી કરવી:— વખારો દેશના દરેક ભાગમાં કુશળ અને બિનકુશળ બનો પ્રકારના કામદારો માટે રોજગારીની તકો ઉલ્લી કરે છે. લોકો માટે તે આવકનો સ્ત્રોત બને છે, જે તેમનું જીવનધોરણ ઉન્નત બનાવે છે.
8. વસ્તુઓના વેચાણને સરળ બનાવે:— વસ્તુઓના વેચાણ માટે જરૂરી કેટલાંક સોપાનો જેમ કે ભાવિક ખરીદનારાઓ દ્વારા વસ્તુઓનું નિરીક્ષણ, ગ્રેડિંગ, બ્રાંડિંગ, પેકેજિંગ અને લેબલિંગ વખારો દ્વારા કરાવી શકાય. વસ્તુઓની માલિકી વખાર સાચવનારના વોરંટ સોપીને ખરીદનારને સહેલાઈથી હસ્તાંતરિત કરી શકાય.

મોડયુલ – ૩ સેવાના કોન્ટ્રેક્ટ



નોંધ



૮. નાણાંની ઉપલબ્ધતા:- વખાર સાચવનારના રત્નીદાની જામીનગીરી સામે બેક અને અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી લોન સહેલાઈથી લઈ શકાય. કેટલાક કિસ્સાઓમાં વખારો ચીજોને જામીનગીરી તરીકે રાખીને ડિપોઝિટરોને એડવાનસની જોગવાઈ પણ કરી શકે છે.
૧૦. નુકસાનનું જોખમ ઘટાડે:- વખારમાં માલ સારી રીતે રક્ષિત અને જાળવેલો હોય છે. વખારો ચોરી નિવારવા સલામતી સ્ટાફ ઓછા ખર્ચ રોકી શકે, જાળવણી માટે જંતુનાશકો દવાનો ઉપયોગય કરી શકે અને બગડી જાય તેવી વસ્તુઓ માટે કોંડ સ્ટોરેજની વ્યવસ્થા કરી શકે. તેઓ અનિશામક ઉપકરણ, આગને નિવારવા માટે સ્થાપિત કરી શકે છે. વળી સંગ્રહ કરી શકે. વળી સંગ્રહ કરેલ માલનો નુકસાનના કિસ્સામાં વણતર માટે વીમો ઉત્તરાવી શકે છે.



૬.૩ પા�ગત પ્રશ્નો

૧. નીચેનાં પેકી કયા વિધાનો સાચા છે અને કયા ખોટા છે તે જણાવો.
 ૧. વખારનું મૂળભૂત કાર્ય માલનો સંગ્રહ કરવો તે છે.
 ૨. વખારમાં થતું નુકસાન વખાર સાચવનારે ઉઠાવવાનું હોતું નથી.
 ૩. વખારના માલિકની રસિદ બેકમાંથી લોન માટે જામીનગીરી તરીકે કામ કરી શકે.
 ૪. વખારની સેવા સતત ઉત્પાદન અને નિયમિત પુરવધામાં મદદ કરે છે.
 ૫. વખારની સેવા કોઈ રોજગાર તકો ઉલ્લી કરતું નથી.
૨. બહુવિકલ્પનિય પ્રશ્નો
 ૧. નીચેનામાંથી કઈ બાબત વખારની સેવા માટે જરૂરી નથી.

અ. ઝડપી માલનો પૂરવઠો	બ. ગ્રસ્તુગત માલનું ઉત્પાદન
ક. મોટા પાયા પર ઉત્પાદન	ડ. નાના પાયા પર ઉત્પાદન
 ૨. નીચેની કઈ વખાર વિમાની મથકે અથવા દરિયાઈ બંદરે જોવા મળે છે.


અ. જાહેર વખાર	બ. સરકારી વખારો
ક. બોન્ડેડ ગોદામ	ડ. સહકારી વખારો
 ૩. જે વખારોની માલિકી અને સંચાલન ઉત્પાદકો કે વેપારીઓની હોય છે.

જેમનો મુખ્ય હેતુ માત્ર પોતાના જ માલનો સંગ્રહ કરવાનો હેતુ હોય છે.	
અ. સરકારી વખારો	બ. ખાનગી વખારો
ક. જાહેર વખારો	ડ. સહકારી વખારો
 ૪. નીચેનું કયું કાર્ય વખારની સેવાનું નથી?

અ. જોખમ ઉઠાવવું	બ. નાંણાકીય સવલત
ક. દરેક ગ્રાહકને વાહન વ્યવહારની સેવા	ડ. માલનું રક્ષણ
 ૫. નીચેનો કયો લાભ વખારની સેવાનો નથી.

વખારની સેવા

- અ. નાના ધેંધાથી ઓને ઉપયોગી
- બ. અનુકૂળ જગ્યાએ ઉપલબ્ધી
- ક. રોજગારી ન આપી શકે
- ડ. નાણાકીય સુવિધા સરળતાથી ઉપલબ્ધ



તમે શું શીખ્યા?

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રુ



નોંધ

- વખારની સેવા એટલે માલનો મોટા પાયા પર પદ્ધતિસર અને વ્યવસ્થિત સંગ્રહ ઉત્પાદનના સમયથી તે વપરાશના સમય સુધી તે સમયનો અવરોધ દૂર કરે છે. તે વેપાર માટે અગત્યની સેવા છે.
- વખારની જરૂરીયાત નીચે મુજજર છે.
 - ૧. ચીજવસ્તુઓનું મોસમી ઉત્પાદન
 - ૨. મોસમી માગ
 - ૩. મોટા પાયા પર ઉત્પાદન
 - ૪. ઝડપી પુરવઠો
 - ૫. સતત ઉત્પાદન
 - ૬. કિંમતનું સ્થિરતાકરણ
- વખારોના પ્રકાર
 - ૧. ખાનગી વખારો
 - ૨. સાર્વજનિક વખારો
 - ૩. સરકારી વખારો
 - ૪. બોન્ડેડ વખારો
 - ૫. સહકારી વખારો
- આદર્શ વખારનાં લક્ષણો
 - ૧. અનુકૂળ સ્થળ
 - ૨. માલ ચાથે કામ પાડવા યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ
 - ૩. માલના સંગ્રહ માટે પૂરતી જગ્યા
 - ૪. બગડી જાય તેવી (ખાદ્ય) ચીજો માટે કોલ સ્ટોરેજની સગવડ
 - ૫. સૂર્ય પ્રકાશ, વરસાદ, પવન, ધૂળ, ભેજ અને ઉપદ્રવીઓથી માલનું રક્ષણ
 - ૬. વાહનો માટે પૂરતી પાર્કિંગની જગ્યા
 - ૭. ચોવીસે કલાક સલામતીની વ્યવસ્થા
- વખારોના કાર્યો
 - ૧. માલનો સંગ્રહ
 - ૨. માલનું રક્ષણ
 - ૩. જોખમ ઉઠાવવું
 - ૪. નાણાકીય સુવિધા

મોડયુલ – ૩

સેવાના શોન્ટ



નોંધ

- વખાર પ્રવૃત્તિ (વેર-હાઉસિંગ) ના લાભ
૧. માલનું રક્ષણ અને તેની જાળવણી
 ૨. માલનો નિયમિત પ્રવાહ
 ૩. ઉત્પાદનમાં સાતત્ય
 ૪. અનુકૂળ સ્થળ
 ૫. સરળ કામ પાડવું
 ૬. નાના ધંધારીઓ માટે ઉપયોગી
 ૭. રોજગારી ઉભી કરવી.
 ૮. માલના વેચાણને સરળ બનાવે.
 ૯. નાણાંની ઉપલબ્ધતા
 ૧૦. નુકસાનનું જોખમ ઘટાડે



સત્રાંત સ્વાધ્યાય

૧. વખારની સેવા એટલે શું?
૨. વખારની જરૂરિયાત સમજાવો.
૩. આદર્શ વખારની છ લાક્ષણિકતાઓનું વર્ણન કરો.
૪. વખારોના વિવિધ પ્રકારોનું વર્ગીકરણ કરો તેમને ટૂંકમાં સમજાવો.
૫. સાર્વજનિક અને ખાનગી વખારો વચ્ચે તફાવત આપો.
૬. વખારના કાર્યો સમજાવો.
૭. સાર્વજનિક વખાર એટલે શું ? સાર્વજનિક વખારનાં કોઈ પણ ત્રણ કાર્યો જણાવો.
૮. ધંધારી ઓ લોકો માટે વખારના લાભ વર્ણવો.
૯. બોન્ડ વખાર આયાતકર્તાઓને કઈ રીતે ઉપયોગી હોય છે ?
૧૦. વખારની સેવા એ વેપારની એક અગત્યની સેવા છે. આ વિધાન લગભગ ૫૦ શબ્દોમાં સમજાવો.



પાઠગત પ્રશ્નોની ચાવી (જવાબ)

૬.૧

- | | | |
|-----------|-----------|-----------|
| (૧) સાચું | (૨) ખોટું | (૩) સાચું |
| (૪) ખોટું | (૫) ખોટું | (૬) સાચું |

વખારની સેવા

૬.૨

- | | | |
|------------|-------------|-----------|
| (૧) સરકારી | (૨) ખાનગી | (૩) ખાનગી |
| (૪) બંદરો | (૫) બોન્ડેડ | |

૬.૩

- | | | |
|-----------|-----------|-----------|
| (૧) સાચું | (૨) ખોટું | (૩) સાચું |
| (૪) સાચું | (૫) ખોટું | |

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રા



નોંધ



તમારા માટે પ્રવૃત્તિઓ

સ્ટોર અને વખારના કાર્યોનું તુલનાત્મક પત્રક બનાવો સ્ટોર વખારથી કઈ રીતે જુદો પડે છે?

(મુદ્દાઓ:- સંગ્રહ ક્ષમતા, સંગ્રહ સ્થિતિઓ, માલિકીપણું, ઉપલબ્ધ સુવિધાઓને આધારે સરખામણી કરો)



માહિતીસંચારની સેવા

આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકે નથી. સમાજના એક સભ્ય તરીકે તે અન્યો પર આધારિત છે. ઘણીખરી વસ્તુઓ માટે બીજાની મદદ લેવી પડે છે. પરંતુ પ્રશ્ન એ છે કે બીજાને શું જોઈએ તે કોઈ કેવી રીતે જાણી શકે? કોઈ વ્યક્તિનું એ તેની લાગણીઓ, વિચારો, ઘ્યાલો, આવશ્યકતાઓ, અનુભવો વગેરે બીજાને એવી રીતે મોકલવા જેથી તે તેને સાચી રીતે સમજી શકે. આ જ વસ્તુ વ્યવસાયમાં પણ બને છે. તે ગ્રાહકો, સરકાર, માલિકો, કર્મચારીઓ વગેરેને માહિતી આપે છે અને તે જ વખતે તેમની પાસેથી માહિતી મેળવે છે. આ પાછાં ચાલો આપણે જાણીએ કે લોકો તેમની લાગણીઓ, વિચારો, ઘ્યાલો, સંદેશાઓ વગેરે કઈ રીતે પહોંચાડે છે.



હેતુઓ:-

આ પાઠ શીખ્યા પછી તમે જાણી શકશો :

- માહિતી સંચારની વ્યાખ્યા આપી શકશો.
- માહિતી સંચાર પ્રક્રિયાનાં તત્ત્વો જણાવી શકશો.
- વ્યવસાયમાં માહિતી સંચારની અગત્ય સમજાવી શકશો.
- માહિતી સંચારના પ્રકારો ઓળખાવી શકશો.
- માહિતી સંચારનાં વિવિધ સાધનોનું વર્ણન કરી શકશો. અને
- માહિતી સંચારના અવરોધો સમજી શકશો.

૭.૧ માહિતી સંચારનો અર્થ

દરરોજ તમે તમારા કુટુંબના સભ્યો, ભિત્રો અને સંબંધીઓ સાથે વિવિધ બાબતો વિશે વાત કરો છો. તમે જુદા જુદા પ્રસંગોએ તમારા ભિત્રો અને સંબંધીઓ પાસેથી પત્રો મેળવો છો. તમે તે પત્રોના જવાબ પણ આપો છો. કેટલીકવાર તાકીદના સંદેશ મોકલવા તમે ટેલિગ્રામ (તાર) મોકલો છો કે ટેલિફોન કોલ કરો છો. આ પ્રક્રિયામાં તમે અન્યો સાતે માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો. તે જ રીતે તમ્યો



માહિતી સંચારની સેવા

પણ તમારી સાથે તેમના અનુભવો જણાવે છે. તમે એ જોયું હશે કે ઓફિસમાં ઓફિસર પટાવાળાને બોલાવવા બેલ (ઘંટડી) વગાડે છે. લોકો રોડ કોસિંગ આગળ ટ્રાફિક સિંગલની લાલ લાઈટ જોઈને તેઓના વાહન થંભાવે છે અને પછી લીલી લાઈટ જોતાં ચલાવવાનું શરૂ કરે છે. શાળામાં પણ વિદ્યાર્થીઓ શાળા દ્વારા ઘંટ સાંભળીને પ્રાર્થના માટે ભેગા થાય છે. આ સાધનો દ્વારા કોઈ સંદેશ મોકલાય છે અને સમજાય છે. અને તે પણ બોલ્યા કે લખ્યા વગર બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતી ખ્યાલો અને અનુભવોના વિનિમયની આ તમામ પ્રવૃત્તિઓ માહિતી સંચાર કરેવાય છે.

માહિતી સંચારની આ વ્યાખ્યા આ રીતે કરી શકાય : "બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વાણી, લેખન, હાવભાવ કે સંકેતો દ્વારા હકીકત, ખ્યાલો, અભિપ્રાય, વિચારો અને માહિતીનો વિનિમય (આદાન પ્રદાન)."

માહિતી સંચારની આ પ્રક્રિયા હંમેશા સંદેશા ધરાવે છે, જે પાર્ટી વચ્ચે મોકલવાના હોય છે. બે પાર્ટીઓ હોય છે. એક મોકલનાર, જે સંદેશો મોકલે છે અને બીજી મેળવનાર જે સંદેશો મેળવે છે. સામાન્ય રીતે માહિતી સંચારની પ્રક્રિયા ત્યારે પૂર્ણ થઈ કરેવાય, જ્યારે પ્રાપ્તકર્તા (મેળવનાર) સંદેશ સમજે અને તેનું પ્રતિપોષણ કે પ્રતિભાવ આપે. રોડ કોસિંગ આગળ લાલ લાઈટનું ટ્રાફિક સિંગલ વાહન થોભાવવાનો સંદેશો આપે છે. જ્યારે લોકો ટ્રાફિક સિંગલનો લાલ લાઈટ જોઈને પોતાના વાહન થોભાવે છે. ત્યારે તે પ્રતિપોષણ કે પ્રતિભાવ કરેવાય છે. આ પ્રતિપોષણ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. તમારા મિત્ર સાથે વાત કરતી વખતે પણ માથું હલાવવું પણ પ્રતિપોષણ તરીકે ગણાય છે. આમ સંદેશા પ્રેષક અને પ્રાપ્તકર્તાની સાથે સાથે પ્રતિપોષણ પણ માહિતી સંચાર પ્રક્રિયામાં એક આવશ્યક તત્ત્વ હોય છે.



માહિતી સંચારની પ્રક્રિયા

તેથી માહિતી સંચાર પ્રક્રિયામાં નીચેના તત્વોનો સમાવેશ થાય છે.

પ્રેષક:- (મોકલનાર) સંદેશો મોકલે, તે વ્યક્તિ, જેને સ્ત્રોત તરીકે પણ ઓળખાય.

પ્રાપ્તકર્તા:- (મેળવનાર) સંદેશો મેળવે તે વ્યક્તિ.

સંદેશો:- માહિતી સંચારનું વિષયવસ્તુ તેમાં હકીકતો, ખ્યાલો, લાગણીઓ કે વિચારોનો સમાવેશ થાય છે.

પ્રતિપોષણ:- સંદેશા અંગે પ્રાપ્તકર્તાનો પ્રતિભાવ, પ્રતિક્રિયા કે પ્રત્યુત્તર જે મોકલનાર તરફ અભિપ્રેત હોય છે.

મોડયુલ - ૩ સેવાના સૌન્દર્યો



નોંધ



પ્રાપ્તકર્તાને સંદેશો મોકલવા માટે કે પ્રાપ્તકર્તા પાસેથી પ્રતિપોષણ મેળવવા માટે આપણને માધ્યમ જરૂરી છે. જેને માહિતી સંચારનું માધ્યમ કે સાધન કહે છે. તે પ્રાપ્તકર્તાને સંદેશો લઈ જાય છે. અને પ્રાપ્તકર્તા પાસેથી પ્રતિપોષણ લાવે છે.



૭.૧ પા�ગત પ્રશ્નો

૧. સાચા વિધાન આગળ ‘T’ (સા) લખો અને ખોટા વિધાન આગળ ‘F’ (ખો) લખો.
 ૧. વ્યક્તિત્વો વચ્ચે માહિતી, ખ્યાલો અનુભવોનો વિનિમય એટલે માહિતી સંચાર.
 ૨. માહિતી સંચારની પ્રક્રિયામાં સંદેશ હંમેશા ન પણ હોય.
 ૩. પ્રતિપોષણ એ માહિતી સંચાર પ્રક્રિયાનું કોઈ ઓક તત્ત્વ હોય
 ૪. લોકોને થોભવાનો સંકેત દર્શાવતો ટ્રાફિક પોલીસ એ માહિતી સંચારની પ્રક્રિયા છે.
૨. યોગ્ય શબ્દો / પદો વડે ખાલી જગ્યા પૂરો
 ૧. સંદેશો મોકલે તે વ્યક્તિ કહેવાય.
 ૨. સંદેશાને પ્રાપ્તકર્તાનો પ્રતિભાવ એ કહેવાય.
 ૩. જે સંદેશ મેળવે તે વ્યક્તિ કહેવાય.
 ૪. માહિતી સંચારના વિષયવસ્તુમાં નો સમાવેશ થાય.
 ૫. કોઈપણ સંદેશાનું પ્રતિપોષણ તરફ હંમેશા નિર્દેશિત થાય.

૭.૨ માહિતી સંચારનું મહત્વ

૧. માહિતી સંચાર એ સત્ય-હકીકતો, આક તિઓ અને વિચારો રજૂ કરવા માટે અગત્યાનું છે.
૨. પેઢી માટે એક અંકૃતાનું સાધન છે. જેનાથી ધ્યાનિય એકમની પ્રક્રિયા, વચ્ચે સંકલન સાધી શકાય છે. તેમજ વિભાગો – કર્મચારીઓ અને વ્યક્તિગત દેખરેખ રાખી શકાય છે.
૩. માહિતી સંચાર ધ્યાનિ કાર્યક્ષમતા વધારે છે. તેમજ ધ્યાનિ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે.
૪. માહિતી સંચાર બાહ્ય પક્ષકારો જેવા કે માલનો પૂરવઠો પૂરો પાડતા અને ગ્રાહકો વગેરે સાથે પેઢીના સબંધો જાળવે છે.
૫. માહિતી સંચાર લોકોને શિક્ષિત બનાવે છે. તેમના શાનની સીમા પ્રસારે છે અને તેમની પ્રતિભાને ખીલવે છે.
૬. ભાગ્ય અને લોક સંપર્કમાં નડતા અવરોધો દૂર કરવાનો પ્રયત્ન કરે છે.
૭. તે લોકોને નવી શોધ ખોળ, નવી ટેકનોલોજી અને નવા ઉત્પાદનોનો માહિતી આપે છે.

માહિતી સંચારની સેવા

c. માહિતી સંચાર બીજાઓએ ઉપલબ્ધ કરેલ લક્ષ્યાંકો અને શોધ ખોળનો લાભ અન્યને આપે છે.


7.3 માહિતી સંચારના પ્રકારો

જ્યારે આપણે બીજાઓ સાથે વાતચીત કરીએ છીએ કે તેમને લખીએ છીએ ત્યારે આપણી વચ્ચે માહિતી સંચાર થાય છે. પરંતુ આવા માહિતી સંચાર માટે ભાષા આવશ્યક છે. શબ્દોની મદદથી થતું માહિતી સંચાર શાબ્દિક માહિતી સંચાર કહેવાય છે. તે જ પ્રમાણે જ્યારે આપણે આપણા મિત્રોને મળીએ ત્યારે આપણે તેમની સાથે હાથ મિલાવીએ છીએ તે પણ કોઈ અર્થ પહોંચાડે છે. આ અશાબ્દિક માહિતી સંચારનું ઉદાહરણ છે. કોઈ પણ શબ્દોના ઉપયોગ વગર થતું માહિતી સંચાર કહેવાય છે. ચાલો, આપણે આ બે (પ્રકારો) વિશે જાણીએ.

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રો



નોંધ



શાબ્દિક માહિતી સંચાર બોલેલા કે લખેલા શબ્દો દ્વારા થતું હોય છે. બોલેલા શબ્દો દ્વારા થતું માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર તરીકે ઓળખાય છે. જે પ્રવચન (વાતા લાપ) મિટિંગ, જૂથ ચર્ચા, પરિષદ, ટેલિફોન, વાતચીત, રેડિયો સંદેશ વગેરેસ્વરૂપમાં હોઈ શકે. લેખિત માહિતી સંચારમાં સંદેશો લેખિત શબ્દો દ્વારા પત્રો, મેમો, પરિપત્રો, નોટિસ, રીપોર્ટ, મેન્યુઅલ સામયિક, (મેગેજિન), હેન્ડબુક વગેરે સ્વરૂપે સંક્ષિપ્ત થાય છે.

અશાબ્દિક માહિતી સંચાર 'દ્રશ્ય', 'શ્રાવ્ય' કે હાવભાવ (સાંકેતિક) હોઈ શકે. કેટલીક વાર તમે કોઈ ચિત્ર, આવેખ, સંકેત, આકૃતિ વગેરે જુઓ છો અને કોઈ સંદેશ તમને પહોંચે છે. આ તમામ જુદાં જુદાં પ્રાણીઓનો ચાર્ટ દર્શાવતો શિક્ષક એ દ્રશ્ય માહિતી સંચાર છે. ઘંટ, સિસ્ટોરી, બજર, હોર્ન વગેરે પણ સાધનો છે જે દ્વારા આપણે સંદેશો મોકલી શકીએ. આ પ્રકારના દ્વારની સહાયથી થતું માહિતી સંચાર અને 'શ્રાવ્ય' માહિતી સંચાર છે. ઉદાહરણાર્થ શાળાઓ અને કોલેજોમાં પિરિયડના પ્રારંભ કે અંત વિશે જાણ કરવા માટે વાગતો ઘંટ, કામદારોની કાર્ય પાળીના ફેરફારની જાણ કરવા કારખાનામાં વપરાતી સાયરન એ શ્રાવ્ય માહિતી સંચારના ઉદાહરણો છે.



માનવશરીરના વિવિધ ભાગોના ઉપયોગ દ્વારા કે શારીરિક હાવભાવ (ભાષા) દ્વારા થતું માહિતી સંચાર હાવભાવ માહિતી સંચાર કહેવાય છે. આપણો રાષ્ટ્રધ્વજ ને સલામી, રાષ્ટ્રગીતના ગાન દરમિયાન હલનચલન વગરની સ્થિતિ, હાથ હલાવવા માથું હલાવવું, ચહેરા પર ગુસ્સાનો ભાવ દર્શાવવો વગેરે હાવભાવ (અંગચેષ્ટા) માહિતી સંચારના ઉદાહરણો છે.



૭.૨ પા�ગત પ્રશ્નો

- અ. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો
૧. શબ્દોની મદદથી થતો માહિતીસંચાર તરીકે ઓળખાય છે.
 ૨. બોલેલા શબ્દો દ્વારા થતું માહિતી સંચાર તરીકે જાણીતું છે.
 ૩. માનવશરીરના વિવિધ ભાગો દ્વારા થતું માહિતી સંચાર કહેવાય છે.
 ૪. ચિત્રો, સંકેત, આકૃતિઓ વગેરેની સહાયથી થતું માહિતી સંચાર તરીકે ઓળખાય છે.
- બ. શાબ્દિક માહિતી સંચાર દર્શાવતા વાક્યાંશ આગળ ‘V’ લખો અને અશાબ્દિક માહિતી સંચાર દર્શાવતા વાક્યાંશ આગળ ‘NV’ લખો.
૧. પત્ર વાંચતી વ્યક્તિ
 ૨. વિદ્યાર્થીને ગુસ્સા સાથે જોતો શિક્ષક.
 ૩. રાષ્ટ્રધ્વજને સલામી.
 ૪. દુકાનદાર સાથે વાતચીત.
 ૫. શાંતિથી મસ્તક હલાવવું.

૭.૪ માહિતી સંચારના સાધનો

આપણો વિવિધ રીતે એકબીજા સાથે માહિતી સંચાર કરીએ છીએ. આ બધા માહિતી સંચારના સાધનો કહેવાય છે. મુખો-મુખ સંપર્કમાં આપણે આપણા શરીરના જુદા જુદા ભાગોનો ઉપયોગ કરીએ છીએ અથવા આપણે એનાથી સંદેશ મોકલીએ છીએ. ઉદાહરણાર્થ, આપણે લેખિત સંદેશ મોકલવા પત્રોનો ઉપયોગ કરીએ છીએ. ટેલિફોન પર બીજાનો સાથે વાતચીત કરીએ છીએ. ટેલિગ્રામ મોકલીએ છીએ અને આપણા સંદેશ મોકલવા વિવિધ આધુનિક મશીનો જેમ કે કમ્પ્યુટર, ફેક્સ મશીન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આપણી માહિતી સંચાર પ્રક્રિયામાં વપરાતા સાધન માહિતી સંચારના હેતુ પર આધાર રાખે છે. ઉદાહરણાર્થ, તાત્કાલિક સંદેશો મોકલવા આપણે સામાન્ય રીતે ટેલિફોનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ મહત્વની બાબત જેને માટે લેખિત દસ્તાવેજ જરૂરી હોય, ત્યાં આપણે પત્ર, ટેલિગ્રામ ફેક્સ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આજકાલ, આધુનિક ટેકનોલોજી એ આપણા જરૂરિયત અને પસંદ પ્રમાણે સાધન પસંદ કરવા વિશ્વાળ વિકલ્પ આપેલ છે. ચાલો, આપણે પસંદ

માહિતી સંચારની સેવા

કરવા વિશાળ વિકલ્પ આપેલ છે. ચાલો, આપણે વ્યવસાયમાં સામાન્ય રીતે વપરાતા માહિતી સંચારના મહત્વના સાધનોની ચર્ચા કરીએ.

પત્રો:-

પત્રો એ માહિતી સંચારનું લેખિત સ્વરૂપ છે. બજિતઓ કે સંસ્થાઓ તે મોકલી શકે કે મેળવી શકે. પત્રોના સ્વરૂપમાં લેખિત સંદેશા પ્રાપ્તકર્તાઓને ખાસ સંદેશાવાહક, પોસ્ટઓફિસ, કે ખાનગી કુરિયર દ્વારા વિતરિત કરી શકાય. આ પદ્ધતિ ઘણું કરીને એવી જગ્યાએ વપરાય છે, જ્યાં મુખ્યમુખ માહિતી સંચાર મુશ્કેલ હોય અથવા અન્ય સાધનો સહેલાઈથી ઉપલબ્ધ ન હોય. તેનાથી માહિતી સંચારના રેકર્ડ રાખવામાં મદદ મળે છે. માહિતી સંચારના આ સાધનમાં ખર્ચ ઓછો આવે છે.



પત્ર લખવો


મોડયુલ - ૩ સેવાના ભેત્રો



નોંધ

ટેલિગ્રામ (તાર):-

તે પત્ર લેખિત માહિત સંચારનો પ્રકાર છે. જે દ્વારા સંદેશ દૂરનાં સ્થળોએ ઝડપથી મોકલાવી શકાય. સામાન્ય ટપાલ કરતાં અતિ ઝડપે સંદેશનું સંકષણ કરે છે. આ સુવિધા તમામ ટેલિગ્રાફ ઓફિસમાં ઉપલબ્ધ હોય છે, જ્યાં નિયત ફી ની ચુકવણી દ્વારા આપણો આપણો સંદેશ મોકલી શકીએ. સંદેશો લખવામાં વપરાતા શબ્દોની સંખ્યાને આધારે ચાર્જ ભરવાપાત્ર બને છે. જેમાં પ્રાપ્તકર્તાના સરનામાનો તેમજ પ્રેષકના નામનો પત્ર સમાવેશ થાય છે. તેથી તાર સંદેશાઓ ટૂંકમાં લખાય છે.



ટેલિગ્રામની આકૃતિ

તાર સામાન્ય કે એક્સપ્રેસ એ રીતે મોકલી શકાય. એક્સપ્રેસ ટેલિગ્રામ સામાન્ય ટેલિગ્રામ કરતાં ઝડપથી પહોંચે છે. તેને માટે વધારાનો ચાર્જ ભરવો પડે છે. વિદેશોમાં ટેલિગ્રામ મોકલવા કેબલગ્રામનો ઉપયોગ થાય છે. ટેલિગ્રામ ટેલિફોનનો ઉપયોગ કરીને પત્ર મોકલી શકાય છે, જેને ફોનોગ્રામ કહે છે. અહીં ટેલિગ્રાફ ઓફિસને રિંગ કરીને, ટેલિફોન દ્વારા સંદેશ નોંધાવી શકાય છે અને પછીથી ટેલિગ્રાફ ઓફિસ તે સંદેશો પ્રાપ્તકર્તાને સંકષિત કરે છે.

ફોન:-

ટેલિફોન એ મૌખિક માહિતી સંચારનું અતિ લોકપ્રિય સ્વરૂપ છે. તે આંતરિક અને બાહ્ય વ્યવસાય માહિતીસંચાર માટે વ્યાપક રીતે વપરાય



ટેલીફોન



છે. લાંબા અંતરે માહિતી સંચાર માટે STD (Subscriber Trunk Dialing) ની સુવિધા ઉપલબ્ધ હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર ISD (International Subscriber Dialing) સુવિધા દ્વારા થઈ શકે. સરકારી તેમજ ખાનગી એજન્સી બન્ને ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે. ટેલિફોન મોટે ભાગે પરસંદ કરવામાં આવે છે. કારણ કે તેનાથી તત્કાલ માહિતી સંચાર સ્થાપિત કરવામાં સહાય મળે છે.

વ્યવસાય ફર્મમાં તેમજ સરકારી અને ખાનગી ઓફિસોમાં ઓટોમેટિક, સિવચબોર્ડ જે પ્રાઇવેટ ઓટોમેટિક પ્રાંચ એક્સ્ચેન્જ (PABX) તરીકે ઓળખાય છે.

(TO CHECK SHOWN IN PAGE NO. 108 OF HARD COPY)

હસ્તલિખિત કે મુદ્રિત જેમ કે પત્રો, વિષયવસ્તુ, આલોખ સ્કેચ વગેરેનું તત્કાલિક સંક્મણ શક્ય બનાવે છે. ટેલિફોન લાઈનના ઉપયોગ દ્વારા આ મશીન દસ્તાવેજની આબુદૂબ નકલ સંદેશ પ્રાપ્તિને છેડે આવેલ બીજા ફેક્સ મશીન ને મોકલે છે. કોઈ પણ સંદેશ મોકલવા માટે દસ્તાવેજ કે જેની પર સંદેશ આકૃતિ કેચિત્ર ટાઈપ કરવામાં કે દોરવામાં આવેલ હોય તે ફેક્સ મશીનમાં મૂકવાનું હોય છે અને અન્ય પાટી નો ફેક્સ નંબર અર્થાત ટેલિફોન નંબ ડાયલ કરવાનો હોય છે. પછી સંદેશ પ્રાપ્તિનો છેડે આવેલ ફેક્સ મશીન તરત જ મેટરની આબુદૂબ નકલ કાઢે છે. વ્યવસાયમાં લેખિત સંદેશાવ્યવહાર માટે આ સૌથી વધુ પ્રચલિત સાધન છે. ફેક્સ પદ્ધતિના મુખ્ય લાભ આ પ્રમાણે છે.



ફેક્સ મશીન

સરળ કામગીરી, કોઈપણ અંતરે હસ્તલિખિત કે મુદ્રિત મેટરનું તત્કાલ સંક્મણ, કે વધુ પ્રાપ્તકર્તાઓને એક સાથે સંક્મણ વગેરે. મશીન માહિતી સંચારના દરેક વ્યવહારને પણ રેકર્ડ કરે છે. એક માત્ર મર્યાદા એ છે કે ફેક્સ મશીન અમુક પ્રમાણભૂત કદના દસ્તાવેજને સ્વીકારે છે. વળી, સામાન્ય વ્યવહાર પ્રમાણે, તે જ દસ્તાવેજની એક નકલ પ્રાપ્તકર્તાને તેમના રેકર્ડ માટે ટપાલ દ્વારા મોકલાય છે. બીજે છેડે પ્રાપ્તકર્તા પણ દસ્તાવેજની ફોટોકોપી ફેક્સ મશીન દ્વારા સંદેશો મળે એટલે તરત જ કરી લે છે. કારણ કે મશીન દ્વારા વપરાયેલ શાહી થોડા સમય પછી ઉડી જવાનું જોખમ રહે છે.

માહિતી સંચારની સેવા

ઈ-મેલ (E-Mail):-

ઈલેક્ટ્રોનિક મેલ જે ઈ-મેલ તરીકે વધુ પ્રચલિત છે. તે માહિતી સંચારનું આધુનિક સાધન છે. આ તંત્રમાં માહિતી સંચારનું આધુનિક સાધન છે. આ તંત્રમાં માહિતી સંક્રમણ કરવાની અને મેળવવાની ઈલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ કિસ્સામાં વ્યક્તિ ઈન્ટરનેટ દ્વારા કોઈ ISP (Internet Service Provider) મારફતે તેમના નામે ઈ-મેલ એકાઉન્ટ ખોલાવે છે. પછી

પત્રો, સંદેશાઓ, ચિત્રો કે ધ્વનિ તેમના કમ્પ્યુટર મારફતે અન્ય વ્યક્તિઓના ઈ-મેલ એકાઉન્ટને મોકલાવી શકાય છે. જ્યારે પણ અન્ય વ્યક્તિ પોતાનો ઈ-મેલ એકાઉન્ટ મેળવે ત્યારે તે સંદેશો મેળવે છે. આ માહિતી દ્રશ્ય-શ્રાવ્ય રીતે મોકલાય છે અને આ પ્રક્રિયા અંતિ ઝડપી હોય છે. ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગને લીધે ઉપયોગ કર્તાઓમાં આ પદ્ધતિ લોકપ્રિયતા મેળવી રહી છે.



વોઈસ મેલ પદ્ધતિ

વોઈસ મેલ:-

આ એક કમ્પ્યુટર આધ્યારિત તંત્ર છે, જે દ્વારા આવતા ટેલિફોન કોલ મેળવી શકાય અને તેનો પ્રત્યુત્તર વાળી શકાય. તે ટેલિફોન સંદેશ કમ્પ્યુટર મેમરી દ્વારા રેકર્ડ કરે છે અને સંગ્રહ કરે છે. કોલ કરનાર વોઈસ મેલ નંબર ડાયલ કરીને અને પછી કમ્પ્યુટરની સૂચનાઓ અનુસરીને જરૂરી માહિતી મેળવી શકે છે. વ્યક્તિઓ તેમના સંદેશા વોઈસ મેલ દ્વારા રેકર્ડ પણ કરી શકે છે. પ્રાપ્તકર્તાઓ પોતાની અનુકૂળતાઓ

મશીનમાંથી સંદેશો મેળવી શકે છે. અને તે પ્રમાણે કાર્ય કરી શકે છે. તમે પ્રવેશ (Admission) પરીક્ષા અને NIOS ના પરિણામ અંગેની માહિતી ઈન્ટર ઓક્ટિવ વોઈસ મેલ પ્રણાલી દ્વારા મેળવી શકો છો. આ પદ્ધતિ મુખ્ય મથક ન્યુ ડિલ્હી મુકામે સ્થાપિત થયેલ છે. તમે વોઈસ મેલમાંથી માહિતી મેળવવા માટે નીચેના બે પૈકી કોઈ ટેલિફોન નંબર જોડી શકો.

(૧) ૦૧૧-૨૬૨૮૧૦૫૪

(૨) ૦૧૧-૨૬૨૮૧૦૭૫

ટેલિકોન્ફરન્સિંગ:-

સામાન્ય રીતે, કોન્ફરન્સ એટલે કોઈ સામાન્ય મુદ્દાઓ વિશે સલાહ મસલત કે ચર્ચા માટે લોકોની મિટિંગ અહીં લોકો સાથે બેસે છે અને આમને સામને (મુખ્યોમુખ) એકબીજા સાથે આંતરરક્ષિયા તો કરે છે પણ તે બીજાઓની સામે પ્રત્યક્ષ રીતે બેઠા વગર



ટેલિકોન્ફરન્સિંગ

વાર્ષિક વ્યવસ્થા

મોડયુલ - ૩ સેવાના કોન્ટ્રો



નોંધ



લોકો અવાજ સાંભળી શકે, અન્યના ચિત્રો જોઈ શકે અને તેમની પૃથ્વાઓને પોતે જુદા જુદા દેશોમાં બેઠા હોવા છતાં પ્રતિભાવ આપી શકે. તેમાં આધુતિક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે ટેલિફોન, કમ્પ્યુટર, ટેલિવિઝન વગેરેનો ઉપયોગ જરૂરી હોય છે. દરેક ટેલિકોન્ફરન્સિંગ માટે કેન્દ્રીય નિયંત્રણ એકમ આવશ્યક હોય છે, જે સંદેશાવ્યવહારની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે.

ટેલિકોન્ફરન્સિંગના બે જુદા પ્રકારો છે. એક. શ્રાવ્ય કોન્ફરન્સિંગ અને બીજું – દ્રશ્ય કોન્ફરન્સિંગ. ચાલો, તે વિશે વધુ જાણીએ.

શ્રાવ્ય કોન્ફરન્સિંગ:-

આ દ્વિ-માર્ગી શ્રાવ્ય સંદેશ વ્યવહાર તંત્ર છે, જેમાં સહયોગીઓ જુદાં જુદાં સ્થળે બેસીને અવાજ સાંભળે છે અને તરત પ્રતિભાવ આપે છે. લોકો રેડિયો કે ટેલિવિઝન મારફતે ધ્વનિ સાંભળી શકે અને ટેલિફોનના ઉપયોગ દ્વારા પૃથ્વાઓ વ્યક્ત કરી શકે.




શ્રાવ્ય કોન્ફરન્સિંગ

દ્રશ્ય-કોન્ફરન્સિંગ:-

ધ્વનિ સાંભળવા ઉપરાંત, કોન્ફરન્સના સહયોગીઓ એકબીજા સાથે વાત કરતી વખતે દરેકનું ચિત્ર પણ જોઈ શકે. આને દ્રશ્ય કોન્ફરન્સિંગ કહેવાય છે.

રેડિયો કોન્ફરન્સિંગ પ્રક્રિયાના બે વિવિધ પ્રકારો છે :

- એકમાર્ગ વિડીયો અને દ્વિમાર્ગ ઓડિયો:-** આ પ્રણાલીમાં સહયોગીઓ સ્ટુડિયોમાં બેઠેલી વ્યકિતાઓનો ધ્વનિ સાંભળી શકે અને તેમનું ચિત્ર જોઈ શકે. શ્રોતા / દર્શક ટેલિફોન દ્વારા સ્ટુડિયોનો સંપર્ક રાખે છે અને સ્ટુડિયોની વ્યકિતાઓ સહયોગીઓની ધ્વનિ સાંભળે છે.
- દ્વિમાર્ગ ઓડિયો અને વિડીયો:-** અહીં બંને છેડેના સહયોગીઓ અર્થાત સ્ટુડિયો અને ઓડિયન્સ તેમની વચ્ચે વાતચીત કરતી વખતે એકબીજાને ધ્વનિ સાંભળી શકે છે અને ચિત્ર જોઈ શકે છે.



૭.૫ માહિતી સંચારને અવરોધતા પરિબળો

માહિતી સંચાર એ દરેક ક્ષેત્રને સ્પર્શતી પ્રવૃત્તિ છે. તે કેટલીકવાર વ્યવહારોમાં મૂકવી અઘરી હોય છે. કેટલાક અવરોધોને કારણે આંતરિક વિચારો અને સંદુશાઓ સ્થગિત થાય છે. અસરકારક માહિતી સંચારને અવરોધ કરનારા પીરબળો નીચે મુજબ છે.

- સંદેશો રજૂ કરવાની નબળાઈ:** ઘણી વખત સંદેશાઓ રજૂ કરવાનો હલકા શબ્દો કે શબ્દભંડેળનો ઉપયોગ જોવા મળે છે. સુસંસ્કૃત ભાષા, ન યોગ્ય શબ્દભંડેળ અને યોગ્ય જોડણીનો અભાવ જોવા મળે છે. આ પ્રકારની વાસ્તવિકતાના અભાવે અયોગ્ય રજૂઆત, અક્ષમ્ય ભૂલો અને ગેરસમજ ઉભી થાય છે. ભાષાંતરની ભૂલોને કારણે ખોટી માહિતી અને અસંગત સંદેશાઓ મળતા હોય છે. આવી ભાષાકીય સમસ્યા ઉભું થવાનું કારણ જુદા જુદા વ્યવસાયમાં રોકાયેલા લોકો તેમના મત મુજબ અર્થ કરતા હોય છે. તેનું કારણ તેમનું શિક્ષણ, તેમના હેતુ, અને તેમની પૂર્વભૂમિકા છે. આ અવરોધ સંચાલકની દિર્ઘકાલીન અને પ્રતિભાથી સંદર્શા આપનારના સ્વભાગ જાણીને દૂર કરી શકાય છે.
- અસપણ સંદેશાઓ:** અસપણ સંદેશાઓને કારણે સફળતાપૂર્વક ચોક્કસાઈથી સંદેશાઓની આપ-લે થઈ શકતી નથી. દરેક સ્તરે સંદેશાઓ મેળવનાર દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા મોકલનાર દ્વારા જે છાપ ઉભી થયેલ છે તે જ છાપ જાળવી રાખવામાં આવે છે. અપરિપક્વતા માહિતી સંચારનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકતું નથી. કેટલાક સંદેશાઓ આડસ અને ધારણાઓને કારણે માહિતી સંચાર નિષ્ફળ જાય છે. સંચાલકે પોતાના તાબેદાર સાથે સહકાર સાચી આ સમસ્યા દૂર કરી શકાય છે. સંચાલકે તાબેદારોને ધ્યાનની સાંભળવા, તેમના સંદેશાઓને યોગ્ય રીતે સમજવાનો વલણ કેળવવો જોઈએ.
- બેદ્યાન:** કેટલીક વાર લોકો બુલેટીન, નોટીસ, મિનિટ્સ (વિગતો) અને અહેવાલો વાંચવામાં નિષ્ફળ રહે છે. ધ્યાનપૂર્વક સંદેશાઓ સાંભળતા નથી. તાબેદાર એવું માને છે. કે આવેલ સંદેશાઓ સંદેશા વ્યવહાર માટે અગત્યના નથી. આવી ભૂલો સંદેશા વ્યવહારને ન્યાય આપવામાં બિન અસરકારક રહે છે. ઉચ્ચઅધિકારી હાથ નીચેના કર્મચારીઓનો સંદેશાઓ ન સાંભળવાનું વલણ ધરાવતા હોય છે. નબળા માહિતી સંચારના સાધનોને કારણે મીહતી સંચારને પ્રોત્સાહન મળતું નથી.
- અસપણ ધારણાઓ:** અસપણ ધારણાઓને કારણે સંદેશાની ચોક્કસાઈ રહેતી નથી. દેશા મોકલનાર અને મેળવનાર વચ્ચે ગેરસમજ ઉભી થાય છે. દા. ત. ગ્રાહક વેપારીને સંદેશો મોકલે છે કે નિયત સમયે આપના સ્થળની મુલાકાત લઈશ, પરંતુ ગ્રાહક એવું વિચારે છે કે વેપારી વાહનની, રહેવાની, જમવાની વ્યવસ્થા કરશે, પરંતુ વેપારી એવું માને છે કે અસપણ માન્યતાઓ (ધારણાઓ) વ્યાપારી અને ગ્રાહકના સંબંધો બંગાડે છે.



નોંધ



૫. **પરિવર્તનનો અભાવ:-** માનવસ્વભાવ પ્રમાણે વ્યક્તિત રોજિંદુ જીવનમાં દખલગીરી ઈચ્છતા નથી અને નવા વિચારો સ્વીકારતા નથી. તેઓ તેમનો દરજાઓ સ્થિર રાખવા માંગતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની માન્યતા અને રિવાજો પ્રમાણે સંદેશાઓ મેળવા ઈચ્છતા હોય છે. જ્યાં સુધી કર્મચારીઓને સંદેશાઓ અંગત રીતે સ્પર્શતા ન હોય ત્યાં સુધી તે માહિતી સંચારમાં રસ લેતા નથી. સંદેશાઓ સમજવાનો સમય વ્યક્તિત વ્યક્તિએ આલગ હોય છે. સંચાલિકીય તાબેદારોને સંદેશાઓ સમજવા પૂરતો સમય અને પ્રોત્સાહન પૂરો પાડવો જોઈએ.
૬. **પરસ્પર અવિશ્વાસ:-** અસરકારક માહિતીસંચાર ત્યારે જ શક્ય બને છે જ્યારે અધિકારી અને તાબેદારો વચ્ચે સંપૂર્ણપણે વિશ્વાસ અને સમજ હોય. તાબેદારને અન્યાય અને બિનતાઈંડ નિર્ણય સંદેશાઓ મેળવામાં વિલંબ કરે છે. બીજા દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવાની મનોવૃત્તિ ખુલ્લામને સ્વીકારવાનો અભાવ હોય છે. સંચાલકે પોતાના તાબેદાર અને સ્વકર્મચારીઓ સારથે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું જોઈએ અને દરેકે રજૂ કરેલા વિચારોને માન આપવું જોઈએ.
૭. **સ્થાન અને દરજાઓ:-** તાબેદાર ઉચ્ચઅધિકારીના સ્થાન અને દરજજાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે સત્ય હકીકતો ઉપરી અધિકારી સમક્ષ રજૂ કરવાનું ડર રાખતા હોય છે. ઉપરી અધિકારી દ્વારા પોતાની માનહાનિ થવાના ડરને કારણે ગેરમાર્ગ દોરનારની માહિતી અને અસપદ માહિતી રજૂ કરતા હોય છે. ઉપરી અધિકારીનું એવું વલણ હોય છે કે વધુમાં વધુ માહિતી પોતાની પાસે હોય છે અને તાબેદારને સાંભળવાનું આગ્રહ રાખતા નથી. મુક્ત અને ન્યાયિક વાતાવરણને આધારે સંચાલક ઉપરી અધિકારી અને તાબેદાર વચ્ચેનો ડર દૂર કરવાનો અને વ્યવસ્થાતંત્રમાં સરળ રીતે માહિતી સંચાર થાય તે જોવાનું કાર્ય કરવું જોઈએ.
૮. **જટિલ વ્યવસ્થાતંત્ર:-** વ્યવસ્થાતંત્રના માળખામાં વિવિધ સ્તરે નિરક્ષણનું કાર્ય થાય છે. સત્તાની લાંબી સાંકણે કારણે આદેશોનું અસરકારક પાલન થઈ શક્તનું નથી. માહિતી સંચાર વિવિધ સ્તરોના નિરીક્ષણને કારતે બિનઅસરકારક રહે છે. કામદારો અને ઉચ્ચસંચાલકોના વ્યવસ્થાતંત્રના લાંબા અંતરને કારણે મુક્ત અને ઝડપી સંદેશાઓ કે વિચારોની આપ-લે થતી નથી. સંચાલકે વ્યવસ્થાતંત્રની આ નબળાઈ દૂર કરવી જોઈએ.



૭.૩ પાઠગત પ્રશ્નો

સાચી રીતે જોડો

કોલમ A

(અ) ટેલિગ્રામ

કોલમ B

(૧) ઇન્ટરનેટ દ્વારા ટપાલ મેળવવી અને મોકલવી

માહિતી સંચારની સેવા

- | | |
|----------------|---|
| (બ) મોબાઈલ ફોન | (ર) મુદ્રિત દસ્તાવેજનું તરત્કાળ સંક્રમણ |
| (ક) ફેક્સ | (ઢ) શોર્ટ મેસેજિંગ સર્વિસ |
| (ડ) વોઈસ મેલ | (૪) વપરાયેલ શબ્દોની સંખ્યા પ્રમાણે નાણાંની ચુકવણી |
| (૪) ઈ-મેલ | (૫) આવતા ટેલિફોન કોલ મેળવવાની અને પ્રત્યુત્તરની કોમ્પ્યુટર આધારિત પ્રણાલી |

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રો



નોંધ



તમે શું શીખ્યા?

- વ્યક્તિગ્રામો વચ્ચે હકીકત, ઘ્યાલો, અભિપ્રાય, વિચારો, વાણી દ્વારા માહિતી લેખન કે હાવભાવ અને સંકેતના વિનિમયની પ્રક્રિયા માહિતી સંચાર તરીકે ઓળખાય છે.
- માહિતી સંચાર પ્રક્રિયાનાં તત્ત્વો મોકલનાર (પ્રેષક), મેળવનાર (પ્રાપ્તકર્તા) સંદેશો અને પ્રતિપોષણ છે.
- માહિતી સંચાર શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે.
- શબ્દોની સહાયથી થતું માહિતી સંચાર શાબ્દિક માહિતીસંતાર કહેવાય છે અને શબ્દોના ઉપયોગ વગર થતું માહિતીસંચાર અશાબ્દિક માહિતીસંચાર કહેવાય છે.
- શાબ્દિક માહિતી સંચાર મૌખિક કે લેખિત હોઈ શકે.
- અશાબ્દિક માહિતીસંચાર દ્રશ્ય, શ્રાવ કે હાવભાવાત્મક (અંગે ચેષ્ટાત્મક) હોઈ શકે.
- વ્યવસાય પ્રવૃત્તિઓ વિશે માહિતીનો વિનિમય અને તેમના પરિણામો વ્યવસાય માહિતી સંચાર કહેવાય છે.
- આપણો આપણો સંદેશો વિવિધ રીતો દ્વારા મોકલીએ છીએ તે માહિતી સંચારમાં સાધનો કહેવાય છે.
- પત્રો, ટેલિગ્રામ, (તાર) ફોન, ટેલેક્સ, ફેક્સ, ઈ-મેલ, પેજર, ટેલિકોન્ફરન્સિંગ એ માહિતીસંચારના એવા સાધનો છે. જે સામાન્ય રીતે દૂરનાં સ્થળોએ સંદેશ મોકલવા વપરાય છે.



સત્ત્રાંત સ્વાધ્યાય

૧. માહિતી સંચારની વ્યાખ્યા લભગભ ૨૦ શબ્દોમાં આપો.
૨. માહિતી સંચાર પ્રક્રિયાનાં ચાર તત્ત્વોનાં નામ આપો.
૩. વ્યવસાય માહિતીસંચાર એટલે શું ?

મોડયુલ – ૩

સેવાના ભેત્ર



નોંધ

માહિતી સંચારની સેવા

૪. "પત્રો એ માહિતીસંચારનું સૌથી ઉત્તમ સાધન છે." શું તમે આ વિધાન સાથે સંમત છો? કારણ આપો.
૫. વોઈસ મેલનું સંક્ષિપ્ત વર્ણન આશરે બે વાક્યોમાં આપો.
૬. શાબ્દિક માહિતી સંચારનો અર્થ સમજાવો.
૭. વ્યવસાયમાં માહિતીસંચારનું મહત્વ આગળ તરી આવે તે આ ચાર મુદ્દાઓ આપો.
૮. ટેલિફોન એ મૌખિક માહિતીસંચારનું અતિલોકપ્રિય સ્વરૂપ છે. શું તમે સંમત છો? કારણો આપો.
૯. શાબ્દિક અને અશાબ્દિક માહિતી સંચાર વચ્ચેનો તરીકો તરફાવત આપો.
૧૦. માહિતી સંચાર પ્રક્રિયા આવૃત્તિની મદદથી દર્શાવો.
૧૧. માહિતી સંચારનો અર્થ અને તેની પ્રક્રિયા સમજાવો.
૧૨. અશાબ્દિક માહિતીસંચારના વિવિધ પ્રકારો જણાવો.
૧૩. "ઈ–મેલ એ લેખિત સંદેશા સંક્ષમણ કરવાની સૌથી ઝડપી પદ્ધતિ છે." સમજાવો.
૧૪. તમે નિકાસકર્તા છો અને (તમે) યુ.એસ.એ.માંના આયાતકર્તાને ભાવપત્રક (Quotation) ની આબુદૂબ નકલ મોકલવા ઈચ્છા છો માહિતીસંચારનું ક્યું સાધન તમે વાપરશો અને શા માટે?



પાઠગત પ્રશ્નોની ચારી

૭.૧

૧.

૧. T ૨. F ૩. T ૪. T

૨.

- | | | |
|------------------------------------|--------------|----------------------------|
| ૧. મોકલનાર (પ્રેષક) | ૨. પ્રતિપોષણ | ૩. મેળવનાર (પ્રાપ્તકર્તા) |
| ૪. હકીકત, ઘ્યાલો, લાગણીઓ કે વિચારો | | ૪. મોકલનાર (પ્રેષક) |

૭.૨

અ.

- | | |
|-------------------------|------------------------|
| ૧. શાબ્દિક માહિતી સંચાર | ૨. મૌખિક માહિતીસંચાર |
| ૩. હાવભાવ માહિતી સંચાર | ૪. દ્રશ્ય માહિતી સંચાર |

બ.

૧. V ૨. NV ૩. NV ૪. V ૫. NV

૭.૩

૧. (અ)-(૪), (બ)-(૩), (ક)-(૨), (દ)-(૫),
(ઈ)-(૧)

માહિતી સંચારની સેવા

૨. (i) d (ii) d (iii) d (iv) c (v) b



તમારા માટે પ્રવૃત્તિઓ

માહિતીસંચારમાં વિવિધ સાધનો જે તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તેની યાદી બનાવો. તમારી જરૂરિયાત મુજબ કોઈ એક સાધનને અગ્રતા આપો. અગ્રતા આપતી વખતે થતો ખર્ચ તેમજ માહિતીસંચારના સાધનમાંથી તમને મળતા લાભો ધ્યાનમાં રાખો.

મોડયુલ - ૩ સેવાના કોન્ટ્રો



નોંધ



ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

શું તમને આ કોર્સ સામગ્રીનો અભ્યાસ કરતાં કોઈ મુશ્કેલી પડે છે? તમે અત્યાર સુધી શીખી ગયેલ પાઠો સમજી શક્યા છો? જો ના, તો તમે તમારી વિશિષ્ટ સમસ્યાઓ વિશે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) ને લખી શકો. NIOS તમારી સમસ્યાનો ઉકેલ નક્કી શોધી કાઢો, પરંતુ હવે પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે તમારી સમસ્યાઓ મોકલી શકો? અગાઉના પાઠમાં તમે માહિતીસંચારના વિવિધ સાધનો વિશે શીખી ગયા. તેમાંના કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને તમે અમને જણાવી શકો. તે પાઠમાં તમે એ પણ શીખી ગયા કે પત્રો એ લેખિત માહિતી સંચારનું બહુ સામાન્ય અને અનુકૂળ સાધન છે. જો તમે અમને કાગળ લખો તો તે કેવી રીતે અમને પહોંચશે? તે અમારી પાસે કોણ લાવશે? વારુ, એ છે પોસ્ટઓફિસ, જે આ કાર્ય કરશે. તે મોકલનાર અને મેળવનાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરશે. પ્રેષક પોસ્ટઓફિસમાં પત્ર પોસ્ટ કરે છે અને પોસ્ટઓફિસ તે પત્ર જે તે વ્યક્તિને પહોંચાડવા તમામ જરૂરી પગલાં લે છે. વધારામાં પોસ્ટઓફિસ કેટલીક અન્ય સેવાઓ પણ કરે છે. આ પાઠમાં આપણો પોસ્ટઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે વધુ શીખીશું.



હેતુઓ:-

આ પાઠ શીખ્યા પછી તમે જાણી શકશો,

- ટપાલ સેવાઓનો અર્થ અને સ્વરૂપ સમજાવી શકશો.
- ટપાલ વિભાગ દ્વારા અને ખાનગી કુરિયર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ જણાવી શકશો.
- ટપાલ સેવાઓનું મહત્વ વર્ણવી શકશો. અને
- ખાનગી કુરિયર સેવાઓનાં ભૂમિકા ઓળખી શકશો.

૮.૧ ટપાલ સેવાનો અર્થ

તમે પોસ્ટ ઓફિસે ગયા હશો. તમે ત્યાં શું કરેલું? તમે ટિકિટો ખરીદી હશો અને પત્ર પોસ્ટ કર્યો હશો. કેટલીકવાર તમે પૈસા પણ મોકલ્યા હશો કે પાર્સલ પણ, અથવા તો તમે તમારી બચત પોસ્ટ ઓફિસમાં જમા કરાવી હશો. પત્રો અને પાર્સલ લઈ જવા, નાણાં મોકલવાની વ્યવસ્થા કરવી, નાણાંની ડિપોઝિટ સ્વીકારવી વગેરે સેવાઓ પોસ્ટઓફિસ દ્વારા

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

આપાતી વિવિધ સેવાઓ છે. આમ જનતા આ સેવાઓ મેળવી શકે. આ તમામ સેવાઓ ટપાલ સેવાઓ કહેવાય છે.



ભારતીય ડાક



૮.૨ ટપાલ સેવાનું સ્વરૂપ

ટપાલ સેવાઓ લેખિત સંદેશા મોકલવામાં જરૂરિયાત સાથે ઉદભવી ભૂતકાળમાં પણ લેખિત સંદેશાનું આદાન પ્રદાન થતું, પરંતુ ત્યારે ત્યાં કેટલીક વ્યક્તિઓ જે 'ખેપીયા' તરીકે ઓળખાય તેમ સંદેશા એક સ્થળેથી બીજે સ્થળે આપવા માટે રાખવામાં આવતા. તાલીમી કબૂતરોને પણ એક જગ્ગાએથી બીજી જગ્ગાએ પત્રો પહોંચાડવા ઉપયોગ થતો. આજની ટપાલ પ્રણાલી વાહનવ્યવહાર તરીકે રોડ અને રેલવેના ફેલાવા સાથે અસરકારક બની. ભારતમાં ૧૮૭૭ સુધી ટપાલ સેવાનો માત્ર સરકારી ટપાલ મોકલવા ઉપયોગ થતો. ૧૮૭૭ પછી ટપાલ સેવા આમ જનતા માટે પણ ઉપલબ્ધ બની પોસ્ટઓફિસે બીજી પણ કેટલીક સેવાઓ: નાણાં મોકલવા, પાર્સલોનું વિતરણ કરવું, બેંકિંગ, વીમા અને આવી ઘણી સેવાઓ સહિત આપતી.

તમે જાણો છો તેમ પોસ્ટઓફિસ વિવિધ પ્રકારના કાર્યોની સેવા આપે છે. તેથી ટપાલ સેવાઓનું સ્વરૂપ બહુઆયામી હોય છે. ચાલો, આપણે ટપાલસેવાઓનું સ્વરૂપ જોઈએ. ટપાલ સેવાઓનો વહીવટ દેશભરમાં ભારત સરકાર દ્વારા થાય છે. અને તેના ચાર્જ સામાન્ય વ્યક્તિને પરવડે તેવા લઘુતમ હોય છે. લેખિત સંદેશાવ્યવહારના સાધન તરીકે સૌથી વધુ આધાર રાખી શકાય તે રીતે તે જોવાય છે. વળી અંતિ દૂર રહેતા લોકોને મનીઓડર દ્વારા નાણાં મોકલવા સૌથી વધુ વિશ્વસનીય સાધન તરીકે સામાન્ય માશસ તેનો ઉપયોગ કરે છે. વળી કિમતી ચીજવસ્તુઓ વિતરણ કરવા સૌથી સહજ સાધન છે.

પોસ્ટ ઓફિસ દ્વારા આપાતી બેંકિંગ સેવાઓ ગ્રામ તેમજ શહેરી વિસ્તારના મોટી સંખ્યાના લોકોને આકર્ષે છે, કારણ કે તે સહેલાઈથી સુલભ છે અને પોસ્ટ ઓફિસનું એક વિશાળ નેટવર્ક છે. સૌથી વધુ રસપ્રદ નોંધપાત્ર લક્ષણ એ છે કે આ તમામ વિવિધ ટપાલ સેવાઓ આપણને કેટલાક વિકલ્પો પૂરો પાડે છે, જે આપણે આપણે જરૂરિયાત અને અનુકૂળતા મુજબ વાપરી શકીએ છીએ. ઉદાહરણાર્થે પત્ર લખવા માટે આપણે પોસ્ટ કાર્ડ, અંતરરદેશીય પત્ર કે કવરનો ઉપયોગ કરી શકીએ.

૮.૩ ટપાલ સેવાઓના પ્રકાર

ભારતીય ટપાલ સેવાઓ પત્રો, પાર્સલ પેકેટ વગેરેનું એકત્રીકરણ છૂટાં પાડવા (Sorting) અને વિતરણ સાથે મુખ્યત્વે સંબંધિત છે. તદુપરાત અનેક બીજી સેવાઓ પણ આમ જનતા તેમજ વ્યવસાય સાહસોને પૂરી પાડવામાં આવે છે. ચાલો આપણે એ બધી સુવિધાઓને નીચેનાં મુખ્ય મથ્યાણાં હેઠળ વર્ગીકરણ કરીએ:

૧. ટપાલ સેવા
૨. નાણાં મોકલવાની સેવા

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



૩. બોકિંગ સેવા
૪. વીમા સેવા
૫. અન્ય સેવા

૮.૪ ટપાલ સેવા (મેઈલ સેવા)

તમે તમારા મિત્રોને અને સંબંધીઓને જુદા-જુદા પ્રસંગોએ પત્રો મોકલો છો. તે જ રીતે, તમે NIOS સાથે તમારા પ્રશ્નો વિશે પત્રવ્યવહાર કરો છો. વિશિષ્ટ પ્રસંગોએ તમે તમારા મિત્રોને અભિવાદન (Greeting) અને બેટ મોકલો છો. આ બધી પરિસ્થિતિઓમાં પોસ્ટઓફિસ તમને સંદેશો મોકલવામાં તેમજ ટપાલ સેવા તરીકે જાણીતી સેવા દ્વારા તમને સંદેશો લાવવામાં પણ સહાય કરે છે. ટપાલ સેવા તરીકે જાણીતી સેવા દ્વારા તમને સંદેશો લાવવામાં પણ સહાય કરે છે. ટપાલ સેવા એ પોસ્ટઓફિસની એક મુખ્ય સેવા છે. જે પત્રો અને પાર્સલ ઓફિસની એક મુખ્ય સેવા છે. જે પત્રો અને પાર્સલ પ્રેષક પાસેથી એકત્રીકરણ કરીને પ્રાપ્તકર્તાઓને વિતરિત કરવા સાથે સંબંધિત છે. ભારતીય ટપાલ સેવા અંતર્દીશીય અને આંતરરાષ્ટ્રીય ટપાલની કામગીરી કરે છે. અંતર્દીશીય ટપાલ એ તે પત્ર છે જ્યાં પત્ર મોકલનાર અને મેળવનાર તે જ દેશમાં રહેતા હોય. બીજી તરફ જ્યાં ટપાલ મોકલનાર અને મેળવનાર જુદા જુદા દેશોમાં રહેતા હોય ત્યારે તે આંતરરાષ્ટ્રીય ટપાલ કહેવાય છે.

લેખિત સંદેશો મોકલવા પ્રેષક પોસ્ટ કાર્ડ, અંતર્દીશીય પત્ર (Indian Letter) કે કવરનો ઉપયોગ કરી શકે. પેકેટ કે પાર્સલમાં કોઈ વસ્તુ મોકલવા (જાડા કાગળ કે કપડાનું) રેપર વાપરી શકાય. આ પોસ્ટઓફિસ દ્વારા મોકલવાની ટપાલનાં વૈકલ્પિક સાધનો છે. ચાલો, આપણે ટપાલ સેવાનાં આ સાધનો વિશે વધુ જાણીએ.

૧. પોસ્ટકાર્ડ:-

પોસ્ટકાર્ડ એ લેખિત સંદેશાબ્દ્યવહારનું સૌથી સસ્તુ સાધન છે. તે એક એવું કાર્ડ છે જેની બંને બાજુઓ આપણે સંદેશો લખી શકીએ. તેમાં પ્રાપ્તકર્તાનું સરનામું લખવા માટે નિયત જગ્યા હોય છે. પોસ્ટઓફિસમાં બે જુદા પ્રકારના પોસ્ટકાર્ડ ઉપલબ્ધ હોય છે. એક સામાન્ય પોસ્ટકાર્ડ અને બીજું સ્પર્ધા (પ્રતિયોગિતા) પોસ્ટકાર્ડ. સામાન્ય પોસ્ટકાર્ડ પત્રો લખવા વપરાય છે. સ્પર્ધા પોસ્ટકાર્ડ રેડિયો, ટેલિવિઝન, ન્યુઝપેપર, સામયિકો દ્વારા જાહેર વિવિધ સ્પર્ધાઓમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ મોકલવા વપરાય છે. બન્ને પોસ્ટકાર્ડનું કદ સરખું હોવા છિતાં તે રંગ અને કિંમતની બાબતમાં જુદા પડે છે.

પોસ્ટકાર્ડ લખતે એક અગત્યનો મુદ્દો તમારે એ યાદ રાખવો જોઈએ કે જો તમે પોસ્ટકાર્ડની કોઈ એક બાજુએ તમારો સંદેશ શબ્દોમાં કે ચિત્રમાં છાપો તો તમારે વધારાનું પોસ્ટેન ચુકવવું પડે. આ પ્રકારનું કાર્ડ મુદ્રિત પોસ્ટકાર્ડ કહેવાય છે. તમે પોસ્ટકાર્ડ કદના અભિવાદન કાર્ડ જોયા હશે, જેની એક બાજુએ ચિત્ર કે સંદેશો મુદ્રિત હોય છે, આ પણ મુદ્રિત પોસ્ટકાર્ડ છે.

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

પોસ્ટઅઓફિસમાં જવાબી પોસ્ટકાર્ડ પણ ઉપલબ્ધ હોય છે, જે પોસ્ટકાર્ડ સાથે બીડેલ હોય છે, જેથી સંદેશો મોકલી શકાય. તે મોકલવાથી પ્રાપ્તકર્તા પાસેથી તમે જવાબ મેળવી શકો. ખરેખર તો તે બે સામાન્ય પોસ્ટકાર્ડ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેમાંનું એક પોસ્ટકાર્ડ સંદેશો મોકલવા વપરાય છે. અને બીજું જવાબ મેળવવા ઉપયોગ થાય છે. પ્રેષક તેનું પોતાનું સરનામું જવાબ પોસ્ટકાર્ડ લખે છે અને તે બન્ને જુદા પાડયા સિવાય મોકલે છે. પ્રાપ્તકર્તા સંદેશા સાથેનું પોસ્ટકાર્ડ છૂટું પાડે છે અને પ્રેષકને જવાબી પોસ્ટકાર્ડમાં જવાબ મોકલે છે.



પોસ્ટ કાર્ડ

૨. આંતરદેશીય પત્રકાર્ડ:-


પોસ્ટકાર્ડની માફક લેખિત સંદેશા આંતરદેશીય (Inland) પત્રકાર્ડ નોઉપયોગ કરીને મોકલી શકાય. પોસ્ટઅઓફિસ દ્વારા આ કાર્ડનું વેચાણ થાય છે અને તે સામાન્ય રીતે આપણા દેશની અંદર સંદેશા મોકલવા વપરાય છે. પોસ્ટકાર્ડથી બિન્ન રીતે, ઈન્લેન્ડ લેટર કાર્ડનો લખેલ ભાગ ગડી વાળેલ અને બંધ કરેલ (ચોંટાડેલ) હોય છે. પ્રાપ્તકર્તા અને મોકલનાર (પ્રેષક)નાં માત્ર નામ—સરનામાં જો કે ઈન્લેન્ડ લેટર કાર્ડની માફક એક ખાસ પ્રકારનું કાર્ડ વિદેશોમાં સંદેશા મોકલવા વપરાય છે. તેને એરોગ્રામ (Aerogram) કહે છે.



આંતરદેશીય પત્રકાર્ડ

૩. કવર (Envelopes):-

તમે શીખી ગયા કે પોસ્ટકાર્ડ પર કે આંતરદેશીય પત્ર (કાર્ડ) પર સંદેશા લખી શકાય. પરંતુ પોસ્ટકાર્ડ ગુપ્ત સંદેશા મોકલવા યોગ્ય હોતા નથી. વળી, ઈન્લેન્ડ લેટર કાર્ડમાં કોઈ બિડાણ સાથે મોકલવાનું શક્ય હોતું નથી. જો કે તેમાં સંદેશાની ગુપ્તતાની ખાતરી જરૂર હોય છે. હવે, ધારો કે તમારે કોઈ સંસ્થામાં નોકરીની શોધ માટે તમારી અરજી કે બાયોડેટા મોકલવાનો છે.



કવર

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



શું તમે ટપાલ મારફતે મોકલાવી શકો ? હા, મોકલવા માટે તમારે ટપાલ પરબીડિયું (કવર) કે ટપાલની ટિકિટો ચોટાડેલ હોય તેવું સામાન્ય કવર જોઈએ. તે એક નાનું પેપર પેકેટ છે, જેની એક બાજું ખુલ્લી હોય છે. તમારું બિડાષ તેમાં મુક્યા પછી તમારે તે બંધ કરવાનું હોય છે અને પછી પ્રાપ્તકર્તાને મોકલવાનું રહે છે. ટપાલ પરબીડિયાં તમામ પોસ્ટઓફિસોએ ઉપલબ્ધ હોય છે. તે તમામ સરકારી કે ખાનગી ઓફિસોમાં તેમજ વ્યવસાય ફર્મ (પેઢીઓ)માં પત્રો અને અન્ય દસ્તાવેજો મોકલવા વ્યાપક રીતે વપરાય છે. પત્રો મોકલવા ઉપરાંત આપણે અમૃક હલકાં બિડાષ જેવાં કે ફોટોગ્રાફ, અભિવાદન કાર્ડ પણ કવર દ્વારા મોકલી શકીએ છીએ. પોસ્ટઓફિસમાં તમે જુદા જુદા પ્રકારના કવર જોશો, જેમ કે સામાન્ય કવર, રાજિસ્ટર્ડ ટપાલ માટેનું કવર વગેરે. આ કવરોમાં જો તમારા બિડાષનું વજન અમૃક નિશ્ચિત મર્યાદામાં હોય તો વધારાની ટપાલ ટિકિટો લગાવવાની જરૂર રહેતી નથી. પરંતુ જો તો મર્યાદા કરતા વજન વધુ હોય તો ટપાલના દર મુજબ વધારાની ટપાલ ટિકિટો લગાવવાની રહે છે. જો તમારા બિડાષનું કદ પોસ્ટઓફિસમાં ઉપલબ્ધ હોય તેવા કવરમાં ન આવે તો તમે તમારું પોતાનું કવર તૈયાર કરી શકો કે બજારમાંથી ખરીદી શકો અને વજન પ્રમાણે તેની પર ટપાલ ટિકિટો લગાવી શકો. અન્યથા પણ પોસ્ટઓફિસમાં ઉપલબ્ધ કવરો વાપરવાનું ફરજિયાત નથી.

૪. પાર્સલ ટપાલ:-

ધારો કે તમારે નજીકિના શહેરમાં રહેતા તમારા મિત્રોને એક પુસ્તક મોકલવું છે. શું તમે તે ટપાલ દ્વારા મોકલાવી શકો ? હા, તે પોસ્ટઓફિસની પાસૂલ સેવા દ્વારા મોકલાવી શકાય. ચાલો, તે વિશે શીખીએ. ટપાલ સુવિધા કે જે દ્વારા વસ્તુઓ પાર્સલના સ્વરૂપે મોકલાવી શકાય તેને પાર્સલ પોસ્ટ કહે છે.



પાર્સલ ટપાલ

તે વિશ્વસનીય અને સસ્તી પાર્સલ વિતરણ સેવા છે. પાર્સલ ટપાલ સેવાઓ હેઠળ નિયત કદ અને વજનનાં પાર્સલો દેશની હદમાં તેમજ દેશની બહાર મોકલાવી શકાય છે. ટપાલ ચાર્જ પાર્સલના વજન પ્રમાણે બદલાતો હોય છે. અંતરદેશીય અને વિદેશી પાર્સલ ટપાલ માટે અલગ પોસ્ટેજ ચાર્જ ચુકવવાનો હોય છે.

૫. બુક પોસ્ટ:-

મુક્રિત સામગ્રી, મુક્રિત પુસ્તકો, સામયિકો, અભિવાદન કાર્ડ સ્વરૂપમાં વસ્તુઓ બુક પોસ્ટ તરીકે ટપાલમાં મોકલી શકાય છે.



બુક પોસ્ટ

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

બુક પોસ્ટ હેઠળ પુસ્તકો કે દસ્તાવેજો ધરાવતા કવર માત્ર બંધ સ્વરૂપમાં હોવા જોઈએ, પણ ચોંટાડેલ નહિ. કવર પર બુક પોસ્ટ એમ દર્શાવેલ હોવું જોઈએ. બુક પોસ્ટ પરનું પોસ્ટેજ ચાર્જ ચોંટાડેલ કવરના ચાર્જ કરતાં ઓછો હોય છે.



૮.૧ પાઠગત પ્રશ્નો

યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો

૧. ને લેખિત સંદેશો મોકલવા એરોગ્રામ વપરાય છે.
૨. સામાન્ય પોસ્ટકાર્ડ અને પ્રતિયોગિતા પોસ્ટકાર્ડ ની બાબતમાં મિન્ન પડે છે.
૩. સામાન્ય અંતરદેશીય પાર્સલ પરનો ટપાલ ચાર્જ પ્રમાણે બદલાતો રહે છે.
૪. બુક પોસ્ટ ટપાલ પરનો પોસ્ટેજ ચાર્જ ચોંટાડેલ કવર પરના ચાર્જ કરતાં હોય છે.
૫. પોસ્ટકાર્ડને બદલે અંતરદેશીય પોસ્ટકાર્ડ વાપરવું જોઈએ, જ્યારે સંદેશો મોકલનાર કોઈ સંદેશો મોકલવા માગતો હોય.

૮.૫ નાણાં મોકલવાની સેવા

ઘારો કે તમે તમારા ધરથી અતિ દૂરના સ્થળે કાર્ય કરો છો અને તમે તમારા કુટુંબને નાણાં મોકલવા માગો છો. તમે પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી નાણાં મોકલવાની સેવા મારફતે તે મોકલાવી શકો. તે મનીઓર્ડર અને પોસ્ટલ ઓર્ડર સુવિધા પૂરી પાડે છે, જેની મદદથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ દેશની અંદર અને બહાર નાણાં મોકલી શકે. ચાલો, આપણે મનીઓર્ડર અને પોસ્ટલ ઓર્ડર વિશે વધુ જાણીએ.

અ. મનીઓર્ડર:-

મનીઓર્ડર સર્વિસ હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા નાણાં મોકલી શકાય. મનીઓર્ડર એ એક એવો ઓર્ડર છે જે એક પોસ્ટઓફિસ દ્વારા બીજી પોસ્ટઓફિસને કરવામાં આવે છે. તેમાં જણાવેલ નામની વ્યકિતને નાણાની અમુક રકમ ચૂકવવા માટે જો તમારે નાણાં મોકલવા હોય તો પ્રથમ તમારે મની ઓર્ડર ફોર્મ ભરવું પડે, જે તમામ પોસ્ટઓફિસે કિમત ચૂકવણી દ્વારા ઉપલબ્ધ બને છે. ભરવામાં આવેલ ફોર્મ મોકલવાના નાણાંની રકમ સાથે પોસ્ટઓફિસને આપવામાં આવે છે. એમ મનીઓર્ડર ફોર્મ માં આપણે વધુમાં વધુ રૂ.૫૦૦૦/- મોકલી શકીએ. મનીઓર્ડર ફોર્મમાં થોડી જગ્યા હોય છે, જ્યાં



મનીઓર્ડર ફોર્મ

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

તમે તમારો સંદેશ પ્રાપ્તકર્તાને લખી શકો. ભરેલું ફોર્મ પછી પોસ્ટઓફિસને મોકલાય છે, જ્યાં પેમેન્ટ કરવાનું હોય છે. ટપાલી તેની સાથે ફોર્મ લઈ જાય છે અને પ્રાપ્તકર્તા પાસેથી સહી મેળવ્યા પછી તેને પૈસા આપે છે.

આ સેવા માટે પોસ્ટ ઓફિસ મોકલનાર પાસેથી નિયત કમિશન ચાર્જ કરે છે, જે મોકલેલ નાણાંની રકમના પ્રમાણમાં બદલાય છે. ગ્રાહકોની અનુકૂળતા માટે પોસ્ટ ઓફિસ વિવિધ પ્રકરની મનીઓર્ડર સેવાઓ આપે છે. જેમ કે સામાન્ય મનીઓર્ડર, ટેલિગ્રાફિક મનીઓર્ડર, સેટેલાઇટ મનીઓર્ડર, સ્પીડપોસ્ટ મનીઓર્ડર વગેરે. વ્યવસાયી વ્યકિતઓનસ સગવડ માટે તે ક્રોપોરેટ મનીઓર્ડર સર્વિસ પણ આપે છે.

૬. પોસ્ટલ ઓર્ડર:-

મનીઓર્ડરની માફક આપણે પોસ્ટલ ઓર્ડર દ્વારા પણ નાણાં મોકલી શકીએ. અર્થાત ભારતીય પોસ્ટલ ઓર્ડર તે Indian Postal Order (IPO) એક જગાએથી બીજી જગાએ નાણાં મોકલવાની સગવડભરી પદ્ધતિ છે અને તે મુખ્યત્વે પરીક્ષા ફી ભરવા કે કોઈ નોકરી માટે અરજી કરવાની ફી ભરવા વપરાય છે. પોસ્ટલ ઓર્ડર તમામ પોસ્ટ ઓફિસો એ જુદાં જુદાં મુલ્ય વર્ગોમાં જેમ કે રૂ. ૧/-, રૂ. ૨/-, રૂ. ૫/-, રૂ. ૭/-, રૂ. ૧૦/-,



પોસ્ટલ ઓર્ડર

રૂ.૨૦/-, રૂ.૪૦/-, રૂ.૧૦૦/- ઉપલબ્ધ હોય છે. આપણે નિયત ચાર્જ ભરી પોસ્ટલ ઓર્ડર ખરીદી શકીએ અને પ્રાપ્તકર્તાને તેનું નામ ઉલ્લેખ કરીને અને જ્યાંથી નાણા લેવાના છે તે પોસ્ટઓફિસમાં રજૂ કરે છે. યોગ્ય વ્યકિતને પેમેન્ટ થાય તેની ખાતરી માટે પોસ્ટલ ઓર્ડરને ઉપર ડાખી બાજુના ખૂણો બે સમાંતર રેખાઓ દોરીને ક્રોસ કરી શકાય. બરાબર બેંક ટ્રાફિક કે ચેક ક્રોસ કરીએ છીએ. તેમ, પોસ્ટલ ઓર્ડરને ક્રોસ કર્યાની અસર એ છે કે તેનું પેમેન્ટ પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખાતા દ્વારા જમા કરી પ્રાપ્ત કરી શકાય છે. નાણાં મોકલવાની આ પદ્ધતિ ઘણું કરીને અધિકારિક હેતુથી કરવામાં આવે છે.

૮.૬ બેન્કિંગ સેવા

તમે જાણો છો બેંક નાણાં સાથે વ્યવહાર કરે છે. બેંક આમ જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારે છે. અને જેમને ફુંડની જરૂર હોય તેમને લોન અને એડવાન્સ આપે છે. ડિપોઝિટ સ્વીકારવા અને નાણાં ઉછીના આપવા ઉપરાંત બેંક ગ્રાહકોને તેમની કિમતી ચીજો સેફ કસ્ટડી (સલામત હવાલા)માં રાખીને, એક જગાએથી બીજી જગાએ નાણાં મોકલીને, વ્યવસાય માહિતી પૂરી પાડીને વગેરે દ્વારા ગ્રાહકોને મદદ પણ કરે છે. પોસ્ટઓફિસો આવી કેટલીક સેવાઓ હાથ ધરે છે જેમ કે આમ જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારવી અને ડિપોઝિટ ઉપાડવી. આમ જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારવી અને ડિપોઝિટ ઉપાડવા

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

આમ આપણે કહી શકીએ કે આ પોસ્ટઓફિસ દ્વારા અપાતી બેંકિંગ સેવાઓ છે. આ સેવા હેઠળ તે વિવિધ યોજનાઓ બચત ને ઉતેજન આપવા તેમજ લોકોને બચત માટે પ્રેરવા માટે આપે છે. ચાલો, આપણે પોસ્ટઓફિસ દ્વારા અપાતી કેટલીક મહત્વની બચત યોજનાઓ વિશે શીખીએ.

૧. પોસ્ટઓફિસ સેવિંગ બેન્ક એકાઉન્ટ:-

આ એવા પ્રકારનું એકાઉન્ટ છે, જેમાં આપણે આપણી બચત પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકીએ છીએ અને જરૂર હોય ત્યારે ઉપાડી શકીએ છીએ. એકાઉન્ટ ખોલવા માટે ઓછામાં ઓછી રકમ રૂ.૫૦/- જરૂરી હોય છે. અને આપણે વધુમાં વધુ રૂ. એક લાખ (૧,૦૦,૦૦૦/-) આપણા એકાઉન્ટમાં જમા કરાવી શકીએ છીએ. એકાઉન્ટ સંયુક્ત રીતે ઓપરેટ કરી શકાય અને તે કિસ્સામાં ડિપોઝિટજી મહત્તમ મર્યાદા રૂપિયા બે લાખ સુધી વધારી શકાય. એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ કે ચેકનો ઉપયોગ કરીને ઉપાડી શકાય. પોસ્ટ ઓફિસ આપણી ડિપોઝિટ પર વ્યાજ આપે છે જે સંદર્ભ ઇન્કમટેક્સમાંથી મુક્ત હોય છે.

૨. ૫ વર્ષીય પોસ્ટઓફિસ આવર્તી જમા યોજના(Recurring Deposit Scheme):-

આવર્તી જમા એકાઉન્ટ ખોલવા માટે ઓછામાં ઓછી રકમ રૂ.૧૦/- સાથે જે રૂ.૫/-ના ગુણાંકમાં હોય છે. તે પણ કોઈ મહત્તમ મર્યાદા વગર, ડિપોઝિટ દર મહિને ૫ વર્ષના સમયગાળા માટે કરવાની હોય છે. એક વર્ષ પછી ૫૦% ડિપોઝિટ પાંચ વર્ષના સમયગાળામાં માત્ર એક વખત ઉપાડી શકાય. એક કરતાં વધુ આવર્તી જમા એકાઉન્ટ કોઈ એક વ્યક્તિના નામે ખોલવામાં કોઈ બાધ નથી.

૩. પોસ્ટઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ:-

કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા રૂ.૨૦૦૦/- ના બેલેન્સથી આવું ખાતું ખોલાવી શકે અને તે પણ કોઈ મહત્તમ મર્યાદા વગર. ડિપોઝિટરે એકી વખતે નિયત સમયગાળો પૂરો થયા બાદ પાકે છે. જેમ કે એક, બે, ત્રણ કે પાંચ વર્ષ. આ એકાઉન્ટ પર વાર્ષિક ઘોરણે વ્યાજ આપવામાં આવે છે. પરંતુ તે ત્રિમાસિક ગણતરી થાય છે. આ એકાઉન્ટ ટ્રસ્ટ દ્વારા પણ ખોલી શકાય. ડિપોઝિટ રકમ તેમજ વ્યાજની આવક ટેક્સમાંથી મુક્ત હોય છે.

૪. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Monthly Income Scheme) (MIS):-

આ યોજના હેઠળ એક નિશ્ચિત રકમ છ વર્ષ માટે જમા કરવામાં આવે છે અને ડિપોઝિટર દર મહિને તેનું વ્યાજ મળવે છે. ઓછામાં ઓછા રૂ.૧,૫૦૦/- અને વધુમાં વધુ વ્યક્તિગત એકાઉન્ટમાં રૂ.૪.૫ લાખ અને સંયુક્ત એકાઉન્ટ કિસ્સામાં રૂ.૮ લાખ ડિપોઝિટ કરી શકાય. ડિપોઝિટની રકમ વ્યાજ ઉપરાંત ૫% દરે બોનસ પણ મેળવે છે. જે પાકતી મુદ્દતે ચુકવવા પાત્ર બને છે. વ્યાજ અને બોનસ બન્ને ટેક્સમાંથી મુક્ત હોય છે. આ એકાઉન્ટ નિવૃત્ત કર્મચારીઓ માટે અથવા તો જે કોઈ જે પેન્શન કે પગારની માફક નિયમિત આવક જોઈતી હોય તેમને અનુકૂળ હોય છે.

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



૫. છ વર્ષાય નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (VIII ઈસ્યુ) યોજના:-

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય : (૧) પુખ્ત ઉમરની વ્યક્તિ વડે પોતાને માટે અથવા કોઈ સગીર માટે અથવા કોઈ સગીર દ્વારા (૨) બે પુખ્ત વ્યક્તિઓ સંયુક્ત રીતે અથવા (૩) ટ્રસ્ટ ડિપોઝિટની કોઈ મર્યાદા નથી. સર્ટિફિકેટ રૂ. ૧૦૦/-, રૂ. ૫૦૦/-, રૂ. ૧૦૦૦/-, રૂ. ૫૦૦૦/- અને રૂ. ૧૦૦૦૦/- ના મૂલ્યવર્ગમાં ઉપલબ્ધ હોય છે. ચક્કવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક ગણાય છે. અને ચૂકવવાપાત્ર પણ અર્ધવાર્ષિક બને છે. ૬ વર્ષ પછી આ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસમાંથી વટાવી રોકડ રકમ લઈ શકાય છે. વ્યાજની આવક પુનઃ રોકાણ તરીકે ગણાતી હોઈ ટેકસ વળતરને આધીન હોય છે. આ ડિપોઝિટ યોજના આવકવેરા ભરનારા માટે અતિ લોકપ્રિય છે.

૬. ૧૫ વર્ષાય પણિલક પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટ (PPF એકાઉન્ટ):-

વ્યક્તિઓ આ એકાઉન્ટ પોતાને નાથે અથવા તો તેમના સગીર બાળકને નાથે ખોલાવી શકે. આ એકાઉન્ટમાં દરેક વર્ષમાં ડિપોઝિટ ઓછામાં ઓછા એકવાર ડિપોઝિટ જમા કરાવવી જરૂરી હોય છે. એકાઉન્ટ ધારક વર્ષમાં મહત્તમ રૂ. ૭૦૦૦૦/- ડિપોઝિટ કરી શકે, જે કયાં તો એકી સાથે અથવા તો વધુમાં વધુ ૧૨ હપ્તાઓમાં જમા કરી શકો. દર વર્ષ ઓછામાં ઓવા રૂ. ૫૦૦/- ડિપોઝિટ કરાવવી જરૂરી હોય છે. દરેક ડિપોઝિટની રકમ રૂ. ૧૦૦/- ના ગુણાંકમાં હોવી જોઈએ. એનો અર્થ એ છે કે તમે કોઈ રકમ જેમ કે રૂ. ૧૨૫૦/- કે રૂ. ૩૭૮૫/- જમા કરાવી શકો. જો કે તે રૂ. ૧૨૦૦/- કે રૂ. ૩૭૦૦/- એમ હોઈ શકે. લોન સુવિધા ત વર્ષ પછી ઉપલબ્ધ બને છે. જ્યારે એકાઉન્ટમાંથી નાણાનો ઉપાડ ત વર્ષ પછી કરવા દેવામાં આવે છે. ડિપોઝિટની રકમ આવકવેરા હેઠળ વળતર મળે છે અને વ્યાજની આવક સંપૂર્ણપણે આવકવેરાયુક્ત હોય છે.

૭. કિસાન વિકાસપત્ર યોજના:-

આ યોજનામાં નાણાંની નિયત રકમ અમુક સમયગાળામાં બમણી થાય છે. નીચેની દ્વારા કિસાન વિકાસપત્રોમાં નાણાં ડિપોઝિટ કરી શકાય.

કોઈ પુખ્ત ઉમરની વ્યક્તિ પોતાને માટે કે કોઈ સગીર માટે.

બે પુખ્ત વ્યક્તિઓ સંયુક્ત રીતે.

ટ્રસ્ટ આ (કિસાન વિકાસપત્ર) તમામ પોસ્ટ ઓફિસોએ રૂ. ૧૦૦/-, રૂ. ૫૦૦/-, રૂ. ૧૦૦૦/-, રૂ. ૫૦૦૦/- અને રૂ. ૧૦૦૦૦/- ના મૂલ્યવર્ગમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે રૂ. ૫૦૦૦૦/- મૂલ્યવર્ગનું કિસાન વિકાસપત્ર માત્ર જનરલ પોસ્ટ ઓફિસ (GPO)માં ઉપલબ્ધ હોય છે. રોકાણ પર કોઈ મહત્તમ મર્યાદા નથી. તે પાકે તે પહેલા નાણાં ઉપાડી શકાય છે. પરંતુ ઓછામાં ઓછો સમયગાળો જેને લોક ઈન પીરિયડ કહે છે, તેની અંદર નાણાં ઉપાડી શકાય નહિ.

૮. વરિષ્ઠ નાગરિક બચત યોજના:-

આ યોજનામાં ૫૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો દ્વારા એક સાથે રૂ. ૧૦૦૦ના ગુણાંકમાં વધુમાં વધુ ૧૫,૦૦,૦૦૦ રૂ. નું રોકાણ કરી શકે છે. જેની પાકવાની

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

મુદ્દત ૫ વર્ષ માટેની છે. જે એક જ વ્યક્તિ કે સંયુક્ત વ્યક્તિત્વો દ્વારા આ ખાતું સંભાળી શકે છે. આ લાભ ૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉમર ધરાવતી વ્યક્તિત્વોને મળે છે. પ્રથમ મુદ્દતમાં વ્યાજ ઉઠી માર્યું, ત૦ જૂન અને ઉઠી મિસેસ્બર મળે છે અને ત્યારબાદ આ વ્યાજ ઉઠી મિસેસ્બર, ત૦ મિસેસ્બર, ત૦ મિસેસ્બર અને ઉઠી મિસેસ્બરે મળે છે.



૮.૨ પાઠગત પ્રશ્નો

ખાલી જગ્યા પૂરો.

- પોસ્ટઓફિસ PPF એકાઉન્ટમાં એક વર્ષ દરમિયાન વધુમાં વધુ નાણાની રકમ ડિપોઝિટ કરાવી શકાય તે છે રૂ.
- એક મનીઓર્ડર ફોર્મમાં આપણે વધુમાં વધુ રૂ. ની રકમ મોકલી શકીએ.
- યોગ્ય વ્યક્તિને નાણાંની ચૂકવણીની ખાતરી કરવા માટે આપણે પોસ્ટલ ઓર્ડરને કરી શકીએ.
- PPF એકાઉન્ટ ધારકને લોન સુવિધા વર્ષો પૂર્ણ થતાં ઉપલબ્ધ બને છે.
- વધુ પૂર્ણ થયા બાદ NSC વટાવી શકાય છે.

૮.૩ વીમા સેવાઓ

ટપાલ અને નાણાં મોકલવાની કામગીરી ઉપરાંત પોસ્ટઓફિસો વ્યક્તિત્વો લાઈફ ઇન્સ્યોરન્સ સુવિધા પણ પૂરી પાડે છે. વીમો એટલે શું તે તમે જાણો છો? વીમો એ બે પાર્ટીઓ વચ્ચેનો એવો કરાર છે જે દ્વારા એક પાર્ટી બીજી પાર્ટીને હાનિ કે નુકસાન થવાના કોઈ પ્રસંગે નાણાંની નિયત રકમ ચૂકવવા સંમત થાય છે. પાર્ટી કે જે નાણાં ચૂકવવા સંમત થાય છે, તેને વીમાકર્તા (વીમો ઉતારનાર) કહે છે અને બીજી પાર્ટીને વીમાકૃત કહે છે. કરાર પ્રમાણે વીમો ઉત્તરાંયો હોય તે નિયત રકમ અર્થાત પ્રીમિયમ એકી સાથે અથવા હપ્તામાં નિયત સમયગાળા માટે વીમો ઉતારનારને ચૂકવે છે. જો તે સમયગાળા દરમિયાન આવી કોઈ ઘટના બને અને વીમેદારને કોઈ નુકસાન થાય તો વીમા કંપનીએ અથવા તેના કુટુંબના સભ્યોને સંમત થયેલ રકમ ચૂકવવાની હોય છે. પોસ્ટ ઓફિસ બે યોજનાઓ હેઠળ જીવનવીમો આપે છે. ૧. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (PLI) અને ૨. Rural Postal Life Insurance (RPLI). ચાલો, આપણે આ યોજનાઓ વિશે વિસ્તારથી શીખીએ.

૧. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (Postal Life Insurance PLI):-

પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (Postal Life Insurance PLI) યોજના પ્રારંભમાં ટપાલ ખાતાના કર્મચારીઓ માટે દાખલ કરવામાં આવેલી, વર્ષો જતાં તે કેન્દ્ર અને રાજ્ય સરકાર, પણ્ણિક સેક્ટર ઉપકર્મો, યુનિવર્સિટીઓ સરકારી અનુદાન સંસ્થાઓ રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાંકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વિસ્તારવામાં આવી. પોસ્ટ ઓફિસ આ સંસ્થાઓના કર્મચારીઓ જે ૫૦ વર્ષ ઉમરની નીચેના હોય તેમને માટે અમુક સમયગાળા

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રા



નોંધ



સુધી નિયત પ્રીમિયમ ભરીને જીવનવીમો ઉતારવાની છૂટ આપવામાં આવે છે. તે (પોસ્ટઓફિસ) વીમો લેનાર વ્યક્તિનું મૃત્યુ થતાં કે નિયત કાલાવધિ પૂરી થતાં અમુક નાણાની રકમ ચૂકવવાનો વાયદો કરે છે.

૨. સરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (RPLI):-

પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની માફક પોસ્ટઓફિસ ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો અને સમાજના નબળા વર્ગના લોકોને જીવનવીમા સુવિધા પણ પૂરી પાડે છે, જેને દુરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (RPLI) કહે છે. RPLI હેઠળ વીમાદાર વ્યક્તિ વીમા સુરક્ષા માટે અતિ અલ્પ પ્રીમિયમ ચૂકવે છે.

૮.૮ અન્ય ટપાલ સેવાઓ

અત્યાર સુધી તથે કેટલીક ટપાલ સેવાઓ જેમ કે ટપાલ, નાણાં મોકલવા, બોન્કિંગ અને વીમા સેવાઓ વિશે શીખી ગયા. આ સેવાઓ ઉપરાંત પોસ્ટઓફિસ વિવિધ અન્ય સેવાઓ પણ પૂરી પાડે છે જેમકે,

૧. સ્ટેમ્પનું વેચાણ:-

પોસ્ટલ સ્ટેમ્પના વધારામાં વિવિધ અન્ય પ્રકારની સ્ટેમ્પ જેમ કે રેવન્યુ સ્ટેમ્પ, શેર ટ્રોન્સફર સ્ટેમ્પ, રીકુટમેન્ટ સ્ટેમ્પ વગેરે પોસ્ટ ઓફિસોએ પણ વેચાય છે. પ્રાપ્તકર્તા પાસેથી પહોંચ મેળવતી વખતે જો નાણાકીય વ્યવહારની રકમ રૂપિયા પાંચસો (હવે પાંચ હજાર) કરતાં વધે ત્યારે રેવન્યુ સ્ટેમ્પ વપરાય છે. શેર ટ્રોન્સફર સ્ટેમ્પ બીજાઓનું નામે શેર કે અન્ય જામીનગીરીઓ હસ્તાંતરિત કરતી વખતે ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે રીકુટમેન્ટ (ભરતી) સ્ટેમ્પ ઉમેદવારોની ભરતી માટે ભારત સરકાર દ્વારા સંચાલિત વિવિધ પરિક્ષાઓની ફી ચૂકવવા માટે જરૂર હોય છે.

૨. ફોર્મનું વેચાણ:-

પોસ્ટ ઓફિસ વિવિધ ફોર્મ જેમ કે પાસપોર્ટ ફોર્મ, UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ફોર્મ, SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) ફોર્મ અને અન્ય રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મનું વેચાણ કરવામાં સુવિધા પૂરી પાડે છે.

૩. બિલ પેમેન્ટ:-

પોસ્ટઓફિસ, ટેલિઝેન, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ ઉપભોક્તાઓ પાસેથી એકત્ર કરે છે.

૪. પેન્શન ચુકવણી:-

પેન્શનરની સગવડ માટે ભારત સરકારે પોસ્ટઓફિસ દ્વારા પેન્શનની ચુકવણીની જરૂરી વ્યવસ્થા ગોઠવી છે. સરકાર રેલવે, કોલસાની ખાણ, ટેલિકોમ પેન્શનરો નજીકની પોસ્ટઓફિસમાંથી આ સુવિધા મેળવી શકે છે. પોસ્ટઓફિસ, સિનિયર સિટિઝન્સો વૃધ્ઘાવસ્થા પેન્શનની સુવિધા પણ પૂરી પાડે છે. સમાજ કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારો આ વૃધ્ઘાવસ્થા પેન્શન આપે છે.

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૫. પોસ્ટ દુકાન (Post Shoppes):-

પોસ્ટ દુકાન એ નાની છૂટક માલ દુકાનો છે જે સ્ટેશનરી આઈટમ, અભિવાદન કાર્ડ અને નાની બેટ આઈટમોનું વેચાણ ગ્રાહકોને કરે છે. આ દુકાનો કેટલીક પોસ્ટઓફિસોના પ્રીમાસીસમાં જોવા મળે છે.

૬. ફિલેટેલી : ટપાલની ટિકિટોનો સંગ્રહ :-

ખાસ અને સ્મારક પોસ્ટ ટિકિટો તેમજ વિશેષ કવર ટપાલ ખાતા દ્વારા આપવામાં આવે છે, જે દેશના સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતાં વિશાળ હારમાળાના થીમને આવરી લે છે. મહત્વની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, નામાંકિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સ્મારક ટપાલ ટિકિટ અને કવરના માધ્યમ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ સ્ટેમ્પ ટપાલ ટિકિટ સંગ્રહના વિશ્વમાં વિશાળ લોકપ્રિયતા માણે છે.

૭. ગ્રામીણ સંચાર સેવક યોજના:-

દરેક ઘરને ટેલિફોન સુવિધા પૂરી પાડવાના સ્વખ સાથે ગ્રામીણ સંચાર સેવક યોજના પ્રસ્થાપિત કરવામાં આવી. તે ટપાલ ખાતું અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નો સંયુક્ત પ્રયાસ છે. આ યોજના હેઠળ ટપાલી ટપાલ આપવા ધેર-ધેર જાય ત્યારે તે પોતાની સાથે મોબાઇલ પણ લઈ જાય. લોકો તે ઝોનનો ઉપયોગ ટપાલીને નિયત ચાર્જ ચુકવીને કરી શકે. આ સુવિધા આપણા દેશના માત્ર ગ્રામ વિસ્તારોમાં ઉપલબ્ધ છે.



૮.૩ પાઠગત પ્રશ્નો

નીચેના વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો.

- એક સરકારી કર્મચારી જેમની ઉંમર પર વર્ષ છે, તે પોસ્ટ ઓફિસમાં જીવન વીમો ઉત્તરાવી શકે.
- રૂ.૬૦૦ રકમના નાણાકીય વ્યવહારના પહોંચ પર કોઈ રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની જરૂર નથી.
- પોસ્ટ શોપીમાં તૈયાર વસ્ત્રો વેચવામાં આવે છે.
- પોસ્ટઓફિસ સમાજના નબળા વર્ગોના લાભ માટે સરલ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ સુવિધા આપે છે.
- ગ્રામીણ સંચાર સેવા યોજના માત્ર ગ્રામ વિસ્તારોમાં ઉપલબ્ધ હોય છે.

૮.૪ વિશિષ્ટ ટપાલની સેવા

લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસ દ્વારા જુદા જુદા પ્રકારની કેટલીક વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડે છે, જેવી કે ઝડપી સંદેશાઓ મોકલવા, નિયત વ્યક્તિને હાથોખાથ ટપાલ મળે તેવી સુવિધા, ટપાલ કે પાર્સલ ખોવાઈ જાય કે નુકશાન પામે તો મોકલનારને વળતર મળે તેવી



સુવિધા પૂરી પાડવામાં આવે છે. આપ વધારાનો ચાર્જ ચુકવી આ સુવિધા મેળવી શકીએ છીએ. ચાલો, આપણે આ સેવાઓ વિગતવાર સમજીએ.

૧. સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગ:-

સામાન્ય રીતે પત્રો ટપાલપેટીમાં નાખતા ટપાલખાતા દ્વારા ટપાલ મોકલી છે તેની પહોંચ આપવામાં આવતી નથી. જ્યારે પત્ર મેળવનાર પત્ર મોકલ્યો છે તેની ખાતરી પત્ર મોકલનાર પાસે મેળવા માંગતો હોય તો પત્ર મેળવનારે વધારાનો ચાર્જ ચુકવી ખરેખર પત્રો મોકલે છે તેનું પ્રમાણપત્ર ટપાલખાતા પાસેથી મેળવી શકે છે તેને સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગ કહે છે. આવું પ્રમાણપત્ર મેળવવા કોરા કાગળ ઉપર પત્ર મોકલનારના નામ, સરનામા લખી યોગ્ય કિમતની ટિકિટ ચોટાડી પરબિડીયાં સાથે આ કાગળ પોસ્ટઓફિસમાં રજૂ કરવા. પોસ્ટઓફિસ પરબિડીયા લઈ રજૂ કરલેલા કાગળ પર સિક્કો મારી આ કાગળ પરત આપે છે. આ કાગળ તપે પત્રો ટપાલ કર્યા છે તનો આધારભૂત દસ્તાવેજ ગણાય છે. આ સેવા મુણવવા માટે ખાસ ધ્યાન રાખો કે પરબિડીયા ઉપર “યુપીસી” લખવો જોઈએ. “યુપીસી” એટલે “અંડર પોસ્ટલ સર્ટિફિકેટ”

વિવાદાસ્પદ સમયે આ સર્ટિફિકેટ રજૂ કરી શકાય છે.

૨. રજિસ્ટરડ પોસ્ટ:-

કેટલીક વાર આપણે એવું ઈચ્છીએ કે મોકલી ટપાલ નિશ્ચિત વ્યક્તિને હાથો હાથ મળે નહિ તો તે ટપાલ પરત આવે. આવી પરિસ્થિતિમાં પોસ્ટઓફિસ દ્વારા રજિસ્ટરડ પોસ્ટની સુવિધા આપે છે. આપણે પત્રો કે પાર્સલ આ રીતે મોકલી શકીએ છીએ. રજિસ્ટ્રેશન ચાર્જ ચુકવ્યા પછી વધારાની ટિકિટ ટપાલ પર લગાવી હાથો હાથ આ ટપાલ પોસ્ટઓફિસમાં આપવામાં આવે છે. પોસ્ટઓફિસ આ ટપાલ લઈ ટપાલ મોકલનારને ટપાલ મળ્યાની રસીદ આપે છે. આ રસીદ ટપાલ મોકલી છે તેની ખાતરી પણ આપે છે. યાદ રાખો કે પરબિડીયા પર પૂરે પૂરું સરનામું લખાયું હોય તો જ પોસ્ટ ઓફિસ આ ટપાલ સ્વીકારે છે. સામાન્ય ટપાલ પર “રજિસ્ટરડ પોસ્ટ” એમ લખવામાં આવે છે. શું આપ એ ખાતરી કરવા માંગો છો કે તમારી ટપાલ જે સરનામે મોકી છે તે જ સરનામે પહોંચી છે. અહીંયા ટપાલ દ્વારા બીજી વધારાની સુવિધા આપવામાં આવે છે. પોસ્ટખાતાના દસ્તાવેજી કાગળ ઉપર રજિસ્ટરડ પોસ્ટ મેળવનારની સહી લઈ તેને આ ટપાલ હાથો હાથ આપવામાં આવે છે. પરંતુ પત્ર મોકલનારને ખબર હોતી નથી ક તે જ વ્યક્તિને પત્ર મળ્યો છે. પરંતુ જો પત્ર મેળવનાર ઈચ્છે તો “એકનોલેજમેન્ટ ડયૂ કાર્ડ” પરબિડીયા સાથે ભરીને રજિસ્ટરડ પોસ્ટ કરી શકાય છે. આ કાર્ડ ઉપર પત્ર મેળવનાર પોતાની સહિ કરી ટપાલીને કાર્ડ પરત આપે છે. ટપાલી આ કાર્ડ પત્ર મોકલનારને પોસ્ટ કરે છે. ચોક્કસ ચાર્જ ચુકવ્યા બાદ દરેક પોસ્ટઓફિસ ઉપર “એકનોલેજમેન્ટ ડયૂ કાર્ડ”ની સુવિધા મળે છે. પત્ર મોકલનાર આ કાર્ડ ઉપર એક બાજુ પોતાનું સરનામું અને બીજી બાજુ પત્ર મેળવનારનું સરનામું લખી પરબિડીયા ઉપર આ કાર્ડ બાંધવામાં આવે છે. પરબિડીયા ઉપર પત્ર મોકલનારે ખાસ લખવું જોઈએ “રજિસ્ટરડ પોસ્ટ એડી”.

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

મોડિયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૩. વીમાયુક્ત ટપાલ:-

પત્ર મોકલતી વખતે પત્ર ખોવાઈ જવાનો કે નુકશાન થવાનો ડર હોય છે. જે વસ્તુઓ ટપાલ દ્વારા મોકલવામાં આવી હોય અને તેની હેરફેર થતા આ વસ્તુઓની નુકશાન થાય તો તે નુકશાનનું વળતર વસ્તુ મોકલનારને મળી શકે. જો સામાન્ય પત્ર રજિસ્ટર્ડ પત્રો કે પાર્સલને નુકશાન થાય તો ટપાલખાતુ જવાબદાર નથી પરંતુ જો વીમાસુરક્ષિત સુવિધાનો લાભ લઈ પત્ર કે પાર્સલ મોકલનારને હેરફેર દ્વારા આ પત્રને કે પાર્સલને નુકશાન થાય તો ટપાલ ખાતા દ્વારા ચોક્કસ વળતર ચુકવી આપવામાં આવે છે. ચોક્કસ રકમ ભરી કિમતી ચીજ વસ્તુઓ કે દસ્તાવેજો વીમા સુરક્ષિત પોસ્ટ દ્વારા મોકલી શકાય છે. વસ્તુના કિમતને આધારે ટપાલખાતા દ્વારા વીમાનું પ્રિમિયમ નક્કી કરવામાં આવે છે. અહીંથી ટપાલ ખાતા દ્વારા કાયદા મુજબ નુકશાનીનું વળતર ચુકવવા જવાબદાર હોય છે. યાદ રાખો કે પોસ્ટ ઓફિસની જરૂરિયાત મુજબ આવા પાર્સલને યોગ્ય રીતે પેકિંગ અને બંધ કરવું અનિવાર્ય છે.

૪. સ્પીડ પોસ્ટ:-

પહેલી ઓગસ્ટ ૧૯૮૮ના રોજ સ્પીડ પોસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી. કેટલીકવાર આકસ્મિક સંજોગોને કારણે કે વહેલામાં વહેલી તકે પત્ર મેળવનારને પત્ર મળવો જરૂરી હોય છે. અહીં ટપાલ ખાતા દ્વારા ખાતરી આપવામાં આવે છે કે સ્પીડ પોસ્ટની સુવિધાના કારણે તમારો પત્ર નિયત સમયે ચોક્કસ વ્યક્તિને મળી જશે. આ સેવા મુજબ પત્રો દસ્તાવેજ અને પાર્સલ ખૂબ ઝડપથી એટલો કે ચોક્કસ સમયમાં રવાનગી કરવામાં આવે છે. સામાન્ય ટપાલ કરતા અંતરના આધારે સ્પીડ પોસ્ટ ઉપર ચુકવવો પડણો ચાર્જ વધુ હોય છે. આ સુવિધા સ્પીડ પોસ્ટના કેન્દ્ર ઉપર ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે. જો મોકલનાર મોટા જથ્થામાં નિયમિત સ્પીડ પોસ્ટ કરતા હોય તો તેમના સ્થળોથી પણ સ્પીડ પોસ્ટ લઈ જવાની સુવિધા ટપાલખાતા દ્વારા આપવામાં આવે છે.

૫. પોસ્ટ રેટેન્ટ:-

પત્ર મોકલનારને જ્યારે પત્ર મેળવનારનું સરનામું સચોટ રીતે ખબર ન હોય ત્યારે તે વિસ્તારના પોસ્ટ માસ્ટરને પત્ર મોકલવામાં આવે છે. આવા પત્રો પોસ્ટ રેસટેન્ટ પત્રો કહે છે. આવા પત્રો મોકલતી વખતે ખાસ ધ્યાન રાખો કે પત્ર ઉપર “પોસ્ટ રેસટેન્ટ” કુ “કેર ઓફ પોસ્ટ માસ્ટર” દર્શાવું જરૂરી છે. આ સૂચનાને આધારે પોસ્ટ માસ્ટર જેને પત્ર મોકલે છે. તેના દ્વારા આવી ટપાલો પોસ્ટમાસ્ટર પાસે વધુમાં વધુ ૧૪ દિવસ સુધી રાખવામાં આવે છે. ત્યારબાદ આવા પત્રો જે પોસ્ટ ઓફિસથી પત્રો મળ્યા છે ત્યાં પરત કરવામાં આવે છે. આવી સુવિધા ખાસ કરીને પ્રવાસીઓ અને મુસાફરી કરતા સેલ્સમેનો માટે ઉપકારક છે કે જેમનું ચોક્કસ સ્થળ કે સરનામું નક્કી હોતું નથી. અથવા તો જેઓ ચોક્કસ સરનામાવાળી સ્થળ શોધી રહ્યા છે તેવી વ્યક્તિઓ માટે પણ આ સુવિધા ઉપયોગી છે.



૮.૪ પાઠગત પ્રશ્નો

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.

૧. સ્પીડ પોસ્ટની સુવિધા બધીજ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હોય છે.

વાફિઝિય વ્યવસ્થા



૨. માત્ર રજિસ્ટર્ડ ટપાલ જ વીમા સુરક્ષિત ટપાલ બનાવી શકાય છે.
૩. પોસ્ટ રેસ્ટેન્ટ ટપાલ મેળવનારને પોસ્ટ ઓફિસમાં માત્ર એક અઠવાડિયા સુધી રાખવામાં આવે છે.
૪. બે પોસ્ટ ઓફિસના અંતરના આધારે વીમા સુરક્ષિત ટપાલનો ચાર્જ નક્કી થાય છે.
૫. સર્ટિફિકેટ ઓ પોર્ટીગ દ્વારા મોકલેલ ટપાલ ખોવાઈ જાય તો પત્ર મોકલનારને નુકશાનનું વળતર મળતું નથી.

૮.૧૦ સંદેશા વ્યવહાર

પોસ્ટ ઓફિસ પોતાના કાઉન્ટર પર અથવા પોસ્ટ ઓફિસ સામે મૂકેલ લેટર બોક્સમાંથી ટપાલ મેળવે છે. લોકો પોતાની ફૂરસદના આધારે લેટર બોક્સમાં ગમે ત્યારે પત્રો નાખી શકે છે. પોસ્ટ ઓફિસ કામકાજના કાર્યલયના સમય દરમ્યાન દિવસના એક કે બે વખત લેટર બોક્સમાંથી આ ટપાલ મેળવે છે. આવા લેટર બોક્સ પોસ્ટ ઓફિસની સામે અથવા તો ખાસ નક્કી કરેલા જાહેર સ્થળે મૂકેલા તમે જોઈ શકો છો. પરંતુ તમે કયારેય એય નોંધ્યું છે કે કેટલીક પોસ્ટ ઓફિસની આગળ આ લેટર બોક્સ લાલ, લીલા, ભૂરા અને પીળા કલરના હોય છે. શા માટે આવી બિનનતા રાખવામાં આવી છે? ખરેખર તેના હેતુ જુદા જુદા સ્થળોના અંતરના આધારે પત્રો ટપાલ કરી શકાય તે માટે આવા રંગો પસંદ કરવામાં આવ્યા છે. આ સુવિધા પત્રોનું ઝડપી વિભાગીકરણ અને ઝડપી રવાનગી કરવા ઉપયોગી થાય છે. ચાલો આપણે જોઈએ કે જુદી જુદી રંગની પેટીઓ ક્યા પ્રકારના પત્રો માટે ઉપયોગી થાય છે.

- લાલ રંગની પેટીમાં સ્થાનિક પત્રો નાખી ન શકાય.
- લીલા રંગીની પેટીમાં માત્ર સ્થાનિક પત્રો જ નાખી શકાય.
- ભૂરા રંગની પેટીમાં મેટ્રો શહેરને લખવામાં આવતા પત્રો જ નાખી શકાય.
- પીળા રંગની પેટીમાં માત્ર રાજ્યધાની – કેપિટલ શહેરમાં જતી ટપાલ નાંખવામાં આવે છે.

જ્યારે તમે લેટરબોક્સમાં પત્રો નાખો છો ત્યાર બાદ પોસ્ટ ઓફિસ દ્વારા આ પત્રોનું વિતરણ કેવી રીતે થાય છે તે તમે જાણો છો?

- પોસ્ટ ઓફિસ બધા જ પત્રો ઓક્ટ્રિત કેર છે. દરેક પત્રો ઉપર પૂરતી કિંમતની ટિકિટો લગાડી કે કેમ તેની ચકાસણી કરે છે.
- સ્થળના અંતરને આધારે પત્રો અલગ પાડવામાં આવે છે.
- જુદા જુદા અંતરને આધારે અલગ પાડેલ ટપાલોનું જુદા પેકેટમાં કે કોથળામાં મુકવામાં આવે છે.
- આ પેકેટ કે કોથળામાં જે તે પોસ્ટ ઓફિસે રવાના કરવામાં આવે છે.
- પેકેટ કે કોથળા મેળવનાર પોસ્ટ ઓફિસ આ પેકેટ કે કોથળા ખોલીને દરેક પત્ર ઉપર પોસ્ટ ઓફિસ પર સિક્કો મારે છે.
- સ્થળ અને સરનામાના આધારે આ પોસ્ટ ઓફિસ પત્રોનું વગી કરણ કરે છે.

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

- ટપાલી દ્વારા જે તે સ્થળે જાતે જઈને પત્રોને વહેંચણી કરે છે.

તમે વિચારતા હશો કે આ પોસ્ટ બેગ કે કોથળાઓ કે પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસે કેવી રીતે પહોંચતા હશો?

ટૂકા અંતર માટે ટપાલના કોથળાઓ લઈ જવામાં આવે છે.

- સામાન્ય રીતે રસ્તા માર્ગ મોટર, રીક્ષા અને સાઈકલનો ઉપયોગ ટપાલ લાવવા લઈ જવા થાય છે. પરંતુ લાબાં અંતરને ટપાલની હેરફર માટે રેલ્વે માર્ગનો બૃહદ ઉપયોગ થાય છે. જેને રેલ્વે મેલ સર્વિસ (RMS) કહે છે. સમગ્ર ભારતમાં મોટા રેલ્વે સ્ટેશનો ઉપર આરામદાસની સુવિધા તમે જોઈ હશો.
- રેલ્વે, મોટર કે સાઈકલ દ્વારા મોકલવામાં આવતી ટપાલને સમાંતર ટપાલ કહે છે.
- રોડ અને રેલ્વે દ્વારા ટપાલ મોકલવા ઉપરાંત ભારતીય ટપાલ ખાતા દ્વારા જરૂર પડે હવાઈ—વિમાન માર્ગનો પણ ઉપયોગ કરે છે.
- બધી જ વિદેશી ટપાલો હવાઈ માર્ગ મોકલવામાં આવે છે. જેથી જે ટપાલ હવાઈ માર્ગ મોકલવામાં આવે છે. તેને “ઓર મેઇલ” કહે છે.

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૮.૧૧ ટપાલની હેરફર માટે પોસ્ટેજની સુવિધા

તમે વિચારતા હશો કે પોસ્ટ કાર્ડ કે અંતરદેશીય પત્ર સમગ્ર દેશમાં જુદા જુદા અંતરે કેવી રીતે પહોંચાડવામાં આવતા હશો? આપણા દેશમાં સ્પીડ પોસ્ટ સિવાય દરેક પ્રકારની ટપાલ માટે દરેક સ્થળે એક સરખા ભાવ રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે પત્રોના વજનના આધારે પોસ્ટેજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ પત્રો વિદેશમાં મોકલવામાં આવે છે ત્યારે વજન અને અંતરના આધારે પોસ્ટેજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં ટપાલ ખર્ચ ચૂકવવા માટે જુદી જુદી કિમતની ટિકિટોનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટિકિટો પોસ્ટ ઓફિસમાંથી ખરીદેલ હોવી જોઈએ એને પરબિડીયા પર યોગ્ય સ્થળે ચોંટાડી હોવી જોઈએ. ટપાલ મોકલવા માટે આ જ માત્ર એક ટપાલ ખર્ચ ચૂકવવાની સુવિધા નથી પરંતુ જુદા જુદા પ્રકારની ટપાલો જ્યારે મોકલવામાં આવે છે ત્યારે ટપાલ ખર્ચ ચૂકવવા નીચે મુજબની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

૧. ટપાલ ટિકિટો:-

પરબિડીયાને પાર્સલ મોકલવા માટે પોસ્ટ ઓફિસમાંથી યોગ્ય કિમતની ટિકિટો ખરીદી તેની ઉપર લગાવવામાં આવે છે. પરંતુ જે પોસ્ટ કાર્ડ, અંતરદેશીય પત્રો અને પરબિડીયાં પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદ્યા છે તેની પર ટિકિટ લગાવાની હોતી નથી. કારણ કે તે જરૂરી કિમતની સાથેના જ હોય છે. ઓછામાં ઓછું વજન ધરાવતા પત્રો માટે જ આ પ્રકારના પરબિડીયા ખરીદી શકાય છે. પરંતુ તમારા પરબિડીયાનું સામાન્ય વજન કરતા વજન વધી જાય છે તો તેની ઉપર વધારાની ટિકિટ લવાગી અનિવાર્ય બને છે.



૨. ફેર્કિંગ મશીન:-

વિશાળ ઓફિસોમાં જ્યાં દરરોજના સેંકડો પત્રો મોકલવાના હોય ત્યાં ટપાલ ખાતા દ્વારા આ પત્રો ઉપર ફેર્કિંગ મશીનથી ટિકિટો લગાડવાની સુવિધા આપવામાં આવે છે. પરબિડીયા ઉપર ટિકિટ લગાડવાના યંત્રને ફેર્કિંગ મશીન કહે છે. આ મશીન પરબિડીયા ઉપર નિશ્ચિત કિંમતના ટિકિટો છાપે છે. આવી ટપાલને રેક ટપાલ કહે છે. મશીનમાં પત્રો મુકી જુદી જુદી કિંમત માટે બટન દબાવી પરબિડીયા ઉપર ટિકિટની છાપ ઉપસાવી શકાય છે. ફેર્કિંગ મશીન દ્વારા લાલ રંગની તકતિમાં ટિકિટ છાપે છે. આવું યંત્ર પોસ્ટ ઓફિસમાંથી ભાડેથી લાઈસન્સ દ્વારા મેળવી શકાય છે. પોસ્ટ ઓફિસ દ્વારા મેળવેલ લાઈસન્સ વારે આ મશીનમાં જુદી જુદી કિંમતની ટિકિટો અંકિત કરી શકે છે. પોસ્ટ ઓફિસને ચૂકવેલ કિંમતને ફેર્કિંગ મશીનમાં ટિકિટો છાપાયા બાદ આપોઆપ આ મશીન બંધ થઈ જાય છે. મશીન પુનઃકાર્યરત કરવા ટપાલખાતાની જરૂરી કિંમત ચૂકવી ચાલુ કરી શકાય છે.

૩. ટિકિટ ચોંટાડયા સિવાય ટપાલ વ્યવસ્થા:-

તમે જોયુ હશે કે કેટલીક ટપાલ ઉપર ટિકિટ લગાડવામાં આવતી નથી. તો આ ટપાલ તમારા સ્થળે કેવી રીતે આવી? ખરેખર આવી ટપાલ મોકલવા માટે અગાઉથી જ ટપાલ ખાતાને એક સાથે ટપાલ ખર્ચ ચૂકવી દેવામાં આવે છે. દા. ત. વર્તમાન પત્રો કે સામાયિકો મોકલતા પહેલા અગાઉથી જ ટપાલ ખર્ચ એક સાથે જ પોસ્ટ ઓફિસમાં ભરવામાં આવે છે. વ્યાપારી જવાબ મેળવતા પત્રો પણ આ રીતે અગાઉથી ટપાલ ખર્ચ ચૂકવીને વગર ટિકિટે ટપાલ મોકલી શકાય છે. ટપાલ ખાતા દ્વારા બ્રેલાબિપીમાં લખેલું સાહિત્ય વિના મૂલ્ય હેરફેર કરે છે.

૪. કોમ્પ્યુટરરાઇઝ રસીદ:-

કેટલીક પોસ્ટ ઓફિસમાં વર્તમાન સમયમાં કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ સિલિપ ચોંટાડીને પત્ર મોકલી શકાય છે. જેની ઉપર ટિકિટ લગાડવી જરૂરી હોતી નથી. આ રસીદ ઉપર ચૂકવેલ કિંમત તારીખ અને સમય અંકિત થયેલ હોય છે. આવી સુવિધા રજિસ્ટર્ડ પત્રો અને સ્પીડ પોસ્ટ માટે વપરાય છે. સામાન્ય પત્રો માટે નહિ.



૪.૫ પાઠગત પ્રશ્નો

નીચેના એ અને બી જોડકટને યોગ્ય રીતે જોડો.

કોલમ ઓ

- ૧. લીલા રંગની પેટી
- ૨. ફેર્કિંગ મશીન
- ૩. અપૂર્તી કિંમતની ટપાલ ટિકિટ ચોંટાડવી.
- અ. પત્ર મોકલનારને પત્ર પરત કરવો.
- બ. પત્ર મોકલનાર દ્વારા ટપાલ ખર્ચ ન ચૂકવો.
- ક. પત્ર મેળવના દ્વારા ખૂટતી કિંમતની ટિકિટનો બે ગણો ચાર્જ ભરી પત્રો મેળવવા પડે છે.

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

૪. બીજાનેસ રિપ્લાય કાર્ડ
૫. પત્ર મેળવનારના ખોટા સરનામા
૬. લોકલ પત્રો.
૭. ટપાલ ખર્ચ છાપવો.

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૮.૧૨ પોસ્ટ ઓફિસ વ્યવસાય વ્યવહારને કેવી રીતે સુવિધા આપે છે?

અગાઉ ચર્ચા કર્યા મુજબ વિવિધ સાધનો દ્વારા ટપાલ પહોંચાડવા ઉપરાંત પોસ્ટઓફિસ વ્યવસાય ફર્મને કેટલીક ખાસ સેવાઓ પૂરી પાડે છે. જેમ કે,

- વેલ્યુ પેયેબલ પોસ્ટ દ્વારા ચીજોના વેચાણને સરળ બનાવવું.
- વ્યવસાય જવાબી ટપાલ દ્વારા કોઈ અગાઉથી ચુકવણી વગર ગ્રાહકો પાસેથી પત્રો લઈ જવા.
- મીડિયા પોસ્ટ દ્વારા ઉત્પાદનની જાહેરાતને સુવિધા આપવી.
- એક્સપ્રેસ પોસ્ટ મારફતે વિ વસનિયત અને સમયબધ્ય સેવા પૂરી પાડવી.
- બીજાનેસ (વ્યવસાય) પોસ્ટ દ્વારા મોટા જથ્થામાં ટપાલ મોકલનારને વિવિધ પ્રી-મેલ સેવા આપવી.
- કોર્પોરેટ મનીઓર્ડર દ્વારા નાણાંની મોટી રકમનું હસ્તાંતરિત કરવા દેવું.
- પોસ્ટ બેગ અને પોસ્ટ બોક્સ સુવિધા દ્વારા ટપાલ એકમ કરવાની ખાસ વ્યવસ્થા કરવી.

ચાલો, આપણે આ સુવિધાઓ વિશે વિશેષ જાણીએ.

૧. વેલ્યુ પેયેબલ પોસ્ટ (Value Payable Post - VPP):-

કેટલીક વાર આપણે અમુક ચીજો ખરીદવા માંગીએ, જે કોઈ સ્થાનિક દુકાનમાં ઉપલબ્ધ ન હોય. આવા કિસ્સામાં આપણે દૂરના વિકેતાને વસ્તુઓ આપણને મોકલવા હંમેશા વિનંતી કરી શકીએ. અહીં પોસ્ટઓફિસ વિકેતાને એક સારો વિકલ્પ વેલ્યુ પેયેબલ પોસ્ટ (VPP) સેવાનો ઉપયોગ કરવાનો આપે છે. આ સેવા હેઠળ પોસ્ટ ઓફિસ વિકેતા પાસેથી કુલ રકમ (વસ્તુઓની કિંમત અને VPP ચાર્જ) માણ્ય પછી તે વસ્તુઓની ડીલિવરી આપે છે. પછી પોસ્ટઓફિસ વિકેતાને નાણાં મોકલે છે.

૨. બીજાનેસ જવાબી પોસ્ટ:-

આપણે જાણીએ છીએ કે ગ્રાહકો ઉભા કરવા તે દરેક વ્યવસાયનો મહત્વનો આર્થિક હેતુ છે. આ હેતુ સિધ્ય કરવા માટે વ્યવસાયદાર હંમેશા ગ્રાહકો પાસેથી તરિત જવાબ અને પ્રતિક્રિયા શોધે છે. આ બાબતમાં પોસ્ટઓફિસ ગ્રાહકોને તેમના જવાબ બીજાનેસ જવાબ પોસ્ટ દ્વારા મોકલવાની છૂટ આપે છે, જેને માટે મોકલનાર પાસેથી કોઈ પોસ્ટેજ વસુલ કરે છે. આ સુવિધાઓ લાભ લેવા માટે વ્યવસાયદાર પોસ્ટઓફિસમાંથી નિયત ફી ભરીને લાયસન્સ મેળવી શકે છે. તે લાયસન્સ નંબર કાર્ડ કે કવર પર સ્પષ્ટ રીતે છપાયેલા હોવા જોઈએ અને તેની સાથે શબ્દસમૂહ જેમ કે "બીજાનેશ જવાબી કાર્ડ / કવર, પ્રાપ્તકર્તા (જેને પત્ર લખ્યો હોય તે વ્યક્તિ) દ્વારા પોસ્ટેજ ચુકવાતું નથી." જો ભારતમાં પોસ્ટ કરેલ હોય તો કોઈ પોસ્ટેજ સ્ટેમ્પ જરૂરી નથી. પ્રાપ્તકર્તાનું સરનામું કાર્ડ કે કવર પર છપાયેલ હોવું જોઈએ.



૩. મીડિયા પોસ્ટ:-

આ સેવા હેઠળ ટપાલ ખાતું કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓ ગ્રાહકોને પોસ્ટકાર્ડ, અંતરરદેશીય પત્રકાર્ડ, એરોગ્રામ અને અન્ય ટપાલ સ્ટેશનરી પર જાહેરાત દ્વારા પહોંચી શકે તેવી છૂટ આપે છે. જનતા જાગૃતિ સંદેશાઓ સરકાર દ્વારા ટપાલ સ્ટેશનરી પર છાપી શકાય.

૪. એક્સપ્રેસ પોસ્ટ :-

પોસ્ટઓફિસ કોર્પોરેટ અને વ્યવસાય ગ્રાહકોને તેની એક્સપ્રેસ પોસ્ટ દ્વારા વિશ્વસનીય ઝડપી અને સસ્તી પાર્સલ સેવા આપે છે. તે ઘેર ઘેર ઉપ કિ.ગ્રા. વજન સુધીનાં પાર્સલોની સમયબધ્ય ડિલિવરી પૂરી પાડે છે.

૫. બીજનેસ (વ્યવસાય) પોસ્ટ:-

પોસ્ટઓફિસ બિજનેસ ગ્રાહકોને વ્યવસાય પોસ્ટ દ્વારા પ્રીમેલ પ્રવૃત્તિઓ હાથ ધરીને બીજી તક પૂરી પાડે છે. પ્રી-મેલિંગ પ્રવૃત્તિઓમાં મોકલનારના ઘરેથી એકત્રીકરણ, પેકેટમાં ચીજો મૂકૃતી, પાર્સલ ચોટાડવું, સરનામું કરવું વગેરે તેમજ ટપાલને ફેન્કિંગ કરવું વગેરેનો સમાવેશ થાય છે.

૬. કોર્પોરેટ મનીઓર્ડર:-

વ્યક્તિગતોની માફક બિજનેસ સંસ્થાઓ પણ મનીઓર્ડર દ્વારા નાણાં મોકલી શકે. તેમને માટે પોસ્ટઓફિસ કોર્પોરેટ મનીઓર્ડર સેવા આપે છે. તેનાથી બીજનેસ સંસ્થાને દેશના કોઈ પણ ભાગમાં રૂપિયા એક કરોડ સુધી હસ્તાંતરિત કરવા સક્ષમ બનાવે છે. આ સુવિધા સેટેલાઈટ સાથે સંકળાયેલ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ હોય છે.

૭. પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ:-

તમે જાણો છો કે ટપાલી પ્રાપ્તકર્તા (જેને ટપાલ લખી હોય)ના ઘરે વિવિધ પ્રકારની ટપાલ પહોંચાડે છે. વધારામાં પોસ્ટઓફિસ અનરજિસ્ટર્ડ ટપાલ પ્રાપ્તકર્તા ઓને પોસ્ટઓફિસ અને પોસ્ટબેગ સુવિધાઓ પણ પૂરી પાડે છે. આ સુવિધા હેઠળ પોસ્ટઓફિસે પ્રાપ્તકર્તાને નિયત ભાડું ભરીને અમૃક નંબર અને બોક્સ કે બેગમાં રાખે છે. પોસ્ટઓફિસ તે નંબરને લખેલ (સંબોધેલ) તમામ ટપાલ તે બોક્સ કે બેગમાં રાખે છે. પછી પ્રાપ્તકર્તા (જેને ટપાલ લખી હોય તે) પોતાની સગવડ મુજબ ટપાલ એકત્ર કરવા જરૂરી વ્યવસ્થા કરે છે. પોસ્ટબોક્સના કિસ્સામાં પ્રાપ્તકર્તા પોસ્ટઓફિસમાંથી તેની એલોટ થયેલ બોક્સમાંથી ટપાલ એકત્ર કરે છે. પરંતુ પોસ્ટ બેગના કિસ્સામાં પ્રાપ્તકર્તા બેગને તેની ઓફિસે લઈ જઈ બેગ ખોલી શકે. કોઈ ફર્મ કે વ્યક્તિ આવી બોક્સ પોસ્ટઓફિસમાંથી ભાડે લઈ શકે. આ સુવિધા ઘણું કરીને નીચેના માટે યોગ્ય હોય છે.

- વ્યવસાય ફર્મ જેમને પોતાની ટપાલ તત્કાલ જોઈએ છે.
- જાણ્યાબંધ ટપાલ પ્રાપ્તકર્તા.
- મેલ ઓર્ડર વ્યવસાય.
- જેમને પોતાનું નક્કી સરનામું ન હોય.
- જેઓ પોતાના નામ સરનામાં જાહેર કરવા માંગતા ન હોય.



૮.૬ પાઠગત પ્રશ્નો

ખાલી જગ્યા પૂરો

૧. પોસ્ટ ઓફિસ વ્યવસાય સાહસોને પોસ્ટ દ્વારા પ્રીમેલ સેવા આપે છે.
૨. ઉત્પાદન અને સેવાઓની જાહેરાત પોસ્ટ ઓફિસ દ્વારા ટપાલની સુવિધાનો ઉપયોગ કરીને થઈ શકે.
૩. બીજાનેસ પોસ્ટમાં મોકલનાર દ્વારા કોઈ પોસ્ટેજ લગાવવાની જરૂર નથી.
૪. કોર્પોરેટ મની ઓર્ડર, નાણાં રૂ..... સુધી મોકલાવી શકાય.
૫. દ્વારા ટપાલો મોકલનાર કે લોકોને પ્રાપ્તકર્તાની ઓળખ જાહેર કર્યા સિવાય મેળવી શકાય.

૮.૧૩ ટપાલ સેવાઓનું મહત્વ

ટપાલ સેવાઓ સામાન્યતઃ આમ જનતા માટે અને વિશેષતઃ વ્યવસાય માટે મહત્વની છે. નીચેના મુદ્દાઓ ટપાલ સેવાઓનું મહત્વ પ્રકાશિત કરે છે:

૧. સંદેશા વ્યવહારનાં સસ્તાં સાધનો:-

પોસ્ટ ટપાલ સેવાઓ સંદેશાવ્યવહારનાં અન્ય સાધનોનાં સાપેક્ષો અતિ નીચા દરે ઉપલબ્ધ હોય છે. ન્યુગ્ઝેપેર્સ અને જર્નલનો ફેલાવો મોટો છે અને દૂર દૂરનાં ગામડાંઓના લોકોને પણ પહોંચે છે. તે ટપાલ સેવાઓને કારણો આ શક્ય એટલા માટે બને છે કે ન્યુગ્ઝેપેર્સ અને મેગેઝિન રાહતના દરે મોકલી શકાય છે.

૨. બચતને પ્રોત્સાહન આપે છે:-

સામાન્ય સાધનવાળા લોકો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવાતી વિવિધ નાની બચત યોજનાઓ દ્વારા નાની બચત કરવા પ્રેરાય છે. તદુપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા બચતો ને ટેક્સ વળતરની છૂટ છે. દા.ત. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પાલિક પ્રોવિડન્ડ ફંડ. વળી પોસ્ટઓફિસમાં બચત કરતા લોકો માટે ઈનામો આપવાની પણ જોગવાઈ છે.

૩. નીચા દરે નાણાં સલામત મોકલવા:-

નાણાં મોકલવાનું સૌથી સસ્તું અને અતિ પ્રચલિત સાધન પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડરથી નાણાં મોકલવાવાં તે છે. જો નાણાં તાકીદે મોકલવાના હોય, તો તે ટેલિગ્રાફિક મનીઓર્ડર દ્વારા થઈ શકે. પોસ્ટલ ઓર્ડર અંને નાણાં હસ્તાંતરણનો અન્ય તરીકો છે.

૪. વેપારને ઉન્નતિ:-

ટપાલ સેવાઓની ઉપલબ્ધતા એ આંતરિક તેમજ બાહ્ય વેપાર બન્નેના વિકાસ અને વિસ્તારને સુવિધા પૂરી પાડે છે. પત્રવ્યવહાર દ્વારા વેપાર પૃથ્વાઓ કરવામાં આવે છે અને વ્યવસાય કામગીરીને પૂર્ણ કરવામાં આવે છે. ઓર્ડર મુકવા, મેલ મોકલવાની જાણ,



નોંધ



ચુક્કવણી માટે સ્મૃતિપત્રો વગેરે ઘણું કરીને ટપાલ દ્વારા મોકલાય છે. ચેક, ડ્રાઇટ અને કિમતી દસ્તાવેજો પણ ટપાલ દ્વારા મોકલાય છે. મૂલ્યવાન દસ્તાવેજો ધરાવતી રજિસ્ટર્ડ ટપાલ નિયત રકમ માટે વીમાકૃત થઈ શકે, જેથી ટપાલ સંક્મણ દરમિયાન નુકસાનના ઝોખમ ને કવર કરી શકાય. મેલ ઓર્ડર બીજનેસ સમગ્ર રીતે ટપાલ મેલ અને પાર્સલ ડિલિવરી સેવા પર આધાર રાખે છે.

૫. દૂર અધ્યયન ને સરળ બનાવે છે ઓપન સ્કુલઃ-

ઓપન યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ જે દૂર શિક્ષણ અને પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપે છે, તે અધ્યોત્તાઓને ટપાલ દ્વારા અધ્યયન સામગ્રી મોકલીને શિક્ષણ આપે છે. વળી તેઓ અધ્યોત્તાઓ સાથે તમામ પત્ર વ્યવહાર પોસ્ટઓફિસ દ્વારા કરે છે. આમ, દૂર દૂરના વિદ્યાર્થીઓ નિયમિત વર્ગોમાં હાજરી આપવાની આવશ્યકતા વગર તેમના પાઠો શીખવાના લાભ મેળવે છે.

૮.૧૪ ખાનગી કુરીયર સેવાઓ

કેટલાક ખાનગી સંચાલકો છે જેઓ જનતાને ટપાલ સેવા પૂરી પાડે છે. તેઓ ખાનગી કુરીયર તરીકે જાણીતા છે. તેઓ પત્રો અને પાર્સલો એકત્ર કરે છે અને પ્રાપ્તકર્તાના સ્થળે પહોંચાડે છે. ખાનગી કુરીયર પત્રો, પાર્સલ, પેકેટ વગેરે એકત્ર કરવામાં અને વિતરણ કરવામાં ઝડપી સેવા પૂરી પાડે છે. પત્રો અને પાર્સલો કુરીયર દ્વારા મોકલીએ તો કોઈ પોસ્ટેજ પત્રો અને પાર્સલ પર લગાવવાની જરૂર નથી. ખાનગી કુરીયર સેવા માટે ચૂકવવા પાત્ર ચાર્જ એક સમાન હોતા નથી. ખાનગી કુરીયર મોટાં શહેરો અને નગરોમાં લોકપ્રિય હોય છે. ઓવર નાઈટ એક્સપ્રેસ (OVERNITE EXPRESS), DHL, બ્લ્યુડાર્ટ એક્સપ્રેસ (BLUEDART EXPRESS) આપણા દેશના કેટલાક ખાનગી કુરીયરો છે.



ખાનગી કુરીયર સેવાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે.

૧. તે સંદેશાવ્યવહારનું ઝડપી સાધન પૂરું પાડે છે.
૨. તે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માટે સુવિધાઓ પૂરી પાડે છે.
૩. તે તમામ પ્રકારની વસ્તુઓ (સોનું અને જવેલરી સિવાય) પહોંચાડે છે.
૪. વસ્તુઓ પહોંચાડવા રેલવે, રોડ વે અને હવાઈમાર્ગનો ઉપયોગ ઉપરાંત કેટલીક એજન્સીઓ સંદેશાના સંક્મણ માટે ટેલિફોન, ટેલેક્સ અને ફેક્સ સેવાઓના ઉપયોગ કરે છે.
૫. તે વસ્તુઓના સલામત અને સમયસર વિતરણ માટે પૂર્ણ જવાબદારી ઉદ્ધારે છે.
૬. તે મોકલનારના ઠેકાણોથી વસ્તુઓ એકત્ર કરે છે અને પ્રાપ્તકર્તા ઓને પહોંચાડે છે.



૮.૭ પાઠગત પ્રશ્નો

પાઠગત પ્ર નો

૧. નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે કે ક્યા ખોટા છે?
 ૧. PIN ટપાલના ઝડપી અને સહેલા સોર્ટિંગને સરળ બનાવે છે.
 ૨. ટપાલખાતું ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે.
 ૩. ટપાલ કચેરી (પોસ્ટ ઓફિસ) દૂર અધ્યયન કાર્યક્રમમાં સહાય કરતી નથી.
 ૪. ચેક અને ડિમતી દસ્તાવેજો લોકોને પોસ્ટ દ્વારા મોકલી શકાય.
 ૫. ખાનગી કુરીયર પાર્સલ લઈ જતા નથી.
૨. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
 ૧. નીચેની કઈ સેવા ટપાલ વ્યવહારની સેવા નથી.
 - અ. મેઇલ સર્વિસ
 - બ. બેન્કિં સર્વિસ
 - ક. લોકરની સુવિધા
 ૨. નીચેનામાંથી કઈ વીમાની પોલિસી ટપાલ દ્વારા આપવામાં આવે છે.
 - અ.
 - બ. આજીવન વીમા પોલિસી
 - ક. ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્શી
 - ડ. સંયુક્ત જીવન પોલિસી
 ૩. નીચેનામાંથી કઈ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે.
 - અ. પેન્શનના નાણાં ચૂકવવાની
 - બ. બિલ ચૂકવવાની
 - ક. મની ઓર્ડરની સેવા
 - ડ. ટપાલ સેવાની માસિક બયત યોજના
 ૪. નીચેની કઈ ખાસ સેવા ટપાલ ખાતા દ્વારા આપવામાં આવતી નથી.
 - અ. રજિસ્ટર્ડ પોસ્ટની સેવા
 - બ. ટિકિટોનું વેચાણ
 - ક. સ્પીડ પોસ્ટ
 - ડ. વીમા સુરક્ષિત ટપાલ
 ૫. નીચેનામાંથી કઈ સેવા ખાનગી કુરીયરની સેવા છે?
 - અ. પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ
 - બ. ધંધાકીય ટપાલ
 - ક. ઓવરનાઈટ એક્સપ્રેશનની સેવા
 - ડ. વેલ્યુ પે એબલ પોસ્ટની સેવા

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



નોંધ



તમે શું શીખ્યા?

- પોસ્ટઓફિસ દ્વારા અપાતી વિવિધ સેવાઓ ટપાલ સેવાઓ postal services કહેવાય છે. આ સેવાઓમાં પત્રો અને પાર્સલો લઈ જવા નાણાં મોકલવાની વ્યવસ્થા ગોઠવવી, ડિપોઝિટ સ્વીકારવી, લોકોનો જીવનવીમો ઉતારવો વગેરે.
- મોકલનાર પાસેથી પત્રો અને પાર્સલોનું એકત્રીકરણ કરો પ્રાપ્તકર્તાને પહોંચાડવા તેને ટપાલસેવા કરે છે. પોસ્ટ ઓફિસ પોસ્ટકાર્ડ, કવર, અંતરદેશીય પત્ર કાર્ડ, પાર્સલ પોસ્ટ બુક પોસ્ટ વગેરે દ્વારા ટપાલ સેવા આપે છે વળી તે વિશિષ્ટ ટપાલ સેવાઓ પણ Certificate of posting (ટપાલ પ્રમાણપત્ર) રજિસ્ટર્ડ પોસ્ટ, વીમાકૃત પોસ્ટ, સ્પીડપોસ્ટ, ન્યાસ્ત પોસ્ટ (Post restante) દ્વારા પૂરી પાડે છે.
- પોસ્ટઓફિસની નાણાં મોકલવાની સેવા દ્વારા નાણાં એક સ્થળોથી બીજે સ્થળે હસ્તાંતરિત કરી શકાય છે. તે મનીઓર્ડર કે પોસ્ટલ ઓર્ડર સુવિધાઓ પૂરી પાડે છે. જેના દ્વારા લોકો દૂરનાં સ્થળોએ નાણાં મોકલી શકે છે.
- પોસ્ટઓફિસ વિવિધ બયત યોજનાઓ જેવી કે પોસ્ટઓફિસ સેર્વિંગ બેક એકાઉન્ટ, ૫ વર્ષીય પોસ્ટઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ, પોસ્ટઓફિસ, માસિક આવક યોજના (Monthly Income Scheme) છ વર્ષીય નેશનલ સેર્વિંગ સર્ટિફિકેટ (VIII ઈશ્યુ) યોજના, ૧૫ વર્ષીય પણ્ડિક પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર યોજના વગેરે આપીને લોકોમાં બયત ટેવને પ્રોત્સાહન આપે છે.
- વક્તિગત જીવન પોસ્ટ ઓફિસ દ્વારા Postal Life Insurance (PLI) તેમજ Rural Postal Life Insurance યોજનાઓ દ્વારા વીમો ઉત્તરાવી શકાય.
- પોસ્ટ ઓફિસ વ્યવસાયી વ્યવહારો VPP બીજનેસ જવાબી પોસ્ટ, મીડિયા પોસ્ટ એક્સપ્રેસ પોસ્ટ, બજનેસ પોસ્ટ, કોર્પોરેટ મનીઓર્ડર, પોસ્ટ બેગ કે પોસ્ટ બોક્સ આપીને સુવિધા પૂરી પાડે છે.
- ટપાલ સેવાનું મહત્વઃ— તે સંદેશાવ્યવહારનું સસ્તું સાધન પુરું પાડે છે. બયતને પ્રોત્સાહન આપે છે, નીચા દરે નાણાં મોકલવામાં સહાય કરે છે. વેપારને ઉન્નત કરે છે અને દૂર અધ્યયન ને સરળ બનાવે છે.
- ખાનગી કુરીયર તેમના પોતાના નેટવર્કની સહાય દ્વારા આપણા દેશમાં ટપાલ સેવાઓ પણ પૂરી પાડે છે. તેઓ પત્રો, પાર્સલોના એકત્રીકરણ અને ડિલિવરીમાં જરૂરી સેવા પૂરી પાડે છે.



સત્રાંત સ્વાધ્યાય

1. ભારતીય ટપાલનો લોગો(મુદ્રક) તમારી નોટબૂકમાં બનાવો.
2. અંતરદેશીય ટપાલ અને આંતરરાષ્ટ્રીય ટપાલ વચ્ચેનો તફાવત આપો.
3. ગ્રામીણ સંચાર સેવક યોજના એટલે શું ?

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

૪. ૧૫ વર્ષીય પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટની વિશેષતાઓ જણાવો.
૫. ટપાલ સેવાઓમાં PIN ક્યો હેતુ સારે છે ?
૬. ભૂ-તલા ટપાલ અને હવાઈ ટપાલ વચ્ચેનો તફાવત આપો.
૭. પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ લેટરબોક્સના જુદા જુદા રંગો કયા? તેઓ ક્યો હેતુ સારે છે ?
૮. પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ લેટરબોક્સના જુદા જુદા પ્રકારના પોસ્ટકાર્ડ જણાવો.
૯. મનીઓર અને પોસ્ટલાઓર વચ્ચેનો તફાવત લખો.
૧૦. પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ એવી જીવનવીમાની વિવિધ યોજનાઓ સમજાવો.
૧૧. ખાનગી કુરીયર સેવાની વિશેષતાઓ જણાવો.
૧૨. પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી પોસ્ટ બેગ સુવિધાની યોગ્યતાનું વર્ણન કરો.
૧૩. પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી નાણાં મોકલવાની સેવાઓનું વર્ણન કરો.
૧૪. પોસ્ટલ સેવા એટલે શું? પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી કોઈ બે સેવાઓ સમજાવો.
૧૫. પોસ્ટઓફિસ દ્વારા સંચાલિત થતી કોઈ પણ ચાર બયત યોજનાઓ સમજાવો.
૧૬. ટપાલ સેવા વ્યવસાય વ્યવહારોને કઈ રીતે સરળ બનાવે છે ?

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



પાઠ્ય આધારિત પ્રશ્નોના જવાબ

- ૮.૧ (૧) વિદેશો (૨) રંગ અને કિંમત (૩) વજન (૪) ઓછું
(૫) ગુપ્ત
- ૮.૨ (૧) રૂ.૭૦૦૦૦/- (૨) રૂ.૫૦૦૦/- (૩) ક્રોસ્ટ (૪) ત્રણ
(૫) છ
- ૮.૩ (૧) ખોટું (૨) ખોટું (૩) ખોટું (૪) સાચું (૫) સાચું
- ૮.૪ (૧) ખોટું (૨) સાચું (૩) ખોટું (૪) ખોટું (૫) સાચું
- ૮.૫ (૧) ઝ (૨) ઈ (૩) ક (૪) બ (૫) અ
- ૮.૬ (૧) વ્યવસાય (૨) માધ્યમ (૩) જવાબ (૪) એક કરોડ

મોડયુલ – ૩
સેવાના ભેત્ર



નોંધ

ટપાલ (પોસ્ટ) અને કુરીયર સેવા

(૫) પોસ્ટ બેગ કે પોસ્ટ બોક્સ

૮.૭

૧.

૧. સાચું

૨. ખોટું

૩. ખોટું

૪. સાચું

૫. ખોટું

૨.

૧. અ.

૨. ક.

૩. ક.

૪. બ

૫. ક



તમારા માટે પ્રવૃત્તિઓ

૧. નજીકની પોસ્ટઓફિસની મુલાકાત લો, અને સામાન્ય ટપાલના નીચેનાના પ્રવર્તમાન ટપાલ દરો મેળવો. કવર, રજિસ્ટર્ડ પોસ્ટ, મનીઓર્ડર ફી, પોસ્ટલ ઓર્ડર ચાર્જ, સ્પર્ધા (પ્રતિયોગિતા) પોસ્ટકાર્ડ, સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગ વગેરે
૨. નજીકની પોસ્ટઓફિસે જાઓ અને નેશનલ સેર્વિંગ સર્ટિફિકેટ અને ડિસાન વિકાસ પત્રના લાભ વિશે તપાસ કરો.

ધ્યાન આપો:-

આ પાઠમાં ટપાલ સુવિધાઓ અને થોજનાઓ માટે આપવામાં આવેલ વિવિધ માહિતી વર્ષ ૨૦૧૧ ને લાગુ પડે છે. આ અંગેની અધતન માહિતી માટે તમારી નજીકની પોસ્ટઓફિસમાં સંપર્ક કરવા સલાહ છે.



બેન્કિંગ સેવાઓ

જ્યારે આપ શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હશો ત્યારે આપે કેનેરા બેક, પંજાબ નેશનલ બેક, સેટ બેક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ કોમર્શિયલ બેક વગેરે સાઈનબોર્ડ (પાટિયા) મકાનો ઉપર લાગેલાં જોયા હશો. આ બધાં નામોનો અર્થ શો? શું આપે કદી તેમના વિષે જાણવા પ્રયત્ન કર્યો છે? જો આપ કોઈ એવા મકાનમાં પ્રવેશ કરશો તો તમને કોઈ વ્યાપારી કાર્યાલય જેવો માહોલ જોવા મળશે. તમે જોશો કે કાઉન્ટર પાછળ બેઠેલા કેટલાક કર્મચારીઓ તેમના સામે ઉભેલા આગંતુકો સાથે વાત કરી રહ્યા છે. તમે જોશો કે કેટલાક માણસો એક કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવી રહ્યા છે, જ્યારે કેટલાક બીજા કાઉન્ટર ઉપરથી પૈસા મેળવી રહ્યા છે. કાઉન્ટરોની પાછળ કાર્યાલયમાં કેટલાક મેજ અને ખુરશી જોઈ શકશો. તેના ઉપર અધિકારીઓ બેઠેલા હોય છે. કાર્યાલયના એક છેડે તમને એક ચેમ્બર (પાર્ટીશનવાળી નાની ઓરરી) જોવા મળશે. તેમાં પ્રબંધક બેઠા હોય છે. તેના ટેબલ ઉપર કેટલાક કાગળો પડ્યા હોય છે. આ છે એક બેંકનું કાર્યાલય.

આલો આપણે બેંકો અને તેમની પ્રવ તિ વિષે વિગતવાર જાણકારી મેળવીએ.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- બેક શબ્દનો અર્થ જણાવી શકશો.
- બેકીંગની ભૂમિકા સમજાવી શકશો.
- જુદી જુદી જાતની બેંકો ઓળખી શકશો, અને
- વ્યાપારી બેંકના કાર્યો વર્જવી શકશો.

૬.૧ બેંકનો અર્થ

તમે જાણો છો કે ખોરાક, કપડાં, બાળકોનું શિક્ષણ, રહેઠાણ વગેરેના રોજબરોજના ખર્ચને પહોંચી વળવા લોકો પૈસા કમાય છે. તેમને વિવાહ, બાળકોનું ઉચ્ચશિક્ષણ, મકાન બાંધવું તેમજ અન્ય સામાજિક કાર્યો વગેરે જેવા ભાવિ ખર્ચાઓને પહોંચી વળવા પણ પૈસાની જરૂર પડે છે. આ બધા મોટા ખર્ચા છે અને જો વર્તમાન આવકમાંથી થોડા થોડા પૈસા બચાવ્યા હોય તો જ તેમને પૂરા કરી શકાય છે. વૃદ્ધાવસ્થા અને બીમારી માટે

બેન્કિંગ સેવાઓ

પણ બચત કરવી જરૂરી છે. કારણ કે આવા સમયે લોકો કામ કરીને પોતાની આજીવિકા રળી શકે નહિ.

પ્રાચીન કાળમાં પણ લોકોને બચત કરવી જરૂરી લાગી હતી. તેઓ પોતાના ઘરમાં ધનનો સંગ્રહ કરછ રાખતા આ પ્રથાથી તેમને જ્યારે જરૂર હોય ત્યારે બચત કામમાં આવી શકતી. પણ આ પ્રથામાં ચોરી, લુંટ કે અન્ય અકસ્માત ઘટનાઓથી ધનહાનિ થવાનું જોખમ રહેતું. આથી લોકોને એવા કોઈ સ્થાનની જરૂર પડવા લાગી કે જ્યાં પોતાની બચત સલામત રીતે જમા કરી શકાય અને જ્યારે જરૂર પડે ત્યારે મેળવી શકાય. બેંકો એવાં સ્થાનો છે કે જ્યાં લોકો પોતાની બચત એવી ખાતરી સાથે જમા કરાવી શકે કે જ્યારે જરૂર પડશે ત્યારે પોતાની થાપણ તેઓ ઉપાડી શકશો. જે લોકો વેપાર કે કોઈ અન્ય હેતુ માટે ઉધાર પૈસા લેવા માગતા હોય તેઓ પણ વાજબી વ્યાજના દરે બેંકો પાસેથી લોન મેળવી શકે.

"બેંક એક કાયદેસરનું સંગઠન છે, જે લોકોની થાપણો સ્વીકારે છે જે માગણી મુજબ ઉપાડી શકાય છે. જે વ્યકિતઓ કે વ્યાપાર ગૃહોને પૈસાની જરૂર હોય તેમને બેંક પૈસા દીરે પણ છે."

બેંક બીજી પણ ઘણી સેવાઓ પૂરી પાડે છે. જેમકે બિલો એકઠાં કરવા, બિલોની ચૂકવણી કરવી, જવેરાત અને અન્ય કીમતી ચીજો સલામતીપૂર્વક સાચવવી, વ્યાપારીઓની શાખ ક્રમતાને પ્રમાણિત કરવી વગેરે.

બેંક જાહેર જનતા તેમજ વ્યાપાર જગત પાસેથી પણ થાપણ સ્વીકારે છે. કોઈ વ્યકિત ભવિષ્ય માટે પૈસા બચાવવા માગે તો તે પોતાની બચત બેંકમાં જમા કરાવી શકે છે. વેપારીઓને વેચાણમાંથી આવક થાય છે. તેમાંથી તેમણે ખર્ચ માટે ચૂકવણું કરવું પડે છે. તેઓ પોતાના વેચાણનો વકરો સલામતી પૂર્વક બેંકમાં જમા કરાવી શકે છે અને તેમાંથી વખતોવખત પોતાનો ખર્ચ કાઢે છે. બેંકો થાપણ જમા કરાવનારને બે ખાતરી આપે છે.

અ. થાપણની સલામતી અને

બ. જ્યારે જરૂર પડે ત્યારે થાપણનો ઉપાડ

થાપણો ઉપર બેંકો વાજ આપે છે. જે મુદ્દલમાં ભરતું જાય છે. થાપણદારો માટે આ એક જબરું પ્રલોભન છે. આનાથી લોકોમાં બચત કરવાની ટેવ પાડવાને પ્રોત્સાહન

મોડયુલ - ૩ સેવાના ક્ષેત્ર



નોંધ





મળે છે. બેંકો થાપણના આધાર ઉપર કિસાનો, ધંધાડારીઓ અને વેપારીઓને ઉત્પાદક હેતુ માટે લોનો તેમજ એડવાન્સ (આગોતરો ઉપાડ) પણ આપે છે. આ રીતે બેંકો દેશના આર્થિક વિકાસ અને આમ જનતાની સુખાકારીમાં પણ યોગદાન આપે છે. બેંકો લોનો ઉપર વ્યાજ પણ લે છે. સામાન્ય રીતે જમા થાપણ ઉપર જે વ્યાજ આપવામાં આવે છે તેના કરતાં આ વ્યાજના દર ઉચ્ચ હોય છે. વળી બેંકો વેપારી આલમને અને જાહેર જનતાને જે અન્ય વિવિધ સેવાઓ પુરી પાડે છે તેને માટે પણ ફી વસુલ કરે છે લોન ઉપર બેંકને મળ તું વ્યાજ જે થાપણ જમા કરનારને અપાતા વ્યાજ કરતાં વધુ હોય છે તે અને સેવા માટે વસુલ કરવામાં આવતી ફી એ બંને બેંકો માટે આવકના મુખ્ય સ્ત્રોત છે. તેમાંથી તેઓ વહીવટી ખર્ચ કાઢે છે.

બેંકો દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓને 'બેંકિંગ' કહેવામાં આવે છે. એક પ્રવૃત્તિ તરીકે બેંકીંગમાં થાપણ સ્વીકારવી અને પૈસા ધીરવા અથવા રોકવાનો સમાવેશ થાય છે. માલસામાન અને સેવાઓના વિનિમય (આદાન–પ્રદાન)માં સહાયક એવી કેટલીક સેવાઓ અને ધન પુરું પાડીને તે વ્યાપારી પ્રવૃત્તિઓને સરળ બનાવે છે. આમ બેંકિંગ વેપાર વણજની એક અગત્યની સહાયક સેવા છે. તે માત્ર માલવના ઉત્પાદન કે સેવાઓ માટે જ ધન આપતી નથી પણ ખરીદનાર અને વેચનાર વચ્ચેના વિનિમયને પણ સુલભ બનાવે છે.

આપ જાણતા હશો કે આપણા દેશમાં બેંકીંગ પ્રવૃત્તિઓનું નિયમન કરવા કાયદા છે. બેંકમાં થાપણ જમા મૂકવી કે બેંકમાંથી કરજ લેવું તે વૈધાનિક (કાયદેસરનો) વ્યવહાર છે. બેંકો ઉપર સરકારનું નિયંત્રણ હોય છે. તેથી બેંકો જનતાનો વિશ્વાસ અને ખાતરી માણે છે. વળી બેંકો જનતાના વિશ્વાસ ઉપર પણ અવલંબે છે. જનતાઓ વિશ્વાસ સંપાદન કર્યા સિવાય બેંકો ટકી શકે નથી.

૮.૨ બેંકો અને શરાફો (શાહુકારો) વચ્ચે તકાવત

આપ ધારતા હશો કે બેંક પણ શરાફની માફક કરજ લેનારને નાણાં આપે છે અને લોન ઉપર વ્યાજ લે છે. પણ ખરેખર એમ નથી, બેંક શાહુકાર કરતાં તદન જુદ્દી છે. બેંક બે મુખ્ય કાર્યો કરે છે. પ્રથમ તો તે થાપણ (જમા) સ્વીકારે છે અને પછી તેના આધારે લોન ધીરે છે. જ્યારે બીજીબાજું શરાફો તેમની પોતાની અંગત દોલતમાંથી ધીરે છે અને સામાન્ય રીતે બીજા પાસેથી (જમા) થાપણ સ્વીકારતા નથી.

નીચેનું કોષ્ટક બેંક શરાફ વચ્ચેનો તકાવત સ્પષ્ટ કરે છે.

આધાર	બેંક	શરાફો
૧. અસ્તિત્વ	બેંક વ્યવસ્થિત સંસ્થાન છે.	શરાફ વ્યક્તિ છે.
૨. પ્રવૃત્તિ	બેંકીંગ પ્રવૃત્તિમાં જમા સ્વીકારવામાં આવે છે તેમજ પૈસા ધીરવામાં આવે છે.	શરાફની પ્રવૃત્તિમાં રકમ (થાપણ) જમા લેવાનો સમાવેશ થતો નથી.

બેન્કિંગ સેવાઓ

૩. ગ્રાહક	બેંકો સામાન્ય તથા આમ જનતાની અને ખાસ કરીને વેપારી આવમની જરૂરિયાતો પૂરી કરે છે.	શરાફ ખેડૂતો અને ગરીબ લોકોની જરૂરિયાતો પૂરી કરે છે.
૪. જમાનત	બેંકો વાસ્તવિક (મુર્ત) અને વ્યક્તિગત જમાનતો સ્વીકારે છે.	શાહુકારો મોટે ભાગે લોન આપવા માટે જમાનત રૂપે ઘરેણાં, જવેરાત કે જમીન સ્વીકારે છે.
૫. લોન વસુલાત કરવાની પ્રક્રિયા	લોન વસુલ કરવાની પ્રક્રિયા લવચીક હોય છે.	વસુલ કરવાની પ્રક્રિયા સખત અને જડ હોય છે.
૬. વ્યાજનો દર	લોન પર વ્યાજનો દર ભારતીય રિઝિવ બેંક નક્કી કરે છે.	વ્યાજનો દર શરાફ નક્કી કરે છે તથા મોટા ભાગે ખૂબ ઉચ્ચો હોય છે.

મોડયુલ – ૩ સેવાના ક્ષેત્ર



નોંધ

બેંકીંગની ભૂમિકા:-

બેંકો વેચાર માટે તેમજ વ્યક્તિગતી અંગત જરૂરિયાત માટે ધન આપે છે. રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં તેઓ એક મહત્વની મૂભૂમિકા ભજવે છે. ચાલો આપણે બેંકીંગની ભૂમિકા વિષે જાણીએ.

- તે આમ જનતામાં બચતની ટેવને પ્રોત્સાહિત કરે છે અને એ રીતે ઉત્પાદન માટે ધન પુરું પાડે છે.
- તે જેમની પાસે વધારાના (ફાજલ) નાણાં છે અને જેમને વિવિધ વ્યાપારી પ્રવૃત્તિઓ માટે પૈસાની જરૂર છે તે બંનેની વચ્ચે મધ્યસ્થી નું કાર્ય કરે છે.
- તે રોકડને બદલે ચેક દ્વારા ધનની પ્રાપ્તિ અને ચૂકવણી કરીને વ્યાપારી વ્યવહારોને સરળ બનાવે છે.
- તે વેપારીઓને ટૂંકા તેમજ લાંબાગાળાની લોન તથા પેશગી (આગોઠરી ચૂકવણી) આપે છે.
- તે ખેડૂતોને, લઘુઉદ્યોગોને અને સ્વનિર્ભર (સ્વ-રોજગારીવાળાન-લોકોને તેમજ મોટા ઉદ્યોગ ગૃહોને શાખ પૂરી પાડીને રાષ્ટ્રીય વિકાસમાં સહાયક બને છે અને દેશના સંતુલિત આર્થિક વિકાસમાં ફાળો આપે છે.
- તે સામાન્ય લોકોને ગ્રાહક માટે ટકાઉ વસ્તુઓ, મકાન, મોટર વાહન વગેરે માટે લોન આપીને લોકોનું જીવન ધોરણ ઉચ્ચ લાવવામાં મદદ કરે છે.



૬.૧ પાઠગત પ્રશ્નો

યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરો

૧. બેંક લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને જે લોકોની વિવિધ હેતુ માટે જરૂર હોય તેને પૈસા




૨. જે લોકો પાસે વધારાના પૈસા હોય અને જેમને પૈસા ઉધાર લેવા હોય તે બે વર્ષ્યે બેંક નું કામ કરે છે.
૩. બેંકિંગ વ્યાપારી પ્રવૃત્તિઓને સરળ બનાવે છે અને ના એક અગત્યના સહાયક તરીકે ગણવામાં આવે છે.
૪. બેંક રોકડને બદલે થી નાણાં ચૂકવવાની સગવડ આપે છે.
૫. એક પોતાની અંગત દોલતમાંથી નાણાં ધીરે છે અને સામાન્ય રીતે કોઈ પાસેથી થાપણ જમા લેતો નથી.

૮.૩ બેંકોના પ્રકાર

આપણા દેશમાં બિન્ન બિન્ન પ્રકારની બેંકો કાર્યરત છે. તેઓ ખેતી, વ્યાપાર, ધંધા વગેરેમાં જોડાયેલા વિવિધ કક્ષાના લોકોની આર્થિક જરૂરિયાતો પૂરી કરે છે. કાર્યોના આધાર પર ભારતમાં બેંકિંગ સંસ્થાઓનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.

બેંકોના પ્રકાર



ક. કેન્દ્રીય બેંક:-

કોઈપણ દેશની એવી બેંક કે જેને દેશની બેંકિંગ પ્રથાનું નિર્દેશન અને નિયમન કરવાની કામગીરી સૌંપવામાં આવી હોય તેને કેન્દ્રીય બેંક કહેવામાં આવે છે. આવી બેંક સામાન્ય જનતા સાથે વ્યવહાર કરતી નથી. આવી બેંકો મુખ્યત્વે સરકારના બેંકર તરીકે કામ કરે છે. તમામ અન્ય બેંકોના જમા ખાતાનો હિસાબ રાખે છે અને જરૂર પડે ત્યારે અન્ય બેંકોને ઓડવાન્સ પૈસા આપે છે. આથી તેને બેંકરની બેંક કહેવાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશની કેન્દ્રીય બેંક છે.



કેન્દ્રીય બેંક સરકારની (રેવન્યુ) આવક અને વિવિધ હેડે થયેલ ખર્ચનો અહેવાલ રાખે છે. એ નાણાંકીય અને શાખાની બાબતોની નીતિઓમાં સરકારને સલાહ આપે છે અને બેંકની

બેન્કિંગ સેવાઓ

આપણો (જમા રકમ) અને બેંકની લોનો ઉપરના વ્યાજના દરો પણ નક્કી કરે છે. આ ઉપરાંત વિદેશી વિનિમય દરો પણ આ બેંક નક્કી કરે છે. કેન્દ્રીય બેંકનું એક અન્ય અગત્યનું કાર્ય છે ચલણી નોટોનું પ્રદાન કરવું અને વિવિધ પદ્ધતિથી દેશમાં ચલણી નોટો ફરતી રહે તેનું નિયમન કરવું કેન્દ્રીય બેંક સિવાય અન્ય કોઈ બેંક ચલણી નાણું આપી શકે નહિએ.

૭. વ્યાપારી બેંક (વાણિજ્ય બેંક):-

વાણિજ્ય બેંકો એવી વાણિજ્ય સંસ્થાઓ છે કે જે જમા (આપણા) સ્વીકારે છે અને પોતાના ગ્રાહકોને ટૂંકા સમય માટે લોનો તથા અગ્રીમ ઉપાડ (એડવાન્સ) આપે છે. ટૂંકા ગણાની આવી લોનો ઉપરાંત વાણિજ્ય બેંકો વ્યાપારી સાહસોનો મધ્યમગાળોની તેમજ (દીઘી) લાંબાગાળાની લોન પણ આપે છે. હાલમાં કેટલીક વાણિજ્ય બેંકો વ્યકિતઓને મકાન માટેની લાંબાગાળાની લોનો પણ આપે છે. વાણિજ્ય બેંકના બીજા પણ ઘણાં કાર્યો છે. તેમની ચર્ચા આ પાઠમાં પાછળ કરવામાં આવી છે.

વાણિજ્ય બેંકોના પ્રકાર:- વાણિજ્ય બેંકો ત્રણ પ્રકારની છે. જેમકે, સાવ જનિક ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક અને વિદેશી બેંક.

૧. **સાર્વજનિક ક્ષેત્રની બેંકો:**- આ એવી બેંકો છે જેમાં પૈસાના જોખમની જવાબદારી મહદું અંશે ભારત સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની હોય છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ઉદાહરણ છે : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, બેંક ઓફ બરોડા અને દેના બેંક વગેરે
૨. **ખાનગી ક્ષેત્રની બેંકો:**- ખાનગી ક્ષેત્રની બેંકોમાં મોટા ભાગની શેરની અસ્ક્યામત ખાનગી વ્યકિતઓની હોય છે. આ બેંકોને મર્યાદિત ઉત્તરદાયિતવાળી કંપનીઓ તરીકે રજિસ્ટર (નોંધણી પંજીકરણ) કરવામાં આવે છે. દા.ત. જમ્મુ અન્ડ કાશ્મીર બેંક લિ., બેંક ઓફ રાજસ્થાન લિ., ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક લિ., લોર્ડ કિઝા બેંક લિ., ભારત ઓવરસીઝ બેંક લિ., ગ્લોબલ ટ્રસ્ટ બેંક, વિજય બેંક વગેરે
૩. **વિદેશી બેંક:**- આ બેંકો રજિસ્ટર્ડ (પંજીકૃત) હોય છે અને તેમના મથકો વિદેશોમાં હોય છે. પણ આપણા દેશમાં તેમની શાખાઓ કાર્યરત હોય છે. આપણા દેશમાં કાર્યરત કેટલીક વિદેશી બેંકો છે. હોંગકોંગ અન્ડ શાંગહાઇ બેંકો, કોર્પોરેશન (HSBC) સિટીબેંક, અમેરિકન એક્સપ્રેસ બેંક, સ્ટાન્ડર્ડ અન્ડ ચાર્ટર્ડ બેંક, ગ્રિંલે બેંક વગેરે. ૧૯૮૧ના વિતીય ક્ષેત્ર સુધારા પણી આપણા દેશમાં કાર્યરત બેંકોની સંખ્યામાં વધારો થયો છે.

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



ગ. વિકાસ બેંકો:-

યંત્ર સામગ્રી (મશીનરી) અને ઉપકરણો (સાધાનો)ની ખરીદી માટે, આધુનિકતમ તકીનીકીનો ઉપયોગ કરવા માટે અને આધુનિકીકરણ (અધતનીકરણ)ના પ્રસાર માટે વ્યાપારમાં કેટલીકવાર માધ્યમથી મંડળીને લાંખાળાની પૂજીની જરૂર પડે છે. આવી આર્થિક સહાય વિકાસ બેંકો આપે છે. તેઓ વિકાસ માટેના અન્ય ઉપાયો પણ યોજે છે. જેમ કે જો કોઈ કંપનીએ શેર કે ડિબેન્ચરનો ઈસ્યુ બહાર પાડ્યો હોય અને લોકોમાંથી પૂરું ભરણું ન થાય તો તે શેરો કે ડિબેન્ચરો ખરીદે છે. ભારતીય ઔદ્યોગિક નાણા નિગમ (IFCI) અને રાજ્ય નાણાં નિગમ (SFCs) ભારતમાં વિકાસ બેંકના ઉદાહરણ છે.

ઘ. સહકારી બેંકો:-

જે લોકો તેમના આપસી હિતને સંયુક્ત રીતે પરિપૂર્ણ કરવા ઈચ્છતા હોય તેઓ સહકારી મંડળી એકટ હેઠળ એક સહકારી મંડળી સ્થાપે છે. જ્યારે આવી કોઈ સહકારી મંડળી બેંકીંગ કેન્દ્ર અપનાવે ત્યારે તેને સહકારી બેંક કહે છે. આવી મંડળીઓ બેંકીંગ વ્યવસાય શરૂ કરતા પહેલાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લાઈસન્સ મેળવવું પડે છે. કોઈપણ સહકારી બેંક મંડળી તરીકે રાજ્ય સહકારી મંડળીઓના રાજ્યસ્ટ્રારની સંપૂર્ણ દેખરેખ (નિરીક્ષણ) નીચે કામ કરવાનું હોય છે. બેંકીંગ વ્યવારની બાબતમાં મંડળીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઘડેલા અને બહાર પાડેલા નિર્દેશોનું પાલન કરવું ફરજિયાત છે.

સહકારી બેંકોના પ્રકાર:— આપણા દેશમાં ત્રણ પ્રકારની સહકારી બેંકો કાર્યરત છે. તેઓ છે પ્રાથમિક શાખ મંડળીનો કેન્દ્રીય સહકારી બેંકો. આ બેંકો કાર્યરત છે. તેઓ છે પ્રાથમિક મંડળીઓ, કેન્દ્રીય સહકારી બેંકો તથા રાજ્ય સહકારી બેંકો. આ બેંકો ત્રણ સત્તે સંગઠિત હોય છે. ગ્રામ કે શહેરી કક્ષાઓ, જિલ્લા કક્ષાઓ અને રાજ્ય કક્ષાઓ.

૧. **પ્રાથમિક શાખ મંડળીઓ:**— આ મંડળીઓ ગ્રામડા કે શહેરની કક્ષાઓ રચાઈ હોય છે. તેમાં એક ક્ષેત્રમાં રહેતા એવા પૈસા (ઋણ) લેનાર તેમજ ન લેનાર એવા બંને પ્રકારના લોકો સભ્ય હોય છે. આવી દરેક મંડળીનું કાર્યક્ષેત્ર એક નાનકડા વિસ્તાર પૂરતું મર્યાદિત હોય છે જેથી સભ્યો એકબીજાને ઓળ ખતા હોય અને પ્રવર્તિઓ ઉપર દેખરેખ રાખી શકતા હોય જેથી દગ્ધાને સ્થાન ન રહે.
૨. **કેન્દ્રીય સહકારી બેંકો:**— આ બેંકો જિલ્લા કક્ષાઓ કામ કરતી હોય છે. તે જ જિલ્લાની કેટલીક પ્રાથમિક શાખ મંડળીઓ તેની સભ્ય હોય છે. આ બેંકો પોતાના સભ્યો (એટલે કે પ્રાથમિક શાખ મંડળી) ને લોન આપે છે અને પ્રાથમિક શાખ મંડળીઓ અને રાજ્ય સહકારી બેંકો વચ્ચે કિરીઝ કાર્ય કરે છે.
૩. **રાજ્ય સહકારી બેંકો:**— આ બેંકો દેશના રાજ્યોમાં સર્વોચ્ચ (શિખરરૂપ) સહકારી બેંકો છે. આ બેંકો ધન એકત્ર જમા કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય

બેન્કિંગ સેવાઓ

વિતરણમાં સહાય કરે છે. પૈસા ઉધાર લેનાર વ્યક્તિ પાસે પૈસા રાજ્ય સહકારી બેંકોમાંથી કેન્દ્રીય સહકારી બેંકો તથા પ્રાથમિક શાખ મંડળીઓ દ્વારા પહોંચે છે.

૨. વિશિષ્ટ બેંકો:-

કેટલીક એવી બેંકો છે કે જે કોઈ વિશિષ્ટ કાર્યક્ષેત્રમાં સ્થપાયેલા વ્યવસાયની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે છે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે. 'એક્ઝિમ' (EXIM) બેંક, 'સીડબી' (SIDBI) અને 'નાબાર્ડ' બેંક વગેરે આના ઉદાહરણ છે. તેઓ કોઈ વિશિષ્ટ કાય ક્ષેત્રમાં પોતાને જોડે છે અને એ રીતે તેમને વિશિષ્ટ બેંક કહે છે. ચાલો આપણે તેમના વિષે જાણીએ.

૧. ભારતીય આયાત-નિકાસ બેંક : (EXIM – EXPORT-IMPORT Bank of India.) (એક્ઝિમ):— જો તમે તમારા ઉત્પાદનની વિદેશોમાં નિકાસ કરવા માટે અથવા તમારા દેશમાં વેચવા માટે વિદેશોમાં આયાત કરવા માટેનો કોઈ વ્યવસાય સ્થાપવા માંગતા હો તો એક્ઝિમ બેંક તમને જરૂરી જાણકારી તેમજ સહાય પૂરી પાડે છે. આ બેંક આયાતકારો અને નિકાસકારોને લોન આપે છે. અને વેર્ચિવક બજારની માહિતી આપે છે. આ બેંક આયાત અને નિકાસ માટેની તકો વિષે માગ દશ ન આપે છે. તેમાં રહેલા જોખમો અને જે હરિફાળનો સામનો કરવો પડે તેની વિષે પણ જાણકારી આપે છે.



૨. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સીડબી (SIDBI – Small Industries Development Bank of India):— જો તમે કોઈ નાનું વ્યાપારી એકમ કે નાના પાયા પરનો લઘુ ઉદ્યોગ સ્થાપવા માગતા હો તો ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક તમને સરળ શરતોએ લોન આપે. તે બેંક નાના પાયા ઉપરના ઉદ્યોગોનું અધતનીકરણ કરવા, નવી ટેકનોલોજી (તકનીકી) નો ઉપયોગ કરવા માટે વિકિય માટેની પ્રવૃત્તિઓ માટે ધન પુરું પાડે છે. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંકનું મુખ્ય કાર્ય અને હેતુ છે. નાના પાયાને ઉદ્યોગોનો પ્રસાર કરવો, વિકાસ કરવો અને ધન પુરું પાડવું.



૩. રાષ્ટ્રીયકૃત – ગ્રામ વિકાસ બેંક (નાબાર્ડ) NABARD. (National Bank for Agriculture and Rural Development):- કૃષિ તથા ગ્રામ વિકાસના ક્ષેત્રોને ધન પુરું પાડવા માટે 'નાબાર્ડ' કેન્દ્રીય અથવા મૂર્ધન્ય (સર્વોચ્ચ) સંસ્થા છે. જો કોઈ વ્યક્તિ ખેતી કે હાથશાળ વણાટ, માણીમારી વગેરે જેવી પ્રવૃત્તિ કરવા માંગતી હોય તો નાબાર્ડ પ્રાદેશિક ગ્રામ્ય બેંકો દ્વારા તેને લાંબા તેમજ ટૂંકાગળાની ઓમ બંને પ્રકારની શાખ પૂરી પાડે છે. આ બેંક ખાસ કરીને ખેતી, લઘુ-ઉદ્યોગો, કુટિર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો હાથ

મોડયુલ - ૩ સેવાના ક્ષેત્ર



નોંધ



કારીગરી (હુનર) અને એને આનુષ્ઠાનિક ગ્રામ્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં રોકાયેલી સહકારી શાખ મંડળીઓને આર્થિક સહાય કરે છે.



૮.૨ પાઠગત પ્રશ્નો

નીચેના દરેક વિધાનમાં વર્ણવાયેલ બેંકનો પ્રકાર ઓળખો

૧. ઓછું ભરણું થવાના સંયોગોમાં એક કંપનીના શેર અને ડિબેન્ચરના ગ્રાહક થવાની જવાબદારી ઉઠાવતી બેંક.
૨. ઉત્પાદનની વિદેશોમાં નિકાસ કરવામાં સહાય અને માર્ગદર્શન આપતી બેંક.
૩. પોતાના સમાન હેતુની પૂર્તિ માટે લોકોના એક જૂથે રચેલી બેંક.
૪. ચલણી નોટો આપનાર બેંક.
૫. વાણિજ્ય બેંક જેમાં મોટાભાગનું જોખમ સરકારનું હોય છે.

૮.૪ વાણિજ્ય બેંકના કાર્યો

વાણિજ્ય બેંકોના કાર્યો બે પ્રકારનાં છે

૧. પ્રાથમિક કાર્ય અને
૨. ગૌણ કાર્ય

આલો આપણે આ કાર્યોની વિસ્તારથી ચર્ચા કરીએ.

૧. પ્રાથમિક કાર્ય:-

વાણિજ્ય બેંકના પ્રાથમિક કાર્યમાં સમાવિષ્ટ છે.

- ક. જમા (થાપણો) સ્વીકારવી
- ખ. લોન અને એડવાન્સ (અગ્રીમ ઉપાડ) મંજૂર કરવા

ક. જમા (થાપણો) સ્વીકારવી:-

વાણિજ્ય બેંકનું સૌથી અગત્યનું કાર્ય છે. લોકો પાસેથી થાપણો એકઠી કરવી. જે લોકો પાસે વધારાની આવક અને બચત હોય છે તેઓ તે રકમ બેંકમાં થાપણ મૂકવાનું પસંદ કરે છે. થાપણના પ્રકારોના આધારે બેંકોમાં મૂકેલું ભંડોળ (નાણાં) વ્યાજની પણ કમાણી કરે છે અને આમ બેંક પાસે જમા રકમ રણેલા વ્યાજ સાથે વધતી જાય છે. વ્યાજનો દર ઉચ્ચો હોય તો લોકોને વધુ પૈસા બેંકમાં મૂકવાનું પ્રોત્સાહન મળે છે. વળી બેંકમાં જમા કરાવેલી રકમ સુરક્ષિત રહે છે.

ખ. લોન તથા એડવાન્સ આપવા:-

બેન્કિંગ સેવાઓ

વાણિજ્ય બેંકનું એક બીજું મહત્વનું કાર્ય છે લોન તથા એડવાન્સ આપવા, આવી લોનો અને એડવાન્સ જનતાના સમ્ભ્યો અને વેપારી આલમને આપવામાં આવે છે. તેનો વ્યાજનો દર વિવિધ જમા ખાતાઓ ઉપર આપવામાં આવતા વ્યાજના દર કરતાં વધારે ઉંચો હોય છે. લોન તથા એડવાન્સ ઉપર લેવામાં આવતા વ્યાજનો દર તેના હેતુ, અવધિ (સમયગાળો) અને પરત કરવાના પ્રકાર પ્રમાણે બિન્ન હોય છે.

૧. લોન :—

લોન એક નિશ્ચિત સમય મર્યાદા માટે આપવામાં આવે છે. સામાન્ય રીતે વાણિજ્ય બેંકો ટૂંકા સમયગાળા માટે લોનો આપે છે. પરંતુ લોન 'સમયાવધિ' લોન એટલે કે એક વર્ષથી વધુ સમય માટે લોન પણ આપવામાં આવે છે. લોન લેનારને લોન એક જ હપ્તામાં અથવા જુદા જુદા હપ્તામાં પણ આપવામાં આવે છે. લોન સામાન્ય રીતે અમુક સંપત્તિની જમાનત સામે આપવામાં આવે છે. લોન સામાન્ય રીતે હપ્તામાં ભરપાઈ કરવામાં આવે છે. જો કે કુલ રકમ એક સાથે પણ ભરી શકાય છે.

૨. એડવાન્સ :—

એડવાન્સ એક શાખ-સુવિધા છે જે બેંક પોતાના ગ્રાહકોને આપે છે. તે લોન કરતાં એ રીતે જુદી પડે છે કે લોન લાંબા ગાળા માટે પણ આપી શકાય છે. પણ એડવાન્સનો હેતુ રોજ બરોજના વ્યાપારની જરૂરિયાતો પૂરી પાડવાનો છે. વ્યાજનો દર દરેક બેંકનો જુદો જુદો હોય છે. વ્યાજ મંજૂર થયેલી રકમ ઉપર નહીં પણ ઉપાડેલી રકમ ઉપર વસુલ કરાય છે.

એડવાન્સના પ્રકાર :—

બેંકો એડવાન્સ નગદ શાખ, ઓવર ડ્રાફ્ટ (અધિવિકર્ષ ખાતામાં જમા રકમ કરતાં વધારે ઉપાડ) અને બિલ ડિસક્ઉન્ટીંગ દ્વારા આપે છે.

૩. નગદ શાખ :—

નગદ શાખ એક એવી સુવિધા (વ્યવસ્થા) છે કે જેના દ્વારા બેંક ગ્રાહકોને અમુક મર્યાદા સુધી રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. આ રકમ ગ્રાહકના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ગ્રાહક આ રકમ જેવી રીતે અને જયારે જરૂર પડે ત્યારે ઉપાડી શકે છે. વ્યાજ ખરેખર ઉપાડેલી રકમ ઉપર વસુલ કરવામાં આવે છે. ગ્રાહક સાથે નક્કી થયેલી શરતો મુજબ નગદ શાખ મંજૂર કરવામાં આવે છે.

૪. ઓવરડ્રાફ્ટ (જમા રકમ કરતાં વધારે ઉપાડ) :—

ઓવરડ્રાફ્ટ પણ બેંક દ્વારા આપવામાં આવતી એક શાખ સુવિધા છે. બેંકમાં ચાલુખાતું ધરાવતા ગ્રાહકને પોતાના ખાતામાં જમા કરતાં વધુ રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે. આ એક કામયલાઉ સુવિધા છે. ઓવરડ્રાફ્ટની સગવડ અમુક

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



નિશ્ચિત મર્યાદા સુધી સંપત્તિની જમાનત અથવા વ્યક્તિની જમાનત અથવા બંને ઉપર આપવામાં આવે છે.

ગ. બિલ ડિસ્કાઉન્ટીંગ:-

બેંકો બિલ ડિસ્કાઉન્ટીંગ દ્વારા ટૂંકાગળાની આર્થિક સુવિધા આપે છે. એટલે કે બીલ (હુંડી)ની પાકવાની તારીખ પહેલાં વળતરની અમૃક રકમ કાપી લઈને ચૂકવણી કરી આપે છે. ગ્રાહકને હુંડી પાકવાના સમય સુધી રાહ જોયા વગર રકમ મળી જાય છે. જો કદાચ કોઈ હુંડીનો પાકવાના સમયે સ્વીકાર ન થાય તો બેંક ગ્રાહક પાસેથી બીલની રકમ વસુલ કરી શકે છે.

૨. ગૌણ કાર્યો:-

જમા રકમ સ્વીકારવી અને પૈસા ધીરવાના પ્રાથમિક (મુખ્ય) કાર્યો ઉપરાંત બેંકો અન્ય સંખ્યાબંધ કાર્યો કરે છે તેને ગૌણ (દ્વિતીય કક્ષાના) કાર્યો કહેવામાં આવે છે. તે આ મુજબ છે :

- ક. શાખા પત્રો તેમજ ટ્રોવેલર્સ ચેક વગેરે આપવા.
- ખ. સેફ ડિપોઝિટ વોલ્ટ કે લોકરની સુવિધા પૂરી પાડીને બહુ મૂલ્ય વસ્તુઓ (ગવેરાત – ઘરેણાં) અગત્યના દસ્તાવેજો અને જામીનગીરી વગેરેને સલામતી પૂરી પાડે છે.
- ગ. ગ્રાહકોને વિદેશી ચલણના વિનિમય વ્યવહારોની સુગમતા આપે છે.
- ઘ. એક ખાતામાંથી બીજા ખાતામાં કે એક શાખામાંથી બીજી શાખામાં ચેક, પે ઓર્ડર કે ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પૈસાના હસ્તાંતરની સુવિધા આપે છે.
- ય. માલ સામાન, યંત્ર સામગ્રી, વાહનોની ખરીદી માટેની ચૂકવણી કરવા પોતાના ગ્રાહકો વતી બાંહેધરી આપવી.



૮.૩ પાઠગત પ્રશ્નો

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં અને ખોટાં છે તે જણાવો અને સાચા વિધાનો સામે "સાચા" દર્શાવો, ખોટા વિધાનો સામે "ખોટા" દર્શાવો.

૧. લોન અને એડવાન્સ બંને બેંકો દ્વારા ગ્રાહકોને લાંબાગળા માટે આપવામાં આવે છે.
૨. બેંક આપણા ગવેરાત, અગત્યના દસ્તાવેજ વગેરે પોતા પાસે સુરક્ષિત રાખે છે.
૩. બેંક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે વ્યાજબી દરે લોન આપે છે.
૪. બિલોનું ડિસ્કાઉન્ટીંગ બેંકો મફત કરે છે.
૫. ઓવરડ્રાફ્ટ દ્વારા ગ્રાહક પોતાના ખાતામાં જમા રકમ કરતાં વધુ પૈસાનો ઉપાડ કરી શકે છે.



નોંધ

૮.૫ મધ્યસ્થ બેંક

મધ્યસ્થ બેંકની સ્થાપના પહેલી એપ્રિલ ૧૯૭૫માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદા ૧૯૭૪ દ્વારા થઈ હતી. શરૂઆતમાં આરબીઆઈનું વડું મથક કલકતામાં હતું. પરંતુ ૧૯૭૭માં આ વડું મથક મુંબઈ ખાતે કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું. આરબીઆઈના વડા મથકે આરબીઆઈના ગર્વનર બેંકિંગની નીતિઓ—નિર્ણયો ઘડે છે. શરૂઆતમાં ખાનગીસેત્રની માલિકો હોવાથી ૧૯૪૮માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની છે. જેનું સૌથી મહત્વનું કાર્ય સમગ્ર દેશની બેંકો ઉપર દેખરેખ રાખવા નિયંત્રણ રાખવા અને સ્થાનિક બાબતો માટે સેન્ટ્રલ બોર્ડને માર્ગદર્શન આપવું. પ્રાદેશિક બેંકોનું પ્રતિનિધિત્વ કરવું. આર્થિક વિકાસના હેતુથી સ્થાનિક સરકારી બેંકોને માર્ગદર્શન આપવું અને સેન્ટ્રલ બોર્ડના સત્તામંડળ દ્વારા સમયાંતરે થયેલ કાર્યોની મૂલ્યાંકન કરવું.

૮.૬ બેંક જમા ખાતું

તમે શીખી ચૂક્યા છો કે બેંકોની મુખ્ય પ્રવૃત્તિ લોકો પાસેથી જમા રકમ સ્વીકારીને વ્યાવસાયિકો તેમજ અન્ય જરૂરિયાતવાળાઓની ધીરવાની છે. વાસ્તવમાં જે પૈસા બેંકોમાં જમા કરાવવામાં આવે છે તે બનતા સુધી લોકોની બચત હોય છે. તમે જાણો છે કે જો કોઈ પૈસા કમાતું હોય અને તેની નિયમિત આવક હોય તો તે પૈસા માત્ર રોજબરોજના ખર્ચમાં વાપરતું નથી પણ ભવિષ્યની જરૂરિયાત માટે આવકઓ અમુક હિસ્સો બચાવવાનો પ્રયત્ન કરે છે. ધનની ભવિષ્યાં વિવિધ હેતુઓ માટે જરૂર પડે છે. જેમ કે પરિવારમાં આંદંગી સબબ ડોક્ટરી સારવા માટે, લંગ પ્રસંગ કે બાળકોના ઉચ્ચ અભ્યાસના ખર્ચ માટે અથવા કોઈ ધાર્મિક ઉત્સવ ઉજવવા માટે ધનની જરૂર પડે છે, ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બચાવેલા પૈસા ઘરમાં રાખી શકાય. પણ ઘરમાં બચાવી રાખેલા પૈસા નિષ્ઠિય (બિન ઉત્પાદક) રહે છે, કોઈ વળતર આપતા નથી. એટલા માટે લોકો પૈસા એવા કોઈ સ્થળે રાખે છે કે જ્યાં તે સલામત પણ રહી શકે અને વળી કંઈક આવક પણ કમાઈ શકે. બેંક એક એવું સ્થળ છે કે જ્યાં એકવાર જમા કરાવેલી રકમ સલામત પણ રહે છે અને વ્યાજ પણ કમાઈ શકે છે. આ પાઠમાં આપણે જમા ખાતા કે જે આપણે બેંકમાં ખોલાવી શકાય અને તેનું સંચાલન કરી શકાય તે વિષે શીખીશું.

૮.૭ બેંક જમા ખાતાના પ્રકારો

બેંક જમા (થાપણ) જુદા જુદા લોકો માટે જુદા જુદા હેતુઓ પરિપૂર્ણ કરે છે. કેટલાક લોકો નિયમિત બચત કરી શકતા નથી. તેઓ માત્ર જાયારે તેમને વધારાની આવક થાય ત્યારે બેંકમાં પૈસા મૂકતા હોય છે. બેંકમાં જમા કરાવવાના હેતુ છે ભાવિ જરૂરિયાતો માટે પૈસા સલામત રાખવા કેટલાક લોકો બની શકે તેટલા લાંબા સમય સુધી બેંકમાં પૈસા મૂકી રાખવા ઈચ્છે છે. જેથી તેઓ વ્યાજ કમાઈ શકે અથવા બચતનો વ્યાજ સહિત સંગ્રહ કરી શકે જેથી તેઓ ફ્લેટ ખરીદી શકે અથવા વૃદ્ધાવસ્થામાં દવાખાનાના ખર્ચને પહોંચી વળે. કેટલાક, મોટે ભાગે વેપારીઓ, તેમના વેચાણની સંપૂર્ણ આવક બેંકમાં જમા કરાવે છે અને આ જમા રકમમાંથી જ બધા વ્યાપારી ખર્ચ ચુકવે છે. આ તશીવતોને ઘાનમાં વાણીજ્ય વ્યવસ્થા



રાખીને જ બેંકો લોકોના હેતુને અનુકૂળ આવે અને તેમને સગવડતા રહે તે માટે બિન્ન બિન્ન પ્રકારના ડિપોઝિટ ખાતા ખોલવાની સુવિધા આપે છે.

બેંકો જે હેતુ સારે છે તેના આધારે બેંક ડિપોઝિટના ખાતાનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.

- ક. બયત બેંક ખાતું
- ખ. ચાલુ જમા ખાતું.
- ગ. સાવધિ જમા ખાતું.
- ઘ. આવતી જમા ખાતું.

આંદો ઉપરોક્ત ખાતાના સ્વરૂપ વિષે ટૂંકમાં જાણીએ.

ક. બયત બેંક ખાતું:-

જો કોઈ વ્યક્તિની આવક મર્યાદિત હોય અને ભવિષ્યની જરૂરિયાતો માટે પૈસા બચાવવા છીંછે તો તેને માટે બયત બેંક ખાતું સૌથી વધુ સાનુકૂળ છે. આ ખાતું અમુક પ્રારંભિક લઘુતમ રકમ જમા કરાવી ખોલાવી શકાય છે. આ લઘુતમ રકમ બેંકે બેંકે અલગ હોઈ શકે છે. આ ખાતામાં પૈસા ગમે ત્યારે મૂડી શકાય છે અને (ઉપાડ) વિદ્રોધિ ફોર્મમાં સહી કરી અથવા ચેક આપી અથવા ATM કાર્ડની મદદથી પૈસા ઉપાડી શકાય છે. સામાન્ય રીતે બેંક આ ખાતામાંથી પૈસા ઉપાડવાની સંખ્યા ઉપર અમુક અંકુશ મૂકે છે. વ્યાજ જમા રકમની બચેલી સિલક ઉપર મળે છે અને વળી વખતોવખત તેમાં ફેરફાર પણ થાય છે. બેંકે નક્કી કર્યા મુજબની લઘુતમ રકમની સિલક ખાતામાં જાળવવી પડે છે.

ખ. ચાલુ જમા ખાતું:-

મોટા મોટા વેપારીઓ, કંપનીઓ અને શાળા, કોલેજ કે હોસ્પિટલ જેવી સંસ્થાઓને પોતાના બેંકના ખાતા દ્વારા પૈસા ચૂકવવાના હોય છે. બયત બેંક ખાતામાંથી ઉપાડ કરવાની સંખ્યા ઉપર નિયંત્રણ હોય છે. તેથી આ જાતનું ખાતું તેમને માટે અનુકૂળ નથી. તેમને એવા ખાતાની જરૂર છે કે જેમાંથી તેઓ ધારે તેટલી વાર ઉપાડ કરી શકે. બેંકો તેમના માટે ચાલુ ખાતા ખોલે છે. બયત બેંક ખાતાની માફક આ ખાતું પણ ખોલાવવા માટે તેમાં અમુક લઘુતમ રકમ મૂકી જરૂરી છે. આ જમા ખાતામાં બેંક સિલક ઉપર કશું જ વ્યાજ આપતી નથી. ઉલટાનું ખાતેદારે ખાતું ચલાવવા માટે દર વર્ષ ખર્ચ પેટે અમુક રકમ ચૂકવવી પડે છે.

બેંકો પણ ખાતેદારોની સગવડ સાચવવા ખાતામાં કુલ જમા રકમ કરતાં વધુ ઉપાડની છૂટ આપે છે. આને ઓવર ડ્રાફ્ટની સગવડતા કહે છે. આવી સુવિધા ખાસ વિશિષ્ટ ગ્રાહકોને જે તે બેંક સાથે અગાઉ કરાર કર્યા મુજબ અમુક મર્યાદામાં આપવામાં આવે છે.

ગ. સાવધિ જમા ખાતું (FD એકાઉન્ટ):-

બેન્કિંગ સેવાઓ

આને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ પણ કહે છે. ઘણી વખત લોકો લાંબા સમય માટે પૈસા બચાવવા ઈચ્છે છે. જો પૈસા બચત બેંક ખાતામાં મૂકવામાં આવે તો બેંકો નીચા દરે વ્યાજ આપે છે. તેથી વધુ વ્યાજ કમાવા માટે પૈસાને (ફિક્સડ ડિપોઝીટ) "સાવધિ જમા ખાતામાં" મૂકવામાં આવે છે.

આ પ્રકારના જમા ખાતામાં રકમ અમુક નિશ્ચિત સમય સુધી જમા કરવામાં આવે છે. આ અવધિ ૧૫ દિવસથી માંઠીને ઉ વર્ષ કે તેથી વધુ સમય માટેની હોય છે. આ દરમિયાન ઉપાડ કરવાની છૂટ હોતી નથી. તેમ છતાં જમાકર્તાની વિનંતીથી રકમ પાકતી તારીખ પહેલાં ઉપાડવા દેવામાં આવે છે.

આવ કિસ્સામાં બેંક અગાઉ નક્કી કર્યા કરતાં ઓછું વ્યાજ આપે છે. જ્યારે સાવધિ જમા રકમ ઉપરનું વ્યાજ નિશ્ચિત સમયાંતરે ઉપાડી શકાય છે. અવધિ સમાપ્ત થતાં જમા રકમ ઉપાડી શકાય છે અથવા તેને બીજા સમયગાળા માટે ફરીથી મૂકી શકાય છે. બેંકો સાવધિ જમાની રસીદની જામીનગીરી ઉપર લોન પણ આપે છે.

૮. આવતી જમા ખાતું:-

આ ખાતું એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ નિયમિત બચત કરી શકતા હોય અને નિશ્ચિત સમય બાદ જમા રકમનું સારું એવું વળતર મેળવવાની અપેક્ષા રાખતા હોય. ખાતું ખોલતી વખતે વ્યક્તિને અમુક સમય સુધી દર મહિને અમુક રકમ જમા કરવાનું કબૂલ કરવું પડતું હોય છે. અવધિ પૂરી થતાં (પાકતી તારીખે) સમગ્ર જમા થયેલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે. તેમ છતાં રકમ જમા કરાવનાર પાકતી તારીખ પહેલા પણ પોતાનું ખાતું બંધ કરાવી શકે છે અને ત્યાં સુધીના સમયગાળાના વ્યાજ સહિત કુલ રકમ પરત મેળવી શકે છે. ખાતું માણસ વ્યક્તિગત રીતે અથવા બીજા સાથે સંયુક્ત રીતે અથવા તો સગીરના નામે વાલી તરીકે ખોલાવી શકે છે. આ ખાતાની જમા રકમ ઉપર વ્યાજનો દર બચત બેંક ખાતાના વ્યાજના દર કરતાં ઉચ્ચો અને સાવધિ જમા પરના વ્યાજ કરતાં નીચો હોય છે.



૮.૪ પાઠગત પ્રશ્નો

અ. નીચેનામાંથી કયાં વિધાનો ખરાં છે કે ખોટાં છે ?

- બચત બેંક ખાતામાં મૂકેલી રકમ વર્તમાન તેમજ ભાવિ જરૂરિયાતો પૂરી કરવા કામમાં આવે છે.
- સાવધિ જમા ખાતામાં નિશ્ચિત રકમ દર મહિને મૂકવી પડે છે.
- આવતી જમા ખાતામાં મૂકેલી રકમનો વ્યાજનો દર બચત બેંક ખાતાનાં દર કરતાં પ્રમાણમાં ઉચ્ચો હોય છે.
- ચાલુ જમા ખાતું માત્ર વ્યાપારીઓ જ ખોલાવી શકે છે, શૈક્ષણિક સંસ્થાઓ નહિ.

મોડયુલ - ૩ સેવાના ક્ષેત્ર



નોંધ



૫. ગૃહનિર્માણ બચત જમા ખાતું આવતી જમા ખાતાનો જ એક પ્રકાર છે.
 ૬. સાવધિ જમા ખાતા ઉપર મળતું વ્યાજ જેટલા સમયગાળા માટે રકમ મૂકી હોય તેની (લંબાઈ) લાંબા સમયગાળા ઉપર આધારિત હોય છે.
 ૭. બચત બેંક ખાતામાંથી ઉપાડ માત્ર ખાતા ધારક જ કરી શકે છે.
 ૮. બેંક ચાલુ જમા ખાતા ઉપર વ્યાજ દેતી નથી.
૯. યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરો
 ૧. બચત બેંક ખાતું ધનરાશિથી ખોલી શકાય છે.
 ૨. સાવધિ જમા ખાતું જે દરે વ્યાજ આપે છે. તે દર બચત બેંક ખાતાના વ્યાજના દર કરતાં હોય છે.
 ૩. ઓવરડ્રાઇટની સગવડ જમા ખાતા ધારકોને મળે છે.
 ૪. ચાલુ ખાતામાંથી પૈસા આપીને ઉપાડી શકાય છે.
 ૫. આવતી જમા ખાતની સિલક ઉપર વ્યાજનો દર સાવધિ જમા ખાતા પર મળતા વ્યાજના દર કરતાં હોય છે.

૮.૮ બચત બેંક ખાતું કેવી રીતે ખોલવું

કોઈ વાણિજ્ય બેંકમાં બચતખાતું ખોલાવવા માટે તમારે શરૂઆતમાં કેટલી રકમ તમે જમા કરાવવા માગો છો તે નક્કી કરી લેવું પડે. તમે તમારી નજીકમાં નજીકની કોઈ બેંકમાં જઈને બચત બેંક ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓવી કેટલી રકમ જમા કરાવવી પડે તે જાણી શકો. તમારે ઓછામાં ઓછી એટલી રકમ અથવા તેથી વધુ રકમ જમા કરાવી શકો. બેંકમાં (કે તેની કોઈપણ શાખામાં) પ્રવેશતાં જ તમને પુછપરછ માટેની બારી (અથવા 'હું આપને મદદ કરી શકું? એવા બોર્ડ વાળી બારી) જોવા મળશે. જમા કરાવવાની લઘુત્તમ રકમ વિષે જાણી લીધા પછી તમારે બેંકમાં બચત જમા ખાતું ખોલવા માટે આવેદનપત્ર (ફોર્મ)ની માંગણી કરવી જોઈએ. આ ફોર્મ માટે તમારે પૈસા આપવાના હોતા નથી. ત્યાર પછી તમારે નીચેનાં પગલાં ભરવા જોઈએ.

૧. આવેદનપત્ર ભરવું:-

આવેદન પત્રમાં નીચેની જરૂરી માહિતી ભરવી જોઈએ.

- ક. અરજદાર (વ્યક્તિ)નું નામ.
- ખ. તેનો / તેણીનો ધંધો.
- ગ. રહેઠાણાનું સરનામું.
- ઘ. અરજદારની નમુનાની સહી.
- ચ. અરજદારની ઓળખાણ આપનારનું નામ, સરનામું, ખાતા નંબર અને સહી.

આ માહિતી આપવા ઉપરાંત તમારે જે તે કાળે અલખમાં હોય તે બેંકના નીતિ નિયમો અને શરતોનું પાલન કરવાની બાહેધરી પણ આપવી પડશે. આવેદન પત્ર નીચે તમારે

વાણિજ્ય વ્યવસ્થા

બેન્કિંગ સેવાઓ

સહી કરવી પડે છે. (કેટલીક બેંકોમાં આવેદનપત્ર સાથે અરજદારના બે ફોટો સંલગ્ન કરવા પડતા હોય છે.)

૨. યોગ્ય ઓળખાણ (પરિચય):-

દરેક બેંક માટે એ જરૂરી હોય છે કે અરજી કરનાર (આવેદક) ની ઓળખાણ આપનાર બેંકનો જાણીતો માણસ હોવો જોઈએ. કોઈ વ્યકિતનું ખાતું પહેલેથી જ બેંકમાં હોય તે ઓળખાણ આપે તો તે સગવડતા ભર્યું રહે. કેટલીક બેંકો અરજદારના પાસપોર્ટ અથવા ડ્રાઇવીંગ લાયસન્સની પ્રમાણિત નકલ સ્વીકારતી હોય છે. આમ, હોય તો અંગન ઓળખાણની જરૂર રહેતી નથી. ઓળખાણ એટલા માટે જરૂરી છે કે કોઈ અનિયન્ત્રિત (સંદિગ્ધ) વ્યકિતને ખાતું ખોલાવતાં રોકી શકાય.

૩. નમુનાની સહી (હસ્તાક્ષર):-

આવેદકે આવેદનપત્રમાં નક્કી કરેલ જગ્યાએ પોતાની નમુનાની સહી કરવાની હોય છે. આ ઉપરાંત અરજદારે એક અન્ય કાર્ડ ઉપર પણ નમુનાની સહી કરવાની હોય છે. આ કાર્ડ ઉપર પણ નમુનાની સહી કરવાની હોય છે. આ કાર્ડ ઉપર અરજદારનો પોતાનો ફોટો ચીપકાવવામાં આવે છે અને તેના ઉપર તેનું નામ અને ખાતા નંબર લખેલા હોય છે.

ઉપરના પગલાં ભર્યા પછી (વિધિ પૂર્ણ કર્યા પછી) અને પછી સંબંધિત અધિકારીને સંતોષ થાય કે આવેદનપત્ર બરાબર છે તે પછી એક છાપેલી પે-ઈન-સ્લીપ (પૈસા જમા કરાવવાની કાપલી) ભરીને રોકડની બારી ઉપર રકમ જમા કરાવવાની હોય છે. ત્યારપછી તમને ખાતા નંબર ફાળવવામાં આવે છે. આ નંબર તમારા અરજીપત્રક ઉપર તેમજ તમારી નમુના સહી ધરાવતા કાર્ડ ઉપર લખવામાં આવે છે. આ સાથે જ તમે જે પ્રારંભિક રકમ (ખાતું ખોલાવવા) જમા કરી હોય તેની નોંધ કરેલી એક પાસબુક તમને આપવામાં આવે છે. ભવિષ્યની બંધી જમા તેમજ ઉપાડની રકમમાં તેમાં નોંધવામાં આવે છે. આ પાસબુક તમારી પાસે જ રહે છે. જો તમે તમારી જમા રકમમાંથી ઉપાડ કરવા માટે કે તમારા ખાતામાંથી પૈસા ચૂકવવા માટે ચેકપો ઉપયોગ કરવા માગતા હો તો તમને તમારી માગણીથી ચેકબુક આપવામાં આવે છે. ચેક એક છાપેલું ફોર્મ હોય છે તેના ઉપર તમે તેના ઉપર નિર્દિષ્ટ જગ્યાએ બેંકને અમુક વ્યકિતને રકમ આપવાનો ઓર્ડર આપી શકો છો.

૮.૯ બચત બેંક ખાતું ચલાવવાની પદ્ધતિ

તમે આ રીતે ખાતું ખોલાવ્યા બાદ ખાતાનું સંચાલન કેવી રીતે કરવું તે તમારે જાણવું જોઈએ, બીજા શબ્દોમાં કહીએ તો તમારા ખાતામાં વધારે જમા રકમ ભરવા કે પૈસા ઉપાડવા માટેની પદ્ધતિ વિષે તમારે જાણવું જોઈએ.

૧. ખાતામાં રકમ જમા કરાવવા બાબત:-

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

મોડયુલ - ૩

સેવાના ભેત્ર



નોંધ

બેન્કિંગ સેવાઓ

તમે તમારા ખાતામાં પૈસા કઈ રીતે જમા કરાવશો? તમે અગાઉ ખાતું ખોલાવતી વખતે પ્રારંભિક રકમ જમા કરાવવા માટે પે-સ્લીપ વાપરી ચુક્કા છો. આ એક છાપેલું ફોર્મ છે, જે બેંકમાં મળે છે. દરેક પે-સ્લીપમાં બે ભાગ હોય છે જે કાણાં કાણાં વાળી લાઇનથી જુદા પાડેલ હોય છે, તેમાં જમણી બાજુના ભાગને 'ફોર્ઝિલ' તથા ડાબી બાજુના ભાગ ને 'કાઉન્ટર ફોર્ઝિલ' કહે છે. રોકડ રકમ કે ચેક જમા કરાવતી વખતે પે-સ્લીપ ભરવી પડે છે. રોકડ અને ચેક એમ બંને ભરવા હોય તે બે અલગ અલગ સ્લીપ ભરવી પડે છે.

ધારો કે તમારે ખાતામાં રોકડ જમા કરાવવી છે. તો તમારે પે-સ્લીપ ભરવી પડે છે. તેમાં જમા કરવાની તારીખ, તમારું નામ અથવા કોઈ બીજાના ખાતામાં પૈસા ભરવા હોય તો તેનું નામ, ખાતા નંબર અને જમા કરેલી રકમ (આંકડાં) સંખ્યામાં તેમજ શબ્દોમાં લખવાની હોય છે. આ ઉપરાંત તમારે પે-સ્લીપમાં મુકરર કરેલી જગ્યાઓ જુદા જુદા મુશ્કેલી (એટલે કે રૂ.૫, ૧૦, ૨૦, ૪૦, ૧૦૦ વગેરે) કેટલી ચલણી નોટો છે તે અને તેની સામે તેનું મૂલ્ય વગેરે વિગતો જણાવવી પડે છે. બેંકમાં રોકડ જમા કરાવવા માટે એક બારી હોય છે. તમારે પે-સ્લીપ ઉપર સહી કરીને ત્યાં રજૂ કરવી પડે છે અને સાથે જ રોકડ રકમ પણ ત્યાં જ આપવાની હોય છે. રોકડ સ્વીકારનાર જમણી ફોર્ઝિલ પોતાની પાસે રાખી લે છે અને ડાબી બાજુની કાઉન્ટર ફોર્ઝિલ રખ્ખર સ્ટેમ્પ મારી પોતાની સહી કરીને તમને પરત આપે છે.

 STATE BANK OF INDIA ACCOUNT NUMBER : 32114355590 BRANCH : MUMBAI DATE : 10.06.2022 AMOUNT : ₹ 500/- SIGNATURE : [Signature]	 STATE BANK OF INDIA BRANCH : MUMBAI DATE : 10.06.2022 AMOUNT : ₹ 500/- SIGNATURE : [Signature]
---	---

પે-સ્લીપ નો નમૂનો

હવે ધારો કે તમારે રોકડ ને બદલે તમે જે કાર્યાલયમાં કામ કરતા હો તેમાંથી તમને પગાર પેટે ચેક મણ્યો હોય તે તમારે જમા કરાવવો છે. તો તમે તેને કોઈ બીજી બેંકમાં જઈને રોકડ કરવાને બદલે તમારી બેંકમાં તમારા ખાતામાં જમા કરવાનું પસંદ કરશો. તમારી બેંક ચેકની રકમ મેળવી લેશે અને તમારા બચત બેંક ખાતામાં જમા કરશે.

તમારે તેક જમા કરાવવો હોય તો પણ તમારે ફરી પે-સ્લીપ જ વાપરવી પડશે.

તેમાં તમારે જમા કરવાની તારીખ, તમારો ખાતા નંબર, ખાતા ધારકનું નામ, ચેકનો ક્રમ નંબર તથા તારીખ જે બેંક ઉપર ચેક લખ્યો હોય તેનું નામ અને સરનામું અને ચેકની રકમ આંકડામાં તથા શબ્દોમાં એમ બધી વિગતો દર્શાવવી પડે છે. પછી સ્લીપમાં સહી કરીને ચેકને ટંકણીથી ફોર્ઝિલ સાથે જોડીને ચેક સ્વીકારની બારી ઉપર

બેન્કિંગ સેવાઓ

તમારે તે રજૂ કરવાનું હોય છે. બારી ઉપર ચેક સ્વીકારનાર વ્યક્તિ ચેક સાથેની ફોર્મલ પોતાની પાસે રાખી લેશો અને કાઉન્ટર ફોર્મલ ઉપર બેકનો રખ્ખર સ્ટેમ્પ લગાવીને પોતાની સહી કરીને તમને પરત કરશો. કેટલીક બેકોમાં બારી પાસે એક બોક્સ (પેટી) રાખવામાં આવે છે. બારી ઉપર રખ્ખર સ્ટેમ્પ પણ મોજૂદ હોય છે. જ્મા કરાવનાર ફોર્મલ અને કાઉન્ટર ફોર્મલ પર રખ્ખર સ્ટેમ્પ લગાડે છે અને પછી કાઉન્ટર ફોર્મલ જુદી પાડીને ચેક સાથેની ફોર્મલ પેટીમાં રહેલી તીરાડ દ્વારા પેટીમાં નાખે છે.

૨. જ્મા ખાતામાંથી ઉપાડ:-

તમે તમારા ખાતામાં બચત ભવિષ્ય માટે જ્મા કરાવો છો ગમે ત્યારે તમને પૈસાની જરૂર પડી શકે. તેથી બેકમાંથી પૈસા કેવી રીતે પાછા મેળવવા તે તમારે જાણી લેવું જોઈએ. ઉપરના વિભાગમાં તમે બચત ખાતામાં પૈસા જ્મા કરાવવાની રીત શીખી ગયા છો. આવો હવે તમારા ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા સમજીએ.

નીચેનાનો ઉપયોગ કરી બેકમાંથી પૈસા ઉપાડી શકાય છે.

- ક. રૂપિયા ઉપાડવાનું ફોર્મ
- ખ. ચેક
- ગ. એ.ટી.અમ. કાર્ડ

ક. રૂપિયા ઉપાડવાનું ફોર્મ:-

દરેક બેકમાં ઉપાડ માટેનું છાપેલું ફોર્મ હોય છે. તેનો ઉપયોગ ખાતા ધારક પોતાના ખાતામાંથી ઉપાડ કરવા માટે કરી શકે છે.

આ ફોર્મ ભરી તેમાં ઉપાડની તારીખ, ખાતા નંબર, ઉપાડવાની રકમ (આંકડામાં તેમજ શબ્દોમાં) અને ખાતા ધારકની સહી વગેરે દશા વવાનાં હોય છે. તે ફોર્મ તમારે તમારી પાસબુક સાથે રાખીને જે બારી ઉપર તમારા ખાતાનું સંચાલન થતું હોય ત્યાં રજૂ કરવું પડે છે. બારી ઉપર સામાન્ય રીતે જે તે અધિકારી તમારા ખાતામાં જ્મા સિલકની ચકાસણી કરી અને તમે ફોર્મ ઉપર કરેલ નમુનાની સહી તને કાર્ડ ઉપર કરેલી સહી સાથે મેળવીને ફોર્મ પૈસા ઉપાડવા માટે પાસ કરી દે છે. ઉપાડની રકમ તમારી પાસબુકમાં નોંધવામાં આવે છે. અને જો ઉપાડ અમૃક ચોક્કસ મર્યાદામાં (દા.ત.રી.૫૦૦૦/-) હોય તો તમને બારી ઉપર પૈસા ચૂકવી દેવામાં આવે છે. નહીંતર તમને અમૃક નંબર છાપેલો ટોકન આપવામાં આવે છે. અને આ ટોકન ઉપાડની રકમ મેળવવા માટે નગદ બારી (કેશ કાઉન્ટર) ઉપર રજૂ કરવો પડે છે.

ખ. ચેક:-

ખાતા ધારક તરીકે તમે તમારા બચત ખાતામાંથી રકમ ઉપાડવાનું ફોર્મ ભરીને સહી કરીને ઉપાડી શકો. અથવા ચેકથી ઉપાડી શકો છો. ખાતામાંથી ઉપાડ કરવાનું ફોર્મ માત્ર ખાતાધારક જ વાપરી શકે છે. અન્ય કોઈ નહિ, જ્યારે તેક કોઈ બીજી પાર્ટીઓને ચુકવણું કરવા માટે પણ વાપરી શકાય છે.

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

મોડયુલ - ૩
સેવાના ભેત્ર



નોંધ

બેન્કિંગ સેવાઓ	20.....
Pay toor Bearer
Rupees.....	
STATE BANK OF INDIA	
J.N.U., N.Delhi	Rs.
MSBL/97	
6 5 3 0 0 3 1 1 0 0 0 2 0 5 6 1 0	Signature

ચેક

આ રીતે અન્ય કોઈ વ્યક્તિને આપેલો ચેક બેંકમાંથી તે પોતે વટાવીને રોકડ પૈસા લઈ શકે છે અથવા બીજી કોઈ બેંકમાં પોતાના ખાતામાં તેના વતી એકત્રિત કરવા માટે જમા કરાવી શકે છે.

ચેક રજૂ કરીને પૈસા ઉપાડવામાં પણ પૈસા ઉપાડવાનું ફોર્મ ભરીને સહી કરીને પૈસા ઉપાડવાની ઉપર દર્શાવેલી તમામ પ્રક્રિયા કરવી પડે છે. આ બંને કિસ્સામાં ઉપાડની રકમ બેંકના ચોપડામાં જે તે સંબંધિત બચત બેંક ખાતામાં નોંધવામાં આવે છે. અને આ બધી નોંધો જ્યારે પણ ખાતા ધારક પોતાની પાસબૂક બેંકમાં રજૂ કરે ત્યારે તેમાં નોંધી દેવામાં આવે છે.

ગ. એ.ટી.એમ. કાર્ડ:-

ખાતાધારક પોતાના ખાતામાંથી સરળ રીતે પૈસા ઉપાડી શકે તે માટે બેંકો ખાતેદારોને એ.ટી.એમ.કાર્ડ આપે છે. આ કાર્ડનો ઉપયોગ ચાલુ જમા ખાતું કે બચત બેંક ખાતું એમ બંનેમાંથી રકમ સ્વયંસંચાલિત ટેલર મશીન (ATM) દ્વારા ઉપાડવા માટે કરી શકાય છે. આ એક ચુંબકીય કાર્ડ છે. અને અમૃક ચોકક્સ ગુપ્ત નંબરથી તેનું સંચાલન કરી શકાય છે. પૈસા ઉપાડવાની આ સર્વોત્તમ સરળ રીત છે.

ટેલર બારીઓ:-

જમા ખાતામાંથી રકમ ઉપાડવા માટે ઝડપી લેવડ-દેવડ માટે બેંકોમાં ટેલર બારીઓ રાખવામાં આવે છે. આ ટેલર બારી બે જાતની હોય છે.

- ક. માનવ સંચાલિત ટેલર બારી અને
- ખ. સ્વયં સંચાલિત ટેલર બારી.


સામાન્ય રીતે માનવ સંચાલિત ટેલર બારીમાં બચત બેંક ખાતામાંથી અમૃક ચોકક્સ મર્યાદા સુધી રકમ ઉપાડવાની છૂટ આપે છે. ચેક કે ઉપાડનું ફોર્મ બારી ઉપર રજૂ કરવામાં આવે છે અને ખાતામાં સિલકની ચકાસણી કરીને અને ખાતેદારની નમુનાની સહી મેળવીને ખાતરી કરીને રકમ ચૂકવવામાં આવે છે.



બેન્કિંગ સેવાઓ

સ્વયં સંચાલિત ટેલર ક્રાઉન્ટર પર ATM (ઓટોમેટેડ ટેલર મશીન) સ્થાપી દેવામાં આવે છે. જેમાં ચોવીસેય કલાક જરા પણ રૂકાવટ વગર રકમની લેવડ – દેવડ થઈ શકે છે. આમા તમારી સિલકની ચકાસણી કરવા, નમુનાની સહી સરખાવવા કે અથવા રકમ તમને આપવા કે તમારી પાસેથી સ્વીકારવા કોઈ માણસની જરૂર પડતી નથી. ચાલો આપણો જોઈએ કે ATM મશીન કઈ રીતે કાર્ય કરે છે.

જ્યારે બેંક ATM મશીન સ્થાપે છે ત્યારે દરેક ખાતેદારને બક એક ચુંબકીયકાર્ડ ગુપ્ત કોડ નંબર સાથે આપે છે. આ (ગુપ્ત) કોડ નંબર ને (PIN) કહેવામાં આવે છે. કાર્ડ ધારકને જ્યારે પૈસા ઉપાડવા કે જમા કરાવવા હોય ત્યારે પ્રથમ તો તેણે પોતાનો (PIN) 'વ્યક્તિગત ઓળખાણ નંબર' દર્શાવીને ATM મશીન સંચાલન માટે ઓળખાણ સાબિત કરવી પડે છે. જ્યારે ATM કાર્ડ મશીનમાં દાખલ કરવામાં આવે ત્યારે તે તમારો PIN દાખલ કરવા માટે તમારે કાં તો કી બોર્ડનો ઉપયોગ કરવો પડે અથવા તો મશીનના પર્દા (ઝીન) ને સ્પર્શ કરવો પડે— એકવાર તમારી ઓળખાણ નક્કી થઈ જાય પછી બહુ જ સરળ રીતે મશીન જે સુચના આપે તે રીતે પૈસા ઉપાડી કે જમા કરાવી શકાય. પૈસા જમા કરાવવા માટે ATM કેન્દ્ર ઉપર રાણી મૂકુવામાં આવેલા એક ખાસ પરબીડિયામાં તમારે તે કવરને તમારે મશીનની તીરાડ પાસે રાખવું ત્યાર પછી ડીપોઝીટનું બટન દબાવતાં પરબીડિયું આપમેળે જ મશીનમાં દાખલ થઈ જશે. બેંકના અધિકારીઓ નિયમિત રીતે અમુક સમય બાદ તે કવરો કાઢી લે છે અને કવરની રકમ જે તે ખાતામાં જમા કરી દે છે.



એ.ટી.એમ. કાર્ડના નમૂના

એ જ રીતે પૈસા ઉપાડવા માટે પણ ઉપાડ બટનને દબાવવું કે સ્પર્શ કરવો પડે અને ત્યાર પછી જરૂરી રકમનો ઉલ્લેખ કરવો પડે અને તમારી જરૂરી રકમ તમને તુરત જ મશીનની નીચેના (નિકાસ) ખાનામાં મળી જશે.



૬.૫ પાઠગત પ્રશ્નો

૧. નીચેના કયા વિધાનો ખરાં છે કે ખોટા છે?
 ૧. બચત બેંક ખાતું ખોલવા માટે પે-સ્વીપનો ઉપયોગ કરવો પડે.
 ૨. જો ખાતા ધારક બચત બેંક ખાતામાંથી ઉપાડ કરવા માટે ચેકનો ઉપયોગ કરતો હોય તો તે ઉપાડનું ફોર્મ વાપરી શકે નહીં.
 ૩. બચત બેંક ખાતું ધારણ કરનાર બચત બેંક ખાતું ખોલવાના સમયે કોઈ અન્ય વ્યક્તિગતી ઓળખાણ આપી શકે નહીં.





૪. બેંક જમા રકમ અને ઉપાડ નોંધ શકે તે માટે ખાતેદારે પાસબૂક રજૂ કરવી જોઈએ.
 ૫. ખાતું ખોલવા માટેની અરજીનું ફોર્મ બેંક તરફથી મફત આપવામાં આવે છે.
 ૬. જ્યારે ચેક દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિને ચુકવણું કરવાનું હોય ત્યારે ચેક ઉપર તેનુંનામ લખવું જોઈએ.
 ૭. જો ખાતા ધારક માગણી કરે તો જ બેંક ચેકબૂક આપે છે.
 ૮. બચત બેંક ખાતું ખોલાવ્યા પછી તુરત જ બેંક પાસબૂક આપે છે.
૨. યોગ્ય ખાતી જગ્યા પૂરો
૧. બેંક પે-સ્લીપની કાઉન્ટર ફોર્મલ ને પાછી આપે છે.
 ૨. પે-સ્લીપની જમણી બાજુના ભાગને કહે છે.
 ૩. જમા કરાવતા પહેલાં ચેક પે-સ્લીપની ઉપર લગાડવો પડે છે.
 ૪. ચેકનું ચુકવણું કરતા પહેલા ખાતેદારની સહીની સાથે ચકાસણી કરવામાં આવે છે.
 ૫. ટેલર પદ્ધતિ ખાતેદારને રોકડના ઝડપી માં મદદ કરે છે.
 ૬. બચત બેંક ખાતામાં રોકડ રકમ બારી ઉપર જમા કરાવી શકાય છે.

૮.૧૦ ઈ-ઇલેક્ટ્રોનિક બેન્કિંગ

સૂચના અને સંચારની આધુનિક તકનીકીના વિકાસ સાથે બેંકીંગ સેવા પણ હવે કોમ્પ્યુટર દ્વારા સુલભ બની છે. હાલમાં મોટાભાગની શાખાઓમાં તમે બેંકીંગ વ્યવહારોની નોંધ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો જોઈ શકશો. તમારા જમા ખાતામાં કેટલી સિલાક છે તેની માહિતી તમે કોમ્પ્યુટર દ્વારા મેળવી શકશો. હાલમાં મોટા ભાગની બેંકોમાં પૈસાની લેવડટેવડ કરનાર માણસના કાઉન્ટર (બારી)નું સ્થાન હવે "ઓટોમેટેડ ટેલર મશીન" (ATM) લીધું છે. કોમ્પ્યુટરો અને અન્ય સંચારના વિજાણું માધ્યમો દ્વારા ચાલતી બેંકીંગ પ્રવૃત્તિને "ઇલેક્ટ્રોનિક બેંકીંગ" અથવા 'ઈ-બેંકીંગ' કહેવામાં આવે છે. આલો આપણે ભારતમાં વપરાતી કેટલીક બેંકીંગની આધુનિક વિધિઓ વિષે ચર્ચા કરીએ.

સ્વયંસંચાલિત ટેલર (લેવડટેવડ) મશીન (યંત્ર) (ATM):-

હાલમાં બેંકોએ સંપૂર્ણ ભારતમાં સાનુકૂળ જગ્યાઓને ATM મશીનો લગાવ્યા છે. આના ઉપયોગથી ગ્રાહક ગમે ત્યારે પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી મૂકી શકે છે.

બેન્કિંગ સેવાઓ

ડેબિટ કાર્ડ:-

બેંકો હાલમાં પોતાના ગ્રાહકો જે ચાલુ કે બચત ગમે તે ખાતું ધરાવતા હોય તેમને ડેબિટકાર્ડ આપે છે. ગ્રાહકો વિવિધ સ્થળોએ માલ-સામાન કે સેવાઓ ખરીદવા માટે રોકડ રકમની જગ્યાએ આ ડેબિટકાર્ડનો ઉપયોગ કરી શકે છે. ડેબિટકાર્ડ આ ચૂકવાયેલી રકમ આપોઆપ ગ્રાહકના ખાતામાં ઉધરાઈ (બાદ થઈ) જાય છે.



ડેબિટ કાર્ડ

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

ક્રેડિટ કાર્ડ:-

જે લોકોનું ખાતું બેંકમાં હોય કે ન પણ હોય તેમને બેંક ક્રેડિટ કાર્ડ આપે છે, ડેબિટ કાર્ડની માફફ જ ક્રેડિટ કાર્ડ પણ ખરીદીની રકમ ચૂકવવા માટે વપરાય છે. જેથી વ્યક્તિ એ પોતાની સાથે રોકડ રકમ લઈ જવાની જરૂર પડતી નથી. ક્રેડિટકાર્ડ ધરાવનારને બેંક અમુક નિર્ધારિત સમયગાળામાં ક્રેડિટની રકમ ચૂકવી આપવાની છૂટ આપે છે. જો કાર્ડધારક નિર્ધારિત સમયગાળામાં તેની ક્રેડિટ રકમ પાછી ભરપાઈ ન કરી શકે તો બેંક તેની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. આ વ્યાજ નો દર સામાન્ય રીતે ઘણો ઉચ્ચો હોય છે.



ક્રેડિટ કાર્ડ

નેટ બેન્કિંગ:-

ઇન્ટરનેટની સુવિધા દ્વારા બેંક અને ખાતેદાર વચ્ચે નાણાંકીય વ્યવહારની લેવડ દેવડ થાય છે. ઇન્ટરનેટ દ્વારા સમગ્ર બેન્કિંગ વ્યવહારો સરળ રીતે કરી શકાય છે. બધીજ બેંકોના કોમ્પ્યુટર ઇન્ટરનેટના જોડાણથી સુસજ્જ કરી નાણાંકીય વ્યવહારોની એકસૂત્રતત્ત્વ જાળ વામાં આવે છે. ઇન્ટરનેટની બેન્કિંગ કાર્ય કરી શકે છે. નેટ બેન્કિંગના સહયોગથી તમારા ખાતામાં રહેલું બેલેન્સ જાણી શકો છો. પરંતુ ફિક્સ ડિપોઝિટ મુકી શકો છો. બંડોણી હેરફેર કરી શકો છો. લાઈટનું બીલ, ટેલિફોન કે મોબાઇલ બીલ કે અન્ય ચૂકવણી પણ ઇન્ટરનેટ દ્વારા કરો શકો છો. વર્તમાન સમયમાં નેટબેન્કિંગના કારણે તમારી બેંકોના ખાતા સાથે તમારા અન્ય બેંકના ખાતા સાથે જોડી શકાય છે. જેથી કોમ્પ્યુટરના મોનીટર પર એક સ્થળે એક જ સમયે જુદી જુદી બેંકમાં રહેલા ખાતા ઉપયોગ કરી શકો છો.



નેટ બેન્કિંગ પદ્ધતિ



નેટ બેંકિંગ તમારા ઘરે ઈન્ટરનેટની મદદથી તમારા બેંકિંગ ક્રાયો કરવાની સુવિધા આપે છે. ઓન લાઈન બેંકિંગ સુવિધાથી ખાતેદારને રોજિંદા બેંકિંગ કાર્યો જેવા કે ભંડોળની ફેરબદલ, બેલેન્સની જાણકારી, બિનોની ચૂકવણી અને સ્ટોપ પેમેન્ટની વિનંતી ઉપરાંત લોન અને કેડિટ કાર્ડની અરજી પણ કરી શકો છો. ઓન લાઈન બેંકિંગ સુવિધા કોઈ પણ સ્થળથી કોઈ પણ સમયે મેળવી શકો છો. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી તમામ બેંકોના વ્યવહારો સુસજ્જ બનાવામાં આવ્યા છે. ખાતેદાર પોતાના કોમ્પ્યુટરમાં બેંકની વેબસાઈટમાં જઈને લોગ-ઇન કરી પોતાના ખાતાની માહિતી મેળવી શકે છે.

ખાતેદાર બિલોની ચૂકવણી, મની ટ્રાન્સફરની સુવિધા, ફિક્સડ ડિપોઝિટ અને બાકી બિલોના નાણાં પણ મેળવી શકે છે.

ફોન બેંકિંગ:-

ફોન બેંકિંગ દ્વારા ખાતેદાર આ સુવિધા મેળવી ચોવીસ કલાકના સમય દરમ્યાન ગમે ત્યારે ટેલિફોન દ્વારા બેંકની સેવાઓનો લાભ લઈ શકે છે. ફોન પર નાણાંની ચૂકવણી, નાણાંની તથાદીલ, લોનની માંગણી ઉપરાંત વ્યક્તિગત મુલાકાત જેવી જ સુવિધાઓ ટેલિફોન દ્વારા મેળવી શકાય છે. ફોન બેંકિંગ દ્વારા ખાતેદાર પોતાના ખાતાની સંપૂર્ણ માહિત જાણી શકે છે, ફિક્સડ ડિપોઝિટ કરી શકે છે, નાણાંની હેરફેર કરી શકે છે. ડિમાન્ડ ટ્રાફટ મેળવી શકે છે કે પોતાના બાકી રહેલા બીલના નાણાં મેળવી શકે છે. વર્તમાન સમયમાં મોબાઈલ ફોનની ઉપયોગીતા વધતા વધુ ને વધુ લોકો ફોન બેંકિંગ સુવિધાનો લાભ લે શકે છે. બેંક સાથેના તમામ વ્યવહારોના SMS બેંક અને ખાતેદાર પરસ્પર એકભીજાને મોકલવાની સુવિધા ફોન બેંકિંગ દ્વારા આપવામાં આવે છે.



ફોન બેન્કિંગ



૬.૬ પાઠ્યત પ્રશ્નો

- કોલમ 'અ' માં આપેલા વિધાનો તે કોલમ 'બ' ના શબ્દો (પદો) સાથે યોગ્ય રીતે જોડો.
 કોલમ 'અ'
 (૧) બેંકિંગ સગવડ જે આપણે સાથે પૈસા લઈ ન ગયા
 હોઈએ તો પણ આપણા ખાતામાંથી ચૂકવણું
 કરવાની સગવડ આપે છે.
 (૨) આપણાને ચોવીસે કલાક પૈસાની જમા કરવા કે
 ઉપાડવાની અપાતી બેંકિંગ સુવિધા
- કોલમ 'બ'
 (અ) ATM (એ.ટી.એમ.)
 (બ) ફોન બેંકિંગ

બેન્કિંગ સેવાઓ

- (૩) આપણને બેંકના વ્યવહારો ઈન્ટરનેટ પર કરવામાં સહાયક સુવિધા
- (૪) આ સગવડ વાપરીને આપણે મોબાઈલ ફોન ઉપર બેંકના ખાતામાં સિલક કેટલી છે તે જાણી શકીએ.
- (૫) બેંકમાંથી શાખ લઈને માલસામાનની ખરીદી માટે ચુકવણું કરવા આપણને મળતી સુવિધા

૨. યોગ્ય વિકદ્ય પસંદ કરીને ઉત્તર આપો.

૧. નીચેનું કયું કાર્ય મધ્યસ્થ બેંકનું નથી?
 - અ. સવ બેંકિંગ પ્રક્રિયાને માર્ગદર્શન આપતું અને અંકુશ રાખતું.
 - બ. સરકારના પ્રતિતરીક તરીકે બેંકિંગનું કાર્ય કરવું.
 - ક. આમ જનતાનાં બેંકના કાર્ય કરવા.
 - ડ. બીજી વધી બેંકોની થાપણો સાચવવી.
૨. નીચેની કઈ બેંક વાણિજ્ય બેંક નથી?
 - અ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા.
 - બ. રીગર્વ બેંક ઓફ ઇન્ડિયા.
 - ક. ICICI બેંક.
 - ડ. પંજાબ નેશનલ બેંક.
૩. નીચેનું કયું કાર્ય વાણિજ્ય બેંક દ્વારા કરવામાં આવતું નથી?
 - અ. કેશ ક્રેડિટ.
 - બ. ઓવરડ્રાફ્ટ.
 - ક. ધંધાકીય માહિતી મેળવી અને પૂરી પાડવી.
 - ડ. હૂંઠી વટાવવી.
૪. જાહેર થાપણોની (F.D.) સુવિધા મળવાપાત્ર છે.
 - અ. વેપારીઓને.
 - બ. પગારદાર કર્મચારીઓને.
 - ક. લોકો લાંબા સમય સુધી બચત કરવા ઈચ્છતા હોય તેવા લોકો માટે.
 - ડ. જે લોકો દર મહિને વ્યાજ મેળવવા ઈચ્છતા હોય તેવા માટે.
૫. નીચેના કયા દસ્તાવેજથી બેંકમાંથી નાણાં ન ઉપાડી શકાય?

અ. ચેક.	ક. ઓળખપત્ર.
બ. ઉપાડ ચિઠી.	ડ. A.T.M.

મોડયુલ - ૩ સેવાના ક્ષેત્ર



નોંધ



તમે શું શીખ્યા?

- બેંક એક એવી સંસ્થા છે જે લોકો પાસેથી જમા થાપણ સ્વીકારે છે અને જે લોકોને જરૂર હોય તેને પૈસા દીરે છે.
- વ્યાપાર માટે બેંકિંગ એક મહત્વપૂર્ણ સહાયક છે.
- બેંકિંગ ભયત (ની ટેવ) નું પ્રોત્સાહન આપે છે અને જમા કરાવનાર અને ઉધાર લેનાર વચ્ચે મધ્યસ્થી (કડી) રૂપ છે.
- તેઓ ઉધાર વ્યવહારોમાં મદદ કરે છે, આયાત-નિકાસને સરળ બનાવે છે, રાષ્ટ્રીય વિકાસમાં મદદ કરે છે અને લોકોનું જીવન ધોરણ ઉચ્ચ લાવે છે.
- બેંકોના પ્રકાર:-
 - કેન્દ્રીય બેંક રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી બેંકનું કામ કરે છે. દેશમાં ચલણી નોટો પણોચાડે છે. તેને બેંકરની બેંક પણ કહે છે.
 - વાણિજ્ય બેંકો લાંબા—ટૂકાગાળાની લોનો આપે છે અને તેના ઉપર વ્યાજ લે છે તેના ત્રણ પ્રકાર છે.— જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને વિદેશી બેંકો
 - વિકાસ બેંક મધ્યમ કે લાંબાગાળા માટે વ્યાપારને નાણાં દીરે છે.
 - સહકારી બેંકો સહ્યોના સામાન્ય હિતને પૂરા કરવા રચાય છે. ભારતમાં આપણી પાસે પ્રાથમિક શાખ મંડળી (ગ્રામ્ય કક્ષા), કેન્દ્રીય સહકારી બેંકો (જિલ્લા કક્ષા) અને રાજ્ય સહકારી બેંકો (રાજ્ય કક્ષા) વગેરે છે.
 - 'એકગીમ' બેંકો આયાતકારો અને નિકાસકારો ને માર્ગદર્શન અને સહાય આપે છે.
 - "નાબાઈ" ખેતી અને અન્ય ગ્રામ્ય પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવામાં મદદ કરે છે.
- વાણિજ્ય બેંકોના કાર્યો:-
 - પ્રાથમિક કાર્યોમાં જમા થાપણ સ્વીકારવી, લોનો, એડવાન્સ, રોકડ, શાખ, ઓવરડ્રાફટ અને બિલના ડિસ્કાઉન્ટીંગ વગેરે મંજુર કરવાનો સમાવેશ થાય છે.
 - ગૌણ કાર્યોમાં શાખપત્ર આપવો, કિંમતી ચીજો માટે સલામત સુરક્ષાની જવાબદારી લેવી, ગ્રાહક બંડોળ, શૈક્ષણિક લોનો વગેરે પૂરાં પાડવાં.
- બેંકમાં જમા થતી રકમો જુદા જુદા લોકોના જુદા જુદા હેતુ પૂર્ણ કરે છે. આ તફાવતોને લક્ષ્યમાં રાખીને જુદા જુદા લોકોને તેમની સગવડતા અને હેતુઓને અનુકૂળ આવે તે માટે નીચે દર્શાવેલા જુદા જુદા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા પૂરી પાડે છે.

બેન્કિંગ સેવાઓ

- બયત બેંક ખાતું
- ચાલુ જમા ખાતું
- ફિક્સડ ડિપોઝીટ (સાવધિ) ખાતું
- આવતી જમા ખાતું
- આવતી જમા ખાતાના વિવિધ પ્રકારો હોય છે. જેમ કે ગૃહ સુરક્ષિત ખાતું, સંગૃહિત-કમ-બિમારી જમા ખાતું ગૃહ નિર્માણ જમા ખાતું વગેરે
- વાણિજ્ય બેંકમાં બયત બેંક ખાતું ખોલવા માટે તમારી નીચેના પગલાં ભરવા જોઈએ.
- આવેદનપત્ર ભરવું, બેંકને પરિચિત એવી કોઈ વ્યક્તિની વ્યવસ્થા કરવી, નમુનાની સહી.
- ઈ-બેંકીંગ:- સૂચના અને પ્રસારણ ટેકનોલોજીનો વિકાસ થતાં બેંકીંગ વ્યવહાર ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, અને ઓ.ટી.એમ. વગેરે દ્વારા વિજાળું માધ્યમ દ્વારા થાય છે.



પાઠંત્ર પ્રશ્નો

૧. બેંક શબ્દની પશ્ચિમાણ જણાવો.
૨. 'બેંકીંગ' નો અર્થ શો ?
૩. દરેકનાં બે ઉદાહરણ આપો (૧) ખાનગી ક્ષેત્રની વાણિજ્ય બેંકો
(૨) ભારતમાં વિદેશી બેંકો
૪. બેંકના ગ્રાહકોને ક્રેડિટકાર્ડ દ્વારા કઈ સુવિધાઓ મળે છે ?
૫. નગદ શાખ (કેર ક્રેડિટ) એટલે શું ?
૬. 'વિકાસ બેંક' ક્યા કાર્યો કરે છે ?
૭. લગભગ ૧૦૦ શબ્દોમાં બેંકીંગની ભૂમિકા સમજાવો.
૮. 'કેન્દ્રીય બેંક' ક્યા કાર્યો કરે છે ?
૯. (ક) 'એકનીમ બેંક અને (ખ) 'નાબાર્ડ' ક્યા કાર્યો કરે છે.
૧૦. વાણિજ્ય બેંકના કોઈપણ ૪ (ચાર) ગૌણ કાર્યો જણાવો.
૧૧. વાણિજ્ય બેંકના પ્રાથમિક કાર્યો જણાવો.
૧૨. વાણિજ્ય બેંકના વિવિધ પ્રકારો સોદાહરણ સમજાવો.
૧૩. (૧) અસ્તિત્વ (૨) સલામતી (૩) પ્રવૃત્તિ અને (૪) ગ્રાહકોના આધારે બેંકો
અને શાહુકારો (શરાફો) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
૧૪. વાણિજ્ય બેંક ક્યા કાર્યો કરે છે તે વર્ણિબાબત.

મોડયુલ - ૩ સેવાના ક્ષેત્ર



નોંધ



નોંધ

૧૫. ગ્રાહકોને આપવામાં આવતી આધુનિકતમ સગવડતાઓના ઉદાહરણો આપીને બેંકિંગ ક્ષેત્રનાં વર્તમાન વિકાસને સમજાવો.
૧૬. 'સહકારી બેંક એટલે શું ?' ભારતમાં સહકાર બેંકોના પ્રકારો સમજાવો.
૧૭. કોઈ બેંકમાં બચત બેંક ખાતું ખોલાવવાની પ્રક્રિયા વર્ણવો.
૧૮. બચત બેંક ખાતામાં રોકડ જમા કરાવવાની રીત જણાવો.
૧૯. તમારા બચત બેંક ખાતામાં ચેક જમા કરાવવા તમે શી વિવિધ કરશો ?
૨૦. બચત બેંક ખાતામાં ઉપાડ ફોર્મનો ઉપયોગ વર્ણવો.
૨૧. બચત બેંક ખાતું ખોલવા તમારે કઈ કઈ વિગતો આવેદનપત્રમાં ભરવી પડે ?
૨૨. તમારા બચત બેંક ખાતામાંથી રોકડ ઉપાડ કેમ કરશો તે જણાવો.
૨૩. બચત બેંક ખાતામાં રોકડ કે ચેક જમા કરાવવા માટે પે-સ્લીપનો ઉપયોગ ટૂંકમાં વર્ણવો.
૨૪. પે-સ્લીપ શું છે ? તેની ઉપયોગિતા જણાવો.
૨૫. તમારા બચત બેંક ખાતામાં કુલ સિલિક હોય તેથી વધુ રકમ તમે ઉપાડી શકો ? તમારા જવાબ માટેના કારણો આપો.
૨૬. ATM શું છે ? ગ્રાહકોને તે કઈ રીતે સહાય કરે છે ?
૨૭. બચત બેંક ખાતું ખોલવા માટે બેંકને જાણીતી વ્યક્તિ દ્વારા અરજદારની ઓળખાણ સ્થાપિત કરવી શા માટે જરૂરી છે ?
૨૮. બચત બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે ?



પાઠગત પ્રશ્નોના જવાબ

૮.૧

- (૧) ધીરે છે. (૨) મધ્યરસ્થી (૩) વ્યાપાર (૪) ચેક
(૫) શાહુકાર / શરાફ

૮.૨

- (૧) વિકાસ બેંક (૨) એક્ઝિભિન્ન (૩) સહકારી બેંક
(૪) કેન્દ્રીય બેંક (૫) સાવ જનિક ક્ષેત્ર બેંક

૮.૩

- (૧) ખોટુ (૨) સાચું (૩) સાચું (૪) ખોટુ (૫) સાચું

૮.૪

(અ)

- (૧) સાચું (૨) સાચું (૩) સાચું (૪) ખોટુ (૫) સાચું
(૬) સાચું (૭) ખોટુ (૮) સાચું

બેન્કિંગ સેવાઓ

(બ)

(૧) ઓછામાં ઓછુ

(૨) વધુ

(૩) ચાલુ ખાતુ

(૪) ચેક

(૫) સરખું

૮.૫

૧.

(૧) સાચું

(૨) સાચું

(૩) ખોટુ

(૪) ખોટુ

(૫) સાચું

(૬) સાચું

(૭) સાચું

(૮) સાચું

૨.

(૧) ખાતેદાર / જમાકતા

(૨) ફોર્ડલ

(૩) ફોર્ડલ

(૪) નમુનાની સહી

(૫) ઉપાડ

(૬) જમા સ્વીકાર બારી

૮.૬

૧.

૧ – ક,

૨ – એ,

૩ – ઈ,

૪ – બ,

૫ – કુ.

૨.

(૧) ક

(૨) બ

(૩) ક

(૪) બ

(૫) ક



આપ જાતે કરો:-

➤ તમારા ક્ષેત્રમાં કાર્યરત બેંકોની યાદી બનાવો અને તેમના કાર્યો પ્રમાણે તેમનું વર્ગીકરણ કરો.

૧. તમારી નજીકની ગમે તે બેંકની શાખામાં જાઓ, એક જમા પે-સ્લીપ લઈ આવો અને તેમાં કાલ્યનિક આંકડાઓથી વિગતો ભરવા પ્રયત્ન કરો.

૨. નીચેના વિષે માહિતી એકઢી કરો.

ક. જુદાં જુદાં જમા ખાતા ખોલવા માટે જરૂરી લઘુત્તમ રકમ.

ખ. બચત બેંક, આવતી અને ફિક્સેડ (સાવધિ) જમા ખાતા પર પ્રાપ્ત વ્યાજના દરો.

મોડયુલ - ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



વીમાની સેવાઓ

તમે બજારમાં દુકાનો જોઈ હશે આ દુકાનોમાં ઘણી વस્તુઓ વેચવા માટે સંગ્રહિત કરવામાં આવી હોય છે. તમારામાંથી કેટલાકે કારખાનાઓ જોયાં હશે. ત્યાં વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે યંત્રો લગ્યાવવામાં આવ્યા હોય છે. તમે એક જગ્યાઓથી બીજી જગ્યાએ માલ પરિવહન કરતી આગળાડીઓ, ખટારાઓ અને વહાણો પણ જોયા હશે. આ બધામાં ફગલાબંધ પૈસાની જરૂર પડે છે. અને માર્ગમાં હંમેશા હાનિ (નુકસાન) થવાનું જોખમ ઉભું હોય છે. દા.ત. દુકાનોમાં વેચાણ માટે સંઘરવાની વસ્તુઓ ખરીદવામાં પુષ્કળ ઘનનું રોકાણ કરવું પડે છે અને વસ્તુઓ વેચાયા પહેલાં નુકસાન થવાનું જોખમ કાયમ હોય છે. આ નુકસાન આગ જેવી આકસ્મિક ઘટનાઓ, કુદરતી પ્રકોપ કે દંગા ફસાદ કે ચોરી સુધ્યાના કારણે થઈ શકે છે. એજ રીતે કારખાનાઓમાં મશીનો ખરાબ થઈ જવાથી ભારે નુકસાન થવા સંભવ છે. પરિવહન દરમિયાન પણ માલ સામાનને અક્સમાતના કારણે નુકસાન થાય અથવા નાશ પામે આ બધા સંજોગોમાં નુકસાન થાય અથવા નાશ પામે આ બધા સંજોગોમાં નુકસાન તો વેપારીને જ થાય છે. માત્ર તેનો માલ સામાન કે સંપત્તિ જ નહિં પણ ખુદ પોતે પણ રોજબરોજના જીવનમાં જોખમથી મુક્ત હોતો નથી. તેને કોઈ બીમારી લાગુ પડી શકે અથવા કોઈ દુર્ઘટના થઈ શકે તેનાથી તેના કુટુંબને મોટું નુકસાન ભોગવવું પડે.

આ બધાં જોખમો દૂર કરી શકાય ? અથવા તેમને લઘુત્તમ કરી શકાય ? આ જોખમો સામે રક્ષણ આપે તેવી કોઈ ચીજ છે ? ચાલો આપણે આ પાઠમાં તેના વિષે શીખીએ.



હેતુઓ:-

- વ્યવસાયિક જોખમો સમજાવી શકશો.
- વીમાની વ્યાખ્યા કરી શકશો.
- વીમાનું મહત્વ સમજાવી શકશો.
- વીમાના જુદા જુદા પ્રકારો ઓળખાવો
- જીવન વીમો, આગ વીમો, સમુદ્રી વીમો અને અન્ય પ્રકારના વીમાના પ્રમુખ લક્ષણો વર્ણવી શકશો અને

- વીમા કરારને લાગુ પડતા સિધ્યાંતો જણાવી શકશો.

૧૦.૧ વ્યવસાયિક જોખમોનું સ્વરૂપ

તમે જો કોઈ વ્યાપારમાં પડવા માગતા હો તો સ્વાભાવિક છે કે તમારો મુખ્ય હેતુ નકો ક્રમાવાળો હોય. દરેક વ્યાપારનો આ અત્યંત મહત્વનો પ્રમુખ હેતુ છે, કારણ કે નક્ષા વગર તો તમારી મૂડી ઘટતી જાય અને છેવટે સંદર્ભ નાચ થઈ જાય. આથી તમે તમારો વ્યાપાર ફૂશળતાપૂર્વક ચલાવવા બધું જ કરી છૂટો. કયારે તમને લાગે કે તમારા કારખાનાના ઉત્પાદનનું વેચાણ ઘટી રહ્યું છે. આ એક ચેતવણીનો સંકેત છે. ત્યારપછી તમે તેની પાછળનાં કારણો શોધવા પ્રયત્ન કરશો. જો તમે તે કારણો શોધી શકો તો તમે તેના કોઈ ઉપાયો યોજી શકો. ધારો કે તમને ખબર પડે કે તમે જે આયાતી માલ વેચો છો તે જ ગુણવત્તા (પ્રકાર)નો માલ તમારા પ્રતિસ્પદી વેપારીઓ ખૂબ જ નીચી કિમતે વેચે છે. આમ બજારની પરિસ્થિતિ બદલાતાં તમારે ખોટ આવી પડે છે. વળી આવક કે નક્ષામાં ઘટાડો થવાના અન્ય કારણો પણ હોય છે.

એક જગ્યાઓથી અન્યત્ર લઈ જતાં માલસામાન ખોવાઈ જાય. ગોદામમાં અચાનક આગ લાગી શકે. કામદારો હડતાળ ઉપર જાય. આમાંથી કેટલીક શક્યતાઓનું પુવા નુમાન તમે ન કરી શકો કે કેટલાક કિસ્સામાં તમે પરિસ્થિતિ નિયંત્રણમાં ન લઈ શકો. આ છે જોખમની સંકલ્પના. જોખમ એ એવી ખોટ કે નુકસાનની સંભાવના છે કે તેમાં ભાગ ભજવનારા પરિબળો ઉપર વ્યાપારીનું બહુ જ જુજ નિયંત્રણ હોય છે, અથવા મુદ્દલ હોતું નથી.

તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ અયોક્કસ, આકસ્મિક ઘટનાઓ કે બનાવોને આધીન છે. અને તેથી નુકસાન કે ખોટનો સંભવ છે. આમાંથી કેટલીક ખોટ માટે સમયસર સાવચેતી (પાણી પહેલાં પાણ બાંધવી) રાખી શકાય. પણ અમુક નુકસાન કે હાનિ તો એવાં છે કે કાં તો વ્યાપારીએ પોતે જ સહન કરવા પડે અથવા શક્ય હોય તો બીજાને સહભાગી બનાવવા પડે.

નુકસાન કે ખોટની શક્યતાને બે વ્યાપક અર્થમાં બે કક્ષામાં વહેંચી શકાય. અનિશ્ચિતતાઓ અને જોખમ. અનિશ્ચિતતાઓ એવી એવી ઘટનાઓ છે કે જેનું પુર્વનુમાન થઈ શકે નહીં. પણ ભૂતકાળના અનુભવોના પ્રકાશમાં જોખમોનું પુર્વનુમાન થઈ શકે. કારખાના કે ગોદામોમાં આગ લાગવાની શક્યતાઓ આવા બનાવો બનવા સામે અગમચેતી ઉપર અથવા પરિણામે થનાર નુકસાનને બની શકે તેટલી નીચી કક્ષાએ લઈ જવાની પૂર્વ તૈયારી ઉપર નિર્ભર હોય છે. એ જ બાબત ચોરસ કે અક્સમાતને પણ લાગુ પડે છે.

હવે બીજા પ્રકારની પરિસ્થિતિ જુઓ. દરેક વ્યક્તિએ જયારે તે કામ કરવા શક્યતમાન ન રહે અથવા વૃદ્ધાવસ્થા કે માંદગીનો ભોગ બને તે માટે પોતાની ભાવિ જરૂરિયાતોનો વિચાર કરવો પડે છે. હવે આ કોઈ આકસ્મિક ઘટના નથી. બીમારી તો ગમે તે વ્યક્તિને કોઈ સમયે તો આવી જ શકે છે, ખાસ કરીને અમુક ઉમર બાદ એ પણ લક્ષમાં રાખવું જરૂરી છે કે મૃત્યુ પણ એવા સમયે આવી શકે છે જયારે કુટુંબનું ભરણપોષણ કરવા માટે આજીવિકાની જરૂર હોય.





એવાં જોખમો પણ હોય છે કે જેમનું વ્યાપારમાં ઘણું મહત્વનું સ્થાન હોય છે. જ્યારે માલ સામાનનું એક જગ્યાઓથી બીજી જગ્યાએ પરિવહન થતું હોય ત્યારે અક્સમાત થઈ શકે છે. જેનાથી માલસામાન ને નુકસાન થવાનું અથવા તદન ગુમાવવાનું જોખમ હોય છે. ગાડીઓ પાટા ઉપરથી પડી જાય, પૂલો તૂટી પડે અથવા એન્જીનમાં ખામી સર્જવાથી વિમાન હુંદિટના ચ્રસ્ત બની શકે છે. બીજા શહેરમાં જતાં વચ્ચમાં ખટારા લૂંટાઈ શકે છે. વહાણ દ્વારા (દરિયાઈ માર્ગ) મોકલેલો માલ બંદરે ઉત્તરતા કે બંદરથી ચડાવતા માલને નુકસાન થઈ શકે છે. આવા નુકસાનમાં શું કોઈ અન્ય પક્ષોને ભાગીદાર બનાવી શકાય છે? ચાલો આપણે વીમાની મદદથી આ બધામાં કેમ ભાગીદારી બનાવી શકાય તે સમજીએ.

જોખમોનો પ્રકાર

સહારૂપ જોખમ	:	પૂર્વધારણા ઉપર વ્યાપારી નિર્ણયને લગતું જોખમ. દા.ત. ફેશનમાં ફેરફાર, સરકારી નીતિ વગેરે
શુદ્ધ જોખમ	:	જે માં હાજીજી શક્યતા જોઈ શકાય છે તેવું જોખમ
સમૃતિ જોખમ	:	સંપત્તિની હાનિ સંબંધ જોખમ
અંગત જોખમ	:	લોકોના જીવન કે સ્વાસ્થ્યને લગતું જોખમ.
નાણાંકીય જોખમ	:	વ્યાપારના નાણાંકીય વ્યવહારને લગતું જોખમ
બજારનું જોખમ	:	માલ સામાન બજારમાં વેચવાનું જોખમ

૧૦.૨ વીમાનો અર્થ શો?

સરળ ભાષામાં કહીએ તો વીમે એક અનું સાધન છે જેના દ્વારા થોડ શુલ્ક (જેને પ્રીમિયમ કહે છે.) ભરીને નુકસાન કે ખોટના જોખમો બીજા પક્ષ (વીમો ઉત્તારનાર) પર નાખી શકાય છે. જે પક્ષનું જોખમ વીમો ઉત્તારનાર પર નાખવામાં આવે છે તેને વીમાદાર (insured, વીમો ઉત્તારેલ વ્યક્તિ) કહે છે. દેખીતી રીતે જ વીમો ઉત્તારનાર સામાન્ય રીતે કોઈ કંપની (સંગઠન) હોય છે જે નુકસાન કે ખોટ વહેંચી લેવા (માં ભાગીદાર કરવા) તૈયાર હોય છે. અને તેમ કરવા સક્ષમ પણ હોય છે.

વીમો વીમા કંપની અને વીમાકૃત વ્યક્તિ વચ્ચેનો એક કરાર છે જેમાં વીમા કંપની એક નક્કી કરેલી રકમ (પ્રીમિયમ) ના બદલમાં વીમાકૃત વ્યક્તિને કોઈ બનાવ (ઘટના) બનતાં (દા.ત. અમુક ઉમરે મૃત્યુ) અમુક નક્કી કરેલી રકમ આપે છે અથવા જોખમનો વીમો ઉત્તારેલ હોવાથી ખરેખર થયેલું નુકસાન ભરપાઈ કરી આપે છે.

જો તમે વીમાના આધાર વિષે વિચાર કરશો તો તમને માલુમ પડશો કે એ એક પ્રકારનો સહકાર (સહયોગ) છે જેના દ્વારા જુમનું જોખમનો ભય હોય તે સર્વ પ્રીમિયમ ભરે છે. જ્યારે એકાદ કે બહુ જ જુજ



વીમાની સેવાઓ

વ્યક્તિગો કે જે મણે નુકસાન સહન કરવું પડ્યું હોય તેમને વળતર ચુકવી આપવામાં આવે છે. વાસ્તવમાં જોખમની સંભાવનાવાળાઓની સંખ્યા ઘણી વિશાળ હોય છે અને તે પૈકીના બહુ જ થોડા લોકોને નિશ્ચિત સમયગાળા દરમિયાન નુકસાન સહન કરવું પડતું હોય છે. વીમા કંપની જે થોડા ઘણા લોકોને ખરેખર નુકસાન વેઠવું પડ્યું હોય તે નુકસાન તમામ વીમાદારોમાં વહેંચી નાખવાના મધ્યસ્થી તરીકે કામ કરે છે.

મોડયુલ – ૩
સેવાના સૌન્દર્યો



નોંધ



૧૦.૧ પા�ગત પ્રશ્નો

નીચેના પત્રકી કયા વિધાનો 'ખોટા' છે અને કયા 'ખરાં' છે ?

- જોખમનો અર્થ છે માલસામાન કે માણસને થનાર હાનિ કે નુકસાનની સંભાવના.
- ફેશનમાં પરિવર્તન વ્યક્તિગત જોખમ છે.
- અમુક અચોક્કસ ઘટનાઓથી થતું નુકસાન વેપારીઓએ જાતે ભોગવવું પડે છે.
- કેટલાંક જોખમો અગમયેતી વાપરીને રોકી શકાય છે. જેમ કે મશીનની ખરાબી.
- વીમો એ કોઈ પક્ષને થનાર નુકસાન (ખોટ)નાં જોખમોને અન્ય સ્વૈચ્છિક અને નુકસાન વહેંચી લેવા માટે સક્ષમ એવા પક્ષ ઉપર સંકાન્ત કરવાનું સાધન છે.
- વીમો ઉત્તરાવનાર વ્યક્તિ વીમા કંપનીને જે રકમ ચૂકવે તેને પ્રીમિયમ કહે છે.

૧૦.૩ વીમાનું મહત્વ

વીમાનું મહત્વ બરાબર સમજવા માટે આપણે તેનાથી થતા ફાયદાની ચર્ચા કરવી જોઈએ.

આપણે આગળના ભાગમાં સમજાવ્યું હતું તેમ વીમો હાનિ કે નુકસાનની સ્થિતિમાં વ્યક્તિગત કે વ્યાપારી જોખમોની અસરને ઘણા લોકો (વિશાળ સમુદ્દર)માં વહેંચી નાખવાનું એક અત્યંત મહત્વનું સાધન છે. આ રીતે વીમો ઉત્તરાવેલ વ્યક્તિમાં સુરક્ષાની ભાવના પેદા થાય છે. જે વ્યક્તિ પોતાની ચાલુ આવકમાંથી નિશ્ચિત સમયગાળે વીમાનું પ્રીમિયમ ભરે છે તેને સેવા નિવૃત્તિ સમયે એક ચોક્કસ (મોટી) રકમ મળવાનું અથવા મૃત્યુ થાય તો તેના કુટુંબને સુરક્ષા મળવાનું આશ્વાસન રહે છે. વેપારીઓ પણ પોતાના હાનિ કે નુકસાનના જોખમનું વીમાનું પ્રીમિયમ ભરીને હાનિ કે નુકસાનની સતતથ તી ચિંતામાંથી મુક્ત થઈ જાય છે.

માલસામાનના વિશાળ પાયા પર ઉત્પાદન અને રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેના વિતરણના પરિપ્રેષ્યમાં જોઈએ તો વીમો અત્યંત મહત્વનો ભાગ બજવે છે. વીમો વ્યાપારી તેમજ ઔદ્યોગિક એમ બંને સાહસોમાં સહાયક છે, કેમ કે આ સાહસોમાં મિલકતો અને પ્લાન્ટો સ્થાપવામાં અને કાચામાલની શોધખોળ (પ્રાપ્તિ) અને તૈયાર વસ્તુઓમાં અઢણક ઘનના રોકાણોની જરૂર પડે છે. વ્યાપારી વર્ગને વીમા દ્વારા સલામતી (સુરક્ષા) નો અનુભવ થાય છે. કેમકે તમને ખાતરી મળે છે કે એક નાનકડી રકમ ભરીને તેઓ ભવિષ્યમાં થનાર સંભાવ્ય મોટા નુકસાનને ભરપાઈ કરી શકશો.



રાજ્યીય અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પણ વ્યક્તિગ૊ની જ્યતને પણ વીમો તેમજો આપેલ પ્રીમિયમરૂપે વીમા કંપનીઓ પાસે સંગ્રહીત થવાની તક આપે છે. આ ધનભંડોળ મોટી મોટી કંપનીઓ કે સરકાર દ્વારા અપાતી જામીનગીરી (સુરક્ષા)માં રોકવામાં આવે છે.

જે લોકો પોતાની વૃદ્ધાવસ્થા કે મૃત્યુના જોખમે ને આવરી લેવા માટે વીમો ઉત્તરાવે છે તેઓ પોતાની વર્તમાન આવકમાંથી અમુક ભાગ બચત કરવા પ્રેરાય છે, જે પોથે જ એક અતિ મહત્વની પ્રવૃત્તિ છે.

વળી વીમાક્ષેત્ર ઘણા લોકો માટે રોજગારીનો સ્ત્રોત (પ્રાન્તિકસ્થાન) પણ છે. આખા દેશમાં પથરાયેલી (વીમા) કચેરીઓમાં (લાખો) લોકો નોકરી મેળવે છે. તેમજ તે વીમા કંપનીઓમાં એજન્ટ (દલાલ) તરીકે આજીવિકા રણવાની પણ લોકોને તક આપે છે.



૧૦.૨ પાઠગત પ્રશ્નો

કોંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો.

1. વીમો થોડા લોકોના ને ઘણા લોકોમાં વહેચવાનું સાધન છે.
(નુકસાન, ખર્ચ)
2. વ્યાપારી આવમના લોકો વીમાને કારણે અનુભવે છે.
(સલામતી, બિન સલામતી)
3. વીમા કંપનીઓ પોતાનું ભંડોળ મોટી કંપનીઓ કે સરકારી માં રોકે છે.
(વીમા, જામીનગીરી)
4. વીમો તેમજ વાણિજ્ય માટે એક પ્રકારની સહાય છે.
(ઉદ્યોગ, વ્યાપાર)

૧૦.૪ વીમાના પ્રકાર

કરાર ઉપર આધુરિત વીમાનું નીચેના પ્રકારોમાં વર્ગીકરણ કરી શકાય.

1. જીવન વીમો
2. આગ વીમો
3. સમુદ્રી વીમો અને
4. અન્ય વીમા જેમકે લૂંઘાડ વીમો, મોટરવાહન વીમા વગેરે

થોડા સમય પહેલાં (હજુ હમણા સુધી) ભારતીય જેવનવીમા નિગમ (LIC) અને પોતાની સહાયક કંપનીઓ સહિત સામાન્ય વીમા નિગમ જીવન વીમા અને સામાન્ય વીમાના ક્ષેત્રમાં કામ કરતી એકમાત્ર કંપનીઓ હતી. હવે આ સેવા

વીમાની સેવાઓ

ક્ષેત્રમાં સંખ્યાબંધ ખાનગી કંપનીઓ દાખલ થઈ છે. ચાલો આપણે આ દરેક પ્રત્રકાના પ્રમુખ લક્ષણો જોઈએ.

૧. જીવનવીમો:-

જીવન વીમો (જેને જીવન સુરક્ષા પણ કહે છે.) એક કરાર છે જે અનુસાર વીમા કંપની વીમાદારને અમુક રકમ મરણ થાય ત્યારે અથવા અમુક વર્ષ પૂરાં થાય ત્યારે આપવાનું વચન આપે છે. એના બદલમાં વીમો ઉત્તરાવનાર વ્યક્તિ અમુક રકમ પ્રીમિયમ તરીકે એક સામટી અથવા છ માસિક કે વાર્ષિક હપ્તામાં ચૂકવવા સહમત થાય છે. આવી જાતના મામલામાં જે જોખમોનો વીમો ઉત્તર્યો હોય તે બનવાનું ચોકક્સ નક્કી જ હોય છે. તેથી જ જીવન વીમાને જીવન સુરક્ષા પણ કહે છે. આ માટેના લેખિત સ્વરૂપના આવેદનપત્રને જીવન વીમા પોલિસી કહે છે. આ મુજબ વીમા ધારકને અમુક નિશ્ચિત રકમ નક્કી કરેલી અવધિની તારીખે અથવા કોઈ ઘટના ઘટે ત્યારે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલી હોય છે, જે નક્કી જ છે. વેપારીઓ જુથ વીમા દ્વારા પોતાના કર્મચારીઓના વીમા ઉત્તરાવવાની વ્યવસ્થા કરી શકે છે. આનાથી કર્મચારીઓમાં વફાદારીની ભાવના પણ વિકસે છે. અને તેઓ ઉપયોગ કરજ (લોન) લેવામાં પણ થઈ શકે છે.

વીમા (સુરક્ષા) પોલિસી બે પ્રકારની હોય છે. (ક) આજીવન વીમા પોલિસી (ખ) બસ્થિત (મુદ્દતી) પોલિસી. આજીવન વીમા પોલિસી જીવન પર્યંતની હોય છે અને પ્રીમિયમ ભર્યા કરવાનું હોય છે. વીમાની રકમ વીમા ધારકના મૃત્યુબાદ જ તેના વારસદારોને ચૂકવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ બસ્થિત (મુદ્દતી) પોલિસી અમુક નિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રહે છે. વીમાની રકમ નિશ્ચિત કરેલા વર્ષોનો સમયગાળો પૂરા થાય પછી ચૂકવવા પાત્ર બને છે અથવા જો વીમાધારકનું મૃત્યુ તે સમય પહેલા થાય તો ત્યારે ચૂકવવાપાત્ર બને છે.

૨. આગ વીમો:-

આગ વીમાનો કરાર એ એવો કરાર છે જે મુજબ વીમા કંપની વીમા ધારકે પ્રીમિયમ ભર્યા બાદ અમુક નિશ્ચિત કરેલ વસ્તુઓને આગથી નુકસાન થાય અથવા નાણ થાય ત્યારે તેના કારણે વીમા ધારકને થતું નુકસાન કે ખોટ ભરપાઈ કરી દેવાનું વચન આપે છે. આ વીમો ક્ષતિપૂર્તિનો કરાર છે. એનો મતબલ એ થયો કે વીમા ધારક આગથી ગુમાવેલી મિલકતનું મૂલ્ય અથવા પોલિસીની રકમ બેમાંથી જે ઓછુ હોય તેના સિવાય કોઈ બીજી વસ્તુનો દાવો કરી શકતો નથી. આગથી થયેલા નુકસાનના દાવાની રકમ બે શરતોને આધીન ચૂકવવામાં આવે છે. (ક) આગ ખરેખર લાગી હોવી જોઈએ અને (ખ) આગ અક્સમાત લાગી હોવી જોઈએ. ઈરાદાપૂર્વક લગાડેલી નહીં. આગ લાગવાનું કારણ ગમે તે હોય તેનાથી કશો ફરક પડતો નથી. આ મામલામાં દાવો કરવાને લાગુ પડતો મૂળ ભૂત સિધાંત ક્ષતિપૂર્તિનો છે. વીમા ધારકે તેણે જેટલી રકમની પોલિસી લીલી હાંય તેટલી જ મહત્તમ રકમ તેને મળી શકે. તેની મર્યાદામાં તે ખરેખર થયેલ નુકસાનનું વળતર મેળવવા હકદાર છે. તે વીમા દ્વારા નક્કો કરી શકે નહિં. દા.ત. કોઈ વ્યક્તિ અમુક ચીજો ઉપર

મોડયુલ - ૩ સેવાના કોન્ટ્રો



નોંધ

મોડયુલ - ૩

સેવાના ક્ષેત્ર



નોંધ

વીમાની સેવાઓ

રૂ.૨૦૦૦૦/- નો વીમો ઉત્તરાવે છે. આમાંથી રૂ.૧૫૦૦૦/-ની કિંમતનો માલ સામાન આગથી નાણ થયો છે તો વીમા ધારક વીમા કંપની પાસેથી થયેલા નુકસાનની રકમ એટલે કે રૂ.૧૫૦૦૦/- નો દાવો કરી શકે (રૂ. ૨૦૦૦૦/- નો નહીં)

૩. સમુદ્રી વીમો:-

સમુદ્રી વીમો એક એવો કરાર છે જેનાથી વીમા કંપની સમુદ્રી સાહસોમાં આકસ્મિક રીતે આવી પડેલાં જોખમોમાં યાત્રી વહાણ કે માલવાહક જહાજના માલિકને થતા નુકસાન પર લદાયેલ માલસામાનના નુકસાનના જોખમનો વીમો પણ સામેલ છે. જે સમુદ્રી વીમો તુફનને કારણે થયેલા માલના નુકસાનના જોખમને આવરી લે છે તેને માલસામાન વીમો કહે છે. વહાણનો માલિક સમુદ્રમાં આવતા ઉતાર-ચઢાવના કારણે વહાણને થયેલા નુકસાનના જોખમ સામે વહાણનો પણ વીમો ઉત્તરાવી શકે તેને 'હલ્લ' વીમો કહે છે. વળી જ્યારે માલસામાન નક્કી કરેલા બંદરના મુકામે સલામત ઉત્તર્યા પછી માલના માલિકે ચૂકવવાનું હોય ત્યારે જહાજ કંપની માલના નુકસાનના કારણે ભાડાની ખોટ જવાનું જોખમ હોય તો તેનો પણ વીમો ઉત્તરાવી શકે છે. આવા સમુદ્રી વીમાને નૂર વીમો (ભાડાનો વીમો) કહે છે. સમુદ્રી વીમાના તમામ કરારો શક્તિપૂર્તિના કરારો હોય છે.

નીચે વિવિધ પ્રકારની સમુદ્રી વીમા પોલિસીઓ આપેલી છે.

ક. સમયાવધિ વીમો:- આ પોલિસી અમુક વસ્તુ માટે અમુક નિશ્ચિત સમય માટેનો વીમો ઉતારે છે. બનતા સુધી ૧ વર્ષનો સમય હોય છે. આ સામાન્ય રીતે જ્યારે અધ્યમાત્રામાં માલ હોય ત્યારે માલસામાન કે હલ્લ વીમા માટે ઉપયોગ થાય છે.

ખ. યાત્રા વીમા પોલિસી:- આ પોલિસી કોઈ વિશેષ યાત્રા માટે હોય છે. તેમાં સમયની કોઈ ગણતરી નથી. આનો ઉપયોગ મોટેભાગે માલસામાન માટે થતો હોય છે.

ગ. મિશ્ર વીમા પોલિસી:- આ પોલિસી અંતર્ગત જહાજ કે માલનો વીમો કોઈ વિશિષ્ટ યાત્રા માટે અને નિશ્ચિત સમય એમ બંને માટે ઉતારવામાં આવે છે. (દા.ત.હલ્લ) દા.ત. એક વહાણનો મુંબઈ અને કોલંબો વચ્ચે ૫ મહિનાની મુદ્દત માટે વીમો ઉતારવામાં આવે છે આથે મિશ્ર પોલિસી કહે છે.

ઘ. અનિશ્ચિત વીમા પોલિસી:- આ પોલિસી ડેણ માલસામાનની પોલિસી અમુક મોટી રકમ માટે લેવામાં આવે છે. જ્યારે જ્યારે માલ સામાન વહાણમાં ચડાવવામાં આવે ત્યારે વીમા કંપની તેનું મૂલ્ય જાહેર કરે છે અને પોલિસીના કુલ મૂલ્યમાંથી તે રકમ બાદ કરવામાં આવે છે. અને આમને આમ પોલિસીની કુલ રકમ પૂરી ન થાય ત્યાં સુધી આ વહાણના માલનો વીમો ચાલુ રહે છે.

ક્રમ	મુદ્દાઓ	આગનો વીમો	દરિયાઈ વીમો	જીવન વીમો
૧	વળતર	વળતર સ્વરૂપે વીમાની રકમ કે વાસ્તવિક નુકસાન બે માંથી જે ઓછું	વળતર સ્વરૂપે ખરીદ કિંમત ઉપરાંત ૧૦ થી ૧૫% જેટલા નશ	ઉત્તરેલ વીમાની પૂરેપૂરી કિંમત પડતર સ્વરૂપે ચૂકવાય છે.

વીમાની સેવાઓ

મોડયુલ – ૩
સેવાના કોન્ટ્રો



નોંધ

		હોય તે ચૂકવાય છે.	સ્વરૂપે વધારાની રકમ ચૂકવાય છે.	
૨	વીમા યોગ્યદીત	વીમા યોગ્યદીત વીમો ઉતારતી અને વીમો પાકતી બંને સમયની મુદ્દતે હોવા જોઈએ.	નુકસાન સમયે વીમાયોગ્યદીત હોવું જોઈએ.	વીમો ઉતારતી વખતે વીમા યોગ્યદીત હોવું જોઈએ.
૩	પોલિસીની તબદિલી	વીમા કંપનીની મંજૂરી વિના વીમા પોલિસી બદલાય નહિ.	વીમા કંપનીની મંજૂરી વિના વીમા પોલિસી બદલાય નહિ.	વીમા પોલિસીની ફેરબદલ શક્ય નથી.
૪	જોખમનો પ્રકાર	ચોક્કસ	ચોક્કસ	ચોક્કસ પરંતુ સમય અનિશ્ચિત.
૫	મુદ્દત	એક વર્ષીય મુદ્દત	એક વર્ષીય મુદ્દત વીમા પ્રિમિયમનો	લાંબી મુદ્દત
૬	પ્રિમિયમ	પ્રિમિયમનો આધાર વીમા રકમ ઉપર રહે છે. વધુ વીમો ઉતારતા વધુ પ્રિમિયમ ભરવું પડે છે.	આધાર જોખમના પ્રકાર પર રહેલો છે.	વીમો પ્રિમિયમનો આધાર ઉમર, વીમાની રમક અને મુદ્દત ઉપર રહેલો છે.
૭	હેતુ	આગના જોખમ સામે વળતર મેળવવા.	દરિયાઈ જોખમ સામે વળતર મેળવવા.	રક્ષણ અને બચત માટે.
૮	સરન્ડર (પોલિસી પરત કરવી)	મુદ્દત પહેલા વીમો પરત થઈ શકે નહિ.	મુદ્દત પહેલા વીમો પરત થઈ શકે નહિ.	પાકતી મુદ્દત પહેલા વીમો પરત થઈ શકે છે.

૪. વીમાના અન્ય પ્રકાર:-

સાધારણ વીમા કંપનીઓ જીવન, આગ અને સમુદ્રી વીમા ઉપરાંત વિવિધ પોલિસી દ્વારા બીજી ઘણી બાબતોમાં જોખમોનો વીમો ઉતારે છે. આમાના કેટલાક જોખમો અને વિવિધ પોલિસીઓની રૂપરેખા આ નીચે આપવામાં આવી છે.

૫. મોટર વાહન વીમો:-

ઉતારી મોટરકારો, વેન, વ્યાપારી વાહનો, મોટર સાઈકલ, સ્કૂટર વગેરે તમામ પ્રકારનાં મોટર વાહનના વીમામાં વાહનને અકસ્માતથી થયેલું નુકસાન અથવા ચોરીનું



જોખમ તેમજ અક્સમાતમાં ઘાયલ થવા કે મૃત્યુ થવાથી ઉત્પન્ન થતી ત્રીજાપક્ષની જવાબદારીની સ્થિતિમાં થયેલા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. મોટર વીકલ્પ એકટ મુજબ ત્રીજા પક્ષના જોખમાનો વીમો અનિવાર્ય છે.

ખ. ચોરી વીમો:-

આ વીમા હેઠળ વીમા કંપની વીમા રક્ષિત વસ્તુઓની ચોરી લૂટ-ધાડ એટલે કે જંગમ વસ્તુઓની લૂટ, ધરફડ ચોરીથી થયેલી નુકસાની ભરપાઈ કરી દે છે.

ગ. વિશ્વાસ વીમો:-

વ્યાપારીઓ પોતાના કર્મચારીઓ દ્વારા થતી ધોખાબાજી કે બેઈમાની અથવા રોકડરકમની ઉચ્ચાપત કે માલ સામાન હડપ કરી જવાથી થતા નુકસાનના જોખમની સામે સાવયેતી રૂપે આવી પોલિસી લેતા હોય છે. જે રોકડ રકમનો હવાલો ધરાવતા કે સ્ટોરના ઈન્યાર્જ કર્મચારીઓના દગ્ગા અને અપ્રમાણિકતાથી થતા નુકસાન આવરી લે છે.

ધ. વ્યક્તિગત અક્સમાત અને માંદગીનો વીમો:-

વ્યક્તિગત મૃત્યુ કે કાયમી ખોડ ખાપણ થવાની સામે આ પ્રકારની વીમા પોલિસી ઉત્તરવામાં આવે છે. ઉદા. વીમાનમાં મુસાફરી કરતા થતા અક્સમાતો.

ય. જવાબદારીના વીમા:-

કોઈ વ્યક્તિનું મૃત્યુ કે અક્સમાત થાય તો તેની ચુકવવી પડતી વળતરની ચુકવણી માટે ઉત્તરવામાં આવતા વીમાને જવાબદારીના વીમા કહે છે. આ વીમાના મુખ્ય બે પ્રકારો છે.

૧. કમ ચારીની જવાબદારીનો વીમો:- આ વીમામાં નોકરી આપનાર માલિક દ્વારા કામદારને થતા નુકશાનની સામે વળતર ચુકવવા કામદારોનો વીમો લેવામાં આવે છે.
૨. જાહેર જવાબદારી:- વ્યક્તિ કે વેપારીના ધંધાકીય સ્થળે જાહેર જનતા દ્વારા મૂલાકાત દરમ્યાન થતા નુકશાન સામે વળતર ચુકવા આ વીમો ઉત્તરવામાં આવે છે.

યી. માલ મિલકતનો વીમો:-

પોતાના મકાનમાં કે હેરફર કરતી વખતે કિમતી વસ્તુઓને થતા નુકશાન સામે આર્થિક વળતર મેળવવા આ વીમો ઉત્તરવામાં આવે છે. માલ મિલકતનો વીમો વેપારી ઉપરાંત ગૃહસ્થ પણ લઈ શકે છે.



૧૦.૩ પાઠગત પ્રશ્નો

નીચેના પૈકી ક્યા વિધાનો 'ખરા' છે અને ક્યા 'ખોટા' છે?

૧. સમુક્તી વીમાના કરાર સામાન્ય કરાર છે, જ્યારે જીવન વીમો જીતિપૂર્તિનો કરાર છે.

વીમાની સેવાઓ

૨. આગ વીમો આગથી થતા નુકસાનને ભરપાઈ કરી આપે છે અને વીમા કંપની સમક્ષ દાવો કરતાં આગ લાગવાના કારણનું કોઈ મહત્વ નથી.
૩. સાગરમાં તોફાનથી થતા નુકસાન સામે વહાણનો વીમો ઉત્તરાવી શકાય છે.
૪. (બસ્ટિસ) બંદોબસ્ત પોલિસીમાં વીમા ધારકે જીવનભર પ્રીમિયમ ભરવું પડે છે.
૫. જીવનવીમામાં પ્રીમિયમ ઓક સાથે અથવા વાર્ષિક હપ્તામાં ભરી શકાય છે.
૬. સમુક્તી વીમામાં કેટલીક વખત હલ્લ વીમા માટે સમયાવહિ વીમો વાપરવામાં આવે છે.
૭. વેપારના માલિકો માટે વિશ્વાસ વીમો ફરજિયાત નથી.
૮. ક્ષતિપૂર્તિ કરાર પાછળ નિહિત સિધ્યાંત એ વાત સુનિશ્ચિત કરવાનો છે કે વીમાધારક વીમામાંથી નફો કમાઈ ન લે.

મોડયુલ – ૩
સેવાના સૌન્દર્યો



નોંધ

૧૦.૫ વીમાના સિદ્ધાંતો

વીમાના કેટલાક સિદ્ધાંતોને વીમા કંપની અને વીમા ધારક વર્ણયેના કરારને લાગુ પડે છે.
આ સિદ્ધાંતો નીચે પ્રમાણે ચર્ચા કરી છે.

૧. પૂર્ણ સદ્ભાવના (સદ્દવિશ્વાસ):-

વીમા કરાર એ પરસ્પર વિશ્વાસ અને શ્રદ્ધાના કરારો છે. વીમા કંપની અને વીમા ધારક બંને પક્ષો અરસ પરસ તમામ આનુષ્ઠાનિક માહિતી પુરી પાડવી જોઈએ. દા.ત. વીમો ઉત્તરાવનાર જો તેના જીવન ઉપર જોખમરૂપ કોઈ બીમારીથી ગ્રસ્ત હોય તો તેણે તે હકીકત જીવન વીમો ઉત્તરનાર કંપનીને જણાવી દેવી જોઈએ.

૨. વીમા યોગ્ય સ્વાથ :-

આનો અર્થ છે વીમાની બાબતમાં આર્થિક અથવા ધન સંપત્તિનો સ્વાર્થ હોવો. કોઈ વ્યક્તિને સંપત્તિ કે જીવનના વીમામાં ત્યારેજ વીમા યોગ્ય હિત (સ્વાર્થ) હોય જ્યારે તેના હોવાથી તેને લાભ થવાનો હોય અને તેને નુકસાન થવાથી કે તેનો નાશ થવાથી આર્થિક રીતે ગુમાવવાનું હોય. જીવનવીમાની બાબતમાં પોલિસી લેનાર વ્યક્તિને પોલિસી લેતી વખતે વીમા યોગ્ય સ્વાર્થ હોવો જોઈએ. દા.ત. કોઈ માલાસ પોતાની પત્નીના નામે જીવન વીમો પોલિસી લઈ શકે છે અને જો પાછળથી તેઓ છૂટા છૂટા લઈલે તો આનાથી વીમા કરારને કોઈ અસર નહીં પડે કારણ કે તે માલાસને વીમાનો કરાર કરતી વખતે તેની પત્નીના જીવનમાં વીમા યોગ્ય સ્વાર્થ હતો.

સમુક્તી વીમાની બાબતમાં સંપત્તિને નુકસાન કે હાનિ થાય તે સમયે વીમાયોગ્ય સ્વાર્થ હોવો જરૂરી છે. આગ વીમાના કરારમાં વીમા યોગ્ય સ્વાર્થ પોલિસી લેતી વખતે તેમજ સંપત્તિને નુકસાન અથવા હાનિ એમ બંને સમયે હોવો જરૂરી છે.



૩. ક્ષતિપૂર્તિ (નુકસાનીનું વળતર):-

ક્ષતિપૂર્તિનો અર્થ છે કે માણસ ઘટના ઘટવા પૂર્વ જે સિથિતિમાં હતો તે જ સિથિતિ તેને પુનઃ લાવી આપવી આ સિદ્ધાંત આગ અને સમુક્રી વીમાને લાગુ પડે છે, પણ જીવન વીમાને લાગુ પડતો નથી કારણ કે જીવન પાછું લાવી આપી શકતું નથી.

આ સિદ્ધાંતનો હેતુ એ છે કે જ્યારે જે ઘટનાનો વીમો ઉત્તારવામાં આવ્યો હોય તેવી ઘટના બની જાય ત્યારે વીમા ધારક વ્યક્તિ તેમાંથી કોઈ નક્કો કમાઈ ન જાય. નુકસાનીનું વળતર ખરેખર થયેલું નુકસાન અથવા જેટલી રકમનો વીમો હોય તે બેમાંથી જે ઓછું હોય તે મુજબ મળે છે.

૪. યોગદાન :-

એક વસ્તુનો વીમો એકથી વધુ વીમા કંપની પાસે ઉત્તરાવી શકાય આવા સંયોગોમાં જે વીમા (ની રકમ) નો દાવો કરવામાં આવે તેમાં બધી વીમા કંપનીઓને ભાગીદાર થવું જોઈએ અથવા યોગદાન આપવું જોઈએ.

૫. ઉત્તરાધિકાર નિયુક્તિ અથવા અવેજીકરણ:-

વીમાના કરારમાં અવેજીકરણ એટલે જ્યારે વીમા કંપની વીમા ધારકને વળતર ચૂકવી આપે પછી જે વસ્તુનો વીમો ઉત્તરાવવામાં આવ્યો હોય તેના તમામ અધિકારી વીમા ધારક પાસેથી પ્રાપ્ત કરી લે છે. ધારો કે ૨૦૦૦૦/- રૂપિયાની કિમતનો માલસામાન આંશિક રીતે (અધોપદ્ધો) નાશ પામ્યો છે, અને વીમા કંપની વીમા ધારકને વળતર ચૂકવી દે છે. પછી વીમા કંપની તે આંશિક રીતે નાશ પામેલ માલ સામાન પણ લઈ શકે છે. અને તેને બજારમાં વેચી શકે છે.

૬. ન્યૂનીકરણ:-

જો કોઈ કમનરીબ ઘટના બને તો વીમા ધારકે વીમો ઉત્તરેલ વસ્તુનું નુકસાન કે હાનિ જેટલું બની શકે તેટલું ઓછું કરવાના તમામ શક્ય પ્રયત્નો કરવા જોઈએ. આ સિદ્ધાંત એટલું સુનિશ્ચિત કરે છે કે વીમાધારક કોઈ વસ્તુનો વીમો ઉત્તરાવ્યા પછી તે વસ્તુની સલામતી પરત્વે બેપરવા ન બની જવો જોઈએ. વીમા ધારક પાસે એવા વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે કે જાણે તે વસ્તુનો વીમો ઉત્તરાવ્યો જ ન હોય.

૭. હાનિનું નિકટતમ કારણ:-

આ સિદ્ધાંત મુજબ નુકસાનનું વળતર વીમા ધારક ત્યારે જ માગી શકે જ્યારે જે કારણ સામે જોખમનો વીમો ઉત્તરાવ્યો હોય તે જ કારણથી નુકસાન થયું હોય. જે જોખમનો વીમો ઉત્તરાવ્યો હોય તે નુકસાનનું નજીકતમ કારણ હોવું જોઈએ એમ હોય તો જ વીમા કંપની નુકસાન ભરપાઈ કરવા જવાબદાર ઠરે છે. દા.ત. એક વહાણ સંતરા ખરેલું છે. તેનો દુર્ઘટનાથી થતા નુકસાન સામે વીમો ઉત્તરાવવામાં વિલંબ થાય છે. પરિણામે સંતરા સડી જાય છે. આ માટે વીમા કંપની કોઈ વળતર નહીં ચુકવે કારણ કે

વીમાની સેવાઓ

નુકસાનીનું કારણ સફર દરમિયાન અક્સમાતનું ન હતું પણ સંતરા ઉતારવામાં થયેલા વિલંબનું હતું.



૧૦.૪ પાઠગત પ્રશ્નો

યોગ્ય શબ્દોથી ખાલીજગ્યા પુરો

- પૂર્ણ સદ્ગ્રાવનાનો સિદ્ધાંત વીમા કંપની અને વીમા ધારક બંને વચ્ચે
ઉપર આધ્યારિત છે.
- જીવન વીમા કરારમાં વીમા ધારકનું ના સમયે વીમા
યોગ્ય હિત જોવું જોઈએ.
- ના સિદ્ધાંત પાછળનો હેતુ ઓ છે કે વીમા ધારક વીમા કરારમાંથી
કોઈ નફો કરી ન જવો જોઈએ.
- જો વીમા કંપની બે કે તેથી વધુ હોય અને વીમાના દાવાની રકમ કોઈ એક
વીમા કંપનીએ ચૂકવી હોય તો તેણે તે રકમ ચૂકવી હોય તે વીમા કંપનીને
બીજી વીમા કંપનીએ હિસ્સો આપવો પડે છે.



તમે શું શીખ્યા?

- જોખમ એ એવી હાનિ કે નુકસાનની શક્યતા છે કે તેનાં જે કારણો છે તેના
ઉપર આપણું નહીંવત નિયંત્રણ છે. (નિયંત્રણ નથી) તમામ વ્યાપારી
પ્રવૃત્તિઓમાં આકસ્મિક ઘટનાઓથી થતા નુકસાનને હાનિનો સંભવ રહેલો છે.
- વીમો એક એવું સાધન છે જેના દ્વારા અમુક રકમ જેને પ્રીમિયમ કહે છે તે
ભરીને હાનિ કે નુકસાનના જોખમને બીજા પક્ષ (વીમા કંપની) ઉપર લાદી શક્ય
છે. જે પક્ષનું જોખમ વીમા કંપની ઉપર તબદીલ થાય છે તેને વીમાધારક
કહે છે.
- વીમો વીમાકંપની અને વીમાધારક વચ્ચે થયેલા કરાર ઉપર આધ્યારિત છે. આ માટે
તે એક નક્કી રકમ (પ્રીમિયમ)ના બદલામાં કોઈ ચોકકસ ઘટના બનતાં
(દા.ત. વીમા ધારક મૃત્યુ થતા) વીમા ધારકને આપવાનું વચન આપે છે.
(જવાબદારી લે છે.) અથવા તો જ્યારે વીમાકૃત જોખમના કારણો જે ખોટ ગઈ હોય
તેને ભરપાઈ કરી આપે છે.
- વીમાનું મહત્વ:-** વીમો એક વ્યક્તિને થયેલા નુકસાન કે હાનિને ઘણા લોકોમાં
વહેચવાનું સરળ સાધન છે. મોટા પાયા પર ઉત્પાદન અને માલસામાનના
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વિતરણના પરિપ્રેક્ષ્યમાં જોતાં
વીમો એક અગત્યની ભૂમિકા બજવે છે. વ્યાપારી અને ઔદ્યોગિક એમ બંને સાહસો
માટે તે સહાયક છે. આમ એકત્રિત થયેલ પ્રીમિયમની રકમ

મોડયુલ - ૩
સેવાના કોન્ટ્રો



નોંધ



જામીનગરીઓમાં તે રોકે છે, જે આખરે રાષ્ટ્રીય વિકાસમાં વપરાય છે. વળી વીમો ઘણા લોકો માટે રોજગારીનું પ્રાપ્તિસ્થાન પણ બને છે.

- **પ્રકારો** : એક સેવા તરીકે વીમાની પ્રવૃત્તિ ચાર મોટા વર્ગોમાં વહેંચી શકાય.
- **જીવનવીમો** : આજીવન વીમા પોલિસી, બદ્ધિસ વીમા પોલિસી
- **આગ વીમો** : સમયાવિધ વીમા પોલિસી
- **સમુદ્રી વીમો** : સફર વીમા પોલિસી, મિશ્ર વીમા પોલિસી, અનિશ્ચિત વીમા પોલિસી
- **અન્ય વીમાના પ્રકારો:** મોટર વાહન વીમો, ચોરી–ધાડ વીમો, વિશ્વાસ વીમો, વ્યક્તિગત અક્સમાત અને તંદુરસ્તી વીમો, જવાબદારી વીમો, મિલકત વીમો



પાઠાંત પ્રશ્નો

૧. વ્યાપારી જોખમનો અર્થ શો છે ?
૨. વીમાની વ્યાખ્યા આપો.
૩. વીમો કેમ મહત્વનો ગણાય છે ? ગમે તે બે કારણ જણાવો.
૪. 'બદ્ધિસ' (બંદોબસ્ત) જીવન વીમા પોલિસી એટલે શું ?
૫. સફર પોલિસી એટલે શું ?
૬. 'હલ્લ્ય' (જહાજી) વીમો એટલે શું ?
૭. વીમો વ્યાપાર અને ઉદ્યોગ માટે અગત્યની સહાય કરી રીતે છે તે સમજાવો.
૮. આજીવન વીમા પોલિસી બંદોબસ્ત વીમા પોલિસીથી જુદ્દી પડે છે. જીવન વીમાને જીવન સુરક્ષા પણ શા માટે કહે છે ?
૯. મોટરવાહન વીમો અને વિશ્વાસ વીમા નીચે આવરી લેવાતા જોખમોના પ્રકાર સમજાવો.
૧૦. સમુદ્રીવીમા પોલિસી ક્યો હેતુ સારે છે ? વિવિધ પ્રકારની સમુદ્રી પોલિસીઓ સમજાવો. તેઓ આયાત નિકાસકારોને કોઈ રીતે ઉપયોગી છે ?
૧૧. એક વ્યક્તિને કેન્સરની બીમારી હતી તે વાત તેણે જીવન વીમા પોલિસી લેતી વખતે જાહેર કરી નહીં. તેણે આમાં જે સિધ્યાંતનો ભંગ કર્યો તેનું નામ આપો અને લગભગ ૫૦ શાઢોમાં તે સમજાવો.
૧૨. (ક) જીવનવીમો (ખ) અર્જિન વીમો (ગ) સમુદ્રી વીમો આ બધામાં કયા સમયે વીમા યોગ્ય (સ્વાર્થ) હિત હોય?



પાઠગત પ્રશ્નોના જવાબો

- ૧૦.૧** (૧) ખરું (૨) ખોટું (૩) ખોટું (૪) ખરું
 (૫) ખરું (૬) ખરું
- ૧૦.૨** (૧) નુકસાન (૨) સલામતી (૩) જામીનગીરી
 (૪) ઉદ્ઘોગ
- ૧૦.૩** (૧) ખોટું (૨) ખરું (૩) ખરું (૪) ખોટું
 (૫) ખરું (૬) ખરું (૭) ખરું (૮) ખરું
- ૧૦.૪**
- | | | | |
|----|---------------------|----|-------------|
| ૧. | વિશ્વાસ અને શ્રદ્ધા | ૨. | પોલિસી સેવા |
| ૩. | ક્ષતિપૂર્તિ | ૪. | ભાગે પડતો |



જાતે કરો (પ્રવૃત્તિ)

- વિદ્યાર્થીઓના વિસ્તારમાં જેમણે આગથી થતા નુકસાનને સરભર કરવા વીમો ઉત્તરાચ્છો હોય તેવા દુકાનદારોની સંખ્યા વિષે તપાસ કરવા તેમણે જણાવ્યું.
- પડોશમાં જે લોકોએ જીવવીમાની પોલિસી લીધી હોય તેવા લોકોની સંખ્યા વિષે તપાસ કરવા વિદ્યાર્થીઓને જણાવવું અને જે લોકો પાસે જીવનવીમા પોલિસી હોય તેમની પાસે આજીવન કે એન્ડાઉમેન્ટ પોલિસી છે તે પણ તપાસ કરવા કહેલું.



નોંધ



આઉટ સોર્સિંગ

કોઈ ચોક્કસ હેતુ, કાર્ય, પ્રક્રિયા, ઉત્પાદન કે સેવા પોતાની કંપની કે ઘંધાના સ્થળે કરવાના બદલે કોઈ ચોક્કસ બીજી કંપની કે એકમની પાસે ચોક્કસ સમય કે મુદ્દત માટે કરાવવામાં આવે તો તેને આઉટ સોર્સિંગ કરે છે. તમારા લેડી સેકેટરી મેટરનીટી રજા પર ગયા છે અને તેમના સ્થાને નવા સેકેટરી થોડા સમય માટે ક્રમ કરે છે. તેને આઉટ સોર્સિંગ ન કહેવાય. વધુમાં જણાવીએ તો જે કાર્ય બહાર બીજા પાસે કરાવીએ તેને આઉટ સોર્સિંગ કહે છે. આઉટ સોર્સિંગનું સામાન્ય ઉદાહરણ આપણે વર્તમાન પત્રમાં આવતા સમાચારો કે અમેરિકા – યુરોપના દેશો દ્વારા ભારત અને ચીનમાં ઉત્પાદન કે સેવાનું કાર્ય કરાવવાનું વધુ ફાયદાકારક ગણે છે. આઉટ સોર્સિંગના સામાન્ય ઉદાહરણોમાં ટેલિફોન કોલ સેન્ટર, ટેકનીકલ સહાય કેન્દ્રો ઉપરાંત કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ વગેરે છે. વિશિષ્ટિકરણનો લાભ મેળવવાના કેન્દ્રબિંદુથી આઉટ સોર્સિંગ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી કાર્યો બહાર કરાવવાનો ઉકેલ વાણિજ્યની પ્રક્રિયાનું આઉટ સોર્સિંગ જેને Business Process Outsourcing (BPO) દ્વારા કરાવી શકાય છે. બીજનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ (BPO) એ ચોક્કસ કાર્ય કે લક્ષ જેવા કે પગાર પત્રકો તૈયાર કરવા, વિવિધ પ્રકારની સેવાઓ રહારની મેળવવી, સામાન્ય રીતે BPO એ એકમે પોતાની પડતર નીચી લાવી આર્થિક પરિસ્થિતિને વધુ સંધર – મજબૂત બનાવી બજારમાં પોતાનું કાયમી સ્થાન બનાવવાનું છે. આ પ્રકરણમાં તમે બીજનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગનો અર્થ અને મહત્વ સમજી શકશો. સાથે સાથે જ્ઞાન – વિશિષ્ટ સેવાના આઉટ સોર્સિંગ જેને નોલેજ પ્રોસેસ આઉટ સોર્સિંગ, ટુંકામાં KPO નો અર્થ સમજી શકશો.



હેતુઓ:-

આ પ્રકરણના અધ્યયન પછી તમે,

- બિજનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગનો (Business Process Outsourcing) BPO અર્થ જાણશો.
- નોલેજ પ્રોસેસ આઉટ સોર્સિંગનો (Knowledge Process Outsourcing) KPO અર્થ જાણશો.

આઉટ સોર્સિંગ

- બી. પી. ઓ. અને કે. પી. ઓ.નું મહત્વ વર્ણવી શકશો.
- બી. પી. ઓ. અને કે. પી. ઓ.નો તફાવત જાણશો.

૧૧.૧ ધ્યાકીય પ્રક્રિયા આઉટ સોર્સિંગનો અર્� અને સમજૂતિ (Business Process Outsourcing) બી. પી. ઓ. નો અર્થ અને સમજૂતિ

મોડ્યુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

બિઝનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગમાં જે ઉત્પાદન પ્રક્રિયાનું કોઈ ચોક્કસ કાર્ય એકમની એક પ્રક્રિયાના ભાગ રૂપે એકમમાં ન કરાવતા તે કાર્ય બહારના એકમો દ્વારા કરાવવામાં આવે તો તેને બિઝનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ કહે છે. સરળ સમજ માટે જ્યારે વીમા કંપનીઓ તેના વીમાના દાવા પતાવણી પ્રક્રિયા અને બેન્ક વિરાસ આપવાની પ્રક્રિયા જ્યારે જાતે કરવાને બદલે બહારની વ્યક્તિકે એકમો પાસે કરાવે તેને આઉટ સોર્સિંગ કહે છે. બી. પી. ઓ. ના બીજા સામાન્ય ઉદાહરણો જોઈએ તો શહેરમાં આવેલ કોલ સેન્ટર અને પગારપત્રકો બનાવતા કેન્દ્રો. ખાસ કરીને કંપનીઓ પોતાની પડતર ઘટાડવા અને વિશિષ્ટિકરણનો લાભ મેળવવા ધ્યાના અમુક કાર્યો જાતે કરવાને બદલે જે એકમોને આવા કાર્યો કરવાનો અનુભવ વધુ હોય તેમને સોંપવામાં આવે છે. આ ઉપરાંત દરેક દેશમાં મજૂરી – વેતનનાં દર જીવન જીવવાની પદ્ધતિને કારણે અલગ – અલગ હોય છે. ત્યારે નીચી મજૂરી વાળા દેશમાં ધ્યાકીય પ્રક્રિયાઓ કરાવી નાણાંકીય લાભ કંપનીઓ મેળવે છે.

બી. પી. ઓ. સામાન્ય રીતે બે કક્ષામાં વહેચાયેલ છે. ઓફિસમાં પછીથી કરવામાં આવતા (બેક ઓફિસ – back office)

આઉટ સોર્સિંગના કાર્યો જેવા કે ખરીદ પ્રક્રિયા કરવી, બિલ બનાવવા, ઉઘરાણી કરવા વગેરે. અને ઓફિસમાં પહેલેથી કરવામાં આવતા આઉટ સોર્સિંગના કાર્યો જેવા કે બજાર–સંશોધન, ગ્રાહકોનો સંપર્ક અને તેમને આપવામાં આવતી સેવાઓ, જાહેરાતો કે પછી ટેકનીકલ માર્ગદર્શન કે સહાય જેને ફ્રન્ટ ઓફિસ આઉટ સોર્સિંગ કહે છે. આઉટ સોર્સિંગ એ વિશાળ ફલક ઉપર કાર્યરત છે. ધ્યાનનો લક્ષ્યાંક પૂર્ણ કરામાં સહાયક ઉપરાંત નીચી પડતર અને કાર્યદક્ષતા તેના પાયાના તત્વો છે. સામાન્ય ભાષામાં બિઝનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ (Business Process Outsourcing - B.P.O.) બી. પી. ઓ. એટલે એક એવી પ્રક્રિયા છે કે કંપનીઓ પોતાના કેટલાક કામો ત્રાહિત પક્ષકારો પાસેથી કરાવવા અને જેના બદલામાં આવી કંપનીઓને કરાર પ્રમાણે જરૂરી ફી અથવા વળતર એ અગાઉથી નક્કી થયેલ છે તે ચુકવવામાં આવે છે. આ બી.પી.ઓ. નો મુખ્ય ઉદેશ કંપની પોતાનો ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન સમય પર અસરકાર અંકુશ મુક્કી વિશાળ નફો મેળવવાનો છે.





બી.પી.ઓ.નું ધ્યાન ઉપભોક્તાઓને શ્રેષ્ઠ સુવિધાઓ ઝડપી પૂરી પાડી તેમનો સંતોષ વધારવો, ગ્રાહકોને વસ્તુ કે સેવાની સાચી ઓળખ આપવી, ઉપભોક્તા વપરાશ વધારવી, હરિશાઈનો યોગ્ય સામનો કરવો અને છેલ્લે આ બધાનો લાભ એકમની નફાક્કારક વધારવાનો છે. વર્તમાન સમયમાં ઘણાં બધા એકમો બી.પી.ઓ. (B.P.O.) ની સેવા આપી રહ્યા છે. જેમાં કોલ સેન્ટર, હેલ્પ સેન્ટર, તબીબી–સ્વાસ્થ્ય વિવરણ, બિલ બનાવવા – મોકલવા, પગાર પત્રકો તૈયાર કરવા, ડેટા એન્ટ્રી, માહિતી સંચાર, સંદેશ વ્યવહારની સેવાઓ, માનવ સંશોધનને લગતી સેવાઓ, જેમાં કર્મચારીની ભરતી, ઇન્ટરવ્યુ, પસંદગી વગેરે બી.પી.ઓ. દ્વારા ઓછા ખર્ચ અને ઓછા સમયમાં શ્રેષ્ઠ રીતે મેળવી શકાય છે. બી.પી.ઓ.ના ઓછા સમયમાં શ્રેષ્ઠ રીતે મેળવી શકાય છે. બી.પી. ઓના સંશોધન અને વિકાસનો શેય ઇન્ફરમેશન ટેકનોલોજી (IT) ને આભારી છે. બી.પી.ઓ. ને કારણે ઇન્ફરમેશન ટેકનોલોજીની સેવા પણ બી.પી.ઓ. દ્વારા પૂરી પાડવામાં આવે છે. બી.પી.ઓ. આઈ.ટી.ની સુવિધાઓ પૂરતી જ મર્યાદિત નથી. પરંતુ તમામ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે.

બી.પી.ઓ. સરળ રીતે કહીએ તો વાણિજ્યની એવી પ્રક્રિયાઓનું કે કાર્યનું નિરાકરણ લાવે છે કે જેની સાથે લોકો એક પદ્ધતિથી જોડાયેલા હોય. ઓર્ડરો મેળવવા માટેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા અને એકમના ખર્ચ – પડતર નીચે લાવવી. સમગ્ર ધંધાકીય એકમની પદ્ધતિઓને કાર્યદક્ષતા તરીકે, જવાબદારીપૂર્વક, બ્રાન્ડની ઓળખ, ઉપભોક્તા સંબંધ અને સમગ્ર વ્યવસ્થાતંત્રને શ્રેષ્ઠતમ બનાવે છે.

૧૧.૨ બિજનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગના લાભ (બી.પી.ઓ.)

મહત્વના લાભ જોઈએ તો બી.પી.ઓ. સંચાલકોને તેમના રોજ – બરોજના કાર્યોમાંથી મુક્ત કરી તેમની કાબેલીયત ધંધાના મહત્વના નિર્ણયો તરફ કેન્દ્રીત કરી શકાય છે. એક વાર કંપની આઉટ સોર્સિંગના માળખામાં સફળ રીતે પ્રવેશયા બાદ સંચાલકો નવી ધંધાકીય આવકની તક શોધી નવા – નવા પ્રોજેક્ટો શરૂ કરી પોતાના ઉપભોક્તા – ગ્રાહકો તરફ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. કાર્યાલયની બાદના કાર્યોનું આઉટ સોર્સિંગ સામાન્ય રીતે વિકાસશીલ રાષ્ટ્રોની કંપનીઓને સોંપી નીચેના લાભ મેળવી શકાય છે.

- ૧. પડતર ઘટાડી શકાય છે:** – ધંધાકીય એકમના કેટલાક કાર્યો બહાર કરાવીને નિષ્ણાંત વક્તિઓનો લાભ મેળવી શકાય છે. તેમના જ યંત્રો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ એકમના યંત્રોનો ખર્ચ, મરામતનો ખર્ચ, મજૂરીનો ખર્ચ, વહિવટી ખર્ચ અને અન્ય ખર્ચાઓ ઘટાડી શકાય છે.
- ૨. કંપનીના (ધંધાના) મુખ્ય (ચાવીરૂપ) કાર્ય તરફ લક્ષ:** – રોજ બરોજના કાર્યાલયના કાર્યોનું આઉટ સોર્સિંગ કરાવીને સંચાલકોનાં સમય શક્તિ બચાવી એકમના મુખ્ય કાર્ય તરફ ધ્યાન આપી કંપનીને આર્થિક રીતે સદ્ગ્ર બનાવી શકાય છે.

આઉટ સોર્ચિંગ

૩. **બહારના નિષ્ણાંતોનો લાભ:-** જે તે કોન્ટ્રના નિષ્ણાંત અધિકારીની નિમણૂક કરી તાલીમ આપી તેનો લાભ લેવો એ અતિશય ખર્ચાળ બને છે. જ્યારે તેવા જ બહારના નિષ્ણાંતોને કામ સૌંપી તેમના શાન અને માર્ગદર્શનનો લાભ મેળવી શકાય છે.
૪. **ગ્રાહકોની સતત બદલાતી જતી માંગને ધ્યાનમાં રાખવી:-** ઘણાં બી.પી.ઓ.ની સેવા પૂરી પાડતા સ્થાનિક કેન્દ્રો ગ્રાહકોની બદલાતી જતી માંગની માહિતી, તેમજ ગ્રાહકોને જે પ્રકારનો બદલાવની જરૂરિયાત છે તે મુજબની માહિતી કંપનીને સંયોજન, જોડાણ કે સંયુક્ત સાહસમાં ફેરફાર કરવા મદદ કરે છે.
૫. **કમાણીમાં વધારો:-** અતિ મહત્વની ન હોય તેવી પ્રવૃત્તિઓનું આઉટ સોર્ચિંગ કરાય છે. કંપની તેનું વેચાણ અને બજાર હિસ્સામાં વધારો કરી શકે છે, નવી પેદાશોનો વિકાસ કરી શકે છે, નવા જ બજારમાં પ્રવેશી શકે છે. ગ્રાહકોની સેવાઓ અને સંતોષ વધારવામાં મદદરૂપ થાય છે.

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

૧૧.૩ નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગનો (Knowledge Process Outsourcing - KPO) અર્થ.

કે.પી.ઓ. એ ભારતમાં નવો જ ઉદ્ય પામતો અભિગમ છે. કે.પી.ઓ. એટલે નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ છે. કે.પી.ઓ. એ બી.પી.ઓ.નો સુધારેલ આવૃત્તિ સમાન છે. જૂની બી.પી.ઓ. પદ્ધતિમાં ગ્રાહકો કે ઓફિસને લગતા અત્યંત સામાન્ય કાર્યો જ બહારની દુનિયાને સૌંપવામાં આવતા હતા. પરંતુ કે.પી.ઓ.માં અગત્યના કાર્યો બહારના નિષ્ણાંત વ્યક્તિઓ કે કંપનીઓ પાસે કરાવવામાં આવે છે. કે.પી.ઓ. શાનને કે નિષ્ણાંત વ્યક્તિઓના ઉપયોગ પર પ્રકાશ ફેંકે છે. કે.પી.ઓ. એ ધ્યાનની એવી પ્રવૃત્તિઓને લક્ષ આપે છે કે જ્યાં નિષ્ણાંત વ્યક્તિઓની ખાસ જરૂર હોય, સંસ્થાને સામાન્ય કાર્ય કે પ્રક્રિયા પૂરી પાડવાને બદલે જ્યાં ઉચ્ચ શાન, ટેકનોલોજી અને નિષ્ણાંતોની જરૂર હોય તેવી પ્રવૃત્તિ કે કાર્ય પૂરા પાડવામાં આવે છે. કે.પી.ઓ. એ બી.પી.ઓ.ના એક દરજા કરતા આગળ છે. બી.પી.ઓ. પૂરા પાડતા ઔદ્યોગિક એકમો ખરેખર નિષ્ણાંત કે શાની વ્યક્તિને કાર્યશીલ અને બહુઉપયોગી બનાવવાનું કાર્ય કરે છે. બી.પી.ઓ. જ કે.પી.ઓ.ના અનેક લાભ અને ભવિષ્યના વિકાસના ફળ બનાવવાનું કાર્ય કરે છે.

પરંતુ આપણે માત્ર B ની જગ્યાએ K ને જ મહત્વ આપીએ એવું નથી. નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ એ ઉચ્ચ મુલ્ય વૃદ્ધિ પ્રક્રિયા છે. જે ખુબ જ ઉચ્ચ ગુણવત્તા અને લાયકાત માંગી લેતી યોજના માટે છે. વ્યક્તિઓનામાં રહેલું ઉપયોગી શાન અને અનુભવનો ઉપયોગ બહાર લાવવાની પ્રક્રિયા છે. જ્યારે આ





જ પ્રવૃત્તિ બહારથી મેળવવામાં આવે છે ત્યારે નવી જ ધંધાકીય પ્રવૃત્તિઓનો જન્મ થાય છે. અને આ જ પ્રવૃત્તિ નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ તરીકે ઓળખાય છે. કે.પી.ઓ. એ સેવાના મુલ્યાંકન અને મૂડી રોકાણના સંશોધનમા, પેટન્ટ મેળવવામાં, કાયદાક્રિય અને વીમાના ક્ષેત્રે એકમને સેવા આપવામાં ઉપયોગી છે. કે.પી.ઓ. ને સરળ શબ્દોમાં કહેવું હોય તો જે અતિમહત્વના કાર્યો છે જેમાં નિષ્ણાંત અને અનુભવી વ્યક્તિઓના જ્ઞાનની જરૂર હોય તેવા કાર્યો બહારના નિષ્ણાંત અને અનુભવી વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી કરાવવા.

નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ એ ઉચ્ચ કક્ષાના લક્ષ્યાંકે બહારની વ્યક્તિઓના ગૃહ (શક્ય છે કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં પ્રસરેલા હોય તેવા ગૃહ) પાસેથી કરાવવા. કંપનીના સામાન્ય કાર્યોમાં બી.પી.ઓ. વ્યવસ્થાતંત્રને ઉપયોગી બને છે. આગળની હરોળ ના ન હોય તેવા અને માહિતીની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરાવાના કાર્યો કે જેમાં ઈંગ્લીશ ઉપર સામાન્ય પ્રભાવ હોય અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન જરૂરી બને છે. જ્યારે નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ એ બી.પી.ઓ.ની તુલનાએ વધુ જટિલ અને વધુ મુલ્યવર્ધક હોય છે. વધુ અગત્યના કાર્યો માટે ઉપયોગી છે. કે.પી.ઓ. ના કાર્યો વધુ મુશ્કેલ ભર્યા અને ઉચ્ચ અભ્યાસ કે ખાસ પ્રમાણપત્ર ધરાવતા નિષ્ણાંતો દ્વારા કરાવાય છે. ઉદાહરણ તરીકે એકાઉન્ટિંગ તૈયાર કરવું, બજાર અને કાયદાક્રિય સંશોધનો, વેબ ડિઝાઇન અને સંપર્ક સર્જન કરનારા હોય છે.

કે.પી.ઓ. અને બી.પી.ઓ. ઘણીવાર કંપનીઓ આઉટ સોર્ચિંગ કરતા હોય છે. ઘણા ઉચ્ચ મુલ્યના કાર્યો સૌથી નીચા દરે રોજગારીનો દર હોય છે એવા રાષ્ટ્રોમાં કરાવવામાં આવે છે. કે.પી.ઓ. દ્વારા પોતાના રાષ્ટ્રની આર્થિક સમુદ્ધિમાં વધારો બી.પી.ઓ. ના જેમજ કરે છે. ભારત જેવા રાષ્ટ્રો જ્યાં માનવવસ્તી – શ્રમનો પૂરવઠો વધુ છે તેવા રાષ્ટ્રો કે.પી.ઓ અને બી.પી.ઓ.ના ઉદ્યોગને વધુ મહત્વ આપી રહ્યા છે.

૧૧.૪ કે.પી.ઓ. ના ફાયદા

- કે.પી.ઓ. દ્વારા કરાવવાનો મુખ્ય ધોય જે જટિલ અને ખાસ કાર્યદક્ષતાની ગણતરી અનિવાર્ય હોય તેવા જેવા કે પડતર પર અંકુશ, ઉચ્ચ સેવાઓ, ગુતવતા અને ઝડપ જરૂર હોય તેવા કાર્યો માટે કે.પી.ઓ. વધુ ઉપયોગી છે. આગળી હરોળના મહત્વના કાર્યો માટે સંચાલકો જ દ્વારા કરાતા હોવાથી પ્રત્યક્ષ કાર્યદક્ષતામાં વધારો થાય છે. જ્યારે પાછલી હરોળના કાર્ય માટે ઓછું મહત્વ આપતા ઉત્પાદન અને કાર્યદક્ષતામાં ઘટાડો થાય છે. જેથી પાછલી હરોળના કાર્યોનું આઉટ સોર્ચિંગ કરતા વ્યવસ્થાતંત્ર પૂનઃ સતત કાર્યરત થઈ ધોય પૂર્ણ થઈ શકે છે.**
- ઉચ્ચ કક્ષાની કાય ક્ષમતા:** – સારી અને સક્ષમ સેવાઓ પૂરી પાડતા કે.પી.ઓ. એકમ પાસે પેકનોલોજી, લોકોમાં કાર્ય પદ્ધતિમાં કરેલ રોકાણ સાર્થક બને છે. નિષ્ણાંતો રોકીને એક જ પ્રકારની સેવા અનેક ઉપભોક્તાઓ અથવા જરૂરિયાતમંદને પૂરી પાડીને તેવા કાર્યમાં નિષ્ણાંત બને છે. આમ ટેકનોલોજીમાં રોકાણ અને નિષ્ણાંતપણાના સંયુક્ત લાભ સેવા મેળવનાર કંપનીને

આઉટ સોર્ચિંગ

- મળે છે. ટુકમાં કંપનીને ઓછામાં ઓછા રોકાણ દારા અધતન ટેકનોલોજી અને નિષ્ઠાનોની શ્રેષ્ઠ સેવા ઉપલબ્ધ બને છે.
૩. **રોકડમાં ગતિશીલતા:-** આઉટ સોર્ચિંગ ઘણીવાર ઉપભોક્તાની મિલકતો સેવા પૂરી પાડનારને ફેરબાદલ કરે છે. સાધનો, વિહીકલ્સ, સુવિધાઓ, પરવાના કે વર્તમાન સમયમાં ઉપયોગી છે તેવી વસ્તુઓ વેન્ડર – છૂટક વેપારીઓને વેચે છે. ફેરિયાઓ – વેન્ડર આ મિલકતો ગ્રાહકોને વેચે છે. વસ્તુના મુલ્યમાં દરેક મધ્યસ્થ પોતાનું મુલ્ય વધારતો જાય છે. આ કથિત હેરફેર મુણ ગ્રાહકને રોકડમાં વધારો કરી આપે છે. જ્યારે આ મિલકત વેન્ડરને વેચવામાં આવે ત્યારે છાપેલી કિંમત પર વેચવામાં આવે છે જે સામાન્ય રીતે મુણ કિંમત કરતા વધુ હોય છે. અને આમ બે વ્યવહાર વચ્ચેનો તફાવતની રકમ વેન્ડરને અને મુણ ગ્રાહકને મળતો હોય છે.
૪. **સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ:-** દરેક ધંધાકીય એકમમાં હંમેશ ઉત્પાદનના સાધનોની મર્યાદા હોય છે. આઉટ સોર્ચિંગ એકમને આવા સાધનોની મર્યાદા હોય છે. આઉટ સોર્ચિંગ એકમને આવા સાધનોની અધિત પરોક્ષ રીતે દૂર કરે છે. ખાસ કરીને માનવ સંસાધનો પૂરા પાડીને. ખાસ કરીને સામાન્ય પ્રવૃત્તિઓનું આઉટ સોર્ચિંગ કરીને અતિમહત્વના કાર્યને ઝડપથી ગ્રાહકલક્ષી બનાવાય છે. એકમ આ માનવ સંપત્તિને કાર્ય સોંપણી કરીને કે કામદારોના જૂથનો ઉપયોગ વધુ મુલ્યવર્ધક બનાવવા પ્રતિનિધિ તરીકે ઉપયોગ કરે છે. જનશક્તિ જે આંતરિક શક્તિ હતી તેનો બાહારશક્તિમાં રૂપાંતર કરી ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે.
૫. **વિવિધ સમસ્યાઓનો ઉકેલ:-** આઉટ સોર્ચિંગ એ સંચાલકીય સમસ્યાઓના ઉકેલ અને સમાધાનથી જરૂરિયાતનો વિકલ્પ છે. ખાસ યાદ રાખવું જોઈએ કેઆઉટ સોર્ચિંગ કરતી કંપનીઓ જો કંપનીની જવાબદારીઓ બરાબર અદાન કરતી હોય તો તેમને લાંબા સમય સુધી ચાલુ ન રાખી તેમની સેવા અટકાવી દેવામાં આવે છે. આથી કંપની એવી જ કંપનીઓને આઉટ સોર્ચિંગ આપે છે કે જે કંપનીની સમસ્યાઓ મુણભૂત રીતે સમજે ને અને જો સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ જાય તો તેમની સાથે વાર્તાવાપ કરી આઉટ સોર્ચિંગમાંથી દૂર કરાય છે.
૬. **ધંધાના મુખ્ય કાર્ય પર ધ્યાન રાખવું:-** ધંધાકીય એકમના સામાન્ય કાર્યો બાધાર આઉટ સોર્ચિંગ કરાવીને પુર્ણ કરાતા હોવાથી સંચાલકોનો આ મહામુલ્ય સમય એકમના ખુબ જ જટિલ નિર્ણયો માટે એટલે કે એકમના સૌથી મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. સામાન્ય કાર્ય પરથી તેમની શક્તિ એકમના અસામાન્ય – અતિ મહત્વના કાર્યો ધ્યાન કેન્દ્રીત કરે છે. સંચાલકો પોતાના સ્ત્રોતોનો ઉપયોગ ગ્રાહકોના સંશોધનો – જરૂરિયાતો તરફ કેન્દ્રીત કરે છે.
૭. **નાણાકીય સ્ત્રોતોની શ્રેષ્ઠ ઉપયોગ:-** વિશાળ ધંધાકીય એકમો વિશાળ પાયા પર મૂડી મેળવવા હરિફાઈનો સામનો કરવો પડે છે. અનુભવી સંચાલકો હંમેશા પોતાની મૂડીનું રોકાણ કરી નશકારક યોજનામાં કરવું હંમેશા તેના વિશે જ વિચારતા હોય છે. એકમના સામાન્ય કાર્યોમાં રોકેલ મૂડી નશકારક છે કે

મોડયુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ

મોડયુલ - ૩

સેવાના ક્ષેત્ર



નોંધ

આઉટ સોર્સિંગ

કેમ તે કહેવું મુશ્કેલ છે. જ્યારે અસામાન્ય - મહત્વના કાર્યોમાં મુડી રોકાણ ઉત્પાદનના કાર્યોમાં રોકાયેલી હોય કે સેવાના કાર્યોમાં પરંતુ તે પ્રત્યક્ષ રીતે જ નફ્ફાકારક રોકાણ છે કે કેમ? તે કહી શકાય છે. આજ અભિગમથી સામાન્ય - રોજ બરોજના કાર્યોનું આઉટ સોર્સિંગ કરીને મુડી રોકાણ ઘટાડી શકાય છે. આઉટ સોર્સિંગને કારણે એકમની નાણાંકિય જરૂરિયાત ખુબ ઘટાડી શકાય છે અને આજ મુડીને મહત્વના કાર્યો - સંશોધનમાં રોકી ઈક્વિટી પર વધુ નફો મેળવી શકાય છે.

- c. **પડતર અંકુશઃ**— કંપની બધા જ કાર્યો જાતે કરવાનો અભિગમ રાખે એટલે કે કંપની ઉચ્ચ સંશોધનો, વિકાસ, બજાર પ્રક્રિયા અને અન્ય કાર્યો બધું જ જાતે કરે તો અનેક ઘણ્ણો ખર્ચ વધી જાય છે અને આ બધા જ ખર્ચનો બોજ ગ્રાહક પર આવે છે. પરંતુ જે કાર્ય બહાર સસ્તા દરે કરાવી શકતા હોય તેવા કાર્યો નીચા દરે બહાર કરાવીને ખુબ જ ખર્ચ ઘટાડી શકાય છે. જેનો સીધો જ લાભ ગ્રાહકોને મળે છે. આ ઉપરાંત ખુબ જ ઓછા મુડી રોકાણ આઉટ સોર્સિંગથી આધુનિક ટેકનોલોજી - ઇન્જિસ્ટકચરનો લાભ નિષ્ણાતોનો લાભ, કિયાત્મક લાભ મેળવી કંપની ખરેખર ખર્ચ પર અંકુશ મુકે છે. જે અન્યની તુલનામાં ખુબ ફાયદાકારક બને છે.
- d. **ઓછામાં ઓછા જોખમો**— ધંધાકિય એકમના અસામાન્ય જોખમો મુડી રોકાણ સાથે જોડાયેલા હોય છે. બનાર, હરિઝાઈ, નાણાંકિય પરિસ્થિતિ, સરકારી નિયંત્રણો અને ટેકનોલોજી ઝડપી પરિવત ન પામતા હોય છે. આ પરિબળો બદલાતા એકમના જોખમોનું પ્રમાણ વધે છે. ખાસ કરીને આવનાર સમયમાં આવા બદલાતા જતા પરિબળોમાં નાણાંકિય જરૂરિયતો મેળવવી મુશ્કેલ હોય છે. તેમ છતાં આઉટ સોર્સિંગની સેવા પૂરી પાડતા એકમો ધંધાકિય એકમની નાણાંકિય જરૂરિયતો ઘટાડે છે. પરિણામે એકમના મુડી રોકાણના જોખમો વિભાજિત થાય છે. જેથી એક ચોક્કસ કંપનીના જોખમોનું પ્રમાણ ઘટે છે.

૧૧.૫ કે.પી.ઓ (નોલેજ પ્રોસેસ આઉટ સોર્સિંગ) અને બી.પી.ઓ (બિજનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગ)નો તફાવત

નોલેજ પ્રોસેસ આઉટ સોર્સિંગના ઉદ્ઘોગો એ બિજનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગથી તદ્દન ભિન્ન છે. કે.પી.ઓ.માં ચોક્કસ લાયકાત ધરાવતા અનુભવી નિષ્ણાતની અનિવાર્યતા છે. કે.પી.ઓ.ની સેવા આપતા નિષ્ણાતો ઉચ્ચ શિક્ષણ અને અનુભવનો નિયોગ હોય છે. જ્યારે બી.પી.ઓ.ના ઉદ્ઘોગએ સામાન્ય કાર્યો મોટા જથ્થામાં અને પ્રમાણમાં ઓછા સરળ કાર્યો સાથે જોડાયેલા છે. બી.પી.ઓ.માં મજૂરીનું કામ વધુ તેમજ ઓછી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત હોય છે. જ્યારે કે.પી.ઓ.માં નિર્ણયશક્તિની જરૂરિયાત વધુ અને જે તે ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂરિયાત છે. જેમ કે વક્કિલ, ડાક્ટર્સ અને એન્જીનિયર જેવા વિશિષ્ટ નિષ્ણાતોની જરૂરિયાત છે. કે.પી.ઓ અને બી.પી.ઓની તુલના ખર્ચની દ્રષ્ટિએ પણ કરી શકાય. કે.પી.ઓના કાર્યમાં રોકાયેલ કર્મચારીઓનું પગાર

આઉટ સોર્ચિંગ

ધોરણ બી.પી.ઓ કરતા ખુબ જ વધુ હોય છે. કારણ કે કે.પી.ઓ.ની સેવા આપણા નિષ્ઠાતો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા એન્જીનીયર, ડૉક્ટર, સી.એ., વકીલ વગેરે હોય છે. બી.પી.ઓ. ગ્રાહકોને લાભ, સેવાઓ, ટેકનીકલ સપોર્ટ અવાજ દ્વારા, ટેલી માર્કેટિંગ વેચાળ વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. જ્યારે કે.પી.ઓ. ખુબ જ શાનની જરૂરિયત હોય તેવી સેવાઓ, નિષ્ઠાતોની સેવા અને જ્યાં ચર્ચા – વિચારણા માંગીલે તેવા ક્ષેત્રો જેવા કે કાયદાકિય સાહ સૂચનો, ધંધાકીય તક અને બજાર સંશોધન વરેરે. બી.પી.ઓ.માં વ્યવહારિક, ધંધાકીય સમજ અને મગજ નિર્ણયોનો અમલ કરી શકે તે જરૂરી છે. બી.પી.ઓ.માં કર્મચારીઓ વધુ લાયકાત ધરાવતા હોવા ન જોઈએ. જે માત્ર માહિતી સંચારના સાધનોની ઉપયોગિતા સમજતો હોવો જોઈએ. જ્યારે કે.પી.ઓ.ના કર્મચારીઓ પાસે વિશિષ્ટ કોશલ્ય અને જે તે ક્ષેત્રમાં વિશિષ્ટ લાયકાત – શાન અને અનુભવ અનિવાર્ય છે. આથી જ કે.પી.ઓના કર્મચારીઓ પાસે ઉચ્ચ શિક્ષણનું શ્રેષ્ઠ શાન હોવું જોઈએ.

મોડ્યુલ – ૩ સેવાના ક્ષેત્ર



નોંધ



૧૧.૧ પાઠગત પ્રશ્નો

૧. ખાલી જગ્યા પૂરો.

૧. આઉટ સોર્ચિંગ દ્વારા વસ્તુનું સરળ રીતે ઉત્પાદન કરી શકાય છે કે જે સામાન્ય રીતે , , શુષ્ણધમો ધરાવતું હોય છે.
૨. કે જ્યાં ગ્રાહકો પોતાનું કાર્ય વિવિધ સ્થળે પૂર્ણ કરવા મોકલતા હોય છે.
૩. કંપનીના દસ્તાવેજો કાગળ પરના માધ્યમથી ઇલેક્ટ્રોનીક માધ્યમમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે
૪. બી.પી.ઓ. સામાન્ય રીતે બે જૂથમાં વહેંચાયેલ છે અને

૨. નીચેના વિધારનો સાચા છે કે ખોટા તે જણાવો.

૧. ઓફિસ કાર્ય પદ્ધિની પ્રક્રિયા માટે બી.પી.ઓ.ના કર્મચારીઓને કર્મચારીઓના સતત સંપર્કમાં રહેવું પડે છે.
૨. ઓફિસ કાર્ય પદ્ધિની પ્રક્રિયા માટે માહિતી સંચારની જરૂરિયાત કોલીગ પ્રક્રિયા કરતા વધુ હોય છે.
૩. કોલ સેન્ટરમાં સામાન્ય રીતે ગ્રાહકોને ભુતકાળની માહિતી અને હિસાબ અંગેની માહિતી આપવામાં આવે છે.
૪. કંપની આઉટ સોર્ચિંગનું કાર્ય કઠીનાઈ અને દબાણપૂર્વક કરે છે.

મોડયુલ – ૩

સેવાના ક્ષેત્ર



નોંધ

આઉટ સોર્ચિંગ

૫. ઉત્પાદનમાં સ્થિરતા અને ચોક્કસાઈ રાખવા આઉટ સોર્ચિંગનું કાર્ય આપવામાં આવે છે.
૬. બહુવિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.
- નીચેનામાંથી ક્યો લાભ કે.પી.ઓ. (KPO) દ્વારા મળતો નથી.
 - સ્ત્રોતોના વૈકલ્પિક ઉપયોગ.
 - સમસ્યાઓનું નિરાકરણ.
 - મુખ્ય ધંધાકીય બાબતો પર ધ્યાન.
 - વિવિધ સમસ્યાઓનું નિરાકરણ.
૭. કે.પી.ઓ.નું ફુલ ફોર્મ આપો.
- નોલેજ પ્રોસેસ આઉટ સોર્ચિંગ.
 - નો પ્રોસેસ આઉટ સોર્ચિંગ.
 - નોલેજ પ્લોર આઉટ સોર્ચિંગ.
 - નોલેજ પ્રસેસ ઓવરસીસ.
૮. નીચેનામાંથી કયા તત્ત્વની ગેરહાજરી હોય તો વસ્તુના ઉત્પાદનના આઉટ સોર્ચિંગ કરી શકાય નહીં.
- | | |
|-----------|----------|
| અ. આકાર | બ. કદ |
| ક. સ્વરૂપ | ડ. કિંમત |



તમે શું શીખ્યા?

બિઝનેશ આઉટ સોર્ચિંગ એ એક પ્રકારનો કરાર છે કે ચોક્કસ કાર્ય, ચોક્કસ હેતુ જેવા કે પગાર પત્રક બનાવવા ગીજા પક્ષકારને સેવા પૂરી પાડવી. બી.પી.ઓ. એ સામાન્ય રીતે કંપનીના સામાન્ય કાર્યો બહાર બીજા પાસે કરાવીને બિનજરૂરી ખર્ચને ઓછા કરી શકાય. પરંતુ કંપનીના અતિ મહત્વના કાર્યો બી.પી.ઓ. દ્વારા ન કરાવી શકાય. બી.પી.ઓ.ના આધારથી જ આપણે બજારમાં અગ્રીમ સ્થાન જાળવી ન શકીએ. બી.પી.ઓ.ના હેતુઓ ખર્ચ ઘટાડવા, મુખ્ય ધંધા પર ધ્યાન રાખવા, નિષ્ણાતોની સેવાનો લાભ લેવા હોય છે. કે.પી.ઓ. ધંધાના અતિ મહત્વના કાર્યો કે જેમાં નિષ્ણાત વ્યક્તિત્વોની સેવાની જરૂરિયાત હોય, કે.પી.ઓ. ધંધાના જે કાર્યોમાં નિષ્ણાત અનુભવી અને જટિલ શાનની – આવડતની જરૂર હોય તેવા કાર્યોમાં કાર્યદક્ષ અને નિપૂણ વ્યક્તિત્વો દ્વારા કાર્ય પુરુષ કરાય છે. કે.પી.ઓ. આધુનિક ટેકનોલોજી દ્વારા ઉત્પાદન કાર્ય કરાવવાનો લાભ થાય છે. બજાર કે ઉત્પાદન

આઉટ સોર્સિંગ

માળખાની શ્રેષ્ઠ સુવિધાનો લાભ લઈ શકાય છે. કઠીન કાર્યો સરળ રીતે પાર પાડી શકાય છે. મુખ્ય કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે. લાંબા સમયનું મુડી ભંડોળ શકાય બને છે. વગેરે લાભ કે.પી.ઓ. દ્વારા થાય છે. મુખ્ય તકાવત બંને વર્ચ્યેનો એ છે કે બી.પી.ઓ એ માનવના શારીરિક શ્રમને અને ઓછી લાયકાત કે ઓછા તાલિમ પામેલા કર્મચારીઓ દ્વારા કરાય છે. જ્યારે કે.પી.ઓ. ઉચ્ચ શૈક્ષણિક જ્ઞાન, નિષ્ણાતોની જરૂરિયાત જેવા કે વકીલ, ડૉક્ટર, વ્યવસાયિક સંચાલકો અને અન્જીનિયરની જરૂર રહે છે.

મોડ્યુલ – ૩
સેવાના ક્ષેત્ર



નોંધ



(સ્વાધ્યાય) – પ્રક્રિયા સ્વાધ્યાય

- તમે આઉટ સોર્સિંગમાં શું સમજાવો? સમજાવો.
- બિજનેશ આઉટ સોર્સિંગ એટલે શું? તેના લાભ જણાવો.
- નોલેજ બિજનેસઆઉટ સોર્સિંગ એટલે શું? તેના લાભ જણાવો.
- બિજનેશ પ્રોસેસ આઉટ સોર્સિંગ અને નોલેજ આઉટ સોર્સિંગ વર્ચ્યેનો તકાવત સ્પષ્ટ કરો.



પાઠગત પ્રશ્નોના ઉત્તર

- ૧૧.૧
૧. આકાર, કદ, સ્વરૂપ ૨. ઓફ શોરીંગ
 ૩. માહિતી – ડેટા એન્ટ્રી જોબ
 ૪. ઓફિસ પહેલાના અને ઓફિસ પછીનાં કાર્યો
- ૨.
૧. ખોટું, ૨. ખોટું, ૩. સાચું, ૪. ખોટું, ૫. સાચું
- ૩.
૧. ઢ, ૨. અ, ૩. ઢ

મોડયુલ – ૩

મહત્તમ માર્ક

૨૫

અભ્યાસના કલાક

૪૫

ખરીદ – વેચાણ અને વિતરણ

વર્તમાન વैશ્વિક બજારમાં જથ્થાબંધ ઉત્પાદનને કારણે અસરકારક વિતરણ માર્ગો અપનાવવા પડે. આધુનિક ટેકનોલોજીના કારણે વેચાણ અને વિતરણ કોને વિવિધ પદ્ધતિઓમાં આમુલ કાંતિ આવેલ છે. અને વિશ્વ એક બજાર બન્યુ છે. આજે એક દેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુ અને સેવાઓ ત્વરીત બીજા રાષ્ટ્રોમાં ઉપલબ્ધ બને છે. આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે વિદ્યાર્થીઓ ઘંધાકીય જગતમાં વસ્તુ અને સેવાના ખરીદ – વેચાણ અને વિતરણની પ્રક્રિયા સમજી શકે. જાહેરાત અને વેચાણ વૃદ્ધિની વિવિધ પદ્ધતિઓ અપનાવી શકે.

- | | |
|--|----------------------------|
| પાઠ – ૧૨ : ખરીદ અને વેચાણ | પાઠ – ૧૩ : વિતરણના માધ્યમો |
| પાઠ – ૧૪ : છૂટક વેપાર | પાઠ – ૧૫ : જાહેરાત |
| પાઠ – ૧૬ : વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ | |

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

૧૨

ખરીદ અને વેચાણ

તમારા રોજ બરોજના જીવનમાં તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષવા માટે તમારે કેટલીક વસ્તુની જરૂર પડે છે. દા.ત. તમારે નાસ્તા માટે દૂધ અને બ્રેડની જરૂર પડે, પહેરવા માટે કપડાં, સવારી કરવા સાઈકલ, રોકગમુકત થવા માટે દવા તથા મનોરંજન માટે ફિલ્મ જોવાની જરૂર પડે છે. આ બધું તમે કેવી રીતે મેળવી શકો? આ બધી વસ્તુ બજારમાં વેચાણ માટે તૈયાર હોય છે. આ બધાની તમારે જેમ અને જ્યારે જરૂર પડે ત્યારે તમે ખરીદી શકો છો. એ જ રીતે વ્યાપારમાં પણ વ્યાપારી સાહસોને ઉત્પાદન માટે કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે ખરીદવા પડે છે. અને કાર્યાલય પરિસર માટે જમીન, મકાન (ઇમારત) ફર્નિયર, લેખન સામગ્રી, કોમ્પ્યુટર વગેરેની જરૂર પડે છે. સાથો સાથ વ્યાપારી સાહસો પોતાના ઉત્પાદનની માલસામગ્રી તથા સેવાઓ વેચવાનું પણ કામ કરે છે. આમ, આપણો આપણો આજુભાજુ ખરીદ અને વેચાણ જેવી આવશ્યક પ્રવૃત્તિઓ થતી જોઈ શકીએ. ચાલો આપણો આ પાઠમાં આ બધા વિષે વધુ શીખીએ.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે સમજી શકશો

- ખરીદ અને વેચાણની વાખ્યા આપી શકશો.
- વ્યાપારમાં વેચાણની સંકલ્પન સમજાવી શકશો.
- ખરીદના વિવિધ પ્રકારો અને વેચાણની પદ્ધતિઓ વર્ણવી શકશો.
- વેચાણ પ્રક્રિયા અને તેમાં વેચાણ માટે વપરાતા દસ્તાવેજો વિષે સમજાવી શકશો.

૧૨.૧ ખરીદ અને વેચાણનો અર્થ

ખરીદી એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પૈસા આપીને કેટલીક વસ્તુઓ કે સંપત્તિ બીજા પાસેથી પોતાના નામે કરી શકે છે. આમા પૈસા આપીને બીજાની પાસેથી સેવા મેળવવાનો પણ સમાવેશ થઈ જાય છે. એજ રીતે વેચાણ પણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા માલસામાન કે સંપત્તિ એક માણસ પાસેથી રોકડા પૈસાના બદલામાં અથવા ઉધારથી બીજા માણસ નામે તબદીલ કરી શકાય છે. આમા પૈસા લઈને અપાતી સેવાઓનો પણ સમાવેશ થઈ જાય છે.



ખરીદ અને વેચાણ

આમ ખરીદ અને વેચાણ બંને સાથે સાથે જ ચાલે છે જ્યાં વેચાણ હોય ત્યાં ખરીદી અને ખરીદી હોય ત્યાં વેચાણ અવશ્ય હોય જ છે. આમ મૂળભૂત રીતે દરેક ખરીદ-વેચાણમાં બે પક્ષો હોય છે. એક પક્ષ જે વેચાણ કરે છે. તેને વેચાણકર્તા (વિકેતા) કહે છે. અને બીજો પક્ષ જે ખરીદી કરે છે તેને 'ખરીદનાર' (ગ્રાહક) કહેવાય છે.

ચાલો આપણે એક ઉદાહરણથી સમજીએ. રમેશ તમારા વિસ્તારમાં એક દુકાનદાર છે. તે મોટા શહેરમાં જઈને હોલ સેલ વેપારી પાસેથી રોકડેથી રેડીમેઇડ જલ્બા લઈ આવે છે. અહીં હોલસેલ વેપારી 'વેચાણકર્તા' છે. અને રમેશ ખરીદ કરનાર છે. રમેશ આ રેડીમેઇડ વસ્ત્રો પોતાની દુકાનમાં લાવે પછી તમે તેની દુકાને જઈને પૈસા આપીને એક શર્ટ ખરીદો છો. અહીં રમેશ વેચાણકાર છે અને તમે ખરીદદાર છો.



આમ, આપણે જોઈએ છીએ કે ખરીદ કરનાર માલ સામગ્રી કે સેવાઓ વેચાણકાર પાસેથી પૈસા આપીને પોતાના વપરાશ કે ઉપયોગ માટે ખરીદે છે અને વેચનાર પૈસા સ્વીકારે છે અને તેને ખરીદનાર ના પક્ષમાં જતા કરે છે. આ પ્રક્રિયામાં ખરીદ કરનાર કાં તો પૈસા તાત્કાલિક રોકડા ચૂકવી આપે છે અથવા પછી પાછળથી ગમે ત્યારે આપે છે.

ખરીદી અને વેચાણની સંક્લયના:-

તમે જાણો છો કે વેપારીઓ અન્ય લોકોના ઉપયોગ માટે જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. લોકો અમૃક કિમત આપી તે વસ્તુઓ કે સેવાઓ ખરીદે છે અને વેપારીઓ તેમની પાસેથી પૈસા કમાય છે. આ પૈસા વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના ખર્ચ કરતાં વધારે હોય તે જરૂરી છે. આ રીતે કોઈ વેપારમાં (ધન) (લાભ, નફો) કમાઈ શકાય છે. નફો એ વેપારીએ ઉદાહેરા જોખમનું ઈનામ (વળતર) પણ છે અને તેમણે રોકેલી મૂડીનું વળતર પણ છે. આમ વ્યાપારી સાહસોએ કરેલ ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન વેચાય તે જરૂરી છે. આમ ઉત્પાદનનું વેચાણ ખુદ વ્યાપારી સાહસના અસ્તિત્વ માટે તેમજ સમયની સાથે વૃદ્ધિ માટે પણ જરૂરી છે.

વસ્તુઓ કે સેવાઓને વેચાણકષ્મ બનાવવા માટે ઉત્પાદન શરૂ કરતા પહેલાં પણ કંઈક વિશેષ કરવાની આવશ્યકતા છે.

- ક. લોકોની જરૂરિયાંને પ્રથમ ઓળખવાની અને નક્કી કરવાની જરૂર છે અને તેને અનુરૂપ માલ સામાન અને સેવાઓ ઉત્પન્ન કરવાની રૂપરેખા ઘડવી જોઈએ.
- ખ. ગ્રાહકને પોતે ખરીદેલી વસ્તીમાંથી હંમેશા સંતોષ મળવો જ જોઈએ અને તેથી ઉત્પાદન અને સેવાઓમાં સતત (નિરંતર) સુધારો થતો જાય તે જરૂરી છે.
- ગ. ઉત્પાદન કે સેવાઓ ગ્રાહકોને સરળતાપૂર્વક સુલભ અને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
- ઘ. ઉત્પાદન કે સેવાઓની કિમત ગ્રાહકોને પોસાય તેવી હોવી જોઈએ.

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



૩. ઉત્પાદન અથવા સેવાઓ વિષેની જાણકારી અને તેના લાભો વિષેની જાણકારી વેચાણ પૂર્વ અને પછી પણ મેળવી જોઈએ.

ઉપરોક્ત તમામ કાર્ય (પ્રવૃત્તિઓ) ના સમૂહને વ્યાપારમાં બજાર પ્રક્રિયા કહેવાય છે. વેચાણ એ બજાર પ્રક્રિયાથી ભિન્ન છે છતાં તેનો એક ભાગ છે.



૧૨.૧ પા�ગત પ્રશ્નો

કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

૧. વેચાણ અને હંમેશા સાથે જ ચાલે છે.
 (બજાર, ખરીદી, હુકાન)
૨. દરેક ખરીદ-વેચાણમાં વેચનારને પૈસા આપે છે.
 (હુકાનદાર, ખરીદનાર, ઉત્પાદક)
૩. વેપારીઓ કમાય છે કારણ કે લોકો તેની વસ્તુઓ અને સેવાઓનું મુલ્ય ચૂકવે છે.
 (નફો, પૈસા, અધિક)
૪. ગ્રાહકને પોસાય તેવી કિંમતે વસ્તુઓ આપવી તે પ્રક્રિયાનો એક ભાગ છે.
 (વેચાણ, બજાર, વિતરણ)
૫. એવી બધી પ્રવૃત્તિઓ કે જે ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને ઉત્પાદકથી ઉપભોક્તા તરફ વાળે તે જો જ એક ભાગ છે.
 (વિતરણ, પરિવહન, વેચાણ)

૧૨.૨ રોકડ અને શાખ પર ખરીદી અને વેચાણ

૧૨.૩ ખરીદીની પદ્ધતિઓ

ખરીદી અને વેચાણની થોડીક જાણકારી મેળવ્યા બાદ ચાલો આપણે હવે ચીજ વસ્તુઓ ખરીદતી વખતે ઉપયુક્ત વિવિધ પદ્ધતિઓ વિષે શીખીએ વસ્તુઓની ખરીદી યાતો તેમનું જાતે નિરીક્ષણ કરીને અથવા તો નમુનાનું પરીક્ષણ કરીને કરી શકાય છે. આ ઉપરાંત તેમના વર્ણનના આધારે અથવા તેમની બ્રાન્ડના નામના આધારે પણ કરી શકાય છે. ચાલો આ પદ્ધતિઓ વિષે વધારે જાણકારી મેળવીએ.

મોડ્યુલ - ૪
ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ

- નિરીક્ષણ દ્વારા ખરીદી:** - માનો કે તમારે ખમીશ કે પેન કે શાકભાજી ખરીદવા હોય તો તમે શું કરો? તમે તમારી નજીકની કોઈ દુકાન પર રૂબરૂ જઈને ખમીશ કે પેન કે શાકભાજીની જાતે તપાસ કરશો અને પછી ખરીદશો. આ ખરીદીની એક સર્વાવિધ પ્રચલિત રીત છે. જેને જાતે નિરીક્ષણ દ્વારા ખરીદીની પદ્ધતિ કહેવામાં આવે છે. તેમાં ખરીદનાર પોતે વેપારી પાસે જાય છે અને જે વસ્તુ ખરીદવાનું પોતે નક્કી કર્યું હોય તેનું અથવા વસ્તુઓના સમગ્ર જથ્થાનું જાતે નિરીક્ષણ કરે છે. આ ખરીદ પદ્ધતિ મોટેભાગે છૂટક ખરીદીમાં વપરાય છે.
- નમુના દ્વારા ખરીદી:** - જ્યારે તમારે જથ્થાબંધ ખરીદી કરવી હોય ત્યારે ખરીદવાના સંપૂર્ણ જથ્થાની ચકાસણી કરવી શક્ય નથી. ત્યારે તમે નમુના કે તરાફ (પ્રતિરૂપ)-ની તપાસ કરીને કઈ વસ્તુ ખરીદવી તે નક્કી કરો છો. નમુનો વસ્તુની પ્રતિકૃતિ હોય છે, ખાસ કરીને કાચો માલ કે ખાદ્ય પદાર્થની. આ નમુનો સમગ્ર ઉત્પાદનના પ્રતિનિધિરૂપ હોય છે. તેની ગુણવત્તા તે પૂરા જથ્થાની ગુણવત્તા દર્શાવતી હોય છે. એ જ રીતે પેટન્ (ઇપ) એ પ્રમાણભૂત ઉત્પાદિત વસ્તુનો નમુનો (પ્રતિકૃતિ) હોય છે. જેમ કે કાપડ કે હાથી (નાળિયેર ના તાંત્રણ -ઇલક્ટ્રાન્ડ) નું ગાદલું વગેરે. તે સમગ્ર ઉત્પાદનના રંગ, બનાવટ (પોત, વણાટ) વગેરે દર્શાવે છે. કેટલીકવાર તેની ઉપર કોડનંબર પણ દર્શાવેલ હોય છે. ખરીદીનો ઓર્ડર આપતી વખતે કોડનંબરનો પણ ઉપયોગ કરી શકાય. બંને પણો એ વાત સ્વીકારે છે (સહમત થાય છે, કબુલ થાય છે) કે સમગ્ર જથ્થો (પૂરવઠો) નમુના (ઇપ) પૂર્માણેની જ ગુણવત્તા ધરાવે છે.
- ઉત્પાદનની બ્રાન્ડ અથવા વિવરણ દ્વારા ખરીદી:** - અમુક કિસ્સામાં વેપારી સંભવિત ગ્રાહકને વસ્તુનો નમુનો પણ દર્શાવી શકતો નથી. દા.ત. કોઈ ફર્નિચરનું ઉત્પાદન કરનાર પોતાનું ફર્નિચર લઈને ગ્રાહકને દેખાડવા માટે સંભવિત ગ્રાહકની શોધમાં ભટકી શકતો નથી. તો આને બદલે તે શું કરશો? તે વેચાણ માટે રજૂ થયેલા માલસામાનના વિવરણ અને કિંમત સહિતની યાદી (સૂચિપત્ર) પોતાની સાથે લઈ જશો. કયારે ચીજવસ્તુ પ્રમાણભૂત ઉત્પાદન હોય છે. તેની ગુણવત્તા અને કિંમત ચોકકસ નિર્ધારિત હોય છે. કેટલીકવાર તેમને નંબર કે નામ આપવામાં આવે છે. કેટલીકવાર આ નામો બ્રાન્ડ (માઝો) તરીકે પ્રચલિત બની જતા હોય છે. જેમ કે ગોદરેજ, સ્ટોરવેલ, સર્ફ, ધારા, લાઈફબોય, ફેવિકોલ, પ્રેપ્સોડન્ટ વગેરે



આમાં ગ્રાહકે ખરીદી કરવા માટે બ્રાન્ડ નામ કે ઉત્પાદનનું વિવરણ દર્શાવી ઓર્ડર આપવાનો હોય છે.

૧૨.૪ વેચાણની પદ્ધતિઓ

અમૃક વસ્તુ ખરીદતાં પહેલાં કેટલીકવાર આપણે વસ્તુ કેવી રીતે મેળવવી કે કઈ રીતે પૈસા ચુકવવા તેની આપણને બબર હોતી નથી. જો આપણે વીજળીનો સામાન વેચાણારની દુકાને જઈએ તો છૂટક વેપારી સામાન્ય રીતે એવી આશા રાખતા હોય છે કે આપણે તેને રોકડા પૈસા આપીશું અને આપણી પસંદગીની વસ્તુ લઈશું. હવે માનો કે કોઈ વસ્તુ ગ્રાહક ખરીદવા માંગતો હોય તે જરા વધારે ખર્ચણ વસ્તુ હોય. દા.ત. માઈક્રોવેવ ઓવન તો ગ્રાહક સમગ્ર કિંમત એક સાથે ચુકવી ન શકે એમ બને.

તો વેપારી તેને અમૃક રકમ તુરત ચુકવીને બાકીની રકમ માસિક હપ્તામાં ચુકવવાની છૂટ આપી શકે. વળી કયારેક તેમને રસ્તાની બાજુએ બેનર (પતાકા) લગાવેલી પણ જોવા મળે છે કે રવિવારે ફર્નિચરની હરાજી થશે. તમે તમારી પસંદગીની જાણસ લેવા માટે હરાજીમાં બોધી લગાવી શકો. કેટલીક વાર રાજ્ય સરકારે બહાર પાડેલી નોટિસો (જાહેરાતો) પણ વાંચી હશે જેમાં સરકારે અમૃક વસ્તુ પુરી પાડવા માટે વેપારીએ પાસેથી ટેન્ડરો / ભાવપત્રકો મંગાવ્યા હોય. આ બધી જ વેચાણની પદ્ધતિઓ છે. હવે આપણે આ બધી પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરીશું.

૧. ભાડાની ખરીદ પદ્ધતિ:-

ભાડા ખરીદ પદ્ધતિમાં ખરિદકિંમત હપ્તાઓમાં ચુકવવાની જોગવાઈ હોય છે. છતાં જ્યાં સુધી તમારા હપ્તા ચુકવાઈ ન જાય ત્યાં સુધી વસ્તુને ભાડાની વસ્તુ જ ગણવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભલે માલનું વિતરણ ગ્રાહકને કરી ટેવામાં આવે છતાં તેનો માલિકી હક વેપારી પાસે જ રહે છે. અને ગ્રાહક જે રકમ ચુકવે તે વસ્તુ ભાડે લીધેલાનું મુલ્ય ગણવામાં આવે છે. જો ગ્રાહક કોઈ હપ્તો ન ભરી શકે તો વેપારી તે વસ્તુ પાછી આપવાની માંગણી કરી શકે છે. એટલું જ નહીં. ચુક કરનાર ગ્રાહક ઉપર પોતાને થયેલા નુકસાન બદલ કાનુની દાવો પણ માંડી શકે છે. અહીં એક વસ્તુ ખાસ નોંધવી જોઈએ કે ગ્રાહક હપ્તાની સમયાવહિ દરમિયાન ગમે ત્યારે કુલ રકમ ચુકવી દઈને વસ્તુની ખરીદી કરી માલિકી ધરાવવાનો અધિકાર ધરાવે છે. આવી જાતની ખરીદી મોટે ભાગે ઘર, પ્લાન્ટ (કારખાનાં), યંત્ર સામગ્રી જેવી ટકાઉ અને બહુમુલ્ય વસ્તુ માટે વાપરવામાં આવે છે.

૨. વેચાણની વિલંબિત હપ્તા યોજના:-

જ્યારે વસ્તુઓ વેચવામાં આવે અને ચુકવણું હપ્તામાં કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે તેને વેચાણની વિલંબિત હપ્તા યોજના તરીકે ઓળખવામાં આવે છે. આવા કિસ્સામાં જો ગ્રાહક કોઈ હપ્તાની ચુકવણીમાં કસુરવાર થાય તો પણ વેપારી પોતાની વસ્તુ પાછી આપવાની માગણી કરી શકતો નથી. કારણ કે જ્યારે પ્રારંભિક ચુકવણું થાય

ખરીદ અને વેચાણ

અને વસ્તુ વેચાય ત્યારે જ વસ્તુની માલિકીનો હક ગ્રાહકને મળી જાય છે. બહુ બહુ તો વેપારી બાકીની લેણી સામે ન્યાય અદાલતમાં ગ્રાહક સામે દાવો દાખલ કરી શકે.

૩. સંમતિથી વેચાણ:-

સંમતિથી વેચાણ મૂળભૂત રીતે શરતી વેચાણ છે. આ પ્રકારના વેચાણમાં રકમ ચૂકવી આપતાં ગ્રાહકને વસ્તુ એવી સમજણ સાથે આપવામાં આવે છે કે ખરીદનાર અમુક નિઃચત સમય મર્યાદામાં વસ્તુ (સમગ્ર જથ્થો કે તેનો અમુક ભાગ) વેપારીને પરત કરી પોતે ચૂકવેલી રકમ અમુક સમય સુધીમાં પરત કરવાનો દાવો કરી શકે છે. જો વસ્તુ ગ્રાહકની જરૂરિયાતો સંતોષી ન શકે તો આમ થઈ શકે છે. જો નિધારિત સમયમાં ગ્રાહક વેપારીને જાણ ન કરે તો વસ્તુ વેચાઈ ગઈ છે એમ માની લેવામાં આવે છે. ક્યારે આ વેચાણ પદ્ધતિમાં અમુક ફેરફારો પણ કરવામાં આવે છે. માલ ગ્રાહકને સંમતિથી મોકલવામાં આવે છે. તેમાં એવી સમજણ હોય છે કે સંમતિ સૂચવવા માટે ગ્રાહક પૈસા ચૂકવી આપે અથવા કોઈપણ જાતના દેણા (ત્રણ) વગર વસ્તુ પાછી આપે.

૪. ટેન્ડર દ્વારા વેચાણ:-

વેચાણની આ પદ્ધતિ સામાન્ય રીતે મોટા સંગઠનો કે સરકાર દ્વારા અત્યંત મોટા પાયા ઉપર થતી ખરીદીના કિસ્સામાં જોવા મળે છે. જેમાં જરૂરી માલનો જથ્થો પણ અત્યંત વિશાળ માત્રામાં હોય છે અને ચૂકવવાની રકમ પણ અતિશય મોટી હોય છે. ટેન્ડર (નિવિદા) એક બાંહેદારી છે. જેમાં દશા વેલી શરતો પ્રમાણે માલસામાનનો પૂરવઠો પૂરો પાડવાનો હોય છે. વેચાણની આ પદ્ધતિમો ખરીદવા ઈચ્છનાર ટેન્ડરો મંગાવે છે. આની પાછળ એ આશય હોય છે કે જે માલ પૂરો પાડનાર વ્યક્તિની શરતો સૌથી વધુ સ્પર્ધાત્મક (વાજબી) અને સાનુક્ષુણ હોય તેની પસંદગી કરી શકાય. ટેન્ડરો મંગાવવા મોટેભાગે એક કે વધુ વર્તમાન પત્રોમાં જાહેરાત અથવા સૂચના પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં માલની જરૂરી વિગતો સામેલ હોય છે. ઘણી વખત જાહેરાતના અનુસંધાને અરજી કરનારને ટેન્ડર મોકલવામાં આવે છે. સામાન્ય રીતે ટેન્ડર ભરનારે ટેન્ડર સાથે બાનાની રકમ ડોપોડીટ તરીકે મોકલવાની હોય છે. આનાથી રસ ધરાવનાર પાર્ટીની ગંભીરતાની ખાતરી થાય છે. એક સામાન્ય પ્રચલિત રીતે મુજબ ટેન્ડરો સીલબંધ કવરમાં માંગવામાં આવે છે. જેથી જે તે પણ મૂકેલી શરતો ખાનગી રહે અને તેની સાથે કોઈ પ્રકારના ચેડા ન થાય. સીલબંધ કવરો યોગ્ય સક્ષમ અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવે છે. અને સૌથી વધુ અનુકૂણ ટેન્ડર સ્વીકારવામાં આવે છે. ત્યાર પછી ટેન્ડરમાં જણાવેલી શરતોના આધારે તે ટેન્ડર મોકલનાર સાથે વિધિવત કરાર કરવામાં આવે છે.

૫. લિલામ (હરાજી) દ્વારા વેચાણ:-

વાણિજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ





હરાજીથી વેચાણ એવું હોય છે કે અમૃક વસ્તુઓ નિશ્ચિત તારીખે અને સમયે જાહેર સ્થળે વેચાણ માટે રજૂ કરવામાં આવે છે. જેથી લોકો તે વસ્તુ માટે બોલી લગાવી શકે. સૌથી ઉચી બોલી લગાવનારને વસ્તુ વેચવામાં આવે છે. હરાજી દ્વારા થતા વેચાણમાં વસ્તુ પ્રદર્શિત કરવામાં આવે છે અને એક આરક્ષિત (અનામત) કિંમત વેચનાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

આ કિંમત લોકોને જણાવવામાં પણ આવે છે. અથવા ખાનગી પણ રાખી શકાય છે. કયારેક અમૃક ઉલડ કિંમત પણ રાખવામાં આવે છે. તેનાથી બોલી શરૂ થાય છે. આને લઘુતમ કિંમત પણ ગણી શકાય જેનાથી નીચે વસ્તુ વેચવાની હોતી નથી. ખરીદવા ઈચ્છુક વ્યક્તિ દ્વારા જે બોલી રજૂ થાય તેને તેની માગણી ગણી લેવામાં આવે છે. અને જો તેની બોલી સૌથી ઉચી હોય તો વસ્તુ તેને વેચવામાં આવે છે અને તેની બોલી સ્વીકારવામાં આવે છે. એકવાર સ્વીકાર્ય પછી બોલી બોલનાર ફરી જઈ શકતો (પીછેછા કરી શકતો) નથી. તેણે કિંમત ચુકવીને વસ્તુ ન વેચવાનો અભાવિત અધિકાર હોય છે. હાલમાં તે હરાજીથી વેચાણ ઈન્ટરનેટ ઉપરથી કરવાનું પ્રયત્નિત બનતું જાય છે.

૬. નિકાલ (ધોવાણ) વેચાણ:-

તમે આવી જાહેરાતો વાંચી હશે. "ભવ્ય કિલરયરન્સ સેલ, ૭૦ ટકા સુધી છુટ", "ઉનાળુ સેલ" અથવા "વાર્ષિક સેલ" વગેરે. આ વેચાણ મોટેભાગે વધારાના કે બિનજરૂરી સ્ટોકના નિકાલ માટે કરવામાં આવે છે. અને આને "નિકાલ વેચાણ" કહેવામાં આવે છે. કેટલાક વેપારીઓ સમયે સમયે આવા વેચાણ યોજતા હોય છે. સ્ટોક ખાલી કરવા માટે ભારે વળતર જાહેર કરતા હોય છે.

ભાડા ખરીદ પદ્ધતિ અને વિલંબિત હપ્તા પદ્ધતિમાં આ પ્રમાણે તફાવત છે.

વિલંબિત હપ્તા પદ્ધતિ

૧. તે ખરી રીતે એક વેચાણકાર છે.
૨. પ્રારંભિક રકમ ચુકવતાંની સાથે જ વસ્તુની માલિકીનો હક ગ્રાહકને મળી જાય છે.
૩. ચુકવણામાં ખામી આવે તો વેપારી ખરીદનાર ઉપર બાકીની રકમ માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે. પણ વસ્તુનો કણ્ણો
- ભાડા ખરીદ પદ્ધતિ
૧. તે મુખ્યત્વે વસ્તુઓને ભાડાથી લેવાનો કરાર છે.
૨. માલિકીના હકો વેપારી પાસે રહે છે. અને ગ્રાહક વસ્તુ (પૂરા પૈસા ભરીને) ખરીદી લેવાનો વિકલ્પ અખત્યાર કરી શકે છે.
૩. ગ્રાહક ગમે તે તબક્કે વસ્તુ પાછી કરી શકે છે અને પૈસા ન ભરાય તો વેપારી પણ વસ્તુ પાછી લઈ શકે છે.

ખરીદ અને વેચાણ

પાછો મેળવી શકતો નથી. એ જ રીતે ગ્રાહક
પણ વસ્તુ પાછી આપીને ચૂકવણાની રકમ
સરભર કરી શકતો નથી.



૧૨.૨ પાઠગત પ્રશ્નો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટા તે દર્શાવો.

- હરાજી દ્વારા વેચાણમાં આરક્ષિત કિંમત હોવા છતાં વસ્તુઓ સૌથી ઉચ્ચી બોલી લગાવનારને વેચવામાં આવે છે.
- ભાડા ખરીદની વેચાણ પદ્ધતિમાં ગ્રાહક ગમે ત્યારે માલ પરત કરી શકે છે.
- સંમતિથી વેચાણ પદ્ધતિમાં ખરીદનારને આપેલ માલની કિંમત હંમેશા અગાઉથી ચૂકવવામાં આવે છે.
- બાનાની રકમ ટેન્ડર ભરનારાઓને ચૂકવવાની હોય છે. તે તેમની ટેન્ડર બાબતમાં ગંભીરતા દર્શાવે છે.
- નિકાલ વેચાણ વર્ષાંગતની સમાપ્તિ પછી તુરત વસ્તુઓના વેચાણને કહે છે.

૧૨.૫ ચૂકવણીની પદ્ધતિઓ

વેચાણમાં ગ્રાહક કિંમતને બદલે માલ ખરીદવાનો પ્રસ્તાવ મુકે છે અને વેપારી તે સ્વીકારે છે. અથવા વેપારી અમુક કિંમતે માલ વેચાવાનો પ્રસ્તાવ મૂકે છે અને ખરીદનાર તે સ્વીકારે છે. હવે માલની કિંમત તાત્કાલિક પણ ચૂકવવામાં આવે છે અને પાછળથી પણ ચૂકવી શકાય છે. આ રીતે સ્થાનિત ચૂકવણી હપ્તાઓમાં પણ કરી શકાય છે. અથવા તો ઉધાર માટે નક્કી કરેલી અવધિના અંતે એક સાથે પણ કરી શકાય છે.

૧. તાત્કાલિક ચૂકવણી:-

તાત્કાલિક ચૂકવણીમાં ખરીદનાર વેપારીને સંપૂર્ણ રકમ રોકડી ભરી આપે છે. અલબત્ત જો વેપારી માન્ય રાખે તો ગ્રાહક ચેક, ડ્રાઇન, કેરીટકાર્ડ કે ડેનિટકાર્ડ દ્વારા પણ ચૂકવણી કરી શકે છે. ખરેખર જો વેપારસ અને ગ્રાહક વચ્ચે કોઈ પ્રગટ (સ્પષ્ટ) કે અંતનિહિત (સુચિત) સમજણ થઈ ન હોય તો વેપારી ચેક દ્વારા કિંમત સ્વીકારવા બંધાયેલો નથી. છૂટક ખરીદ વેચાણ કે જેમાં નાની રકમ ચૂકવવાની હોય છે. તેમાં આનું પ્રચલન સામાન્ય રીતે હોય છે. દા.ત. કરિયાણું, શાકભાજી, તૈયાર કપડા વગેરે જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓના વેચાણમાં તુરત રોકડા પૈસા આપવામાં આવે છે.

૨. સ્થાનિત હપ્તા યોજના:-

આખે "ખરીદો આજે અને પૈસા ચૂકવો પાછળથી" યોજના કહે છે. આ પદ્ધતિમાં ગ્રાહક વેપારીને એક નાની રકમ ચૂકવીને વસ્તુનો કબજો મેળવે છે. જ્યારે બાકીની રકમ તે નિશ્ચિત સમયગાળામાં હપ્તાઓમાં ચૂકવે છે. આ હપ્તા એક નિશ્ચિત રકમના હોય છે જે

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



દરમાસે અથવા દર ત્રણ માસે નિયમિત રીતે ચૂકવવા પડે છે. આ ચૂકવણીમાં કુલ બાકી રકમ અને તેના ઉપરનું વાજ સમાવિષ્ટ હોય છે. સામાન્ય રીતે જેમ જેમ હપ્તા ભરાતા જાય તેમ રકમ ઉપરનું વાજ ઘટતું જાય છે. કયારે વેપારી વાજ મુક્ત હપ્તા પણ સ્વીકારવા સહમત થાય છે. જો ખરીદનાર કોઈ હપ્તો ન ચૂકવી શકે તે વેપારી બાકી રકમ માટે દાવો માંડી શકે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. વિનોંદ એક સ્થાનિક દુકાને રંગીન ટી.વી. ખરીદવા ગયો. ટી.વી.ની કિમત રૂ.૨૦૦૦૦/- હતી. સ્થળિત હપ્તા યોજના અન્વયે તેણે ૧૦ ટકા રકમ રોકડી તથા બાકીની રકમ ૧૦ વાજ મુક્ત માસિક હપ્તામાં ચૂકવવાની હતી. આમ તેણે શરૂઆતમાં રૂ.૨૦૦૦/- રોકડા આપવા પડ્યા અને બાકીની રકમ માસિક રૂ.૧૮૦૦/-ના ૧૦ હપ્તે ચૂકવવાની હતી. હવે જો વિનોંદ નિયમિત હપ્તા ન ચૂકવે તો વેપારી બાકીની રકમ માટે તેના ઉપર કોર્ટમાં દાવો દાખલ કરી શકે. આ પ્રકારની વેચાણ પદ્ધતિ મુખ્યત્વે ઓછી ટકાઉ અને ખરાનીત વાગતી વસ્તુઓના વેચાણમાં વધારે ઉપયુક્ત હોય છે.

૩. શાખની સમયાવહિના અંતે સ્થળિત ચૂકવણી:-

જ્યારે શાખ ઉપર વસ્તુ ઉધાર વેચવામાં આવે ત્યારે ગ્રાહકે વસ્તુની કિમત નક્કી થયેલી સમયાવહિને અંતે ચૂકવવાની હોય છે. દા.ત. ત્રણ મહિના જો ખરીદનાર વહેલા પૈસા ભરી દે તો વેપારી તેને વિશેષ છૂટ (વળતર) આપી શકે છે. જે તે ભરતિયામાં નિર્ધારિત તારીખથી અગાઉ ચૂકવણી માટેની ચોખ્યી રકમ તરીકે દર્શાવે છે.

૧૨.૬ વેચાણ પ્રક્રિયા

સામાન્ય રીતે આપણે બજારમાં જઈએ ત્યારે આપણે દુકાને ફરીને વસ્તુની કિમતની તપાસ કરીએ છીએ અને તેની ગુણવત્તાની તપાસ કરીને છેવટે આપણે આપણી પસંદગીની વસ્તુની ખરીદી કરવા નિર્ણય કરીએ છીએ. પણ જે ઉત્પાદકો કે વેપારીઓના ઉત્પાદન કેન્દ્રો કે વ્યાપાર કેન્દ્રો ખૂબ દુરના સ્થળોએ આવેલા હોય તેમની પાસેથી ખરીદી કરવાનું એટલું સરળ નથી હોતું. આ માટે ગ્રાહક (ખરીદનાર) તેમજ વેપારી (વેચનાર) એ અમુક પ્રક્રિયા અપનાવવી પડે છે. અને વ્યાપારી પ્રક્રિયા સમાપ્ત થાય તે પહેલાં તેને વિવિધ તબક્કાઓમાંથી પસાર થતું પડે છે. આ વિભાગમાં આપણે ટેશની ભૌગોલિક સીમાની અંદર વસ્તુઓના ખરીદ-વેચાણ સાથે સંલગ્ન વિવિધ તબક્કાઓ વિષે અત્યાસ કરીશું. આ પ્રક્રિયાનું શાન તમને ગ્રાહક તરીકે કે વેપારી તરીકે પણ ઉપયોગી થશે.

વસ્તુઓના વેચાણની સામાન્ય પ્રક્રિયા જેને વેચાણનું રૂટિન (નિત્યક્રમ) કહે છે તેમાં નીચેના સોપાન સામેલ છે.

૧. સંભવિત ખરીદનારની પુછપરછા:-

વેચાણ પ્રક્રિયાની શરૂઆત વસ્તુ ખરીદનાર દ્વારા સૌથી વધુ ઉપયોગી પ્રાપ્ત વેચાણકારથી થાય છે. તેમાં માલ પૂરો પાડવો, કિમત અને માલની ગુણવત્તા વગેરે બાબતમાં પુછ-પરછ થાય છે. આ તપાસ છાપામાં જાહેરાત, બજારના અહેવાલ, ભાવપત્રક સુચિ વગેરે જેવા ગૌણ માહિતી સ્ત્રોતો દ્વારા થઈ શકે છે. જો કે છતાં સંપ્રાપ્તિનો ઉત્તમ

ખરીદ અને વેચાણ

સ્રોત નક્કી કરવા સામાન્ય રીતે પુછ-પરછ વેપારી કે ઉત્પાદક પાસેથી સીધે સીધી માહિતી મેળવવા માટે કરાતી હોય છે. મોટા મોટા વ્યાપારી ગૃહોમાં જ્યાં દરરોજ નિયમિત ખરીદી થતી હોય છે તે આ તો છાપેલા પુછ-પરછનાં ફોર્મ તૈયાર રાખે છે.

૨. સંભવિત ખરીદનારનો ભાવપત્રક આપવું:-

સંભવિત ખરીદનાર તરફથી પુછ-પરછનું ફોર્મ મેળવ્યા પછી વેપારી તેને જરૂરી માહિતી આપે છે. તેને ભાવપત્રક કહે છે. વેચાણ સંબંધી સૂચનાઓ તથા શરતો તેમજ કિંમત જે વેપારી ભાવપત્રકમાં દર્શાવે છે. તેમાં આગળ ભાવતાલ (ચર્ચા વિચારણા બોધ છોડ) ને અવકાશ હોય છે. વેપારીઓ પણ છાપેલા ભાવપત્રક વાપરે છે.

૩. ખરીદનાર પાસેથી ઓર્ડર મેળવવો:-

ઈચ્છુક ગ્રાહક ભાવપત્રકમાં દર્શાવેલ વેચાણની શરતો અને સૂચનાઓથી સંતુષ્ટ થાય તો તે વેપારીને વસ્તુ મોકલવા માટે ઔપચારિક ઓર્ડર મોકલે છે. ઘણીવાર ખરીદનાર ઓર્ડર માટેના તૈયાર છાપેલા ફોર્મ પણ રાખતા હોય છે.

૪. ઓર્ડરનો અમલઃ-

ઓર્ડર મળ્યા પછી સામાન્ય રીતે વેચાણકાર તેની પહોંચ (મળ્યાની ખબર) મોકલે છે અને ઓર્ડરની સ્વીકૃતિ મોકલી આપે છે. જો ઓર્ડરનો અમલ તાત્કાલિક કરવાનો હોય તો સ્વીકૃતિ મોકલવી જરૂરી નથી. ઓર્ડર ઉપર મળ્યા તારીખ સહિત સિક્કો મારવામાં આવે છે. જો ખરીદનાર નવો હોય તો વિકેતા તેની શાખ (ઉધાર, આબરુ)-ની લાયકાત તેમજ આર્થિક સધ્યરતાની તપાસ કરે છે. જો વેપારી તે તેની શાખ યોગ્યતાની બાબતમાં સંતોષ થાય તો તે તેને માલ વેચવાનું નક્કી કરે છે. નહીંતર વેચાણકાર પોતે ઓર્ડર સ્વીકારી શકે તેમ નથી તેવું જણાવતો ક્ષમાપના (દિલગીરી) દર્શાવતો પત્ર લખે છે. જો ઓર્ડર અપાયેલી વસ્તુ હાજર સ્ટોકમાં ન હોય તો ઉત્પાદનના સમયને લક્ષમાં રાખીને વિતરણની ચારીખ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી ઓર્ડરની એક નકલ ઉપર વિતરણની તારીખ નાખી ઉત્પાદન વિભાગમાં મોકલી આપવામાં આવે છે.

૫. ભરતિયું બનાવવું:-

ભરતિયામાં લેવડ-દેવડ, ખરીદ-વેચાણ વગેરેની તમામ વિગતો તેમજ ખરીદનાર પાસેથી વેપારીએ મેળવવાની રકમ સમાવિષ્ટ હોય છે. વિકેતા માલસામાનની સાથે જ આ ભરતિયું ખરીદનારને મોકલી આપે છે. તેની એક નકલ વેચાણકાર પોતે રાખે છે. તથા ઉત્પાદન વિભાગ અથવા ગોડાઉન (વખાર) અને હિસાબ ખાતાને પણ એક એક નકલ મોકલવામાં આવે છે.

૬. ગ્રાહકનું ખાતું ખોલવું:-

જ્યારે ભરતિયાની નકલ હિસાબ ખાતાને મળે ત્યારે ખાતાવહીમાં ગ્રાહકના નામનું ખાતું ખોલવામાં આવે છે. આ ખાતામાં વેચેલા માલની ભરતિયામાં દર્શાવેલી કિંમત શાખ (ઉધાર) અવધિની છૂટ અને ગ્રાહકે ભરપાઈ કરેલી રકમ નોંધવામાં આવે

વાણીજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



છે. જો ગ્રાહકનું ખાતુ અગાઉ ખોલાઈ ચુક્યું હોય તો તેમાં જ જરૂરી વિગતો ભરવામાં આવે છે.

૭. રવાનગી અને વિતરણ:-

માલ સામાન છૂટો કરવા માટે ગોદામ કે ઉત્પાદન વિભાગને હિસાબીખાતા તરફથી ભરતિયાની નકલ કે વિતરણની નોંધની નકલ કે બંનેની જરૂર રહે છે. આ રીતે છૂટો થયેલો માલ પછી પેકીંગ વિભાગમાં જાય છે. જ્યાં ઓર્ડર પ્રમાણે જ બધો માલ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરાય છે. ત્યારપછી પેક થયેલા માલ ઉપર લેબલ લગાડીને તેને રવાનગી નોંધની એક નકલ ખરીદનારને મોકલવામાં આવે છે. આ નોંધના સૂચના નોંધ અથવા સૂચના પત્ર પણ કહે છે. તેમાં રવાના કરેલ માલનું સંપૂર્ણ વિવરણ હોય છે. વળી ગ્રાહકને પણે તે માલની ડિલીવરી કેવી રીતે મેળવી શકે તે વિષે પણ સૂચન હોય છે. જો માલ રેલ્વે અથવા માર્ગવાહન વ્યવહાર (ટ્રૂક) દ્વારા મોકલવામાં આવ્યો હોય તો પરિવહના અધિકારીએ આપેલી પહોંચની પણ એક નકલ રવાનગી નોંધ સાતે જોડવામાં આવે છે.

૮. માલની ડિલીવરી લેવી:-

વેપારી પાસેથી રેલ્વે કે ટ્રૂકની રસીદ મેળવ્યા બાદ ગ્રાહક રેલ્વે કે માર્ગવાહન વ્યવહાર અધિકારી પાસેથી માલની ડિલીવરી મેળવે છે. ડિલીવરી લેતી વખતે ગ્રાહક કે તેના એજન્ટે માલની સંપૂર્ણ ચકાસણી કરી લેવી જોઈએ. જો માલને કોઈ (ક્ષતિ) નુકસાન પહોંચ્યું હોય તો તુરંત વાહન વ્યવહાર અધિકારીને જાણ કરીને તુરંત જ નુકસાની નો દાવો રજૂ કરી દેવો જોઈએ.

૯. હિસાબની પતાવટ:-

આ પ્રક્રિયાનું અંતિમ ચરણ છે. માલનું ચુકવણું કરવું. પૈસાનું ચુકવણું અગાઉ નક્કી કરેલી શરત મુજબ કરવાનું હોય છે. દેશના આંતરિક વ્યાપારમાં ભોટેભાગે ચુકવણું મનીઓર્ડર, ચેક, બેંક, ટ્રાફિટ, વિનિમયપત્ર, પ્રતિશાપત્ર વગેરે દ્વારા થાય છે. ગ્રાહક નિયમિત હોય તો તેની સમગ્ર લેણી રકમ નિર્ધારિત કરવામાં આવે છે અને ગ્રાહકે લેવડ-દેવડને બદલે નિયમિત સમયાંતરે પૈસા ચુકવવાના હોય છે. જો પૂરેપૂરી રકમ ચુકવાઈ જાય તો હિસાબ પતી ગયેલો માનવામાં આવે છે. સમય સમય પર જે પૈસા મળે તેન રસીદ મોકલવામાં આવે છે. ઘણીવાર વેપારી હિસાબનું સામાયિક સ્ટેટમેન્ટ (પત્રક) મોકલે છે. તેમાં નીચેની વિગતો હોય છે.

- ક. વેચાણની તારીખ
- ખ. વેચેલમ માલની રકમ
- ગ. ગ્રાહક પાસેથી મળેલી કિંમત
- ઘ. ગ્રાહક પાસે બાકી નીકળતી રકમ

હવે તમે બરાબર સમજી ગયા હશો કે વસ્તુના વેચાણની પ્રક્રિયામાં વિવિધ સોપાનો સામેલ હોય છે.

૧૦. ભૂલોની સુધારણા:-

અત્યાર સુધી તમે શીખ્યા કે વ્યાપારી લેવડ-ટેવડ ગ્રાહકની પુછ-પરછથી શરૂ થાય છે અને ખરીદેલ માલનો હિસાબ વેપારી સાથે તદ્દન પ્રશ્નો પતી જાય ત્યારે સમાપ્ત થાય છે. જો કે વેચનાર માલ મોકલતી વખતે અને ભરતિયું બનાવતી વખતે ખૂબ જ તકેદારી રાખે છે. છતાં પણ ક્ષતિ રહી જવાની સંભાવના હોય છે. આ ભૂલો "ઉધારપત્ર" (ડેબિટનોંઘ) કે "જમાપત્ર" (ક્રેડિટનોંઘ) દ્વારા સુધારી શકાય છે. ચાલો આપણે આ બંને નોટ (પત્ર) વિષે વિગતવાર સમજીએ.

જમાપત્ર:— એક દસ્તાવેજ કે ખરીદનારને જણાવે કે અમુક રકમ તેના ખાતામાં જમા લેવામાં આવી છે.

ઉધારપત્ર:— એક દસ્તાવેજ કે જે ગ્રાહકને જણાવે કે અમુક રકમ તેના ખાતે ઉધારવામાં આવી છે.



૧૨.૩ પાઠગત પ્રશ્નો

૧. નીચેની કોલમ 'અ' અને 'બ' ને યોગ્ય રીતે જોડો.

કોલમ 'અ'

કોલમ 'બ'

- | | |
|-----------------------|--|
| ૧. ભાવપત્રક | (ક) અત્યારે ખરીદો પૈસા બાદમાં ચૂકવો |
| ૨. ભરતિયું | (ખ) વેચાણની સંતોષકારક શરતો |
| ૩. સ્થળિત હપ્તા યોજના | (ગ) ગ્રાહક સાથે વિસ્તૃત લેતી દેતીનું વર્ણન |
| ૪. વિલંબિત ચૂકવણું | (ઘ) ઓર્ડરનું પાલન કરવું |
| ૫. ક્ષમાપત્ર | (ય) વેચાણકારે મેળવવાની રકમ |

૨. નીચેના પૈકી કયા વિધાનો ખરો છે અને કયા ખોટા છે ?

૧. ગ્રાહકનું ખાતું મુખ્યત્વે ગ્રાહકે ચૂકવેલા પૈસાનો હિસાબ રાખે છે.

૨. રવાનગી નોંધને સૂચનાપત્ર પણ કહે છે.

૩. જો હેરફેર દરમિયાન વસ્તુને નુકસાન થયું હોય તો ખરીદનાર તુરત જ ટ્રાન્સપોર્ટ અવિકારી સમક્ષ નુકશાનીનો દાવો રજૂ કરી દવો જોઈએ.

૪. વિકેતા જમાપત્ર દ્વારા ખરીદનારના ખાતામાં લખાયેલી વધારાની રકમની ભૂલ સુધારી લે છે.

૫. વેપારીએ મોકલેલ ઉધારપત્ર ગ્રાહકને જણાવે છે કે તેના ખાતામાં અમુક રકમ ઉધારવામાં આવે છે.

૩. વૈકલ્પિક પ્રશ્નો :

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



તમે શું શીખ્યા?

ખરીદી એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક વ્યક્તિ પૈસા ચૂકવીને અમુક વસ્તુઓ કે મિલકતો વેચાણકાર પાસેથી પોતાનાનામે તબદીલ કરાવી શકે છે. વેચાણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા અમુક વસ્તુ કે મિલકત એક વ્યક્તિ રોકડ કે શાખના બદલામાં અન્ય વ્યક્તિને હસ્તાંતરિત કરે છે. વેચાણ અને ખરીદી હંમેશા એક સાથે થાય છે.

એક વ્યાપારી પ્રક્રિયા તરીકે વેચાણમાં એવી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે કે જે ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ માલ સામાન અને સેવાઓનો પ્રવાહ ચાલુ રાને.

માલસામાન જાતે તપાસીને અથવા નમુનાના આધારે તેની પેટર્નની ચકાસણી કરીને અથવા તો ભ્રાન્ડના માર્ક કે વર્ષનના આધારે ખરીદી શકાય છે. વેચાણની પદ્ધતિઓ છે : ભાડા ખરીદ પદ્ધતિ, વેચાણની વિલંબિત યોજના, સંમતિથી વેચાણ, ટેન્ડર દ્વારા વેચાણ, હરાજીથી વેચાણ અને નિકાલવેચાણ. ખરીદીનું ચુકવણું આટલી રીતે થાય – તાત્કાલિક ચુકવણી સ્થગિત હપ્તા યોજના, શાખ સમયના અંતે સ્થગિત ચુકવણી.

વેચાણની પ્રક્રિયાનાં સોપાન – પુછ-પરછ, ભાવપત્રક ઓર્ડર, ઓર્ડરનો અમલ, ભરતિયું બનાવવું, ગ્રાહકનું ખાતું ખોલવું, માલની રવાનગી અને વિતરણ, માલની ડીલીવરી લેવી (માલ મેળવી લેવો) અને છેવટે હિસાબની પતાવટ માલ મોકલવામાં કે ભરતિયું બનાવવામાં થયેલી ભૂલ જમાપત્ર અને ઉધારપત્ર દ્વારા સુધારી શકાય છે.



પાઠાંત પ્રશ્નો

1. 'ખરીદ' એટલે શું ?
2. ઉત્પાદનના વેચાણમાં સંકળાયેલી પ્રવૃત્તિઓ જણાવો.
3. 'હરાજી દ્વારા વેચાણ' નો અર્થ શો ?
4. 'વિલંબિત હપ્તા યોજના' ને ચુકવણાના પ્રકાર તરીકે સમજાવો.
5. માલ મોકલવામાં કે ભરતિયું બનાવવામાં થયેલી ભૂલો કેવી રીતે સુધારી શકાય તે વર્ણવો.
6. વેચાણની વિલંબિત હપ્તા અને ભાડા ખરીદ પદ્ધતિની રીતો વર્ણેનો તફાવત સ્પષ્ટ કરો.
7. ઉત્પાદનની ખરીદીના પૈસા ચૂકવવા માટે કઈ વિવિધ પદ્ધતિઓ.
8. ટેન્ડર દ્વારા વેચાણની પ્રક્રિયા સમજાવો.
9. કોઈ ઉત્પાદન ખરીદવા માટેની વિવિધ પદ્ધતિઓ વર્ણવો.
10. ઉત્પાદનના વેચાણ માટે અપનાવાતી વિવિધ પદ્ધતિ સમજાવો.
11. ઉત્પાદનના વેચાણ માટેની પ્રક્રિયા જણાવો.

ખરીદ અને વેચાણ

૧૨. વક્યની સામાન્ય પ્રક્રિયાના ભાગ તરીકે ઓર્ડરનો અમલ થઈ ગયા બાદ કયાં પગલાં જરૂરી છે?



પા�ગત પ્રશ્નોના જવાબ

૧૨.૧

- (૧) ખરીદી (૨) ખરીદનાર (૩) નફો (૪) બજાર
 (૫) વેચાણ

૧૨.૨

- (૧) ખોટું (૨) ખરું (૩) ઘોટું (૪) ખરું (૫) ખોટું

૧૨.૩

૧.

૧-(ખ), ૨-(ગ), ૩-(ક), ૪-(ચ), ૫-(ઘ)

૨.

૧. ખોટું ૨. સાચું ૩. સાચું ૪. ખોટું ૫. સાચું

૩.

૧-ખ, ૨-ક, ૩-ઘ, ૪-ખ, ૫-ઘ



જાતે કરો

જાતે કરો:-

- સમાચાર પત્રોમાં આવતી ટેન્ડરો મંગાવથી જાહેરાતો કાપીને સંગ્રહ કરો અને તેમાં રહેલી માહિતી વાંચો.
- જો તમારો કોઈ મિત્ર કે પણ્ણિવાર સભ્ય કોઈ ઓફિસમાં કામ કરતો હોય તો અને ઓફિસ માટે ફર્નિચર, લેખન સામગ્રી, કોમ્પ્યુટર વગેરે ખરીદવા કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તે તેની પાસેથી જાણો.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



વિતરણના માધ્યમો

શું તમે જાણો છો કે વ્યવસાય અધ્યયનની જે અભ્યાસ સામગ્રી અત્યારે તમારા હાથમાં છે તે દિલ્હી સ્થિત "નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલીંગ" (NIOS) (રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન) ની મુખ્ય કચેરી ખાતે તૈયાર કરવામાં આવી છે ? આ સામગ્રી તમારી પાસે કેવી રીતે આવી ? તે તમારા અભ્યાસ કેન્દ્ર પાસેથી મળી ? તે તમે તે બજારમાંથી ખરીદી ? જો તમેને તે તમારા અભ્યાસ કેન્દ્રોમાંથી મળી હોય તો જરા વિચાર કરો કે તે ત્યાં કેવી રીતે પહોંચી ? હીકીકતમાં અભ્યાસ સામગ્રી છપાવ્યા બાદ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાને (રામીવિરિપ્સ) તે તમારા અભ્યાસ કેન્દ્ર ઉપર મોકલી આપી. અને પછી તમે તે ત્યાંથી મેળવી એ જ રીતે જ અભ્યાસ સામગ્રી બજારમાં ઉપલબ્ધ છે તે વેપારીઓએ સીધી NIOS પાસેથી ખરીદેલી હોય છે અને પછી પુસ્તક વિકેતાઓ તે તમને વેચે છે. આમ NIOS દ્વારા પ્રકાશિત અધ્યયન સામગ્રી યાતો અધ્યયન કેન્દ્ર દ્વારા અથવા પુસ્તક વિકેતાઓ દ્વારા તમારી પાસે પહોંચી. એ જ રીતે આપણે દૈનિક જીવનમાં જે ચીજવસ્તુઓ કે સેવાઓનો ઉપલોગ કરીએ છીએ તે ઉત્પાદકો અથવા વિનિર્માતાઓ પાસેથી આવે છે અને કેટલાક લોકો દ્વારા આપણા સુધી પહોંચે છે. આ પાઠમાં આપણને જરૂરી એવી ચીજવસ્તુઓ અને સેવાઓ આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે શીખીશું.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- વિતરણના માધ્યમોનો અર્થ સમજાવી શકશો.
- વિતરણના વિવિધ માધ્યમો ઓળખી શકશો.
- જથ્થાબંધ વેપારી તથા છૂટક વેપારોઓનાં કાર્યો વર્ણવી શકશો.
- જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી વચ્ચેનો તફાવત સમજી શકશો.


૧૩.૧ વિતરણ માધ્યમોનો અર્થ

તમે જાણો છો કે વેપારનો મુખ્ય ઉદ્દેશ દુર રહેલા ઉપભોક્તાઓને માલ પહોંચાડવાનો છે. જ્યારે વસ્તુઓ કે સેવાઓ ઉત્પાદક પાસેથી ઉપભોક્તા પાસે પહોંચે ત્યારે તેમણે વિવિધ લોકોના હાથમાંથી પસાર થવું પડે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. શ્રીનગરના એક ખેડૂતને સફરજનની વાડી છે. એક વખત બધા સફરજન પાકી ગયા પછી તે દિલ્હીના એક

વિતરણના માધ્યમો

એજન્ટને તે તમામ સફરજન વેચી દે છે. એજન્ટ શ્રીનગરમાંથી સફરજન મેળવી લે છે પેક કરે છે અને નવી દિલ્હીની સબજીમંડી (શાકમાર્ક૆ટ)ના એક જથ્થાના બંધ વેપારીને વેચી દે છે. પછી તે જથ્થાબંધ વેપારી સમગ્ર દિલ્હીમાં થોડા થોડા જથ્થામાં વહેંચીને છૂટક ફળ વેપારીઓને વેચી દે છે. અને છેવટે આપણે તે ફળ વેચનારાઓ પાસેથી જરૂરિયાત પ્રમાણે ખરીદીએ છીએ. આમ આપણે જોયું કે શ્રીનગરના ઉત્પાદક પાસેથી ઉત્પાદન ઉપભોક્તા પાસે પહોંચતા પહેલા એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી જેવા કેટલાક હાથોમાંથી પસાર થાય છે. આ બધાને મધ્યસ્થી કહેવાય છે. આ મધ્યસ્થીઓ એક બાજુ ઉત્પાદકો અને બીજી બાજુ ઉપભોક્તાઓ વચ્ચે બંનેને સાંકળણી કરી છે. તેઓ ખરીદવું, વેચવું, સંઘરવું, વગેરે કેટલીક ડિયાઓ કરે છે. આ મધ્યસ્થીઓ જ વિતરણ માધ્યમ બને છે. આમ વિતરણ માધ્યમો એવો માર્ગ છે જેના દ્વારા ચીજ વસ્તુઓ ઉત્પાદકોથી અંતિમ ઉપભોક્તાઓ સુધી પહોંચે છે.

જે માર્ગ માલ ઉત્પાદકો થી ઉપભોક્તાઓ સુધી પહોંચે છે. તેને વિતરણ માધ્યમ કહેવાય છે.



૧૩.૨ માધ્યમોના પ્રકાર

સામાન્ય રીતે માલસામાન અને સેવાઓ ઉપભોક્તા સુધી પહોંચતા પહેલાં કેટલાક હાથોમાંથી પસાર થાય છે. પણ કેટલીક વાર ઉત્પાદકો કોઈ મધ્યસ્થીને સામેલ કર્યા વગર સીધે સીધા ઉપભોક્તાઓને જ તેમનો માલ અથવા સેવાઓ વેચે છે. તેને પ્રત્યક્ષ માધ્યમ કહે છે. માધ્યમો બે પ્રકારના હોય છે, પ્રથમ પ્રત્યક્ષ માધ્યમ અને બીજું પરોક્ષ માધ્યમ.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



પ્રત્યક્ષ માધ્યમ માત્ર એક જ છે. ઉત્પાદકથી ઉપભોક્તા જ્યારે પરોક્ષ માધ્યમો ઘણા છે જેમ કે,

1. ઉત્પાદક → એજન્ટ → જથ્થાબંધ વેપારી → છૂટક વેપારી → ઉપભોક્તા
2. ઉત્પાદક → જથ્થાબંધ વેપારી → છૂટક વેપારી → ઉપભોક્તા
3. ઉત્પાદક → એજન્ટ → ઉપભોક્તા
4. ઉત્પાદક → જથ્થાબંધ વેપારી → ઉપભોક્તા
5. ઉત્પાદક → છૂટક વેપારી → ઉપભોક્તા

વહેચણીના સામાન્ય માધ્યમ

૧. પ્રત્યક્ષ માધ્યમ:-

આ માધ્યમમાં ઉત્પાદક પોતાનું ઉત્પાદન અને સેવાઓ સીધા ગ્રાહકને જ વેચે છે. ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચે કોઈ મધ્યસ્થ માણસ હોતા નથી. ઉત્પાદક ઉપભોક્તાઓને પોતાના સેલ્સમેન દ્વારા ધેર ધેર માલ પહોંચાડી શકે અથવા તો પોતાના જ છૂટક સ્ટોર ઉપરથી માલ વેચી શકે. દા.ત. બાટા ઈન્ડિયા લિ., એચીપીસીએલ, લિબર્ટી શૂઝ લિ. વગેરેને પોતાનું ઉત્પાદન ગ્રાહકોને વેચવા માટે તેમની પોતાની રિટેઇલ શોપા (છૂટક વેચણની દૂકાન) છે. એવાં કેટલાંક સેવા સંગઠનો પણ છે જે ઉપભોક્તાઓન. સીધેસીધી પોતાની સેવાઓ પૂરી પાડે છે. બેંક, સલાહ કંપનીઓ, ટેલીફોન કંપનીઓ, યાત્રી-માલ-પરિવહન સેવાઓ વગેરે સેવા વિતરણના પ્રત્યક્ષ માધ્યમના ઉદાહરણો છે.

ઉત્પાદક → ઉપભોક્તા

૨. પરોક્ષ માધ્યમ:-

જો ઉત્પાદક વિશળ પાયા ઉપર ઉત્પાદન કરતો હોય તો તે પોતાનો માલ સીધો ઉપભોક્તાને વેચી શકે એવું ન બને આશી તે પોતાનો માલ મધ્યસ્થી દ્વારા વેચે છે. આ મધ્યસ્થી જથ્થાબંધ કે છૂટક વેપારી પણ હોઈ શકે. જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી બહુમોટા પાયે માલ ખરીદે છે. જ્યારે છૂટક વેપારી ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને અંતિમ ઉપભોક્તાને તેની જરૂરિયાત પ્રમાણે માલ વેચે છે. વિતરણ પ્રક્રિયામાં જ્યારે મધ્યસ્થીઓ સામેલ હોય ત્યારે તેને વિતરણનું પરોક્ષ માધ્યમ કહે છે.

ઉત્પાદક → છૂટક વેપારી → ઉપભોક્તા

સામાન્ય રીતે આખરી ઉપભોક્તાને માલ વેચવાનું આ સર્વસામાન્ય માધ્યમ છે. જથ્થાબંધ વેપારી દ્વારા માલ વેચવાનું ખાદ્યાન, મસાલા વાસણ અને ખાસ કરીને નાના કંદની વસ્તુઓ વગેરેમાં વધારે અનુકૂળ રહે છે.

વિતરણના માધ્યમો

આ માધ્યમમાં ઉત્પાદકો એક કે વધુ છૂટક વેપારીઓને માલ વેચે છે અને તેઓ આખરી ઉપભોક્તાને વેચે છે. આ માધ્યમો નીચેના સંજ્ઞાગોમાં ઉપયોગ થાય છે.

1. જ્યારે વસ્તુઓ સ્થાનિક બજારમાં વેચવા યોગ્ય હોય જેમકે – પ્રોડ, બિસ્કીટ, પેટિસ વગેરે
2. જ્યારે છૂટક વેપારી મોટા ગજાનો હોય અને મોટા પાયે ખરીદી કરીને નાના એકમોમાં ઉપભોક્તાઓને વેચતો હોય.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને સુપર માર્કેટ આના ઉદાહરણો છે.

ઉત્પાદક → જથ્થાબંધ વેપારી → છૂટક વેપારી → ઉપભોક્તા



૧૩.૧ પા�ગત પ્રશ્નો

યોગ્ય શબ્દોથી નીચેના વિધાનો પૂર્ણ કરો.

1. જે માગે વસ્તુઓ ઉત્પાદકથી આખરી ઉપભોક્તા સુધી પહોંચે છે તે તરીકે જાણીતો છે.
2. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી અને આખરી ઉપભોક્તા વચ્ચે માધ્યમ બને છે.
3. જ્યાં વસ્તુઓ મધ્યસ્થીઓ દ્વારા વેચવામાં આવે તેને વિતરણનું માધ્યમ કહે છે.
4. જ્યાં માલસામાન કોઈપણ મધ્યસ્થીની સેવા લીધા વગર સીધેસીધો ઉપભોક્તાને વેચવામાં આવે તેને માધ્યમ કહે છે.
5. પ્રત્યક્ષ માધ્યમમાં ઉત્પાદકો ઉપભોક્તાઓને પોતાનો માલ પોતાના સેલ્સમેન દ્વારા ધેર ધેર પહોંચાડે છે અથવા તેમના પોતાના દ્વારા પહોંચાડે છે.

૧૩.૩ જથ્થાબંધ વેપારી તેમજ છૂટક વેપારી

જથ્થાબંધ તેમજ છૂટક વેપારીઓ મહત્વના મધ્યસ્થીઓ છે. જેઓ સામાન્ય રીતે માલને ઉત્પાદક તરફથી ઉપભોક્તા તરફ વહાવવામાં સરળતા કરી આપે છે. ચાલો આપણે તેમના વિષે વિગતવાર અભ્યાસ કરીએ.

૧. જથ્થાબંધ વેપારીઓ:-

જથ્થાબંધ વેપારી વિતરણ માધ્યમના અગત્યના મધ્યસ્થીઓ માહેતો એક છે. જે પુષ્ટ માત્રામાં વસ્તુઓનો વેપાર કરે છે. તેઓ ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલ ખરીદે છે. અને તેનો નાનો નાનો (થોડો થોડો) હિસ્સો છૂટક વેપારીનો વેચે છે. કયારે વળી ઉપભોક્તા મોટા

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



પ્રમાણમાં ખરીદી કરે તો તે સીધો સીધો તેને જ માલ વેચે છે. તે સામાન્ય રીતે બહુ મર્યાદિત જાતની વસ્તુઓનો જ વેપાર કરે છે અને તે વસ્તુઓ એક વિશિષ્ટ શ્રેણીનું ઉત્પાદન હોય છે. જેમકે, લોહું, સ્ટીલ, કાપડ, કાગળ, વીજણીના ઉપકરણો વગેરે. ચાલો જથ્થાબંધ વેપારીની કેટલીક લાક્ષણિકતાઓ (ખાસિયતો) વિષે જાણીએ.

જથ્થાબંધ વેપારીની લાક્ષણિકતાઓ (વિશેખતાઓ):-

જથ્થાબંધ વેપારીઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે

૧. જથ્થાબંધ વેપારીઓ સીધા ઉત્પાદક કે વિનિર્માતા પાસેથી માલ ખરીદે છે.
૨. જથ્થાબંધ વેપારીઓ મોટા પાયે માલ ખરીદે છે અને પ્રમાણમાં નાના નાના જથ્થામાં વેચે છે.
૩. તેઓ ઉત્પાદનની એક જ શ્રેણી (પ્રકાર, તરાફ)ની વિવિધ વસ્તુઓ ખરીદે છે / વેચે છે. દા.ત. એક જથ્થાબંધ વેપારી 'કાગળ'નો વેપાર કરે છે. તો તેણે તમામ પ્રમારના કાગળ, કાર્ડ બોર્ડ, કાર્ડ પેપર વગેરે રાખવા જોઈએ.
૪. તેઓ ઉત્પાદનના વિતરણ / વેચાણ માટે અનેક એજન્ટો રાખતા હોય છે.
૫. જથ્થાબંધ વેપારીઓએ વેપારમાં મોટા પાયા ઉપર મૂડી રોકાણ કરવું પડે છે.
૬. તેઓ સામાન્ય રીતે છૂટક વેપારીઓને ઉધાર વેપારની સગવડ આપે છે.
૭. તેઓ ઉત્પાદકો કે વિનિર્માતાઓને આર્થિક સહાય પણ પૂરી પાડતા હોય છે.
૮. તેઓ મોટેભાગે શહેર કે નગરના અમૃક વ્યાપારી ક્ષેત્રમાં રહેતા હોય છે.

ઉદાહરણ તરીકે તમને એક વિસ્તારમાં કાપડના વેપારી બીજા વિસ્તારમાં પુસ્તક પ્રકાશક તો વળી કોઈ વિસ્તારમાં ફર્નિયરના વેપારીઓ જોવા મળશે.

જથ્થાબંધ વેપારીઓના કાર્યો:-

તમે હવે જથ્થાબંધ વેપારીઓનો અર્થ બરાબર સમજી ગયા છો અને તેમની વિશેખતાઓની પણ નોંધ લીધી છે. ચાલો હવે આપણે તેમના કાર્યો વિશે જાણીએ.

જથ્થાબંધ વેપારીઓ સામાન્ય રીતે નીચેના કાર્યો કરે છે.

૧. વસ્તુઓનો સંગ્રહ:- જથ્થાબંધ વેપારી ઉત્પાદકો કે વિનિમા તાઓ પાસેથી ઢગલાબંધ માલ ભેગો કરે છે
૨. વસ્તુઓના સંગ્રહ ભંડાર:- જથ્થાબંધ વેપારી પુષ્ટ માલ ભેગો કરે છે અને તેનો વખાર (ગોદામ, સ્ટોર, હાઉસ)માં સંલામત રીતે સંગ્રહ કરે છે. આ માલ વેચાઈ જાય ત્યાં સુધી સાચવવો પડે છે. જસ્ટી નાશ પામે તેવો માલ શીતાગાર/કોસ્ટ સ્ટોરેજમાં રાખવો પડે છે, જેમ કે ફળો, શાકભાજી વગેરે.
૩. વિતરણ:- જથ્થાબંધ વેપારી છૂટક વેપારીઓને માલ વેચે છે. આ રીતે તે વિતરણનું પણ કામ કરે છે.

વિતરણના માધ્યમો

૪. નાણાં (ધન) પ્રદાન:- જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદકો અને વિનિર્માર્તાઓને અગાઉથી પૈસા મોકલી આપી આર્થિક સહાય પણ કરે છે. વળી તે છૂટક વેપારીઓને માલ ઉધાર પણ વેચે છે. આમ બંને બાજુને જથ્થાબંધ વેપારી આર્થિક સહાય પૂરી પાડે છે.
૫. જોખમ ઉઠાવવું:- જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદકો પાસેથી તૈયાર માલ ખરીદીને તે વેચાઈ જાય ત્યાં સુધી વખારમાં રાખે છે. આમાં તેને વસ્તુઓની માંગમાં ઉત્પન્ન થતું પરિવર્તન, કિંમતમાં વૃદ્ધિ, માલ બગડી જવો કે નાશ પામવો વગેરે જોખમોનો સામનો કરવો પડે છે.
૬. પ્રમાણિકતા (ગિલટી):- જ્યારે એકસરખી ગુણવત્તાવણો માલ ન હોય ત્યારે જથ્થાબંધ વેપારી ગુણવત્તાના ધોરણો નક્કી કરી માલનું વર્ગીકરણ કરે છે. આ ધોરણો માલની ગુણવત્તા, કંદ અને વજનના આધારે કરે છે. માલનું પ્રમાણિકરણ કર્યા બાદ યોગ્ય જથ્થામાં માલનું પેકિંગ કરે છે. કેટલાક જથ્થાબંધ વેપારીઓ પોતાના નામની જ બ્રાન્ડ આપી બજારમાં વિતરણ કરે છે.
૭. કિંમત નિર્ધારણ:- વસ્તુનું વેચાણકિમત જથ્થાબંધ વેપારી દ્વારા નક્કી થાય છે. જથ્થાબંધ વેપારી વસ્તુની કિંમત માલના પુરવઠા દ્વારા નક્કી કરે છે. જથ્થાબંધ વેપારીઓ બજારની પરિસ્થિતી, વસ્તુની માંગ, લોકોની શોખ અને લોકોને જ્યારે જરૂર પડે ત્યારે વસ્તુનો પુરવઠો પુરો પાડવાનું મહત્વ કાર્ય કરે છે.



૧૩.૧ પાઠગત પ્રશ્નો

જથ્થાબંધ વેપારીઓ વિષેના નીચેના કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે તે જણાવો.

૧. તેઓ સીધા છૂટક વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદી ઉપભોક્તાઓને વેચે છે.
૨. તેઓ સામાન્ય રીતે ઉત્પાદકો અને છૂટક વેપારીઓને શાખાની સુવિધા આપે છે.
૩. તેઓ જથ્થાબંધ માલ ખરીદે છે અને વેચાય ત્યાં સુધી સલામત રીતે સંઘરી રાખે છે.
૪. જથ્થાબંધ વેપારીઓને પોતાના વેપાર માટે થોડીક મૂડીની જરૂર પડે છે.
૫. તેઓ ગ્રાહકની નજીક વિવિધ બજારોમાં ઠેર ઠેર રહેતા હોય છે.
૬. તેઓ વેચાણ માટે અનેક પ્રકારની વસ્તુઓ થોડી થોડી માત્રામાં ખરીદે છે.

૨. છૂટક વેપારીઓ:-

છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી અને કયારેક ઉત્પાદકો પાસેથી માલ ખરીદીને ગ્રાહકોને વેચતા હોય છે. તેઓ સામાન્ય રીતે નાની નાની દુકાનો દ્વારા કામ કરતા

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



હોય છે. થોડા માલનું વેચાણ કરતા હોય છે. તેઓ રોજબરોજની વપરાશની વિવિધ પ્રકારની ઘણીબધી વસ્તુઓ રાખતા હોય છે.

છૂટક વેપારીઓની લાક્ષણિકતાઓ (વિશેષતા, ખાસિયતો):–

છૂટક વેપારીઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

૧. છૂટક વેપારીઓને ઉપભોક્તાઓ સાથે સીધો સંબંધ હોય છે. ગ્રાહકોની જરૂરિયાતોની તુમને ખબર હોય છે. અને તે મુજબની વસ્તુઓ પોતાની દુકાનમાં રાખે છે.
૨. છૂટક વેપારીઓ પુનઃ વેચાણ માટે માલનું વેચાણ કરતા નથી. પરંતુ ગ્રાહકોના આખરી ઉપયોગ માટે જ વેચે છે. દા.ત. ફોન, કપડાં, પેન, પેન્સિલ, વગેરે તમારા ઉપયોગ માટે જ છે. વેચાણ માટે નહિ.
૩. છૂટક વેપારીઓ થોડા થોડા પ્રમાણમાં વસ્તુઓ ખરીદે છે અને વેચે છે. તેથી ગ્રાહકો ભવિષ્ય માટે સંગ્રહ કર્યા વગર પણ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે.
૪. જથ્થાબંધ વેપારીઓની સરખામણીમાં છૂટક વેપારીઓને વેપાર શરૂ કરવા કે ચલાવવા ઓછી મૂડીની જરૂર પડે છે.
૫. છૂટક વેપારી ઉત્પાદનની વિવિધ અનેક જાતોનો વેપાર કરે છે. અને ગ્રાહકોને માલ ખરીદવા માટે વિશ્વાળ પસંદગીની તક આપે છે.
૬. છૂટક વેપારીઓ માલ શાખ પર ખરીદે છે પણ સામાન્ય રીતે તેને રોકડમાં વેચે છે.
૭. છૂટક વેપારી પોતાની દુકાન કે શો રૂમમાં ગ્રાહકોને આકર્ષિત કરવા વસ્તુઓની ગોઠવણીશાશ્વતારીને કરવામાં આવે છે. આ વસ્તુનો શાશ્વત ગ્રાહકને આકર્ષે છે.

છૂટક વેપારીઓનાં કાર્યો:–

બધા છૂટક વેપારીઓ બિના બિના રૂચિ અને સ્વભાવવાળા ગ્રાહકો સાથે વેપાર કરતા હોય છે. તેથી પોતાના ગ્રાહકોને સંતોષ આપવા તેમજ તેમને વધુ ખરીદવા માટે લોભાવવા તેઓએ સક્રિય તેમજ કુશળ બનવું પડે છે. છૂટક વેપારીઓ માલના વિતરણમાં શું શું કરે છે તે આપણે જોઈએ.

૧. વસ્તુઓની ખરીદી અને સંકલનઃ— છૂટક વેપારીઓ ઉત્પાદકો અને વિનિર્માતાઓ પાસેથી વિવિધ પ્રકારનો માલ ખરીદે છે અને સંકલિત કરે છે. તેઓ ગ્રાહકોને ગમતી જ બ્રાન્ડ કે જાતની વસ્તુઓ જ રાખતા હોય છે અને તેમની માંગ હોય તે પ્રમાણે વસ્તુઓનો જથ્થો રાખતા હોય છે.
૨. માલનો સંગ્રહ:— ગ્રાહકોને જયારે જે વસ્તુઓ જોઈએ તે હાજર સ્ટોકમાં મળી રહે તે માટે છૂટક વેપારીઓ સ્ટોરમાં વસ્તુઓનો સંગ્રહ કરે છે. જેમ અને જયારે ગ્રાહકોને જરૂર પડે તેમ અને ત્યારે આ સ્ટોરમાંથી માલ કાઢીને તેમને વેચી શકાય

વિતરણના માધ્યમો

- છે. આથી ગ્રાહકો એક સામટો માલ ખરીદીને સંઘરી રાખવાની કડાકૂટમાંથી બચી જાય છે.
૩. ઉધારની સગવડઃ— જો કે સામાન્ય રીતે છૂટક વેપારીઓ માલ રોકડેથી વેચતા હોય છે. પણ પોતાના નિયમિત ગ્રાહકને ઉધાર પણ આપતા હોય છે. ઉધારની સગવડ મોટા પ્રમાણમાં ખરીદ કરનારને પણ આપવામાં આવે છે.
૪. વ્યક્તિગત સેવાઓઃ— છૂટક વેપારીઓ વસ્તુઓની ગુણવત્તા, વિશિષ્ટતા અને ઉપયોગિતાની બાબતમાં પોતાના ગ્રાહકોને સલાહ માર્ગદર્શન આપીને વ્યક્તિગત સેવા પણ કરે છે. ગ્રાહકોના ગમા અણગમાને લક્ષણમાં રાખીને તેઓ સલાહસૂચનો પણ આપતા હોય છે. તેઓ (મજૂરી લીધા વગર) ગ્રાહકોને માલ તેમના ઘર સુધી પહોંચતો કરવાની સેવા પણ આપતા હોય છે. આમ જ્યારે માલની માગણી જ્યાં થાય ત્યાં માલ પૂરો પાડીને તેઓ સ્થળની ઉપયોગિતા સજે છે.
૫. જોખમ ઉઠાવવુંઃ— છૂટક વેપારીઓ જોખમ ઉઠાવે છે જેમ કે,
- માલને આગ લાગવી કે ચોરી થવી.
 - માલ વેચાઈ ન જાય ત્યાં સુધીમાં ગુણવત્તા ઘટવાનું જોખમ.
 - ગ્રાહકોની રૂચિ અને ફેશનમાં ફેરફાર.
૬. વસ્તુઓનું પ્રદર્શનઃ— છૂટક વેપારીઓ વિવિધ પ્રકારની વસ્તુઓની બહુ જ પદ્ધતિસર અને આકર્ષક રીતે પ્રદર્શન કરતા હોય છે. તેનાથી ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળે છે. અને માલના સત્વર વિતરણમાં પણ સુગમતા રહે છે.
૭. માહિતી પ્રદાનઃ— છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ દ્વારા ઉત્પાદકોને ગ્રાહકોના વર્તન—વ્યવહાર, રૂચિ, ફેશન અને તેમની માગ સંબંધી તમામ માહિતી પહોંચાડતા હોય છે. આમ, તેઓ બજાર (વેચાણ) સંશોધન માટે એક ઉપયોગી સ્ત્રોત બની રહે છે.

૧૩.૧ જથ્થાબંધ અને છૂટક વેપારીઓ વચ્ચે તફાવત

તમે જથ્થાબંધ અને છૂટક વેપારીઓ વિષે અગ્રાઉ જાણી ચૂક્યા છો. તમે જોયું હશે કે તે બંને શૈલી અને કાર્યમાં એકબીજાથી જુદા પડે છે. ચાલો આપણે આ તફાવતો શોધીએ.

જથ્થાબંધ વેપારી	છૂટક વેપારી
(૧) વસ્તુઓ જથ્થાબંધ ખરીદે છે.	(૧) વસ્તુઓ થોડા પ્રમાણમાં ખરીદે છે.
(૨) સીધા ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે છે.	(૨) મોટાભાગે જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદે છે.
(૩) વસ્તુઓની મર્યાદિત જાતોનો વેપાર કરે છે.	(૩) ઉત્પાદનની એક વિશાળ વૈવિધ્યપૂર્ણશ્રેષ્ઠીનો વેપાર કરે છે.





(૪) વેપાર શરૂ કરવા અને ચલાવવા વધારે મૂડીની જરૂર પડે છે.	(૪) વેપાર શરૂ કરવા અને ચલાવવા ઓછી મૂડીની જરૂર પડે છે.
(૫) વસ્તુઓ પુનઃવેચાણ માટે વેચે છે.	(૫) વસ્તુઓ વપરાશ માટે વેચે છે.
(૬) ગ્રાહકોને સાથે સીધો સંબંધ નહિ.	(૬) ગ્રાહકો સાથે સીધો સંબંધ.
(૭) દુકાનની શોભા-સજાવટ ઉપર વિશિષ્ટ ધ્યાન આપવામાં આવતું નથી.	(૭) ગ્રાહકોનું ધ્યાન આકર્ષવા માટે છૂટક વેપારીઓ દુકાનની સજાવટ ઉપર વધુ ધ્યાન આપે છે.



૧૩.૩ પાઠગત પ્રશ્નો

- નીચેના વિધાનો પૈકી જથ્થાબંધ વેપારીને લાગુ પડતા વિધાનો સામે કોંસમાં '✓' સાચું દર્શાવો અને છૂટક વેપારી સામે '✗' ખોટું દર્શાવો.
 - થોડીમાત્રામાં વસ્તુઓ વેચવી ()
 - વધારે મૂડી જરૂરી ()
 - વસ્તુઓનું પુનઃવેચાણ માટે વેચાણ ()
 - સીમિત પ્રકારની વસ્તુઓનું વેચાણ ()
 - ઉપભોક્તા સાથે પ્રત્યક્ષ સંબંધ ()
- નીચેના પ્રશ્નોના જવાબ આપો.
 - છૂટક વેપારીને ક્યા જોખમ હોય છે ? ગમે તે બે જણાવો.
 - ઉત્પાદકોને છૂટક વેપારીના કાર્યો દ્વારા કઈ રીતે લાભ થાય છે ? કોઈપણ બે કાર્યોમાંથી થતા ફાયદા જણાવો.
 - ધારો કે તમારી ગલીમાં એક જાતની વસ્તુઓ બે અથવા ત્રણ દુકાનદારો વેચે છે. તો તમારી જરૂરિયાતો માટે ક્યા દુકાનદાર પાસેથી ખરીદી કરવાનું પસંદ કરશો.
- યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
 - પ્રત્યક્ષ વિતરણ માર્ગમાં માત્ર સમાવેશ થાય છે.
 - ઉત્પાદક → છૂટક વેપારી → ઉપભોક્તા
 - ઉત્પાદક → ગ્રાહક
 - ઉત્પાદક → જથ્થાબંધ વેપારી → ગ્રાહક
 - ઉત્પાદક → એજન્ટ → ગ્રાહક
 - જથ્થાબંધ વેચાણની પદ્ધતિમાં વેચનાર વેપારીને ક્યા નામથી ઓળખાય છે?

વિતરણના માધ્યમો

- અ. વિદેશી વેપારી.
 બ. જથ્થાબંધ વેપારી.
 ક. મૂળગત કે મૂળભૂત વેપારી.
 ઢ. છૂટક વેપારી.
 ૩. જથ્થાબંધ વેપારી કોને જોડણી મહત્વની કરી છે?
 અ. ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી.
 બ. છૂટક વેપારી અને ગ્રાહક.
 ક. ઉત્પાદક અને ગ્રાહક.
 ઢ. ઉત્પાદક અને છૂટક વેપારી.
 ૪. ગ્રાહોના સમય અંતરે ગમા અને અણગમાની જાણ જથ્થાબંધ વેપારીઓને કોના દ્વારા થાય છે?
 અ. જાહેરાત દ્વારા.
 બ. વર્તમાનપત્ર દ્વારા.
 ક. છૂટક વેપારીઓ દ્વારા.
 ઢ. ગ્રાહકો દ્વારા.
 ૫. જથ્થાબંધ વેપારીઓનું મુખ્ય લક્ષણ છ.
 અ. ઉત્પાદકની જાહેરાત આપવી.
 બ. સસ્તા દરે વસ્તુનું વેચાણ કરવું.
 ક. જુદા જુદા પ્રકારે વસ્તુનું વેચાણ કરવું.
 ઢ. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલ ખરીદી છૂટક વેપારીને વેચવો.



તમે શું શીખ્યા?

વિતરણના માધ્યમો એ એવો માર્ગ છે કે જે દ્વારા માલ સામાન ઉત્પાદકો પાસેથી નીકળી ઉપભોક્તા સુધી પહોંચે છે. જ્યારે ઉત્પાદક વસ્તુઓ કે સેવાઓ સીધી ઉપભોક્તાને વેચે છે. ત્યારે તેને પ્રત્યક્ષ માધ્યમ કહે છે. જ્યારે વિતરણ પ્રક્રિયામાં અનેક મધ્યરથી સામેલ હોય ત્યારે તેને પરોક્ષ માધ્યમ કહે છે.

વિતરણ માધ્યમમાં જથ્થાબંધ વેપારી એવા મધ્યરથી છે કે જેઓ જથ્થાબંધ માલની લે-વેચ કરે છે. તેઓ વસ્તુઓ છૂટક વેપારીને અને ક્યારેક સીધી ઉપભોક્તાને પણ વેચે છે. જથ્થાબંધ વેપારીઓનાં કાર્ય છે માલ સામાન ભેગો કરવો અને સંગ્રહવો, વિતરણ, આર્થિક સહાય અને જોખમ ઉઠાવવું.

છૂટક વેપારીઓ એવા મધ્યરથી છે કે જે જથ્થાબંધ વેપારીઓ કે ઉત્પાદકો પાસેથી માલ ખરીદે છે અને ઉપભોક્તાઓને વેચે છે. તેઓ માલ ખરીદવા, સંગ્રહવા અને એકત્ર કરવાની

મોડયુલ - ૪
 ખરીદ - વેચાણ અને
 વિતરણ



નોંધ

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

વિતરણના માધ્યમો

ક્રમગીરી બજાવે છે. ઉધારની સગવડ આપે છે. વ્યક્તિગત સેવાઓ આપે છે. જોખમ ઉઠાવે છે. દુકાનો કે શોરૂમમાં વસ્તુઓનું પ્રદર્શન કરે છે અને માહિતી પૂરી પાડે છે.



પાઠગત પ્રશ્નો

૧. વિતરણ માધ્યમ એટલે શું ?
૨. કોઈ એવી ચાર સેવાઓના નામ આપો જેનું વિતરણ પ્રત્યક્ષ માધ્યમોથી થતું હોય.
૩. કોઈપણ ઉત્પાદન ઉત્પાદક પાસેથી નીકળીને જે વિવિધ માધ્યમો દ્વારા અંતિમ ઉપભોક્તા સુધી પહોંચે છે તે માધ્યમો સમજાવો.
૪. જથ્થાબંધ વિકેતાની વ્યાખ્યા આપો. તેઓ કઈ રીતે વિતરણ માધ્યમમાં અગત્યનું કરીરૂપ ભૂમિકા ભજવે છે ?
૫. છૂટક વેપારીની કોઈપણ ચાર વિશેષતાઓ દર્શાવો.
૬. વસ્તુઓના વિતરણમાં છૂટક વેપારીઓની ભૂમિકા સ્પષ્ટ કરો.
૭. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ વચ્ચે કોઈપણ પાંચ તફાવતો દર્શાવો.
૮. જથ્થાબંધ વેપારીના કાર્યો જણાવો.



પાઠગત પ્રશ્નોના ઉત્તર

૧૩.૧

- (૧) વિતરણ માધ્યમ (૨) મધ્યસ્થી (૩) પરોક્ષ
(૪) પ્રત્યક્ષ (૫) છૂટક સ્ટોર

૧૩.૨

- (૧) ખોટું (૨) ખરું (૩) ખરું
(૪) ખોટું (૫) ખોટું (૬) ખોટું

૧૩.૩

૧.

૧. ✓ ૨. ✗ ૩. ✗ ૪. ✗ ૫. ✓

૨. નીચેનામાંથી કોઈપણ બે

૧.

વિતરણના માધ્યમો

- ક. આગ અથવા વસ્તુની ચોરીનું જોખમ
 - ખ. વસ્તુ વેચાય નહીં ત્યાં સુધી તેની ગુણવત્તા ઘટવાનું જોખમ
 - ગ. ઉપભોક્તાઓની રૂચિ અને ફેશનમાં ફેરફાર
- ૨.
- ક. વસ્તુઓના સંગ્રહણ અને પ્રદશ ન દારા બજારમાં સહાય
 - ખ. ઉત્પાદકોએ ઉઠાવવાનું જોખમ પોતે ઉપાડે છે.
 - ગ. તેઓ ગ્રાહકોની રૂચિ અને પસંદગી વિષેની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે.
૩. તે દુકાનદાર પાસેથી આપણે આપણે જરૂરિયાત મુજબ ખરીદી કરીએ.
- ક. વસ્તુની વાજબી કિંમત લેતો હોય
 - ખ. વેચાણ પદ્ધીની સેવાઓ પણ પૂરી પાડતો હોય.
 - ગ. આપણી રૂચિ અન પસંદગી પ્રમાણેની વિવિધ વસ્તુઓ પૂરી પાડતો હોય.
 - ઘ. ઉધાર તેમજ વસ્તુ ઘરે પહોંચાડવાની સગવડ આપતો હોય.

૩.

૧. ૬

૨. ૬

૩. ૫

૪. ૩

૫. ૩



જાતે કરો:

તમારા પોતાના મહોલ્લામાંથી દુકાનની મુલાકાત કરો અને જથ્થાબંધ અથવા છૂટક વેપારીઓના કાયો શોધો.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



છૂટક વેપાર

તમારે તમારા દૈનિક જીવનમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની જરૂર પડે છે. તમને આ બધી ચીજ વસ્તુઓ ક્યાં મળે છે? શું આ બધી વસ્તુ તમને તમારી સ્થાનિક બજારમાંથી મળે છે? જો ન મળે તો તમારે તે વસ્તુ નજીકના કોઈ શહેર કે બજારમાંથી ખરીદવી પડતી હશે. સામાન્ય રીતે તમારે પસંદગીની વસ્તુ મેળવવા માટે દુકાને – દુકાને અને બજારે – બજારે ફરવું પડતું હશે. તમને વિચાર આવતો હશે કે આ બધી વસ્તુઓ એક જ દુકાનમાં કેમ નહીં મળતી હોય? હા, એવી અમુક દુકાનો છે ત્યાં તમારી સગવડતા મુજબની વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદી શકો છો. વળી, આ બધી ચીજોની પસંદ કરી હોય તે તમને ઘર આંગણે પણ મળી શકે. એવી પણ દુકાનો છે કે જ્યાં કોઈ વેચનાર હાજર નથી હોતા કે જે તમને માર્ગદર્શન આપે અથવા વસ્તુ ઉપાડીને તમને દેખાડે. ઇતાં તમે તમારી પસંદગીની ચીજ ખરીદી શકો છો. તમને નવાઈ લાગે છે ને? એમાં આશ્રય પામવાની જરૂર નથી. ચાલો આપણે આ બધું કેમ બને છે તે જોઈએ.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે આટલું જાણી શકશો.

- છૂટક વેપારનો અર્થ જણાવી શકશો.
- છૂટક વેપારના જુદા જુદા પ્રકાર ઓળખી શકશો.
- જુદા જુદા પ્રકારના વિશાળ પાયા પર છૂટક વેપારમાં રોકાયેલાની યાદી બનાવી શકશો.
- વિશાળ પાયે છૂટક વેપારના દરેક પ્રકારના લાભ અને ગેરલાભ વર્ણવી શકશો.
- જે વસ્તુનો સંગ્રહ નથી કરી શકતા તેવા છૂટક વેપારીઓના વિવિધ પ્રકાર વર્ણવી શકશો.

૧૪.૧ છૂટક વેપારનો અર્થ

નાના દુકાનદારો જે ઉપભોક્તાને પ્રત્યક્ષ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહે છે. લારી-ગલ્વાવાળા, ફેરિયાઓ, એક જ ભાવની દુકાન કે જીવન જરૂરિયાતની નાની નાની વસ્તુઓ વેચતા વેપારીઓ આ બધા જ છૂટક વેપારના પ્રકારો છે. છૂટક વેપાર એ વિતરણ માર્ગની

છૂટક વેપાર

છેલ્લી કરી છે. છૂટક વેપાર એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જોડતી કરી છે. જે જથ્થાબંધ વેપારી પાસેથી નાના – નાના જથ્થામાં વસ્તુઓ ખરીદીને ગ્રાહકને જોઈતા પ્રમાણમાં તેમની જરૂરિયાતો પૂર્ણ કરે છે. છૂટક વેપારમાં અથ્વ મૂડી રોકાણની જરૂર પડે છે અને મહદૂઅંશો છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી રોકડેથી જ માલ ખરીદે છે. તે કોઈ ખાસ વસ્તુના વેચાણમાં સક્રિય નથી. પરંતુ નાની – નાની ઘણી બધી વસ્તુઓના વેચાણમાં રસ લે છે. તેની દુકાનની પ્રવૃત્તિ – વસ્તુઓના વેચાણ ત્યાંના સ્થાનિક રહીશેને આધારિત છે.

૧૪.૨ છૂટક વેપારના પ્રકાર

આગળના ભાગમાં તમે છૂટક વેપારીઓ વિશે જાણ્યું. તમારા મનમાં એવી છાપ હશે કે છૂટક વેપારીઓ પોતાના નજીકના મહોલ્ખામાં વેપાર કરતા નાના દુકાનદારો છે. તમને જાણીને આશ્રય થશે કે ફેરિયા અને મહોલ્ખાના વેપારીઓથી માંડીને સુપર માર્કેટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ (ખાતાવાળી દુકાન) અને બહુવિકલ્પ ધરાવતી દુકાનો સુવીના બધા આપણા દેશમાં છૂટક વેપાર કરે છે. આપણો છૂટક વેપારને બે ભાગમાં વર્ગીકરણ કરી શકીએ.

અ. નાના પાયા પર છૂટક વેપાર,

બ. મોટા પાયા પર છૂટક વેપાર

નાના પાયા પર છૂટક વેપારમાં મર્યાદિત વસ્તુઓ અને મર્યાદિત જથ્થામાં ચોક્કસ સ્થાનિક વિસ્તારમાં વસ્તુ કે સેવાનું વિતરણ (વેચાણ) કરવામાં આવે છે. જેમાં અથ્વ મૂડી રોકાણ અને મર્યાદિત ગ્રાહક સંખ્યા હોય છે. જ્યારે બીજી બાજુ મોટા પાયા પરના છૂટક વેપારમાં મુડીનું રોકાણ વધુ હોય છે. અને મોટા પ્રમાણમાં (જથ્થા માં) વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જે અનેક ગ્રાહકોની જરૂરિયાણો પૂરી પાડે છે. સુપર માર્કેટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને બહુવિકલ્પની (મોલ) દુકાનો મોટા પાયા પરના છૂટક વેપારના ઉદાહરણ છે.

આ પાઠમાં તમે છૂટક વેપાર વિશે વિગતે શીખશો.

અ. નાના પાયા પર છૂટક વેપાર:-

નાના પાયા ઉપરના છૂટક વેપારમાં વિવિધ પ્રકારના છૂટક વેપારીઓ રોકાયેલા હોય છે. તેમનું વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે.

૧. હરતો – ફરતો છૂટક વેપાર (અસ્થાયી છૂટક વેપાર)

૨. સ્થાયી દુકાન ધરાવતો છૂટક વેપાર.

૩. હરતો – ફરતો છૂટક વેપાર:-

મોડયુલ – ૪
ખરીદ – વેચાણ અને
વિતરણ



નોંધ



આ એક નાના પાયા ઉપરનો છૂટક વેપાર છે. જે વસ્તુ કે સેવા પ્રત્યક્ષ રીતે ગ્રાહકોને વેચે છે. તેઓને એક જગ્યાએ બેસીને વેચવા માટે સ્થાયી દુકાનો હોતી નથી. તમે તેમને સવારમાં વહેલાં છાપા વેચતા જોયા હશે. બસ કે ગાડીમાં શીંગ - ચણા, રમકડાં, ફળ ફળાઈ, છાપાં, બંગડીઓ વગેરે હરતા - ફરતા વેચતા હોય છે. તમારા ફણિયા કે સોસાયટીમાં શાકભાગીની લારી, ફળફળાઈ, બરફના ગોળા, આઈચીમ, ચવાણું, નમકીન કે બંગડીઓ, એરીંગ, બક્કલ, કલીપ, પ્લાસ્ટીકની વસ્તુઓ વગેરે લારીમાં વેચતા હોય છે. લારીમાં ભમરા, પૌંઆ કે માટીના વાસણ કે તક્કિયા, ગાળિયા, ચાદર, ટુવાલ વગેરે લારીમાં વેચતા હોય છે. અમુક વેપારીઓ પગારના હિવસે કે અમુક તહેવારોએ બજાર કે ઓફિસના અમુક સ્થળે વસ્તુઓ વેચતા હોય છે. ગામડામાં આવા બજારને હાર કહે છે. જગારે શહેરમાં આવા બજારને ગુજરી કહે છે. હરતા - ફરતા વેચાતી વસ્તુઓ કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામ વાળી હોતી નથી.

૨. સ્થાયી દુકાનવાળો છૂટક વેપાર:-

આ પ્રકારના છૂટક વેપારમાં વેપારીની દુકાનનું સ્થળ ચોક્કસ અને કાયમી હોય છે. તેને સ્થાયી દુકાન કહે છે. આવી દુકાનો બજારમાં, વ્યાપારી સંકુલમાં, સોસાયટીના નાકે કે રહેઠાણવાળા વિસ્તારમાં હોય છે. સાધારણ રીતે આ દુકાનો મયા હિત પ્રકારની વસ્તુઓ વેચે છે. વસ્તુઓ સ્ટોરમાં - દુકાનમાં પ્રદર્શી ત કરવામાં આવે છે. ઉપરાંત પોતાની વખારમાં પણ માલ રાખે છે.

સ્થાયી દુકાન પર વેચાતી વસ્તુઓના પ્રકારને આધારે છૂટક વેપારનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય.

- અ. જનરલ સ્ટોર અથવા વૈવિધ્યવાળી વસ્તુઓ વેચતી દુકાન,
 - બ. એક જ વસ્તુનો સ્ટોર (દુકાન),
 - ક. વિશિષ્ટ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી દુકાન.
- અ. જનરલ સ્ટોર અથવા વૈવિધ્યવાળી વસ્તુઓ વેચતી દુકાન:-

નામ પ્રમાણે જ આ દુકાનો રોજરબરોજની સામાન્ય વપરાશની ચીજ વસ્તુઓનું છૂટક વેચાણ કરતા હોય છે. દા. ત. ટેક જનરલ સ્ટોરમાં તમારી વિવિધ પ્રકારની જરૂરિયાતો જેવી કે મોઝા, હાથ રૂમાલ, ગંઝી ફ્રાક, અંડરવેર વગેરે, બિસ્કીટ, ચોકલેટ, નાસ્તા, ભેટની વસ્તુઓ, સ્ટેશનરી વગેરે જોઈતી બધી વસ્તુઓ મળે છે. સામાન્ય રીતે આ છૂટક વેપારીઓ માત્ર રોકડેથી જ સીધું વેચાણ કરતા હોય છે. તેમ છતાં તેમના નિયમિત ગ્રાહકો માટે તેઓ વળતર આપે છે. ઉધાર - બાકીની સગવડ પણ આપે છે. અને કયારેક ખુબ સસ્તા દરે પણ ઘરે પહોંચતી કરે છે.



જનરલ સ્ટોર

છૂટક વેપાર

બ. એક જ વस્તુનો સ્ટોર (દુકાન):-

આવા સ્ટોરમાં એક જ પ્રકારની વસ્તુ વેચાય છે. તમે દવાની દુકાનો (મેડિકલ સ્ટોર), સ્ટેશનરીની દુકાન, રમકડાની દુકાન, તૈયાર કપડાની દુકાન, વાસ્થાની દુકાન વગેરે જોઈ હોશે. આ બધી એક જ વસ્તુની દુકાનો છે. તેઓ બિનાબિન કદની, ખાંડની, ડીજાઈની, વિવિધ ફેશન - સ્ટાઇલની, ગુણવત્તાની, ભાવની એક જ જાતની વસ્તુઓનું વેચાણ કરે છે.



મેડિકલ સ્ટોર (એક જ વસ્તુનો સ્ટોર)

ક. વિશિષ્ટ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી દુકાન:-

આ પ્રકારની દુકાન ચોક્કસ બ્રાન્ડ કે કંપનીના ઉત્પાદનોનો વેપાર કરે છે. આવા સ્ટોરમાં કોઈ પણ ચોક્કસ બ્રાન્ડ કે નિર્માતાની તમામ વિવિધ વસ્તુઓ મળી રહે છે. તમે 'વડલેન્ડ શુ શોપ્સ' કે નોકીઆના મોબાઇલનું વેચાણ કરતી દુકાનો જોઈ હોશે. આવી દુકાનોમાં કંપનીની તમામ પ્રકારની વસ્તુઓ વેચાતી હોય છે.



વડલેન્ડ શુ શોપ્સ
(વિશિષ્ટ વસ્તુઓની દુકાન)



૧૪.૧ પાઠગત પ્રશ્નો

આપેલા કોલમ A અને કોલમ B ને જોડીને યોગ્ય જોડ બનાવો.

કોલમ A

૧. સુપર બજાર
૨. હરતા ફરતા છૂટક વેપાર
૩. વિવિધ દુકાન
૪. વિવિધ વસ્તુ ભંડાળ
૫. એક જ વસ્તુનો ભંડાર

કોલમ B

- અ. એક જ ખાંડની વસ્તુઓ વેચે છે.
- બ. એક જ શ્રેણીની વિવિધ ઉત્પાદનો વેચે છે.
- ક. સામાન્ય વપરાશની વિવિધ પ્રકારની વસ્તુઓ.
- દ. મોટા પાયે છૂટક વેપાર
- એ. લારીમાં વેચવાની વસ્તુઓ.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ



૧૪.૩ વિશાળ પાયે છૂટક વેપારનો અર્થ

ઘારો કે તમે નવાં કપડાં, નવા બૂટ (જૂતા) કેટલીક સૌદય પ્રસાધનોની સામગ્રી અને દેનિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માંગો છો. તમે કપડા ખરીદવા એક દુકાને જશો. પછી બૂટ ખરીદવા કોઈ ભીજી દુકાને જશો. આમ તમારી વિવિધ જરૂરિયાતો ખરીદવા અનેક દુકાનોમાં ફરવું પડશે. વળી એવું પણ બને કે તમારી પસંદગીની વસ્તુ અમુક દુકાનમાં ન પણ હોય, તો તમારે ભીજી દુકાને જવું પડશે. કેટલીક વાર તમારે બજારમાં ભારે ભીડનો સામનો કરવો પડે. આમ સ્થાનિક બનારની આ સામાન્ય મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડે છે.

આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે આપણામાંના કેટલાક લોકો સ્થાનિક બજારની નાની દુકાનો સિવાયની અન્ય મોટી દુકાનોમાં જવાનું પસંદ કરતા હોય છે. દા. ત. જો આપણે જુદી જુદી દુકાને જવાની કુરસદ ન હોય અને આપણી જરૂરિયાતની જુદી જુદી વસ્તુ ખરીદવી હોય તો આપણે એક એવી દુકાન શોધવા પ્રયત્ન કરીશું કે જ્યાં આપણી મોટાલાગની જરૂરિયાતની ચીજો મળી રહે અને વિવિધ જાતોમાંથી પસંદગી કરવાની તક મળે. આપણે આપણા વ્યવસયમાં વસ્તુ હોઈએ અને આપણને ઘેર બેઠાં જ વસ્તુઓ મળી રહે, અથવા તો આપણે કોઈ પ્રયત્ન કંપનીના વ્યાપારી માંકા વાળી – પ્રાન્ડેડ વસ્તુની જરૂર હોય તો આપણને તે વસ્તુ કિફાયત ભાવે મળી જાય તેવી તમામ સુવિધાઓવાળી દુકાન મળી જાય તો આપણને ખુબ જ સુગમતા રહે.

તમારા સ્થાનિક બજારમાં કોઈ એવી દુકાન છે કે જ્યાં તમને આ બધી સુવિધાઓ મળે અને તમે તમારી વસ્તુઓ ખરીદો?

ખરેખર આવી સુવિધાઓ તમને મોટા શહેર કે નગરોની કેટલીક છૂટક દુકાનોમાં મળી રહે. તેઓ એક જ છત નીચે વિવિધ પ્રકારની ચીજો તમને ઉપલબ્ધ કરાવે છે. આ દુકાનો મોટે ભાગે શહેરના સમૃદ્ધ વિસ્તારના મધ્ય – મુખ્ય સ્થળે આવેલી હોય છે. અને અનેક ગ્રાહકોને તેઓ વસ્તુ વેચે છે. આમાં કેટલીક દુકાનોમાં તમને વિવિધ પ્રકારની વસ્તુઓ જોવા મળે જાયારે ભીજી કેટલીક દુકાનોમાં તમને એક જ ઉત્પાદકે બનાવેલી તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળે જેમ કે, બૂટ, શર્ટ, પેન્ટ, બેલ્ટ, ચેશમા વગેરે. આવી દુકાનોને મોલ પણ કરે છે. આ બધી જ દુકાનો જથ્થાબંધ માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીઓની માફક વ્યક્તિઓને વેચે છે. કેટલીક વાર મોટા ઉત્પાદકો પણ પ્રત્યક્ષ વેચાણ કરવા પોતાની કંપનીઓની જ દુકાન – શો રૂમ દેશના વિવિધ બજારમાં ખોલે છે. દા. ત. રિલાયન્સના મોલ, રેમન્ડ મિલના શો રૂમ, બાટા કંપનીના શો રૂમ વગેરે. આ તમામ ઉદાહરણો મોટા પાયા પર છૂટક વેપાર કરતી દુકાનોના જ છે.

હેવે તમે જણાવશો કે વિશાળ પાયા પર વેચાણ કરતી છૂટક વેપારની દુકાન એટલે શું?

વિશાળ પાયા પર છૂટક વેપાર એવા પ્રકારનો વેપાર છે કે જેમાં એક જ જાતની વસ્તુઓ અથવા વિવિધ પ્રકારની વસ્તુઓ એક જ છત નીચે અનેક ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. અથવા તો ગ્રાહકોની જરૂરિયાતો અને સુવિધાઓ મુજબ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

છૂટક વેપાર

વિશાળ પાયા પર છૂટક વેપાર કરતી દુકાનની વિશેષતાઓ:-

- આવી દુકાનો ગ્રાહકોની સુવિધા સચવાય તે અનુસાર તેમની રોજ બરોજની જરૂરિયતોની વસ્તુઓ મોટા પાયા પર પૂરી પાડે છે.
- આવી દુકાનો પોતાની ખરીદી સીધા જ ઉત્પાદકો પાસેથી ખરીદે છે. જેથી મધ્યસ્થીના કમીશનનો બચાવ થાય છે. જેનો લાભ ગ્રાહકને સીધો આપી શકાય છે.
- તે વિશાળ ગ્રાહકોને પોતાની સેવા પૂરી પાડે છે.
- સ્થાનિક કાયમી દુકાનો કરતા આવી દુકાનોના કદ વિશાળ હોય છે.
- આવી દુકાનો – મોલની સ્થાપના કરવા માટે તેમજ તેને રોજ બરોજ અલાવવા માટે ભારે મુઠી રોકાણની જરૂર પડે છે.
- આવી દુકાનો ગ્રાહકોને રોકડમાં જ વસ્તુઓનું વેચાણ કરતી હોય છે.



૧૪.૨ પાઠગત પ્રશ્નો

યોગ્ય જવાબ આપી ખાલી જગ્યા પૂરો.

- વસ્તુ અને સેવાઓના જથ્થામાં પ્રત્યક્ષ વેચાત કરતી દુકાનને છૂટક વેપાર કહે છે.
- જ્યારે દુકાનદાર અનાજ કરિયાણું અને બીજી કટેલીક વસ્તુઓ ગ્રાહકોને પ્રત્યક્ષ વેચે છે ત્યારે તે પ્રવૃત્તિમાં રોકાયેલ છે.
- જ્યારે એક કે તેથી વધારે પ્રકારની વસ્તુઓ ગ્રાહકોને વેચતા હોય ત્યારે તેને છૂટક વેપાર કહે છે.
- વિશાળ પાયાની છૂટક વેપાર એ શહેરના વિસ્તારમાં સ્થપાયેલ હોય છે અને તે વસ્તુઓનું વેચાત સંખ્યામાં ગ્રાહકોને કરે છે.
- વિશાળ પાયાની દુકાનો શરૂ કરવામાં મોટા પાયા પરનાં પોતાના ઉત્પાદનો સીધા જ ગ્રાહકોને વેચે છે.

૧૪.૪ વિશાળ પાયા પર છૂટક વેપારના પ્રકાર

ભારતમાં સામાન્ય રીતે નીચેના પ્રકારો મોટા પાયા પર છૂટક વેપારમાં જોવા મળે છે.

- ખાતાવાળી દુકાનો (ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ).

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



૨. બહુવિકલ્પ - વૈવિધ્ય સ્વરૂપવાળી દુકાનો.

૩. સુપર માર્ક૆ટ.

ચાલો, ઉપરના બધા જ પ્રકારની ચચા આપણે કરીએ.

૧૪.૫ ખાતાવાળી દુકાનો (ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ)

ખાતાવાળી દુકાનો એક મોટા પાયા પર ઇંગ્રેડિયન્ટ્સ વેપાર કરતી દુકાન છે. જ્યાં એક જ મકાનની છત નીચે અનેક પ્રકારની વસ્તુઓ વેચાય છે. આખું ભવન સંખ્યાબંધ વિભાગોમાં વહેંચાયેલું હોય છે. દરેક વિભાગમાં એક ખાસ પ્રકારની વસ્તુ મળે છે.

૪. ત. સ્ટેશનરીનો વિભાગ, રેડીમેઇડ ગારમેન્ટ્સનો વિભાગ, વીજળીના ઉપકરણોનો વિભાગ, કોકરીનો વિભાગ, ઘરેણાનો વિભાગ, સૌદય પ્રસાધનોનો વિભાગ વગેરે વસ્તુઓ ઉપલબ્ધ હોય છે.

આ બધા વિભાગો એક જ મુખ્ય કેન્દ્રથી સંચાલિત થતા હોય છે. એક જ પ્રવેશ દ્વારથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ માં દાખલ થાઓ પછી એક પછી એક તમે દરેક વિભાગની મુલાકાત લઈ શકો છો. આ સ્ટોર્સ માંથી ખરીદી કરવા ગ્રાહકોને આકષ વા સંચાલકો દ્વારા અને સુવિધાઓ અને વેચાણ વૃદ્ધિ યોજનાઓ આપે છે. જેમ કે, નાસ્તા માટે રેસ્ટોરન્ટ, ટેલિફોન વ્યવસ્થા, સોફ્ટ, ઠંડુ પીવાનું પાણી, શૈચાલય આ ઉપરાંત ડિસ્કાઉન્ટ ટેમઝ ATM મશીનો પણ મુકવામાં આવે છે.

આવી ખાતાવાળી દુકાનો વિકસિત રાષ્ટ્રો અમેરિકા અને યુરોપના દેશોમાં ખૂબ પ્રચલિત છે. આપણા દેશમાં પણ હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દિલ્હી, જ્યાપુર, ચેનાઈ, કલકતા વગેરે શહેરોમાં જોવા મળે છે.

ખાતાવાળી દુકાનોની વિશેષતાઓ:-

ખાતાવાળી દુકાનોનો અર્થ જાણી, ચાલો હવે આપણે તેની વિશેષતાઓ જોઈએ.

૧. મોટે ભાગે આવા સ્ટોર્સ શહેરો કે નગરોના મુખ્ય વ્યાપારી કેન્દ્રોમાં આવેલા હોય છે. જેથી જુદા જુદા સ્થળોએથી લોકો પોતાની સગવડ મુજબ ત્યાં વસ્તુઓ ખરીદવા સહેલાઈથી આવી શકે.
૨. ખાતાવાળી દુકાનોના કદ બહુ જ વિશાળ હોય છે. ઘણા વિભાગો તેમજ કાઉન્ટરોમાં વહેંચાયેલા હોય છે.



ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ

છૂટક રેપાર

૩. દરેક વિભાગમાં વિશિષ્ટ પ્રકારની ચીજો વેચાય છે. દા. ત. એક વિભાગ વિજાણું સાધનો વેચતા હોય તો બીજામાં રેડીમેઇડ ગારમેન્ટ્સ તો વળી ત્રીજામાં ખાદ્ય સામગ્રી વેચાતી હોય છે.
૪. બધા વિભાગોનું વ્યવસ્થાપન અને નિયંત્રણ એક જ સ્થળે કેન્દ્રીત હોય છે.
૫. ખાતાવાળી દુકાનો ગ્રાહકોને ખરીદી કરવામાં આનંદ થાય તેનું ધ્યાન રાખતા હોય છે. તે ગ્રાહકોને બધી જ જરૂરી વસ્તુઓ એક જ સ્થળે એક જ છત નીચે ખરીદવાની સગવડ આપે છે.
૬. ખાતાવાળી દુકાનમાં જ ગ્રાહકો માટે નાસ્તા – જમવાની સુવિધા, આરામગૃહ, ટેલિફોન, ATM વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
૭. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદવાની સગવડતા પણ આપે છે.
૮. ખાતાવાળી દુકાનો વધુ ખરીદી કરતા નિયમિત પ્રતિષ્ઠિત ગ્રાહકોને ફી હોમ ડિલિવરીની સુવિધા પણ આપે છે.

ખાતાવાળી દુકાનના ફાયદા:-

ખાતાવાળી દુકાનના ફાયદા નીચે મુજબ છે.

૧. **ખરીદીની વિવિધાં સુવિધાઓ:-** – એક જ છત નીચે અનેક પ્રકારની જીવન ઉપયોગી વસ્તુઓ મળતી હોય તથે. તમારે તમારી વસ્તુઓ ખરીદવા માટે બજારે બજારે કે દુકાને દુકાને ફરવું પડતું નથી. આથી તમારા કિમતી સમય અને શક્તિનો બચાવ થાય છે. વળી, ગ્રાહકોની સગવડ માટે જ ભંડારની અંદર જ ચા – નાસ્તાની સુવિધા, ઢંડા પાણીની વ્યવસ્થા, આરામ ગૃહની વ્યવસ્થા, શૌચાલયો, એ.ટી.ઓમ વગેરેની સુવિધા આપવામાં આવે છે.
૨. **ઉત્પાદનોની વિશાળ પસંદગીની તક:-** – ખાતાવાળી દુકાનોમાં જુદા જુદા ઉત્પાદકોની વિવિધ વસ્તુઓની એક મોટી શૈશ્વી હોય છે. ગ્રાહક આ વિવિધ વસ્તુઓમાંથી પોતાને ગમતી અને પરવડતી ઉત્તમ વસ્તુ ખરીદી શકે છે.
૩. **મોટા પાયે ખરીદ – વેચાણના લાભો:-** – ખાતાવાળી દુકાનનાં સંચાલકો વિશાળ જથ્થામાં સીધા ઉત્પાદકો પાસેથી જ વસ્તુઓ ખરીદે છે. જેથી મધ્યસ્થિતિઓના કખીશાન કે નક્ષા પર કાપ આવે છે. આથી ખરીદ કિમત ખુબ જ નીચી આવે છે અને જેનો લભમ તે સીધા ગ્રાહકોને નીચા ભાવે વસ્તુનું વેચાત કરે છે. તેમજ વેચાણનું પ્રમાણ વધુ હોવાથી વહિવટીય ખર્ચ પણ નીચો આવે છે.
૪. **કેન્દ્રીત જાહેરાત ખર્ચ:-** – ખાતાવાળી દુકાનોમાં જુદા જુદા કિમાગોમાં અનેક વસ્તુઓ વેચાણ માટે પ્રદર્શનમાં મુકેલ હોય છે. અને સુંદર રીતે તેની જાહેરાત કરતા હોય છે. ગ્રાહક આવી જાહેરાત ઓ પ્રદર્શન જોઈને અમુક વસ્તુઓ ખરીદવા

મોડયુલ - ૪
ખરીદ – વેચાણ અને
વિતરણ



નોંધ



પોતાના મન પર અંકુશ મુકી શકતો નથી. અને ઘણી બધી વસ્તુઓ જાહેરાથી ખરીદી લે છે. આમ જાહેરાતોના લાભથી વેચાણ વધે છે.

૫. **કુશળ વ્યવસ્થાપન:**— ખાતાવાળી દુકાનોમાં અનેક વસ્તુઓનું વેચાણ અને ગ્રાહકોના મુલાકાણથી તેનું સંચાલન કાર્યદક્ષ અનિવાર્ય છે. આથી નિષ્ણાત સેલ્સમેનો અને સંચાલકોને રોકી તેમની સેવાનો લાભ ખાતાવાળી દુકાનના વિકાસમાં અને ગ્રાહકોને બન્નેને મળી શકે છે.

ખાતાવાળી દુકાનના આટલા લાભ હોવા છતાં પણ તેનાં કેટલાક ગેરલાભ પણ છે. ચાલો આપણો તેની પણ નોંધ લઈએ.

ખાતાવાળી દુકાનોની મર્યાદાઓ:-

- વિશાળ મુડી રોકાણ:**— ખાતાવાળી દુકાનોનું કદ વિશાળ હોય છે. વળી તેવા સ્ટોર્સને શહેરના સમૃદ્ધ અને મુખ્ય વિસ્તારમાં સ્થાપવી પડે છે. આથી ભારે મુડી રોકાણની જરૂર પડે છે.
- રહેઠાણના સ્થળેથી દૂર:**— સામાન્ય રીતે ખાતાવાળી દુકાનો રહેઠાણના સ્થળેથી શહેરના બજારના મુખ્ય ભાગમાં આવેલી હોય છે. તેથી ઘણા ગ્રાહકો થોડી વસ્તુ ખરીદવા દૂર સુધી જઈ શકતા નથી અને રોજ બરોજની વસ્તુઓ માત્ર નજીકની દુકાનેથી જ ખરીદી લેતા હોય છે.
- વિશાળ સંચાલકીય ખર્ચ:**— આ ઉપરાંત ફર્નિચર થી માંડીને, કાર્યદક્ષી મોટા પ્રમાણમાં સ્ટાફ, વિશાળ પ્રમાણમાં વસ્તુઓની ગોઠવણી, પ્રદર્શન, જાહેરાત, પેકિંગ, રોશની ટુંકમાં તેને સતત કાર્યરત રાખવા કાર્યશીલ મુડીની પણ ભારે જરૂર પડે છે. જેણો ખર્ચ ક્યારેક ગ્રાહક પર નાખવામાં આવે છે.
- ઉચ્ચ વેચાણ કિંમત:**— વિશાળ મુડી રોકાણ, વિશાળ કાર્યશીલ મુડી વગેરેને કારણે વેચાણ કિંમત અન્ય સ્ટોર્સ કરતા વધુ હોવાથી ગ્રાહકો પૂનઃ મુલાકાત લેવાનું થાણે છે.
- ગ્રાહકોના વ્યક્તિગત ધ્યાનનો અભાવ:**— ખાતાવાળી દુકાનોનું વિશાળ કદ અને મોટા પ્રમાણમાં ગ્રાહકો હોવાથી માલિક અને ગ્રાહકો વચ્ચે પ્રત્યક્ષ અંકુશ રાખી શકાનો નથી. રોકેલા કર્મચારીઓ જ ગ્રાહકો સાથે વ્યવહાર કરતા હોય છે. માલિકો પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના ગ્રાહકોની રૂચિ અને પસંદગી, ગમા — અણગમા વિશેની માહિતી મેળવી શકતા નથી.



૧૪.૩ પાઠગત પ્રશ્નો

ખાતાવાળી દુકાનના સંબંધમાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.

છૂટક વેપાર

- ખાતાવાળી દુકાન એ એક છૂટક દુકાન છે જ્યાં એક જ મકાનમાં જુદા જુદા વિભાગો / કાઉન્ટરો ઉપર વિવિધ વસ્તુઓ વેચવામાં આવે છે.
- ગ્રાહકોને સારી સુવિધાઓ આપવાને કારણે ઈલેક્ટ્રોનીક વસ્તુઓનો વિભાગ, તૈયાર કપડાઓનો વિભાગ, અનાજ – કરિયાળાનો વિભાગ પાડીને નિયંત્રણ રાખવામાં આવે છે.
- માલિકો અને ગ્રાહકો વચ્ચે જુદા જુદા વિભાગો દ્વારા પ્રત્યક્ષ હોય છે.
- વેચાણ માટે પ્રાય વસ્તુ ઉપરાંત ખાતાવાળી દુકાનો ગ્રાહકોને વધારે સેવાઓ પૂરી પાડે છે.
- ગ્રાહકોના વિશ્લેષણ સંખ્યાને લાભાર્થી આવી દુકાનો રહેઠાણના વિસ્તારોમાં સાનુકૂળ રીતે સ્થપાયેલ હોય છે.
- ખાતાવાળી દુકાનો ગ્રાહકોને ઉચ્ચી કિમતે વસ્તુઓ પૂરી પાડે છે. કારણ કે સ્ટોરના નિભાવ અને સંચાલન માટે વધુ ખર્ચ થતો હોય છે. તેમજ તેઓ ગ્રાહકોને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતા હોય છે.

મોડયુલ – ૪
ખરીદ – વેચાણ અને
વિતરણ



નોંધ

૧૪.૫ સુપર બજાર (અપના બજાર)

સુપર બજાર એક અન્ય પ્રકારની મોટા પાયે છૂટક વેપાર કરતું સંગઠન છે. સુપર બજારમાં ઘર વપરાશની રોજ બરોજની ચીજ વસ્તુઓ એક જ સમયે અને સ્થળોથી ખરીદી શકીએ છીએ. અઠવાડિયા કે મહિનાની જરૂરિયાત એક સાથે ખરીદી શકીએ છીએ.



સુપર બજારનું ચિત્ર

સુપર બજારનો અર્થ:-

સુપર બજાર એક મોટા પાયે ચાલતો ગ્રાહક સહકારી ભંડાર છે. ત્યાં અનાજ, કીરયાણું, ખાદ્ય સામગ્રી, ફળ–ફળાઈ, શાકભાજી તેમજ ટકાઉ અને ઘર ઉપયોગી ટકાઉ વસ્તુઓ એક જ દુકાનની છત નીચેથી ખરીદી શકીએ છીએ. અપના બજાર ગ્રાહકોના સંગઠનથી જ બનેલ છે. તેમના વતી સંચાલકો સીધા જ ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં નીચા ભાવે વસ્તુઓનું ખરીદી કરીને પોતાના સભ્યો ઉપરાંત આમ જનતાને પણ માલનું વેચાણ



કરે છે. આથી દુકાનોનો મુખ્ય આશય મધ્યરથી – દલાલોને મુક્ત કરીને સત્તા ભાવે ચીજ વસ્તુનું વેચાણ કરવાનો છે.

સુપર બજારની વિશેષતાઓ:-

સુપર બજારની વિશેષતાઓ નીચે પ્રમાણે છે.

૧. આ ભંડારો સહકારી મંડળીના સ્વરૂપે સ્થાપવામાં આવે છે.
૨. આ ભંડારો બજારના કેન્દ્રસ્થાને સ્થાપવામાં આવેલા હોય છે. અને તેઓ રહેઠાણના વિસ્તારમાં વસ્તુઓ વેચવા માટે પોતાની શાખાઓ પણ ખોલે છે. કેટલીક સુપર માર્કેટના સંચાલકો ગ્રાહકોની સોસાયટીના સ્થળે માલ વેચવા હરતી ફરતી વાન પણ રાખે છે.
૩. તેમાં ફક્ત પ્રમાણભૂત (ઉતામ) ગુણવત્તાવાળી વસ્તુઓ જ વેચાય છે.
૪. કેટલીક વાર આવા સહકારી ભંડારો સ્વયં-સેવાના આધારે પણ ચલાવવામાં આવે છે. જેમાં તમારી જરૂરિયાતની વસ્તુઓ દુકાનમાં પ્રદર્શિત કરેલી વસ્તુઓમાંથી જાતે પસંદ કરી અને બાસ્કેટ કે ટ્રોલીમાં લઈને કાઉન્ટર પર જાતે જ રજૂ કરવાની હોય છે. અને તેનું બિલ પણ કાઉન્ટર પરના માણસે બનાવી તમારી પાસેથી જરૂરી રકમ વસુલ કરે છે. આ કાર્ય માટે તમને ખડે પગે સેલ્સમેન મદદ કરે છે.
૫. આ સહકારી ભંડારની દુકાનનું સંચાલન ગ્રાહક સભ્યમાંથી ચુંટાયેલા સભ્યો દ્વારા જ કરવામાં આવે છે.
૬. સુપર બજાર સીધા જ ઉત્પાદકો કે સરકારી કે સહકારી એકમો પાસેથી જથ્થાબંધ માલ ખરીદે છે. અને ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે.
૭. સુપર બજારમાં વસ્તુઓ માત્ર રોકડેથી જ વેચાય છે.
૮. સહકારી ભંડારના (મંડળીના) સભ્યો સુપર બજાર સ્થાપવા અને ચલાવવા માટે ભંડોળ પૂર્ણ પાડે છે.

સુપર બજારના લાભો:-

ચાલો આપણે સુપર બજારના લાભો જોઈએ.

૧. **વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ:-** સુપર બજારમાં રોજ બરોજની ઘર વપરાશની વસ્તુઓની એક વિશાળ વૈવિધ્યપૂર્ણ શ્રેણી જોવા મળે છે.
૨. **ગુણવત્તાવાળી વસ્તુઓ:-** તે ગ્રાહકોને ઉતામ પ્રકારની વસ્તુઓ પૂરી પાડે છે. તેમાં ભેણ સેળ કે નકલી માલનો સંભવ રહેતો નથી.

છૂટક વેપાર

૩. ઓછી કિંમત:- મોટા પાયે ખરીદી અને મધ્યસ્થીઓને બાકાત કરવાના લાભોના કારણે સુપર માર્કેટમાં બજારમાં વસ્તુઓ પ્રમાણમાં ઓછા ભાવે મળે છે.
૪. ઓછો સંચાલન ખર્ચ:- સુપર બજારમાં સામાન્ય રીતે સેલ્સમેન કે સહાયકની સેવાઓ મળતી નથી. તેથી સંચાલન ખર્ચ ઘટે છે.
૫. સભ્યોને લાભ:- મંડળીના સભ્યોને વસ્તુઓ કિંફાયતી ભાવે મળે છે. અને વર્ષ દરમિયાન જે મંડળીને નફો થાય તેમાં સભ્યોને શેરના પ્રમાણમાં ડિવિડન્ડ સ્વરૂપે આવક પણ મળે છે.
૬. પસંદગીની આજાઈ (સ્વાપ્તતા):- ગ્રાહકોને એક જ સ્થળે વિવિધ ખ્રાન્ડ - માર્કની વસ્તુઓ મળે છે. તેથી તેમને માટે પસંદગી કરવાનું સરળ બની જાય છે. પ્રદર્શિત કરેલી વસ્તુમાંથી તમે જાતે મન પસંદ વસ્તુ ખરીદી શકો છો.
૭. સરકારી અંકુશ:- ભારતમાં મોટે ભાગે સુપર બજારો કેન્દ્રલ અનુ રાજ્ય સરકારના નિયંત્રણમાં હોય છે. આશી ભાવો કાબુમાં રાખવામાં મદદ મળે છે. અને માલની કૃત્રિમ તંગી ઉલ્લી કરવાની શક્યતા પણ ઘટી જાય છે.

સુપર બજારની મર્યાદાઓ:-

ઉપર જણાવેલા લાભો ઉપરાંત સુપર બજારની કેટલીક મર્યાદાઓ પણ છે.

૧. ભારે મુડી રોકાણ:- સુપર બજાર શરૂ કરવા અને ચલાવવા બહુ મોટી મુડીની જરૂર પડે છે.
૨. કુશળ વ્યવસ્થાપનનો અભાવ:- મુડીની અધિતને કારણે કુશળ વ્યવસ્થાપક કે સેલ્સમેન રાખી શકતા નથી.
૩. ઉધારની સગવડતાનો અભાવ:- ગ્રાહકોને માલ રોકડેથી જ વેચવામાં આવતો હોઈ ઉધારની સગવડ આપવામાં આવતી નથી.

૧૪.૫ ખાતાવણી દુકાન અને સુપર બજાર વચ્ચે તફાવતો

મુદ્દાઓ	ખાતાવણી દુકાન	સુપર બજાર
૧. માલિકી નિયંત્રણ	આ દુકાનોની માલિકી અને સંચાલન ખાનગી કોન્ટ્રનું હોય છે.	આ ભંડારની માલિકી અને સંચાલન સહકારી મંડળીઓનું હોય છે.
૨. સગવડો	રેસ્ટોરન્ટ, ટિકિટ બુકિંગ, વિશ્રામગૃહ, ટેલિફોન, શૌચાલય વગેરે સગવડો ગ્રાહકો માટે હોય છે.	ગ્રાહકો માટે આવી કોઈ સગવડો હોતી નથી.



મોડ્યુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

ઇંગ્રેડ વેપાર

૩. વસ્તુના ભાવો	માલ સામાનના ભાવે સામાન્ય રીતે બજાર ભાવ કરતા ઉચા - વધુ હોય છે.	ખાતાવાળી દુકાનની સારખામણીમાં વસ્તુના ભાવે સામાન્ય રીતે ઓછા હોય છે.
૪. ઉધારની સગવડ	સંજોગોવસાત્ પ્રતિષ્ઠિત ગ્રાહકોને ક્યારેક શાખાની - ઉધારની સુવિધા મળે છે.	હંમેશા રોકડેથી જ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે.



૧૪.૩ પાઠગત પ્રશ્નો

૧. સુપર બજારના સંબંધમાં નીચેના વિધાનો 'ખરા' છે કે 'ખોટા' તે દર્શાવો.
 ૧. ખાતાવાળી દુકાનની જેમ જ સુપર બજારમાં પણ વિવિધ વસ્તુઓ એક જ છત નીચે વેચવામાં આવે છે.
 ૨. તેઓનું સંચાલન સહકારી મંડળી માફંક થાય છે. તેમાં સભ્યો મુડી રોકે છે.
 ૩. સહકારી મંડળીના સભ્યોની સગવડ ખાતર માલ ઉધાર વેચવામાં આવે છે.
 ૪. સુપર બજારને પ્રશિક્ષિત પ્રબંધક રાખવાનું પરવડે નહીં. તેથી તેની સંચાલન પ્રક્રિયાઓમાં ખામી રહે છે.
 ૫. સસ્તા ભાવે વસ્તુ વેચવા માટે સુપર બજાર હલકી જાતની વસ્તુ વેચે છે.
૨. નીચેના વિધારો ક્યા પ્રકારના મોટા પાયાના છૂટકે વેપારને દર્શાવે છે તે કહો.
 ૧. જુદા જુદા વિસ્તારોમાં ખોલેલી જુદી જુદી દુકાનોમાં માલનું વેચાણ થાય છે.
 ૨. અન્ય સ્થળે બજારભાવ હોય તેના કરતા સામાન્ય રીતે ઉચા ભાવે વસ્તુ વેચાય છે.
 ૩. આ સ્ટોર્સ મોટે ભાગે ગ્રાહકોના સહકારના જૂથથી બનેલ હોય છે.
 ૪. વેચાણ માટેની વસ્તુઓ ઉપરાંત ગ્રાહકોને બીજી ઘણી સુવિધાઓ અપાય છે.
 ૫. ગ્રાહકોને એક જ પ્રકારનો માલ વેચવામાં આવે છે.

છૂટક વેપાર

૩. મોટા પાયે છૂટક વેચાણના સંબંધમાં નીચેના વાક્યોમાં કૌસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

૧. સામાન્ય રીતે જથ્થાબંધ વસ્તુઓ ગ્રાહકોને વેચવા માટે
પાસેથી ખરીદવામાં આવે છે.
(નિર્માતાઓ, વચેટિયાઓ)
૨. ઉપભોક્તાને બધી વસ્તુઓ મોટે ભાગે ઉપલબ્ધ
કરાવવામાં આવે છે.
(એક જ છાપરા નીચે, જુદી જુદી દુકાનોમાં)
૩. તે ગ્રાહકોની સંખ્યાને સામાન વેચે છે.
(મર્યાદિત, વિશ્લાળ)
૪. ગ્રાહકોને સામાન વેચવામાં આવે છે.
(રોકડેથી, ઉધાર)
૫. મોટા પાયા ઉપર છૂટક વેચાણમાં જરૂરી મુડી રોકાણની રકમ સ્થાનિક
છૂટક દુકાનોના મુડી રોકાણ હોય છે.
(ના જેટલી, કરતાં ઘણી વધારે)

૧૪.૭ બહુ સંખ્યક દુકાનો

આગળના વિભાગમાં આપણે વિભાગીય ભંડાર વિષે જાણ્યું કે સંપૂર્ણ વેપાર એક જ વિશ્લાળ દુકાનોની શૃંખલાની છત નીચે ચાલે છે. અને ગ્રાહકો ત્યાં આકર્ષાય છે. હવે આપણે બહુ સંખ્યક દુકાનો વિષે વાંચીશું. જેમાં ગ્રાહકોની નજીક દુકાનો સ્થાપીને મોટા મોટા નિર્માતાઓ ગ્રાહકો સુધી પહોંચે છે.



બહુ સંખ્યક દુકાનોનું ચિત્ર

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



તમે ક્યારેય એ જોયું છે કે તમારા શહેર/નગરમાં કેટલીક ઇંગ્રેડિયન્ટ્સ દુકાનો આલારી હોય છે? તેમનાં નામ, ડિઝાઇન અને સજાવટ એક સરખાં જ હોય છે. અને એક જ બ્રાન્ડ (માકા)ની એક પ્રકારની વસ્તુઓ વેચે છે. તમે કહેશો ‘હા’ . બાટાના શો રૂમ, નોકીઆ મોબાઇલનો શો રૂમ, યુ.એસ. પીઝા, મેક ડેનાલ્ફની રેસ્ટોરન્ટ વગેરે.

આ બધી બહુ વિકલ્પીય દુકાનો છે. તેઓ તેમની તમામ દુકાનોમાં એક પ્રકારનો સામાન એક સરખી કિંમતે વેચે છે. આ દુકાનો મોટા ભાગે ઉત્પાદકો/નિર્માતાઓની માલિકીની હોય છે. અને તેઓ જ ચલાવતા હોય છે. તેઓ કોઈ શહેરમાં વિભિન્ન સ્થળોએ પોતાની શાખાઓ ખોલે છે. અથવા દેશના જુદા જુદા શહેરો કે નગરોમાં શાખાઓ ખોલે છે. આ દુકાનોને ‘સંકલિત દુકાનો’ પણ કહે છે.

બહુ સંખ્યક દુકાનોની વિશેષતાઓ:-

આ પ્રકારની ઇંગ્રેડિયન્ટ્સ દુકાની સંકલ્પના વધારે સ્પષ્ટ કરવા માટે ચાલો આપણે બહુ સંખ્યક દુકાનો વિષે વધારે જાણીએ.

1. એક જ વ્યવસ્થાપન અને એક જ માલિકી નીચે આ દુકાનો ગ્રાહકોની નજીક ચલાવવામાં આવે છે.
2. ગ્રાહકો ઓળખી શકે તે માટે દરેક શહેરની બધી જ દુકાનો એક જ રીતે સજાવવામાં આવે છે.
3. બહુ સંખ્યક દુકાનો એક જ સરખા પ્રકારની વસ્તુઓ વેચે છે. મોટે ભાગે રોજ બરોજની ઉપયોગી વસ્તુઓ જેમ કે જોડા, કાપડ, પીઝા, કેક, મોબાઇલ, ઘડિયાળ, બાઈક, કાર, આઈસ્ક્રીમ વગેરે.
4. બધી દુકાનોમાં એક જ સરખી કિંમત હોય છે. મુખ્ય કાર્યાલય દ્વારા ભાવો નક્કી થાય છે. આમ હોવાથી આમાં ભાવતાલ કરવા કે છેતરપીડીને અવકાશ રહેતો નથી.
5. બધી બહુ સંખ્યક દુકાનોનું નિયંત્રણ અને વ્યવસ્થાપન મુખ્ય કાર્યાલયથી થાય છે.
6. બધી બહુ સંખ્યક દુકાનો બધી વસ્તુઓ રોકડેશી વેચે છે. ગ્રાહકોને ઉધારની સગવડ આપવામાં આવતી નથી.
7. બધી વસ્તુઓ મધ્યસ્થ સ્થળોથી ખરીદવામાં અથવા ઉત્પન્ન કરવામાં આવે છે અને પછી જુદી જુદી શાખાઓમાં વેચવા મોકલે છે.

સંકલિત દુકાનોના લાભ:-

બહુ સંખ્યક (સંકલિત) દુકાનો ગ્રાહકોને કે અન્ય વેપારીઓને નીચેના લાભ આપે છે. ચાલો આપણે એ વિશે જાણીએ.

છૂટક વેપાર

- સરળ ઓળખ:-** દરેક સંકલિત દુકાનનું બાંધકામ એક સરખુ હોય છે. તે દુક્કિમદુક્કોનોસુંગ્રંઝસાનેપોશેજોવટ એક સમાન હોય છે. આનાથી ગ્રાહકને દલાલો / મધ્યસ્થીઓની ગેરહાજરી:- સંકલિત દુકાનો મોટાભાગે મોટા સફળ ઉદ્યોગપતિની માલિકીની હોય છે. અને તેમાં જે જાતે જ ઉત્પાદન કરે છે. તે જ વસ્તુનું વેચાણ કરે છે. આથી મધ્યસ્થીઓ જેવા કે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી હોતા નથી.
- મોટા પાયાના લાભો:-** સંકલિત દુકાનોની શ્રેષ્ઠી ખુબ વિશાળ હોય છે. એટલે મોટા પાયા પર ઉત્પાદન કરીને મોટા પાયા પર વેચાણ કરે છે. પરિણામે પડતર ખુબ નીચી આવે છે. બધી જ દુકાનોની ખરીદી એક જ જગ્યાએથી થતી હોવાથી તેમ જ જાહેરાત પણ બધી દુકાનો વતી એક જ સ્થળેથી થતી હોવાથી ખર્ચમાં કાપ મૂકી શકાય છે.
- ઓછી કિંમત:-** મોટા પાયા પરના લાભ મળતા હોવાથી સસ્તા ભાવે વસ્તુઓ ગ્રાહકને મળે છે. કારણ કે સંચાલન ખર્ચ ઓછો આવે છે. મધ્યસ્થીઓ, દલાલોનું કમીશન હોતું નથી.
- રોકડમાં વેચાણ:-** સંકલિત દુકાનોમાં હંમેશા રોકડ જ વેચાણ કરવામાં આવે છે. પરિણામે ઘાલખાદ કે ઉધાર વેચાણ કે ઉધરાણીનો પ્રશ્ન હોતો નથી.
- ગ્રાહકોનો વિશ્વાસ:-** દરેક સંકલિત દુકાનોમાં સરખી જ ગુણવત્તાવાળી સરખા જ ભાવવાળી વસ્તુઓ મળતી હોવાથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી શકાય છે.
- સુવિધાપૂર્ણ સ્થળ:-** આવી દુકાનો શહેરના મધ્ય કે મુખ્ય બજારમાં કે ધર્મધરમતા શોપીંગ સેન્ટરોમાં આવેલા હોવાથી ગ્રાહકો સહેલાઈથી પોતાની જરૂરિયાતોની વસ્તુઓ ખરીદી શકે છે.

સંકલિત દુકાનોની મર્યાદાઓ:-

ઉપરના તમામ લાભો મળતા હોવા છતાં બહુ સંખ્યક દુકાનોને કેટલીક મર્યાદાઓ નરે છે.

- મર્યાદિત પસંદગી:-** આવીદુકાનો ઉત્પાદનોની મર્યાદિત જાતનો જ વેપાર કરે છે. એથી આ દુકાનોમાં પ્રાપ્ય અમૃક માર્કની વસ્તુઓ પૂરતી જ ગ્રાહકોની પસંદગી મર્યાદિત બને છે.
- ઉધારની સુવિધાનો અભાવ:-** આવી દુકાનોમાં બધું જ વેચાણ રોકડેથી થતું હોવાથી ગ્રાહકોને ઉધારની શાખ પરની સુવિધાઓ મળતી હોતી નથી.
- ભાવતાલનો અભાવ:-** સંકલિત દુકાનોના વડા મથકેથી વસ્તુઓના ભાવ નક્કી થતા હોય છે. જે ચોક્કસ પણે ચુકવવા પડે. જેથી ગ્રાહક વસ્તુ ખરીદતી વખતે વેચાણ કરનાર સાથે ભાવતાલ કરાવી શકતો નથી.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



૪. **ઉત્સાહનો અભાવ:-** આ દુકાનોનું સંચાલન પગારદાર મેનેજરો અને કર્મચારીઓ દ્વારા થતું હોય તેમને મુખ્ય મથકની સુચનાઓનું કડક પાલન કરવું પડે છે. તેમના પગાર પણ નિશ્ચિત હોય છે. આશી દુકાનોનું વેચાણ વધારવા કે ગ્રાહકને સંતોષ આપવાનો ઉત્સાહ હોતો નથી.



૧૪.૫ પાઠગત પ્રશ્નો

સંકલિત દુકાનોના સંદર્ભમાં નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. જે વિવિધ દુકાનો જે એક જ પ્રકારના ઉત્પાદનો ભાવે વેચે છે અને મોટે ભાગે ઉત્પાદકો જ ચલાવતા હોય છે. તેને બહુ સંખ્યક દુકાનો કહે છે.
૨. સહેલાઈથી ઓળખાય તે માટે એક જ નિર્માતાની બધી સંકલિત દુકાનોમાં એક સરખું પ્રદર્શન અને હોય છે.
૩. બધું વેચાણ રોકડેથી થતું હોઈને નું જોખમ હોતું નથી.
૪. બહિસ્કારના કારણે વસ્તુ ગ્રાહકોને ઓછા ભાવે મળે છે.
૫. સંકલિત દુકાનોનું સંચાલન દ્વારા થતું હોય છે. તેથી મેનેજર અને કર્મચારીઓનો ઉત્સાહ ઓછો જોવાય છે.
૬. આવી દુકાનોમાં ઉત્તમ ગુણવત્તાવાળી અસલી ચીજો મળે છે. તેથી જનતાને આ ઉત્પાદનોમાં ઉત્પન્ન થાય છે.
૭. આવી દુકાનોમાં પ્રકારનાં ઉત્પાદનો ગ્રાહકોને પૂર્ણ પાડી શકાય છે.
૮. આ દુકાનો મુખ્ય બજારમાં અને વ્યસ્ત શોર્પીંગ સેન્ટરમાં આવેલ હોઈ સ્થળ ની પૂરી પાડી શકાય છે.

ખાતાવાળી દુકાન અને વૈવિધ્ય સભર (બહુ સંખ્ય) દુકાનોમાં તફાવત:-

તમે ખાતાવાળી દુકાનો અને વૈવિધ્ય સભર દુકાનોનાં બે અલગ અલગ મોટા પાયાના ઇંગ્રેડ વેપારનાં સંગઠનો તરીકે અભ્યાસ કર્યો. હવે તમે આ બંને પ્રકારો વચ્ચેનો તફાવત જણાવી શકશો અને તેને આ પાઠના અંતે આપેલા જવાબો સાથે સરખાવી શકશો.

ખાતાવાળી દુકાનો અને વૈવિધ્ય સભર દુકાનોના મુણભૂત આધાર.

૧. **સ્થાન:-** આ બંને પ્રકારના સ્ટોર્સ જ્યાં ગ્રાહકોની ભરપૂર અવર જવર થતી હોય તેવા બજારના મધ્યસ્થ ભાગમાં હોય છે.

છૂટક વેપાર

૨. **સજાવટ:**— પ્રત્યેક દુકાનોની બાહ્ય અને આંતરિક સજાવટ એક સમાન હોય છે. દરેક દુકાનોનો દેખાવ અને સજાવટ મુખ્ય મથકેથી નક્કી થાય છે.
૩. **વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ:**— મર્યાદિત ઉત્પાદકોની ઉત્પાદિત વિશાળ શ્રેષ્ઠીનું છૂટક વિતરણ કરવામાં આવે છે.
૪. **વસ્તુઓની કિંમત:**— આવી તમામ દુકાનોમાં કિંમત સામાન્ય રીતે વધુ હોય છે. અને એક સમાન હોય છે.
૫. શાખ પર વેચાણની સુવિધાઓ ઉપલબ્ધ નથી.

મોડયુલ – ૪
ખરીદ – વેચાણ અને
વિતરણ



નોંધ

૧૪.૮ મોલ્સ

આધુનિક છૂટક વેચાણનું વિતરણ ધરાવતું સ્વરૂપ એ મોલ છે. અહિયા ગ્રાહકો માત્ર પોતાની જીવજરૂરિયાત કે ભૌતિક સુખસગવડના સાધનો નો ખરીદે છે પરંતુ આનંદ પ્રમોદન અને મનોરંજન માટેના કેન્દ્રો પણ હોય છે. યુવાન કે યુવતી તેમનો સમય ત્યાં પસાર કરે છે. અહિ અનેક હેતુઓ માટે લોકો એકનીત થાય છે. અને આવા વિશાળ મોલ્સના સાંનિધ્યમાં લગ્ન માટેના ભોજન સમારંભ, બર્થ ડે ઉજવણીની પાર્ટીઓ પણ રાખવામાં આવે છે. આ એક સ્થળ એવું છે કે અનેક ઉત્પાદકોની અનેક વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે.



મોલનું ચિત્ર

મોલ્સ ખરેખર અનેક દુકાનોના બંધાયેલા

હોય છે. જેમાં અનેક ઉત્પાદકોના ઉત્પાદનો વેચાણ કરવામાં આવે છે. મોલ્સના સંચાલકો પાસે વિશિષ્ટ વેચાણ કરવાનો અનુભબ હોય છે. મોલ્સમાં ખરીદી કરવાનો એક જુદો જ માહોલ – વ્યવસ્થા હોય છે. મોલ્સ આ દિવસોમાં અત્યંત આધુનિક સાધનો અને સુવિધાઓથી સજજ હોય છે. મોલ્સનું બાંધકામ અને સજાવટ કલાત્મક હોય છે. વિશાળ જગ્યા ધરાવતી અનેક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરતી દુકાનો હોય છે. જેમાં બ્રાન્ડેડ, વિશ્વ વિભ્યાત વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. ફેશનેબલ બ્રાન્ડેડ કપડા, કોકરી, રમકડા, ઈલોક્ટ્રનિક વસ્તુઓ અને ઉત્પદકોની કોઈ પણ વસ્તુના વેચાણ યોજના માયે સફળ પૂરવાર થયેલ છે. સાથે સાથે વેચાણ વૃદ્ધ માટેનું સૌથી સફળ માધ્યમ પૂરવાર થયેલ છે. ગ્રાહકોને વસ્તુના વેચાણ ઉપરાંત અનેક આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડે છે.

૧૪.૯ આઉટલેટ્સ

આઉટલેટ્સ સ્ટોર્સ કે ફેક્ટરીની સાથે જ જોડાયેલ આઉટલેટ્સ ઉત્પાદકોની વસ્તુનું ઉત્પાદન સ્થળેથી જ ગ્રાહકોને સીધુ વેચાણ કરે છે. આ પદ્ધતિમાં સામાન્ય રીતે કારખાનાની સાથે

વાણિજ્ય વ્યવસ્થા

મોડ્યુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ

છૂટક વેપાર

છૂટક વેપાર માટે સ્ટોર બનાવવામાં આવે છે. ક્યારેક ગ્રાહકોને ઉત્પાદીત વસ્તુની ઉત્પાદન પ્રક્રિયા જોવા માટે છૂટ આપવામાં આવે છે. આધુનિક સમયમાં ફેક્ટરીના આઉટલેટ્સ દ્વારા જ બ્રાન્ડેડ વસ્તુનું વેચાણ થતા ગ્રાહકોમાં ગુણવત્તા અને કિંમતની બાબતમાં વિશ્વાસ બેસે છે. મધ્યસ્થી અને દલાલો વચ્ચે જ હોવાથી વિતરણ ખર્ચ ખુબ જ ઓછો આવે છે. જેનો લાભ ગ્રાહકોને મળે છે. આવા આઉટલેટ્સ મુલ્યવાન ગ્રાહકો માટે ઓરીજિનલ અને ગુણવત્તાસભર વસ્તુ ફેક્ટરીમાંથી ખરીદવાનો લાભ મળે છે.

૧૪.૧૦ દુકાન રહિત છૂટક વેચાણ

વિભાગીય ભંડાર, બહુ સંખ્યક દુકાનો અને સુપર બજાર કેવી રીતે અસંખ્ય ગ્રાહકોને વસ્તુઓ વેચે છે તે તમે જાણી ચૂક્યા છો. આ બધા પ્રકારના છૂટક વેચાણમાં તમારે બજારમાં દુકાનો પર જવું પડે છે. અને તમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદવી પડે છે. તેઓના વેપારના કલાકો (સમય) નિશ્ચિત હોય છે. અને તમારે આ સમય દરમિયાન જ વસ્તુ ખરીદવા જવું પડે છે. તમને કદી એવો વિચાર આવ્યો છે કે શા માટે વસ્તુઓ તમારી પસંદગી મુજબ આખા દિવસ દરમિયાન મળતી નથી? સવારે દુકાનદાર દ કે ૧૦ વાગ્યે આવીને દુકાન ઉઘાડે ત્યાં સુધી તમારે શા માટે રાહ જોવી? વળી તમને તમારી વસ્તુ ધેર બેઠા જ મળી જાય તેવું પણ ગમે.

હા, આજ કાલ પ્રૌધોગિકીમાં પ્રગતિ અને વધારે સારા સંચાર માધ્યમોને કારણે આમ બનવું શક્ય છે. જો તમે આ સુવિધાઓનો લાભ ઉઠાવવા માંગતા હો તો નીચેની છૂટક વેપાર પદ્ધતિઓ તમને સહાય કરી શકે.

૧. ટપાલ દ્વારા વેપાર
૨. ટેલિફોન દ્વારા ખરીદી
૩. સ્વયં સંચાલિત વેચાણ મશીન દ્વારા વેચાણ
૪. ઇન્ટરનેટ (પર) ખરીદી

૧. ટપાલ દ્વારા વેપાર

જો તમારે કોઈ ટકાઉ વસ્તુ ખરીદવી હોય તો તમારે દુકાને જ જવું પડે એવું જરૂરી નથી. જુઓ નીચેના ચિત્રોમાં શું થઈ રહ્યું છે.



છૂટક વેપાર



મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



ટપાલ દ્વારા ખરીદીનું ચિત્ર

છાપામાં આવેલી એક જાહેરાત એક વ્યક્તિનું ધ્યાન અમુક વસ્તુ તરફ ખેંચે છે. તે કુપન ભરીને વેચનારને મોકલી આપે છે. વેચનાર ઓર્ડર મેળવે છે. અને વસ્તુ પેક કરે છે. વેચનાર પોસ્ટ ઓફિસ દ્વારા વસ્તુ મોકલે છે. ખરીદનાર જરૂરી રકમ આપીને પોસ્ટમેન પાસેથી મેળવી લે છે.

આ ટપાલ દ્વારા વેચાણની પદ્ધતિ છે અને તેને ‘મેઈલ ઓર્ડર બિઝનેસ’ (ટપાલ દ્વારા વેપાર) તરીકે ઓળખવામાં આવે છે તેને ટપાલ દ્વારા ખરીદી પણ કહેવાય છે. આ વસ્તુ વેચવાની પદ્ધતિમાં વિનિર્માતા કે ઉત્પાદક ટપાલ દ્વારા વસ્તુ સીધેસીધી ગ્રાહકોને દેયે છે. વેપારી પાત્પાના ઉત્પાદનની જાહેરાત વર્તમાન પત્રો, મેગેજીનો, દૂરદર્શન, પુસ્તિકાઓ, સૂચિપત્રો વગેરે દ્વારા કરે છે. આ રીતે ગ્રાહકોને પોતાના ઉત્પાદનની જાણ કરે છે. જાહેરાતમાં માલની વિશેષતાઓનું વિગતવાર વર્ણન હોય છે. ગ્રાહક તે ખરીદવા લલચાય છે. આ જાહેરાતમાં ઓર્ડર ફોર્મ કે કુપન પણ હોઈ શકે છે. તેને ભરીને ગ્રાહકે ટપાલ દ્વારા ઓર્ડર માટે આપેલા સરનામા પર રવાના કરવાનું હોય છે. ઓર્ડર મેળવ્યા બાદ ટપાલ ઓર્ડર ગૃહ સામાનને સારી રીતે પેક કરે છે. એ તેની રકમનું વી.પી.પી. (વેલ્યુ પેએબલ પોસ્ટ = મૂલ્ય ચૂકવી મેળવાણી ટપાલ) કરીને પોસ્ટ દ્વારા સામાન મોકલે છે. પોસ્ટ ઓફિસ ગ્રાહકના ઘેર સામાન પહોંચાડે છે અને ખરીદનાર પાસેથી પૈસા વસુલ કરે છે. અને પછી વિકેતા કે માલ સામાન મોકલનારને પૈસા ચૂકવી દે છે.

ટપાલ દ્વારા વેપારની વિશેષતાઓ:-

૧. સમગ્ર પ્રક્રિયા ટપાલ દ્વારા થાય છે.
૨. ગ્રાહક અને વેપારીના રૂબરૂ સંપર્ક વિના ખરીદ – વેચાણ થાય છે.
૩. વેપારી વર્તમાન પત્રો, મેગેજીનો, પત્રો, સૂચિપત્રો વગેરે દ્વારા પોતાની વસ્તુનું વિગતવાર વર્ણન, પૈસા ચૂકવવાની પદ્ધતિ, વેચાણની શરતો વગેરેની જાહેરાત કરે છે.
૪. વેપારી ગ્રાહક પાસેથી ઓર્ડર ટપાલ દ્વારા મેળવે છે.
૫. વેપારી માલ સારી રીતે પેક કરીને વી.પી.પી. દ્વારા ગ્રાહકને મોકલે છે.
૬. વેપારી પૈસા ટપાલ કચેરીએથી મેળવે છે.



૭. આ પ્રક્રિયામાં કોઈ વચેટિયા હોતા નથી.

હવે તમે ટપાલ દ્વારા વસ્તુઓ ખરીદવાની પદ્ધતિનો કંઈક ખ્યાલ મેળવો હશે. તમને લાગે છે કે બધી જાતની વસ્તુઓ તમે ટપાલ દ્વારા ખરીદી શકો? ટપાલ દ્વારા કઈ વસ્તુ ખરીદવાનું સુગમ પડે તેનો વિચાર કરીએ.

ટપાલ દ્વારા વેપાર માટે સાનુક્કણ વસ્તુઓ:-

આવી જાતના વેપાર માટે નીચેના લક્ષણો ધરાવતી વસ્તુઓ સામાન્ય રીતે સુગમ પડે.

૧. હલકા વજનની અને ઓછી જગ્યા રોકે તેવી વસ્તુઓ, ભારે અને વજનદાર મોટી વસ્તુઓ આ રીતે વેચી શકાય નહીં.
૨. ટકાઉ અને જલ્દી નાશ ન પામે તેવી વસ્તુઓ.
૩. જેની બજારમાં જબરી માંગ હોય તેવી વસ્તુઓ.
૪. એવી વસ્તુઓ જેમને મોકલવાનો ખર્ચ તેમની કિંમત કરતા ઓછો હોય.
૫. એવી વસ્તુઓ જેને સહેલાઈથી હેન્ડલ કરી શકાય (હેરવી – ફેરવી શકાય)

ટપાલ દ્વારા વેપારના લાભ:-

આ પદ્ધતિમાં નીચેના લાભો છે.

૧. ગ્રાહક ઘેર બેઠા આરામથી વસ્તુ ખરીદી શકે છે. આનીથી તેનો સમય અને મહેનત બયે છે.
૨. ટપાલ દ્વારા વેપાર થોડીક મૂડીથી પણ ચાલુ કરી શકાય છે. કારણ કે આ વ્યાપારમાં ચીજ વસ્તુનો મોટો બંડાર રાખવાની જરૂર નથી.
૩. સામાન્ય રીતે આ વ્યાપારમાં ગ્રાહકોને એવી ખાતરી આપવામાં આવે છે કે જો તેમને માલથી સંતોષ ન થાય તો તેઓને તેમના પૈસા પાછા પરત આપવામાં આવશે. આનાથી ગ્રાહકોના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે.
૪. ટપાલ દ્વારા વેપાર સામાન્ય રીતે રોકડના ધોરણે થતો હોય છે. તેથી તેમાં પૈસા ડુબવાનું જોખમ રહેતું નથી.
૫. અસંખ્ય ગ્રાહકો સાથે તે વિશ્લેષણ માર્કેટની સુવિધા આપે છે.

ટપાલ દ્વારા વ્યાપારની મર્યાદાઓ:-

ટપાલ દ્વારા વેપારની મર્યાદાઓ નીચે મુજબ છે.

૧. ગ્રાહકોને ઉધારની સગવડતા મળતી નથી.

છૂટક વેપાર

૨. અણપદ લોકોને આવી રીતનો વેપાર માફક આવતો નથી.
૩. પૈસા ચૂકવ્યા પહેલાં ગ્રાહકને વસ્તુની ચકાસણી કરવાની તક મળતી નથી.
૪. ગ્રાહકનું રહેઠાણ ટપાલ સેવાથી જોડાયેલું હોવું જોઈએ.
૫. આ પદ્ધતિમાં વ્યાપક અને વિસ્તૃત જાહેરાતની જરૂર છે.

ટેલી શોપીંગ

આજકાલ વેપારમાં ટેલિફોન એક અનિવાર્ય સંચાર માધ્યમ બની ગયું છે. તમે જોયું હશે કે તમારા વિસ્તાર નજીક વેપારીઓ માલ સામાનની ખરીદીનો ઓર્ડર ટેલિફોન દ્વારા જ આપતા હોય છે. અને એજ રીતે ગ્રાહકો તરફથી પણ પોતાને દેર જણાસ પહોંચતી કરવાનો ઓર્ડર પણ મેળ વતા હોય છે. આવું તમારા વિસ્તારની એક નિશ્ચિત દુકાનમાં બની શકે. પણ ઘણા મોટા મોટા વ્યાપાર ગૃહોમાં તો તમામ પ્રકારની લેવડ-દેવડ ટેલિફોન ઉપર જ થાય છે. તેઓ સંભવિત ગ્રાહકોનો ટેલિફોન ઉપર જ સંપર્ક કરીને પોતાનો માલ લેવા આગ્રહ કરે છે. કયારેક તેઓ પોતાના ઉત્પાદનની જાહેરાત ટી.વી. કે અન્ય સમૂહ માધ્યમ દ્વારા કરતા હોય છે. તેઓ તેની વિશેષતાઓ સ્પષ્ટ રીતે જણાવે છે. એટલું



જ નહીં તેનું જીવંત નિદર્શન પણ કરે છે. ઉત્પાદનની કિંમત અને કોડ નંબર (જો હોય તો) અને વેપારીનો ટેલિફોન નંબર વગેરે પડદા ઉપર રજૂ થાય છે. ગ્રાહક તરીકે તમે ટેલિફોન નંબર ધૂમાવીને ઓર્ડર આપી શકો છો. તેઓને પૈસા મળી ગયા પછી તેઓ તમારી ઈચ્છા મુજબની વસ્તુઓનું વિતરણ કરી આપશે. આપણા દેશમાં ‘એશિયન સ્કાય શોપ’ અને ‘ટેલિબ્રાન્ડ’ આવા ટેલી શોપીંગના ઉદાહરણ છે. ચાલો આ પદ્ધતિના કયા ફયદા છે તે જોઈએ.

ટેલી શોપીંગના લાભો:-

૧. લેભિટ ઓર્ડરની સરખામણીમાં આમાં વસ્તુ ખરીદવામાં સમયાશક્તિ અને પૈસાનો બચાવ થાય છે.
૨. જે લોકો બહુ જ વયસ્ત રહેતા હોય અને ખરીદ કરવા માટે જેમની પાસે વધારે ફુરસદ ન હોય તેમને માટે આ એક સગવડ ભરી ખરીદીની પદ્ધતિ છે.
૩. વિતરણ પ્રક્રિયામાં વચેટિયાઓની દરમિયાનગીરી આમાં દૂર થાય છે.
૪. ખરીદ કરનાર વેપારીના સ્થાન પર રૂબરૂ ગયા વિના વેચાણની શરતો, ચૂકવણીની રીત, પેકિંગ વગેરે વિષેની માહિતી મેળવી શકે છે.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



ટેલી શોપીગની મર્યાદાઓ:-

ટેલી શોપીગની મર્યાદાઓ નીચે પ્રમાણે છે.

૧. ઓર્ડરો બધા ટેલિફોન ઉપર જ મળતા હોઈને લેવડ-દેવડને કોઈ લેખિત નોંધ હોતી નથી. આમ જો વેચાણની શરતોની બાબતમાં વિવાદ થાય તો તેની નિકાલ કરવાનું કામ મુશ્કેલ બને છે.
૨. વેચાણ માટે રજૂ થયેલી વસ્તુની ચકાસણી કરવાની કોઈ સગવડ હોતી નથી. તેમાં દગ્ગાબાજી અને અપ્રામાણિકતાનું જોખમ અપરિહાર્ય છે.
૩. વેપારી ગ્રાહકોને આકર્ષવા માટે પોતાના ઉત્પાદન વિષે ગેરમાર્ગ દોરનારી માહિતી આપી શકે છે.
૪. ગ્રાહકોને ઉધારની સગવડ મળતી નથી.

૩. સ્વયં-સંચાલિત વિકય મશીન દ્વારા વસ્તુનું વેચાણ

વસ્તુ વેચવાની એક અન્ય પદ્ધતિ છે સ્વયં સંચાલિત વિકય મશીન દ્વારા વેચાણ. તેનાથી ગ્રાહકોને ચોવીશેય કલાક (રાત-દિવસ ગમે ત્યારે) વસ્તુ ખરીદવાની સુવિધા મળે છે. આવા મશીનો સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ગીય શોપીગ કેન્દ્રો વગેરે જેવા અનુકૂળ સ્થળોએ ગોઠવવામાં આવે છે. સ્વયં સંચાલિત મશીન માં તમે સિક્કો કે ટોકન દાખલ કરીને તમે અમૃક વિશિષ્ટ વસ્તુ ખરીદી શકો છો. આ જૂટક વેપારની પદ્ધતિ વિદેશોમાં પ્રચલિત છે. તેના દ્વારા સંખ્યાબંધ ગ્રાહકોને ચોકલેટ, દૂધ, સૂપ, આઈસ્ક્રીમ, અખબાર વગેરે વેચવામાં આવે છે, ભારતમાં હજી આ પદ્ધતિ પ્રચલિત થઈ નથી.



૪. સ્વયં સંચાલિત વેચાણ મશીનના લાભ:-

૧. આ મશીન ચલાવવું (વાપરવું) બહુ જ સરળ છે. અભિષ્ણ વ્યક્તિ પણ તેને ચલાવી શકે.
૨. ખરીદનાર વિશિષ્ટ ગુણવત્તાયુક્ત વસ્તુ, સમાન વજનવાળી અને નિશ્ચિત કિંમતે મેળવી શકે છે.
૩. આમાં દુકાનદાર તરફથી થતા બગાડ કે દગાનું જોખમ રહેતું નથી.
૪. તે વેચનારનો સમય અને શક્તિ બચાવવામાં મદદ કરે છે.
૫. આમાં કોઈ જાહેરાતની જરૂર નથી.
૬. આમાં સંપૂર્ણ વેચાણ રોકડેથી થતું હોઈ ખરીદનાર દ્વારા પૈસા ન ચૂકવવાનો સંભવ રહેતો નથી.

છૂટક વેપાર

સ્વયં સંચાલિત મશીન ની મર્યાદાઓ:-

- આ મશીનનું પ્રારંભિક રોકાણ બહું મોટું હોય છે.
- મશીન નિયમિત મરામત અને નિભાવ માંગે છે.
- મશીનની સંગ્રહશક્તિ મર્યાદિત હોઈને તેને અવારનવાર ભરવું (લોડ કરવું) પડે.
- આ મશીનમાં નખાયેલા સિક્કા કે ટોકન વારંવાર કાઢી લેવા પડે.

ઇન્ટરનેટ શોપીંગ

ઇન્ટરનેટ શોપીંગ એ છૂટક વેપારની એવી પદ્ધતિ છે જેમાં ઇન્ટરનેટ દ્વારા વેપાર કરવામાં આવે છે. વિકેતા અગર વિનિર્માતા પોતાના ઉત્પાદનની તમામ વિગતો તેની ચોક્કસ જાણકારી, ઉપયોગ વગેરે પોતાની વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરે છે. ગ્રાહક તરીકે તમારે તમારા કોમ્પ્યુટર ઉપર વેબસાઈટ ખોલીને તમારી જરૂરિયાત

મુજબની વિવિધ વસ્તુઓ જોવાની હોય છે. પછી તમે પ્રાપ્ય તમામ સરખા ઉત્પદનોની કિંમત પણ સરખાવી શકો છો અને માલ સામાનને લગતી ખાસ સૂચનાઓ પણ તમે વેપારીને પાઠવી શકો છો. તમારે બધા પૈસા તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવવાના હોય છે. તમારો ઓર્ડર મળ્યા પછી વિકેતા કે માલ પૂરો પાડનાર તમામ સામાન ટપાલ સેવા અથવા કુરિયર દ્વારા પહોંચયતો કરે છે. આમ તમારો સંપર્ક વિશ્વ બજાર સાથે થાય છે. તમે સામાનની શ્રેષ્ઠ પસંદગી કરી શકો છો. આ બધા માટે તમારા ઘેર ઇન્ટરનેટ જોડાણ (કનેક્શન) વાળું કોમ્પ્યુટર હોવું જરૂરી છે. તમે સાયબર કાફી દ્વારા પણ ઓર્ડર આપી શકો છો. આ પ્રકારની છૂટક ખીરદીને ‘ઓન લાઈન ખરીદી’ પણ કહે છે. પુસ્તકો, મેગેજીનો, જર્નલો (માહિતી ગ્રંથો) સોફ્ટવેર અને આરોગ્ય અને સૌંદર્ય સંભાળની વસ્તુઓ માટે આ સાનુક્કુણ રહે છે.

ઇન્ટરનેટ શોપીંગના લાભ:-

- આપણે ઘેર બેઠાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી વસ્તુ ખરીદી શકીએ છીએ.
- ગ્રાહકોનો સમય અને શ્રમ બચે છે.
- છૂટક વેપારની આ સૌથી ઝડપી પ્રક્રિયા છે.
- વેપારીઓને આ ફાયદાકારક છે કારણ કે તેમાં તેમણે પોતાના ભંડારોમાં માલનો વિપુલ જથ્થો રાખવાની જરૂર નથી.
- આ પદ્ધતિ વિદેશી વ્યાપારમાં બહુ ઉપયોગી છે.

ઇન્ટરનેટ શોપીંગની મર્યાદાઓ:-

- જે લોકો કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તે લોકો માટે ઉપયોગી નથી.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ





૨. આમાં વસ્તુઓની ભૌતિક તપાસ કરવી શક્ય નથી.
૩. આમાં પેસા કેડિટ કાર્ડથી ચૂકવવાના હોય છે. અને કેડિટ કાર્ડ રાખવાનું સામાન્ય માણસને પોસાય નહીં.
૪. બિકિંગાત રીતે જાતે ખરીદવાનો આનંદ મળતો નથી.



૧૪.૬ પાઠગત પ્રશ્નો

૧. નીચેના વિધાનો ‘ખોટાં’ છે કે ‘ખરાં’ તે જણાવો.
 ૧. ટપાલ દ્વારા વેપારમાં વેપારી સૂચિપત્ર, મેગેજીન, ટી.વી. વગેરે દ્વારા પોતાના ઉત્પાદકની જાણકારી આપવા ગ્રાહક સુધી પહોંચે છે.
 ૨. ટપાલ દ્વારા વેપાર ટેલિફોન અને ટી.વી. દ્વારા સહેલાઈથી ચલાવી શકાય. તેમજ ટપાલ ખાતાની સેવા જરૂર નથી.
 ૩. ઝવેરાત (ઘરેણાં), ફળો, શાકભાજી, અનાજ વગેરે વસ્તુ ગ્રાહકને વેચવા માટે ટપાલ દ્વારા વેપાર પદ્ધતિ વપરાય છે.
 ૪. ટેલી શોપીગમાં સમય અને શક્તિ બયે છે કારણ કે ટેલિફોન દ્વારા ઓર્ડર આપી શકાય છે.
 ૫. ટેલી શોપીગમાં ચીજ વસ્તુ બદલવી સરળ પડે છે.
 ૬. ટેલી શોપીગમાં દગ્ગો કે બેઈમાનીનું જોખમ રહેલું છે કારણ કે ઉપભોક્તાને વસ્તુ ખરીદા પહેલાં તેની ચકાસણી કરવાની તક મળતી નથી.
૨. યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરો.
 ૧. રાત દિવસ ગમે ત્યારે વસ્તુ ખરીદવાની સરળ પદ્ધતિ છે
 ૨. સ્વયં સંચાલિત મશીનમાં નાખીને તમે ઈચ્છિત વસ્તુ ખરીદી શકો છો.
 ૩. કેડિટ કાર્ડનો ઉપયોગ ના માધ્યમથી વસ્તુ ખરીદવામાં થાય છે.
 ૪. દુનિયામાં ગમે ત્યાંથી પુસ્તકો કે મેગેજીન ખરીદવા માટે છૂટક ખરીદીની સૌથી ઈચ્છાવા યોગ્ય પદ્ધતિ છે.
 ૫. ઉત્પાદનની જાહેરાત કરવાની માં જરૂર નથી.
 ૬. ઓન – લાઈન શોપીગમાં ના સમય અને શ્રમનો બચાવ થાય છે.

છૂટક વેપાર

૧. સ્વયં સંચાલિત વ્યાપાર મશીનની મર્યાદા એ છે કે ખૂબ ખર્ચાળ છે.
૨. દ્વારા માલ ખરીદવામાં કોમ્પ્યુટરનું શાન જરૂરી છે.
૩. બહુવિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
૧. જે છૂટક વેપાર માત્ર જાહેરાતો પર જ આધાર રાખે છે તે વિતરણ વ્યવસ્થા એટલે.....
- અ. ખાતાવાળી દુકાનો બ. ટપાલ વ્યવહારી દુકાનો
- ક. સહકારી મંડળી ડ. બહુવિકલ્પીય દુકાનો.
૨. એક જ સંચાલક અને એક જ છત નીચે અનેક વસ્તુઓનું છૂટક વેચાણ થતું હોય તેવી દુકાન વ્યવસ્થાને....
- અ. ખાતાવાળી દુકાનો બ. સહકારી મંડળી
- ક. બહુવિકલ્પ દુકાનો ડ. આમાંની એક પણ નહીં
૩. એવું સ્થળ કે જ્યાં જુદા જુદા પ્રકારની દુકાનો એક જ મકાનમાં જોવા મળે છે.
- અ. બહુવિકલ્પ ધરાવતી દુકાનો બ. ખાતાવાળી દુકાન
- ક. સુપર બજાર ડ. જચ્ચાબંધ માર્કેટ
૪. જ્યાં સેલ્સમેનની જરૂર નથી.
- અ. સ્વયં સંચાલિત વેન્ડીંગ મશીન બ. ઇન્ટરનેટ દ્વારા વેપાર
- ક. ખાતાવાળી દુકાન ડ. મોલ્સ
૫. ટેલિ શોપીંગનો આધાર
- અ. ટેલિફોન બ. ટી.વી
- ક. વ્યક્તિગત મુલાકાત ડ. આમાંનું એક પણ નહીં



તમે શું શીખ્યા।

- છૂટક વેપારી એ એવો મધ્યસ્થી છે કે જે જચ્ચાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી નાના જચ્ચામાં માલ ખરીદી ગ્રાહકોને તેમની જરૂરિયત પ્રમાણે માલ વેચે છે.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

મોડ્યુલ - ૪

ખરીદ – વેચાણ અને
વિતરણ



નોંધ

છૂટક વેપાર

- છૂટક વેપાર પ્રક્રિયામાં ખરીદી, ગોઈવણ, સંગ્રહ અને વેચાણની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. શાખ-ઉધારે પણ માલનું વેચાણ કરે છે. વ્યક્તિગત વેચાણની સુવિધા આપે છે. જોખમો ઉઠાવે છે. સ્ટોરની બહાર વસ્તુઓનું આકર્ષક પ્રદર્શન કરે છે. ઉત્પાદકોને ગ્રાહકોની બદલાતી જતી અભિરૂત્યિ – ફેશન – ટેવની માહિતી પણ આપે છે.
- છૂટક વિતરણ વ્યવસ્થાને નાના કદના છૂટક વેપારી અને મોટા કદના છૂટક વેપારીમાં વર્ગીકરણ કરી શકાય છે.
- નાના કદના છૂટક વેપારમાં ફેરીયાઓ અને સ્થિર નાની દુકાનો ધરાવતા વેપારનો સમાવેશ થાય છે.
- મોટા કદના છૂટક વેપારમાં ખાતાવાળી દુકાનો, બહુદેતક ધરાવતી દુકાનો, સુપર માર્કેટ (અપના બજાર) કે જ્યાં આર્થિક ખરીદ – વેચાણના વ્યવહારો ખુબ મોટા હોય છે.
- સ્થિર દુકાનો છૂટક વેપારની વિવિધ રીતોથી અલગ પડે છે.
- મોટા પાયા પર છૂટક વેપાર એક એવી વેપાર પદ્ધતિ છે જેમાં એક જ પ્રકારની વસ્તુ અથવા જાત જાતનો સામાન ગ્રાહકોને એક જ છાપરા નીચે એક મોટી દુકાનમાં મળી રહે છે. અથવા ગ્રાહકોની સુવિધા મુજબ ધરે પહોંચાડવામાં આવે છે. ભારતમાં મોટા પાયા પર છૂટક વેચાણના મુખ્ય પ્રકારો છે. (૧) વિભાગીય ભંડાર (૨) બહુ સંખ્ય દુકાનો અને (૩) સુપર બજાર.
- વિભાગીય ભંડાર મોટા પાયા પરની છૂટક દુકાનો છે. ત્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ જુદા જુદા વિભાગો કે કાઉન્ટરો ઉપર એક જ મકાનમાં વેચાય છે. તેઓ મોટા શહેરો કે નગરોમાં વાણિજ્ય કેન્દ્રોમાં હોય છે. વિવિધ વસ્તુઓ વેચવા ઉપરાંત આ ભંડારો ગ્રાહકોની સગવડતા ખાતર રેસ્ટોરાં, ટેલિફોન, એટીએમ વગેરે સુવિધાઓ પૂરી પાડતા હોય છે.
- બહુસંખ્ય દુકાનો એક જ પ્રાન્દની વસ્તુઓ વેચે છે. તેની બધી દુકાનોમાં ભાવો એક સરખા હોય છે. અને વસ્તુઓ પણ એક સરખી જ હોય છે. સરળતાથી ઓળખાય તે માટે બધી દુકાનોમાં સજાવટ પણ એક સરખી જ હોય છે અને મુખ્ય કાર્યાલાયથી જ બધી દુકાનોનો વહીવટ થાય છે.
- સુપર બજાર એક વ્યાપક ઉપભોક્તાઓનો સહકારી ભંડાર છે. જ્યાં ઉપભોક્તાઓને રોજ બરોજના ઉપયોગની સેકડો વિવિધ વસ્તુઓ વાજબી ભાવે એક જ છાપરા નીચે વેચવામાં આવે છે. તેઓ વિનિર્માતાઓ કે સરકારી સંસ્થાઓ પાસેથી વિપુલ જથ્થામાં માલ સીધેસીધો ખરીદે છે અને ઉપભોક્તાઓને ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડે છે.

છૂટક વેપાર

- દુકાન રહિત છૂટક વેચાણનાં સ્વરૂપો (પ્રકાર) આ મુજબ છે. (૧) ટપાલ દ્વારા વેપાર (૨) ટેલી શોપીગ (૩) સ્વયં સંચાલિત વેચાણ મશીન દ્વારા વેપાર અને (૪) ઇન્ટરનેટ શોપીગ.
- ટપાલ દ્વારા વેપાર એ ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટપાલ દ્વારા વસ્તુ વેચવાની પદ્ધતિ છે. વિકેતા પોતાના માલની જાહેરાતથી ગ્રાહકો સમક્ષ પહોંચે છે. અને વસ્તુઓ ગ્રાહકોને ટપાલ દ્વારા પહોંચાડાય છે. આ વેપાર પદ્ધતિ માત્ર હલકા વજનની, ટકાઉ (નાશ ન પામે તેવી) અને સહેલાઈથી હેરવી – ફેરવી શકાય તેવી વસ્તુઓ માટે અનુકૂળ છે.
- ટેલી શોપીગમાં ગ્રાહકોનો ટેલીફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે. અથવા લોકોને ઉત્પાદન અને તેના ઉપયોગ વિષે જાણ કરવા ટી.વી. ઉપર જાહેરાત આપવામાં આવે છે. ગ્રાહક વસ્તુનો ઓર્ડર ટેલીફોન ઉપર આપે છે. આ પદ્ધતિથી ખરીદનારનો સમય અને શ્રમ બચે છે. આમાં દગ્દો કે બેઈમાનીનું જોખમ રહે છે. કારણ કે ખરીદનાર વેચાણ માટે રજૂ થયેલી વસ્તુની ચકાસણી કરી શકતો નથી.
- સ્વયં સંચાલિત વ્યાપાર મશીન દ્વારા વસ્તુઓ રાત દિવસ ગમે ત્યારે ખરીદી શકાય છે. વિકેતા આવા મશીનો બહુ સગવડતાવાળી બસ સ્ટેશન, શોપીગ સેન્ટર જેવી જગ્યાઓ સ્થાપે છે. ગ્રાહકો માત્ર મશીનમાં સિક્કા કે ટોકન દાખલ કરીને વસ્તુઓ ખરીદી શકે છે.
- ઇન્ટરનેટ શોપીગમાં ઉત્પાદન વિષેની માહિતી ઇન્ટરનેટ વેબસાઈટ ઉપરથી મળે છે. અને ઇન્ટરનેટ ઉપર જ ઓર્ડર આપવામાં આવે છે. સામાન ટપાલ કે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે. અને પૈસા કેડિટ કાર્ડ દ્વારા ચૂકવવામાં આવે છે. ઇન્ટરનેટ શોપીગ દ્વારા ઘરમાં બેઠા બેઠા જ દુનિયાની કોઈપણ બજારમાંથી વસ્તુ ખરીદી શકાય છે.



સત્રાંત સ્વાધ્યાય

1. મોટા પાયે છૂટક વેપારની વ્યાખ્યા આપો.
2. ભારતમાં વિભાગીય ભંડાર અને બહુ સંખ્યક દુકાનોનાં બધો ઉદાહરણો આપો.
3. સુપર બજારનો અર્થ શો?
4. ટપાલ દ્વારા વ્યાપારમાં મંગાવવી સરળ પડે તેવી ચાર વસ્તુના નામ આપો.
5. ગ્રાહકો અને વેપારીઓને બહુ સંખ્યક દુકાનો દ્વારા થતા ચાર ફાયદા ગણાવો.
6. ગ્રાહકો અને વિકેતાઓને બહુ સંખ્યક દુકાનો દ્વારા થતા ચાર લાભો સમજાવો.



નોંધ

મોડ્યુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

છૂટક વેપાર

૭. સુપર બજાર ગ્રાહકો માટે કઈ રીતે લાભદારી છે? લગભગ ૫૦ શબ્દોમાં સમજાવો.
૮. ટપાલ દ્વારા ઓર્ડર આપી માલ ખરીદવાના પ્રક્રિયાની રૂપરેખા આપો.
૯. વસ્તુઓ ખરીદવાની એક ખૂબ જ સગવડભરી પદ્ધતિ હોવા છતાં ટેલી શોપીગનો ઉપયોગ ગ્રાહકો વધારે પ્રમાણમાં કરતા નથી. શા માટે?
૧૦. વિભાગીય ભંડારની કોઈ પણ છ વિશેષતાઓ સમજાવો.
૧૧. વિભાગીય ભંડાર અને શૃંખલાબદ્ધ દુકાનો વચ્ચે મોટા પાયાના છૂટક વેપાર સંગઠનની દ્રષ્ટિએ શો તફાવત છે તે સ્પષ્ટ કરો.
૧૨. વિવિધ પ્રકારના મોટા પાયાના છૂટક વેપારના સામાન્ય લક્ષણોની ચર્ચા કરો.
૧૩. ગ્રાહકો માટે ઇન્ટરનેટ શોપીગના ફયદા અને મર્યાદાઓ સમજાવો.
૧૪. સ્વયં સંચાલિત મશીન દ્વારા વેપાર એ છૂટક વેપારની એવી પદ્ધતિ છે કે જેનાથી ગ્રાહકો અને વેપારીઓને અગાધિત લાભો થયા છે. ચર્ચો.



પાઠંત્ર પ્રશ્નોના જવાબો

૧૪.૧

૧. ક ૨. ઈ ૩. અ ૪. બ ૫. ઢ

૧૪.૨

૧. નાના કદના	૨. છૂટક વેપાર	૩. વિશાળ કદના
૪. મધ્ય ભાગમાં, વિશાળ	૫. ઉત્પાદકો	

૧૪.૩

૧. સાચુ,	૨. ખોટું,	૩. ખોટ,	૪. સાચુ,	૫. ખોટુ,
૬. સાચુ				

૧૪.૪

૧.

૧. સાચુ,	૨. સાચુ,	૩. ખોટ,	૪. સાચુ,	૫. ખોટ
----------	----------	---------	----------	--------

છૂટક વેપાર

૨.

- | | |
|--------------------------|--------------------|
| ૧. બહુવિકલ્પ દુકાનો | ૨. ખાતાવાળી દુકાનો |
| ૩. અપના બજાર (અપના બજાર) | ૪. ખાતાવાળી દુકાનો |
| ૫. બહુવિકલ્પ દુકાનો | |

૩.

- | | |
|------------------|-----------------|
| ૧. ઉત્પાદક | ૨. એક છતની નીચે |
| ૩. વિશાળ | ૪. રોકડ |
| ૫. ના કરતા વિશાળ | |

૧૪.૫

- | | |
|-----------------------|---------------|
| ૧. સરખુ | ૨. સુશોભિત |
| ૩. ખરાબ ઉધાર (ઘાલખાધ) | ૪. મધ્યસ્થિ |
| ૫. મુખ્ય મથક | ૬. વિશ્વાસ |
| ૭. મર્યાદિત | ૮. સુવિધાજન્ય |

૧૪.૬

૧.

- | | | | | |
|----------|----------|----------|----------|----------|
| ૧. સાચુ, | ૨. ખોટુ, | ૩. ખોટુ, | ૪. સાચુ, | ૫. ખોટુ, |
| ૬. સાચુ | | | | |

૨.

- | |
|---------------------------------------|
| ૧. સ્વયં સંચાલિત છૂટક વેચાણ કરતુ મશીન |
| ૨. કોઈન્સ (સિક્કા) અથવા ટોકન |
| ૩. ઇન્ટરનેટ શોપીંગ / ઓન લાઈન શોપીંગ |
| ૪. ઇન્ટરનેટ શોપીંગ / ઓન લાઈન શોપીંગ |
| ૫. સ્વયં સંચાલિત છૂટક વેચાણ કરતુ મશીન |
| ૬. ગ્રાહકો |
| ૭. યંત્રો |

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



નોંધ

૮. ઇન્ટરનેટ શોપીંગ / ઓન લાઈન શોપીંગ

૩.

૧. બી

૨. આ

૩. બી

૪. બી

૫. આ



તમારા માટે પ્રવૃત્તિઓ

વર્તમાન પત્રના લેખો અને જાહેરાત અને જાહેરાતોનો અભ્યાસ કરી એ શોધો કે કયા ઉત્પાદકો સીધું જ ગ્રાહકોને વેચાણ કરે છે.

- ખાતાવાળી દુકાનો
- બાહુવિકલ્પીય દુકાનો (વૈવિધ્યસભર દુકાનો)
- સંકલિત દુકાનો.
- ટપાલ વ્યવહારી દુકાનો.



જાહેરાત

ઘારોકે પરીક્ષા પાસ કરીને તમે તમારા વિસ્તારમાં એક રેસ્ટોરા (નાસ્તા ગૃહ) ખોલવા માંગો છો. તમારી પાસે પૂરતી જગ્યા, જરૂરી નાણાં અને તેને ચલાવવાની આવડત છે. પણ તમારા રેસ્ટોરા વિષે લોકોને કેવી રીતે જાણ થશે? જ્યાં સુધી લોકો તેના વિષે જાણે નહીં ત્યાં સુધી તમારા રેસ્ટોરામાં કોણ આવશે. લોકોને ખબર પડે કે ત્યાં એક રેસ્ટોરા આવેલી છે એ માટે શું કરવું જોઈએ એ તમે વિચારી શકો છો? ખરેખર, જો ખોરાકની ગુણવત્તા સારી હોય અને સ્વચ્છતા સારી હોય તો રેસ્ટોરા કેટલાક લોકોને આકર્ષી શકે. પરંતુ તમારી રેસ્ટોરા કયાં આવેલી છે તે લોકો ને જણાવવા માટે તમારે સતત કેટલાક ઉપાયો યોજવા પડે. વળી કઈ જાતનો ખોરાક અને વિવિધ વાનગીઓ મળે છે તે જણાવવું પડે કે જેથી તમને નિયમિત રીતે ગ્રાહકો મળ્યા કરે. હકીકતમાં દરેક વેપારી પોતાના ઉત્પાદન અને સેવાઓ વિષે લોકોને જાણ કરવાની પ્રવૃત્તિમાં ગુંથાયેલો જ હોય છે કે જેથી તેનું વેચાણ વધી શકે. ચાલો આ પાઠમાં આપણે આ પ્રવૃત્તિ વિષે વધુ જાણીએ.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- જાહેરાત નો અર્થ સમજાવી શકશો.
- જાહેરાત ના ઉદ્દેશો નું વર્ણન કરી શકશો.
- જાહેરાત ના વિભિન્ન માધ્યમોની ઓળખ કરી શકશો.
- જાહેરાત ના દરેક માધ્યમ ની સાનુક્ઝણતા સૂચવી શકશો.

૧૫. ૧ જાહેરાતનો અર્થ

અખબારમાં તમે માત્ર તાજી ઘટનાઓ કે ખેલકૂદ વિષે જ વાંચતા નથી. પણ તમને કેટલાક ઉત્પાદનો કે સેવાઓ વિષે માહિતી કે સંદેશ પણ જોવા મળશે, જેમ કે – એર કન્ડીશનર સાઇકલ, માથામાં નાખવાનું તેલ, ભવન, નિર્માતા વગેરે. આવી માહિતી તમને માહિતી ગ્રંથો, મેગેઝીનો, પત્રિકાઓ આકાશવાણી, દુરદર્શન, રસ્તાને કિનારે લગાવેલા હોડિંગો વગેરે તમે ઉત્પાદનો કે સેવાઓની સુલભતા, કિમત(ભાવ) વિશિષ્ટ લક્ષણો વગેરે જાણકારી મેળવી શકો છો. આમ જ્યારે તમને આવી વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે ત્યારે તમે તે વસ્તુ જ્યાં મળતી હોય ત્યાં પહોંચી જાઓ છો, તેની ગુણવત્તા અને વિશિષ્ટતાઓ ચકાસો

જાહેરાત

ઇઓ અને જો તે વસ્તુ તમારી જરૂરિયાત પૂરી કરતી હોય તો તમે તે ખરીદો છો. ઉદાહરણ તરીકે તમે રેડિયો સાંભળતા હો ત્યારે 'બજાજ આધ્મન્ડ(બદામ) કેશ તેલ' નામના ઉત્પાદન વિષે જાણવા મળે છે. પણ તમે કેશ તેલ ખરીદવા જાઓ ત્યારે તમે વેપારીને તે વસ્તુ બતાવવા કહો છો. હવે જો તેની સુગંધ તમને ગમે અને કિંમત વાજબી લાગે તો તમે તે ખરીદો છો. આવા અનેક પ્રકારના દાખલા તમને જોવા મળે. જેમ કે દા.તઃ હપ્તાથી ફ્લેટ વેચતા બિલ્ડરો,



પ્રચાર માધ્યમ

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

વળતર આપતા વેપારીઓ, ઉત્પાદક બજારમાં મૂકેલું કોઈ નવું ઉત્પાદન વગેરે. સ્વાભાવિક છે કે આવી માહિતી આપવાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રાહક કોઈપણ ઉત્પાદન વિષે જાણો અને સેવાઓ વિષે જાણો અને તે ખરીદવા માટે તેમને લલચાવી શકાય. આ રીતે વિનિર્માતાઓ, વેપારી કે સેવા પ્રદાતાઓ વગેરે પોતાનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકષ વા આવી માહિતીઓ આપવા ઈચ્છા હોય છે. આ સમગ્ર વૃદ્ધિ મુલક પ્રવૃત્તિને જાહેરાત કહેવામાં આવે છે અને ઉત્પાદક કે વેપારી કે સેવા પ્રદાતાને "જાહેરાત દાતા" (વિજાપન કરતા) અથવા "પ્રાયોજક" કહેવામાં આવે છે. જે સંદેશ કે માહિતી પુસ્તિકા, મેગલિનો, હોડીંગો ટી.વી વગેરે માધ્યમો દ્વારા જાહેરાત કરવામાં આવે તેને જાહેરાતનાં માધ્યમો કહેવાય છે.

જાહેરાત ની વ્યાખ્યા:-

અમેરિકન માર્કેટીંગ એસોસિએશન જાહેરાત ની વ્યાખ્યા આમ કહે છે. 'કોઈ નિશ્ચિત પ્રાયોજક દ્વારા પૈસા આપીને કરતી વિચાર વસ્તુઓ અને સેવાની અવૈયક્તિક (બિનઅંગત) રજૂઆત અથવા પ્રવર્તન.' જાહેરાત એટલા માટે અવૈયક્તિક છે કે તે કોઈ વ્યક્તિને વિશેષને અનુલક્ષીને હોતી નથી. બીજું, પ્રાયોજક એટલે કે વિનિર્માતા અથવા ઉત્પાદક નિશ્ચિત (ઓળખાયેલ) હોય છે કારણ કે જાહેરાતમાં હંમેશા તેનું નામ સરનામું સામેલ હોય જ છે. અને તે સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ પણ પોતે જ ભોગવે છે. ત્રીજું, ઉત્પાદક વસ્તુની ગુણવત્તા, આકાર(રૂપરેખા), પેકિંગ તેમજ કિંમત વગેરેના લગતા વિચારને પણ પુરસ્કૃત કરી શકે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ ઉત્પાદન સેવા કે વિચારને લગતા પ્રાયોજક દ્વારા આપેલા સંદેશ સાથે જોડાયેલી તમામ પ્રવ તિઓને જાહેરાત કહેવામાં આવે છે.

જાહેરાતનાં લક્ષણો:-

જાહેરાતનો અર્થ અને વ્યાખ્યા લક્ષણમાં લેતા આપણે જાહેરાતના લક્ષણો એકંદરે આ મુજબ ગણાવી શકીએ.



૧. સંદેશની અવૈયક્તિક રજૂઆત:-

જાહેરાતમાં ઉપભોક્તાઓ સાથે કોઈ પ્રત્યક્ષ સંપર્ક હોતો નથી. તે સામાન્ય રીતે તમામ સંભવિત ગ્રાહકોને અનુલબ્ધીને હોય છે.

૨. સંચાર નું મૂલ્ય ચૂકવેલું સ્વરૂપ:-

જાહેરાતમાં વિનિર્માતા વર્તમાનપત્ર, હોર્ડિંગ મેગેઝીન, રેડિયો, ટેલીવિઝન વગેરે જેવા સમૂહ માધ્યમ દ્વારા સંભવિત ઉપભોક્તાઓ સાથે છે. આ બધા માધ્યમોમાં થોડી જગ્યા કે થોડો સમય રોકવા માટે તેણે કિંમત ચૂકવવી પડે છે.

૩. ઉત્પાદન સેવા અથવા વિચાર ને પ્રોત્સાહન:-

જાહેરાત માં કોઈપણ ઉત્પાદન, સેવા અથવા વિચારના બાબામાં કોઈક સંદેશ હોય છે. તે લોકો ને તેમના વિષે જાણકારી આપે છે અને ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે.

૪. પ્રાયોજક હંમેશા પરિચિત હોય છે:-

જાહેરાત દેનાર વિનર્માતા, વેપારી અથવા સેવા પ્રદાતાની ઓળખાણ હંમેશાં પ્રત્યક્ષ હોય છે.

૫. કોઈ સંચાર માધ્યમ દ્વારા સંપર્ક:-

જાહેરાત હંમેશા કોઈને કોઈ માધ્યમ દ્વારા પહોંચતી હોય છે. આ માટે અમૃક જ માધ્યમ હોવું જરૂરી નથી. બધાં માધ્યમો નો પણ ઉપયોગ થઈ શકે.

૧૫.૨ જાહેરાતના હેતુઓ

તમે શીખી ગયા કે જાહેરાત નો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સંદેશ કે માહિતી પહોંચાડવાની છે. પણ આવો સંદેશો કે માહિતી ના પ્રસાર સાથે જ તે પ્રાયોજક કે જાહેરાત દાતા માટે લાભદાયી પણ હોય છે. ચાલો આપણે જાહેરાતના વિવિધ હેતુઓ વિષે જાણીએ.

૧. ગ્રાહક ને શિક્ષિત કરવા:-

ટી.વી. ઉપર "ટાટા નમક" ની જાહેરાત આવતી હતી તે તમને યાદ છે? તે જાહેરાત માં એક કહેવામાં આવે છે કે "ટાટા નમક" આરોગ્ય માટે સારું છે કારણકે તેમાં આયોડીન રહેલું છે. આ સંદેશો તમને શીખવે છે કે આયોડીન સ્વાસ્થ્ય માટે સારું છે અને દાંડી નમકમાં આયોડીન છે.

૨. નવા ઉત્પાદન ની માંગ પેદા કરવી:-

તમે છાપા માં વાંચ્યુ હશે કે એક નવી જાતની પેન જેને "જેલ પેન" કહે છે તે બજારમાં દાખલ થઈ છે. તે બહુ જ કિફાયતી છે અને લખવામાં ઘણી સગવડભરી છે. આનાથી તમે પેન ખરીદવા પ્રોત્સાહિત થાઓ છો. એવી જ રીતે જાહેરાત દ્વારા જાણકારી મેળવીને તમારા

જાહેરાત

જેવા ઘણા વિદ્યાર્થીઓ પેન ખરીદશે અને આનાથી બંગારમાં પ્રવેશતા નવા ઉત્પાદન ની માંગ ઉત્પન્ન થશે.

૩. ચાલુ ગ્રાહકો ને ટકાવી રાખવા:-

તમને યાદ હશે નિરમા વોશીંગ પાઉડર બહુ જ લોકપ્રિય ડીટરજન્ટ હતો. પણ વીલ પાઉડર બંગારમાં આવ્યા પછી એકાએક નિરમા પાઉડર ની માંગ ઘટી ગઈ. પછી નિરમા પાઉડરના નિર્માતાઓએ ઉત્પાદન સુધાર્ય અને વિવિધ માધ્યમોમાં તેની જાહેરાત કરી. આવું જાણ્યા પછી લોકો આગાઉ નિરમા વાપરવા લાગ્યા. આ રીતે નિરમાએ પોતાની ચાલુ માંગ ટકાવી રાખી. આમ જાહેરાત માત્ર નિર્માતાઓને નવી ઉત્પાદનની વસ્તુની માંગ ઉભી કરવામાં જ નહીં પણ જૂના ગ્રાહકોને ટકાવી રાખવામાં પણ મદદ કરે છે.

૪. વેચાણ વધારવા:-

આપણે જોયું કે જાહેરાત નવા ઉત્પાદન ની માંગ ઉત્પન્ન કરે છે અને જૂના ની માંગ ટકાવી રાખે છે. આમ માંગ વધવાથી ઉત્પાદનનું વેચાણ પણ વધે છે.

૫. વિકેતા ને સહાય કરવી:-

મોટાભાગ ની જાહેરાતોમાં ઉત્પાદનનાં પ્રમુખ લક્ષી તેના ગુણો અને ઉપયોગો વિગતવાર જણાવવામાં આવે છે. આનાથી વિકેતા ને મદદ મળે છે. તેનું ઉત્પાદન ઝડપથી વેચાય છે અને ગ્રાહકો ને સમજાવવામાં કે મનાવવામાં તેનો સમય બગડતો નથી.



૧૫.૧ પાઠગત પ્રશ્નો

નીચેના વિધાનો 'ખરા' છે કે 'ખોટા' તે જણાવો.

૧. જાહેરાત ના માધ્યમ થી પ્રાયોજક ગ્રાહક સાથે સીધો સંપર્ક કરે છે.
૨. જાહેરાતનો ખર્ચો પ્રાયોજક ભોગવે છે.
૩. જાહેરાત ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો અને તેમના ઉપયોગની બાબતમાં શિક્ષિત કરવામાં સહાયક હોય છે.
૪. જાહેરાત ચાલુ તેમજ નવા ઉત્પાદન ના વેચાણમાં વધારો કરવામાં સહાય કરે છે.
૫. ગ્રાહકો ને વસ્તુ કે સેવા વેચવામાં વિકેતાને જાહેરાતથી કશો ફાયદો થતો નથી.

૧૫.૩ જાહેરાતના માધ્યમ

અત્યાર સુધી તમે શીખ્યા કે જાહેરાત છાપાં, જર્નલો, રેડિયો, ટી.વી. જેવા કોઈક માધ્યમ દ્વારા પ્રસારિત થાય છે. નીચેની આકૃતિ માં કેટલાક પ્રચલિત જાહેરાતનાં માધ્યમો આપવામાં આવ્યા છે.


મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



નોંધ



આલો આપણો આ માધ્યમો વિષે વિગતવાર જાણીએ.

અ. મુદ્રિત માધ્યમ:-

મોટેભાગે વેપારીઓ જાહેરાત માટે મુદ્રિત માધ્યમ નો ઉપયોગ કરતા હોય છે. તેમાં અખબાર, મેગાਜિનો, જર્નલો વગેરે દ્વારા જાહેરાત નો સમાવેશ થાય છે. તેને પ્રેસ જાહેરાત પણ કહે છે.

૧. વર્તમાન પત્ર:-

તમે છાંપા તો વાંચતા જ હશો. આપણા દેશમાં અખબાર અંગ્રેજી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં બહાર પડે છે. વર્તમાન પત્રો સમાચારપત્રો, મતો અને તાજી ઘટનાઓના સ્ત્રોતો છે. આ ઉપરાંત વર્તમાનપત્રો જાહેરાત નું પણ ખૂબ પ્રચલિત માધ્યમ છે. જાહેરાતદાતા વર્તમાન પત્રો દ્વારા સંદેશ પ્રસારણ કરે છે તે કરોડો લોકો સુધી પહોંચે છે.



વર્તમાન પત્ર

લાભો:-

વર્તમાન પત્રો દ્વારા જાહેરાત ના નીચે મુજબ લાભો છે.

૧. સામાન્ય રીતે વર્તમાનપત્રો નો બધું બહોળો ફેલાવો હોય છે. અને એક જાહેરાત છાપા દ્વારા અસંખ્ય લોકો સુધી પહોંચી જાય છે.
૨. વિસ્તૃત પ્રકાશન ના કારણે સામાન્ય રીતે જાહેરાતની કિમત પ્રમાણ માં ઓછી હોય છે.

વાણિજ્ય વ્યવસ્થા

જાહેરાત

૩. સામાન્ય રીતે અખભાર દરરોજ પ્રકાશિત થાય છે. આથી એકની એક જાહેરાત વારંવાર આપી વાચકો દરરોજ યાદ આપી શકાય છે.
૪. વર્તમાનપત્ર બહુ જ ટૂંક સમય ની નોટિસ આપી ને જાહેરાત ના મુદ્રા આપી શકાય છે. ત્યાં સુધી કે છેલ્લી ઘડીએ પણ મુદ્રામાં ફેરફાર શક્ય બને છે. આમ જાહેરાત લચીલી બની શકે છે.
૫. વર્તમાન પત્રો અલગ અલગ પ્રદેશોમાંથી વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. તેથી જાહેરાતદાનાં ઈચ્છિત બજાર પ્રદેશ અને વાચકો સુધી સ્થાનિક પ્રાદેશિક ભાષા દ્વારા પહોંચવાની વિશાળ તકો સાંપડે છે.

મર્યાદાઓ:-

વર્તમાન પત્રોમાં જાહેરાત ની નીચે મુજબની મર્યાદાઓ પણ છે.

૧. સામાન્ય રીતે વર્તમાન પત્રો મળતાં તુરત જ વંચાઈ જાય છે પછી ઘરના કોઈ ખૂલ્ખામાં મૂકી દેવામાં આવે છે. ૨૪ કલાક બાદ આપણા ને બીજું વર્તમાનપત્ર મળે છે. આમ અખભારો નું આયુષ્ય બહું ટૂંકું હોય છે.
૨. સામાન્ય રીતે છાપું લોકો સમાચાર માટે વાંચે છે. જાહેરાત ઉપર બહુ ઓછુ ધ્યાન અપાય છે.
૩. અભણ લોકો વાંચી શકતા નથી. તેથી છાપાની જાહેરભબરો તેમને કોઈ લાભ પહોંચાડી શકતી નથી.
૪. સામયિકો:-



સામયિકો

સામયિકો નિયમિત રીતે પ્રકાશિત થાય છે. પણ દરરોજ પ્રકાશિત થતાં નથી. આ સામયિકો સાપ્તાહિક, પાલ્સિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અથવા વાર્ષિક ધોરણ પણ પ્રકાશિત થતાં હોય છે. દા.ત. તમે ઓનલુકર, ઈન્ડિયા ટુડે, ફ્રાન્ટલાઇન યોજના, સ્વાગત, ફેમિના જેવા નિયમિત રીતે અંગેજીમાં છપાતાં તેમજ ગૃહશોભા, નંદન અને ચંપક જેવા હિન્દીમાં છપાતાં મેગેજીનો અને જર્નલો જોયા હશે. એવી જ રીતે હિન્દી અને

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ સામયિકો છે. આ બધા સામયિકોના વાંચકો વિશાળ સંખ્યામાં છે અને તેમાં છપાયેલી જાહેરાતો અસંખ્ય લોકો સુધી પહોંચે છે.

લાભો:-

૧. સામયિકોનું આયુષ્ય વર્તમાન પત્રોની સરખામણીમાં લાંબુ હોય છે. સામયિકો ભવિષ્યમાં વંચાય અથવા ફુરસટે વંચાય અથવા ફરી વખત વંચાય, જ્યારે જરૂર પડે ત્યારે વાંચી શકાય તે માટે લાંબો સમય સાચવવામાં આવે છે.
૨. સાયયિકોનો વાચક વર્ગ પસંદગીકૃત હોય છે અને તેથી જાહેરાત દેનાર પોતાના ગ્રાહકોના લક્ષ્યજૂથ વિષે જાણી શકે છે. અને તે મુજબ પસંદગી કરેલી (ચૂંટી કાઢેલી) જાહેરાત આપવામાં આવે છે. દા.ત. ફેમિના સામયિક માત્ર મહિલાઓનું મેગેજિન છે તો જે ઉત્પાદનનો ઉપલોગ માત્ર પુરુષોજ કરી શકતા હોય તેને લગતી જાહેરાતો તેમાં ભાગ્યે જ છિપાય. જો કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદકો તેનો ઉપયોગ મહિલાઓ જ કરતી હોય તો તેની જાહેરાત આ મેગેજિનમાં આપવાનું વધારે પસંદ કરે છે.

મર્યાદાઓ:-

૧. સામયિકોમાં જાહેરાત આપવાનું પ્રમાણમાં મોંઘું પડે છે.
૨. વર્તમાનપત્રો કરતાં ઘણા થોડી સંખ્યામાં વાચકો સુધી જાહેરાત પહોંચે છે.
૩. જાહેરાતની સામગ્રી બહુ વહેલી આપી ટેવી પડે છે. તેમાં છેલ્ટી ઘરીએ ફેરફાર શક્ય નથી. આનાથી લચીલાપણું ઘટે છે.

૬. ઇલેક્ટ્રોનિક માધ્યમ:-

આધુનિક જમાનાના વેપારમાં જાહેરાતનું આ બહુ લોકપ્રિય (પ્રચલિત) માધ્યમ છે. આમાં રેડિયો, ટેલીવિઝન અને ઇન્ટરનેટનો સમાવેશ થાય છે. ચાલો તેની વિગતો તપાસીએ.

૧. રેડિયો જાહેરાત:-

આપણે બધા રેડિયો વિષે જાણીએ છીએ અને તેમાં આવતી વિવિધ ઉત્પાદનોની જાહેરાતો આપણે સાંભળી છે.

રેડિયોમાં કોઈ કાર્યક્રમનું પ્રસારણ થતું હોય ત્યારે વચ્ચેમાં નાના બ્રેક (અંતરાલ) આવે છે અને તેને વસ્તુઓ અને સેવાઓની જાહેરાતથી ભરવામાં આવે છે. વળી ઘણાં લોકપ્રિય કાર્યક્રમોના પ્રયોજકો જ ખુદ જાહેરાત દેનાર હોય છે. રેડિયોમાં કાર્યક્રમોના પ્રસારણ સમયે યોગ્ય સમયે અંતરે જાહેરાત આપવામાં આવે છે.



રેડિયો જાહેરાત

જાહેરાત

લાભ:-

- લોકો નિયમિત સાંભળતા હોઈ તે વધારે અસરકારક હોય છે.
- જે અભિજ્ઞ લોકો લખી વાંચી શકતા નથી તેમને માટે પણ ઉપયોગી છે.
- જ્યાં છાપું વાંચવું શક્ય ન હોય ત્યાં પણ તમે રેડિયો સાંભળી શકો. દા.ત. રસ્તામાં મુસાફરી કરતા કે ઘરે કામ કરતા હો ત્યારે પણ રેડિયો સાંભળી શકો. જ્યારે તે વખતે તમે છાપું વાંચી શકો. તે જ રીતે તમે વાહન ચલાવતા હો ત્યારે પણ રેડિયો સાંભળી શકો પણ છાપું ન વાંચી શકો.

મર્યાદા:-

- નિયમિત રેડિયો સાંભરનાર જ તેને શું સાભળ્યું તે યાદ રાખી શકે. કયારેક કયારેક રેડિયો સાંભળનાર તેને શું સાંભળ્યું તે ભૂલી જઈ શકે.
 - જાહેરાત જે સંદેશો મોકલવા માગતી હોય તે સ્પષ્ટ ન હોય તો તાત્કાલિક તેને બીજીવાર સાંભળવાની કોઈ તક હોતી નથી. આ ઉપરાંત કોઈ અન્ય વ્યવધાન વચ્ચાં ઉત્પન્ન થાય તો પણ પ્રસારણને બગાડીનાખી શકે.
 - ટેલિવિઝનની સરખામણીમાં રેડિયોમાં દ્રશ્ય પ્રમાવ ન હોવાથી ઓછો અસરકારક છે.
૨. ટેલિવિઝન જાહેરાત:-

માહિતી પ્રસારણ તકનીકી અને ઈલેક્ટ્રોનિક માધ્યમના જડપી ફેલાવાના કારણે આજે જાહેરાત માધ્યમોમાં ટેલિવિઝન સૌથી ટોચ ઉપર છે. ટેલિવિઝનનો પ્રભાવ સૌથી વધુ અસરકારક છે. કારણ કે તે આપણી આંખો અને કાન એમ બંને (ઇન્નિયો) ઉપર પ્રભાવ પાડે છે. (દ્રશ્ય-શ્રાવ્ય સાધન છે.) વસ્તુઓ દેખાડી શકાય, તેમના ઉપયોગનું નિર્દર્શન કરી શકાય અને



ટેલિવિઝન જાહેરાત

તેમની ઉપયોગિતા વર્ણવી શકાય. ટી.વી.માં આવી સગવડ મળે. રેડિયોની જેમ જ ટી.વી. ઉપર પણ જાહેરાતો કાર્યક્રમો વચ્ચેના નાના નાના બ્રેક (અંતરાલ)માં દર્શાવી શકાય. અહીં પણ જાહેરાત દાતાઓ દ્વારા કાર્યક્રમો પ્રયોજાતા હોય છે.

લાભો:-

- તે દ્રશ્ય-શ્રાવ્ય પ્રભાવના કારણે સૌથી વધુ અસરકારક છે.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ





૨. આકર્ષક (જકડી રાખો તેવા) સુત્રો (નારા), નાચ-ગાન શુંખલા અને પ્રભ્યાત હસીઓ દ્વારા ઉત્પાદનની રજૂઆત વગેરે કારણોને લીધે ટીવી દ્વારા જાહેરાતની ચિરસ્થાયી અસર પડે છે. દા.ત. "ઢંડા મતલબ કોકકોલા" કહેતા આમીરખાન કે પેપ્સીની જાહેરાતમાં સચીન તેદુલકરને કોણ ભૂલી શકે ?
૩. ફળાબંધ વિવિધ ચેનલોના કારણે જાહેરાતા પાસે તેનલ અને જાહેરાતનો સમય પસંદ કરવાની વિશ્યાળ તકે ઉપલબ્ધ હોય છે.
૪. પ્રદેશિક ચેનલોનો પ્રવેશ થતા અભિષ્ણ માણસ પણ ચેનલ જોઈને અને સાંભળીને જાહેરાત સમજી શકે.

મર્યાદાઓ:-

૧. ટીવી જાહેરાથો બનાવવી અને પ્રસારણ કરવું તે સામાન્ય રીતે વધારે ખર્ચાળ છે. આજકાલ લગભગ બધાન ઉત્પાદકો ટીવી જાહેરાત દ્વારા જ સંદેશ પ્રસારિત કરવા પ્રયત્ન કરતા હોઈ પ્રેક્શકો પર પ્રભાવ ઓછો પડે છે. અત્યારે જ્યારે ચેનલોમાં કોમર્શિયલ બ્રેક (વ્યાપારી જાહેરાત માટેનો બ્રેક) આવે ત્યારે લોકો ચેનલો બંધ કરી નાખે છે અગર બાદલી નાખે છે.

૩. ઈન્ટરનેટ:-

તમે ઈન્ટરનેટ વિષે જાણો છો? હકીકિતમાં તે સંપ્રસારણ અને માહિતી એકત્ર કરવાનું આધુનિકતમ માધ્યમ છે. જો તમારી પાસે કોમ્પ્યુટર હોય અને જો તમે ઈન્ટરનેટની સુવિધા ધરાવી શકતા હો તો તમે એક સેકન્ડના પણ એક ભાગમાં આખી દુનિયામાંથી માહિતી મેળ વી શકો. ઈન્ટરનેટ દ્વારા તમે કોઈપણ વિનિર્માતા અથવા એવા પ્રવતાની વેબસાઈટ ઉપર જઈને માહિતી મેળવી શકો. કયારેક તમારી પાસે વેબસાઈટના સરનામા ન હોય તો તમે ઈન્ટરનેટના સર્વ એન્જિન અથવા પોર્ટલની મદદ લઈ શકો. લગભગ દરેક સર્વ એન્જિન કે પોર્ટલ પર વિવિધ વિનિર્માતા અથવા સેવાદાતાઓ પોતાના ઉત્પાદનની જાહેરાત કરતા હોય છે.



ઇન્ટરનેટ પર જાહેરાત

લાભો:-

૧. તમારા ઘર અંગણે આખી દુનિયાની માહિતી મળી રહે છે.
૨. ઉપયોગ કરનાર પોતાના અનુકૂળ સમયે અને જરૂરિયાત મુજબ જાહેરાત જોઈ શકે છે.

જાહેરાત

મર્યાદાઓ:-

- કોમ્પ્યુટર વિના તેને જોઈ શકાય નહિ.
- તે અભિષ્ણ અથવા ઈન્ટરનેટના ઉપયોગથી અજાણ માટે નિરૂપયોગી છે.

ક. અન્ય માધ્યમ:-

આપણે જાહેરાતના જે માધ્યમોની ચર્ચા કરી તે મોટાભાગના રેડિયો, છાપાં કે મેગેઝીન વગેરેને અમૃક અંશે બાદ કરતા ઘર આંગણે અથવા એકાદ ઓરડામાં વપરાતા હોય છે. વળી આ બધા માધ્યમોમાં જાહેરાત વિષે જાણવા ઉપભોક્તાઓ કોઈને કોઈ ખર્ચ કરવો પડે છે. છતાં કેટલાંક માધ્યમો એવા છે કે જેમાં ઉપભોક્તાઓ કશો ખર્ચ કરવો પડતો નથી. એટલું જ નહી પણ તમે જ્યારે બહાર જતા હો ત્યારે પણ જોઈ શકાય છે. આવી કેટલીક જાહેરાતોમાં હોર્ડિંગ, પોસ્ટરો, વાહન ઉપર જાહેરાત પ્રદર્શન અને ભેટની વસ્તુઓ વગેરેને ગણાવી શકાય.

૧. હોર્ડીંગ:-

રસ્તા ઉપર નીકળતા તમે લોખંડના ચોકઠા ઉપર કે છાપરાની ટોચ ઉપર કે દીવાલો ઉપર મોટા મોટા હોર્ડિંગ જોયા હશે. સામાન્ય રીતે આ જાહેરાત ચીતરેલા પાટિયા હોય છે. અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમોથી ડીજાઈન કરેલ હોય છે. જે રાત દિવસ સહેલાઈથી જોઈ શકાય છે. જાહેરાત દાતાઓએ જ્યાં હોર્ડિંગ મૂક્યાં હોય તે સ્થળનું ભાડું તેના માલિકે આપવું પડે છે.



હોર્ડિંગ પર જાહેરાત

૨. પોસ્ટરો:-

પોસ્ટરોને છાપવામાં આવે છે અને દિવાલો, મકાનો, પુલો વગેરે ઉપર લગાવવામાં આવે છે તેથી લોકોનું (ઉપભોક્તાઓનું) ધ્યાન આકષ્ણી શકાય. આપણા દેશમાં પડા ઉપર દર્શાવાતી ફિલ્મોના પોસ્ટરો છબીઘરો પર લગાડેલા હોય તે દ્રશ્ય સામાન્ય છે.



પોસ્ટર પર જાહેરાત

૩. વાહન પર પ્રદર્શન:-

તમે બસ, ટ્રેન વગેરે જાહેર પરિવહનના સાધનો ઉપર જાહેરાતો જોઈ હશે. હોર્ડિંગની અપેક્ષાએ આ જાહેરાતો ગતિશીલ છે અને અસંખ્ય લોકોને આવરી લે છે.



વાહન પર જાહેરાત



૧૫.૨ પાઠગત પ્રશ્નો

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



૧. નીચેનાને યોગ્ય રીતે જોડો :
- (૧) બસ ઉપર બિરલા સફેદ સિમેન્ટની જાહેરાત (ક) ઈલોક્ટ્રોનિક માધ્યમ
 - (૨) 'ઈન્ડિયા ટુકે'માં આઈસીઆઈસીઆઈ (ખ) અન્ય માધ્યમ
બોકની જાહેરાત
 - (૩) ટીવીમાં મેળી નુડલ્સની જાહેરત (ગ) મુદ્રિત માધ્યમ
૨. યોગ્ય વૈકલ્પય પસંદ કરી ઉત્તર આપો.
૧. નીચેનું કયું લક્ષણ જાહેરાતમાં નથી.
 - અ. અંગત સંદેશાની રજૂઆત.
 - બ. સંદેશાનો કિમત ચુકવીને રજૂઆત.
 - ક. સ્પોન્શાર કરનારની હંમેશા ઓળખ.
 - ડ. કેટલાક માધ્યમ દ્વારા પ્રસારિત.
 ૨. મુદ્રિત માધ્યમમાં સમાવેશ થતો નથી.
 - અ. વર્તમાનપત્રો.
 - બ. સામયિકો.
 - ક. ઈન્ટરનેટ.
 - ડ. પોસ્ટર.
 ૩. બીજાણું માધ્યમનો સમાવેશ થાય છે.
 - અ. હોલ્ડિગસ.
 - બ. વાહનવહાર પર જાહેરાત.
 - ક. ઈન્ટરનેટ.
 - ડ. પોસ્ટર.
 ૪. ટી. વી. દ્વારા જાહેરાત હંમેશા અનુકૂળ હોતી નથી કારણ કે...
 - અ. દ્રશ્યની સાથે જ અવાજની અસર.
 - બ. પ્રત્યક્ષ પ્રસ્તાવ.
 - ક. ખર્ચાળ.
 - ડ. દરેક સ્થળે ટી. વી. હોતા નથી.
 ૫. રેડિયો દ્વારા જાહેરાત માટે યોગ્ય નથી.
 - અ. દ્રશ્યની અસર જરૂરી છે.
 - બ. મર્યાદિત વિસ્તાર.

જાહેરાત

- ક. અશિક્ષિત લોકો.
- ડ. ચોક્કસ પ્રાદેશિક પ્રસારણ સાંભળતા ગ્રાહકો.

૧૫.૪ જાહેરાત માધ્યમની ઉપયુક્તતા

જાહેરાત આપનારે પોતાના ઉત્પાદનને લક્ષ્યમાં રાખીને દરેક માધ્યમની ઉપયોગિતાની બાબતમાં વિચાર કરવો જોઈએ. આ હેતુ માટે તેઓએ ઉત્પાદન કે સેવાનું સ્વરૂપ કે જેની જાહેરાત કરવાની છે તે અને આવા ઉત્પાદન માટે ગ્રાહકોનું લક્ષ્યજૂથ, જાહેરાત માટે ફાળવેલ ખર્ચની રકમ અને દરેક માધ્યમમાં સ્થાન અને સમયની સુલભતા વગેરેનો વિચાર કરવો પડે. છતાં, સામાન્ય રીતે, જાહેરાતના દરેક માધ્યમની ઉપયુક્તતા સંક્ષિપ્ત રીતે નીચે પ્રમાણે જણાવી શકાય.

૧. વર્તમાનપત્ર:-

વર્તમાનપત્રો જન સાધારણ માટેની ઉપભોક્તા સમગ્રીની જાહેરાત માટે સાનુકૂળ છે. નવું ઉત્પાદન દાખલ થાય ત્યારે વર્તમાનપત્રની જાહેરાત અત્યંત ઉપયોગી છે. કારણ કે તે જ જગ્યા નિયમિતરૂપે રોકી શકાય. કિલયરન્સ સેલ, એક્સચેન્જ ઓફર વગેરે માટે પણ વર્તમાનપત્રો સાનુકૂળ છે.

૨. સામયિકો:-

સામયિકો જે તે સામયિકોના લક્ષ્યિત ગ્રાહકોને જરૂરી ઉત્પાદનો માટે સાનુકૂળ છે. દા.ત. કોઈપણ પુસ્તકની જાહેરાત રીડર્સ ડાઝેસ્ટ જેવા કોઈ સામયિકમાં આપી શકાય. કારણ કે આ સામયિકોના લક્ષ્યિત ગ્રાહક વાચક હોય તેવું અનુમાન થઈ શકે છે. એ જ રીતે આંતરિકત સજાવટકારો (ઇન્ટિરિયર ડેકોરેટ્સ), વાસ્તુ શિલ્પીઓ, ભવન નિર્માતાઓ (બિલ્ડરો) વગેરે માટે ખાસ વિશિષ્ટ સ્વરૂપે ડિગ્રીન અને ડેકોરેશનને સમાવતા કોઈ મેગેગીનમાં જાહેરાત આપે તે સલાહભર્યું ગણાય. ઉપભોક્તા સામગ્રી માટે વિશાળ ફેલાવો ધરાવતું કોઈપણ સામયિક ઉપયોગી ગણાય.

૩. રેડિયો:-

ઉત્પાદનની વિવિધ જાતોની જાહેરાત માટે રેડિયો વધુ સાનુકૂળ રહે. છતાં રેડિયો જાહેરાત માટે 'સમય' મહત્વનો છે. દા.ત. ખેડૂતો ખેતરેશી પાછા ફરે પછી સામાન્ય રીતે તેઓ રેડિયો સાંભળતા હોય છે. અને આ સમય દરમિયાન કુષ્ણ ઉત્પાદન કરતી કોઈ કંપની (પેઢી) જાહેરાત આપી શકે અથવા કાર્યક્રમ પ્રાયોજિત કરી શકે.

૪. ટેલીવિઝન:-

ટીવીમાં જાહેરાત આપવા માટે જાહેરાત આપનારે પોતાના ઉત્પાદન માટે યોગ્ય ચેનલ અને કાર્યક્રમની પસંદગી કરવી તે ઘણું અગત્યનું છે. દા.ત. બાળકો માટે ઉપયોગી ઉત્પાદનની જાહેરાત કાર્ટૂન નેટવર્ક ચેનલમાં આપી શકાય. એ જ રીતે કોઈ ધારાવાહિક કે ફિલ્મ દરમિયાન કુટુંબને જરૂરી ચીજ વસ્તુની જાહેરાત આપી શકાય. જે ઉત્પાદનોને ગ્રાહકોને

વાળીજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ




નોંધ



નોંધ

વેચતાં પહેલાં જીવંત નિદર્શન જરૂરી હોય તેમને માટે પણ આ માધ્યમ ઉપયોગી છે.



તમે શું શીખ્યા?

- જાહેરાતમાં કોઈપણ ઉત્પાદક, વેપારી કે સેવાદાતા પોતાના ઉત્પાદન કે સેવા કે વિચારની પોતાના સંભાવ્ય ઉપભોક્તા વર્ગ સમક્ષ રજૂ કરતા હોય તેવી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે.
- જાહેરાતમાં અમુક ખર્ચ થાય છે તે ઉત્પાદક, વેપારી કે સેવાદાતા ભોગવે છે. તેમને પ્રાયોજક અથવા જાહેરાત દેનાર કહે છે.
- કોઈપણ ઉત્પાદન, સેવા કે વિચાર અંતર્ગત સંદેશને જાહેરાત કહે છે.
- પ્રત્યેક જાહેરાતમાં પ્રાયોજકની ઓળખાણ પ્રગટ કરવામાં આવે છે.
- જાહેરાતનો મૂળભૂત હેતુ ગ્રાહકોને ઉત્પાદન કે સેવાની બાબતમાં શિક્ષિત કરવાનો અને એ રીતે તે ખરીદવા તેમને પ્રોત્સાહન કરવાનો હોય છે.
- જાહેરાત કોઈપણ નવા ઉત્પાદનની માંગ ઉભી કરવાનું તેમજ કોઈપણ ચાલુ ઉત્પાદનની માંગ ટકાવી રાખવા કે તેમાં સુધારો કે વધારો કરવાનું કામ કરે છે. છેવટે દરેક જાહેરાત વેપારમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે.
- જાહેરાતના વિવિધ માધ્યમો હોય છે. જેમાં વર્તમાનપત્રો અને સામયિકો (મુક્રિત માધ્યમ), રેડિયો, ટેલીવિઝન અને ઈન્ટરનેટ (ઇલેક્ટ્રોનિક માધ્યમ) હોર્ડિંગ, પોસ્ટરો, વાહનો ઉપર નિદર્શન અને બેટની વસ્તુઓ (અન્ય માધ્યમ) વગેરેનો સમાવેશ થાય છે. દરેક માધ્યમના આગવા લાભ અને ગેરલાભ અને અમુક ચોક્કસ ઉત્પાદન માટેની સાનુક્કુળતા હોય છે.



પાઠાંત પ્રશ્નો

૧. જાહેરાતનો અર્થ શો ? તેમના લક્ષણો જણાવો.
૨. જાહેરાતના કયા માધ્યમનો દરશ્ય-શ્રાવ્ય પ્રભાવ હોય છે ?
૩. અંધજનો જાહેરાતનું કયું માધ્યમ વધારે પસંદ કરશો ?
૪. જાહેરાત આપવી એટલે શું ? તે કયો હેતુ સારે છે ?
૫. વર્તમાનપત્ર દ્વારા જાહેરાતના કયા લાભો અને કઈ મર્યાદાઓ છે ?
૬. સામયિકોમાં જાહેરાત આપવાના લાભો અને મર્યાદાઓ સમજાવો.

જાહેરાત

૭. રેઝિયો જાહેરાતનો અર્થ શો ? તેના લાભો અને મર્યાદાઓ ગણાવો.
૮. જાહેરાતના કોઈપણ ત્રણ ઉદ્દેશો વર્ણાવો.
૯. મેગેઝીનો, ટી.વી., હોર્ડિંગો માટે જાહેરાત અનુકૂળ હોય તેવી કોઈપણ ચાર વસ્તુઓના નામ આપો.
૧૦. જાહેરાતના માધ્યમો એટલે શું ? જાહેરાતના વિવિધ પ્રકારના ઈલેક્ટ્રોનિક માધ્યમો જણાવો.
૧૧. આપણે પૈસા ખર્ચાં સિવાય માહિતી મેળવી શકીએ તેવા વિવિધ પ્રકારના (જાહેરાતના) માધ્યમો સમજાવો.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



પાઠગત પ્રશ્નોના જવાબ

૧૫.૧

- (૧) ખોટું (૨) ખરું (૩) ખરું (૪) ખરું (૫) ખોટું

૧૫.૨

૧. (૧) બ (૨) ક (૩) અ
૨. (૧) અ (૨) ક (૩) ક (૪) ક (૫) અ



જાતે કરો.

➤ વર્તમાનપત્રો, ટેલીવિન્ઝા અને સામયિકો દ્વારા થતી ઉત્પાદન / સેવાઓની જાહેરાતની યાદી બનાવો.



૧૬

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

ધારો કે તમે સાબુખરીદવા બજારમાં જાઓ છો. દુકાનદાર તમને સુચવે છે કે જો તમે બે સાબુની ગોટી ખરીદશો તો "ખરીદો બે, મેળવો ત્રણ" યોજના હેઠળ તમને એક વધારાની સાબુની ગોટી મફત મળશે. તમે આનાથી ખરીદવા માટે આકર્ષણો છો. કારણ કે આમ કરવાથી તમારા એક સાબુખરીદવાના પેસા બચે છે. વળી સાબુદરરોજ વપરાશની વસ્તુ છે. તેથી તમે વધારાની બે ગોટી પછી વાપરવા માટે રાખી મુકી શકો. આ કોઈ ઉત્પાદનના વેચાણમાં વધારો કરવાની રીત છે અને આગળના બે પાઠમાં તમે જે શીખ્યા તેના કરતા તદ્દન જુદી છે. ચાલો આ પાઠમાં આના વિષે વધારે શીખ્યો.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો,

- વેચાણવૃદ્ધિનો અર્થ સમજાવી શકશો.
- વેચાણવૃદ્ધિના હેતુઓ જણાવી શકશો.
- વેચાણવૃદ્ધિમાં વપરાતા વિવિધ ઉપકરણોનું વર્ણન કરી શકશો.
- દરેક ઉપકરણની વેચાણવૃદ્ધિમાં શી ભૂમિકા છે તે ઓળખી શકશો.
- વેપારમાં વેચાણવૃદ્ધિની શી અગત્ય છે તે વર્ણવી શકશો.
- વ્યક્તિગત વેચાણનો અર્થ જણાવી શકશો.
- વ્યક્તિગત વેચાણનો આવશ્યક તત્ત્વો સમજાવી શકશો.
- વ્યક્તિગત વેચાણનું મહત્વ વર્ણવી શકશો, અને
- એક સફળ વિકેતાના ગુણો ઓળખી શકશો.

૧૬.૧ વેચાણવૃદ્ધિનો અર્થ

દરેક વેપારી પોતાની વસ્તુનું વેચાણ વધુ થાય તેમ ઈચ્છે. તે હેતુ માટે તે કેટલીક રીતો અપનાવે છે. તમે કદાચ "લખપતિ બનો", "સિંગાપુરની સફર માણો", "એક કિલોના પેકેંગમાં ૩૦ ટકા વધુ", "કાર્ડ ખોતરો અને ઈનામ જીતો", વગેરે વિષે સાંભળ્યું હશો. કોઈ ખરીદીની સાથે લંઘબોક્સ, પેન્સિલબોક્સ, પેન, શેન્પુ-પાઉચ વગેરે ભેટ અપાતી પણ તમે જોઈ હશો.

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ



વેચાણવૃદ્ધિનો અર્થ

વળી "એક્સચેન્જ ઓફર" (જુની વસ્તુ બદલાવી નવી આપવી) પણ હોય છે. ટેલીવીઝનના ચાલુ મોડલના બદલામાં તમે ઘટાડેલી કિમતે નવું મોડલ મેળવી શકો. તમે તમારી નજીકિની બજારમાં આવી પણ નોટિસો (વિજાપન) જોઈ હો. "વિન્ટર સેલ" (શિયાળુ વેચાણ), "સમર સેલ" (ગ્રીઝ વેચાણ), "ટ્રેડ ફેર" (વ્યાપાર મેળો), "૫૦ ટકા સુધી છૂટ" અને એવી બીજી ઘણી યોજનાઓ હોય છે જે ગ્રાહકોને અમુક વસ્તુ ખરીદવા માટે આકર્ષી શકે. આ બધા જ વિનિર્માતાઓ કે વિકાસારોએ પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે આપેલાં પ્રલોભનો છે. આ અભિપ્રેરણ મફત નમુના, ભેટ, વળતર (છૂટ) કૂપન, નિર્દર્શન, શો (ખેલ), સ્પર્ધાઓ વગેરેના રૂપમાં પણ હોઈ શકે. આ બધા ઉપાયો સામાન્ય રીતે ગ્રાહકોને વધુ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે અને આમ કોઈપણ ઉત્પાદનું વેચાણ વધે છે. વસ્તુઓ વેચવાનો આ અભિગમ "વેચાણવૃદ્ધિ" તરીકે જાણીતો છે.

તમે અગાઉના પાઠોમાં જાહેરાત અને વ્યક્તિગત વેચાણ વિષે શીખી ગયા છો. વ્યક્તિગત વેચાણમાં અમુક જાહેરાત વિશાળ સંખ્યાના સંભવિત ગ્રાહકોને અનુલક્ષીને હોય છે. તેઓ પણ વેચાણની અભિવૃદ્ધિમાં સહાય કરે છે. આમ, ભાવિ ઉપભોક્તાઓને વેચાણવૃદ્ધિ માટે પ્રયુક્ત અભિપ્રેરકો વિષે જાણ માટે જાહેરાતને સંપ્રેષણ માધ્યમ તરીકે પ્રયોજી શકાય છે. એ જ રીતે વ્યક્તિગત વેચાણ દ્વારા પણ વ્યક્તિગત ગ્રાહકોને અભિપ્રેરકોની બાબતમાં સૂચના આપી શકાય. પણ છતાં તકનીકી (પ્રયુક્તિ) અને અભિગમની દ્રષ્ટિએ વેચાણ વૃદ્ધિ જાહેરાત અને વ્યક્તિગત વેચાણથી જુદી પડે છે. વેચાણવૃદ્ધિ વિવિધ પ્રકારે વેચાણમાં વધારો કરવા માટે અલ્પકાલીન, અનાવર્તી પદ્ધતિઓ અપનાવે છે. આ પ્રસ્તાવ ઉપભોક્તાને માટે આખું વર્ષ ઉપલબ્ધ હોતો નથી. આ બધી યોજનાઓ સામાન્ય રીતે બજારમાં તહેવારલ, મોસમનો અંત, વર્ષનો અંત અને એવા અન્ય પ્રસંગોએ ઉપલબ્ધ હોય છે.

આમ વેચાણ વૃદ્ધિમાં જાહેરાત અને વ્યક્તિગત વેચાણને બાદ કરતાં અમુક ચોક્કસ વસ્તુના વેચાણમાં અભિવૃદ્ધિ કરનાર તમામ પ્રવૃત્તિઓ સમાવિષ્ટ હોય છે.



૧૬.૧ પાઠોત્તમો

વાણિજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

નીચેના પ્રશ્નોના જવાબો તેની નીચે આપવામાં આવેલી ખાલી જગ્યામાં આપો.

ક. વેચાણ વૃદ્ધિનો અર્થ શો ?

.....

.....

.....

ખ. જાહેરાત કઈ રીતે વેચાણ વૃદ્ધિમાં મદદ કરી શકે ?

.....

.....

.....

૧૬.૨ વેચાણવૃદ્ધિનું મહત્વ

આજનું વ્યાવસાયિક વિશ્વ હરીફાઈનું વિશ્વ છે. જો વેપારનું કોઈ ઉત્પાદન બજારમાં વેચાય નહીં તો તે વેપાર ટકી શકે નહીં. આમ બધી જ વેપાર પ્રવૃત્તિઓ વેચાણ વધારવા માટે હોય છે. ઉત્પાદકો જાહેરાતોમાં અને વ્યક્તિગત વેચાણમાં પુષ્કળ ખર્ચ કરે છે. તેથી ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે પ્રલોભનો આપવા પડે. કોઈપણ ઉત્પાદનનું વેચાણ વધારવા માટે વેચાણ વૃદ્ધિ જરૂરી છે. ચાલો આપણે વિનિર્માતા અને ઉપભોક્તાઓની દ્રષ્ટિએ વેચાણ વૃદ્ધિની ચર્ચા કરીએ.

નિર્માતાઓની દ્રષ્ટિએ : નિર્માતાઓની દ્રષ્ટિએ વેચાણ વૃદ્ધિ મહત્વની છે કારણ કે,

૧. તે સ્પર્ધાત્મક બજારમાં વેચાણ વધારવામાં સહાય કરે છે અને તેથી નફામાં વધારો થાય છે.
૨. તે સંભવિત ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત બજારમાં નવું ઉત્પાદન દાખલ કરવામાં સહાય કરે છે.
૩. જ્યારે કોઈ નવું ઉત્પાદન દાખલ થાય અથવા ફેશનમાં કે ઉપભોક્તાઓની રૂચિમાં ફેરફાર થાય ત્યારે હાજર માલનો જલ્દી નિકાલ થાય.
૪. તે ગ્રાહકોને પોતાની સાથે રાખીને વેચાણનું પ્રમાણ સ્થિર રાખે છે. તે તદ્દન શક્ય છે કે ગ્રાહકના મનના વિચાર બદલાય અને તે કોઈ નવી ગ્રાન્ડ અજમાવવા પ્રયત્ન કરે. વેચાણ વૃદ્ધિની યોજના વિવિધ પ્રલોભનો ગ્રાહકોને ટકાવી રાખવામાં મદદ કરે છે.

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

ઉપભોક્તાઓની દ્રષ્ટિઓ:-

ઉપભોક્તાની દ્રષ્ટિએ વેચાણ વૃદ્ધિ મહત્વની છે. કારણ કે,

૧. ઉપભોક્તાને વસ્તુ ઓછી કિંમતો મળે છે.
૨. તે ગ્રાહકોને ઈનામો આપીને અને વિવિધ સ્થળોની મુલાકાત કરાવીને આર્થિક ફાયદો કરાવે છે.
૩. ઉપભોક્તા વિવિધ ઉત્પાદનોની ગુણવત્તા, લક્ષણો અને ઉપયોગો વિષે તમામ માહિતી મેળવે છે.
૪. "પૈસા પાછા" જેવી કેટલીક યોજનાઓ ઉપભોક્તાઓના મનમાં વસ્તુની ગુણવત્તા પરત્યે વિશ્વાસ ઉત્પન્ન કરે છે.
૫. તે લોકોનું જીવન ધોરણ ઉચ્ચ લાવવામાં સહાય કરે છે. પોતાની જુની વસ્તુઓનો વિનિમય કરીને તેઓ બજારમાં પ્રાપ્ય આધુનિકતમ વસ્તુઓ વાપરી શકે છે અને આવી વસ્તુના ઉપયોગથી તેમની સામાજિક છબી સુધરે છે.



૧૬.૨ પાઠગત પ્રશ્નો

નીચેનામાંથી ક્યાં વિધાન 'ખરા' છે કે 'ખોટા' છે ?


૧૬.૩ વેચાણવૃદ્ધિનાં ઉપકરણો: (ઉપાયો, તરકીબો)

કોઈપણ ઉત્પાદની વેચાણ વૃદ્ધિ કરવા માટે ઉત્પાદક કે વિનિર્માતા જાતજાતની તરકીબો અજમાવે છે. જેમ કે નમુનો, ભેટ, બોનસ અને એવી બીજી ઘણી યુક્તિઓ. એમને વેચાણ વૃદ્ધિનાં ઉપકરણો કે પ્રયુક્તિઓ કે પદ્ધતિઓ કહેવામાં આવે છે. ચાલો આપણે સામાન્ય તથા પ્રચલિત એવી કેટલીક વધારે વેચાણ વૃદ્ધિની તરકીબો વિષે જાણીએ.

૧. મફત નમુનો:-

તમે બજારમાં વિવિધ વસ્તુઓ ખરીદતા હશો ત્યારે તમને શેંપુ, કપડાં ધોવાનો પાઉડર, કોઝીની ભુકી વગેરે મફત નમુના મળ્યા હશે. કયારેક તો દુકાનદાર તેની પાસેથી કોઈપણ વસ્તુ ખરીદી ન હોવા છતાં આવા મફત નમુના વહેચતો હોય છે. આ નમુનાઓ ગ્રાહકોને કોઈ નવું ઉત્પાદન વાપરી જોવા આકર્ષવા અને તે રીતે નવા ગ્રાહક

વાણિજ્ય વ્યવસ્થા



મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



બનાવવા માટે વહેંચવામાં આવે છે. કેટલાક વેપારીઓ ઉત્પાદનને લોકપ્રિય બનાવવા માટે પસંદ કરેલા ગ્રાહકોમાં મફત નમુના વેચતા હોય છે. દા.ત. દવાની બાબતમાં મફત નમુના કોઈ ડોક્ટરને આપવામાં આવે છે, પુસ્તકોના મફત નમુનાની નકલ શિક્ષકોને આપવામાં આવે છે.

૨. પ્રીમિયમ કે બોન્સ આપવું:-

નેસકોઝી સાથે ભિલ્ક શેકર, બોન વીટા સાથે અકે મગ (ખાલુ), ૫૦૦ ગ્રામ ટૂથપેસ્ટ સાથે ટૂથ બ્રશ, એક કિલોગ્રામના પેકીંગમાં ૧૦ ટકા વધારે વગેરે વસ્તુઓ અમુક વસ્તુની ખરીદી ઉપર પુરસ્કાર રૂપે મફત મળતા વસ્તુઓનાં ઉદાહરણો છે. આવા પ્રસ્તાવો ઉપભોક્તાઓને અમુક ચોકક્સ વસ્તુ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં અસરકારક સાબિત થાય છે. ચાલુ ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં અને પુરસ્કૃત કરવામાં પણ ઉપયોગી છે.



૩. વસ્તુ વિનિમય પ્રસ્તાવ:-

આ યોજનામાં જુની વસ્તુ આપીને નવી વસ્તુ તેની મૂળ કિમત કરતાં ઓછી કિમતે અદલાબદ્દી થઈ શકે છે. સુધારેલા ઉત્પાદન તરફ ગ્રાહકોનું ધ્યાન ખેંચવા પણ આ ઉપયોગી છે. તમારું જુનું મિક્સર-કમ-જ્યુસર લઈ આવો અને માત્ર રૂ.૫૦૦/- ભરી નવું લઈ જાઓ. અથવા તમારા બ્લેક એન્ડ બાઈટ (શ્વેત-શ્યામ) ટી.વી. ને બદલે કલર ટી.વી. લઈ જાઓ વગેરે આ વિનિમય યોજનાના ઉદાહરણો છે.



૪. કિમતમાં છૂટ પ્રસ્તાવ:-

આ પ્રસ્તાવ હેઠળ ઉત્પાદનો તેમની મૂળ કિમત કરતાં ઓછી કિમતે વેચવામાં આવે છે. "એક લાઈફબોય સાથુ ઉપર ૨/- રૂપિયાની છૂટ", "તાજમહાલ ચાના ૨૫૦ ગ્રામના પેકેટ ઉપર ૧૫/- રૂપિયાની છૂટ", "એક કુલરની ખરીદી ઉપર રૂ.૧૦૦૦/-ની છૂટ" વગેરે કેટલીક સામાન્ય યોજનાઓ છે. મંદીના સમયમાં અને કયારેક નવું ઉત્પાદન બજારમાં ચાલુ કરવા વખતે તેને બધાવો આપવા માટે આ પ્રકારની યોજના તૈયાર કરવામાં આવે છે.



૫. કુપનો:-

કયારેક કોઈ વસ્તુના નિર્માતાઓ ઉત્પાદનના પેકેટની અંદર અથવા વર્તમાનપત્ર કે મેગેગ્રીનોમાં છપાયેલી જાહેરાત દ્વારા અથવા ટપાલ દ્વારા કુપનોનું વિતરણ કરે છે. વસ્તુ ખરીદી વખતે કુપન છૂટક



વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

વેપારી પાસે રજૂ કરી શકાય. કુપન ધારકને વસ્તુની ખરીદીમાં અમુક વળતર (છૂટ) મળે છે. દા.ત. તમે એવી કુપનો જોઈ હશે કે "આ કુપન ટેખાડો એ પાંચ કિલોગ્રામ અન્નપુર્ણા આટા પર રૂ. ૧૫/- છૂટ મેળવો" આ યોજના હેઠળ વસ્તુની ઘટાડેલી કિમત સંભવિત ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે આકર્ષ છે.

૬. મેળા અને પ્રદર્શનો:-

કોઈપણ નવા ઉત્પાદનનો પરિચય કરાવવા તેનું નિર્દર્શન કરવા, અને તેના વિશિષ્ટ લક્ષણો અને ઉપયોગિતા સમજાવવા સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળાઓ અને પ્રદર્શનો યોજાતા હોય છે. વસ્તુઓને સજાવટ કરી પ્રદર્શિત કરવામાં આવે છે. તેમનું નિર્દર્શન કરવામાં આવે છે અને વ્યાજબી છૂટ આપી તેનું



વેચાણ પણ કરવામાં આવે છે. નવી દિલ્હી ખાતે પ્રગતિ મેદાનમાં દર વર્ષ ૧૪ નવેમ્બરથી ૨૭ નવેમ્બર સુધી યોજવામાં આવતો "અંતર રાષ્ટ્રીય વ્યાપારી મેળો" એ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિના રૂપમાં એક પ્રખ્યાત ઉદાહરણ છે.

૭. વ્યાપારી ટિકિટો:-

કેટલીક અમુક ચોકક્સ પ્રકારની વસ્તુઓ ખરીદતાં ગ્રાહકોને ખરીદીના મૂલ્યના પ્રમાણમાં વ્યાપારી ટિકિટો આપવામાં આવે છે. જે ગ્રાહક અમુક નિશ્ચિત મૂલ્યની ટિકિટો નિશ્ચિત મર્યાદામાં એકઢા કરી શકે તો તે અમુક લાભો માટે હક્કદાર બને છે. આ પ્રયુક્તિ ગ્રાહકોને નિશ્ચિત મૂલ્યની ટિકિટો ભેગી કરવા માટે જે તે ઉત્પાદન વારંવાર ખરીદવા પ્રેરિત કરે છે.

૮. ખોતરો અને જીતો પ્રસ્તાવ:-

ગ્રાહકોને ચોકક્સ વસ્તુ ખરીદવા અભિપ્રેરિત કરવા માટે 'ખોતરો અને જીતો' યોજના પણ રજૂ કરવામાં આવે છે, આ યોજના મુજબ ગ્રાહક ઉત્પાદનના પેકેટ ઉપર નિર્ધારિત કરેલી જગ્યાએ ખોતરે (ઘસે, ઉગરડે) તેની નીચે લખેલી સૂચના મુજબ ગ્રાહકને નિશ્ચિત જગ્યામાં જણાવ્યા મુજબ કોઈ વસ્તુ મફત મળે છે. અથવા કિમતમાં છૂટ મળે છે. અથવા તો નિર્માતા દ્વારા આયોજિત પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકે છે.



૯. પૈસા પરત પ્રસ્તાવ:-

આ યોજના હેઠળ ગ્રાહકોને ખાતરી આપવામાં આવે છે કે જો વસ્તુ વાપર્યા પછી તેમને સંતોષ ન થાય તો પૈસા પાછા આપવામાં આવશે. આનાથી ગ્રાહકોના મનમાં ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યે



મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

મોડયુલ - ૪

ખરીદ - વેચાણ અને વિતરણ



નોંધ

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

વિશ્વાસ જાગૃત થાય છે. આ પ્રયુક્તિ મોટે ભાગે કોઈ નવું ઉત્પાદન બજારમાં દાખલ કરતી વખતે ખાસ કરીને ઉપયોગી છે.



૧૬.૩ પાઠગત પ્રશ્નો

સાધનો / પ્રયુક્તિઓને યોગ્ય રીતે હેતુઓ સાથે જોડો.

સાધનો / પ્રયુક્તિઓ

- (૧) મફત નમુના વિતરણ
- (૨) વસ્તુ વિનિમય યોજના
- (૩) મૂલ્યમાં છૂટનો પ્રસ્તાવ
- (૪) વ્યાપારી ટિક્ઝો

હેતુઓ

- (ક) ગ્રાહકને એક વસ્તુ વારંવાર લેવા પ્રેરે છે.
- (ખ) ઉત્પાદન સુધીરણા તરફ ધ્યાન દોરવું.
- (ગ) નવું ઉત્પાદન બજારમાં પ્રસ્તુત કરવું
- (ઘ) મંદીમાં વેચાણમાં વધારો કરવો

૧૬.૪ વ્યક્તિગત વેચાણ

જ્યારે તમારે કંઈક ખરીદવું હોય ત્યારે તમે તેને લગતી દુકાને જઈને ત્યાંથી ખરીદો છો.



પણ કેટલીકવાર લોકો અમુક વસ્તુ કે ઉત્પાદન તમારી પાસે લાવે છે અને તમારે ઘેર વસ્તુ પહોંચાડે છે. દાત. હાથ લારીઓ (સ્કર્ડીઓ)માં શાકભાજી, ચોખા વગેરે ભરીને એક ઘેરથી બીજા ઘેર જતા અને ઘેર ઘેર વેચતા લોકો તમે જોયા હશો. એ જ રીતે સાડી, કાર્પોર(જાજમ), વિજાળું ઉપકરણો વગેરે પણ ઘેર ઘેર વેચતા લોકો તમે જોયા હશો.

તમે જ્યારે સ્થાનિક બસો કે ટ્રેઇનમાં લોકોને પેન, રમકડાં, ચોપડીઓ, દાંતિયો વગેરે વેચતા જોયા હશો. મોટા શહેરમાં પણ જણ શોધક, વાયુ શોધક (શુદ્ધ કરનાર) કપડા ધોવાનો પાઉડર, મછિર દૂર કરવાનું સાધન વગેરે ઘેર ઘેર વેચવા ફરતા લોકો તમે જોયા હશો. તમને નથી લાગતું કે વસ્તુઓને દુકાનમાં રાખીને વેચવા કરતા આ કંઈક જુદી જ વસ્તુ વેચવાની પદ્ધતિઓ છે? આ પાઠમાં ચાલો આપણો આ પ્રકારના વેચાણો વિષે વધારે શીખીએ.

૧૬.૫ વ્યક્તિગત વેચાણનો અર્થ

તમારી પાસે વસ્તુઓ અને માલસામાન વેચવા આવતા માણસોની કલ્પના કરો. તેઓ શા માટે એમ ઈચ્છે છે? તેઓ તમને માલસામાનના કેટલાક વિવિધ નમુનાઓ દેખાડે છે.

વेचाण, वृद्धि अने व्यक्तिगत वेचाण

ઉત्पादननी विशेषताओ तमने समજाववा प्रयत्न करे છે, જો જરૂર પડે તો વस્તુ કઈ રીતે કામ કરે છે તેનું પ્રત્યક્ષ નિર્દર્શન પણ કરે છે. કિંમતમાં કેટલું વળતર (ધૂટ) મળશે તેની માહિતી આપે છે. વસ્તુ ખરીદવા તમને આગ્રહ કરે છે અને તમને ગમતી વસ્તુ ભવિષ્યમાં લાવી આપવાનું વચન સુધ્યાં આપે છે. આમ તેઓ વસ્તુ વિષે માત્ર તમને જણાવતા કે સમજાવતા જ નથી પણ તમને તે વસ્તુ ખરીદવા આગ્રહ પણ કરે છે. એટલું જ નહીં પણ ભવિષ્યમાં પણ તમે તેમની પાસેથી જ ખરીદો તેવી આશા રાખે છે. આની સામે તમે પણ તે ઉત્પાદન વિષે વધારે માહિતી ઓક્ટી કરવા પ્રયત્ન કરો છો અને તેને જુઓ છો અનો વધારે સારી રીતે અંદાજ કાઢવા તને વાપરી પણ જુઓ છો, જેથી ખરીદવાનો નિર્ણય કરી શકાય.

જે વ્યક્તિ તમને આ રીતે વસ્તુ વેચે છે તેને 'વિકેતા' કહે છે અને વિકયની આ તકનીકી (પ્રયુક્તિ)ને 'વિકયકલા' (સેલ્સમેનશીપ) કહે છે. આ રીતે વ્યક્તિગત વેચાણનો અર્થ છે સંભવિત ગ્રાહક પાસે વસ્તુ રજૂ કરવી અને તે ખરીદવા માટે તેને સમજાવી વસ્તુ ખરીદવા તૈયાર કરવો. આમ આમાં વેચનાર અને ખરીદનારની રૂબરૂ પરસ્પર ચર્ચા અને ખરીદવાની વસ્તુની ભૌતિક ચકાસણી આવશ્યક છે. આમાં કોઈ વ્યક્તિને વસ્તુ માત્ર વેચવી એટલો જ હેતુ નથી પણ તેને કાયમી ગ્રાહક બનાવવાનો પણ હેતુ સમાયેલો છે.

ઘણી દુકાનોમાં પણ આ પ્રયુક્તિ અજમાવવા માટે દુકાનદારે રોકેલા આવા વિકતાઓ તમને જોવા મળશે. દા.ત. ઘરેણા (જવેરાત)-ની દુકાન, ઉપભોક્તા વસ્તુ ભંડાર, સાડીની દુકાન વગેરેમાં પણ તમને આવા સેલ્સમેન જોવા મળશે. કેટલીક સેવાઓની બાબતમાં તમને દુકાનોમાં પણ વ્યક્તિગત વેચાણ જોવા મળે. દા.ત. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો એક જ હજામની દુકાને જતા હોય છે અને અમુક ચોક્કસ હજામ પાસે જ વાળ કપાવતા હોય છે અને માલિસ (ચંપી) કરાવતા હોય છે. આ દર્શાવે છે કે વ્યક્તિગત વેચાણની બાબતમાં વિકેતાઓ ગ્રાહકની રૂચિ અને પસંદગી જાણવી પડે છે અને એ રીતે તેઓ પોતાની વસ્તુ કે સેવાઓ ખરીદવા તેમને આકર્ષતા હોય છે. વ્યક્તિગત વેચાણનો ખ્યાલ મેળવ્યા પછી ચાલો આપણે વ્યક્તિગત વેચાણના કેટલાક આવશ્યક તત્ત્વો વિષે જાણીએ.

૧૬.૬ વ્યક્તિગત વેચાણના આવશ્યક તત્ત્વો

વ્યક્તિગત વેચાણમાં નીચેના તત્ત્વો સમાવિષ્ટ છે.

- ૧. રૂબરૂ ચર્ચા:**— વ્યક્તિગત વેચાણમાં વિકેતા સંભવિત ગ્રાહક સાથે રૂબરૂ (પ્રત્યક્ષ) વાતચીત કરે તે અપેક્ષિત છે.
- ૨. પ્રેરણા:**— વ્યક્તિગત વેચાણમાં વિકેતા સંભવિત ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે પ્રેરણા આપે તે જરૂરી છે. તેથી વિકેતામાં ગ્રાહકોને પોતાની વાત ગણે ઉતારવાની આવડત (ક્ષમતા) હોવી જોઈએ, જેથી ગ્રાહકના મનમાં તે વસ્તુ ખરીદવા માટે રસ ઉત્પન્ન થાય.

મોડયુલ – ૪

ખરીદ – વેચાણ અને વિતરણ



નોંધ

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

૩. **લચીલાપણું:-** વ્યક્તિગત વેચાણનો અભિગમ હંમેશા લવચીક હોય છે. ક્યારેક વિકેતા ઉત્પાદનની વિશેષતાઓ અને લાભો સમજાવતો હોય, કેટલીક વાર વસ્તુના ઉપયોગનું નિર્દર્શન કરી દેખાડતો હોય, વળી ક્યારેક તેણે ગ્રાહકોએ પૂછેલા ઠગલાબંધ પ્રજ્ઞાનો પણ સામનો કરવો પડે. ગ્રાહકની પરિસ્થિતિ અને રસ જોઈને વિકેતા તાત્કાલિક પોતાનો અભિગમ નક્કી કરી લેતો હોય છે.
૪. **વેચાણની વૃદ્ધિ (ક્રીલાવો):-** વ્યક્તિગત વેચાણનો આખરી ઘોય છે વધારે ને વધારે ગ્રાહકોને પોતાની વસ્તુ વાપરવા સમજાવીને વેચાણમાં વૃદ્ધિ કરવી.
૫. **માહિતી પ્રદાન:-** વ્યક્તિગત વેચાણમાં ગ્રાહકને વસ્તુ ક્યાંથી મળશે, તેના વિશિષ્ટ લક્ષણો કયા છે, ઉપયોગો કેટલા છે, વસ્તુની ઉપયોગિતા શી છે વગેરે જાતજાતની માહિતી આપવામાં આવે છે. આમ તે એક શૈક્ષણિક પ્રક્રિયા છે.
૬. **પારસ્પરિક લાભ:-** આ એક દ્વિ-માર્ગીય પ્રક્રિયા છે. વિકેતા અને ગ્રાહક બંનેને આમાંથી લાભ મળે છે. ગ્રાહકો જ્યારે વસ્તુ ખરીદીને સંતોષ પામે છે ત્યારે વિકેતાને તેનો લાભ (નફો) મળે છે.



૧૬.૪ પાઠગત પ્રશ્નો

યોગ્ય શબ્દોથી નીચેની ખાલી જગ્યા પૂરો

૧. વ્યક્તિગત વેચાણમાં વસ્તુ ખરીદવા ને સમજાવવો પડે છે.
૨. વ્યક્તિગત વેચાણનો અંતિમ ઘોય છે.....
૩. વ્યક્તિગત વેચાણનું સૌથી અગત્યનું તત્ત્વ છે ચર્ચા.
૪. ગ્રાહકોને માહિતી પૂરી પાડવાને લીધે વ્યક્તિગત વેચાણ એક પ્રક્રિયા બની રહે છે.

૧૬.૭ વ્યક્તિગત વેચાણનું મહત્વ

વ્યક્તિગત વેચાણ અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે તે વેચાણ વધારવામાં મદદ કરે છે. પણ તેને અગત્યનું બનાવનાર બીજા પણ કેટલાંક લક્ષણો છે. ચાલો આપણે ઉત્પાદક અને ગ્રાહક બંનેના દ્રષ્ટિબંદુથી વ્યક્તિગત વેચાણના મહત્વની ચર્ચા કરીએ.

ઉત્પાદકોની દ્રષ્ટિઓ:-

૧. આ નવા તેમજ પ્રચલિત એમ બંને ઉત્પાદનોની માંગ પેદા કરે છે.
૨. આ નવા નવા ગ્રાહકો ઉત્પન્ન કરે છે અને આ રીતે ઉત્પાદનનું બજાર વિસ્તારવામાં સહાયક બને છે.

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

૩. આનાથી ઉત્પાદનમાં સુધારો પણ થાય છે. (રૂભરૂ) પ્રત્યક્ષ રીતે વેચાણ કરતાં વિકેતા ગ્રાહકોની પસંદગી અને માંગણીથી પરિચિત થાય છે અને તે મુજબ તે ઉત્પાદકોને યોગ્ય સૂચનો કરે છે.

ગ્રાહકોની દ્રષ્ટિઓ:-

૧. વ્યક્તિગત વેચાણ બજારમાં પ્રવેશેલાં નવાં નવાં ઉત્પાદન વિષે ગ્રાહકોને જાણકારી મેળવવાની તક આપે છે. આમ તે ગ્રાહકોને નવા ઉત્પાદન વિષે માહિતી તેમજ શિક્ષણ આપે છે.
૨. વ્યક્તિગત વેચાણના કારણો જ ગ્રાહકો બજારમાં આવેલા નવાં નવાં ઉત્પાદનોના ઉપયોગ વિષે જાણકારી મળે છે. વિકેતાએ ઉત્પાદનનું સંભવિત ગ્રાહકો સમજ નિર્દર્શન કરે છે અને ગ્રાહકોને તેના ઉપયોગ અને ઉપયોગિતા સમજાવે છે.
૩. વ્યક્તિગત વેચાણ ગ્રાહકને તેમની જરૂરિયાત અને રૂચિ મુજબ કયો માલ સૌથી વધુ અનુકૂળ આવશો તે વિષે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. કારણ કે તેમાં સામસામે મોટામોઠ વાતચીત થતી હોય છે.
૪. વ્યક્તિગત વેચાણ ઉત્પાદનના ઉપયોગમાં પડતી મુશ્કેલીઓ અને પોતાની ફરિયાદો રજૂ કરવાની ગ્રાહકને તક આપે છે. એટલું જ નહીં તેનો ઉકેલ પણ તાત્કાલિક મળે છે.



૧૬.૫ પાઠગત પ્રશ્નો

નીચેના કયા વિધાન 'ખરા' છે અને કયા 'ખોટા' છે ?

૧. વ્યક્તિગત વેચાણ વિકેતાઓએ કરેલાં સૂચનના આધારે પોતાનું ઉત્પાદન સુધારવામાં ઉત્પાદકોને સહાયક બને છે.
૨. કોઈપણ ઉત્પાદન વિષે ગ્રાહક વિકેતા પાસેથી તાત્કાલિક ઉકેલ મેળવી શકતો નથી.
૩. વ્યક્તિગત વેચાણથી માત્ર પ્રચ્યલિત ઉત્પાદનો માટે જ નવા નવા ગ્રાહકોને ઉત્પન્ન થાય છે.
૪. ઉત્પાદનનો વધુ સારો ઉપયોગ વ્યક્તિગત વેચાણનું પરિણામ નથી.
૫. ગ્રાહકો ઉત્પાદનના બારામાં વિકેતાને ફરિયાદ કરી શકે નહીં.

૧૬.૬ વ્યક્તિગત વેચાણ કરતા વિકેતાના ગુણો

વ્યક્તિગત વેચાણ કરતા વિકેતાના ગુણોની યાદી બનાવવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે આ યોગ્યતાઓ સમય અને પરિસ્થિતિ અનુસાર બદલતી રહે છે. વળી ઉત્પાદનનો પ્રકાર અને ગ્રાહકોની માંગ ઉપર પણ તેનો આધાર રહે છે. વળી, એવું પણ બને કે એક વિકેતા એક પરિસ્થિતિમાં અસરકારક રહ્યો હોય તે બીજી પરિસ્થિતિમાં બિન અસરકારક નીવડે. તેથી વાસ્તવિક જીવનમાં અમુક વિશિષ્ટ ઉત્પાદન શ્રેણી માટે અમુક ગુણો સાનુક્કુણ હોય તે

વાણિજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ




નોંધ



અન્ય માટે અપ્રસ્તુત કરે તેવું પણ બને. છતાં એવા કેટલાક સામાન્ય ગુણો છે. જે જીવનમાં સફળ થવા માટે દરેક વિકેતામાં હોવા જરૂરી છે.

વ્યક્તિગત વેચાણ કરતા વિકેતાના ગુણો



આ ગુણોની યાદી નીચે આપેલ છે.

૧. શારીરિક યોગ્યતા
૨. માનસિક યોગ્યતા
૩. સચ્ચચિત્ર
૪. ઉત્પાદન અને કંપનીનું જ્ઞાન
૫. સારો વ્યવહાર (સારું વર્તન)
૬. સજાવટ (પ્રેરણ) ની શક્તિ

આલો હવે આપણે ઉપરની યોગ્યતાઓની ચર્ચા કરીએ.

૧. **શારીરિક યોગ્યતા:**— વિકેતા દેખાવડો અને પ્રભાવશાળી વ્યક્તિ ઉપરાંત સંગીન સ્વાસ્થ્ય ધરાવતો હોવો જોઈએ.
૨. **માનસિક (બૌધિક) યોગ્યતા:**— એક સારા વિકેતામાં કેટલાક બૌધિક ગુણો હોવા જોઈએ. જેમ કે કલ્પનાશીલતા પહેલ કરવાની શક્તિ, આત્મવિશ્વાસ, તીવ્ર સ્મર્ણશક્તિ સતર્કતા વગેરે તેનામાં ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓ સમજી જવાની આવડત જોઈએ.
૩. **સચ્ચચિત્ર:**— એક સારા વિકેતામાં પ્રામાણિકતા અને સમન્વય જેવા ગુણો હોવા જોઈએ. તેણે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે. તે તેમની જરૂરિયાતો જાણવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ અને તેમની જરૂરિયાતો કઈ રીતે સંતોષી શકાય તે વિષે તેણે માર્ગદર્શન આપવું જોઈએ. તેના માલિકને પણ તેનામાં શ્રદ્ધા હોવી જોઈએ. વિકેતા ગ્રાહક અને શેઠ બંને પ્રત્યે વફાદાર હોવો જોઈએ.
૪. **ઉત્પાદન અને કંપનીનું જ્ઞાન:**— વિકેતામાં ઉત્પાદન અને પોતે જે કંપનીનો પ્રતિનિધિ છે તેનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ તે ઉત્પાદનનું દરેક દરેક પાસું સમજાવી શકવા સમર્થ હોવો જોઈએ. દા.ત. તેના ગુણો, તેનો કેવી રીતે

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

ઉપયોગ કરવો, કેવી કેવી તક્કેદારી (સાવચેતી) રાખવી વગેરે તે કંપનીના વ્યાપાર અને વ્યાવસાયિક વિવરણ વિષે સમજાવી શક્યા સક્ષમ હોવો જોઈએ. ઉપરાંત હરીજોના ઉત્પાદનનું પણ તેને શાન જોઈએ જેથી તે પોતાના ઉત્પાદનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી શકે.

૫. **સદ્વર્તન (સારો વ્યવહાર):-** વિકેતા સહયોગ પૂર્ણ અને શિષ્ટાચારી હોવો જોઈએ. સદ્વર્તન માણસને ગ્રાહકનો વિશ્વાસ જીતવા શક્તિ આપે છે. કદાચ કોઈ ગ્રાહક અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નો કરે તો પણ તેણે ઉશ્કેરાઈ જવું ન જોઈએ. વળી જે વ્યક્તિને તે સમજાવવા પ્રયત્ન કરતો હોય તે વસ્તુ ખરીદે જ એ પણ જરૂરી નથી. વિકેતાએ દરેક પ્રસંગે શાંત અને વિવેકી રહેવું જોઈએ.
૬. **સમજાવટ (પ્રેરણા)ની શક્તિ:-** સારો વિકેતા વાતચીતમાં નિષ્પુપ હોવો જોઈએ કે જેથી તે જે વ્યક્તિત્વ સાથે વાત કરતો હોય તેને વાતચીતમાં જકડી રાખી શકે. તે તેને સમજાવી શકવા અને તેના મગજમાં પોતાની વસ્તુ ખરીદવાની ઈચ્છા જાગૃત કરવા સક્ષમ હોવો જોઈએ.



૧૬.૬ પાઠગત પ્રશ્નો

- નીચેના વિધાનો 'ખરા' છે કે 'ખોટા' તે જણાવો.
 - સારો વિકેતા બનવા માટે ઉત્પાદનનું શાન જરૂરી નથી.
 - સારા વિકેતામાં કલ્પના શક્તિ, પહેલ કરવાની શક્તિ અને સતર્કતા હોવા જોઈએ.
 - સારા વિકેતા માટે સમાજ તેને સ્વીકારે તે જરૂરી નથી.
 - સારો વિકેતા ઉપભોક્તાને વફાદર હોવો જોઈએ. શેઠને નહિ.
 - પ્રભાવશાળી અવાજ, સોખામણો ટેખાવ અને સંગીન સ્વાસ્થ્યને સારા વિકેતાના ગુણો કોઈ સ્થાન નથી.
- વૈકલ્પિક પ્રશ્નો

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ



તમે શું શીખ્યા?

- જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સિવાયની વસ્તુના વેચાણમાં વૃદ્ધિ કરનારી તમામ સંવર્ધન પ્રવૃત્તિઓ વેચાણ વૃદ્ધિમાં સમાવિષ્ટ હોય છે.
- વેચાણ વૃદ્ધિના હેતુઓ:- નવું ઉત્પાદન પ્રસ્તુત કરવું નવા ગ્રાહકોને આકર્ષવા અને જુનાને ટકાવી રાખવા, મોસમી ઉત્પાદનનું વેચાણ ટકાવી રાખવું, સ્પર્ધાઓ સામે પડકાર ફેંકવો.
- વેચાણ વૃદ્ધિમાં ઉપયુક્ત ઉપકરણો / પ્રયુક્તિઓ:- નમુનાની મજબૂત વહેચણી, પ્રીમિયમ કે બોનસ (વળતર કે બોણી) પ્રસ્તાવી વસ્તુ વિનિમય યોજના, ઘટાડેલા ભાવ, કુપન, મેળા અને પ્રદર્શનો, વ્યાપારી ટિકિટો, ખોતરો (ઘસો) અને જીતો, પૈસા પાછા પ્રસ્તાવ.

વેચાણ વૃદ્ધિનું મહત્વ:-

- ઉત્પાદકો માટે: વેચાણનો વ્યાપ વધારે છે, બજારમાં નવું ઉત્પાદન પ્રચલિત કરવામાં મદદ કરે છે. તથા સુધારો કરે છે. હાજર માલનો ઝડપી નિકાલ કરી શકાય છે અને વેચાણની માત્રામાં સ્થિરતા.
- ઉપભોક્તાઓ માટે: નવા ગ્રાહકો ઉભા (સર્જવા) કરવા, સસ્તા દરે વસ્તુ મળી રહે છે, ઉપભોક્તાઓને આર્થિક લાભ, નવી વસ્તુઓનો (બ્રાન્ડોનો) પરિચય થાય છે. ગુણવત્તાની બાબતમાં ઉપભોક્તાના મનમાં વિશ્વાસ પેદા કરે છે અને જીવનધોરણ ઉચ્ચ લાવે છે.
- વ્યક્તિગત વેચાણનું તાત્પર્ય એ છે કે ગ્રાહકો સમક્ષ વસ્તુઓ અને સેવાઓ એ રીતે રજૂ કરવી કે તે વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે તેમને પ્રેરી શકાય અને સહમત કરી શકાય.
- વ્યક્તિગત વેચાણ માટે જરૂરી તત્વો: રૂખરૂ ચર્ચા, પ્રેરણા, લચીલાપણું, વેચાણની વૃદ્ધિ (ફિલાવો), માહિતી પ્રદાન અને પારસ્પરિક લાભ.
- વ્યક્તિગત વેચાણ ઉપભોક્તા અને ઉત્પાદક બંનેની દ્રષ્ટિઓ મહત્વનું છે.
- એવી ઘણી યોગ્યતાઓ છે કે જે વિકેતા માટે પ્રભાવક હોય. તેમાં શારીરિક યોગ્યતા, માનસિક યોગ્યતા, સચ્ચારિત્ર ઉત્પાદન અને કંપનીનું શાન, સારો વ્યવહાર (સદર્વતન) અને સમજાવટ (પ્રેરણા) ની શક્તિ વગેરે મુખ્ય છે.



પાઠંત પ્રશ્નો

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

૧. વેચાણ વૃદ્ધિની વ્યાખ્યા આપો.
૨. ઉત્પાદકોની દ્રષ્ટિઓ વેચાણ વૃદ્ધિની અગત્ય જણાવો.
૩. ઉપભોક્તાની દ્રષ્ટિઓ વેચાણવૃદ્ધિની અગત્ય જણાવો.
૪. વેચાણ વૃદ્ધિના છ ઉપકરણોની યાદી બનાવો.
૫. વેચાણ વૃદ્ધિનો અર્થ સમજાવો. વેચાણ વૃદ્ધિ શા માટે જરૂરી છે.
૬. વેચાણ વૃદ્ધિના કોઈપણ બે હેતુ, દરેકના ઉદાહરણ સાથે સમજાવો.
૭. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિ તરીકે 'કિમતમાં છૂટ' અને 'મફત નમુના' સમજાવો.
૮. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ વેચાણ વધારવામાં કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.
૯. એક ટૂથપેસ્ટ કંપની ૫૦૦ ગ્રામ ટૂથપેસ્ટ સાથે ૨૫૦ ગ્રામ ટૂથપેસ્ટ મફત આપે છે. આમાં વેચાણ વૃદ્ધિની કઈ પ્રયુક્તિ વપરાઈ તેનું નામ આપો. આ યોજનામાં વિશિષ્ટ હેતુ ક્યો છે? આ સિવાયની બીજી બે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો.
૧૦. વેચાણ વૃદ્ધિની વ્યાખ્યા આપો. વેચાણ વૃદ્ધિના હેતુઓ જણાવો.
૧૧. વેચાણ વૃદ્ધિનો અર્થ સમજાવો. વેચાણ વૃદ્ધિના કોઈપણ ચાર પ્રયુક્તિઓ ચર્ચો.
૧૨. વેચાણ વૃદ્ધિ વિનિર્માતાઓ અને ઉપભોક્તા બંનેને માટે ઉપયોગી છે. સમજાવો.
૧૩. વ્યક્તિગત વેચાણ એટલે શું ?
૧૪. વ્યક્તિગત વેચાણના મુખ્ય તત્ત્વો જણાવો.
૧૫. ગ્રાહકની દ્રષ્ટિઓ વ્યક્તિગત વેચાણની અગત્ય જણાવો.
૧૬. વિનિર્માતાઓની દ્રષ્ટિઓ વ્યક્તિગત વેચાણનું મહત્વ સમજાવો.
૧૭. વ્યક્તિગત વેચાણમાં વ્યસ્ત વિકેતાની શારીરિક અને બૌધિક યોગ્યતાઓ જણાવો.
૧૮. વ્યક્તિગત વેચાણમાં વ્યસ્ત વ્યક્તિની સામાજિક યોગ્યતાઓ જણાવો.
૧૯. વ્યક્તિગત વેચાણમાં વ્યસ્ત વિકેતાના વ્યાવસાયિક ગુણો ક્યા છે ?
૨૦. વ્યક્તિગત વેચાણનું વર્ણન કરો. અને ગ્રાહકો અને ઉત્પાદકોની દ્રષ્ટિઓ તેની અગત્ય સમજાવો.
૨૧. તમને લાગે છે કે સફળ વિકેતા થવા માટે માત્ર વ્યક્તિગત અને માનસિક યોગ્યતાઓ જ પર્યાપ્ત છે? તમારા જવાબના સમર્થનમાં કારણો આપો.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

૨૨. વ્યક્તિગત વેચાણમાં વ્યસ્ત વ્યક્તિની વિવિધ યોગ્યતાઓ વર્ણવો.
૨૩. જો ઉત્પાદન ઉચ્ચકક્ષાનું હોય તે વિકેતામાં કોઈ યોગ્યતા હોવી જરૂરી નથી. તમે આ વિધાન સાથે સહમત છો? કારણો આપો.



પા�ગત પ્રશ્નોના જવાબ

૧૬.૧

૧. જાહેરાત અને વ્યક્તિગત વેચાણને બાદ કરતાં કોઈપણ વસ્તુના વેચાણમાં વૃદ્ધિ કરતી તમામ પ્રવૃત્તિને વેચાણવૃદ્ધિ કહેવાય છે.
૨. સંભવિત ઉપભોક્તાઓને વેચાણ વૃદ્ધિ માટે પ્રસ્તુત કરવામાં આવેલ પ્રેરણા (પ્રલોભન) બાબતમાં સૂચિત કરવા જાહેરાત એક સંપ્રેષણ માધ્યમનું કામ કરે છે.

૧૬.૨

- (ક) ખોટું (ખ) ખોટું (ગ) સાચું (ધ) ખોટું (ય) સાચું

૧૬.૩

- (૧) -(ગ), (૨) -(ખ), (૩)-(ક), (૪) -(ધ)

૧૬.૪

- (૧) ગ્રાહક (૨) વસ્તુનું વેચાણ વધારવું (૩) રૂબરૂ
(૪) શૈક્ષણિક

૧૬.૫

- (૧) ખરું (૨) ખોટું (૩) ખોટું (૪) ખોટું
(૫) ખોટું

૧૬.૬

૧. (૧) ખોટું (૨) સાચું (૩) ખોટું (૪) ખોટું (૫) ખોટું
૨. (૧) ક (૨) ગ (૩) ક (૪) ઘ (૫) ક



જાતે કરો.

વેચાણ, વૃદ્ધિ અને વ્યક્તિગત વેચાણ

1. તમારી નજીકની બજારમાં છૂટક વેપારીઓ પાસે જઈ તપાસ કરો કે તેઓ ક્યા સમયે "હાજર માલ નિકાલ"ની યોજના પ્રસ્તુત કરે છે.
2. વિનિર્માતાઓએ દાખલ કરેલી વિવિધ વેચાણ વૃદ્ધિ યોજનાઓ વિષેની માહિતી છાપાઓ અને મેગેઝીનોમાં આવતી જાહેરાતોમાંથી એકત્ર કરો.
3. સેવાઓ કે વસ્તુ ખરીદતી વખતે વિકેતાના વર્તનનું બારીક નિરીક્ષણ કરો. અને તેનામાં રહેલા વિવિધ ગુણોની નોંધ કરો.

મોડયુલ - ૪
ખરીદ - વેચાણ અને
વિતરણ



નોંધ

મોડયુલ - ૫

મહત્તમ માર્ક

૧૬

અભ્યાસના કંલાક

૩૫

ગ્રાહક જાગૃતિ

ગ્રાહક તુટ્ટિગુણ એજ પ્રત્યેક ધૂધાનો એક માત્ર લક્ષ છે. તેમ છતાં અનેક રીતે ગ્રાહક વેપારીના શોખણનો શિકાર બને છે. કુયારેક ઉચ્ચી કિંમતે નીચી ગુણવત્તાવાળો માલ ગ્રાહકને વેચવામાં આવે છે. આનું મુખ્ય કારણ ઘણાં ગ્રાહકો પોતાને મળેલા હક્ક અને જવાબદારીથી અશાન હોય છે. આજ કારણે અભ્યાસના આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થી ગ્રાહક સુરક્ષાના કાયદા અન્વયે પોતાના અધિકારો, જવાબદારીઓ અને ગ્રાહક સુરક્ષા અંગે વિવિધ જોગવાઈઓ સમજી ઉપયોગ કરી શકે.

પાઠ - ૧૭ : ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

પાઠ - ૧૮ : ઉપભોક્તા સંરક્ષણ



ઉપભોક્તાઓના હક્કો અને જવાબદારીઓ

આપણે ઘણીવાર એવા માણસોને મળીએ છીએ કે જેઓ ફરિયાદ કરતા હોય છે કે તેમણે પૂરા પૈસા ચુકવ્યા હોવા છતાં તેમને હલકી કક્ષાની કે લેણસેળવાળી વસ્તુ મળી. એવી જ રીતે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે તેમણે પૂરેપૂરું ભાડું ચુકવ્યા છતાં તેમની બસ કે ગાડીની સીટો આરામદાયક ન હતી. ઘણીવાર લોકોને પોતાના પૈસાનું પૂરું વળતર મળતું નથી. તેમને જે ચીજ કે સેવા મેળવવાની જરૂર હોય તે માટે તેમણે ખર્ચેલા મૂલ્યનું પૂરું વળતર મેળવવાનો તેમને અધિકાર નથી ?

ઘણીવાર તો લોકો ને આપવામાં આવતી અયોગ્ય (બિન ઉપયુક્ત) વસ્તુઓ કે સેવાઓ માટે ખુદ તેઓ જ જવાબદાર હોય છે. ઘણીવાર એવું બને છે કે તેમને જે વસ્તુઓ કે સેવાઓ તેમની ગુણવત્તાની દરકાર કર્યા વિના લઈ લેતા હોય છે. તેમને જે વસ્તુઓ સેવાઓ જોઈતી હોય તેનું પૂરું વિવરણ આપવાની તેમની જવાબદારી નથી ? આ પાઠમાં ચાલો આપણે ઉપભોક્તાના હક્કો અને જવાબદારીઓ નિષે શીખીએ.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- ઉપભોક્તા શબ્દની વ્યાખ્યા આપી શકશો.
- વસ્તુઓના ઉપભોક્તા અને સેવાઓના ઉપભોક્તા વર્ણણો તકાવત સમજી શકશો.
- "ઉપભોક્તા વાદ" શબ્દનો અર્થ જણાવી શકશો.
- ઉપભોક્તાના વિવિધ હક્કો સમજાવી શકશો અને
- ઉપભોક્તાની વિવિધ જવાબદારીઓ જણાવી શકશો.

૧૭.૧ ઉપભોક્તા કોણ છે?

સરળ શબ્દોમાં કહીએ તો ઉપભોક્તા એવી વ્યક્તિ છે કે જે વિવિધ વસ્તુઓ કે સેવાઓનો ઉપભોગ અથવા ઉપયોગ કરે છે. વસ્તુઓમાં વપરાશથી ખલાશ થઈ જતી વસ્તુઓ (જેમ કે ઘઉનો લોટ, મીઠું, ખાંડ, ફળો વગેરે) તેમજ ટકાઉ વસ્તુઓ (જેમ કે ટી.વી., રેફ્રિજરેટર, ટોસ્ટર, મિક્સર, સાઈકલ વગેરે) નો સમાવેશ થાય છે. આપણે જે સેવાઓ ખરીદીએ તેમાં વીજણીનો પાવર, ટેલીફોન, વાહન વ્યવહાર સેવા, શિયેટરની સેવા વગરેનો સમાવેશ થાય

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ઉપભોક્તા એ છે કે જે વસ્તુઓ કે સેવાઓનો ઉપયોગ કરવા માટે ખરીદે. ધારો કે એક છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુઓ (દાત. લેખન સામગ્રી) ખરીદે છે તો તે ઉપભોક્તા ન કહેવાય કારણ કે તે વસ્તુઓ ફરી વખત વેગવા માટે ખરીદે છે.

શું એવું જરૂરી છે કે ખરીદનાર કે જે ઉપભોક્તા છે તે જ માત્ર એકલો વસ્તુઓનો ઉપયોગ કરે? એવું હંમેશા બનતું નથી. જો તમે એક સ્વાધ્યાય નોટબુક તમારે પોતે તેની અંદર લખવા માટે ખરીદો તો તમે ખરીદનાર તેમજ વાપરનાર પણ છો. પણ માનો કે તમારા પિતાજી ખાદ્ય સામગ્રી ખરીદે છે તો તેનો ઉપયોગ આખું કુટુંબ કરે છે. અથવા માનો કે તે ડિટરજન્ટ પાઉડર ખરીદે છે તો તેનો ઉપયોગ કુટુંબના સત્યો કરે અથવા કોઈપણ વ્યક્તિ જે કપડાં ધોવાનું કામ કરતી હોય તે કરે. આનો અર્થ એ થયો કે ઉપભોક્તા જે વસ્તુ ખરીદે તેનો ઉપયોગ તેના કુટુંબના સત્યો અથવા તો તેના વતી બીજો કોઈપણ માણસ કરે છે.

ઉપભોક્તા એવી વ્યક્તિ છે કે જે વસ્તુઓ કે સેવાઓ તેના પોતાના ઉપયોગ માટે અથવા તો ખરીદનાર વતી બીજી કોઈ વ્યક્તિના ઉપયોગ માટે ખરીદે છે. વસ્તુઓમાં રોજ બરોજના વપરાશની વસ્તુઓ તેમજ સ્થાયી ટકાઉ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે.

જ્યારે પૈસા આપી ખરીદેલી સેવાઓમાં વાહન વ્યવહાર, વીજળી, ફિલ્મ શો વગેરેનો સમાવેશ થાય છે. 'ઉપભોક્તા'ની વ્યાખ્યા એવી પણ થઈ શકે છે કે "કોઈપણ વ્યક્તિ કે જે માલ કે સેવાઓ પસંદ કરે છે." તે મેળવવા પૈસા ખરચે છે અને તમને પોતાની જરૂરિયાત સંતોષવા માટે વાપરે છે.

આલો જોઈએ કે વસ્તુઓના ઉપભોક્તા અને સેવાઓના ઉપભોક્તાઓમાં શો તફાવત છે. આપણા લાભ માટે આપણે જે સેવાઓ ખરીદીએ છીએ તેમાં પરિવહન સેવાનો સમાવેશ કરી શકાય. તેમકે આપણે કોઈપણ સ્થળની મુલાકાત લેવા માટે ટેક્સી કે ઓટોરિક્ષા ભાડે કરીએ છીએ અથવા જાહેર બસ કે રેલ્વે દ્વારા પ્રવાસ કરીએ છીએ. જો તમારી પાસે તમારી પોતાની સાઈકલ, સ્કૂટર, કે મોટર-સાઈકલ હોય તો તમારે તેનું રીપેરીંગ (મરમત) કરાવવું પડે. તે માટે તમારે રીપેર કરનાર દુકાને (ઓટો સર્વિસની દુકાન) લઈ જવી પડે અને રીપેરીંગનું કામ કરનાર વ્યક્તિને તમારે તેના કામ બદલ પૈસા આપવા પડે ત્યારે તમે સેવાના ઉપભોક્તા છે. વીજળી કે ટેલીફોન જેનો આપણે દરરોજ ઘેર અથવા કામના સ્થળે ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે ભોગવીએ છીએ. એવી સેવા જ છે જેને માટે પૈસા આપવા પડે છે. સિનેમા ઘરમાં આપણે ફિલ્મ શો મનોરંજન માટે જોઈએ તે પણ સેવાનો જ એક નમુનો છે.

વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગમાં મુખ્ય તફાવત એ છે કે વસ્તુ ખરીદતા પહેલાં તેની ગુણવત્તાની ભૌતિક ચકાસણી થઈ શકે છે જ્યારે સેવાઓની નિયમિતતા અને વિશ્વાસીયતા અગાઉથી ચકાસી શકાતી નથી. દા.ત. ટીવી ખરીદતા પહેલાં તમે તેની કાર્ય પ્રણાલી, ચિત્રની સ્પષ્ટતા, ગુણવત્તા, અવાજ વગેરેનું નિર્દર્શન જોઈ શકો છો. પણ તમને પૂરા પડાયેલ વીજળી પુરવણાની તમે ચકાસણી કરી શકતા કે તેના વોલ્ટેન સ્થિર રહેશે કે કેમ. ખાદ્ય પદાર્થ

મોડયુલ - ૫ શ્રાહક જાગૃતિ



નોંધ



ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

ખરીદતાં પહેલાં તમે તે ચાખીને ખાતરી શકો છો પછી ખરીદો છો અથવા કોઈ ફળ વધારે પડતું પાકી ગયું નથી તે જોઈને ખરીદી શકો છો. પણ સ્કૂટર કે ટેક્સીનો ડ્રાઇવર સાવચેત રહેશે અને એક્સીડન્ટ નહીં જ કરે અથવા ચલચિત્ર જોતી વખતે છેક છેલ્લે સુધી ચિત્ર અને અવાજ બરાબર રહેશે તેની ચકાસણી કરી શકતા નથી.

વળી જે વસ્તુઓ આપણે ખરીદીએ છીએ તેનો ઉપયોગ આપણે તુરત અથવા અમુક સમય પછી પણ કરી શકીએ. દાત. અનાજનો હપ્તાઓ કે મહિના સુધી સંગ્રહ કરી શકીએ છીએ. અને રેફિજરેટરને સમયે સમયે રીપેર કરાતીને આપણે વર્ષો સુધી વાપરી શકીએ છીએ પણ પરિવહન સેવાઓ, રીપેરીંગ, વીજળી પૂરવઠો, ટેલીફોન સેવા કે ફિલ્મશોની બાબતમાં એમ કરી શકતા નથી.



૧૭.૧ પાઠગત પ્રશ્નો

નીચેના પ્રશ્નોના જવાબ માત્ર 'હા' કે 'ના'માં આપો.

૧. જે વસ્તુ ખરીદે તે ઉપભોક્તા હોય પણ ખરો અને ન પણ હોય એમ બને ?
૨. જે ખોરાકનો ઉત્ભોગ કરે તે ખરીદનાર જ હોય એમ કહેલું સાચું છે ?
૩. દુકાનદાર જાતે પહેરવા માટે રેડીમેઇડ શર્ટ ખરીદે તો તેને ઉપભોક્તા કહેવાય ?
૪. મેં એક જાહેર પુસ્તકાલયમાં સભ્ય ફી ખરીને અને ત્યાં હું પુસ્તકો અને જર્નલો વાચું છું તો હું સેવાઓનો ઉપભોક્તા છું ?
૫. તમારો મિત્રે એક વાર્તાની ચોપડી ખરીદી. તે વાંચી લઈને તેણે સેકન્ડહેન્ડ ચોપડીઓ વેચનાર દુકાનદારને ઓછી કિંમતે વેચી દીધી. તમારો મિત્ર ઉપભોક્તા કહેવાય ?

૧૭.૨ ઉપભોક્તાવાદનો અર્થ

તમે પણ એક ઉપભોક્તા હોઈને સમયે સમયે વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા હશો. તમને પણ કોઈ વિકેતાએ શોખણ કર્યું હોય તેવો અનુભવ થયો હશે. કયારેક તેઓ વધારે પડતો ભાવ લઈ લે તો કયારેક હલકી કલ્યાણી ચીજો અને સેવાઓ પૂરી પાડે. આવું શોખણ કોઈપણ ઉપભોક્તા દ્વારા એકલા હાથે અટકાવવાનું મુશ્કેલ છે. જો ઉપભોક્તાઓ જાગૃત (સાવધ) બની જાય અને આવી ગેરરીતીઓનો સામૂહિક રીતે સામનો કરે તો આવા શોખણની તીવ્રતા ઘટાડી શકાય. પોતાની સલામતી માટે ઉપભોક્તા પોતાની જાતે જ પ્રયત્ન કરે તેને ઉપભોક્તા વાદ કહે છે.

ઉપભોક્તા વાદનો સંદર્ભ તેમના આંદોલન પરત્વે છે. જે વિનિર્માતાઓ, ઉત્પાદકો, વ્યાપારીઓ, વેચાણકારો કે સેવાદાતાઓના ઉપભોક્તાઓ પ્રત્યે યોગ્ય અને પ્રામાણિક વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે છે. આ આંદોલનને બજારમાં ફેલાયેલી બદીઓ સાથે ઉપભોક્તાઓમાં જાગૃતિ પેદા કરવા માટે તેમજ તેમના હિતોનું રક્ષણ કરવા માટેના માર્ગો શોધી કાઢવાની દિશામાં કોઈ ઉપભોક્તા આંદોલનકારી અથવા ઉપભોક્તા મંડળોએ કરેલા પ્રયત્ન તરીકે ગણી શકાય.

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

આ આંદોલન ત્યારે જ સફળ બને જ્યારે ઉપભોક્તા વસ્તુ કે સેવાઓનો ઉપયોગ કરતી વખતે પોતાના હકો અને ફરજો વિષે સભાન હોય. ચાલો ઉપભોક્તાઓના અધિકારો અને ફરજો વિષે જાણીએ.

ગ્રાહક સુરક્ષા ધારો ૧૯૮૬:-

ગ્રાહક સુરક્ષાનો ધારો એ અન્ય ધારા કરતા ગ્રાહકોને વધુને વધુ સુરક્ષા બસ્તે છે. ગ્રાહક સુરક્ષા ધારોએ વિશાળ અધિકારક્ષેત્ર ધરાવે છે. વસ્તુ ખરીદીને છેતરાયા સામે આર્થિક રક્ષણ ઉપરાંત સેવાઓની શોષણ જેવા કે બેન્કના શોષતા, વીમા કે નાણાંકિય શોષણ, વાહન વ્યવહાર, ટેલિફોન, વિજળી પૂરવઠો કે અન્ય બણતણ, ગૃહ યોજના, બોર્ડિંગ અને લોજીંગ, આનંદ પ્રમોદના સાધનો કે મનોરંજનની સેવાઓ વગેરેમાં થતા શોષણ સામે પણ ગ્રાહક સુરક્ષા ધારો રક્ષણ આપે છે.

૧૭.૩ ઉપભોક્તાઓના હકો

તમે જાણો છો કે આજે ઉપભોક્તાઓને બજારમાં હરીફાઈ, ગેરમાર્ગ દોરતી જાહેરાતો, હલકી કક્ષાની વસ્તુઓ અને સેવાઓ વગેરેના કારણે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી ઉપભોક્તાઓના હિતનું રક્ષણ કરવું તે સરકાર અને સાર્વજનિક સંસ્થાઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આથી સરકારે ગ્રાહકોના હિતની સુરક્ષા માટે ઉપભોક્તાના કેટલાક અધિકારોને માન્યતા આપેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો જો ઉપભોક્તાઓએ પોતાની જાતને છેતરપીડી કે શોષણથી બચાવવી હોય તો તેમને અમુક અધિકારો આપવા પડે તેથી તેઓ એક એવી સ્થિતિ સંપાદન કરે કે વસ્તુના વેપારીઓ કે સેવા પ્રકાતાઓ તેમની સાથે વ્યવહાર કરવામાં વધુ કાળજી રાખશે એવી તેમને ખાતરી મળે. દા.ત. ઉપભોક્તાઓનો એક અધિકાર છે. પસંદગી કરવાનો જો તમને તમારા આ અધિકારની જાણ હોય તો તમે વેપારીને એકના એક ઉત્પાદનની જુદી જુદી જાતો તમને દેખાડવા જણાવી શકો. જેથી તમે મનપસંદ પસંદગી કરી શકો. કેટલીકવાર વેપારીઓ કોઈપણ વસ્તુની અમુક ખાસ ભ્રાંડ જ વેચવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ કે તે વેચવામાં તેમને વધારે મોટું વળતર મળતું હોય છે. તે કદાચ ઉત્તમ પ્રકારની વસ્તુ ન હોઈ શકે અથવા તે પ્રમાણમાં ઓછી કિમતે મળતી હોય. જો તમે તમારા પસંદગીના અધિકારનો ઉપયોગ કરો તો તમે આ વ્યવહારને રોકી શકો. અને જો હુકાન પર એક ઉત્પાદનની વિવિધ જાતો ન ઉપલબ્ધ હોય તો તમે બીજી કોઈ હુકાને જઈ શકો.

ચાલો આપણે ગ્રાહક સુરક્ષા કાયદો ૧૯૮૬માં આપેલ વિવિધ ગ્રાહકના અધિકારોની ચચા કરીએ.

૧. સલામતી (સુરક્ષા) નો અધિકાર:-

જે વસ્તુઓ સ્વાસ્થ્ય કે જિંદગી માટે હાનિકારક હોય તેના વેચાણ સામે રક્ષણ મેળવવાનો ઉપભોક્તાને અધિકાર છે જો તમે ઉપભોક્તાના આ અધિકારથી વાકેફ હો તો તમે હાનિ રોકવા માટે સાવચેતીના પગલાં લઈ શકો છો અને જો તેમ છતાં હાનિ થઈ જ ચૂકી હોય તો વેપારી સામે ફરિયાદ કરવાનો તમને હક છે અને વળતર સુધ્યા મેળવવાનો તમે દાવો

મોડયુલ - ૫
ગ્રાહક જાગૃતિ



નોંધ

મોડયુલ - ૫

ગ્રાહક જાળુતિ



નોંધ

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

કરી શકો છો. માનો કે તમે કોઈ દવા ખરીદી તે જો નુકસાનકારક પૂરવાર થાય તો તેને માટે તે દવા વેચનાર ફાર્મસીને જવાબદાર ઢરાવી શકાય. એવી જ રીતે જો તમે રસોઈ માટે ગેસનો બાટલો વાપરતા હો તો તમારે તે લીક થતો નથી તેની તપાસ કરી લેવી પડે અને તેના કારણે આગ લાગે અને કોઈ હાનિ થાય કે કોઈનું મૃત્યુ થાય તો તમને માલ સપ્લાઇ કરનાર નુકસાનીનું વળતર આપવા જવાબદાર બને છે.



૨. માહિતી મેળવવાનો અધિકારી:-

ઉપભોક્તાઓને ઉપલબ્ધ વસ્તુઓનું પ્રમાણ, ગુણવત્તા, શુદ્ધતા, સ્તર કે કક્ષા અને કિંમત વગેરે વિષે માહિતી મેળવવાનો અધિકાર છે કે જેથી તે કોઈપણ ઉત્પાદન કે સેવા ખરીદતાં પહેલાં યોગ્ય પસંદગી કરી શકે. ઉપરાંત જ્યાં જરૂરી હોય ત્યાં વસ્તુ વાપરતી વખતે જે ખોટ કે હાનિ થવાનો સંભવ હોય ત્યાં ઉપભોક્તાને સલામતી ખાતર કઈ કઈ સાવચેતી રાખવી પડે તેની માહિતી આપવી પડે. ફરીવાર ગેસના બાટલાનો દાખલો લઈએ. વિતરણ કરનારે જ્યારે બાટલાનો ઉપયોગ ન થતો હોય ત્યારે રેઝ્યુલેટરની મદદથી ગેસનો પ્રવાહ બંધ કરવાની સુયાના ઉપભોક્તાને આપવી જોઈએ.

૩. પસંદગીનો અધિકારી:-

એક જ ઉત્પાદનની વિવિધ જાતોમાંથી પોતાને જરૂરી છે એવી વસ્તુ (ખરીદવાનો) પસંદ કરવાનો પણ ઉપભોક્તાને અધિકાર છે. કેટલીકવાર વિકેતા કે વેપારી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પદ્ધરાવવા માટે ગ્રાહકો ઉપર દબાણની પ્રયુક્તિઓ અજમાવતા હોય છે. કયારેક ઉપભોક્તા પણ ટી.વી.ની જાહેરાતોથી પ્રભાવિત થઈ જાય છે. જો ઉપભોક્તા આ હક્કી વાકેફ હોય તો આ શક્યતાઓથી બચી શકાય છે.

૪. સુનાવણીનો અધિકાર:-

આ અધિકારના ત્રણ અર્થઘટન છે. વ્યાપાક અર્થમાં જોઈએ તો જ્યારે સરકાર અથવા જાહેર સંસ્થાઓ ઉપભોક્તાઓને હિતને અસરકરતા એવા કોઈ નિર્ણયો લે અથવા નીતિઓ ઘડે ત્યારે ઉપભોક્તાની સલાહ લેવી જોઈએ એવો તેમને હક છે. ઉપભોક્તાને એ પણ અધિકાર છે કે વિનિર્માતાઓ, વિકેતાઓ અને જાહેરાત આપનારાઓ ઉત્પાદન અને વેચાણ વિષે ઉપભોક્તાઓ મત જાણવા માટે તેને સાંભળે ત્રીજું, કાનૂની કાર્યવાહી કે ઉપભોક્તાઓની ફરિયાદ માટેની ન્યાય અદોતોમાં ઉપભોક્તાઓને સાંભળવા જોઈએ એ પણ તમનો હક છે.



૫. ફરિયાદ નિવારણ (નુકસાન વસુલ)નો અધિકાર:-

જો અને જ્યારે ઉપભોક્તાને અનુચ્ચિત વ્યાપાર વ્યવહાર જેમ કે વધુ ભાવ લેવો, હલકી ગુણવત્તાઓ માલ વેચાવો, અથવા બિન સલામત ઉત્પાદન વેચવું, કે સેવા પ્રદાનમાં

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

નિયમિતતામાં શક્તિ વગેરેના કારણે કોઈ ફરિયાદ કે મનુદુઃખ હોય અથવા ખામીયુક્ત કે ભેણસેળવાળી વસ્તુના કારણે તેને કશી હાનિ પહોંચી હોય તો અને ત્યારે તેના ઉપાયો શોધવાનો તેને હક છે. ખામીવાળી વસ્તુઓને બદલે બીજી સારી વસ્તુ અથવા પૈસા વિકેતા કે વેપારી પાસેથી પાછા મેળવવાનો હક છે. તેને યોગ્ય ન્યાયાલયમાં વૈધાનિક સમાધાન મેળવવાનો પણ અધિકાર છે. આ હક દ્વારા ઉપભોક્તાઓને બાંહેધરી મળે છે કે તેમની ફરિયાદ ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવશે. આ હકમાં જો ઉપભોક્તાઓએ કોઈ નુકસાન સહન કર્યું હોય અથવા વિતરક કે વિનિર્માતાઓની ભૂલને લીધે તેને અગવડ પડી હોય તો વળતર મેળવવાની પણ જોગવાઈ છે.

૬. ઉપભોક્તા શિક્ષણનો અધિકાર:-

બજારોમાં ચાલતી ગેરરીતિઓ અને ઉપભોક્તાઓનું શોષણ રોકવા માટે ઉપભોક્તા સજાગતા અને શિક્ષણ અત્યંત આવશ્યક છે. આ હેતુની પરિપુર્તિ માટે ઉપભોક્તા સંગઠન, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારની નીતિના ઘડવૈયાઓ પાસે એવી અપેક્ષા છે કે તેઓ ઉપભોક્તાઓને શિક્ષિત કરી માહિતગાર રહેવા સક્ષમ બનાવે. (ક) અનુચ્ચિત વ્યાપાર વ્યવહારો અટકાવવા માટે ઘડાયેલા આનુષ્ઠાનિક કાયદાઓ (ખ) ઉપભોક્તાઓને છિતરવા માટે બજાર વ્યવહારમાં તોડ મરોડ કરવા પ્રયત્ન (ગ) ઉપભોક્તા કેવી રીતે પોતાના હિતોનો બચાવ કરી શકે અને (ધ) ફરિયાત કરતી વખતે ઉપભોક્તાએ અનુસરવાની પદ્ધતિ.



મોડયુલ - ૫
શ્રાહક જાગૃતિ



નોંધ



૧૦.૨ પાઠગત પ્રશ્નો

૧. "અ" અને "બ" સ્તંભો નીચેના વાક્યાંશો મેળવો

"અ"

"બ"

(૧) સુનાવણીનો અધિકાર

(અ) ન્યાયાલયમાં કાનૂની નિવારણ માટે કાર્યવાહી કરવી.

(૨) સુરક્ષાનો અધિકાર

(બ) નીતિવિષયક નિર્ણય માટે ઉપભોક્તાઓની સલાહ લેવી.

(૩) ઉપભોક્તા શિક્ષણનો અધિકાર

(ક) ઉત્તમકક્ષાની વસ્તુ પસંદ કરવી.

(૪) નિવારણ મેળવવાનો અધિકાર

(ઢ) ખતરનાક વસ્તુના વેપાર સામે સુરક્ષા

(૫) પસંદગીનો અધિકાર

(ઝ) ઉપભોક્તા સંરક્ષણને લગતા પ્રાસંગિક કાયદાની માહિતી

૨. નીચેના પેકી કયાં વિધાનો 'ખરા' છે અને 'ખોટા' છે તે જણાવો.



ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

૧. વેપાર માટે ગ્રાહકને ઉત્પાદનની ગુણવત્તા વિષે જાણવવાની જરૂર નથી કારણ કે તેઓ જાતે જ ગુણવત્તા નક્કી કરી શકે.
૨. આપવામાં આવેલી હલકી કક્ષાની સેવા માટે નિવારણ શોધવાની છૂટ આપવા માટે સેવા દાતાઓ જવાબદાર નથી.
૩. સુનાવણીનો અધિકાર યોગ્ય સ્થળે અને સમયે ગ્રાહકોના હિતો ઉપર યોગ્ય લક્ષ્ય અપાય તે માટે તેમને સક્ષમ બનાવે છે.
૪. જો ગ્રાહકો અસંગઠિત હોય તો સુનાવણીના હકનો અસરકારક અમલ થઈ શકે.
૫. ઉપભોક્તાને પોતાની પસંદગીની વસ્તુ પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને વેપારમાં ઉપભોક્તાને પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.

૧૭.૪ ઉપભોક્તાઓની જવાબદારીઓ

એક પ્રખ્યાત કહેવત છે કે "જવાબદારી વિના હકો કઢી ન હોઈ શકે." ઉપભોક્તાના હકો તપાસ્યા પછી અને તેઓ કયા હેતુ સારે છે તે સમજ્યા પછી હવે એ વિચાર જરૂરી બને છે કે ઉપભોક્તાઓએ પણ તે હકો ભોગવવા માટે લાયક બને તેટલા જવાબદાર બનવું જોઈએ કે કેમ દા.ત. સુનાવણીનો હક ભોગવવા શક્તિમાન બનવું હોય તો ઉપભોક્તાની સમસ્યાઓ જાણવાની તક મેળવવી જોઈએ અને તેના વિષેની માહિતી મેળવતા રહેવી જોઈએ. એજ રીતે ફરિયાદોના નિવારણનો હક ભોગવવા માટે ઉપભોક્તાએ સાચી વસ્તુ સાચી કિંમત પસંદ કરવા માટે તમામ સાવયેટી રાખવી જોઈએ અને હાનિ કે નુકસાન થતું રોકવા માટે વસ્તુને કેમ વાપરવી તે શીખવું જોઈએ. ખાસ કરીને ઉપભોક્તાઓની જવાબદારીમાં નીચેની જવાબદારીઓનો સમાવેશ થાય છે:

૧. સ્વ-સહાયની જવાબદારી:-

ઉપભોક્તા માટે એક વસ્તુ હંમેશા ઈચ્છનીય છે કે શક્ય હોય ત્યાં સુધી માહિતી અને પસંદગી માટે વેપારી ઉપર આધાર ન રાખવો. ઉપભોક્તા તરીકે તમે બીજાથી છેતરાઈ જવામાંથી બચ્યો એવી જવાબદાર રીતે વર્તો તેવી અપેક્ષા રહે છે. એક સુમાહિતગાર ઉપભોક્તા બીજી કોઈપણ વ્યક્તિ કરતાં પોતાની સંભાળ વધુ સારી રીતે રાખી શકે છે. હાનિ કે નુકસાન થઈ ચુક્યા પછી નિવારણ કરવા પ્રયત્ન કરવા કરતાં જાતે જ પહેલાથી સાવયેત અને સજજ રહેવું તે હંમેશા વધારે સારું છે.

૨. લેવડ-દેવડની સાબિતી:-

દ્રેક ઉપભોક્તાની બીજી જવાબદારી એ છે કે સ્થાયી વસ્તુઓની ખરીદીની સાબિતી અને ખરીદીને લગતા દસ્તાવેજો ચોકક્સ મેળવી લેવા અને સાચ્યવી રાખવા. દા.ત. વસ્તુઓ ખરીદો ત્યારે કેશમેમો (રોકડબીલ) મેળવી લેવાની ખાસ જરૂર છે. તમારે યાદ રાખવું જોઈએ કે કદાચ વસ્તુમાં કોઈ ક્ષતિ વિષે તમારે ફરિયાદ કરવાની હોય તો તમે ખરીદીની સાબિતી રજૂ કરો તો જ તમે મરમ્મત માટે વસ્તુ બદલવા માટે દાવો કરી શકો. એ જ રીતે ટકાઉ ઉપભોગની

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

ટી.વી., ફ્રીજ જેવી વસ્તુઓ સાથે વિકેતાઓ વોરન્ટી / ગેરન્ટી કાર્ડ પણ આપતા હોય છે. આ કાર્ડથી તમને ખરીદી પછીના અમૃક સમયગાળા સુધી રીપેર માટે સર્વિસ અથવા તો મફત સ્પેરપાર્ટ બદલવાનો હક પ્રાપ્ત થાય છે.

૩. યોગ્ય દાવો:-

એક બીજી ઉપભોક્તાએ સતત મનમાં રાખવા જેવી જવાબદારી એ છે કે ફરિયાદ કરતી વખતે અથવા હાનિ કે નુકસાનના વળતર માટે દાવો કરતી વખતે તેઓ અતાઉક રીતે (ગેરવાજબી રીતે) બહુ મોટો દાવો ન કરવો જોઈએ. ઘણીવાર ઉપભોક્તા ફરિયાદ નિવારણ માટે કોર્ટમાં દાવો કરતા હોય છે. એવા પણ કિસ્સાઓ બન્યા છે કે ઉપભોક્તાએ કોઈપણ દેખીતા વાજબી કારણ વગર મોટા વળતરનો દાવો કર્યો હોય. આને બે જવાબદાર કૃત્ય ગણવામાં આવે છે એવું ન કરવું જોઈએ.

૪. ઉત્પાદન કે સેવાઓનો સમુચ્ચિત ઉપયોગ:-

કેટલાક ઉપભોક્તાઓ ખાસ કરીને ગેરંટીના સમગ્રગાળા દરમિયાન વસ્તુનો દુરૂપયોગ કરે છે. તેઓ વિચારે છે કે ગેરંટી પરિયડ દરમિયાન તે વસ્તુને બદલે બીજી નવી વસ્તુ મળી જશે. આ તેમને માટે વ્યાજબી નથી. તેમણે હંમેશા વસ્તુ યોગ્ય રીતે વાપરવી જોઈએ. ઉપભોક્તાઓની ઉપરની જવાબદારીઓ ઉપરાંત પણ બીજી કેટલીક જવાબદારીઓ વિષે સચેત હોવા જોઈએ, તેમને ઉત્પાદકો, વેપારીઓ કે સેવા દાતા સાથે કરેલા કરારને ચુસ્ત રીતે વળગી રહેવું જોઈએ. ઉધાર (શાખ પર) ખરીદી કરી હોય તો તેમણે સમયસર પૈસા ભરી દેવા જોઈએ. તેમણે વીજણી કે પાણીના મીટર, બસ અને ગાડીની સીટો વગેરે જેવા સેવાના માધ્યમો સાથે ચોડાં કરવાં ન જોઈએ તેઓઓ યાદ રાખવું જોઈએ કે તેઓ ત્યારે જ હકો ભોગવી શકે જયારે તેઓ પોતાની જવાબદારીઓ નિભાવવા ઈચ્છા હોય.



૧૭.૩ પાઠગત પ્રશ્નો

- નીચેના પૈકી ક્યા વિધાનો 'ખરાં' છે અને ક્યાં 'ખોટાં' છે તે જણાવો.
 - એક જવાબદાર ઉતપભોક્તા પોતાના હિતોની રક્ષા સ્વયં કરવા પ્રયત્ન કરે છે.
 - ઉપભોક્તાએ વસ્તુની ગુણવત્તા સંબંધી માહિતી માટે કદી વેપારી ઉપર નિર્ભર રહેવું ન જોઈએ.
 - જો મે દરેક રીતે સાવચેતી રાખીને કોઈ વસ્તુ ખરીદી હોય તો હું નિવારણ માટેનો મારો હક ભોગવી ન શકું.
 - ગેરંટીની સમયાવહિ દરમિયાન વસ્તુ સંભાળપૂર્વક વાપરવાની જરૂર નથી.
 - જો ઉપભોક્તા તરીકે ખામીવાળી ઈલેક્ટ્રીક હીટરના કારણે મને શારીરિક ઈજા પહોંચી હોય અને મેં ડોક્ટરી સારવારના રૂ.૫૦૦૦/- ખર્ચા હોય તો મને વળતર રૂપે રૂ.૫૦,૦૦૦/-નો દાવો કરવાનો અધિકાર છે.

મોડયુલ - ૫ શ્રાહક જાગૃતિ



નોંધ

મોડયુલ - ૫

ગ્રાહક જાળુતિ




નોંધ

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

૨. વૈકલ્પિક પ્રશ્નો

૧. કઈ સાલમાં ગ્રાહક સુરક્ષા ધારો અમલીકરણ બન્યો?
 - અ. ૧૯૭૨
 - બ. ૧૯૮૨
 - ક. ૧૯૮૬
 - ડ. ૧૯૯૫
૨. ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ગ્રાહકના કેટલા અધિકારો આપ્યા છે?
 - અ. ૬
 - બ. ૮
 - ક. ૭
 - ડ. ૪
૩. ગ્રાહકની જવાબદારી બને છે.....
 - અ. વસ્તુ કે સેવાનો યોગ્ય ઉપયોગ.
 - બ. શિક્ષણનો અધિકાર.
 - ક. હક્ક માટે લડત.
 - ડ. હંમેશા ગ્રાહક સુરક્ષાની અદાલતો આશરો લેવો.
૪. ગ્રાહકલક્ષી અળવળની શરૂઆત.....
 - અ. સરકાર
 - બ. સમાજ
 - ક. ઉત્પાદક
 - ડ. ગ્રાહક
૫. નાણાંનું વળતર ગ્રાહકને ક્યા અધિકારથી મળે છે?
 - અ. માહિતીના અધિકારથી.
 - બ. સમાધાનના અધિકારથી.
 - ક. સુનાવણીના અધિકારથી.
 - ડ. પસંદગીના અધિકારથી.



તમે શું શીખ્યા?

- ઉપભોક્તા એવી વ્યક્તિ છે કે જે વસ્તુઓ કે સેવાઓ પોતાના ઉપભોગ કે ઉપયોગ માટે અથવા ખરીદનાર વતી કોઈ અન્યના ઉપયોગ માટે ખરીદે છે. વસ્તુમાં વપરાઈ જનાર અને ટકાઉ અમ બંને પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે જે સેવાઓ પેસા આપી ખરીદવામાં આવે છે તેમાં પરિવહન, વીજળી, સિનેમા અને એવી અન્ય સેવાઓનો સમાવેશ થાય છે.
- ઉપભોક્તાવાદનું તાત્પર્ય ઉપભોક્તાઓના અંદોલન સાથે છે જેતી વિનિર્માતાઓ, વેપારીઓ, વિકેતાઓ અને સેવા દાતાઓ ગ્રાહકો સાતે ન્યાયી અને પ્રામાણિક આચરણ કરે તેવી ખાતરી મળી શકે.
- ઉપભોક્તાઓના અધિકાર (૧) સુરક્ષાનો અધિકાર (૨) માહિતી મેળવવાનો અધિકાર (૩) પસંદગીનો અધિકાર (૪) સુનાવણીનો અધિકાર (૫) ફરિયાદ નિવારણનો અધિકારી (૬) ઉપભોક્તાના શિક્ષણનો અધિકારી

ઉપભોક્તાઓના હકો અને જવાબદારીઓ

- ઉપભોક્તાની જવાબદારીઓ (૧) સ્વ-સહાયની જવાબદારી (૨) લેવડ-ટેવડની જવાબદારી (૩) યોગ્ય દાવો (૪) ઉત્પાદન કે સેવાઓનો સમુચ્છિત ઉપયોગ



પાઠંત્રણો

૧. ઉપભોક્તાની વ્યાખ્યા આપો.
૨. વસ્તુઓના અને સેવાઓના ઉપભોક્તા વચ્ચે તશ્શાવત દર્શાવો.
૩. ઉપભોક્તાવાદની સંક્ષેપના વર્ણવો.
૪. ઉપભોક્તા શિક્ષણના ભાગરૂપે ઉપભોક્તાએ કઈ બાબતમ શિક્ષિત થવાની અપેક્ષા રાખવી જોઈએ.
૫. ઉપભોક્તાના વિવિધ હકો સમજાવો.
૬. ઉપભોક્તા કોને કહેવાય? ઉપભોક્તાની જવાબદારીઓ કઈ છે?
૭. સ્થાયી વસ્તુ ખરીદતાં ઉપભોક્તાએ ક્યા દસ્તાવેજો સાચવવા જોઈએ?



પાઠગત પ્રશ્નોના જવાબ

૧૭.૧

- (૧) હા (૨) ના (૩) હા (૪) હા (૫) હા

૧૭.૨

૧. (૧)-(૬), (૨)-(૩), (૩)-(૪), (૪)-(૫), (૫)-(૬)
૨. (૧) ખોટું (૨) ખોટું (૩) સાચું (૪) ખોટું (૫) સાચું

૧૭.૩

૧. (૧) સાચું (૨) સાચું (૩) ખોટું (૪) ખોટું (૫) ખોટું
૨. (૧)-(૬), (૨)-(૫), (૩)-(૪), (૪)-(૩),
(૫)-(૬)



જાતે કરો.

- તમે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હો તેવી વસ્તુઓ અને સેવાઓની યાદી બનાવો.
➤ ઉપભોક્તા તરીકે વસ્તુઓ કે સેવાઓ ખરીદ કરતી વખતે તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડયો છે?

મોડયુલ - ૫ શ્રાહક જાગૃતિ



નોંધ



ઉપભોક્તા સંરક્ષણ

આગળના પાઠોમાં તમે ઉપભોક્તાઓના વિવિધ હકો અને જવાબદારીઓ વિષે શીખી ગયો તમે ઉપભોક્તાવાદ વિષે પણ શીખી ગયા, જે ઉપભોક્તાઓને તેમના હકો અને પ્રશ્નો વિષે જાગૃત કરવાના ઉદેશથી ચલાવાનું એક અભિયાન છે કે જેથી તેઓ પોતાને થયેલા નુકસાન અને યાતનાઓનો સામનો કરવાના ઉપાયો શોધી શકે. વળી જો બુધ્યયુક્ત ખરીદીની અવધારણા અને એક શાશ્વત ખરીદકર્તાએ રાખવી પડતી સાવચેતીથી પણ પરિચિત થયા છો. આ પાઠમાં આપણે શા માટે ઉપભોક્તાનું રક્ષણ કરવાની જરૂર છે. અને વેપારીઓની લુચ્યાઈથી તેમને બચાવવાની કંઈ રીતો અને ઉપાયો છે તે વિષે ચર્ચા કરીશું.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- ઉપભોક્તા સંરક્ષણનો અર્થ સમજાવી શકશો.
- ઉપભોક્તાઓને નડતી વિવિધ સમસ્યાઓ જણાવી શકશો.
- ઉપભોક્તાઓના સંરક્ષણની જરૂરિયાત સમજી શકશો.
- ઉપભોક્તાઓના સંરક્ષણમાં જોડાયેલ પક્ષોને ઓળખી શકશો.
- ઉપભોક્તાના સંરક્ષણના હેતુથી બનેલા કાયદાઓ અને જોગવાઈઓની રૂપરેખા આપી શકશો.
- ઉપભોક્તાઓના તકરાર નિવારણ માટે સ્થાયેલી ઉપભોક્તા અદાલતોના અધિકાર ક્ષેત્રની ચર્ચા કરી શકશો.

૧૮.૧ ઉપભોક્તા સંરક્ષણનો અર્થ

તમે એ હકીકતથી વાકેફ છો કે ઉપભોક્તાઓને કેટલાક મૂળભૂત હકો છે, જેમ કે – સુરક્ષાનો અધિકાર, જાણકારી મેળવવાનો અધિકાર, પસંદગીનો અધિકાર, તેના વાત સંભળાવવાનો અધિકાર વગેરે પણ માલ ખરીદતી વખતે આપણે હંમેશા આ અધિકારો યાદ રાખીએ છીએ ખરા? કદાચ નહીં, પણ આપણ હકો વિષે જાણતા હોઈએ તો પણ વિકેતાઓ ઘણીવાર આપણી પરિસ્થિતિનો લાભ ઉઠાવીને આપણને ખામીવાળી, નુકસાનકારક, અસુરક્ષિત કે ઈજા કરી શકે તેવી વસ્તુઓ પદ્ધરાવતા હોય છે.

ધારો કે તમે ખાદ્યતેલ ખરીદવા દુકાને ગયા. દુકાનદાર તમને કહે છે કે તેલ બંધ ડબા કે ટીનમાં ઉપલબ્ધ છે. તમે ખાતરી કરવા માંગો છો કે તેલ બેણસેળિયું એટલે કે બીજા

ઉપભોક્તા સંરક્ષણ

હલકી કક્ષાના કે નુકસાનકારક તેલનો ભેગ કરેલ તો નથીને? દુકાનદાર તમને લેબલ ઉપર ઉત્પાદકનું નામ વંચાવશે અને કહેશે કે તે એક સુવિઘ્યાત કંપની છે. જે અશુદ્ધ તેલ આપે નહીં. પણ તેલ વાપર્યા પછી તમે માંદા પડો છો. તમે દુકાને જઈને દુકાનદારને તેલ પાછું આપી શકો? ના તમે થોડુંક વપારેલું, ઉઘાડા ઉભામાં વધેલું તેલ તે પાછું નહીં લે તે કદાચ તમને એમ કહેશે કે તમારી બીમારી કોઈ અન્ય કારણવશાત થયેલી હો. તેથી તમે વધુમાં વધુ એટલું કરી શકો કે ફરી વખત તે લેબલવાળું તેલ ન ખરીદો. પણ બીજા કોઈ ઉત્પાદકના તેલમાં પણ તમને એવી જ મુશ્કેલી નહીં પડે તેની શી ખાતરી?

વળી એક બીજું ઉદાહરણ લઈએ. કોઈ ઉપભોક્તાને પંખાના રેઝ્યુલેટર કે ઈલેક્ટ્રીયક હીટર કે ટી.વી.માં કોઈ ખામી જણાઈ. વોરન્ટીની અવધિ દરમિયાન વિતરક તે મફત સુધારી આપે. પછી ખામી તો પાછળથી પણ રહે જે. હવે ઉપભોક્તા શું કરે? માની લો કે ઈલેક્ટ્રીયક હીટરમાં રહેલી ખામીથી કયારેક ઈજા પહોંચી. આનો કોઈ ઉપાય છે? તમે તેને વિકેતા પાસે લઈ જાઓ તો ઉલટાનો તમારી ઉપર આક્ષેપ મૂકે કે તમે તેને વાપરતી વખતે જરૂરી સાવધાની નહીં રાખી હોય.

આમ ઉપભોક્તા ચતુર હોય તો પણ તેની લાચારીનાં આ કેટલાંક ઉદાહરણો છે. આથી સામાન્ય માણસોને મદદરૂપ થવા માટે ઉપભોક્તાઓના હિતનું રક્ષણ કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. આમા ઉપભોક્તા સંરક્ષણમાં ઉપભોક્તાઓને વેપારની ગેરરીતીઓથી બચાવવા કેટલાંક જરૂરી પગલાં અને યોજવા પડતા ઉપાયો અભિપ્રેત છે. આને તમે ઉપભોક્તાવાદ જેવા એક આંદોલન તરીકે ગણી શકો. આ મૂળભૂત રીતે જરૂરી છે. કારણ કે વેપારીનું લક્ષ મહત્તમ લાભ ખાટવાનું હોય છે અને આ ઉપભોક્તાઓના ભોગ શક્ય બને છે.

ચાલો આપણે આપણા દેશમાં પ્રચલિત ગતિ વિવિધઓનો વિચાર કરીએ જે આર્થિક નુકસાન અને લોકોના અધોગ્ય અને કયારેક તો જીવન સુધારને જોખમ ઉભું કરે છે.

૧૮.૨ ઉપભોક્તાઓને નડતી સમસ્યાઓ

ઉપભોક્તાઓ બેઈમાન અને અનૈતિક વ્યાપારીઓ, ધંધાદારીઓ, વિતરકો, ઉત્પાદકો અને વિનિર્માતાઓ તેમજ સેવા પ્રદાતાઓ દ્વારા વિવિધ રીતે છેતરાતા હોય છે. નીચેની કેટલીક ગેરરીતીઓ તમને કયારેક તો જોવા મળી હો.

૧. ભેણસેણ:-

એટલે કે વેચવાની વસ્તુમાં હલકીકક્ષાની વસ્તુ ભેણવી દેવી. આ પદ્ધતિ આપણને અનાજ, મસાલા, ચાની પતી, ખાદ્યતેલ, પેટ્રોલ વગેરેમાં જોવા મળે છે. દા.ત. સરસરના તેલમાં રેપ-સીડ પેલ કે આર્જિનોન તેલની ભેણસેણ, કાળા મરીમાં સુકાં પણૈયાના બી, પેટ્રોલમાં કેરોસીન અને શુદ્ધ ધી / માખણમાં વેજીટેબલ ધીની ભેણસેણ થઈ શકે છે. કેટલીક વખત આવી રીતે ભેણસેણ કરેલી હલકી સામગ્રી સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

મોડયુલ - ૫
શ્રાવક જગ્યા



નોંધ



૨. નકલી ચીજોનું વેચાણા:-

એટલે કે ખરી વસ્તુને બદલે તદ્દન હલકી નજીવી કિમતની વસ્તુ પદ્ધરાવી દેવી. આવું ઘણીવાર દવાઓ, નશીલી દવાઓ અને સ્વાસ્થ્ય પોષક ઔષ્ઠોની બાબતમાં બને છે. એવા કિસ્સા પણ નોંધાયા છે કે જેના ઈજેક્શનના બલ્બમાં માત્ર પાણી હોય કે ગ્લુકોગ્ના પાણીની બોટલમાં માત્ર ડિસ્ટીલ વોટર હોય.

૩. ખોટા માપ-તોલના કાટલાં:-

એક બીજી ગેરરીતિ જે કેટલાક વેપારીઓ અજમાવે છે તે છે ખોટાં માપ-તોલના કાટલાં, જે માલ વેપવામાં વાપરે છે. વજન (કિગ્રા) ઉપર વેચાતી શક્કાજી, અનાજ, ખાંડ વગેરે વસ્તુઓ ઘણીવાર ખરેખરા વજન કે લંબાઈથી ઓછી માલુમ પડે છે. ખોટાં કાટલાં (કીલોગ્રામ, ૫૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ વગેરે) કે ખોટા આંકવાળી માપપદ્ધી કે ગજ આવા હેતુ માટે વપરાય છે અને ગ્રાહકોને છેતરવામાં આવે છે. ઘણીવાર પેકેટમાં પેક કરેલી કે સીલબંધ ડાબામાં રહેલી વસ્તુઓ લેબલ ઉપર કે પેકેટ ઉપર દર્શાવેલ હોય તેના કરતા ઓછી હોય છે. આની ચકાસણી સહેલાઈથી થઈ શકતી નથી. ઘણીવાર મીઠાઈઓ પૂંઠાના ખોખાં (જેનું વજન ૫૦ થી ૧૦૦ ગ્રામ હોઈ શકે) સાથે તોળી દેવામાં આવે છે. તમે પૂંઠાના પણ મીઠાઈ જેટલા પૈસા ચૂકવો છો.

૪. નકલી માલનું વેચાણા:-

એટલે કે માલ ઉપર જે તે ઉત્તમ કશાનો હોવાનું ચિહ્ન આપ્યું હોય તેના કરતાં હકીકતમાં કોઈ ભણતો જ માલ હોય. દા.ત. જે વસ્તુ સ્થાનિક રીતે બનાવવામાં આવી હોય તેને આયાતી વસ્તુ તરીકે વેચી દેવામાં આવે છે કારણ કે વિદેશી ચીજો બહેતર હોય એવી સામાન્ય અપેક્ષા હોય છે. હોવાનો સાબુ, ડિટરજનટ પાઉડર, ટ્યુબલાઈટ, જામ, ખાદ્યતેલ અને દવાઓ સુધ્યા ઉપર પ્રઘ્યાત બ્રાન્ડ લગાવવામાં આવે છે, જો કે તે કોઈ બીજી (કંપનીઓ) એ બનાવેલ હોય છે.

૫. સંગ્રહખોરી અને કાળા બજાર:-

એ પણ એક સમસ્યા છે જેનો સામનો ઉપભોક્તા એ કરવો પડે છે. જ્યારે કોઈપણ વસ્તુ ખુલ્લા બજારમાં ન મળતી હોય અને વેપારીઓ ઈરાદાપૂર્વક તેને સંઘરી દે છે ત્યારે તેને સંગ્રહખોરી કરે છે. તેનો હેતુ કૃત્રિમ તંગી ઉભી કરીને ભાવ વધારવાનો છે. સંઘરી રાખેલી વસ્તુઓ ચોરી-ધૂપીથી ઉચ્ચા ભાવે વેચવી એટલે કાળા બજાર. કયારેક કોઈ ઉત્પાદનો પૂરવઠો ઓછો થઈ જાય ત્યારે આવાં અનુચ્ચિત આચરણો અમલમાં મૂકાતા હોય છે. થોડા સમય અગાઉ તમે છાપામાં વાચ્યું હશે કે કેટલાંક રાજ્યોમાં ખુલ્લા બજારમાં કુંગળીની અછત હતી અને જે વેપારી પાસે સ્ટોક હતો તેઓ ઉચ્ચા ભાવે વેચતા હતા.

૬. બંધક વેચાણા:-

ઉપભોક્તા સંરક્ષણ

ટકાઉ ઉપભોક્તા વસ્તુના ખરીદનારાઓને તે વસ્તુની ખરીદીની પૂર્વ શક્તરૂપે કેટલીકવાર અન્ય વસ્તુઓ ખરીદવી પડતી હોય છે. અથવા વેચાણ બાદની એક વર્ષ સુધીની સર્વિસનો ચાર્જ એડવાન્સમાં ચૂકવવો પડે છે. તમે સાંભળ્યું હશે કે તમે જ્યારે નવું ગેસ કનેક્શન લો ત્યારે ગેસની સગડીના વેચાણ સાથે તેને સાંકળી લેવામાં આવે છે. ઘણીવાર ટી.વી. સેટ પણ એ શરતે વેચવામાં આવે છે. કે ગ્રાહકોએ એક વર્ષનો સર્વિસ ચાર્જ આગળથી ભરી ઢેવો પડે.

૭. કોઈપણ વધારાની કિંમત ચૂકવ્યા વગર ભેટ આપવી:-

અથવા કોઈ ઉત્પાદન બીજીવાર ખરીદો ત્યારે ભેટ મેળવવાની કુપન આપવી તે પણ ગ્રાહકને કોઈપણ વસ્તુ ખરીદવા માટે લોભાવવાની એક રીત છે. કેટલીકવાર વસ્તુની કિંમત વધારી દીધા બાદ ભેટો આપવામાં આવે છે. ઘણીવાર વેપારીઓ પણ કોઈપણ વસ્તુના ખરીદક્તા ઓ વચ્ચે સ્પર્ધા કે લોટરીની યોજના મૂકે છે. જ્યારે કોઈપણ ઈનામ આપવાનો તેમનો ઈરાદો હોતો નથી.

૮. ભામક જાહેરાતો:-

પણ ગ્રાહકોને છેતરવાની એક બીજી રીત છે. આવી જાહેરાતો કોઈપણ ઉત્પાદન કે સેવા ઉત્તમ ગુણવત્તા, કક્ષા કે ધોરણની હોવાની ખોટી રજૂઆત કરે છે અથવા કોઈપણ વસ્તુ કે સેવાની જરૂરિયાત કે ઉપયોગિતા ખોટી રીતે સાબિત કરે છે. એક દવાની કંપનીએ જાહેરાત આપે તે કંપનીની પેરાસિટામોલ ટીકરીની એસ્પ્રીન માફક કોઈ આડ અસર થતી નથી. પણ તેણે નિષ્ણાંતોનો રિપોર્ટ દબાવી રાખ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પેરાસિટામોલના ઉપયોગથી લીવર ઉપર નુકસાન કારક અસર પડે છે. એવી જ રીતે એક કંપનીએ પોતાની જાહેરાતમાં ધોષણા કરી કે તે કોઈ વિદેશી કંપનીના તકનીકી સહયોગથી ૧૫૦ સી.સી. ના સ્કુટરનું નિર્માણ કરે છે. હકીકતમાં આવ્યું કોઈ જોડાણ થયું જ ન હતું. એક બીજા કિસ્સામાં એક કંપની પોતાના ટી.વી. સેટના વેચાણમાં બીજી એક પ્રખ્યાત કંપની "ફિલીપ્સ" ના ટ્રેડમાર્કનો ઉપયોગ કરતી હતી. તપાસ કરતાં એવું બહાર આવ્યું કે પોતાના ટી.વી. સેટ ઉપર ફિલીપ્સનો ટ્રેડમાર્ક વાપરવા તેણે જરૂરી મંજુરી મેળવી ન હતી. જો કે આ એક ગલત અર્થઘટનનો કિસ્સો હતો કારણ કે તે કંપની પાસે પોતાના "ઓડિયો" ઉત્પાદન ઉપર ફિલીપ્સનો ટ્રેડમાર્ક વાપરવાનો અધિકારતો હતો જ, પણ માત્ર ઓડિયો સેટ પૂરતો જ.

૯. હલકા સ્તરની વસ્તુઓનું વેચાણ:-

એટલે કે એવી વસ્તુઓનું વેચાણ કે જે ગુણવત્તામાં નિર્ધારિત ધોરણ-ખાસ કરીને સલામતીને લગતી બાબતમાં મુજબની ન હોય. આવા ઉત્પાદનોમાં પ્રેશર-કુકર, સ્ટવ, હિટર, ટોસ્ટર વગેરે વિદ્યુત ઉપકરણો ગુસના બાટલા વગેરે ગણાવી શકાય.

મોડયુલ - ૫ ગ્રાહક જાગૃતિ



નોંધ



નીચેના પૈકી ક્યા વિધાનો 'ખરાં' છે અને ક્યા 'ખોટાં' છે ?

૧. મિલાવટનો અર્થ એવો નથી કે વેચાણની વસ્તુમાં હંમેશા જેરી પદાર્થો જ ભેળવવામાં આવે છે.
૨. બંધક વેચાણમાં બે વસ્તુઓ એક સરખી કિંમતે વેચવામાં આવે છે.
૩. કોઈ વસ્તુની જાહેરાતમાં તેની ખોટી રજૂઆત કરવી તે બામક જાહેરાત છે.
૪. કાળા બજાર એટલે અડવી રાતના અંધારામાં વસ્તુ વેચવી.
૫. ઉપભોક્તા સંરક્ષણ ઉપભોક્તાના હિતની રક્ષા માટેનું આંદોલન છે.

૧૮.૩ ઉપભોક્તા સંરક્ષણની જરૂરિયાત

ઉપભોક્તાઓના હિતના સંરક્ષણ માટે ઉપાયો યોજવાની જરૂરિયાત મુખ્યત્વે તેમની લાચાર પરિસ્થિતિ અને અનુચિત (અપ્રમાણિક) વેપારી તરકીબોમાંથી ઉત્પન્ન થાય છે. અલબત્ત કોઈ ખામી ભરેલા ઉત્પાદનથી થયેલા નુકસાન કે ખોટ અને સેવાઓની ખામી સામે ગ્રાહકોને રક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર તો છે જ. તેમ છતાં ઉપભોક્તાઓ યોગ્ય જાગૃતિના અભાવે અને અશાનતાના કારણે તે હકો ભોગવી શકતા નથી. દાખલા તરીકે ઉપભોક્તા તરીકે બજારમાં ઉપલબ્ધ એક સરખી જાતના વિવિધ ઉત્પાદનો પૈકી યોગ્ય ગુણવત્તાવાળ ઉત્પાદન ખરીદવાનો આપણને અધિકાર છે. પણ ઘણીવાર આપણે સાચી પસંદગી કરવામાં નિઝણ જઈએ છીએ કારણ કે આપણે બામક, લોભામણી જાહેરાતોથી દોરવાઈ જઈએ છીએ અને હલકી કક્ષાની વસ્તુ ખરીદી બેસીએ છીએ.

અમુક સંયોગોમાં આપણે એ અર્થમાં લાચાર હોઈએ છીએ કે આપણે ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે આપણે શક્તિમાન હોતા નથી. ચાલાક વેપારી પોતાના લોભામણા શબ્દોથી છેતરી શકે છે. માનો કે દવાની ટીકીઓનો પઢી ઉપર તેની 'એકસ્પાયરી ડેઇટ' વાંચી શકાય તેમ જ હોય તો આપણે એવી ઉત્પાદનમાં હોઈએ છીએ કે વેપારી જે કહે છે તે માની લઈએ છીએ. હવે જો દવાની ધારી અસર ન થાય તો આપણે ફરી વખત ડોક્ટર પાસે જઈને કોઈ બીજી દવાની ગોળીએ ઉતારી આપવા તેને વિનંતી કરીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણને જે દવા આપવામાં આવી હતી તેની ધારી અસર નહીં થઈ હોય. કારણ કે તે દવા આપણને તેની એકસ્પાયરી ડેઇટ વિતી ગયા પછી આપવામાં આવી હતી.

ઘણીવાર આપણે આપણી પોતાની એવી માન્યતાથી દોરવાઈ જતા હોઈએ છીએ કે જેને માટે કોઈ આધાર ન હોય. દાખલા તરીકે આપણામાંના ઘણાખરા એમ માનતા હોય છે કે જેમ કિંમત ઉચ્ચી તેમ ગુણવત્તા વધારે અને તેથી જો વિતરક આપણને અમુક ઉત્પાદન માટે ભલામણ કરે તો આપણે ઉચ્ચી કિંમત ચૂકવતા ખર્ચકાતા નથી.

બીજી એવી પણ પ્રચલિત માન્યતા છે કે વિટેશી આયાતી વસ્તે હંમેશા ઉત્તમ કક્ષાની જ હોય છે. તેથી જો આપણે છાપેલું લેખલ કે એવી નિશાની જોઈએ કે જે અવું દર્શાવતી

ઉપભોક્તા સંરક્ષણ

હોય કે તે વસ્તુ કોઈ પરદેશમાં બની છે તો આપણે તે કથાં બની છે તેની ખાતરી કર્યા વગર આપણે તે ઉચ્ચી કિંમતે ખરીદી લેતા હોઈએ છીએ.

પેકેટોમાં વેચાતી પ્રસંસ્કૃત (તૈયાર) ખાદ્ય સામગ્રી જેમ કે બટેટાની ચીપ્સ (કાતરી) આરોગ્ય માટે સારી નથી. પણ જુવાન છોકરા છોકરીઓ તે ખરીદીને ખાય છે. કારણ કે તે સ્વાદિષ્ટ હોય છે. ઠંડા પીણાની કેટલીક બ્રાન્ડ યુવક યુવતીઓમાં બહુ જ લોકપ્રિય હોય છે. કારણ કે તે ખાંડની રજુઆત ટી.વી.ઉપર કરનાર પ્રખ્યાત અભિનેતાઓ કે ડિકેટરો હોય છે અને તેઓ જે કહે તેનું તેમના ચાહકોમાં ભારે વજન હોય છે. વધારે પડતાં ઠંડા પીણા પીવા તે પણ આરોગ્ય માટે સારું નથી. એવું લાગે છે કે જાણી આપણે ખાંડ અને મીઠું નાખેલું તાજુ લીબુનું સરબત પીવાનું ભૂલી જ ગયા છીએ.

ઘણીવાર કેટલીક વસ્તુઓના ઉત્પાદકો પોતાના પેકીંગ ઉપર ISI જેવા પ્રમાણભૂત માનક ચિહ્નનો લગાડી દે છે જે આકરી તપાસ બાદ સાચી રીતે પ્રમાણિત કરવામાં આવતું હોય છે. એ જ રીતે આપણે જે વસ્તુના પૈસા ચુકવીએ છીએ તે વસ્તુ પેકીંગમાં મળતી હોય અને તેમાં વજન ઓછું હોય તો હંમેશા વસ્તુ ખરીદતાં પહેલાં તેનું વજન ચકાસી જોવાનું મુશ્કેલ હોય છે. ઘણીવાર તોલવાના કાંટા પણ ખામીવાળા હોય છે.

સોથી મોટી વાત તો એ છે કે જો વસ્તુઓ ખામીવાળી હોય કે સેવાઓમાં કોઈ પણ ઉણપ હોય તો ઉપભોક્તાઓ સમક્ષ જે માર્ગ બુલ્લા છે તેની તેમને જાણકારી હોતી નથી.

આમ, તમે હવે ખૂબ સારી રીતે સમજી ચૂક્યા હશો કે વેપારીઓની બદદાનત કે જે અન્યાયી છે અને આરોગ્યને નુકસાનકારક કે હાનિકર્તા છે અને બીજી જોબની ભયંકર અસર કરે છે, તેનાથી ઉપભોક્તાઓનું રક્ષણ શા માટે જરૂરી છે.



૧૮.૨ પાઠગત પ્રશ્નો

કોંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો

- મારો પાડોશી વીજળીનો સામાન ખરીદવા હંમેશા નજીકીની દુકાને જાય છે. કારણ કે તેને પોતાના મૂળભૂત હક્કની ખબર નથી.
(કિંમત તપાસવાના, પસંદગી કરવાના, ગુણવત્તા ચકાસવાના)
- યુવાન છોકરાઓ પેકેટમાં મળતો તૈયાર ખોરાક ટગલાબંધ ખાય છે. કારણ કે તેઓ જાણતા નથી કે આવો ખોરાક તેમના આરોગ્ય માટે ખરાબ છે અને તેમને તેમના હક્કની ખબર નથી.
(ખરાબ ખોરાકે પાછો કાઢવાના, બીજાઓ પાસેથી સલાહ મેળવવાના, સૂચના પ્રાપ્ત કરવાના)
- કેટલાક ઉપભોક્તાઓ વસ્તુઓ માટે ઉચ્ચી કિંમતે આપવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે તે દર્શાવે છે કે
(તેઓ સમૃદ્ધ છે, દુકાનદાર વાજબી ભાવ લે છે, વસ્તુઓ ઉત્તમ કક્ષાની છે.)

વાર્ષિક વ્યવસ્થા

મોડયુલ - ૫

શ્રાહક જગ્યાનિ



નોંધ



૪. જ્યારે તમે જાહેરાતમ કરેલા દાવા મુજબ કોઈ નવા બ્રાન્ડ નામવાળી વસ્તુ સર્વોત્તમાં કક્ષાની માનીને ખરીદો છો અને ત્યારપછી તે ખામી પૂર્ણ જણાય છે ત્યારે જાહેરાતનો કિસ્સો બને છે.
(સારી, ખોટી, બામક)

૧૮.૪ ઉપભોક્તા સંરક્ષણ સાથે સંલગ્ન પક્ષો

ઉપભોક્તાઓના હિતનું રક્ષણ કરવા માટે ભરવામાં આવતા પગલાંની જરૂરિયાત હવે તમે સમજી ગયા છો. હવે પ્રશ્ન એ થાય કે એ પગલાં ભરે કોણ? શું ઉપભોક્તા એકલા આ કરી શક્શો? અથવા શું આપણો સરકાર પર આધાર રાખવો? વેપારીઓ આ બાબતમાં કંઈ કરી શકે? ખરેખર અસરકારક ઉપભોક્તા સંરક્ષણ માટે આ ત્રણોય પક્ષોએ સામેલ થવું જોઈએ એટલે કે (૧) ઉપભોક્તાઓ (૨) વેપારીઓ અને (૩) સરકાર.

આ દરેક પક્ષ શું કરી શકે તે જોઈએ.

૧. સ્વ-સહાય એજ ઉત્તમ સહાય:-

તેથી શક્ય હોય ત્યાં સુધી ઉપભોક્તાએ પોતે જ પોતાના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. અને બજારની ગેરરીતીથી પોતાની જાતને બચાવવી જોઈએ. આ હેતુ માટે જરૂરી એ છે કે તેઓએ પોતાના હકો વિષે જાણવા અને તેઓ અમલ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે વેપારીઓની શુભ દાનત ઉપર ભરોસો રાખવો જોઈએ નહિ. ઉપભોક્તાઓને શિક્ષણ મેળવવાનો અને પોતાની વાત સંભળાવવાનો અધિકાર છે. તેમણે સ્થાનિક ઉપભોક્તા સંઘ અથવા તેમના પોતાના ઉપભોક્તા સંઘ દ્વારા ઉપભોક્તાઓ માટે ગોઠવેલા તાલીમ કાર્યક્રમાં હાજરી આપવી જોઈએ અને ઉપભોક્તાઓ માટે કામ કરનાર જાહેર કાર્યક્રમાં ઉપભોક્તાઓના સંરક્ષણ માટેના કાયદા અંતર્ગત મળતા હકો અને ઉપાયો વિષે વ્યાખાન આપવા આમંત્રણ આપવું જોઈએ.

૨. વ્યાપારીઓનો પ્રશ્ન:-

વ્યાપારીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી વિનિર્માતાઓ, ઉત્પાદકો, વિતરકો, ડીલરો, જથ્થાબંધ તેમજ છૂટક વેપારીઓ વગેરે તમામ વ્યક્તિઓએ પોતાના હિતમાં ઉપભોક્તાઓના હકોનું સંભાન કરવું જોઈએ. તેઓએ ઉત્તમ પ્રકારની વસ્તુઓ અને સેવાઓની ખાતરી આપવી જોઈએ અને તે પણ વાજભી કિંમતે. ગેરરીતિ રોકવા માટે વ્યાપારી સંઘો, યેભાર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વિનિર્માતા સંઘોએ તેમના સભ્યો સામેની ઉપભોક્તાઓની ફરિયાદ સંભળવી જોઈએ અને ગલત તરીકા અપનાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

૩. સરકાર પક્ષો:-

ઉપભોક્તા સંરક્ષણની જવાબદારી આમ જનતાના સર્વસામાન્ય હિતમાં સરકારે સ્વીકારવી જોઈએ. ઉપભોક્તા મંડળોના દ્રષ્ટિકોણના પરિપ્રેક્ષયમાં વિવિધ કાયદાઓ લાગુ પાડવા જોઈએ અને ઉપભોક્તાઓના હિતમાં જરૂર જણાય તો કાયદાઓમાં સુધારા

ઉપભોક્તા સંરક્ષણ

કરવા જોઈએ. સરકારે કેન્દ્ર અને રાજ્ય સરે ગ્રાહક માટે નીતિ ઘડનાર મંડળોમાં પણ ગ્રાહક જૂથોને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. સરકારે વખતોવખત સંખ્યાબંધ પગલાં લીધા છે.



૧૮.૩ પાઠગત પ્રશ્નો

નીચેના પૈકી ક્યા વિધાનો 'ખરાં' છે અને ક્યા 'ખોટાં' છે?

૧. ઉપભોક્તાઓના હિતના રક્ષણ માટે વેપારીઓ કરી ન કરી શકે.
૨. સરકાર ઉપભોક્તાઓના હિતના રક્ષણની બાબતમાં ઉદાસીન છે.
૩. ઉપભોક્તાની સમસ્યા પરતે ઉપભોક્તા સંઘ તેમનું દ્રષ્ટિ બિંદુ રજૂ કરે તે સાંભળવા માટે તેઓને પ્રતિનિધિઓ મોકલવા આમંત્રણ આપવું જોઈએ.
૪. મૂળભૂત હકો માત્ર જાણવા તે પૂરતું નથી. ઉપભોક્તાઓએ પોતાના હકો પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
૫. ઉપભોક્તાઓએ સ્થાનિક ઉપભોક્તા મંડળોએ યોજેલા કોઈપણ તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવી ન જોઈએ.

૧૮.૪ ઉપભોક્તાઓને કાનૂની રક્ષણ

ભારત સરકારે પાછળનાં કેટલાંક વર્ષોમાં ઉપભોક્તાઓના હિતના સંરક્ષણ માટે કેટલાય કાનૂન બનાવ્યા છે. આ કાયદાઓના હેતુની ટૂંકી રૂપરેખા નીચે આપવામાં આવી છે.

૧. કૃષિ ઉત્પાદન (વર્ગીકરણ અને વેચાણ) અધિનિયમ-૧૯૭૭:-

આ અધિનિયમ હેઠળ ખેત પેદાશોનો ગુણવત્તા સ્તર નક્કી કરવા તેમજ તેને પ્રમાણપત્ર આપવાનું પ્રાવધાન છે. આવી પેદાશો ઉપર ભારત સરકારનાં કૃષિ વિપલન વિભાગનું ગુણવત્તા પ્રમાણ પત્રસીલ "એકગમાર્ક" લગાવવાની છૂટ આપવામાં આવે છે.

૨. ઔદ્યોગિક (વિકાસ અને નિયમન) કાનૂન, ૧૯૫૧:-

આ કાનૂન હેઠળ ઉત્પાદિત વસ્તુઓના ઉત્પાદન અને વિતરણ ઉપર નિયંત્રણની જોગવાઈ છે. આ કાનૂન મૂજબ જો કેન્દ્ર સરકારને જણાય કે ઉત્પાદનમાં ભારે કભી આવે છે અથવા ઉત્પાદનની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અથવા કિંમતમાં ગેરવાજબી વધારો થયો છે. તો ભારત સરકાર કોઈપણ ઉદ્યોગની તપાસ કરવાનો આદેશ આપી શકે છે. જરૂરી તપાસ બાદ ભારત સરકાર સુધીરવા માટે નિર્દેશ જારી કરે છે. અને જો નિર્દેશોનું પાલન ન થાય તો સરકાર જે તે ઉદ્યોગની હસ્તગત કરી લઈ શકે છે.

મોડયુલ - ૫

ગ્રાહક જાગૃતિ



નોંધ



૩. ખાદ્ય પદાર્થ ભેણસેળ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૪:-

આ અધિનિયમ અંતર્ગત ખાદ્ય પદાર્થમાં ભેણસેળ માટે આકરી સજાની જોગવાઈ છે. એવા ભેણસેળ ખાદ્ય પદાર્થ વેચવા કે જેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે અને કદાચ મૃત્યુ પણ નીપણી શકે તેને માટે આજીવન કેદ અને ઓછામાં ઓછા ૩૦૦૦ (ત્રણ હજાર) રૂપિયા દંડની જોગવાઈ છે. આ માટે ખાદ્ય પદાર્થ નિરીક્ષકો નીમવામાં આવે છે અને તેમને વસ્તુઓ નમુનો લઈને વિશ્વેષણ માટે મોકલવાનો પણ અધિકાર છે. આ અધિનિયમ હેઠળ ભેણસેળવાળી ખાદ્ય સામગ્રીના ઉત્પાદન, આયાત સંગ્રહ, વેચાણ અને વિતરણ સંબંધી અપરાધ માટે પણ દંડની જોગવાઈ છે.

૪. આવશ્યક વસ્તુ અધિનિયમ – ૧૯૫૫:-

આ કાનૂન મુજબ સરકારને સાર્વજનિક હિતમાં કોઈપણ વસ્તુને આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવાનો હક છે. ત્યાર પછી સરકાર જે તે ઉત્પાદન, પૂરવઠો, તિરણ અને એવી વસ્તુઓના વેપાર ઉપર નિયંત્રણ મૂકી શકે. આ અધિનિયમ હેઠળ નક્ષખોરો, સંગ્રહખોરો અને કાળા બજારિયાઓની અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે.

૫. તોલ-માપ માનક અધિનિયમ, ૧૯૫૬:-

આ અધિનિયમ મુજબ સમગ્ર દેશમાં વજનના અને લંબાઈના પ્રમાણભૂત સાધનોના ઉપયોગ કરવાનું પ્રાવધાન છે. લંબાઈના માપ માટે "મીટર" અને વજનના માપ માટે "કિલોગ્રામ" ને પ્રાથમિક ઓકમ તરીકે મુકુરર કરાયા છે. આ કાનૂન અમલમાં આવ્યો તે અગાઉ દેશમાં જુદા જુદા ભાગોમાં વજન અને પરિણામની જુદી જુદી પદ્ધતિઓ પ્રવર્તમાન હતી. જેમ કે વજન તરીકે પાઉન્ડ, છટાંક અને શેર અને લંબાઈ માટે ઈચ્ચા, ફૂટ અને વાર વગેરે.

આ તફાવતો વેપારીઓને ઉપભોક્તાઓને છેતરવાની (તેમનું શોષણ કરવાની) તક આપતા હતા.

૬. એકાધિકાર અને પ્રતિબંધિત વ્યાપાર અધિનિયમ, ૧૯૬૮ :-

આ અધિનિયમ હેઠળ ૧૯૮૮ અને ૧૯૮૪માં થયેલા સંશોધન (સુધારા) મુજબ ઉપભોક્તા સમૂહ પ્રતિબંધિત અને અનુચિત (અન્યાયી) વ્યાપારી ગતિવિધિઓ સામે ફરિયાદ દાખલ કરીને પોતાના દાદ (ફરિયાદ, નુકસાનનું વળતર) ના અધિકારનો ઉપયોગ કરી શકે છે. સરકારે "એકાધિકારી અને પ્રતિબંધિત વ્યાપાર આયોગ" MRTP (Monopolies and Restrictive Trade Practice) ની રચના કરી છે. તેને જરૂરી તપાસ કર્યો બાદ ઉપભોક્તાઓની ફરિયાદનો નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે. આ આયોગને ઉપભોક્તાને સહન કરેલ ખોટ કે નુકશાન (ઈજા) નું વળતર આપવાના આદેશ કરવાની પણ સત્તા છે. આ આયોગ અનુસૂચિત વ્યાપાર ગતિવિધિઓ ઉપર તપાસ દરમિયાન ક્રમચલાઉ પ્રતિબંધ પણ મૂકી શકે છે. તેની સિવિલ કોર્ટની સમકક્ષ અધિકારો આપવામાં આવ્યા છે.

ઉપભોક્તા સંરક્ષણ

૭. કાળા બજાર નિયંત્રણ અને આવશ્યક વસ્તુ પુરવઠા અધિનિયમ, ૧૯૮૦:-

આ કાનુનાં પ્રાથમિક હેતુ કાળા બજાર રોકવા અને આવશ્યક વસ્તુઓનો પુરવઠો જગ્યાઈ રહે તે માટે દોષિત લોકો ને બંદી બનાવવાનો છે. આ કાનુનના હેતુ વિરુદ્ધ કોઈપણ રીતે કોઈપણ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને વધુમાં વધુ છ માસની જેલની સજા થઈ શકે છે.

૮. ભારતીય માનક બ્યૂરો અધિનિયમ, ૧૯૮૬:-

આ અધિનિયમ હેઠળ ભારતીય માનક બ્યૂરોની રચના થઈ છે. આ બ્યૂરોએ ભારતીય માનક સંસ્થાન (ISI- Indian Standards Institution)નું સ્થાન લીધું છે. આનો હેતુ ઉપભોક્તાઓના હિતનું રક્ષણ કરવાનો અને આગળ વધારાવાનો છે. તેની મુખ્ય બે પ્રવૃત્તિઓ છે. વસ્તુઓ માટે ગુણવત્તા માપદંડ નક્કી કરવા અને તેમને BIS સ્ટીફીકેશન ચિહ્ન યોજના મુજબ તેમને પ્રમાણિત કરવા જેના દ્વારા સલામતી અને કામગીરીના નિર્ધારિત ગુણવત્તા ધોરણો મુજબ છે કે કેમ તેની પર્યાપ્ત ચકાસણી બાદ નિર્માતાઓને તેમના ઉત્પાદનો ઉપર ISI નો માર્કો લગાવવાની મંજૂરી આપવામાં આપે છે. બ્યૂરોને સામાન્ય ઉપભોક્તાઓમાં ગુણવત્તા વિષયક જાગૃતિ ઉત્પન્ન કરવાના આશયથી ઉપભોક્તા બાબત વિભાગની સ્થાપના કરી છે. ઉપરાંત એક સાર્વજનિક ફરિયાદ સેલ પણ છે. જેમાં ઉપભોક્તાઓ ISI માર્કોવાળા ઉત્પાદન વિષે ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

૯. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬:-

આ અધિનિયમ અન્ય કોઈપણ કાનુનની સરખામણીમાં ઉપભોક્તાઓને વધારે વ્યાપક સંરક્ષણ આપે છે. ઉપભોક્તાઓ વિશાળ પાયે ચાલતી વ્યાપક ગેરરીતિઓ સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. આમાં માત્ર વસ્તુઓ કે ઉત્પાદનો જ નહીં પણ બેંકીંગ, વીમો, ઘનભંડોળ, પરિવહન, ટેલીફોન, વીજળી કે અન્ય ઉજ્જ્વલ પુરવઠો, આવાસ નિર્માણ, લોજીંગ-બોર્ડિંગ, મનોરંજન આંદ-પ્રમોટ વગેરે સેવાઓમાં ખામી પણ સમાવિષ્ટ છે. આ અધિનિયમમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ઉપભોક્તા સંરક્ષણ પરિષદો સ્થાપવાની પણ જોગવાઈ છે. આ ઉપરાંત ઉપભોક્તાઓની તકરાર-નિવારણ અર્થે ન્યાયિક પ્રણાલીની પણ આ અધિનિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. આમાં જિલ્લા ફોરમ, રાજ્ય આયોગ અને રાષ્ટ્રીય આયોગ પણ સમાવિષ્ટ છે. તેમને ઉપભોક્તા અદાલત પણ માની શકાય.



૧૮.૪ પાઠગત પ્રશ્નો

નીચેના કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે ?

- જો ખાદ્ય પદાર્થોમાં કોઈ વ્યક્તિએ મિલાવટ કરી હોય તો ખાદ્ય પદાર્થ ભેણસેળ નિયંત્રણ ધારા હેઠળ કઠોર સજાની જોગવાઈ છે.

મોડયુલ - ૫
શ્રાહક જાગૃતિ



નોંધ

મોડયુલ - ૫

ગ્રાહક જાગૃતિ



નોંધ

ઉપભોક્તા સંરક્ષણ

૨. તોલ-માપ માનકો (ધોરણ) અધિનિયમ વિવિધ સ્થળોએ વાપરવાના પ્રમાણભૂત તોલ-માપ નક્કી કરે છે.
૩. ઉપભોક્તા સંઘો ઉપભોક્તાઓ વતી એકાધિકાર અને પ્રતિબાધિત વ્યાપાર (MRTP) આયોગ સમક્ષ ફરિયાદ કરી શકે નહીં. માત્ર ઉપભોક્તા જ વ્યક્તિગત રીતે પોતાના તરફથી જ એમ કરી શકે.
૪. આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કેન્દ્ર અને રાજ્યકષાએ ઉપભોક્તા સંરક્ષણ પરિષદોની સ્થાપના કરવામાં આવી છે.
૫. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ હેઠળ કેન્દ્ર અને રાજ્ય કષાએ ઉપભોક્તા સંરક્ષણ પરિષદોની સ્થાપના કરવામાં આવી છે.
૬. ભારતીય માનક બ્યૂરો વસ્તુઓ માટેના ગુણવત્તા ધોરણો નક્કી કરે છે અને ઉત્પાદકોને ગુણવત્તા પ્રમાણીકરણ ચિહ્નો વાપરવાની ધૂટ આપે છે.
૭. કોઈપણ વસ્તુને આવશ્યક વસ્તુ તરીકે ધોષિત કરવાની સરકારને સત્તા છે.

૧૮.૬ ઉપભોક્તા અદાલતોનું અધિકાર કોન્ટ્રેન્ટ

ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ હેઠળ સ્થાપિત ન્યાયિક વ્યવસ્થામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ઉપભોક્તા અદાલતો સમાવિષ્ટ છે. તેમને અનુક્રમે જિલ્લા ફોરમ, રાજ્ય ઉપભોક્તા ફરિયાદ નિકાલ આયોગ (રાજ્ય આયોગ) અને રાષ્ટ્રીય ઉપભોક્તા ફરિયાદ નિકાલ આયોગ (રાષ્ટ્રીય આયોગ) તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિગત ઉપભોક્તા સામાન, કિમત અને વળતર માટેના દાવાના આધારે જિલ્લામાં, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ફરિયાદરૂપે રજૂ કરી શકે છે

જો વસ્તુઓ કે સેવાઓની કિમત કે વળતરનો દાવો રૂપિયા ૨૦ લાખથી વધુ ન હોય તો તમામ ફરિયાદોનો ફેસલો જિલ્લા ફોરમના અધિકાર કોન્ટ્રેન્ટમાં આવે છે. કિમત કે રકમ રૂ.૨૦ લાખથી વધુ હોય પણ ૧ કરોડથી વધુ ન હોય ત્યાં કેસોનો નિકાલ કરવાની રાજ્ય આયોગને સત્તા છે. રાજ્ય સરકાર જિલ્લા ફોરમની વિરુદ્ધની ફરિયાદોનો પણ નિકાલ કરે છે. રૂ.૧ કરોડના વધુ રકમના તમામ દાવા કે ફરિયાદો રાષ્ટ્રીય આયોગના અધિકાર કોન્ટ્રેન્ટમાં આવે છે. વળી રાજ્ય આયોગો જાતી કરેલા આદેશો સામે અપીલ થઈ હોય તેનો નિકાલ કરવાની પણ તેને સત્તા છે અને રાષ્ટ્રીય આયોગના આદેશો સામે અપીલ કરવી હોય તો જે તે ફરિયાદી પક્ષે સર્વોચ્ચ ન્યાયલયમાં અપીલ કરવી પડે છે.

૧૮.૭ ઉપભોક્તા ફરિયાદ નિવારણ પ્રક્રિયા

આગળના વિભાગમાં દર્શાવ્યા મુજબ ઉપભોક્તા ફરિયાદ વ્યક્તિગત ઉપભોક્તા દ્વારા અથવા ઉપભોક્તા સંઘો દ્વારા પણ દાખલ કરી શકાય. ફરિયાદ જે જિલ્લામાં ફરિયાદના કારણરૂપ મામલો બન્યો હોય અથવા જ્યાં વિરોધ (સામેનો) પક્ષ રહેતો હોય તે જિલ્લા ફોરમમાં નોંધાતી શકાય અથવા રાજ્ય સરકાર અથવા સંઘ પ્રદેશ (કેન્દ્ર શાસિત પ્રદેશ) દ્વારા અધિસૂચિત (અધિકૃત) રાજ્ય આયોગ સમક્ષ અથવા નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય આયોગ સમક્ષ રજૂ કરી શકાય.

ઉપભોક્તા સંરક્ષણ

ફરિયાદ નોંધાવવા માટે કોઈ ફી નથી. ફરિયાદ ફરિયાદી કે તેના અધિકૃત એજન્ટ દારા રૂબરૂ કે ટપાલથી પણ દાખલ કરી શકાય છે. સામાન્ય રીતે ફરિયાદ દાખલ કરવા માટે નીચે આપેલ સૂચનાઓ સહિત કુલ પાંચ નકલોની જરૂર પડે છે.

૧. ફરિયાદીનું નામ, સરનામું અને વિવરણ.
૨. વિરોધપક્ષ કે પક્ષોનું નામ, સરનામું અને વિવરણ.
૩. ફરિયાદને લગતાં તથ્યો અને મામલો કયાં અને કયારે બન્યો તેની વિગત.
૪. ફરિયાદ કરવામાં આવેલા આરોપોના સમર્થનમાં જો કોઈ દસ્તાવેજ હોય તો તે (દા.ત. રોકડબીલ, પાવતી વગેરે).
૫. ફરિયાદી કેવા પ્રકારની રાહત ઈચ્છે છે તેનું વર્ણન.

ફરિયાદ ઉપર ફરિયાદી કે તેના અધિકૃત એજન્ટની સહી હોવી જોઈએ. તે જિલ્લા ફોર્ક, રાજ્ય આયોગ કે રાષ્ટ્રીય આયોગનાં અધ્યક્ષને સંબોધિત હોવી જોઈએ. કોઈપણ ફરિયાદ ફરિયાદનો મામલો બન્યાની તારીખથી બે વર્ષની અવધિની અંદર દાખલ કરવી જોઈએ. તેમાં જો વિલઘ્ય થાય અને જે તે ફોરમ / આયોગ તેને ક્ષમ્ય ગણે તો વિલઘ્યના કારણની નોંધ રેકર્ડ ઉપર હોવી જોઈએ.

શક્ય હોય ત્યાં સુધી ફરિયાદોનો નિકાલ વિરોધ પક્ષોને નોટિસ મળ્યાની તારીખથી ત્રણ મહિનામાં થઈ જવો જોઈએ. જે ફરિયાદોમાં પ્રયોગશાળામાં વિશ્વેષણ અને પરીક્ષણ જરૂર હોય તેમાં આ મુદ્દત વધારીને પાંચ મહિનાની કરવામાં આવે છે.

ફરિયાદોનું સ્વરૂપ અને ઉપભોક્તાએ માંગેલી રાહત અને કેસના તથ્યોને આધારે ફરિયાદ નિવારણ ફોરમ / આયોગ નીચે દર્શાવેલ પૈકી એક કે વધારે રાહતોનો આદેશ આપે છે.

૧. વસ્તુઓમાં ક્ષતિ / સેવાઓમાં ખામી દૂર કરવી.
૨. વસ્તુને બદલે બીજી વસ્તુ આપવી / સેવાઓને પુનઃ દૂરસ્ત કરવી.
૩. વસ્તુ માટે ચૂકવેલી કિંમત અથવા સેવાઓ માટે ચૂકવેલ વધારાની રકમ પરત કરવી.
૪. સહન કરેલ નકસાન કે ખોટ માટે વળતર (અપાવવું).



૧૮.૫ પાઠગત પ્રશ્નો

૧. કોંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
 ૧. જિલ્લા ફોર્મ એ ફરિયાદોની સુનાવણી કરી શકે જેમાં વસ્તુઓનું મૂલ્ય અને વળતરની રકમ રૂપિયાથી અધિક ન હોય.
(રૂ.૫ લાખ, રૂ.૨૦ લાખ, રૂ.૧ કરોડ)

મોડયુલ - ૫ ગ્રાહક જાગૃતિ



નોંધ



૨. જ્યારે જિલ્લા ફોરમ પાસે જે ફરિયાદ રજૂ કરવામાં આવે તેમાં વસ્તુનું પરીક્ષણ જરૂરી હોય ત્યારે તે કેસનો નિકાલ મહિનાની અંદર લાવવાનો રહે છે.
(૩ મહિના, ૪ મહિના, ૫ મહિના)
 ૩. રાષ્ટ્રીય આયોગનું કાર્યક્ષેત્ર એ ફરિયાદોનું નિરાકરણ કરવાનું છે, જેમાં વસ્તુની કિંમત થી ઉપર હોય છે.
(રૂ.૨૦ લાખ, રૂ.૫૦ લાખ, રૂ.૧ કરોડ)
 ૪. રાજ્ય આયોગ આંદેશ વિરુદ્ધ ફરિયાદ માં દાખલ કરવી પડે.
(સર્વોચ્ચ ન્યાયલય, ઉચ્ચ ન્યાયલય, રાષ્ટ્રીય આયોગ)
 ૫. રાજ્ય આયોગ તે કેસનો નિકાલ કરી શકે જેમાં વસ્તુઓનું મૂલ્ય / વળતર રૂ. થી વધુ ન હોય.
૨. નીચેના પૈકી કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે ?
 ૧. ઉપભોક્તાની ફરિયાદ માત્ર ઉપભોક્તા પોતે જ કરી શકે.
 ૨. જિલ્લા ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કોઈ ફી નથી.
 ૩. કોઈ ફરિયાદ રૂબરૂ અથવા ટપાલ દ્વારા પણ દાખલ કરી શકાય.
 ૪. ફરિયાદ મામલો ઉત્પન્ન થાય તે તારીખથી એક વર્ષની અંદર દાખલ થવી જોઈએ.
 ૫. ટેલીફોન સેવામાં ખામી અંગેની ફરિયાદમાં માગવામાં આવેલી રાહતમાં ક્ષતિ દૂર કરવી, સેવા પુનઃ ચાલુ કરવી, ચૂકવેલી વધારાની રકમ રીફન્ડ મેળવવી અથવા તેને સમયોજિત કરવી તેમજ નુકસાનીનું વળતર વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
 ૬. દાખલ કરવાની ફરિયાદમાં ઉપભોક્તા કે તેના અધિકૃત એજન્ટની સહી જોઈએ.

૧૮.૮ બિન–સરકારી સંગઠનોની ભૂમિકા

બિન–સરકારી સંગઠનો (NGOs)એ એવા લોકોના મંડળો છે જે કોઈપણ લાભના પ્રલોભન વગર આમ જનતાના કલ્યાણને આગળ ધ્યાવવાનો ધોય રાખે છે. તેઓ સૈચિંહ્યક સેવાભાવી સંસ્થાઓ છે તેમને પોતાનું બંધારણ હોય છે. અને પોતાના જ નિયમો હોય છે. અને તેઓ સરકારી હસ્તક્ષેપથી મુક્ત હોય છે. તેઓ દાન ઉપર અને આંશિક રીતે સરકારી સહાય પર આધારિત હોય છે. ઉપભોક્તાઓની સમસ્યા પરતે કાર્યરત બિનસરકારી સંગઠનોને ઉપભોક્તા સંઘો કે ઉપભોક્તાઓની સમસ્યા પરતે કાર્યરત બિન સરકારી સંગઠનોને ઉપભોક્તા સંઘો કે ઉપભોક્તા મંડળો તરીકે ગણવામાં આવે છે.

ઉપભોક્તવા સંરક્ષણ

છેલ્લા બે દાયકરીમાં બિન સરકારી સંગઠનો ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ બનતી રહી છે. ભારતમાં આજે ૮૦૦ થી વધુ આવાં સંગઠનો છે. આ સંગઠનો સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અથવા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલા હોય છે.

બિન સરકારી સંગઠનો એ ઉપભોક્તવા આંદોલનના અંગ રૂપે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. તેઓ નીચેનાં જેવા કેટલાક કાર્યો કરે છે.

૧. ઉપભોક્તવાના અધિકારો વિષે જાગૃતિ પેદા કરે છે અને પરિસંવાદો, કાર્યશાળાઓ અને તાલીમ કાર્યક્રમો દ્વારા ઉપભોક્તવાની સમસ્યાઓ અને ઉપાયો વિષે સામાન્ય પ્રજાજનોને શિક્ષણ આપે છે.
૨. ઉપભોક્તવાઓને કાનૂની ઉપાયો શોધવામાં સહાય કરી કાનૂની સહાય પૂરી પાડે છે.
૩. ઉપભોક્તવા સંરક્ષણ પરિષદ અને અન્ય અધિકૃત બોર્ડોના પ્રતિનિધિ સભ્યો તરીકે ઉપભોક્તવા દ્વારા બિંદુની રજૂઆત કરે છે.
૪. પોતાના પરીક્ષણ સાધનો અથવા માન્ય પ્રયોગશાળાઓ દ્વારા ઉપભોક્તવા ઉત્પાદનોનું તુલનાત્મક પરીક્ષણ યોજે છે જેથી પ્રતિયોગી બ્રાન્ડોની સાપેક્ષ ગુણવત્તાનું મૂલ્યાંકન થઈ શકે. અને ઉપભોક્તવાઓ જાણકાર ખરીદકર્તા બને તે માટે તેમના હિતમાં આવા પરીક્ષણોના પરિણામો પ્રકાશિત કરે છે.
૫. ઉપભોક્તવાઓની સમસ્યાઓ, કાનૂની રિપોર્ટિંગ (કાર્યવાહી) અને હિત સંબંધી ઉભરતી અન્ય બાબતો વિષે વાચકોમાં માહિતીનું વિતરણ કરવા સમાયિકો, માહિતી પુસ્તિકાઓ વગેરે પ્રકાશિત કરે છે. મોટાભાગના સામયિકો વેપારી પેઢીઓની જાહેરાત સ્વીકારતા નથી.
૬. સૂચનાઓ આપે છે અને પગલાં લેવાની ભલામણ કરે છે. જેને સરકારી અધિકારીઓઓ નીતિ ઘડવામાં અને ઉપભોક્તવાઓના હિતમાં અપનાવેલા વહીવટી ઉપાયોમાં ગણતરીમાં લેવી પડે છે.
૭. કેટલાક કિસ્સામાં કેટલાંક બિન સરકારી સંગઠનોએ ઉપભોક્તવાઓના હકો દાખલ કરવામાં બણું સફળતાપૂર્વક જાહેર હિતના દાવા કરેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો બિન સરકારી સંગઠનોએ કોઈ વ્યક્તિ માટે નહીં પણ જાહેર જનતાના હિત માટે ન્યાય અદાલતમાં દાવા દાખલ કરેલા છે.



૧૮.૧ પાઠગત પ્રશ્નો

- નીચેના કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે ?
 - બિન સરકારી સંગઠનો નફો નહીં કરનાર સંગઠનો છે.

મોડયુલ - ૫ ગ્રાહક જાગૃતિ



નોંધ



નોંધ

૨. સામાન્ય રીતે સરકારી ધારા–ધોરણ બિન સરકારી સંગઠનોની ક્રમગીરી ઉપર નિયંત્રણ રાખે છે.
 ૩. ઉપભોક્તા આંદોલન સાથે સંકળાયેલા બિન સરકારી સંગઠનો દ્વારા યોજાના પરિસંવાદો, કાર્યશાળાઓ અને તાલીમ કાર્યક્રમો ઉપભોક્તાઓના શિક્ષણ માટેહોય છે.
 ૪. બિન સરકારી સંગઠનો સરકારી નીતિના ઘડકેયાઓ અને વહીવટી મંડળો દ્વારા ઉપભોક્તાઓની વાત સાંભળવાના હકનો અમલ કરે છે.
 ૫. ઉપભોક્તા સંગઠનોએ કરેલી ભલામણો સરકાર જ્યારે પ્રવર્તમાન કાયદામાં સુધારા કરે ત્યારે લક્ષમાં લે છે.
૨. વૈકલ્પિક પ્ર નો.



તમે શું શીખ્યા?

- ઉપભોક્તા સંરક્ષણનો અર્થ એ છે વ્યાપારમાં થતી ગેરરીતિઓથી ઉપભોક્તાઓને બચાવવા માટે જરૂરી પગલાં અને જરૂરી ઉપાયો યોજવા.
- ઉપભોક્તાઓ નડતી સમસ્યાઓનું સ્વરૂપ:-

 - વસ્તુઓમાં ભેણસેળ
 - નકલી ચીજોનું વેચાણ
 - ખોટા તોલ-માપ
 - ભળતો માલ વેચવો
 - સંગ્રહખોરી અને કાળા બજાર
 - બંધક (શરતી) વેચાણ
 - ભેટ આપવી
 - લોભામણી જાહેરાતો
 - હલકી કક્ષાની વસ્તુ કેચવી

ઉપભોક્તા સંરક્ષણ

- ઉપભોક્તા સંરક્ષણની જરૂર-ઉપભોક્તાઓના હિતનું રક્ષણ કરવા માટે યોજવામાં આવતા ઉપયોગી આવશ્યકતા મુખ્યત્વે તેમની લાચાર પરિસ્થિતિ અને અનુસૂચિત વ્યાપારી આચરણોને લીધે ઉત્પન્ન થાય છે.
- ઉપભોક્તા સંરક્ષણ સંબંધી પક્ષો :
 - (i) ઉપભોક્તા
 - (ii) વેપારીઓ
 - (iii) સરકાર
- ઉપભોક્તાઓનું કાનૂની રક્ષણ :
 - ઔદ્યોગિક (વિકાસ અને નિયમન) ધારો – ૧૯૭૧
 - આવશ્યક વસ્તુ ધારો – ૧૯૫૫
 - ખાદ્યપદાર્થ ભેણસેળ નિયંત્રણ ધારો – ૧૯૫૪
 - કાળા બજાર નિયંત્રણ અને આવશ્યક વસ્તુ પુરવઠા ધારો – ૧૯૮૦
 - ભારત માનક બ્યૂરો ધારો – ૧૯૮૬
 - કૃષિ ઉત્પાદન (વર્ગીકરણ અને વેચાણ) ધારો – ૧૯૭૭
 - તોલમાપ માનક અધિનિયમ – ૧૯૫૬
 - એકાધિકાર અને પ્રતિબંધિત વ્યાપાર અધિનિયમ – ૧૯૬૮
 - ગ્રાહક સંરક્ષણ ધારો – ૧૯૮૬
- ગ્રાહકોના સંરક્ષણ માટે સ્થાપાયેલી ન્યાયિક પ્રણાલી
- બિન સરકારી સંગઠનો ઉપભોક્તાઓમાં તેમના હકો અને જવાબદારીઓ વિષે સભાનતા ઉત્પન્ન કરે છે. ઉપભોક્તાએ કાનૂની સહાય પૂરી પાડે છે. વિવિધ ઉપભોક્તા સંરક્ષણ પરિષદો અને અન્ય નીતિ ઘડનાર મંડળોમાં પ્રતિનિધિત્વ કરે છે.



પાઠાંત પ્રશ્નો

1. ઉપભોક્તા સંરક્ષણનો અર્થ શો?
2. ઉપભોક્તાઓનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
3. ઉપભોક્તાઓને રોજિંદા જીવનમાં નડતી સમસ્યાઓ વર્ણવો.

વાણિજ્ય વ્યવસ્થા

મોડયુલ - ૫
ગ્રાહક જાગૃતિ



નોંધ

મોડયુલ – ૫
ગ્રાહક જાગૃતિ



નોંધ

ઉપભોક્તા સંરક્ષણ

૪. ઉપભોક્તા સંરક્ષણમાં જોડાયેલા પક્ષોના નામ આપો. ઉપભોક્તાઓના હિતના રક્ષણમાં તેમની ભૂમિકા શી છે તે સમજાવો.
૫. ઉપભોક્તાઓના હિતના રક્ષણ માટે સરકારે પસાર કરેલ વિવિધ ધારાઓની યાદી બનાવો.
૬. કોઈ ફરિયાદ દાખલ કરતી વખતે ઉપભોક્તા અદાલત સમક્ષ કઈ કઈ માહિતી રજૂ કરવી જરૂરી છે.
૭. ઉપભોક્તા અદાલત ઉપભોક્તાની તરફણે કઈ કઈ શક્ય શરતોનો આદેશ આપી શકે તે જણાવો.
૮. વિવિધ ઉપભોક્તા અદાલતોનું અધિકાર ક્ષેત્ર જણાવો.
૯. ઉપભોક્તાઓના હિતના સંરક્ષણમાં બિન સરકારી સંગઠનો ફાળો વર્ણવો.
૧૦. ઉપભોક્તાઓની ફરિયાદના નિવારણ માટેની પ્રક્રિયા જણાવો.



પાઠગત પ્રશ્નોના જવાબ

૧૮.૧

- (૧) ખરું (૨) ખોટું (૩) ખરું (૪) ખોટું (૫) ખરું

૧૮.૨

- | | |
|--------------------------|----------------------------|
| (૧) પસંદગી કરવાના | (૨) સૂચના પ્રાપ્ત કરવાના |
| (૩) વસ્તુઓ ઉત્તમ કક્ષાની | (૪) બામક (ગેરમારો દોરનારી) |

૧૮.૩

- (૧) ખોટું (૨) ખોટું (૩) ખરું (૪) ખરું (૫) ખોટું

૧૮.૪

- | | | | | |
|----------|-----------|-----------|----------|----------|
| (૧) ખરું | (૨) ખોટું | (૩) ખોટું | (૪) ખરું | (૫) ખરું |
| (૬) ખરું | (૭) ખરું | | | |

૧૮.૫

૧.

- | | | |
|--------------------|----------------|-------------------|
| (૧) ૨૦ લાખ | (૨) પાંચ મહિના | (૩) ૧ કરોડ રૂપિયા |
| (૪) રાષ્ટ્રીય આયોગ | (૫) એક કરોડ | |

ઉપમોક્તા સંરક્ષણ

૨.

- (૧) ખોટું (૨) સાચું (૩) સાચું (૪) ખોટું (૫) સાચું
(૬) સાચું

૧૮.૬

૧.

- (૧) ખરું (૨) ખોટું (૩) ખરું (૪) ખરું (૫) ખરું

૨.

- (૧) ઘ (૨) ખ (૩) ખ (૪) ઘ (૫) ખ



જાતે કરો.

➤ વખતોવખત છાપામાં અને મેગેઝીનોમાં આવતી ઉપમોક્તાઓના હિતને લગતી વિવિધ જાહેરાતોનો સંગ્રહ કરવો.

મોડયુલ - ૫
ગ્રાહક જાગૃતિ



નોંધ

મોડયુલ - ૬

મહત્તમ માર્ક

૧૨

અભ્યાસના કલાક

૨૫

ધંધામાં કારકીર્દી બનાવવાની તકો

પ્રત્યેક વ્યક્તિએ અમૃક ઉમરે જીવન નિર્વાહ માટે યોગ્ય કારકીર્દીની પસંદગી કરવી જ પડે છે. ધંધાકીય વિશાળ ક્ષેત્ર આર્થિક કમાણીની રોજગારી બને રીતે સ્વ-રોજગારી અને નોકરી દ્વારા આવકની વિશાળ તક પૂરી પાડે છે. આપણા રાખ્ટ્રના વિકાસ કરવા અને બેરોજગારી દૂર કરવા સ્વ-રોજગારી એ શ્રેષ્ઠ માધ્યમ ગણ્યાય છે. આ મોડયુલ વિદ્યાર્થીઓને રોજગારી અને સ્વરોજગારી મેળવવાનો દ્રષ્ટિપાત કરાવે અને શ્રમ દ્વારા વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે તે રીતે તૈયાર કરેલ છે.

પાઠ - ૧૯ : કારકીર્દીની પસંદગી

પાઠ - ૨૦ : ઉદ્યમશીલતા (ઉદ્યોગ સાહસિકતા)



કારકિર્દીની પસંદગી

તમારામાંથી કેટલાક કોઈ વ્યાપારી પેઢીમાં નોકરી મેળવવાનો અથવા વ્યાપાર કરવાનો વિચાર કરતા હશે. કારકિર્દી એટલે વ્યવસાય જે કામ કરવાનું ગમે છે તેને માટે તમે શી યોજના બનાવી છો અને તમારી જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને તમે કેવું જીવન ગાળવા માંગો છો તેના ઉપર પણ તેનો આધાર છે.

તમે શું થવા માંગો છો તે વિષેના તમારા મોટાભાગના વિચારો ઘણું કરીને તમે રેઝિયો સાંભળતા હો કે ટીવી જોતા હો તેમાંથી ઉત્પન્ન થયેલા હોઈ શકે. વળી તમે વર્તમાનપત્રો અને મેગેજીનોમાં નોકરીની ખાલી જગ્યાઓ વિષેની જાહેરાતો પણ વાંચી હશે અથવા તમારે શું થવું જોઈએ તે અંગે તમારા મા-બાપ કે સગા વહાલાંએ સલાહ પણ આપી હશે. તમારી સમજણ શક્તિના આધારે તમારાથી કયું કામ સહેલાઈથી થઈ શકે તેમ છે તેનો પણ તમે વિચાર કર્યો હશે. ભાવિ જીવન માટે તમે તમારી શક્તિઓ અને વલણો માટે સ્પષ્ટ રીતે વિચારવાનું શરૂ કર્યું હશે. આ માટે રોજગારની કઈ કઈ તકો ઉપલબ્ધ છે અને વિવિધ રોજગાર માટે કઈ કઈ ક્ષમતાઓ જરૂરી છે તેનું શાન હોવું આવશ્યક છે.

આ પાઠમાં તમે કારકિર્દી પસંદગી માટેનાં વિવિધ પાસાંઓ વિષે શીખશો. એટલે કે કારકિર્દીની અવધારણા અગત્ય, તકો, પ્રકારો ક્ષમતાઓ વગેરે પરિષ્ણો તમારા પોતાની કારકિર્દી નક્કી કરવામાં ઉપયોગી બને છે.



હેતુઓ:-

આ પાઠ વાંચ્યા પછી તમે જાણી શકશો.

- 'કારકિર્દી'ની સંકલ્પના સમજાવી શકશો.
- કારકિર્દી પસંદ કરવાનું મહત્વ પીછાણી શકશો.
- વેપારમાં કારકિર્દીની વિવિધ તકો ઓળખી શકશો.
- સ્વ-રોજગારનું મહત્વ સમજાવી શકશો.
- સ્વ-રોજગારી અને વેતનવાળી રોજગારી વચ્ચેનો તફાવત સમજી શકશો.
- વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા માટે જરૂરી ક્ષમતાઓની યાદી બનાવી શકશો.
- તમારી પોતાની શક્તિ, રસ અને રૂચિ અનુસાર વ્યાતારમાં યોગ્ય કારકિર્દી ઓળખી શકશો.

કારકિર્દીની પસંદગી

૧૮.૧ કારકિર્દીની સંકલ્પના

કારકિર્દીનો શાબ્દિક અર્થ ઓ છે કે એવો વ્યવસાય કે જેમાં જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવાની તક હોય. માત્ર વ્યવસાયની પસંદગી એટલો જ તેનો અર્થ નથી. તેમાં વ્યક્તિના કાર્યશીલ જીવનમાં તે જે વિવિધ પદો ધારણ કરી શકે તે પણ અભિપ્રેત છે. વ્યાપક અર્થમાં કારકિર્દી વ્યક્તિની જીવન તરાહનું એક અગત્યનું પાસું છે. દા.ત. તમારામાંથી કોઈને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી છે. સમય જતાં તે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બની શકે અને ઓફિસ મેનેજર તરીકે પણ બઢતી મેળવી શકો.

૧૮.૨ કારકિર્દી પસંદ કરવાની અગત્ય

કારકિર્દી પસંદગી જીવનનું એક અગત્યનું પાસું છે. તમે જે કારકિર્દી પસંદ કરો તેના દ્વારા તમારા કારકિર્દી નિર્માણનો પાયો નંખાય છે. ભૂતકાળમાં મોટાભાગના લોકો પહેલાં અભ્યાસ પૂરો કરતા અને પછી કારકિર્દી વિષે નિર્ણય લેતા. પણ આજની યુવા પેઢી તો પોતાનું શાળા શિક્ષણ સમાપ્ત થાય તે પહેલાં જ કારકિર્દી વિષે તેથારી કરતી થઈ ગઈ છે. કારકિર્દીની પસંદગી કોઈપણ વ્યક્તિની મહત્વપૂર્ણ જીવનશૈલીનો બીનજી કોઈ પસંદગી કરતાં વધુ પ્રભાવિત કરે છે. કાર્યના પ્રકારનો પ્રભાવ જીવનના અનેક પાસાંથે સ્પર્શો છે. મૂલ્યોનું ઘડતર વલણો અને ટેવો ઉપર પણ તેનો પ્રભાવ પડે છે. ગળાકાપ હરીફાઈની દુનિયામાં શરૂઆતમાં જ યોગ્ય કારકિર્દીની પસંદગી અત્યંત મહત્વની બની રહે છે. તેથી એક એવી પ્રક્રિયામાંથી પસાર થવાની ચોકકસ જરૂરિયાત છે કે જે વ્યક્તિને વિવિધ કારકિર્દીના વિકલ્પો વિષે માહિતગાર તેમજ જાગૃત બનાવે આ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ પોતાની શક્તિઓ પણ જાણી શકશે જે કારકિર્દી નિર્ણયમાં ખૂબ જ અગત્યની છે.



૧૮.૧ પાઠગત પ્રશ્નો

નીચેના કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે ?

૧. કારકિર્દીમાં માણસ પોતાના કાર્યક્રમના જીવન દરમિયાન જે ધંધામાં રોકાયેલો હોય તેમાં વિવિધપદોની એક શ્રેણી સમાવિષ્ટ છે.
૨. યોગ્ય કારકિર્દીની પસંદગી દરેકના જીવનમાં અત્યંત જરૂરી છે.
૩. આજની પેઢી પાસે કારકિર્દીના બાહુ જ ઓછા વિકલ્પો છે.
૪. શરૂઆતના તબક્કે કારકિર્દી આયોજન જરૂરી નથી.
૫. વિવિધ કારકિર્દી વિકલ્પોનું જ્ઞાન યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં સહાયક છે.

૧૮.૩ વ્યાપારમાં કારકિર્દીની તકો

જ્યારે કોઈ માણસ કોઈને કોઈ વ્યવસાયમાં લાણી જાય ત્યારે આપણે કહીએ છીએ કે તે રોજગારી મેળવે છે. આજે લોકોનો વ્યવસાય કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને માણસની કારકિર્દીનો હેતુ અનિવાર્ય રીતે કોઈક રોજગારી મેળવવાનો છે એટલે કે ગુજરાન

મોડયુલ - ૬
ધંધામાં કારકિર્દી
વાનવવાની તકો



નોંધ



ચલાવવા માટે પૈસા કમાવા કોઈક આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈ જવું તે છે. કારકીર્દીની પસંદગીમાં ખરેખર નીચેના બે વિકલ્પો પૈકી એકની પસંદગી કરવાની હોય છે.

૧. નોકરી
૨. સ્વ-રોજગાર

નોકરી નો અર્થ છે વેતન કે પગારના બદલામાં કોઈ અન્ય વ્યક્તિની સેવા કરવી. જે કોઈ માણસની કચેરી સહાયક તરીકે નિમણૂંકું કરવામાં આવે તો તેના કચેરી નિરીક્ષક તેને જે કામ સોંપે તે તેણે કરવું જોઈએ અને તેના કાર્યો માટે તેને માસિક વેતન કે પગાર મળે છે. આ પ્રકારનો રોજગાર માલિક અને નોકર વર્ચ્યેના કરાર ઉપર આધારિત હોય છે. નોકરે માલિક માટે કામ કરવાનું હોય છે. તેને સોંપેલા કાર્યો કરવાના હોય છે અને તે માટે તેને વળતર મળે છે. કામના કલાકો દરખિયાન તેણે માલિકના નિરીક્ષણ અને નિયંત્રણ નીચે કામ કરવાનું હોય છે. જ્યારે આની સાથે સ્વરોજગારીમાં વ્યક્તિત્વ પોતે જ ગુજરાન ચલાવવા માટે કોઈ આર્થિક પ્રવૃત્તિમાં જોડાય છે. ચાલો આપણે ધૂંધાની તકો અથવા નોકરીની તરાહોની ચર્ચા કરીએ.

૧૮.૪ નોકરી

નોકરીની તકો કયાં કયાં છે તે જોઈએ. સરકારી કાર્યાલયો, રેલ્વે, બેંકો, વીમા કંપનીઓ, કારખાના, વ્યાપારી સંસ્તાઓ અને અન્ય જુદાં જુદાં સંગઠનો ઉપરાંત શાળાઓ, કોલેજો, હોસ્પિટલો વગેરેમાં નોકરીની તકો રહેલી છે.

કારકૂનની કામો, તકનીકી કાર્યો અને અન્ય પ્રકારના નિમ્ન સતરના કાર્યો માટે કરવાની કામગીરીનો આધાર જે તે સંગઠનની પ્રવૃત્તિઓ અને હેતુઓ ઉપર રહેલો છે. આમ, સરકારી વિભાગો, રેલ્વે, બેંકો, વ્યાપારી સંગઠનો, શાળાઓ અને દવાખાનાઓમાં વિવિધ પ્રકારની કારકૂની કામગીરી કરવાની હોય છે. એ જ રીતે ઔદ્યોગિક એકમો, પરિવહન કંપનીઓ વગેરેમાં પણ કામગીરીની



ભિન્નતા પ્રમાણે તકનીકી કર્મચારીશાળાની કામગીરીનું સ્વરૂપ બદલાતું રહે છે. જેમણે માધ્યમિક (ધો. ૧૦) પરીક્ષા પાસ કરી હોય તેમને માટે કારકૂની કાર્ય કે શાળાઓમાં પ્રયોગશાળા મદદનીશની નોકરીની તકો રહેલી છે. કેમ કે ત્યાં લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતા ધો. ૧૦ પાસની હોય છે. પણ તેમને માટે આઈ.ટી.આઈ. અને પોલિટેકનિકના તેમજ રાજ્ય સચિવ અને વ્યાપારી સંસ્થાઓમાં પ્રશિક્ષણની વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિત્વ તકનીકી કર્મચારી તરીકે અથવા કાર્યાલય મદદનીશ કે હિસાબનીશ તરીકે નોકરી મળી શકે છે. વળી જો પેણે કોમ્પ્યુટર સંચાલન કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો કોમ્પ્યુટર સંચાલક તરીકે પણ નોકરી મેળવી શકે છે.

કારકીર્દીની પસંદગી

૧૯.૫ સ્વ-રોજગારી

તમે જે શીખી ગયા છો કે પગારદાર નોકરીના રૂપમાં તમે તમારી કારકીર્દી કેવી રીતે પસંદ કરી શકો. તમે જ્યારે નોકરી સ્વીકારો ત્યારે તમારા માલિક તમને જે કામ સૌંપે તે તમારે કરવાનું હોય છે અને તમને પગાર કે વેતન રૂપે નક્કી કરેલ રકમ મળે છે. પણ કોઈ નોકરી શોધવાને બદલે તમે તમારી આજીવિકા રણવા માટે જાતે જ તમારું પોતાનું કામ કરી શકો છો. તમે ચોપડીઓની દુકાન ખોલી શકો દવાની દુકાન ચલાવી શકો અથવા દરજીની દુકાન નાખી શકો. જો કોઈ વ્યકિત કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે અને જાતે જ તેનું સંચાલન કરે તો તેને સ્વ-રોજગાર કહે છે.



સ્વ-રોજગારી

મોડયુલ - ૬
બંધામાં કારકીર્દી
બાબતવાની તકો



નોંધ

દરેક વિસ્તારમાં તમને નાન દુકાનો, મરામતની દુકાનો કે સેવા આપતા એકમો જોવા મળશે. આ બધા પ્રતિષ્ઠાનોની માલિકી અને સંચાલન એક જ વ્યકિતના હોય છે. કયારેક તે એક કે બે વ્યકિતને પોતાના મદદનીશ તરીકે રોકે છે. કરિયાણાની દુકાન, લેખનસામગ્રીની દુકાન, દવાની દુકાન, દરજીની દુકાન, હજામની દુકાન, ટેલીફોન બૂથ, બ્યૂટી પાર્લર, વીજળીના સાધનો, સાઈકલો વગેરેના સમારકામની દુકાનો વગેરે સ્વરોજગાર ઉપર આધારિત પ્રવૃત્તિઓના ઉદાહરણ છે. આ દુકાનના માલિકો ખરીદ-વેચાણના વેપાર કે સેવા પ્રદાન દ્વારા ધન કમાય છે. જો કયારેક ખર્ચ કરતા આવક હોઈ હોય તો તેમને ખોટ પણ સહન કરવી પડે છે.



૧૯.૨ પાઠગત પ્રશ્નો

યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરો

૧. લોકોનો વ્યવસાય હંમેશા પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે.
૨. નિભસ્તરે સરકારી વિભાગો મોટેભાગે લોકોને કર્યો માટે નીમે છે.
૩. સ્ટોરકીપર તરીકેની કામગીરી માટે માણસમાં ઓર્ડર તૈયાર કરવાનું કૌશલ્ય જોઈએ.
૪. મોટાભાગના કારકૂની પદો માટે ચલાવવાની શક્તિ જરૂરી છે.
૫. ટેલીફોન ઓપરેટર માટેમાં ધારાવાહિકતા હોવી જરૂરી છે.
- ૬.
- ૭.



૧૯.૬ સ્વ-રોજગાર અને નોકરીમાં તફાવત

આધાર	સ્વરોજગારી	નોકરી
૧. સ્વરૂપ	પોતાની પ્રવૃત્તિમાં રચ્યા રહે છે.	માલિકે સૌંપેલી પ્રવૃત્તિમાં રચ્યા રહે છે.
૨. સ્થાન કે હોંદો	વ્યક્તિતનું સ્થાન માલિક તરીકે અથવા નોકરીદાતા તરીકેનું છે.	વ્યક્તિતનું સ્થાન નોકરિયાત તરીકેનું છે.
૩. આવક કે કમાણી	આવક કમાણી નિશ્ચિત નથી. તે માલિકની આવડત પર નિર્ભર છે.	કર્મચારીની આવક નક્કી જ હોય છે. અને જો શેઠ ઈચ્છે તો તેમાં વધારો કરી શકે છે.
૪. કામનો પ્રકાર	કામનો હેતુ વધાર. કમાણી કરવાનો અને વ્યાપારનું કદ વિસ્તૃત કરવાનો છે. કામનો પ્રકાર અગાઉથી નક્કી ન કરી શકાય. તેમાં ફેરફાર પણ થઈ શકે.	કર્મચારીએ કરવાનું કામ અમુક જ પ્રકારનું અને પૂર્વ-નિર્ધારિત છે.
૫. જોખમ	હંમેશ ખોટનું જોખમ રહે છે અને કયારેક આવક ઘટી જાય છે.	જ્યાં સુધી કર્મચારી કામ કરે ત્યાં સુધી આવક ઘટવાનું જોખમ નથી.
૬. કામની સ્વતંત્રતા	પ્રાય તકોના આધારે કઈ રીતે વેપાર ચલાવવો તે નક્કી કરવા માલિક સ્વતંત્ર હોય છે.	કર્મચારીને નોકરીની શરત મુજબ કરવાનું હોય છે.

૧૯.૭ સ્વરોજગારીનાં સંભવિત ક્ષેત્રો

સ્વરોજગારની વિશેષતાઓ વિષે વાંચ્યા પછી તમને કયા કયા ક્ષેત્રોમાં સ્વરોજગારની શક્યતાઓ રહેલી છે તે જાણવું ગમશે. તમારી કારકિદી નું તમે આયોજન કરતા હો તે પ્રક્રિયા દરમિયાન સ્વરોજગારીની તકવાળા નીચેના ક્ષેત્રો લક્ષમાં રાખી શકો.

૧. નાના પાયા પર છૂટક વેપાર:-

કોઈ એક જ વ્યક્તિ એક કે બે સહાયકોની મદદથી નાના વ્યાપારી એકમોની શરૂઆત અને સંચાલન સારી રીતે કરી શકે, તેમાં તેને ફયદો થાય. તેમાં કરિયાણાની દુકાન, લેખન સામગ્રીની દુકાન કે કાપડની દુકાન વગેરે હોઈ શકે.



કારકીર્દીની પસંદગી

૨. વ્યક્તિગત કૌશલ્યના આધારે સેવા પ્રદાન:-

જે લોકો પોતાની વિશિષ્ટ નિપૂણતાના આધારે ગ્રાહકોને સેવા પૂરી પાડી શકે છે તેને પણ સ્વરોજગાર ગણી શકાય. દા.ત. સાઈકલો, સ્કુટરો, કંડા ઘડિયાળ, દિવાલ ઘડિયાળ વગેરેનું રીપેરીંગ (દુરસ્તી સમારકામ) અથવા દરજીકામ, હજામત વગેરેનો સમાવેશ ગ્રાહકોને વ્યક્તિગત ધોરણે વ્યક્તિત્વે આપેલી સેવામાં થઈ શકે.



મોડયુલ - ૬
વંધામાં કારકીર્દી
વાનવવાની તકો



નોંધ

૩. વ્યાવસાયિક યોગ્યતા ઉપર આધારિત વંધાઓ:-

જે પ્રવૃત્તિઓમાં વ્યાવસાયિક પ્રશિક્ષણ અને અનુભવની જરૂર હોય તે પણ સ્વરોજગાર અંતર્ગત આપી શકે છે. આ રીતે વંધો કરતા ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ફાર્માસિસ્ટો, સ્થૂપતિઓ વગેરે પોતાના વિશિષ્ટ પ્રશિક્ષણ અને કૌશલ્યના આધારે સ્વરોજગાર કક્ષામાં આવે છે.



૪. નાના પાયા પર ખેતી:-

ડેરી, મરધાં ઉછેર, મત્સ્યોદ્યોગ, બાળાયત તેમજ રેશમના કીડા ઉછેર જેવી પ્રવૃત્તિઓ જે નાના પાયા પરની ખેતી પ્રવૃત્તિઓ છે તેમાં પણ સ્વરોજગારીની તક ઉપલબ્ધ છે.

૫. ગ્રામોદ્યોગ અને કુટિર ઉઘોગો:-

હાથકાંતણ, વણાટ, હાથ વણાટ, હાથગુંથણી, વસ્ત્રો સીવવા વગેરે જેવી પ્રવૃત્તિઓને સ્વરોજગાર તરીકે ગણી શકાય. આ પ્રવૃત્તિઓ પરંપરાગત વારસાગત કૌશલ્યો પર આધારિત છે.



૬. કલા અને કારીગરી:-

જે ઓઓ કોઈપણ કણા કે કારીગરીમાં તાલીમ મેળવી હોય તેઓ સોની, લુણાર, સુથાર તરીકે આવા વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી શકે.



૧૯.૮



૧૮.૩ પાઠગત પ્રશ્નો

- નીચેના પૈકી કયા વિધાનો 'ખરા' છે અને કયા 'ખોટા' છે
૧. સ્વરોજગારીનો અર્થ છે પોતે કોઈપણ આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈ જવું.
 ૨. પગારવાળી નોકરીમાં આવકની કોઈ મર્યાદા નથી.
 ૩. જ્યારે કોઈ વ્યકિત પૈસા લઈને કોઈ સેવા પૂરી પાડે ત્યારે પણ થોડી પૂંઝી જરૂરી છે.
 ૪. વ્યાપારમાં સ્વરોજગારમાં ખોટનું જોખમ રહેલું છે જે માલિકે ભોગવવાનું છે.
 ૫. સોની સ્વરોજગારવાળો ન કહી શકાય કારણ કે તેણે જીવેરી નીચે કામ કરવું પડે છે.

૧૮.૪ સ્વરોજગારીમાં સફળતા માટે આવશ્યક ગુણો

વિવિધ ક્ષેત્રોમાં રહેલી સ્વરોજગારની રક્રો વિષે વાંચીને તમને એવું લાગ્યું હશે કે કારકીર્દી તરીકે પગારવાળી નોકરી કરતા સ્વરોજગારીની પસંદગી વધારે આકષ્ટક છે. પણ જો તમે સ્વરોજગારમાં સફળ થવાના આવશ્યક ગુણો ધરાવતા હો તો જ તમારે તે વિકલ્પ તરીકે પસંદ કરવી જોઈએ. ચાલો આપણે સ્વરોજગારીમાં સફળ થવા માટેના વિવિધ ગુણો જોઈએ.

૧. માનસિક શક્તિઓ:-

તમે સ્વરોજગારી અપનાવવા માગતા હો તો જ્યાં સ્વરોજગારીની રક છે તેવું તમને સૌથી વધુ અનુકૂળ ક્ષેત્ર કર્યું છે તે શોધી કાઢવાની તમારામાં શક્તિ (આવડત) હોવી જોઈએ. વળી તમામ પ્રકારના વ્યાપારી કામકાજની બાબતમાં નિર્ણય લેવાની પણ શક્તિ એટલી જ જરૂરી છે અને સમસ્યાનું પુર્વનુમાન અને જોખમ ઉઠાવવાની શક્તિ પણ એટલી જ જરૂરી છે.

૨. સતર્કતા અને દીર્ઘ-દ્રષ્ટિ:-

સ્વરોજગાર વ્યસ્ત વ્યકિતએ બજારમાં થઈ રહેલા પરિવત નોથી પણ વાકેફ તેમજ સતર્ક રહેવું જોઈએ કે જેથી તે પોતાનાં વ્યાવસાયિક કાયો નું સમાયોજન કરી શકે. વળી તેણે પરિવત નોનું પણ પુવા નુમાન કરવાની દીર્ઘદ્રષ્ટિ પણ કેળવવી જોઈએ. જેથી તે તકોનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં ઉત્પન્ન થનાર સંભવિત જોખમોનો મુકાબલો કરી શકે.

૩. આત્મવિશ્વાસ:-

કારકીર્દીની પસંદગી

સ્વરોજગારમાં સઘળા નિર્ણયો માલિકે લેવા પડે છે. તેનામાં સમસ્યાઓનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. તેમજ માલ પૂરો પાડનાર, લેણદાર, ગ્રાહકો અને સરકારી અમલદારોનો પણ મુકાબલો કરવાનો રહે છે.

૪. વ્યાપારનું શાન:-

જે માણસ વ્યાપારમાં સ્વરોજગારીમાં રોકાયેલો હોય તેનામાં વ્યાપારનું સંપૂર્ણશાન હોવું જોઈએ. તેમજ વ્યાપારનું તકનીકી શાન અને કૌશલ્ય હોવાં જોઈએ.

૫. સંબંધિત કાયદાઓની જાણકારી:-

આમા વ્યક્તિને કાનૂની નિષ્પાત હોવાની જરૂર નથી. પણ સ્વરોજગારી માટે માણસમાં પોતે જે સ્થળે વ્યાપાર કે સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરે છે તેને સંબંધિત કાયદાઓનું કામયલાઉ શાન હોવું જરૂરી છે. તેમાં ટ્રેડ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, વેચાણ વેરો અને જકાતને લગતા કાયદા અને જો લાગુ પડતું હોય તો સ્થળ, પ્રદૂષણ નિયંત્રણ વગેરેને લગતા નગરપાલિકાના કાયદાના શાનનો સમાવેશ થાય છે.

૬. અન્ય વ્યક્તિગત ગુણો:-

સ્વરોજગારમાં પડેલ વ્યક્તિમાં પ્રામાણિકતા, સંનિષ્ઠા અને સખત પરિશ્રમ જેવા ગુણો હોવા જરૂરી છે.



૧૮.૪ પાઠગત પ્રશ્નો

- સ્વરોજગારીમાં વ્યક્તિમાં ઓળખવાની શક્તિ હોવી જોઈએ.
- સ્વરોજગારીમાં સફળ થવા માટે વ્યક્તિને પોતાની શક્તિમાં હોવો જરૂરી છે.
- વ્યાપારના સફળ માલિક થવા માટે વ્યક્તિને વ્યવસાયનું હોવું જોઈએ.
- સ્વરોજગારીમાં પડેલ વ્યક્તિ માટે નક્કી કરવા માટે હિસાબ (નામું) નું શાન જરૂરી છે.
- ઉદ્યોગ સાહસિકતા અને ના ગુણો સાથે સંકળાયેલી છે.
- જે લોકો મેળવી શકતા નથી તેમના માટે સ્વરોજગારી આજીવિકા રણવાની તકો પૂરી પાડે છે.

મોડયુલ - ૬
બંધામાં કારકીર્દી
બાબતવાની તકો



નોંધ



તમે શું શીખ્યા?

- કારકિર્દીનો શબ્દશાસ્ત્ર અર્થ છે એક વ્યવસાય જેમાં પ્રગતિ અને ઉન્નતિની તકો જીવનમાં મળી શકે છે. કારકિર્દીની પસંદગી જીવનનું એક અગત્યનું પાસું છે.
- કારકિર્દીની પસંદગીમાં બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે જેમ કે પગારવાળી નોકરી અને સ્વરોજગારી.
- નોકરીનો અર્થ છે વેતન કે પગારની બદલામાં અન્ય વ્યક્તિની સેવા કરવી. સ્વરોજગારીનો અર્થ એ છે વ્યક્તિ પોતાનું ગુજરાત ચલાવવા માટે પોતાની જાતે જ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે.
- પગારવાળી નોકરીના માર્ગોમાં નિમન્સતરે કારકુની કે તકનીકી કાર્યનો સમાવેશ થાય છે.
- સ્વરોજગારીમાં નાના પાયા ઉપર છૂટક વેપાર, ઐસા લઈને સેવા આપવી, નાના પાયા પર ખેતી, ગ્રામ અને કુટિર ઉઘોગો, કળા અને હાથ કારીગરી વગેરેનો સમાવેશ થાય છે.
- કારકિર્દી તરીકે સ્વરોજગારી અપનાવવા માટે વ્યક્તિમાં કેટલીક માનસિક શક્તિઓ, સતર્કતા અને દીર્ଘદ્રષ્ટિ, આત્મવિશ્વાસ, વ્યાપાર વિષયક શાન, સાંપ્રત કાયદાઓનો પરિચય અને હિસાબી શાન વગેરે હોવા જોઈએ.



પાઠંત્ર પ્રશ્નો

૧. નોકરી અને સ્વરોજગારીનો અર્થ શો?
૨. "કારકિર્દી" શબ્દની વ્યાખ્યા આપો.
૩. કારકિર્દી પસંદગીનું મહત્વ સમજાવો.
૪. વ્યાપારના ક્ષેત્રમાં સવેતન નોકરીના માર્ગો ટૂંકમાં જણાવો.
૫. વર્તમાન બેકારીના સંદર્ભમાં સ્વરોજગારીનું મહત્વ વર્ણવો.
૬. સ્વરોજગારી મોટા પાયાના ઉઘોગોનો વિકલ્પ કેવી રીતે બની શકે?
૭. સ્વરોજગારીમાં સફળ થવા માટેના કોઈપણ ચાર ગુણો જણાવો.
૮. હિસાબી કાર્ય માટે જરૂરછ ક્રોશલ્યો સમજાવો.
૯. સ્વરોજગારી માટે પ્રોત્સાહક પાસાંઓ ઓળખો.
૧૦. સ્વરોજગારી અને નોકરીની તુલના કરો.
૧૧. સ્વરોજગારી માટેના સંભાવિત ક્ષેત્રોની યાદી બનાવો.

કારકીર્દીની પસંદગી



પાઠગત પ્રશ્નોના જવાબ

૧૯.૧

- (૧) ખરું (૨) ખરું (૩) ખોટું (૪) ખોટું (૫) ખરું

૧૯.૨

- (૧) આર્થિક (૨) કારકૂની (૩) ખરીદી (૪) ઓફિસના મશીન
 (૫) ભાષા (૬) નોકરી (૭) સ્વરોજગાર (૮) ટેકનિકલ સ્ટાફ

૧૯.૩

- (૧) ખરું (૨) ખોટું (૩) ખરું (૪) ખરું (૫) ખોટું

૧૯.૪

૧.

- | | |
|-------------------------------|-----------------|
| (ક) સ્વરોજગારી માટે કામની તકો | (ખ) વિશ્વાસ |
| (ગ) શાન | (ઘ) નફો કે ખોટ |
| (ચ) અભિનવતા, સજ નશીલતા | (ઝ) ઉચ્ચ શિક્ષણ |

૨.

- (૧) ક (૨) ગ (૩) ક (૪) ગ (૫) ખ



જાતે કરો.

- કોઈપણ અઠવાડિયાનું 'એમ્બ્લોયમેન્ટ ન્યુઝ' કે કોઈ છાપું લો અને તેમાંથી તમારા રસ, રૂચિ, શક્તિને અનુરૂપ વ્યવસાયની ખાલી જગ્યા શોધો.

મોડયુલ - ૬
ધ્વામાં કારકીર્દી
બાબતવાની તકો



નોંધ



ઉદ્યમશીલતા (ઉદ્યોગ સાહસિકતા)

તમને ખબર તો છે જ કે જીવન જીવવા માટે કમાતું જરૂરી છે. તમારા માતા-પિતા ભાઈ અને અન્ય સર્વે કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા જ હશે કે જેના દ્વારા તેઓ કુટુંબ માટે પૈસા કમાઈ શકે. તમે આજીવિકા રણવા માટે કેવી રીતે આયોજન કરો છો? તમને કોઈ સંગઠન (સંસ્થા)માં નોકરી કરવી ગમે કે તમારો પોતાનો વ્યાપાર શરૂ કરવો ગમે?

એક શિક્ષક શાળામાં ભણાવે છે, એક કામદાર કારખાનામાં કામ કરે છે. એક ડોક્ટર સરકારી હોસ્પિટલમાં કામ કરે છે. એક કારકૂન બોકમાં નોકરી કરે છે. એક મેનેજર વ્યાપારી સંગઠનમાં કામ કરે છે. આ બધા ઉદાહરણો જે લોકો નોકરિયાત છે અને તેમના શેઠ દ્વારા અપાયેલા વેતન કે પગાર રૂપે પૈસા કમાય છે. આને નોકરી કહેવાય છે. જ્યારે બીજી બાજુ એક દુકાનદાર, કારખાનાનો માલિક, વેપારી કે પોતાનું દવાખાનું ધરવતો ડોક્ટર પોતાનો જ વ્યવસાય ચલાવીને પૈસા કમાય છે. આ સ્વરોજગારવાળી વ્યક્તિઓના ઉદાહરણ છે. છતાં ઘણા એવા લોકો પણ છે કે જેઓ સ્વરોજગારી દ્વારા માત્ર પોતાના જ માટે કાર્ય (ધ્યાન) ઉત્પન્ન કરતા નથી પણ બીજા ઘણા માટે પણ રોજગારી ઉભી કરે છે. તેમને "ઉદ્યમશીલ" (ઉદ્યોગ સાહસિક) કહી શકાય.

આ પાઠમાં તમે ઉદ્યમશીલતા વિષે વિગતવાર શીખશો એટલે કે તેનો મૂળ ધ્યાલ, મહત્વ અને કાર્યો. તમે આવા ઉદ્યમીઓના ગુણો અને નાના-પાયાના ઉદ્યોગો સ્થાપવાની ક્ષમતા વિષે પણ જાણશો. આ તમારા ભાવિ જીવન માટે પણ ઉપયોગી બનશો.



હેતુઓ:-

- ઉદ્યમશીલતાનો મૂળભૂત ધ્યાલ સમજાવી શકશો.
- ઉદ્યમશીલ બનવાનું મહત્વ સમજી શકશો.
- એક સફળ ઉદ્યોગવીરના આવશ્યક ગુણો વર્ણવી શકશો.
- ઉદ્યમીનાં કાર્યો ઓળખી શકશો. અને
- એક લઘુ ઉદ્યોગ સ્થાપવાના વિવિધ પાસાંઓ સમજાવી શકશો.

૨૦.૧ ઉદ્યમશીલતાનો અર્થ



નોંધ

૨૦.૨ ઉદ્યમશીલ હોવાનું મહત્વ



૨૦.૧ પા�ગત પ્રશ્નો

નીચેના વિધાનો પૈકી ક્યા 'ખરાં' છે ક્યા 'ખોટા' છે ?

૧. ઉદ્યમી માણસ વિચારોને કાર્યસ્વરૂપ આપવા માટે જોખમ ઉઠાવે છે.
૨. ઉદ્યમી લોકો જુગારી હોય છે.
૩. ઉદ્યમી માણસ ઉત્તમતા માટે સતત મથામણ કરે છે.
૪. ઉદ્યોગશીલ માણસ જન્મજાત હોય છે, બનાવી શકતા નથી.
૫. ઉદ્યોગ સાહસવીર બીજાઓ માટે પણ રોજગારી ઉત્પન્ન કરે છે.
૬. ઉદ્યમશીલ માણસ સ્વતંત્ર વ્યક્તિત્વ છે.

૨૦.૩ એક સફળ ઉદ્યોગી વ્યક્તિત્વના ગુણ

ચાલો આપણો એક સફળ ઉદ્યોગ વીરના ગુણોનો વિચાર કરીએ. આમ તો એક ઉદ્યોગ સાહસ ચલાવવા માટે ઘણા ગુણોની જરૂર પડે, પણ છતાં કેટલાંક નીચેના ગુણો મહત્વપૂર્ણ ગણાયા છે.

૧. પ્રારંભ (આગેવાની, પહેલ):-

વ્યાપારની દુનિયામાં તકો આવે અને જાય – ઉદ્યમી માણસ કર્મવીર હોવો જોઈએ તેણે આગળ પડીને કામની પહેલ કરીને તકનો લાભ ઉઠાવવો જોઈએ. એકવાર તમે તક ચૂક્યા



પછી ફરીને મળે નહીં. 'ગત અવસર આવે નહીં' તેથી ઉદ્યમી માટે પહેલ કરવી અત્યંત જરૂરી છે.

૨. જોખમ ઉઠાવવાની ઈરછા શક્તિ:-

દરેક વેપારમાં જોખમનું તત્ત્વ રહેલું છે. એનો અર્થ એ કે સફળ પણ થાય અને નિષ્ફળ પણ જાય. બીજા શબ્દોમાં વ્યાપારમાં હંમેશા નફો જ થાય તે જરૂરી નથી. આ વસ્તુ વ્યક્તિને વ્યાપારમાં પડતા રોકે છે. છતાં એક ખરો ઉદ્યમવીર જોખમ ઉઠાવવા અને વેપાર ચલાવી તેમાં સફળ બનવાની સ્વેચ્છા ધારણ કરતો હોય છે.

૩. અનુભવમાંથી શીખવાની આવડતઃ-

ઉદ્ઘોગી માણસ પણ કયારેક ભૂલ કરી બેસે. છતા પણ એકવાર થઈ ગયેલી ભૂલ ફરી વખત ન થવી જોઈએ. કારણ કે એમ થવાથી ભારે મોટું નુકીશાન વેઠવું પડે. માણસે ભૂલમાંથી શીખવું જોઈએ. ઉદ્યમશીલ વ્યક્તિમાં અનુભવમાંથી શીખવાની શક્તિ હોવી જોઈએ.

૪. અભિપ્રેરણા:-

અભિપ્રેરણા સફળતાની ચાવી છે. જીવનના દરેક મોડ પર આ જરૂરી છે. એકવાર તમને કંઈક કરવાની પ્રેરણા મળી પછી તમે તે પૂરું કર્યા વિના જંપવાના નહીં. દા.ત. તમને કયારેક કોઈ વાર્તા કે નવલકથા વાંચવામાં એટલો બધો રસ પડે કે તમે તે પૂરી કર્યા વિના ઉધો નહીં. આ જાતનો રસ કામમાં પ્રેરણાને કારણો આવે છે. એક સફળ ઉદ્યમશીલ વ્યક્તિનો આ એક આવશ્યક ગુણ છે.

૫. આત્મવિ વાસ:-

જીવનમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. જે માણસમાં આત્મ વિશ્વાસની ઉણાપ હોય તે પોતે તો જાતે કોઈ કામ કરી શકે નહીં. પણ બીજાને પણ તે કામ કરવા પ્રેરી શકે નહીં. આત્મવિશ્વાસ માણસની હિંમત, ઉત્સાહ અને નેતાગીરીની શક્તિમાં પ્રગટ થાય છે. સફળ ઉદ્ઘોગવીરમાં આત્મવિશ્વાસ હોવો જ જોઈએ.

૬. નિર્ણય લેવાની શક્તિ:-

વ્યાપારી સાહસ ચલાવવા માટે ઉદ્ઘોગશીલ વ્યક્તિને ઢગલાબંધ નિર્ણયો લેવા પડે. તેથી તેનામાં સમયસર અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તેણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પડે. આધુનિક દુનિયામાં વસ્તુઓ ધણી જ ઝડપથી બને છે. જો ઉદ્ઘોગપતિમાં સમયસર નિર્ણય લેવાની શક્તિ ન હોય તો તે તક ગુમાવે છે અને સરવાળે ખોટ સહા કરે છે.



૨૦.૨ પા�ગત પ્રશ્નો

નીચેના પેકી કયા વિધાનો 'ખરા' અને કયા 'ખોટા' છે?

૧. ઉદ્યોગશીલ માણસે વારંવાર ભૂલો કર્યા પછી શીખવું જોઈએ.
૨. જે માણસમાં નિર્ણયરાંકિત ન હોય તે ઉદ્યોગવીર બની ન શકે.
૩. બધા જ ઉદ્યોગશીલો માટે આત્મવિશ્વાસ ઉષ્ણપ એ જ તેમની સફળતાનું રહસ્ય છે.
૪. ઉદ્યોગ સાહસિકમાં સમયસર નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ.

૨૦.૪ ઉદ્યમશીલના કાર્યો

ઉદ્યમશીલના કેટલાક મુખ્ય કાર્યો આ મુજબ છે.

૧. ઉદ્યોગ સાહસની તકોની ઓળખ:-

વ્યાપારની દુનિયામાં ઘણી તકો રહેલી છે. આ બધી માણસોની ખોરાક, ફેશન શિક્ષણ વગેરે જેવી જરૂરિયાતો ઉપર આધારિત છે. આ બધામાં નિરંતર ફેરફારો થતા રહે છે. સામાન્ય જનોને આ તકોની ખબર પડતી નથી. પણ ઉદ્યોગ સાહસવીર અન્ય લોકો કરતાં વધારે જડપથી આ તકોને સુંધી લે છે. તેથી એક ઉદ્યમશીલ વ્યક્તિએ તેના આંખ-કાન હંમેશા ઉધાડા રાખવા જોઈએ. તેનામાં કલ્પના શક્તિ, સજ નાત્મકતા અને નવસંશોધનની વૃત્તિ હોવા જોઈએ.

૨. વિચારોને કાર્યાન્વિત કરવા:-

ઉદ્યોગશીલ માણસોમાં વિચારોને વ્યવહારમાં અમલમાં મૂકવા માટેની ક્ષમતા હોવી જોઈએ. તે બજારમાં જેની માંગ હોય તેને અનુકૂળ થવા માટે નવા વિચારો, ઉત્પાદનો અને વ્યવહારો અંગેની માહિતી એકઠી કરે છે અને આ એકત્રિત કરેલી માહિતીના આધારે તે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ભાવિ પગલાં નક્કી કરે છે.

૩. શક્યતાનો અભ્યાસ:-

ઉદ્યોગશીલ માણસ પ્રસ્તુત ઉત્પાદન કે સેવાઓની બજાર શક્યતાઓની મોજણી કરવા અભ્યાસ હાથ ધરે છે. તે આવનારી સમસ્યાઓનો આગણ્યી વિચાર કરે છે. અને ઉત્પાદનો જથ્થો, ગુણવત્તા, મૂલ્ય અને વ્યાપાર ચલાવવા માટે જરૂરી પૂર્તિ કરવાના સ્ત્રોતોન માપ કાઢે છે. એવી બધી જ પ્રવૃત્તિઓને આવરી લેતી "બલ્યુ પ્રિન્ટ"ને વ્યાપાર આયોજન કે પ્રોજેક્ટ રિપોર્ટ કરે છે.

૪. સંસાધન (પ્રાપ્તિ):-

ઉદ્યોગ સફળતાપૂર્વક ચલાવવા માટે ઉદ્યમશીલ માણસને ધન, યંત્ર, સામગ્રી, કાચોમાલ, માણસો વગેરે અનેક વિવિધ સંસાધનોની જરૂર પડે છે. ઉદ્યમશીલ વ્યક્તિનું એક મુખ્ય કાર્ય છે. આ બધા સંસાધનોની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવી.

મોડ્યુલ - ૬
બંધામાં કારક્રમી
બનાવવાની તકો



નોંધ

મોડ્યુલ - ૬ શબ્દામાં કારકીર્દી બનાવવાની રક્રો



નોંધ

ઉદ્યમશીલતા (ઉદ્યોગ સાહસિકતા)

૫. ઉદ્યોગની સ્થાપના:-

ઉદ્યોગની સ્થાપના કરવા માટે ઉદ્યોગપતિએ કેટલીક વૈધાનિક ઔપचારિકતાઓ પૂર્ણ કરવી પડે છે. વળી તેણે સાનુકૂળ સ્થળની શોધ, ભવનની ડિઝાઇન નક્કી કરવી, મશીનો સ્થાપનાં અને બીજી ઘણી બાબતો કરવાની હોય છે.

૬. ઉદ્યોગનું વ્યવસ્થાપન:-

ઉદ્યોગપતિના અત્યંત અગત્યનાં કાર્યો પૈકીનું એક છે. ઉદ્યોગનું વ્યવસ્થાપન. તેણે માણસો સામગ્રી અને ધનનું વ્યવસ્થાપન કરવું પડે છે અને ઉત્પાદન અને સેવાનું પણ વ્યવસ્થાપન કરવું પડે છે.

૭. વૃદ્ધિ અને વિકાસ:-

એકવાર ઈચ્છિક પરિણામ પ્રાપ્ત થઈ જાય પછી ઉદ્યોગપતિએ તેની વૃદ્ધિ અને વિકાસ માટેના અન્ય ઉચ્ચ લક્ષ્યોની શોધ કરવી પડે છે. ઉદ્યમશીલ વ્યક્તિ માત્ર નિર્ધારિત લક્ષ્યાંકોની પ્રાપ્તિથી જ સંતોષ માનતી નથી પણ ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.



૨૦.૩ પાઠગત પ્રશ્નો

નીચેના પૈકી દરેક વિષે તમારા શબ્દોમાં બે બે વાક્યો લખો.

૧. શક્યતા (સંભવિતતા) નો અભ્યાસ
૨. સંસાધન (પ્રાપ્તિ)

૨૦.૪ એક લઘુ વ્યાપાર ઉદ્યમની સ્થાપના



તમે ઉદ્યમશીલતા અને એક સફળ ઉદ્યમશીલ વ્યક્તિ માટે આવશ્યક વિવિધ ગુણોની બાબતમાં જાણકારી મેળવી તમે એ પણ શીખી ગયા કે ઉદ્યમશીલ વ્યક્તિ જ્યારે વ્યાપારી

ઉધમશીલતા (ઉધોગ સાહસિકતા)

સાહસ શરૂ કરવા ઈચ્�ે ત્યારે તેણે શું શું કરવું પડે. જો તમારામાં આ બધા ગુણો હોય અને આ બધું પ્રવૃત્તિઓ તમે કરી શકશો એવો આત્મવિશ્વાસ હોય તો હવે તમે તમારું પોતાનું વ્યાપારી એકમ સ્થાપવાનો વિચાર કરો પણ તમે તમારો પોતાનો વ્યાપાર શરૂ કરો તે પહેલાં નાનું વ્યાપારી એકમ સ્થાપતી વખતે ગણતરીમાં લેવા પડતાં વિવિધ પાખાંઓ વિષે તમારે પ્રથમ જાણકારી મેળવવી જોઈએ.

૧. લઘુ વ્યાપાર કોણ શરૂ કરી શકે:-

કોઈપણ માણસ લઘુ વ્યાપાર એકમ સ્થાપિત કરી શકે. તે વિદ્યમાન જુનો ઉધોગશીલ માણસ પણ હોઈ શકે, નવો પણ હોઈ શકે, તેને વેપાર ચલાવવાનો અનુભવ હોઈ શકે અને ન પણ હોઈ શકે, શિક્ષિત પણ હોય અને અશિક્ષિત પણ હોઈ, ગ્રામ્ય કે પણત વિસ્તાર કે શહેરી વિસ્તારનો પણ હોય.

૨. નાણાંની સગવડતાઃ-

ઉધમશીલ વ્યક્તિએ વિ લેખણ કરીને એ શોધી કાઢવું પડે કે તેમાં કેટલી મૂડીની જરૂર પડશે અને વેપારમાં તે મૂડીની કેટલા સમય માટે જરૂર પડશે. વ્યાપાર સ્થાપનારને યંત્રો ખરીદવા માટે મકાન, માટે, કાચોમાલ મજૂરોને મજૂરી ચૂકવવા માટે ધનની જરૂર પડે છે. યંત્રસામગ્રી મકાન અને સાધનો માટે ખચે લા પૈસા તેની સ્થાવર મિલકત ગણાય છે. જ્યારે બીજી બાજુ સામગ્રી ખરીદવામાં અને મજૂરોના વેતન અને પગાર ચૂકવવામાં તેમજ ભાડું ઈલેક્ટ્રોિક અને ટેલિફોન બીલ વગેરેમાં વપરાતી મૂડીને ચાલુ મૂડી કહેવાય છે. વ્યાપાર ચલાવનારે આ સ્થાવર મિલકત અને ચાલુ મૂડી એમ બંને પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે. આ બંડોળ સ્વ-મૂડીમાંથી કે બેંક કે અન્ય નાણાં સંસ્થાઓમાંથી લોન લઈને ઉભું કરવું પડે છે. મિત્રો કે સગા સંબંધીઓમાંથી પણ (ધન) નાણાં ઉધાર લઈ શકાય.

૩. વ્યાપારની લાઈનની પસંદગી:-

જ્યારે ઉધમશીલ વ્યક્તિની કંઈ વસ્તુનો વેપાર કરવો તે વિષે વિચાર કરવા લાગે ત્યારથી જ વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે. તે બજારની માંગના સંદર્ભમાં વ્યાપારની તકોની ગણતરી કરી શકે. તે વિદ્યમાન વસ્તુ કે ઉત્પાદન અથવા કોઈ નવા ઉત્પાદનનો પણ વિચાર કરી શકે પણ કોઈપણ કદમ ઉઠાવતા પહેલાં તેણે વેપારની નફો કરવાની શક્કિત અને તેમાં જરૂરી મૂડી રોક્કાણનો વિચાર કરવો પડે. નફ્કારકતા અને જોખમનો અંદાજ કાઢયા પછી જ ઉધમશીલ વ્યક્તિએ વ્યાપારની કંઈ લાઈન પકડવી તે નક્કી કરવું પડે છે.

૪. સંગઠનના સ્વરૂપની પસંદગી:-

અગાઉના પાઠોમાં તમે વ્યાપાર સંગઠનના વિવિધ સ્વરૂપો વિષે શીખી ગયા છો. હવે તમારે તમારી જરૂરિયાત મુજબ ઉત્તમ સ્વરૂપની પસંદગી કરવાની છે. સામાન્ય રીતે એક લઘુ વ્યાપાર એકમ પસંદ કરવું ઢીક રહેશે. જેમાં કેવળ એક જ વ્યક્તિની સંપૂર્ણ માલિકી અથવા ભાગીદારી પણ હોઈ શકે છે.





૫. બંધાનું સ્થળ:-

વ્યવસાયનું સ્થળ પસંદ કરવામાં ખાસ તકેદારી રાખવી જોઈએ. ઉદ્યમશીલ વ્યક્તિ પોતાના સ્થળે અથવા ભાડાની જગ્યામાં વેપાર શરૂ કરી શકે. તે સ્થળ કોઈ બજાર, વાણિજ્ય સંકુલ કે ઔદ્યોગિક સ્થાનની નજીક હોઈ શકે. સ્થળ નક્કી કરતી વખતે વ્યાપાર શરૂ કરનારે કાચામાલના પૂરવઠાનાં, પ્રાપ્તિ સ્થાનો બજારની નજીકતા, મજૂરોની સુલભતા, પરિવહનની સગવડ, બેંકિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓ જેવાં અનેક પાસાઓ લક્ષ્યમાં લેવા જોઈએ. કારખાનું સ્થાપવા માટે એ સ્થળને પ્રથમ પસંદગી આપવી જોઈએ કે જે કાચામાલની પ્રાપ્તિના સ્થાનથી નજીક હોય અથવા રેલ્વે અને માર્ગ વાહન વ્યવહાર સાથે સાનુકૂળ રીતે જોડાયેલું હોય. છૂટક વેપાર રહેણાંક વિસ્તારની નજીક કે બજારના સ્થળે શરૂ કરવો જોઈએ.

૬. શ્રમીક / કામદારો / કર્મચારીઓની ઉપલબ્ધતા:-

ઉદ્યમશીલ માણસ જાતે જ એકલો વેપાર ચલાવી શકે નહીં. તેણે પોતાને સહાય કરવા માણસો રોકવા પડે. ખાસ કરીને વિનિર્માણ કાર્ય માટે પ્રશાસ્કૃત અને અર્ધ પ્રશાસ્કૃત માણસોની ભરતી કરવી જોઈએ. વ્યાપાર શરૂ કરતા પહેલા વેપારીએ તેમાં સંલગ્ન કાર્યો અને પ્રવૃત્તિઓ માટે યોગ્ય કામદારો મળશો કે કેમ તે તપાસ કરવી જોઈએ.



૨૦.૪ પાઠગત પ્રશ્નો

૧. નીચેના વિધાનો પૈકી ક્યા 'ખરાં' અને ક્યા 'ખોટા' છે
 ૧. ફક્ત ધનવાન વ્યક્તિઓ જ વેપાર શરૂ કર શકે.
 ૨. ઓક લઘુ ઉદ્યોગક એકમ ઉદ્યમી વ્યક્તિ પોતાની કે ભાડાની જગ્યામાં શરૂ કરી શકે.
 ૩. ઉદ્યોગવીરે ગ્રાહકોથી ઘણે દુર વેપાર શરૂ કરવો જોઈએ.
 ૪. લઘુ વ્યાપાર માટે ચાલુ મૂરી જરૂરી નથી.
 ૫. ઉત્પાદનને બજારમાં વેચવા માટે વેચાણ વૃદ્ધિ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
૨. વૈકલ્પિક પ્રશ્નો

ઉદ્યમશીલતા (ઉદ્યોગ સાહસિકતા)



તમે શું શીખ્યા?

- ઉદ્યમ સાહસિક એવી વ્યક્તિ છે જે વ્યાપાર માટેની તકો શોધવાની બાબતમાં સર્જનાત્મક અને નવસંશોધનાત્મક છે. તેનામાં જોખમ ઉઠાવવાની અને વ્યાપાર ચલાવવાની આવશ્યક અભિજ્ઞાની હોવી જોઈએ. આ પ્રક્રિયામાં તે પોતે જ વસ્ત રહેતો નથી પણ અન્ય લોકો માટે પણ રોજગારનું સર્જન કરે છે.
-
- દરેક રાષ્ટ્રને આવા ઉદ્યમી વીરની જરૂર છે. કારણ કે તેઓનો દેશની વૃધ્ઘિ અને આર્થિક વિકાસમાં મોટો ફાળો હોય છે.
- ઉદ્યોગ સાહસિકમાં પહેલ કરવી, જોખમ ઉઠાવવાની ઈચ્છા, અનુભવોમાંથી શીખવાની શક્તિ, સ્વયં-પ્રેરણા, આત્મવિશ્વાસ, સખત પરિશ્રમ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વગેરે ગુણો જોઈએ.
- ઉદ્યમશીલ લોકો વિવિધ વ્યાપારની તકોને ઓળખી લે છે. પોતાના વિચારોને કાર્યમાં પરિવર્તિત કરે છે. પોતાની યોજનાઓની સંભવિતતાનો અભ્યાસ કરે છે. સંસાધનો એકત્ર કરે છે. ઉદ્યોગક એકમો સ્થાપે છે અને વૃધ્ઘિ અને ઉત્કૃષ્ટતા માટે હંમેશા તત્પર રહે છે.
- શિક્ષિત કે અશિક્ષિત વેપારી કુટબનો કે અન્ય કુટબનો ગ્રામ્ય વિસ્તારનો કે શહેરી વિસ્તારનો ગમે તે ઈન્સાન નાનું વ્યાપાર એકમ શરૂ કરી શકે. તેમાં માત્ર ઈચ્છાશક્તિ એ આત્મવિશ્વાસની જ જરૂર છે.
- નાનું વ્યાપારી એકમ સ્થાપવા માટે જરૂરી પૈસા પોતાના સંસાધનોમાંથી પ્રાપ્ત કરી શકાય, અથવા અન્ય પાસેથી ઉધીના લઈ શકાય અથવા બંને રીતે પ્રાપ્ત કરી શકાય. ઉપરાંત બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન પણ લઈ શકાય.
- એક નાનું વ્યાપાર એકમ સફળતા પૂર્વક ચલાવવા માટે તમે કોઈ એક ઉત્પાદન અથવા ઉત્પાદનોના સંગ્રહણની પણ પરસંદગી કરી શકો. માત્ર એ ધ્યાન રાખવું કે બજારમાં તેની માંગ હોવી જોઈએ.



પાઠાંત પ્રશ્નો

1. ઉદ્યમશીલતનો ખ્યાલ સમજાવો.
2. ઉદ્યમશીલની કોઈપણ ત્રણ લાક્ષણિકતાઓ જણાવો.
3. ઉદ્યમશીલ બનવાનું મહત્વ સમજાવો.

મોડયુલ - ૬
બંધામાં કારક્રમી
બનાવવાની તકો



નોંધ

મોડ્યુલ - ૬
શબ્દમાં કારકીર્દી
બનાવવાની રક્ખે



નોંધ

ઉદ્ઘર્ષશીલતા (ઉદ્ઘોગ સાહસિકતા)

૪. સફળ ઉદ્ઘોગ સાહસિકના કોઈપણ ત્રણ ગુણો વર્ણવો.
૫. અભિપ્રેરણ કેવી રીતે સફળતાની ચાવી છે તે સમજાવો.
૬. ઉદ્ઘર્ષશીલનાં વિભિન્ન કાર્યો સમજાવો.
૭. એક બોલપેનનું ઉત્પાદન કરવા માટે એક લઘુઉદ્ઘોગની સ્થાપના કરતી વખતે તમે કયા પાસાંઓ ગણ્યતરીમાં લેશો ?



પાઠગત પ્રશ્નોના જવાબ

૨૦.૧

- (૧) ખરુ (૨) ખોટું (૩) ખરુ (૪) ખોટું (૫) ખરુ
- (૬) ખરુ

૨૦.૨

- (૧) ખરુ (૨) ખરું (૩) ખોટું (૪) ખરુ

૨૦.૩

જાતે જવાબ આપો

૨૦.૪

૧.

- (૧) ખોટું (૨) ખરુ (૩) ખોટું (૪) ખોટું (૫) ખરુ

૨.

- (૧) ઘ (૨) ક (૩) ઘ (૪) ઘ (૫) ઘ



જાતે કરો.

- નજીકના નાના ઉદ્ઘોગસ્થળની મુલાકાત લઈ તેનું કાર્ય નિહાળો.
- તમારા વિસ્તારના કોઈ ઉદ્ઘર્ષશીલને મળો અને તેની સફળતાના રહસ્યની ચર્ચા કરો.

મોડયુલ - ૭

મહત્વમાં માર્ક

૦૦

અભ્યાસના કલાક

૩૦

પ્રાયોગિક અને અહેવાલ (લેખન)

વિદ્યાર્થીઓ આખરે તો સ્વ-રોજગાર કે નોકરી કરતા વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી કરવું. કાર્ય સ્થળની સફળતાનો આધાર તેમણે કેવી રીતે યોજના બદ્ધ અને આવડતથી પોતાની ફરજ બજાતી છે. તેના પર રહ્યો છે. આ મોડયુલ વિદ્યાર્થીને માટે એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે કે નેમની યુક્તિઓનો ઉપયોગ કેસ સ્ટડી કરીને પ્રોજેક્ટ વર્ક પૂરું કરી શકે. તે અપેક્ષી છે કે અહેવાલ કાર્ય વિદ્યાર્થીઓને એવી રીતે વિકસિત બનાવે કે તે વાણિજ્યના – ધ્યાના વિવિધ પાસાઓ સમજે અને તેમના જીવનમાં અર્થપૂર્ણ બને.

મોડયુલ – ૭
પ્રાયોગિક અને અહેવાલ
(લેખન)



૨૧

પ્રોજેક્ટ વર્ક ધૂંધાના અભ્યાસની

સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

વાણિજ્યના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ધૂંધાના સ્વરૂપમાં સમાયેલી તમામ વિભાવનાઓની સમજનો વિકાસ થાય અને તેમના જીવનમાં આ વિષયનું શાન અમૃત્ય બને તે ઉદ્દેશની અપેક્ષા સાથે પ્રોજેક્ટ વર્ક આપવામાં આવે છે.

પ્રોજેક્ટ:-

- તમારી આસપાસ રોજી – રોટી મેળવતા કોઈ પણ પાંચ સજજનોની મુલાકાત લઈ તેમના રોજી – રોટી મેળવવાની આર્થિક પ્રવૃત્તિઓનું ધૂંધાકીય પ્રવૃત્તિ, વ્યવસાયિક પ્રવૃત્તિ અને નોકરી (રોજગારી)ની પ્રવૃત્તિમાં વર્ગીકરણ કરો.

અનુ. નં.	સાહસ ચલાવતા સજજનનું નામ – સરનામું	ઉત્પાદન કે સેવાનું નામ	ધૂંધો – વ્યવસાય નોકરી
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આથી ક પ્રવ તિઓ જેવી કે ધૂંધો, વ્યવસાય અને રોજગારી (નોકરીનું) તુલનાત્મક મુલ્યાંકન કરો.

આધાર અર્થ	ધૂંધો	વ્યવસાય	રોજગારી (નોકરી)
સ્થાપના અને સંચાલનની			
આચાર સંહિતા			
નિયમો અને શરતો			

મોડ્યુલ - ૭
પ્રાયોગિક અને અહેવાલ
(વેખન)



નોંધ

પ્રોજેક્ટ વર્ક ધ્યાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

વળતર			
જોખમ			

૨. કોઈપણ પાંચ દૂકાનદારની કે ધ્યાથી ની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરી આપેલ પત્રકમાં તેમની સાથે થયેલ વાતચીતનો અહેવાલ તૈયાર કરો.
- અ. તેઓ કયા પ્રકારની વસ્તુ કે સેવા પૂરી પાડવા સાથે જોડાયેલા છે.
- બ. તેમના મૂડી રોકાણના સ્ત્રોતો જેવા કે જમીન, શ્રમ અને નાણાં.
- ક. નક્ષે મેળવવા ઉદ્ભવતા જોખમો અને અનિશ્ચિતતાના પ્રશ્નો.
- નીચેના પત્રકમાં તમારો અહેવાલ આપો.

અનુ. નં.	સાહસ - ધ્યાથી ચલાવતા વ્યક્તિતનું નામ સરનામું	સંસાધનોની માત્રા			જોખમો અને અનિશ્ચિતતા
		જમીન (ચોરસ મીટર)	કામદારોની સંખ્યા	મૂડી રોકાણ (ર.)	
૧.					
૨.					
૩.					
૪.					
૫.					

૩. ભારતમાં આયાત અને નિકાસ થતી સૌથી અગત્યની વસ્તુઓની માહિતી સામાયિકો, વર્તમાન પત્રો કે પુસ્તકોનો અભ્યાસ કરી જણાવો. તેમજ ઓછામાં ઓછા પાંચ બંદરોનો ઉપયોગ જે આયાત અને નિકાસ માટે થાય છે તેની માહિતી પણ નીચેના પત્રકમાં આપો.

આયાત થતી વસ્તુઓ

અનુ. નં.	આયાત થતી ચીજ - વસ્તુઓ	આયાતકાર પેઢીનું નામ	આયાત કરેલ દેશનું નામ	આયાત કરવા ઉપયોગમાં લેવાયેલ ભારતના બંદરનું નામ
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

પ્રોજેક્ટ વર્ક ધૂમાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

નિકાસ થતી વસ્તુઓ

અનુ. નં.	નિકાસ થતી ચીજ વસ્તુઓ	નિકાસપે ઢીનું નામ	નિકાસ થતી હોય દેશનું નામ	નિકાસ કરવા ઉપયોગમાં લેવાયેલ ભારતના બંદરનું નામ
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૪. તમારા વિસ્તારના કેટલા દુકાનદાર કે ધૂમાથી ઓની મુલાકાત લઈ તેમનો ધૂમાકીય સાહસ ચલાવવાના હેતુઓ કયા છે? તેની માહિતી આપેલા પત્રમાં તમે આ વિષયના સંદર્ભમાં અભ્યાસ કરી, ધૂમાના હેતુઓ પ્રમાણે વર્ગીકરણ કરો.

અનુ. નં.	ધૂમાકીય એકમનું નામ અને સરનામું	હેતુઓ	હેતુઓના પ્રકારો આધિક હેતુ – વિકિત કે સમાજ ઉપયોગી / રાષ્ટ્રીય કે વિશ્વ ઉપયોગી હેતુ
૧.			
૨.			
૩.			
૪.			
૫.			
૬.			
૭.			

૫. તમારા વિસ્તારના કોઈ પણ પાંચ ધૂમાકીય પ્રવૃત્તિ કરતા ધૂમાથી ઓની મુલાકાત લો અને તેનું વર્ગીકરણ ઉદ્ઘોગ કે વાણિજ્ય પ્રવૃત્તિ પ્રમાણે કરો. આ ઉપરાંત ઉદ્ઘોગને પ્રાથમિક, સેકન્ડરી કે આનુષ્ઠાનિક ઉદ્ઘોગ પ્રમાણે નીચેના પત્રકમાં અહેવાલ સ્વરૂપે તૈયાર કરો.

અનુ. નં.	ધૂમાથીનું નામ અને સરનામું	ધૂમાકીય પ્રવૃત્તિનું સ્વરૂપ	ઔદ્ઘોગિક કે વાણિજ્ય	ઉદ્ઘોગના સંદર્ભમાં પ્રકાર
૧.				
૨.				
૩.				
૪.				
૫.				



નોંધ

મોડ્યુલ - ૭
પ્રાયોગિક અને અહેવાલ
(વૈભન)



નોંધ

પ્રોજેક્ટ વર્ક ધ્યાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

૬. તમારા વિસ્તારની નજીક આવેલા બજારની મુલાકાત લઈ જુદા જુદા પ્રકારની પાંચ દુકાનોની માહિતી મેળવો. ઓછામાં ઓછી ચાર દુકાનો જે માત્ર એક જ વ્યક્તિની માલિકીની છે તેમને પુછો કે તમને આ દુકાન ચલાવતા કયા કયા પ્રશ્નો કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની માહિતી નીચેના પત્રકમાં અહેવાલ સ્વરૂપે આપો.

અનુ. નં.	ધ્યાનથીનું નામ અને સરનામું	દુકાનમાં વેચાતી વસ્તુઓના નામ	એક જ કે સંયુક્ત માલિકી	એક જ માલિક હોય તેને સહન કરવા પડતા પ્રશ્નો મુશ્કેલીઓ.

૭. તૈયાર પેકેટમાં ઉપલબ્ધ કોઈ પણ પાંચ દેનિક ઉપયોગમાં લેવાતી વસ્તુઓ એકત્રીત કરી તેમના ઉત્પાદકોના નામ (કંપની) જણાવો. અને વર્ગીકરણ કરો કે આ કંપની ખાનગી કે જાહેર કંપની છે. અને આમાંથી કઈ કંપનીઓ બાહુ રાષ્ટ્રીય (વિદેશી) કંપનીઓ છે. તે નીચે આપેલ પત્રકમાં અહેવાલ સ્વરૂપે જણાવો.

અનુ. નં.	પેકેટમાં રહેલ વસ્તુનું નામ	ઉત્પાદન કરતી વસ્તુનું નામ	ખાનગી કે જાહેર કંપની	વિદેશી કંપની સામે ✓ ટીક કરો.
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૮. તમારા નજીકના કોઈ પણ પાંચ વેપારીઓનો સંપર્ક કરી માહિતી મેળવો કે તેમના માલના પરિવહન માટે કયા પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે? અને શા માટે? આ વાહન વ્યવહારના માર્ગનો ઉપયોગ કરવાથી તેમને થતા લાભ અને ગેરલાભ નીચેના પત્રકમાં અહેવાલ સ્વરૂપે રજૂ કરો.

અનુ. નં.	વેપારી પેઢીનું નામ	વેચાણ થતી વસ્તુ	વાહન વ્યવહારનો પ્રકાર	આ લાભ	આ પ્રકારના લાભ
૧.					
૨.					
૩.					
૪.					
૫.					

પ્રોજેક્ટ વર્ક વંધાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

૬. કોઈ પણ પાંચ એવી વસ્તુઓની માહિતી એકત્ર કરો કે જેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય અને તેનો વપરાશ માત્ર અમુક છાતુગત (સિળનેબલ) હોય અને એવી બીજી કોઈ પણ પાંચ વસ્તુઓની માહિતી એકત્ર કરો કે જેનું ઉત્પાદન માત્ર અમુક છાતુમાં જ હોય પરંતુ તેની વપરાશ સમગ્ર વર્ષ વરમિયાન હોય. આ માહિતી નીચેના પત્રકમાં અહેવાલ સ્વરૂપે રજૂ કરો.

સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન થતી હોય પરું અમુક ચોક્કસ છાતુમાં જ ઉપયોગ થતી હોય તેવી વસ્તુઓની વિગત

મોડયુલ – ૭
પ્રાયોગિક અને અહેવાલ
(લેખન)



નોંધ

અનુ. નં.	વસ્તુઓની વિગત	ઉત્પાદન થયેલ તે મહિનો	જ મહિનામાં ઉપયોગ લેવાઈ હોય તે
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

અમુક છાતુમાં જ ઉત્પાદન થતી હોય તેવી વસ્તુઓની વિગત (ઉપર મુજબ) પરંતુ સમગ્રવષ દરમિયાન ઉપયોગ થતી હોય.

૧૦. તમારા વિસ્તારના કોઈ પણ પાંચ વૈયક્તિક માલિકી ધરાવતા વેપારીની મુલાકાત લઈ તેમને પૂછો કે શું તમે આ એક જ માલિકીની પેઢી ભાગીદારી પેઢીમાં રૂપાંતર કરવા ઈચ્છા છો? તેમણે આપેલ પ્રત્યુત્તારને નીચે આપેલા પત્રકમાં અહેવાલ સ્વરૂપે રજૂ કરો.

વેપારીઓની યાદી

અનુ. નં.	વૈયક્તિક માલિકીનું નામ અને સરનામું	વૈયક્તિક માલિકનું નામ	ભાગીદારી પેઢીમાં રૂપાંતર કરવાના કારણો
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

ભાગીદારી પેઢીમાં રૂપાંતર ન કરવા ઈચ્છા વૈયક્તિક (એકાડી) વેપારીઓની યાદી

અનુ. નં.	વૈયક્તિક માલિકીનું નામ અને સરનામું	વૈયક્તિક માલિકનું નામ	ભાગીદારી પેઢીમાં ન ફેરફાર કરવાના કારણો
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

મોડ્યુલ - ૭
પ્રાયોગિક અને અહેવાલ
(વેખન)



નોંધ

પ્રોજેક્ટ વર્ક ધ્યાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

૧૧. તમારા નજીકના વિસ્તાર કે ગામડાની મુલાકાત લઈ કાર્યરત એવી સહકારી મંડળીની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓના સંદર્ભમાં આપેલ પત્રકમાં અહેવાલ સ્વરૂપે મેળવેલી વિગતો રજૂ કરો.
- સહકારી મંડળીનો ઉદ્દેશ ક્યો છે?
 - સહકારી મંડળીના સભ્યો કોણ - કોણ છે?
 - આ સહકારી મંડળીએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે?
 - આ સહકારી મંડળી તેના સંચાલનમાં કોઈ મુશ્કેલીઓ અનુભવે છે કે કેમ? તે જણાવો.

તમારો અહેવાલ નીચેના પત્રકમાં રજૂ કરો.

અનુ. નં.	સહકારી મંડળીનું નામ	મંડળીનો હેતુ	સભ્ય સંખ્યા	મુખ્ય પ્રવૃત્તિઓ	સંચાલન કરતા પડતી મુશ્કેલીઓ
૧.					
૨.					
૩.					
૪.					
૫.					

૧૨. તમારા વિસ્તારમાં કાર્યરત એવી બેન્કોની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમના કાર્ય કરવાને આધારે વર્ગીકરણ કરો. નીચેના પત્રકરમાં તમે મેળવેલી માહિતી દર્શાવો અને વાણિજ્ય બેન્કના કાર્યો જણાવો.

અનુ. નં.	બેન્કનું નામ	શાખા	મુખ્ય કાર્ય	બેન્કનો પ્રકાર રાષ્ટ્રીય, ખાનગી, ગ્રામીણ કે સહકારી બેન્ક
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૧૩. તમારા વિસ્તારની સૌથી નજીક આવેલી બેન્કની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમાં લોકોએ ખોલાવેલા ખાતાની પ્રકારના સંદર્ભમાં નીચેના પત્રક સ્વરૂપમાં અહેવાલ આપો.

પ્રોજેક્ટ વર્ક વંધાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

અનુ. નં.	ખાતાનો પ્રકાર	ખાતુ ખોલાવવા જરૂર પડતી ઓછામાં ઓછી રકમ	વ્યાજનો ૬૨	પાકતી મુદ્દતનો સમય જો હોય તો	યોગ્યતા
૧.	બચત ખાતુ				
૨.	ચાલુ ખાતુ				
૩.	રિકીરીંગ ખાતુ				
૪.	બાંધી મુદ્દતની થાપણ ખાતુ				
૫.	પદ્ધીક પોવિફન્ડ ફંડનું ખાતુ				

૧૪. તમારા વિસ્તારના વેપારીઓની મુલાકાત લઈ તેમના વેપારમાં ઉદ્ભવતા જોખમો સામે આર્થિક વળતર મેળવવા ઉત્તારેલ વીમાની માહિતી મેળવો. તેમાંથી ઓછામાં ઓછા પાંચ દુકાનદારોની માહિતી કે જેમાં દુકાનદારોના નામ, સરનામા, આરક્ષિત વીમાનો લાભ નીચેના પત્રક સ્વરૂપમાં દર્શાવો.

અનુ. નં.	વેપારીનું નામ અને સરનામું	ઉત્તરાવેલ વીમાનો પ્રકાર	પોલીસીનું નામ	વીમા કંપનીનું નામ
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૧૫. વર્તમાન પત્રનો અભ્યાસ કરી તેમાં આવેલી જાહેરાતો અને અહેવાલમાંથી ટપાલ વ્યવહારી દુકાનો (મેઇલ ઓર્ડર) દ્વારા ઉત્પાદનોના વેચાણની માહિતી મેળવો. અને આવી ટપાલ વ્યવહારી દુકાનના લાભ અને ગેરલાભ નીચે આપેલ પરિપત્રમાં અહેવાલ સ્વરૂપે રજૂ કરો.

અનુ. નં.	જાહેરાત આપનારનું નામ અને સરનામું	ઉત્પાદન	બ્રાન્ડ	ઓર્ડર મોલવાની પદ્ધતિ (પત્ર – ટેલીફોન – SMS કે E-mail)
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

મોડ્યુલ – ૭
પ્રાયોગિક અને અહેવાલ
(લેખન)



નોંધ

મોડ્યુલ - ૭
પ્રાયોગિક અને અહેવાલ
(વેખન)



નોંધ

પ્રોજેક્ટ વર્ક ધ્યાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

ટપાલ વ્યવહારી દુકાનોના લાભ અને ગેરલાભ મુદ્દાસર જણાવો.

૧૬. તમારા દેનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓની યાદી બનાવો.
એક ગ્રાહક તરીકે તમે આ ખરીદતા સમયે કોઈ મુશ્કેલીઓનો સમનો કરો છો?
ગ્રાહકના હક્ક – અધિકારોનો અભ્યાસ કરી નીચેના પત્રકમાં વર્ણાવો.

અનુ. નં.	વસ્તુ કે સેવાનું નામ	ઉત્પાદન કર્તાનું નામ	સમસ્યાઓ	ગ્રાહકના અધિકાર
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૧૭. પાંચ ભારતીય એવી કંપનીઓની યાદી બનાવો કે જે વિદેશી કંપનીઓ સાથે જોડાઈને સંયુક્ત સાહસ બની છે. આવા સાહસો સાથે જોડાવાથી કયા ખાસ પ્રકારના ફિયદાઓ થાય છે. તેનો અહેવાલ નીચેના પત્રકમાં તૈયાર કરો.

અનુ. નં.	ભારતીય કંપનીનું નામ	વિદેશી કંપનીનું નામ	દેશનું નામ	ઉત્પાદન
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

વિદેશ સહયોગથી બનતા સંયુક્ત સાહસને થતા લાભ મુદ્દાસર જણાવો.

૧૮. વર્તમાન પત્રો, સામાજિકો અને ધંધાકીય અહેવાલનો અભ્યાસ કરી એવી પાંચ કંપનીઓની યાદી બનાવો જે સામાજિક જવાબદારી અસરકારક રીતે અદા કરે છે.
અને એવી પાંચ કંપનીઓની યાદી બનાવો જે સામાજિક જવાબદારી અદા કરવામાં નિષ્ફળ ગઈ છે.

સામાજિક જવાબદારી અદા કરતી કંપનીઓ.

અનુ. નં.	કંપનીનું નામ	સામાજિક પ્રવૃત્તિઓ	સામાજિક જવાબદારીનું નામ
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

પ્રોજેક્ટ વર્ક વંધાના અભ્યાસની સભાનતા માટે સૈદ્ધાંતિક સ્વ-અધ્યયન

સામાજિક જવાદારી આદાન કરતી કંપનીઓની યાદી

અનુ. નં.	કંપનીનું નામ	સામાજિક જવાબદારીઓનો અભાવ	સમાજ પ્રત્યે બેજવાબદાર
૧.			
૨.			
૩.			
૪.			
૫.			

મોડયુલ – ૭
પ્રાયોગિક અને અહેવાલ
(લેખન)



નોંધ

૧૯. ઉત્પાદકો દ્વારા વેચાણ વૃદ્ધિ માટે વર્તમાન પત્રો, સામાચિકો કે અન્ય રીતે કરવામાં આવેલી વિવિધ યોજનાનો અભ્યાસ કરી નીચેના પત્રકમાં અહેવાલ સ્વરૂપે ૨જૂ કરો.

અનુ. નં.	ઉત્પાદકનું નામ	ઉત્પાદીત વસ્તુ બ્રાન્ડ સાથે	યોજના	વેચાણ વૃદ્ધિ યોજનાનું નામ
૧.				
૨.				
૩.				
૪.				
૫.				

૨૦. આપેલા પત્રકમાં નાણાના પ્રાપ્તી સ્થાનોનો તુલનાત્મક અભ્યાસ અહેવાલ સ્વરૂપે ૨જૂ કરો.

અનુ. નં.	તુલનાઓનો આધાર	ઇક્વિટી શૈર	B બેચસો	બેન્કમાંથી લોન	જાહેર થાપણો
૧.	સરળ ઉપલબ્ધ				
૨.	પડતર				
૩.	સંસ્થાનું સ્વરૂપ				
૪.	અંકુશ – નિયમન				
૫.	શાન પર થતી અસર				
૬.	તરલતા – પરિવર્તનશીલ				
૭.	કરવેરાણા લાભ				

વાણિજ્ય વ્યવસ્થા

(વ્યવસાય અધ્યયન)

માધ્યમિક અભ્યાસક્રમ

૧. પ્રસ્તાવના:-

આપણે બધા એક બૃહદ અને સંકુલ ધંધાકીય વાતાવરણમાં જીવન પસાર કરી રહા છીએ. આપણે ગરીબ હોઈએ કે ધનિક પરંતુ ધંધાકીય પ્રવૃત્તિઓ આપણું દેનિક જીવન સરળ અને સુખમય બનાવી રહ્યા છે. ખાસ કરીને આપણી જરૂરિયાતો પૂરી પાડીને અને જીવન ધોરણની ગુણવત્તા વધારીને આડો ભૂતકાળમાં થતી આર્થિક પ્રવૃત્તિઓ અને વર્તમાનની આર્થિક પ્રવૃત્તિઓની સાપેક્ષ સરખામણી અનુભવી શકીએ છીએ. વર્તમાનની આર્થિક પ્રવૃત્તિઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી ને મજ માહિતી સંચારની કારણે ખૂર જડપથી પરિવર્તનશીલ પામે છે. આધુનિક ઉત્પાદન પદ્ધતિ અને નવીન વિતરણ વ્યવસ્થાને કારણે આજે વિશ્વ એ એક આર્થિક એકમનું ઘટક બનેલ છે. આજે એક દેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુ અને સેવાઓ ત્વરીત બીજા દેશોમાં પ્રાપ્ય બને છે. વૈજ્ઞાનિક સંચાલન, ઉચ્ચતમ માહિતી સંચાર અને સંદેશાવ્યવહાર, જડપી નાણાંકીય વ્યવસ્થા તેમજ જોખમો સામે વીમાનું સુરક્ષા કવય જેવી આધુનિક સેવાઓની ઉપલબ્ધતાને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ચરમશીમાઓ વિકાસ પામી રહી છે. આથી જ આપણાને સતત અશર કરતી આ ધંધાકીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા વ્યક્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ અને આર્થિક પર્યાવરણના અભ્યાસથી સજાગ રહેવું જોઈએ. વૈશ્વિક ધંધાકીય માહિતીની પ્રાથમિક – પાયાની જાણકારી હોવી એ આજે અનિવાર્ય ગણાય છે. માધ્યમિક કક્ષાએ વ્યવસાય અધ્યયનનો અભ્યાસક્રમ વધુ ઉપયોગી બનશે જ.

૨. હેતુઓ:-

માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યવસાય અધ્યપનનો અભ્યાસ અનેક રીતે હેતુલક્ષી

- આર્થિક પ્રવૃત્તિઓ અને ધંધાની સામાજિક જવાબદારીઓનો અર્થ સ્વરૂપ અને અવકાશનું શાન સમજી શકશો.
- ઉદ્ઘોગ અને વાણિજ્યમાં આર્થિક પદ્ધતિઓનું વર્ગીકરણ સમજી, ભવિષ્યમાં ધંધાની સ્થાપના માટે નિર્ણય લેવામાં માર્ગદર્શન બની શકે.
- વેપારને ઉપયોગી આનુભંગિક સેવાઓ જેવી કે વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ટપાલ વ્યવહાર, બેન્ક અને વીમા સેવાઓનું મહત્વ – ઉપયોગિતા જાણી શકશો.
- આધુનિક અર્થ વ્યવસ્થાની નવી સંકલ્પનાઓ જેવી કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, બી.પી.ઓ., કે.પી.ઓ. વગેરે સમજી શકશો.
- વિતરણના માર્ગોના પ્રકાર ઉપરાંત છૂટક વેપારનું સ્વરૂપ સમજી શકશો.
- જાહેરાતો, વેચાણ વૃદ્ધિ અને પ્રત્યક્ષ વેચાણનું મહત્વ સમજી શકશો.
- ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક ઝડપ નિવારણની અગત્યતા જાણી શકશો.
- સ્વ-રોજગારીનું મહત્વ અને કારક્રિયા ઘડતર માટે આવશ્યક ગુણો અને કોશલ્યો સમજી શકશો.
- પ્રોજેક્ટ વર્ક(અહેવાલ) તૈયાર કરવાના ગુણો પ્રત્યક્ષ કેસ સ્ટડીથી મેળવી શકશો.

3. અભ્યાસક્રમ:-

ધંધકીય માળખાનો અભ્યાસ સાત મોડુલ્સમાં વિભાજીત કરેલ છે.

મોડયુલ્સ	શીર્ષક	ગુણાંકન	કલાક
૧.	ધંધાકીય પ્રવૃત્તિની પૂર્વભૂમિકા	૧૨	૨૫
૨.	ધંધાકીય સંસ્થાના સ્વરૂપો	૧૫	૩૫
૩.	સેવાક્ષેત્ર	૨૫	૪૫
૪.	ખરીદ – વેચાણ અને વિતરણ	૨૦	૪૫
૫.	ગ્રાહક જાગૃતિ	૧૬	૩૫
૬.	વાણિજ્યક્ષેત્રે કારણીટી	૧૨	૨૫
૭.	પ્રાયોગિક કાર્ય અને પ્રોજેક્ટ કાર્ય	૦૦	૩૦
કુલ		૧૦૦	૨૪૦

४. मुख्यांकनः—

આ વિષયના ગુણાનું મુલ્યાંકન, આંતરિક ગુણાંકન જેમાં તમે મેળવેલા ટ્યુટર માર્કડ એસાઈમેન્ટ અને બાહ્ય ગુણાંકન પ્રેક્ટીકિલ સાથે કરવામાં આવશે. વર્ષમાં બે વાર વાર્ષિક કે બાહ્ય પરીક્ષા લેવામાં આવશે. જેના મહિના એપ્રિલ અને ઓક્ટોબર હશે. ટ્યંટર માર્કડ એસાઈમેન્ટને શૈક્ષણિક સાધન તરીકે વણવામાં આવે છે. TMA વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની પ્રગતિ અને પરીક્ષાની સારી પૂર્વ તૈયારી તરીકે ઉપયોગી થશે. TMA ના ગુણ માર્કશીટમાં અલગ બતાવવામાં આવશે. અને જાહેર પરીક્ષાના સર્વગાહી ગ્રેડ પદ્ધતિમાં ગણવામાં આશે નહીં. મોડયુલ ૭ જે પ્રોજેક્ટ વર્ક છે તે પરીક્ષાના એક ભાગ તરીકે ગણવામાં ન આવતા માત્ર વિદ્યાર્થીના ધંધાકીય પદ્ધતિઓના જ્ઞાનમાં વધારો થવાનો હેતુ છે. મુલ્યાંકનની આ બે પદ્ધતિઓ ઉપરાંત સઘન અને સતત સ્વ-અધ્યયનના સાધન તરીકે પાઠગત પ્રશ્નો, સત્રાંત સ્વાધ્યાય વગેરે પ્રત્યેક પાઠના અંતે આપવામાં આવ્યા છે.

૫. અભ્યાસક્રમનં વિવરણ:-

૪.૧ વાણિજ્ય પ્રવૃત્તિની પૂર્વભૂમિકા ૧૨ ગુણ ૨૫ કલાક:-

આપણે આર્થિક પર્યાવરણમાં જીવંત છીએ. આર્થિક પર્યાવરણ એ સમાજનું અવિભાજ્ય અંગ છે. બૃહદ્દ આર્થિક પ્રવૃત્તિના માળખાને કારણે આપણે આપણી વિવિધ જરૂરિયાતો જેવી કે વૈવિધ્ય સલભ ચીજ વસ્તુઓ અને સેવાઓ સંતોષી શકીએ છીએ. આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ કે કે જેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિશ્વના વાણિજ્યથી સજાગ બને, તેનું મહત્વ સમજી શકે, હેતુઓ જાણી શકે, વાણિજ્ય પ્રવૃત્તિના જુદા જુદા પ્રકારની સમજ મેળવી શકે અને આ ઉપરાંત નવ વિકસિત વિભાવતા જેવી કે ઈ-કોમર્સ અને ધ્યાની સાથે જોડાયેલા વિવિધ સામાજિક પક્ષકારો પ્રત્યેની જવાબદારીઓ જાણી શકે.

४.१.१ धंधाक्रिय प्रवृत्तिनी प्रस्तावना:-

- ## ૧. ધંધાનું સ્વરૂપ અને અવકાશ:-

૨. માનવ પ્રવૃત્તિઓ:- આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ.
 ૩. આર્થિક પ્રવૃત્તિઓ:- ધંધો, વ્યવસાય, સ્વ-રોજગારી
 ૪. ધંધો:- અર્થ, લક્ષણો, મહત્વ હેતુઓ જેમાં આર્થિક, સામાજિક, માનવ આધારિત, રાષ્ટ્રીય અને વૈશ્વીક હેતુઓ.
 ૫. ધંધાની સામાજિક જવાબદારી:- અર્થ, વિવિધ હિત ધરાવતા પક્ષકારો પ્રત્યેની જવાબદારી.
 ૬. પ્રદૂષિત વાતાવરણમાં ધંધાની ભૂમિકા.

૪.૧.૨ ઉદ્યોગ – વાણિજ્ય

- ધંધાની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, ઉદ્યોગ અને વાણિજ્ય.
 - ઉદ્યોગ અને તેના પ્રકારો.
 - વાણિજ્ય, વેપાર અને તેની આનુષ્ઠાનિક સેવાઓ.

૫.૨ વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો ૧૫ ગુણ ૩૫ કલાક

ધૂમાના કદ, માલિકી હક્ક અને સંચાલકિય જરૂરિયાતોને આવીન ધૂમાકીય માળખાના પ્રકાર છે. આ મોડયુલના અભ્યાસ બાદ વિદ્યાર્થી ધૂમાકીય સાહસનો અર્થ, પ્રકાર અને વિવિધ સ્વરૂપો જેવાકે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની (સંયુક્ત હિસ્સાવાળી કંપની) વગેરેનું જ્ઞાન મેળવી શકશે.

પ.૨.૧ વૈયક્તિક માલીકી, ભાગીદારી પેઢી અને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી

१. वैयक्तिक (ऐकाडी) मालिकी:- अर्थ, लक्षणो, लाभ अने गेरलाभ.
 २. भागीदारी पेढी:- अर्थ, लक्षणो, लाभ अने गेरलाभ, मर्यादित जवाबदारीवाणी भागीदारीनी समજ.
 ३. हिन्दू अविभक्त कुटुंबनी पेढी:- अर्थ, लक्षणो, लाभ अने गेरलाभ.

પ.૨.૨ સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની.

1. સહકારી મંડળીઃ— અર્થ, પ્રકાર.
 2. સહકારી મંડળીના લાભ — ગેરલાભ.
 3. સંયુક્ત હિસ્સાવાળી કંપનીઃ— અર્થ, લક્ષણો, પ્રકાર — જાહેર કંપની, પ્રાઇવેટ (ખાનગી) કંપની, સરકારી કંપની, બહુરાષ્ટ્રીય કંપની.

૫.૩ સેવાના ક્ષેત્ર ૨૫ ગુણ ૪૫ કુલાક

આજનું વાણિજ્ય જગ્તિલ અને સેન્સીટીવ બની ગયું છે. વાણિજ્યની સરકારી આધાર જુદા જુદા પ્રકારની આનુંગિક સેવાઓ જેવી કે વાહન વ્યવહાર, વખાર, માહિતી સંચાર, ટપાલ વ્યવહાર, બેન્કિંગ, વીમો અને આઉટ સોર્ટિંગ (BPO) વગેરે પર નિર્ભર છે. વાણિજ્યની આ સેવાઓ વિશાળ પાયા પર પથરાયેલ હોય સમગ્ર વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓને ગતિશીલ શાખી વિકાસની નવી દિશાઓ સર્જી શકે છે. આ મોડયલ આનુંગિક સેવાઓનો અલોકિક વિકાસ સમજાવી શકે છે.

પ.ઉ.૧ વાહન વ્યવહારની સેવા

- ## ૧. વાહન વ્યવહાર:- અર્થ, મહત્વ.

૨. વાહન વ્યવહારની પદ્ધતિઓ:- રેલ્વે, રસ્તા, જળમાર્ગ અને હવાઈ માર્ગ – લક્ષ્ણો, લાભ અને ગેરલાભ.

૫.૩.૨ વખારની સેવાઓ

૧. વખારની સેવાનો અર્થ અને આવશ્યકતા.
૨. વખારના પ્રકારો.
૩. આદર્શ વખારના લક્ષ્ણો.
૪. વખારના કાર્યો.
૫. વખારના લાભ.

૫.૩.૩ માહિતી સંચારની સેવા.

૧. અર્થ અને મહત્વ.
૨. માહિતી સંચારના પ્રકારો, ઔપયારિક અને અનૌપયારિક.
૩. માહિતી સંચારના માધ્યમો:- પત્રો, ટેલિફોન, ટેલિગ્રાફ, ટેલી પ્રીન્ટર, ટેલી કોન્ફરન્સીંગ, ફેક્શન, ઈન્ટરનેટ.
૪. માહિતી સંચારના અવરોધ.

૫.૩.૪ ટપાલ વ્યવહારની સેવા અને કુરિયર સેવાઓ

૧. ટપાલ વ્યવહારનો અર્થ અને સ્વરૂપ.
૨. પોસ્ટ ઓફિસ દ્વારા મળતી સેવાઓ.
૩. ટપાલની સેવાઓ નિપૂણતા.
૪. ટપાલીન સેવા માટેનો ખર્ચ.
૫. ટપાલની સેવાઓનું મહત્વ.
૬. ખાનગી કુરિયર સેવાઓ.

૫.૩.૫ બેન્કની સેવાઓ

૧. બેન્કનો અર્થ અને ફાળો.
૨. બેન્કના પ્રકાર.
૩. વાણિજ્ય બેન્કના કાર્યો.
૪. મધ્યરથ બેન્ક
૫. બેન્કના જમા ખાતા – પ્રકારો.
૬. બચત ખાતા ખોલવા અને કાર્યરત રાખવા.
૭. ઈ – બેન્કિંગ.

૪.૩.૬ વીમો

૧. ધંધાકીય જોખમો.
૨. વીમાનો અર્થ અને મહત્વ.
૩. વીમાના પ્રકારો – જીડીગીનો વીમો, સામાન્ય વીમો – આગનો વીમો, દરિયાઈ વીમા અને અન્ય પ્રકારો
૪. વીમાના સિદ્ધાંતો.

૪.૩.૭ આઉટ સોર્સિંગ

૧. બી.પી.ઓ. (B.P.O.) અર્થ અને મહત્વ.
૨. કે.પી.ઓ. (K.P.O.) અર્થ અને મહત્વ.

૫.૪ ખરીદ – વેચાણ અને વિતરણ

૨૦ ગુણ ૪૫ કલાક

વર્તમાન વૈશ્વિક બજારમાં જથ્થાબંધ ઉત્પાદને કારણે અસરકારક વિતરણ માર્ગો અપનાવવા પડે. આધુનિક ટેકનોલોજીના કારણે વેચાણ અને વિતરણ ક્ષેત્રે વિવિધ પદ્ધતિઓમાં આમુલ કાંતિ આવેલ છે. અને વિશ્વ એક બજાર બન્યુ છે. આજે એક દેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુ અને સેવાઓ તરીત બીજા રાષ્ટ્રોમાં ઉપલબ્ધ બને છે. આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે વિદ્યાર્થીઓ ધંધાકીય જગતમાં વસ્તુ અને સેવાના ખરીદ – વેચાણ અને વિતરણની પ્રક્રિયા સમજી શકે. જાહેરાત અને વેચાણ વૃદ્ધિની વિવિધ પદ્ધતિઓ અપનાવી શકે.

૫.૪.૧ ખરીદ અને વેચાણઃ–

૧. ખરીદ – વેચાણનો અર્થ.
૨. રોકડ અને શાખના વ્યવહારો.
૩. ખરીદ અને વેચાણમાં ઉપયોગી દસ્તાવેજો. ભાવપત્રક, વરદી (ઓર્ડર), ભરતિયું, કેશ મેમો, ડિલિવરી ચલન.
૪. નાણાં ચૂકવણીની રીત: રોકડ ચૂકવણી, હપ્તા ખરીદ પદ્ધતિ, શાખ મુદ્દત પર ચૂકવણી.

૫.૪.૨ વિતરણના માર્ગો:–

૧. વિતરણના માર્ગોનો અર્થ.
૨. પ્રત્યક્ષ અને પરોક્ષ વિતરણ માર્ગ.
૩. વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેણારીની અનિવાર્યતા.

૫.૪.૩ છૂટક વેપાર

૧. છૂટક વેપારના પ્રકાર, નાની દુકાનો, મોટી દુકાનો.
૨. વિશાળ દુકાનોનું સ્વરૂપ – ખાતાવાળી દુકાનો, સુપર માર્કેટ, વૈવિધ્ય સભર દુકાનો, મોલ્સ, શો-રૂમ વગેરે.
૩. અસંગ્રહિત છૂટક માર્ગ, ટપાલ વ્યવહારી દુકાનો, સ્વયં સંચાલીત વેન્ડીંગ મશીન ઇન્ટરનેટ દ્વારા વેચાણ.

૫.૪.૪ જાહેરાતઃ–

૧. જાહેરાતનો અર્થ અને મહત્વ.

૨. જાહેરાતના માધ્યમો.

૫.૪.૫ વેચાણ વ દ્વિ અને વ્યક્તિગત વેચાણ:-

૧. વેચાણ વૃદ્ધિ: અર્થ અને મહત્વ.
૨. વેચાણ વૃદ્ધિના સાધનો.
૩. વ્યક્તિગત વેચાણ: અર્થ અને મહત્વ.
૪. આદર્શ સેલ્સમેનની ગુણવત્તા.

૫.૫ ગ્રાહક જાગૃતિ

૧૬ ગુણ

૩૫ કલાક

ગ્રાહક તુટ્ટિગુણ એજ પ્રત્યેક ધંધાનો એક માત્ર લક્ષ છે. તેમ છતાં અનેક રીતે ગ્રાહક વેપારીના શોખણનો શિકાર બને છે. ક્યારેક ઉચ્ચી કિંમતે નીચી ગુણવત્તાવાળો માલ ગ્રાહકને વેચવામાં આવે છે. આનું મુખ્ય કારણ ઘણાં ગ્રાહકો પોતાને મળેલા હક્ક અને જવાબદારીથી અજ્ઞાન હોય છે. આજ કારણો અત્યારસના આ મોડયુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થી ગ્રાહક સુરક્ષાના કાયદા અન્વયે પોતાના અધિકારો, જવાબદારીઓ અને ગ્રાહક સુરક્ષા અંગે વિવિધ જોગવાઈઓ સમજી ઉપયોગ કરી શકે.

૫.૫.૧ ગ્રાહકના – અધિકારો અને જવાબદારીઓ:-

૧. ગ્રાહકનો અર્થ.
૨. ગ્રાહકના હક્ક.
૩. ગ્રાહકની જવાબદારીઓ.

૫.૫.૨ ગ્રાહક સુરક્ષા:-

૧. અર્થ અને જરૂરિયાત.
૨. ગ્રાહકને સહન કરવ પડતા પ્રશ્નો.
૩. ગ્રાહક સુરક્ષાના પગલા.
૪. કાયદાકિય ગ્રાહક સુરક્ષા.
૫. ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક લઘડા નિવારણ સંસ્થાઓ.

૫.૬ ધંધામાં કારકીર્દી બનાવવાની તકો

૧૨ ગુણ

૨૫ કલાક

પ્રત્યેક વ્યક્તિએ અમુક ઉમરે જીવન નિર્વાહ માટે યોગ્ય કારકીર્દીની પસંદગી કરવી જ પડે છે. ધંધાકીય વિશ્લાણ ક્ષેત્ર આર્થિક કમાણીની રોજગારી બને રીતે સ્વ–રોજગારી અને નોકરી દ્વારા આવકની વિશ્લાણ તક પૂરી પાડે છે. આપણા રાષ્ટ્રના વિકાસ કરવા અને બેરોજગારી દૂર કરવા સ્વ–રોજગારી એ શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. આ મોડયુલ વિદ્યાર્થીઓને રોજગારી અને સ્વરોજગારી મેળવવાનો દ્રષ્ટિપાત કરાવે અને શ્રમ દ્વારા વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે તે રીતે તૈયાર કરેલ છે.

૫.૬.૧ કારકીર્દીની પસંદગી:-

૧. કારકીર્દીનો અર્થ અને મહત્વ.
૨. સફળ સાહસિકના ગુણધર્મો.

૩. સાહસિકના (પ્રવર્તક) કાર્યો.
૪. નાનું ધંધાકીય સાહસની સ્થાપના.
- ૫.૭ પ્રાયોગિક અને અહેવાલ (લેખન) ૦૦ ગુણ ૩૦ કલાક
૧. વાણિજ્ય ના અત્યાસ માટે પ્રયોગિક કાર્ય.

વિદ્યાર્થીએ આખરે તો સ્વ-રોજગાર કે નોકરી કરતા વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી કરવું. કાર્ય સ્થળની સફળતાનો આધાર તેમજો કેવી રીતે યોજના બદ્લ અને આવડતથી પોતાની ફરજ બજાવી છે. તેના પર રહ્યો છે. આ મોડયુલ વિદ્યાર્થીને માટે એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે કે તેમની યુક્તિઓનો ઉપયોગ કેસ સ્ટડી કરીને પ્રોજેક્ટ વર્ક પૂરું કરી શકે. તે અપેક્ષી છે કે અહેવાલ કાર્ય વિદ્યાર્થીઓને એવી રીતે વિકસિત બનાવે કે તે વાણિજ્યના – ધંધાના વિવિધ પાસાઓ સમજે અને તેમના જીવનમાં અર્થપૂર્ણ બને.

વાણિજ્ય વ્યવસ્થા

(વ્યવસાય અધ્યયન)

માધ્યમિક અભ્યાસક્રમ

તમે જાણો છો કે અમે ૨૦૧૨–૨૦૧૩ તના વર્ષથી અમલમાં આવનારા વાણિજ્ય અધ્યયનના અભ્યાસક્રમમાં સંશોધન કાર્ય કરી જરૂરી ફેરફારો કર્યા છે. નવા અભ્યાસક્રમ માટે નવું પાઠ્ય પુસ્તક તૈયાર કરેલ છે. પરિણામે પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રના માળખામાં પણ જરૂરી ફેરફારો થયા છે. પાઠ્ય પુસ્તકના છેલ્લા ભાગમાં પ્રશ્નપત્રની રૂપરેખા તેમજ નમૂનાનું પ્રશ્નપત્ર અને ગુણ પ્રદાન યોજના પણ આપી છે. પ્રશ્નપત્રના નમૂનામાંથી તમને પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા તેમજ દરેક પ્રશ્નને ફાળવેલા ગુણ ઉપરાંત દરેક મોડયુલને ફાળવેલ ગુણ વગેરે વિશે માર્ગદર્શન મળી શકશે. આ નમૂનાના પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ પ્રશ્નોનું સ્વરૂપ, પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોના ગુણ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર જેવા જ હશે. દા. ત. તમને બહુ વિકલ્પ હેતુલક્ષી ૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. જેનો પ્રત્યેકનો ૧ ગુણ હશે. પાંચ (૫) પ્રશ્નો અતિટુંકા જવાબી હશે, જેના પ્રત્યેકના ઉ ગુણ હશે. પાંચ (૫) પ્રશ્નો ટુંકા હશે, જેના પ્રત્યેકના છ ગુણ હશે. પાંચ (૫) લાંબા જવાબી પ્રશ્નો હશે, જેના પ્રત્યેકના પ ગુણ હશે અને છેલ્લે પાંચ (૫) પ્રશ્નો નિબંધાત્મક (વિસ્તૃત) જવાબી હશે, જેના પ્રત્યેકના ફ ગુણ રહેશે. આમ, તમને ઉ ૧૦ પ્રશ્નો અને ૧૦૦ ગુણ મળશે.

નમૂનાના પ્રશ્ન પત્ર સાથે ગુણ પ્રદાન યોજના પણ આપવામાં આવી છે. તેમાં પ્રશ્નોના જવાબો વિગતવાર આપ્યા છે. આ નમૂનાની ઉત્તરવહી આપવાનો ઉદ્દેશ એ જ છે કે તમે પણ આ જ રીતે પ્રશ્નોના ગુણાંકને આધારે જવાબ ટુંકમાં કે લંબાણ પૂર્વક લખી શકો. આમાં મૂલ્યાંકન બિંદુ અનુસાર દરેક જવાબ દીઠ ગુણ વિભાજન પણ આપવામાં આવું છે. અમને આરા છે કે આ ગુણ પ્રદાન યોજના તમારો અભ્યાસક્રમ પરિપૂર્ણ કરવા ઉપયોગી થશે. તેમ છતાં તમને કોઈ બાબતની મુંજવણ હોય તો મુક્ત મને NIOS નો સંપર્ક કરી શકો છો.

પ્રશ્ન પત્રનું માળખું

વિષય: વાણિજ્ય અધ્યયન

ધોરણ: ૧૦

ગુણ: ૧૦૦

સમય: ૩ કલાક

૧. હેતુલક્ષી ગુણ ભારાંક

હેતુઓ	ગુણ	કુલ ગુણના ટકા %
શાન	૩૦	૩૦ %
સમજશક્તિ	૪૦	૪૦ %
ઉપયોગિતા	૨૦	૨૦ %
	૧૦૦	૧૦૦ %

૨. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણ ભારાંક

પ્રશ્નના પ્રકાર	પ્રશ્નનોની સંખ્યા	પ્રત્યેક પ્રશ્નના ગુણ	કુલ ગુણ	વિદ્યાર્થી ને ઉત્તર લખતાં લાગતો અપેક્ષિત સમય
બહુ તિકલ્પ પ્રશ્નો	૧૦	૧	૧૦	૧૦ મિનિટ
બહુ ટુંક જવાબી પ્રશ્નો	૦૫	૩	૧૫	૨૫ મિનિટ
ટુંક જવાબી પ્રશ્નો	૦૫	૪	૨૦	૩૦ મિનિટ
લાંબા જવાબી પ્રશ્નો	૦૫	૫	૨૫	૫૦ મિનિટ
વિસ્ત ત જવાબી પ્રશ્નો	૦૫	૬	૩૦	૫૦ મિનિટ
	૩૦		૧૦૦	૧૫૫ + ૧૫ = ૧૮૦

૩. વિષયવસ્તુ આધારિત ગુણ ભારાંક

મોડિયુલ્સ	ગુણ
૧. વાણિજ્યનો પરિચય	૧૨
૨. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો	૧૫
૩. સેવાના ક્ષેત્રો	૨૫
૪. ખરીદ, વેચાણ અને વિતરણ	૨૦
૫. ગ્રાહક જાગ તિ	૧૬
૬. વાણિજ્યમાં કારકીર્દી ની તકો	૧૨
૭. પ્રોજેક્ટ વક	૦૦

નમૂનાનું પ્રશ્ન પત્ર

વાણિજ્ય અદ્યયન

(માધ્યમિક અભ્યાસક્રમ)

સમય: ૩ કલાક

ગુણ: ૧૦૦

બધા પ્રશ્નોના જવાબ આપો.

૧. નીચેનામાંનું કયું લક્ષણ હિન્હ અવિભક્ત કુટુંબની પેઢી (HUF) માં જોવા મળતું નથી? (૧)
- અ. જન્મજાત સભ્યપદ
ક. મૃત્યુની કોઈ અસર નહીં.
૨. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા અભ્યની સંખ્યા. (૧)
- અ. ૧૦
ક. ૫૦
૩. ગ્રાહક સહકારી મંડળીની સ્થાપનાનો હેતુ. (૧)
- અ. સભ્યોને ઘર આપવા
ક. ગ્રાહકના હિતનું રક્ષણ કરવા
૪. નીચેનાનું કયું કાર્ય વખારનું નથી? (૧)
- અ. માલ સામાનનો સંગ્રહ
ક. જાહેરાત
૫. કઈ બેન્ક વિશિષ્ટ બેન્કનું ઉદાહરણ છે? (૧)
- અ. રાજ્યની સહકારી બેન્કો
ક. વિકાસકૃત બેન્ક
૬. સંભવિત ખરીદનારે વેચનાર પાસેથી માલની વિગતો જાણવા કયા પ્રકારનો પત્ર લખશે. (૧)
- અ. ભાવપત્રકનો પત્ર
ક. વરદી – ઓર્ડરના પત્ર
૭. વેચાણની કઈ પદ્ધતિમાં હપ્તાથી ચુકવણી કરવામાં આવે છે? (૧)
- અ. ટેન્ડરથી કરેલ વેચાણ
ક. હરાજી પદ્ધતિમાં
૮. ગ્રાહક સુરક્ષાના કયા અધિકાર અન્વયે ગ્રાહક નુકશાન પામેલ વસ્તુના બદલામાં નવી વસ્તુ કેપૈસા પાઇએ મેળવી શકે? (૧)
- અ. સુરક્ષાનો અધિકાર
ક. પસંદગીનો હેતુ
૯. જીવા નિવારણનો હેતુ (૧)
- અ. જીવા નિવારણનો હેતુ
ક. પ્રત્યુત્તરનો હક્ક

૯. કારકીર્દીના આયોજનમાં સમાવેશ થાય છે. (૧)
 અ. પોતાનો ધંધો શરૂ કરવો.
 બ. કારકીર્દીની હકારાત્મક અને નહુનાત્મક પાસાઓ વિચારવા.
 ક. નોકરીમાં જોડાવવું
 ઢ. કારકીર્દી સાથે અનુકૂલન સાધવું
૧૦. ધંધાકીય એકમ અને સાહસની પસંદગી કરતા પહેલા ખાસ ખ્યાલ રાખવો જોઈએ. (૧)
 અ. નફ્ફાકારતા બ. જોખમો
 ક. નફ્ફો ઢ. ઉપરના બધા જ.
૧૧. શા માટે ધંધાએ સામાજિક જવાબદારી અદા કરવી જોઈએ? કોઈ પણ ત્રણ કારણો આપો. (૩)
 ૧૨. વ્યવસાયના કોઈ પણ ત્રણ લક્ષણો જણાવો. (૩)
 ૧૩. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપ. ભાગીદારી પેઠીના લક્ષણો જણાવો. (૩)
 ૧૪. નીચેની ખરીદીની પદ્ધતિઓ સમજાવો.
 અ. નિરીક્ષણ દ્વારા ખરીદી. બ. નમુનાને આધારે ખરીદી.
૧૫. “ટપાલ સેવા પત્ર વ્યવહારની, નાણાંકીય અને વિમાની સેવાઓ આપે છે. આ સેવાઓ ઉપરાંત પણ કેટલીક વધારાની સેવાઓ પૂરી પાડે છે.” આ વિધાન બીજી ત્રણ સેવાઓ જણાવી ટુંકમાં સમજાવો. (૩)
૧૬. સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે શું? તેના ત્રણ લક્ષણો જણાવો. (૪)
 ૧૭. નીચેના વિમાના સિદ્ધાંતો સમજાવો.
 અ. વિમા યોગ્ય હિત બ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત
૧૮. ખાતાવાળી દુકાનના બે લાભ અને એ ગેરલાભ જણાવો. (૪)
 ૧૯. ગ્રાહકો વેપારીઓ દ્વારા જુદી જુદી રીતે છેતરાય છે. કોઈ પણ ચાર રીત કે જેમાં ગેરવ્યાજભી રીતે છેતરપીડીનો ગ્રાહક ભોગ બને છે. (૪)
૨૦. સ્વ-રોજગારી અને વેતનયુક્ત રોજગારી (નોકરી) વચ્ચે કયો તફાવત છે? તફાવતના કોઈ પણ ચાર મુદ્દા આપો. (૪)
૨૧. રાષ્ટ્રના અર્થતંત્રની ગતિશિલતામાં બેન્કનો ફાળો સમજાવો. (૪)
 ૨૨. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી ટુંકમાં સમજાવી હોઈ પણ ત્રણ લક્ષણો જણાવો. (૪)
 ૨૩. ધંધાકીય પ્રક્રિયા આઉટ સોર્ટિંગ (BPO) સમજાવી તેના ત્રણ લાભ જણાવો. (૪)
 ૨૪. જથ્થાબંધ વેપારીના કોઈ પણ પાંચ કાર્યો જણાવો. (૪)
 ૨૫. આપણા દેશમાં ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક ઝડપ નિવારણ અદાલતિય અધિકારક્ષેત્ર સમજાવો. (૪)
૨૬. શું માત્ર નફાખોરી જ ધંધાનો એક માત્ર ઉદ્દેશ છે? સમજાવો. (૬)
 ૨૭. “આખરે માહિતી સંચાર એ માનવીય પ્રકૃતિ છે, આથી વ્યવહારમાં કયારેક તેનાથી અસંતોષ – ગેરસમજ ઉદ્ભવે છે” આ વિધાનની યથા તત્ત્વ માહિતી સંચારના અવરોધો સાથે ચચા કરો. (૬)

૨૮. “જાહેરાતોના માધ્યોમોની પરસંદગી ઉત્પાદન અને જાહેરાતોના સ્વરૂપ સાથે સંબંધ કર્તા હોવી જોઈએ” વિધાન સમજાવો. (૫)
૨૯. હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે – આ વિધાન ગ્રાહકની વિવિધ જવાબદારીઓના સંદર્ભમાં સમજાવો. (૫)
૩૦. ઔદ્ઘોગિક નવસાહસિક (પ્રવર્તક) – ધંધાના સ્થાપક એટલે શું? સફળ સ્થાપક (ઉદ્ઘોગપતિ)માં રહેલ સારા ગુણો વર્ણવો. (૫)

ગુણ પ્રદાન યોજના
વાણિજ્ય અધ્યયન
(માધ્યમિક અભ્યાસક્રમ)

પ્રશ્ન નંબર	સાચા વિકલ્પ	ગુણ
૧.	૩.	(૧)
૨.	૬.	(૧)
૩.	૫.	(૧)
૪.	૫.	(૧)
૫.	૬.	(૧)
૬.	૫.	(૧)
૭.	૬.	(૧)
૮.	૬.	(૧)
૯.	૬.	(૧)
૧૦.	૩.	(૧)

૧૧. ધંધાએ સામાજિક જવાબદારી ચોક્કસ અદા કરવી જોઈએ.
૧. જાહેર પ્રતિબિંબ (સમાજનું અવિભાજ્ય અંગ)
 ૨. સરકારી નિયંત્રણો
 ૩. સિથરતા અને વિકાસ
 ૪. કારદારોમાં સંતોષ
 ૫. ગ્રાહકની જાગૃતતા
- (૧ x ૩ = ૩)
૧૨. વ્યવસાયના લક્ષણો. (ગમે તે ત્રણ ટુંકમાં સમજાવો)
૧. એ ઓકુ વ્યવસાય છે.
 ૨. વિશિષ્ટ જ્ઞાન અને ઘનિષ્ટ તાલિમની જરૂરિયાત
 ૩. પ્રાથમિક હેતુ સેવા પૂરી પાડવાનો છે.
 ૪. વ્યવસાયિક સંગઠનો દ્વારા આચાર સંહિતા.
- (૧ x ૩ = ૩)

૧૩. ભાગીદારી પેઢીના લક્ષણો. (ગમે તે ત્રણ ટુંકમાં સમજાવો.)

૧. બે કે તેથી વધારે સભ્ય.
૨. કરારજન્ય સંબંધ.
૩. ધારાકિય નિયંત્રણ.
૪. નફાની વહેચણી.
૫. અમર્યાદિત જવાબદારી
૬. સૈદ્ધાંતિક પ્રતિનિધિત્વ.

$$(1 \times 3 = 3)$$

૧૪. જાત નિરીક્ષણ દ્વારા ખરીદી:- જ્યારે તમે કોઈ શર્ટ, પેન, કે શાકભાજી ખરીદવા જાવ છો ત્યારે તમે શું કરો છો? ત્યારે તમે તે શર્ટ કે પેન કે શાકભાજી ખરીદવા જાતે જ નજીકની દુકાનમાં જઈને જાત તપાસ કરીને ખરીદો છો. સૌથી વધુ વ્યવહારમાં મુકાતી તપાસ કરીને ખરીદો”ની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ખરીદનાર જાતે વેચનારના સ્થળે જાય છે અને જાત નિરીક્ષણ કર્યા બાદ જ ખરીદવાનો નિર્ણય લે છે. છૂટક ખરીદીમાં આ જ પદ્ધતિનો મહદ્દુમંશો ઉપયોગ થાય છે.

નમૂનાને આધારે ખરીદી:- જ્યારે તમે કોઈ વસ્તુ મોટા જથ્થામાં ખરીદવા ઈચ્છા હોય ત્યારે પ્રત્યેક એકમોની જાત તપાસ કરવી મુશ્કેલ છે. ત્યારે તમે તેના કેટલાક નમૂના કે જાતની તપાસ કરી ખરીદવાનો નિર્ણય લો છો. સેમ્પલ એ ખરીદવાના માલનો એક નમૂનો છે, ચોક્કસ કાચા માલનો નમૂનો કે ખાદ્ય સામગ્રીનો નમૂનો. જે જથ્થાબંધ માલનું પ્રતિબિંબ છે. આ નમૂનાની ગુણવત્તા સમગ્ર માલની ગુણવત્તા દર્શાવે છે. આ જ રીતે કોઈ જાત કે ભાગતો નમૂનો જે સમગ્ર વસ્તુની છાપ કે જાત બતાવે છે. દા. ત. કાપડનો ટુકડો, તારની સાદરીઓ વગેરે. જે શેડ, ટેક્સરનો નમૂનો છે. કયારેક નમૂનાના કોડ વર્ડ (સાંકેતિક ભાષા) પણ આપેલ હોય છે. આ સાંકેતિક ભાષાનો ઉપયોગ જથ્થાબંધ ખરીદી વખતે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બન્ને પક્ષકારો સંમત થાય છે કે ખરીદનાર બતાવેલ નમૂના કે જાત પ્રમાણેનો માલ ખરીદશે. અને વેચનાર બતાવેલ નમૂના કે જાત પ્રમાણેનો માલ વેચશે.

$$(1 \frac{1}{2} \times 2 = 3)$$

૧૫. ટપાલ વ્યવહારની સેવાઓ (ટુંકમાં સમજૂતી સાથે)

૧. વીમાની સેવા
૨. અન્ય સેવાઓ.

$$(1 \frac{1}{2} \times 2 = 3)$$

૧૬. કંપની એ કાયદા સર્જિત કૃત્રિમ વ્યક્તિત્વ છે. જેને કાયદાથી અલગ વ્યક્તિત્વ મળેલ છે. જેનો ચોક્કસ હેતુ અને સામાન્ય મહોર હોય છે. જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણો (ગમે તે ત્રણ ટુંકમાં સમજાવો)

૧. કૃત્રિમ કાયદાકિય વ્યક્તિત્વ.
૨. કાયદાકિય અલગ વ્યક્તિત્વ.
૩. ચોક્કસ હેતુ
૪. મર્યાદિત જવાબદારી
૫. સામાન્ય મહોર

$$(1 + 3 = 4)$$

૧૭.

- અ. વીમાયોગ્ય હિતઃ— વસ્તુમાં રહેલ નાણાંકિય કે સામાજિક હિતને વીમાયોગ્ય હિત કહે છે.
 બ. નુકશાન વળતરનો સિદ્ધાંતઃ— વીમાની સેવા એ નફો કમાવી આપવાનું માધ્યમ નથી. પરંતુ ખરેખર જે વીમા વસ્તુને નુકશાન થાય છે તે નુકશાન ભરપાઈ કરી આપવાનું જ કાર્ય કરે છે.

$$(2 + 2 = 4)$$

૧૮. વૈવિધ્ય સભર દુકાનના લાભઃ—

૧. સસરળ ઓળખ
૨. મધ્યથિઓમાંથી મુક્તિ
૩. ખોટા પાયા પર કરકસર
૪. નીચી વેચાણ કિંમત

વૈવિધ્ય સભર દુકાનોની મર્યાદાઓઃ—

૧. મર્યાદિત પસંદગી.
૨. શાખનો અભાવ.
૩. ભાવતાલ કરવાનો અભાવ.
૪. પ્રોત્સાહનનો અભાવ.

$$(1 \times 4 = 4)$$

૧૯. ગેરવ્યાજબી રીતો ગ્રાહકને છેતરવાની ટુંકમાં સમજાવવી.

- ૧.
૨. બગડેલી — નીચી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ.
૩. ખોટા માપ અને વજનનો ઉપયોગ.
૪. ડુલ્ફીકેટ (નકલી) માલનું વેચાણ.
૫. જાહેરાતોનો ઓટો દુષ્પ્રચાર (ભરમાવો).
૬. વેચાણમાં મતભેદ.
૭. ગેરમાર્ગ દોરનારી જાહેરાતો.

$$(1 \times 4 = 4)$$

૨૦ વેતનયુક્ત રોજગારી અને સ્વરોજગારી વચ્ચેનો તફાવતઃ—

અનુ.નં.	તફાવતના મુદ્દાઓ	સ્વ-રોજગારી	વેતનયુક્ત રોજગારી
૧.	સ્વરૂપ	પોતાની માલિકિની જ આર્થિક પ્રવૃત્તિમાં સંક્રિય.	કરાર અનુસાર માલિકની પ્રવૃત્તિમાં સંક્રિય.
૨.	દરજાઓ	આ પદ્ધતિમાં માલિક એ જ નોકરી રાખનાર અને નોકરી કરનાર હોય શકે છે.	આ પદ્ધતિમાં નોકર અને માલિકનો દરજાઓ બને છે.

૩.	આવક – વળતર	આવક નિશ્ચિત છે જે માલિકથી કૂનોહ ને આભારી છે.	આવક નિશ્ચિત છે અને જો માલિક ઈચ્છે તો વધી શકે છે.
૪.	જોખમો	હંમેશ જોખમ રહેલ છે અને આવક ઘટવાની શક્યતા છે.	જોખમ નહિવત છે. જો નોકર કામ ચાલુ રાખે તો આવક નિશ્ચિત છે.

$$(1 \times 4 = 4)$$

૨૧. રાષ્ટ્રીય અર્થતંત્રમાં બેન્કનો ફાળો (ગમે તે પાંચ મુદ્દા)

- લોકોનામાં બચતનો ગુણવર્મ વિકસાવી બચતો સ્વીકારી ઉધોગો માટે વિશાળ ભંડોળ એકનીત કરે છે.
- જે થાપણદારો પાસે જરૂરિયાત કરતા વધુ થાપણો હોય તેમની પાસેથી થાપણો સ્વીકારી જરૂરિયાણ મંદોને વિરાણ કરી મધ્યસ્થિતનું કાર્ય કરે છે.
- વાણિજ્ય વ્યવહારના ખર્ચ અને આવકની લેવડ – દેવડ માટે વિશાળ પાયા પર ચેકનો ઉપયોગ કરી ચલણી નાણાંની હેરફર ટાળે છે.
- ધંધારીઓને ટુંકા અને લાંબા ગાળાની નાણાંકીય જરૂરિયાતો સંતોષવા લોન – વિરાણ આપે છે.
- આયાત – નિકારના ક્ષેત્રે આર્થિક વ્યવહારો કરવા.
- રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે ખેડૂતોને વિરાણ, નાના કદના એકમો કે સ્વ-રોજગાર કરતા એકમોને વિરાણ આપી મોટા પાયા પરના ઔદ્યોગિક ગૃહોની નાણાંકીય જરૂરિયાતો સંતોષી અર્થતંત્રને સમતલ રાખે છે.
- રાષ્ટ્રના નાગરિકોનું જીવન – ધોરણ સુધારવા ભૌતિક સુખ સગવડના સાધનો ખરીદવા, મકાન ખરીદવા તેમજ વાહન વ્યવહારના સાધનો ખરીદવા લોન – વિરાણ આપી મદદ કરે છે.

$$(1 \times 5 = 5)$$

૨૨. કોર્પોરેટ ધંધાકીય જગતમાં વ્યવસાયિક નિષ્ણાંત અને નવસાહસિકને પ્રોત્સાહન આપવા, કાર્યમાં ગતિશીલતા લાવવા, મેનેજરની કાર્યદક્ષતા વધારવા સભ્યને મર્યાદિત જવાબદારીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પેઢીમાં આંતરિક માળખામાં વ્યવસ્થા કરી સભ્યની ટેંબુ ચુકવવાની જવાબદારી સ્થિરિત હોય તેવા ભાગીદારને મર્યાદિત જવાબદારીવાળા ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે.

મર્યાદિત જવાબદારીવાળા ભાગીદારના કાયદા ૨૦૦૮ મુજબ આવા ભાગીદારના સૂચિત લક્ષણો:-

- મર્યાદિત જવાબદારીવાળો ભાગીદાર પેઢી સાથે જોડાયેલ છે પરંતુ પેઢીના ભાગીદારોની જવાબદારી થી મુક્ત છે.
- મર્યાદિત જવાબદારીવાળા ભાગીદારની સત્તા અને જવાબદારી નિશ્ચિત છે. અને આવા ભાગીદારની સક્રિયતા – સંચાલન કરાર આધારિત છે.
- મર્યાદિત જવાબદારીવાળા ભાગીદાર સાથે ઓછામાં ઓછા બે ભાગીદાર હોવા જોઈએ. અને આ બન્ને વ્યક્તિગત રીતે એક જવાબદારીવાળો ભાગીદાર અને એક ભારતિય નાગરિક હોવો જોઈએ.

$$(2 + 3 = 5)$$

૨૩. ધંધાકીય એકમના અમુક કાર્ય જે એકમની અંદર જ કરવાને બદલે જયારે બહારના બીજા પક્ષકારને આ કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવે ત્યારે તેને ધંધાકીય પ્રક્રિયાનું આઉટ સોર્સિંગ – Business Process Outsourcing (BPO) કહે છે.

BPO ના લાભ:-

- પડતર અંકુશ લાવવા.
- મુખ્ય ચાવીરૂપ કાર્યમાં ધ્યાન રાખવા.
- બહારના નિષ્ણાંતોનો લાભ લેવા.
- ગ્રાહકોની સતત બદલાતી જતી માંગ સંતોષવા.
- આવાક વૃદ્ધિ કરવા. (૨ + ૩ = ૫)

૨૪. જથ્થાબંધ વેપારના કાર્યો. (ગમે તે પાંચ ટુંકમાં સમજાવો)

- માલનું એકત્રીકરણ.
- માલનો સંગ્રહ.
- વિરાશ - નાણાંકિય સુવિધા.
- જોખમો ઉદાવવા.
- પ્રમાણીકરણ કરવું.
- કિમત સ્થિરતા. (૧ x ૫ = ૫)

૨૫. આપણાં દેશમાં ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક અદાલતોના અધિરકાર ક્ષેત્ર - કાર્યક્ષેત્ર નીચે મુજબ છે.

ગ્રાહક સુરક્ષા ધારો ૧૯૮૮ હેઠળ ન્યાય પ્રણાલીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગ્રાહક અદાલતો જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્ર સ્તરે કાર્યરત છે. આ અદાલતો જિલ્લા ફોરમ, રાજ્ય ગ્રાહક જઘડા નિવારણ કમીશન (રાજ્ય કમીશન) અને રાષ્ટ્રીય ગ્રાહક જઘડા નિવારણ કમીશન (રાષ્ટ્રીય કમીશન) તરીકે ઓળખાય છે. ગ્રાહક વ્યક્તિગત રીતે કે ગ્રાહકોના સંગઠન પોતાની ફરિયાદ લેનિતમાં જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે વસ્તુની કિમત અને મળવા પાત્ર વળતરને આધારે નોંધાવી શકે છે.

૨૦ લાખ રૂપિયા સુધીના માલ કે સેવાના મુલ્યની ફરિયાદ ગ્રાહકે જિલ્લા ફોરમમાં કરવાની હોય છે. રાજ્ય કમીશનની સત્તા ૨૦ લાખથી વધુ અને ૧ કરોડથી ઓછા મુલ્યની વસ્તુ કે સેવાની ફરિયાદનું નિવારણ કરવાનું હોય છે. રાજ્ય કમીશનનો એવી ફરિયાદોનું પણ નિરાકરણ કરવાનું છે જે જિલ્લા ફોરમમાં ન્યાયથી ગ્રાહક સંતુષ્ટ ન હોય.

રાષ્ટ્રીય કમીશને ૧ કરોડથી વધુ મુલ્યની ગ્રાહકોની ફરિયાદ ઉપરાંત રાજ્ય સ્તરે ગ્રાહકના ન ઉકેલાયેલી ફરિયાદોનો ન્યાય આપવાનો અધિકાર છે. રાષ્ટ્રીય કમીશનનો ન્યાય મહત્વકાંક્ષી ગ્રાહક ઉચ્ચ અદાલતમાં પડકારી શકે છે.

(૫)

૨૬. મહત્વ નશે કમાવવાનો જ એક માત્ર ઉદેશ ધંધાનો નથી પરંતુ આ સિવાય અનેક ઉદેશો ધંધાના રહેલ છે. જે નીચે પ્રમાણે જણાવેલ છે.

૧. ગ્રાહકોનું સર્જન.
૨. નિયમિત પ્રોત્સાહનો - સંશોધનો.
૩. સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ.
૪. સારી ગુણવત્તાવાળો માલ કે સેવાનું ઉત્પાદન કરી પૂરવઠો પૂરો પાડવો.
૫. કામદારોની આર્થિક પરિસ્થિતી સુધારવી. (૨ x ૩ = ૬)

૨૭. માહિતી સંચારના અવરોધક પરિબળો (કોઈ પણ છ ટુંકમાં સમજાવો.)
૧. માહિતીની અયોગ્ય રજૂઆત.
 ૨. સમજમાં અધુરપ.
 ૩. બેદ્યાન.
 ૪. અધુરી ઘારણાઓ.
 ૫. માહિતીના વિનિમયની ખામી.
 ૬. પરસ્પર અવિશ્વાસ.
 ૭. દરજજો અને હોદ્દો. $(1 \times 5 = 5)$
૨૮. જાહેરાતના માધ્યમો વર્તમાનપત્રો, રેડીઓ, ટેલીવીજન વગેરેમાંથી યોગ્ય માધ્યમની પસંદગી માટે નીચેના દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવા જોઈએ.
૧. ઉત્પાદીત વસ્તુ કે સેવાનું સ્વરૂપ.
 ૨. ગ્રાહકોનું સ્વરૂપ.
 ૩. જાહેરાતની પડતર (ખચ).
 ૪. ઉપલબ્ધ જગ્યા અને સમય. $(1 \frac{1}{2} \times 4 = 6)$
૨૯. ગ્રાહકની જવાબદારીઓ (ટુંકમાં સમજૂતિ સહિત)
૧. સ્વ – આધારિત જવાબદારી (મદદ માટે જાતે પહેલ કરવી).
 ૨. ખરીદીનો પૂરાવો.
 ૩. યોગ્ય દાવો.
 ૪. પ્રમાણિત પેદાશ અને સેવાઓ ખરીદવી. $(1 \frac{1}{2} \times 4 = 6)$
૩૦. પ્રવર્તક (નવસાહસિક) નવા ધંધાની સ્થાપના કરે છે. કે જે ધંધાકીય તકોની શોધ કરી નાણાંકીય અને ધંધાકીય સાધનો મેળવવાના પ્રયત્નને આર્થિક વસ્તુના ઉત્પાદનમાં રૂપાંતર કરે છે.
- સફળ ઉદ્ઘોગપતિ (સાહસિક)ના માં નીચેના ગુણો હોવા જોઈએ.
૧. પ્રોત્સાહીત (ઉત્સાહ).
 ૨. જોખમ ઉઠાવવાની ખાત્રી.
 ૩. અનુભવમાંથી ઘડતર.
 ૪. પ્રેરણા.
 ૫. આત્મવિશ્વાસ.
 ૬. નિર્ણય લેવાની ક્ષમતા $(2 + (1 \times 4) = 6)$